

:: અનુક્રમણિકા ::

ક્રમ	વર્ષ	અંક	વિષય	પે.ન.
૧.	૮	૪૪	ઈતિહાસનાં અજવાળે	૧
૨.	૮	૨	ઈતિહાસનાં અજવાળે (૨)	૨
૩.	૮	૩	ઈતિહાસનાં અજવાળે (૩)	૪
૪.	૮	૪	ઈતિહાસનાં અજવાળે (૪)	૭
૫.	૮	૮	સાધકની મુદ્દેવશમાં માર્ગદર્શન	૮
૬.	૮	૧૨	ધાર્મિક ઉત્સવો-મહોત્સવો અંગે	૧૩
૭.	૮	૧૪	કર્તવ્ય પાલન	૧૪
૮.	૮	૧૫	કર્તવ્ય પાલન (૨)	૧૯
૯.	૮	૧૬	ભર્મનિવારણ	૧૮
૧૦.	૮	૧૭	સ્વાધ્યાય અંગે શોશેનીય સ્થિતિ	૨૧
૧૧.	૮	૧૮	પર્વની મહત્ત્વા ન ભૂલીએ	૨૩
૧૨.	૮	૨૦	પર્વની મહત્ત્વા ન ભૂલીએ (૨)	૨૪
૧૩.	૮	૨૨	જપ અંગે કેટલીક વિચારણા	૨૭
૧૪.	૮	૨૩	જપ અંગે કેટલીક વિચારણા (૨)	૨૮
૧૫.	૮	૨૬	સાર્વિક-'વાત્સલ્યમા' ઉત્સાહ દાખલો	૩૧
૧૬.	૮	૨૭	સમાજની મહાન સેવા	૩૩
૧૭.	૮	૨૮	જિલ્લા શબ્દનું રહસ્ય	૩૪
૧૮.	૮	૩૨	રસત્યાગ	૩૮
૧૯.	૮	૩૪	રસત્યાગ (૨)	૪૦
૨૦.	૮	૩૫	ધાર્મિક શિક્ષણની પરિસ્થિતિ...	૪૨
૨૧.	૮	૩૬	રાષ્ટ્રપતિને આપેલી મહાવીર પ્રભુને અંજલિ	૪૪
૨૨.	૮	૩૭	એક આવકારદાયક યોજના	૪૬
૨૩.	૮	૪૦	યોગસાધના	૪૮
૨૪.	૮	૪૧	શું આ પ્રક્રિયા મહત્વનો નથી ?	૫૦
૨૫.	૮	૪૨	ધર્મપ્રચારનાં આવશ્યક અંગો	૫૨
૨૬.	૮	૪૩	જૈનાક્રિત ચિત્રકલા	૫૪
૨૭.	૮	૪૪,૪૫	સુધરણાની સાચી દિશા	૫૬
૨૮.	૮	૪૬	ઉગરનું હોય તો જૈન સંસ્કૃતિ અપનાવો	૫૮
૨૯.	૧૦	૨	ચોરચુને દૂર કરો !	૬૦
૩૦.	૧૦	૪	તીર્થયાત્રા	૬૨
૩૧.	૧૦	૫	તીર્થયાત્રા (૨)	૬૩
૩૨.	૧૦	૬	સંધપતિ કેવા હોય ?	૬૬
૩૩.	૧૦	૭	સંધપતિ કેવા હોય ? (૨)	૬૭
૩૪.	૧૦	૮	શું આપણા ધાર્મિક હિતો સલામત છે ?	૬૯
૩૫.	૧૦	૯	શું આપણા ધાર્મિક હિતો સલામત છે ? (૨)	૭૧
૩૬.	૧૦	૧૦	શું આપણા ધાર્મિક હિતો સલામત છે ? (૩)	૭૩
૩૭.	૧૦	૧૧	પાઠશાળાના કાર્યવાહકોની જવાબદારી	૭૪
૩૮.	૧૦	૧૨	ચાર્ચિનિર્માણનું પ્રથમ પગથિયું	૭૭
૩૯.	૧૦	૧૩	સદ્ગ્વિચારોનું સેવન	૭૮
૪૦.	૧૦	૧૪	સદ્ગ્વિચારોનું સેવન (૨)	૮૦
૪૧.	૧૦	૧૫	પ્રશસ્ત વાજીયવહાર	૮૩
૪૨.	૧૦	૧૬	પ્રશસ્ત વાજીયવહાર (૨)	૮૪
૪૩.	૧૦	૧૭	આકતો ટાળવનો સાચો ઉપાય	૮૯
૪૪.	૧૦	૧૮	શેડ માણેકલાલ ચુનાલાલનું ભાપણ	૮૮
૪૫.	૧૦	૨૦,૨૧	ભવનિર્દેશ એ ભગવદ્ બહુમાન...	૯૧
૪૬.	૧૦	૨૨	જૈન ધર્મની ભક્તિપ્રધાનતા	૯૪

(G)

ક્રમ	વર્ષ	અંક	વિષય	પે.ન.
૪૭.	૧૦	૨૩	જૈન ધર્મની ભક્તિપ્રધાનતા (૨)	૮૫
૪૮.	૧૦	૨૪	જૈન ધર્મની ભક્તિપ્રધાનતા (૩)	૮૭
૪૯.	૧૦	૨૬	જ્ઞાન ભજાનાનો લાભ થો	૮૮
૫૦.	૧૦	૨૭	જ્ઞાન ભજાનાનો લાભ થો (૩)	૯૦૦
૫૧.	૧૦	૨૮	સર્વ ધર્મ સમભાવ અંગે...	૯૦૨
૫૨.	૧૦	૨૯	સર્વ ધર્મ સમભાવ અંગે... (૨)	૯૦૪
૫૩.	૧૦	૩૦	પ્રાથમિક શિક્ષણની જરૂર	૯૦૮
૫૪.	૧૦	૩૧	માતાપિતાની સેવાભક્તિ	૯૧૧
૫૫.	૧૦	૩૨	કેટલીક મનનીય વિચારણા	૯૧૩
૫૬.	૧૦	૩૩	કેટલીક મનનીય વિચારણા (૨)	૯૧૪
૫૭.	૧૦	૩૪	કેટલીક મનનીય વિચારણા (૩)	૯૧૬
૫૮.	૧૦	૩૬	જૈન ધર્મ સંબંધી માહિતી...	૯૧૮
૫૯.	૧૦	૩૭	જૈન ધર્મ સંબંધી માહિતી... (૨)	૯૨૦
૬૦.	૧૦	૩૮	ભારત ભાદર જૈન ધર્મનો પ્રચાર	૯૨૩
૬૧.	૧૦	૩૯	જૈન ધર્મ સહૃદ પાણી શકે એવો છે	૯૨૪
૬૨.	૧૦	૪૦	જૈન ધર્મ સહૃદ પાણી શકે એવો છે (૨)	૯૨૬
૬૩.	૧૦	૪૧	પાર્શ્વનાથકા ચાતુર્યમિ ધર્મ	૯૨૮
૬૪.	૧૦	૪૨	પાર્શ્વનાથકા ચાતુર્યમિ ધર્મ (૨)	૯૩૦
૬૫.	૧૦	૪૩	પાર્શ્વનાથકા ચાતુર્યમિ ધર્મ (૩)	૯૩૩
૬૬.	૧૦	૪૬,૪૭,૪૮	જૈન તીર્થો અંગે રાજસ્થાનમાં પરિસ્થિતિ	૯૩૪
૬૭.	૧૧	૨	લોકપ્રિયતા	૯૩૭
૬૮.	૧૧	૩	શું શોક-ઉદ્બેગ એ મોટો દુર્ગુણ છે ?	૯૩૮
૬૯.	૧૧	૪	દેવનાર કઠલાખાના અંગે આહેર નાન વિનંતિ	૯૪૧
૭૦.	૧૧	૫	પ્ર.- જીવનમાં ધર્મની શી જરૂર છે ?	૯૪૪
૭૧.	૧૧	૭	બીજાને સારુ મનાવવાના પાપમાં	૯૪૭
૭૨.	૧૧	૮	ધર્મ-ઉત્સાહ કેમ વધે ?	૯૪૮
૭૩.	૧૧	૯	મૃત્યુ સુધ્યારવા શું કરવું ?	૯૪૯
૭૪.	૧૧	૧૦	ભાય : ડાં છાકરો અને નવો છોકરો	૯૪૩
૭૫.	૧૧	૧૧	દેવ-ગૃહ-ધર્મ પર સાચા રાગ માટે	૯૪૪
૭૬.	૧૧	૧૨	ઉત્તમતા અને સમ્યગ્દર્શનમાં એક ઉપાય	૯૪૭
૭૭.	૧૧	૧૩	ધર્મ સાધનાનું એક પ્રેરક તત્ત્વ	૯૬૧
૭૮.	૧૧	૧૪	દુઃખ ન લાગવાની ચાવી	૯૬૩
૭૯.	૧૧	૧૫	મુખ્ય વધતે તાત્ત્વિક વિચારણા	૯૬૫
૮૦.	૧૧	૧૬	મીઠાં સંભારણાં : અમર આનંદ	૯૬૭
૮૧.	૧૧	૧૭	અભાગિયા અને ભાગ્યાણી	૯૬૮
૮૨.	૧૧	૧૮	ધર્મ આવશ્વરા છતાં ધર્મનું જેર કેમ નહિ ?	૯૭૧
૮૩.	૧૧	૧૯	જીવન શું ?	૯૭૪
૮૪.	૧૧	૨૧	ધર્મની અવિચિન્ન પરંપરા...	૯૭૭
૮૫.	૧૧	૨૨	દાઢિ સંશોધન અને અજ્ઞાત સાધનાઓ	૯૮૦
૮૬.	૧૧	૨૩	વાસનાશનું અતિ જરૂરી કર્તવ્ય	૯૮૩
૮૭.	૧૧	૨૪	ઉનાતી માટે એક અતિ આવશ્ક તત્ત્વ	૯૮૬
૮૮.	૧૧	૨૫	ઉનાતી માટે એક અતિ આવશ્ક તત્ત્વ (૨)	૯૮૭
૮૯.	૧૧	૨૬	'હું એ તમે ?' કે 'તમે એ હું ?'	૯૮૦
૯૦.	૧૧	૨૭	સંતાપ ટાળવાની અદ્ભુત ચાવી	૯૮૨
૯૧.	૧૧	૨૮	સમ્યગ્દર્શનનો એક ઉપાય	૯૮૪
૯૨.	૧૧	૨૯	ચિત્રરણની મહામૂરી	૯૮૬
૯૩.	૧૧	૩૦	સાચા સ્નેહી બનો	૯૮૮

(H)

ક્રમ	વર્ષ	અંક	વિષય	પે.ન.
૮૫.	૧૧	૩૧	એક કલ્યાણમિશને પ્રેરણા-પત્ર	૨૦૦
૮૬.	૧૧	૩૨	પાયાથી પરાકાણની સાધનાઓ	૨૦૨
૮૭.	૧૧	૩૩	પાયાથી પરાકાણની સાધનાઓ (૨)	૨૦૪
૮૮.	૧૧	૩૪	ગુણસ્થાનકર્માં ઊંઘે ઊંઘે ચઢવા,	૨૦૬
૮૯.	૧૧	૩૬	સ્વાર્થીની કરુણ દશા	૨૦૮
૧૦૦.	૧૧	૩૭	શક્તિ, સ્હૃતિ અને શાંતિનાં અનુપમ સાધન	૨૧૦
૧૦૧.	૧૧	૩૮	સહશિશશ અને કોવેજની કેળવણી	૨૧૨
૧૦૨.	૧૧	૩૯	ભયત્વનો મફત પાસપોર્ટ	૨૧૬
૧૦૩.	૧૧	૪૦	નવકાર શું છે ?	૨૧૮
૧૦૪.	૧૧	૪૧	ધ્યાન-સમભાવ-કરુણાભાવ ક્યાં ?	૨૨૧
૧૦૫.	૧૧	૪૨	નાથને ભૂલાવનાર લોથ	૨૨૪
૧૦૬.	૧૧	૪૪,૪૫	પર્યુષણા પર્વતાં આપન ઉપશમ	૨૨૭
૧૦૭.	૧૧	૪૩	શિક્ષણ-શિખામણ કેમ અપાય ?	૨૩૦
૧૦૮.	૧૧	૪૬	શિક્ષણ-શિખામણ કેમ અપાય ? (૨)	૨૩૨
૧૦૯.	૧૧	૪૭,૪૮	શિક્ષણ-શિખામણ કેમ અપાય ? (૩)	૨૩૪
૧૧૦.	૧૨	૨	આભાનો પોરાક અને ઔષધ	૨૩૬
૧૧૧.	૧૨	૩	હુન્યવી બાબતોમાં લયલીનતાનો રોગ	૨૪૦
૧૧૨.	૧૨	૪	જેન સંધના ઉદ્યમાં અવરોધક તત્ત્વ	૨૪૨
૧૧૩.	૧૨	૫	જેન સંધના ઉદ્યમાં અવરોધક તત્ત્વ (૨)	૨૪૪
૧૧૪.	૧૨	૬	ચાર શરણાંતાના સ્વીકારનું રહસ્ય	૨૪૬
૧૧૫.	૧૨	૭	ભવિતવ્યતા અને પુરુષાર્થ	૨૪૦
૧૧૬.	૧૨	૮	ભવિતવ્યતા અને પુરુષાર્થ (૨)	૨૪૨
૧૧૭.	૧૨	૯	ભવિતવ્યતા અને પુરુષાર્થ (૩)	૨૪૩
૧૧૮.	૧૨	૧૦	લહાવા ક્યાં તુંટવા ?	૨૪૬
૧૧૯.	૧૨	૧૧	જીવન માટી થતું અટકાવો	૨૪૮
૧૨૦.	૧૨	૧૨	વિવિધ ધર્મો અને ધર્મની તકો	૨૬૨
૧૨૧.	૧૨	૧૩	વિવિધ ધર્મો અને ધર્મની તકો (૨)	૨૬૪
૧૨૨.	૧૨	૧૪	વિવિધ ધર્મો અને ધર્મની તકો (૩)	૨૬૬
૧૨૩.	૧૨	૧૫	શરીર અને આભાના વિચાર	૨૬૮
૧૨૪.	૧૨	૧૬	શરીર અને આભાના વિચાર (૨)	૨૭૧
૧૨૫.	૧૨	૧૭	શરીર અને આભાના વિચાર (૩)	૨૭૩
૧૨૬.	૧૨	૧૮	દુઃખ અને દૂષિતમનનો નાશક સમય	૨૭૬
૧૨૭.	૧૨	૧૯	વીતરાગ મિલનની આડે હિવાલો	૨૭૮
૧૨૮.	૧૨	૨૦	વીતરાગ મિલનની આડે હિવાલો (૨)	૨૮૦
૧૨૯.	૧૨	૨૧	વીતરાગ મિલનની આડે હિવાલો (૩)	૨૮૨
૧૩૦.	૧૨	૨૨	જી જીવનની આંદોથી કેમ બચાય ?	૨૮૪
૧૩૧.	૧૨	૨૩	જી જીવનની આંદોથી કેમ બચાય ? (૨)	૨૮૬
૧૩૨.	૧૨	૨૪	અનિવાર્ય શિક્ષણ વચ્ચે	૨૮૮
૧૩૩.	૧૨	૨૫	સંઘરણ શ્રી રમણભાઈ	૨૮૯
૧૩૪.	૧૨	૨૬	સુખ અને સાચ્ચિકતાની ચાવી	૨૯૪
૧૩૫.	૧૨	૨૮	નફા વિનાનો વેપાર	૨૯૭
૧૩૬.	૧૨	૩૦	સંસ્કૃતિ ક્યાં ?	૩૦૦
૧૩૭.	૧૨	૩૧	કેટલોક હકીકત અને દર્શનમાં ભેદ	૩૦૨
૧૩૮.	૧૨	૩૪	પરમાત્મા સાથે સીધો સંબંધ	૩૦૪
૧૩૯.	૧૨	૩૫	પરમાત્મા સાથે સીધો સંબંધ (૨)	૩૦૬
૧૪૦.	૧૨	૩૬	પદ્ધર્થ જીવાના દાઢિ	૩૦૮
૧૪૧.	૧૨	૩૭	મહાન બનતું છે ?	૩૧૦

(I)

૧ ઈતિહાસનાં અજવાળે

(૧)

અદારમી સદીના અંત ભાગે યુરોપિયન વિદ્વાનોએ ભારતવર્ષનો ઈતિહાસ લખવાની શરૂઆત કરી. તેમની દણિએ બૌદ્ધ, બ્રાહ્મણ અને ઈસ્લામ એ ભારતના મુખ્ય ધર્મો હતા અને તેજ ભારતનો ભૂતકાળ તથા વર્તમાન કાળ રજૂ કરતા હતા, એટલે તેમણે જૈન ધર્મની ખાસ નોંધ લીધી નહિ. આ લોકો એમ માનતા હતા કે ‘ભારતના લોકોને ઈતિહાસની કોઈ ગમ ન હતી, એટલે તેમણે ઐતિહાસિક નોંધો રાખેલી નથી’ તેથી તેમણે ભારતનો ઈતિહાસ લખવાનાં જે સાચાં સાધનો હતાં, તેના તરફ દણિ જ દોડાવી નહિ અને તે માટે પૂર્વકાળના પ્રવાસી વગેરે પરદેશી લેખકોએ જે કંઈ લખ્યું હતું તે પરથી ઈતિહાસની સંકલ્પના કરવા માંડી.

તેમણે આ પ્રકારના જે લેખકો ઉપર આધાર રાખ્યો હતો, તે મુખ્યત્વે નીચે મુજબ હતા, (૧) જૂના ગ્રીક લેખકો કે જે સિસ્કંદર સાથે આ દેશમાં આવ્યા હતા કે અહીંના રાજદ્વારી પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા. જેમ મેગેસ્થનિસ (ઈ.સ. પૂર્વ ૩૦૫), (૨) ચીનના યાત્રીઓ જેવા કે ફા-હી-યાન (ઈ.સ. ૪૦૦), હ્યુ યેન સંગ (ઈ.સ. ૬૨૮ થી ૬૪૫), ઈત્સીંગ (ઈ.સ. ૬૮૫), (૩) આરબ વ્યાપારીઓ કે જે ૮મી થી ૧૫મી સદી સુધી દક્ષિણ ભારત સાથે વ્યાપાર કરતા હતા. (૪) અન્ય પ્રવાસીઓ જેમ કે બેનુની (ઈ.સ. ૧૦૦૦), માર્કો પોલો (ઈ.સ. ૧૨૮૮ થી ૧૨૯૨), ઈન બટુટા (ઈ.સ. ૧૩૨૫), (૫) સત્તરમી સદી અને તે પછીના યુરોપિયન પ્રવાસીઓ જેવા કે ટેરી, બર્નિયર, ટ્રાવેર્નિયર, મનુક્કી, પિટર મનદે વિગેરે.

આમાંથી ગ્રીક લેખકોનાં લખાણો મોટા ભાગે નાશ પામ્યાં હતાં અને તેના છુટા છવાયા ટુકડાઓ જ ઉપયોગમાં લેવાયા હતા. ચીની યાત્રીઓ મુખ્યત્વે બૌદ્ધ હતા અને તેમનો મુખ્ય રસ બૌદ્ધ ધર્મને લગતી નોંધો લેવાનો હતો. મુસલમાન લેખકોનું પણ એમ જ હતું. યુરોપિયન મુસાફરો આ દેશના લોકોના વિશેષ સંપર્કમાં આવ્યા ન હતા, તેમને અહીંની ભાષાનું પણ વિશેષ જ્ઞાન ન હતું, એટલે તેમણે ઉપરછલ્લી તપાસમાં જે કાંઈ જાણ્યું તે લખ્યું અને તેમાં અનેક છબરડા વાયા. પરંતુ રાજ્યકર્તાઓના આશ્રયને લીધે આ હેવાલો ગ્રામાણિક મનાયા અને ભારતનું સાચું દર્શન એમાં જ થતું હતું, એવો પ્રચાર જ્ઞાનબંધ ચાલ્યો.

આ સંયોગોમાં કોઈક એમ લખ્યું કે ‘જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની જ એક શાખા છે;’ તો કોઈએ લખ્યું કે ‘તે છિંદુ ધર્મનો એક ભાગ છે.’ કોઈક તો શ્રી મહાવીર સ્વામીના માતાપિતાનાં નામમાં પણ ગોટાળો કર્યો; તો કોઈએ શ્રી મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય શ્રી ગૌતમભુદ્ધ ઠરાવી તેમના શિષ્ય તરીકે પણ જાહેર કર્યા.

એ સમય જ એવો હતો કે ભારતના વિદ્વાનોની વાતને મહત્વ આપવામાં આવતું ન હતું અને યુરોપિયન વિદ્વાનોને મહત્વ આપવામાં આવતું હતું, પછી તેના લખાણો ગમે તેવાં હોય.

આ લેખકોએ જૈન ધર્મ વિષે જે જાતજાતની બાંતિ ફેલાવી હતી, તેનું નિવારણ સહૃથી પહેલાં જર્મનીના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. હર્મન યાકોબીએ કર્યું. તેમણે સપ્રમાણા ચર્ચા કરીને એ વાત સિદ્ધ કરી આપી કે જૈન ધર્મ એ છિંદુ ધર્મ કે બૌદ્ધધર્મની શાખા નથી પણ એક સ્વતંત્ર ધર્મ છે, અને તે બૌદ્ધ ધર્મ કરતાં પણ વધારે જૂનો છે. ‘ધી સેકેડ બુક ઓફ ધી ઈસ્ટ’ નામની ગ્રંથમાણમાં તેમણે જૈન સૂત્રોના ભાખાંતર પ્રકટ કરતી વખતે વિશેષ પ્રસ્તાવના લખી તેમાં એ પણ સિદ્ધ કર્યું કે ‘પાર્શ્વનાથ એક ઐતિહાસિક પુરુષ હતા.’

આજે તો અનેક વિદ્વાનોએ આ વાત માન્ય રાખી છે અને કેમ્બ્રિજ હિસ્ટરી ઓફ ઇન્ડિયા (પૃ. ૧૫૩), હામ્સવર્થ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડ (વો. બીજું પૃ. ૧૧૮૮), તથા એન્સાઈક્લોપીડિયા ઓફ રીલિજિયન એન્ડ ઓથક્સ (વો. ૭) વગેરે પ્રમાણભૂત ગણાતા ગ્રંથોમાં પણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની એક ઐતિહાસિક પુરુષ તરીકે નોંધ લેવામાં આવી છે. પરંતુ દિલગીરીની વાત એટલી જ છે કે હજુ આપણા દેશમાં ચાલતાં ઈતિહાસના પુસ્તકોમાં આ વસ્તુની નોંધ લેવામાં આવી નથી.

હવે તો શ્રી અરિષ્ટનેમિ ભગવાનને પણ ઐતિહાસિક માન્યતા મળી ચૂકી છે, તેના પ્રમાણો વગેરે આગામી લેખમાં જોઈશું.

૨ ઈતિહાસનાં અજવાળે

(૨)

શ્રી અરિષ્ટનેમિ ભગવાનની ઐતિહાસિકતા

ડૉ. રાધાકૃષ્ણાન્ન ઇન્ડિયન ફિલોસોફી વોલ્યુમ ૧ લાના પૃ. ૨૮૭ પર લખે છે કે ‘These is no doubt that Jainism prevailed even before

Vardharmam or Parswanath, The Yajurved mentions the names of Three Tirthankars Risabha, Ajitnath and Aristnemi. The Bhagwat Puran endorses the view that Risabha was the founder of Jainism.' વર્ધમાન તથા પાર્શ્વનાથની પહેલાં જૈન ધર્મ પ્રચાલિત હતો એ બાબતમાં કોઈ શંકા નથી. યજુર્વેદમાં ઋષભ, અજિતનાથ તથા અરિષ્ટનેમિ એ ત્રણ તીર્થકરોનાં નામનો નિર્દેશ મળે છે. ઋષભ જૈનધર્મના સંસ્થાપક હતા એ મતને ભાગવત પુરાણ સંમતિ આપે છે.

સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. નાગેન્દ્રનાથ બસુ હરિવંશ પુરાણની અંગ્રેજી પ્રસ્તાવનામાં લખે છે કે શ્રી પાર્શ્વનાથની પહેલા થઈ ગયેલા જૈનોના બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ શ્રી કૃષ્ણના ભત્રીજા હતા. આપણે જો શ્રી કૃષ્ણને ઐતિહાસિક માનીએ તો શ્રી નેમિનાથ પ્રભુને તેમના સમકાળીન એક ખરા અને ઐતિહાસિક પુરુષ ન માનવાનું કોઈ કારણ નથી.

ડૉ. કુહરરે એપીગ્રાફિકા ઈટિકાના પ્રથમ ભાગમાં પૃ. ૩૮૮ અને બીજા ભાગમાં પૃ.૨૦૬-૭ માં જણાયું છે કે, જૈનોના બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુને હવે ઐતિહાસિક વ્યક્તિ માનવામાં આવે છે.

પ્રો. એલ.ડી. બાર્નેટ એન્સીયન્ટ મીડિયિન ક્ષત્રિય કાઉન્સિન પહેલા વોલ્યુમની પ્રસ્તાવનામાં આવો જ અભિઆય દર્શાવ્યો છે.

મી.કાર્વા ભગવદ્ ગીતાના પરિશિષ્ટમાં જણાવે છે કે “નેમિનાથ શ્રી કૃષ્ણના ભત્રીજા હતા, જ્યારે બાવીશમાં તીર્થકર શ્રીકૃષ્ણના ભત્રીજા હતા, ત્યારે આગળના ૨૧ તીર્થકરો કેટલા પુરાણા હશે તેની પાછકો કલ્પના કરી લે.”

અહીં કોઈને એમ લાગે કે આતો એક પ્રકારના તર્ક છે. તેમાં ઐતિહાસિક પ્રમાણ શું ? તો એ પ્રમાણ પણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. કાશી-હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. પ્રાણનાથ વિદ્યાલંકાર એક જાણીતા શોધક છે. તેમને સૌરાષ્ટ્રમાંથી એક તાત્ત્વિક મળી આવ્યું છે કે જે બાબિનોનિયન રાજા નેબુજ્ઘનાર (ઇ.સ. પૂર્વ ૧૧૪૦)ના સમયનું છે, અને રોમન લિપિમાં લખાયેલું છે. તેમણે આ તાત્ત્વિક એવી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના તા. ૧૮મી માર્ચ ૧૮૮૫ના અંકમાં એક લેખ લખતાં જણાયું હતું કે તાત્ત્વિકમાં નીચે પ્રમાણે લખાણ છે; ઉક્ત રાજા નેબુજ્ઘનાર કે જે સુ (સુમેર) જ્યારોનો છે અને જે રેવાનગર (કાણ્યાવાડ)નો રાજા છે, તે યદુરાજનાં સ્થાને (દ્વારકા) આવ્યો. તેણે મંદિર બંધાવ્યું છે, તેમાં પૂજા કરી છે અને રૈવતગિરિના શાશ્વત અધિકાર્યક નેમિ પ્રભુના અંગે આ સાલિયાશું ચાલુ કરેલ છે.

ડૉ. પ્રાણનાથ કહે છે કે ‘આ લેખ ઐતિહાસિક દસ્તિએ અતિ મહત્વનો છે

અને તેમાં નેમિપ્રભુનું નામ આવે છે, એટલે તે જૈન ધર્મની અતિ પ્રાચીનતા સાબિત કરે છે.’

શ્રીનેમિનાથ પ્રભુનાં ત્રણ કલ્યાણકો રૈવતગિરિ પર થયાં, તેથી રૈવતગિરિને આપણે શ્રી નેમિનાથ પ્રભુનું ખાસ તીર્થ માન્યું છે, અને આજ પર્યત તેની યાત્રામાં જીવનની કૂતૃકૃત્યતા લેખી છે. ઉપર્યુક્ત તાત્ત્વિક આપણી આ માન્યતાને યથાર્થ પુરવાર કરી છે.

ઋગ્વેદ તથા યજુર્વેદમાં નીચેનો મંત્ર આવે છે;

સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા: સ્વસ્તિ નસ્તીક્ષ્યો અરિષ્ટનેમિ: સ્વસ્તિ નો બૃહસ્પતિર્દ્ધાતુ ॥

અહીં અરિષ્ટનેમિનો જે ઉલ્લેખ છે તે જૈનોના બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથનો છે એવો અભિપ્રાય સ્વામિ વિરુદ્ધાક્ષ વરિયાર એમ.એ. વેદાંતરત્ન તથા બીજા પણ વિદ્વાનો ધરાવે છે.

હિંદુ પુરાણો, રામાયણ, મહાભારત, વેદ વગેરેનો અભ્યાસ કરતાં અન્ય તીર્થકરોની પ્રાચીનતાનાં પ્રમાણો પણ મળી આવે છે, તે હવે પછી જોઈશું.

U

પ્રસન્નતાની ચાવી

V

એકવાર એક મુનિએ પ્રશ્ન પૂછ્યો : “ગુરુદેવ ! સદા પ્રસન્ન રહેવાની ચાવી શું ?”

ગુરુદેવ કહ્યું : “જવાબ સાવ સહેલો છે. તમારી પ્રસન્નતાની ચાવી તમારી પાસે જ છે. પ્રસન્ન રહેવા માટે તમારે ૨૪ કલાકના દિવસમાં તમારી સમક્ષ રાજું કલાકનું કામ રાખવું. અથીતૂ તમારે તમારી જાતને સતત સત્કાર્યોમાં ચોજુ રાખવી. નવરું મન એ શેતાનનું કારખાનું છે. મનને જ્ઞાનાદિ અનેકાનેક સત્કાર્યોમાં જોડાયેલું રાખીએ એટલે એનો અંટશાંટ વિચારો કરવાનું મળે જ નહિં. મન સદા પ્રસન્ન જ રહે. મનની પ્રસન્નતા જેવું સુખ બીજું શું હોઈ શકે ? એમની આ વાત ‘પરોપદેશો પાંડિત્યમ્’ જેવી નહિં પણ સ્વર્ય જીવનમાં આચરણ પામેલી હતી. કાણો-કાણનો સદુપયોગ કરી લેવાની એમની કાળજી ખરેખર નોંધપાત્ર હતી.

W

—“ભુવનભાનુ એક સોનેરો પાનુ” પુસ્તકમાંથી સાભાર

X

૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૂત (ભાગ-૨)

③ ઐતિહાસનાં અજવાળો

(૩)

પ્રથમ કેટલાક એમ માનતા હતા કે ૨૪ તીર્થકરોની વાત પૌરાણિક છે, અર્થાત્ એ નામો કલ્પિત છે, માત્ર તેમાંનું છેલ્લું નામ શ્રી વર્ધમાન-મહાવીર જ ઐતિહાસિક છે. પરંતુ ઐતિહાસિક શોધખોળ આગળ વધી ને એ ભ્રમ ભાંગ્યો. બૌદ્ધ જાતકોમાં અનેક સ્થળે શ્રી પાર્શ્વનાથ અને તેમણે પ્રવતર્વિલા ચાતુર્યામ ધર્મનો ઉલ્લેખ મળવા લાગ્યો, એટલે શ્રી પાર્શ્વનાથ ખરેખર ઐતિહાસિક પુરુષ સિદ્ધ થયા. ત્યારપણી સૌરાષ્ટ્રના તાંત્રિક વગેરેથી શ્રી અરિષ્ઠનેમિ ભગવાનને ઐતિહાસિક પુરુષની માન્યતા મળી. આમ ચોવીસમાંના છેલ્લા ગ્રંથ ઐતિહાસિક સિદ્ધ થયા, એટલે વિદ્વાનોને લાગવા માંડયું છે કે કદાચ આગળના તીર્થકરો પણ ઐતિહાસિક હોય.

જે વિદ્વાનો તટસ્થભાવે અને પ્રામાણિકપણે ઐતિહાસિક શોધખોળો કરે છે તે પરંપરાગત ચાલી આવતી કોઈ વાતને એકદમ ખોટી કહી ધૂતકારી કાઢતા નથી. અનુભવે તેમને શીખવ્યું છે કે તેમાં ઘણું તથ્ય હોય છે, તેથી તેનો સંભાળપૂર્વક અભ્યાસ કરવો. આ રીતે ૨૪ તીર્થકરોની માન્યતા પરંપરાગત ચાલી આવે છે અને તેમાંના ગ્રંથ તીર્થકરો ક્રમશાસન: ઐતિહાસિક સિદ્ધ થયા છે, એટલે બીજા પણ અવશ્ય થયેલા હોવા જોઈએ, એમ માનવું જ વધારે ડાપણભરેલું છે.

મહાભારતની ઘટનાને વિદ્વાનોએ ઐતિહાસિક માની છે, પણ તેનો કાલનિર્ણય ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. ઈ.સ. પૂર્વે ૮૫૦ થી માંડી ઈ.સ. પૂર્વે ૩૧૦૨ સુધીનો સમય તે માટે દર્શાવવામાં આવે છે. એટલે શ્રી પાર્શ્વનાથનો સમય જેમ ઈ.સ. પૂર્વે ૮૭૭ થી ૭૭૭ નો નિર્ણિત કરવામાં આવ્યો છે, તેમ શ્રી અરિષ્ઠનેમિનો સમય હજુ સુધી નિર્ણિત કરી શકાયો નથી, પણ સંભવ છે કે મહાભારતનો આખરી સમય નિર્ણય થઈ જતાં શ્રી અરિષ્ઠનેમિનો સમય-નિર્ણય પણ થઈ જશે.

એકવીસમાં તીર્થકર શ્રી નમિનાથ સંબંધમાં ખુદ જૈન શાસ્ત્રોમાં પણ બહુ ઓછી હકીકત મળે છે, આમ છતાં ‘નાથ’ સંપ્રદાયમાં આજે નમિનાથી અને પારસનાથી આવી બે શાખા ચાલે છે અને તેનો વિશેષ પ્રચાર બંગાળમાં છે. આ સંપ્રદાયો મુખ્યત્વે યોગસાધના સાથે વિશેષ સંબંધ ધરાવે છે અને જૈન તીર્થકરો

બધા જ યોગસાધક હતા તથા તેમનાં નામની પાછળ પણ નાથ શબ્દ લગાડવામાં આવે છે, એટલે વિદ્વાનોએ આ બાબતમાં ઊંડા ઊતરીને એ નિર્ણય કરવાનો રહ્યો કે નમિનાથી સંપ્રદાય અને પારસનાથી સંપ્રદાય ખરેખર કર્યારે ચાલ્યા અને કોનાથી ચાલ્યા ?

રામાયણ આજે ભારતમાં ઘણું વંચાય છે, પણ બધા વિદ્વાનો રામને ઐતિહાસિક વ્યક્તિ માનતા નથી. કેટલાક તેમને માત્ર વાલ્ભીક્રિની કલ્પના માત્ર જ લેખે છે, પરંતુ જૈન શાસ્ત્રોએ પણ રામની વાત જ સ્વીકારી છે, એટલે તે ઐતિહાસિક હોવા જોઈએ એ નિશ્ચિત છે; વળી રામાયણનો રચના-કાળ અને વિમલસૂરિ-વિરચિત પત્ર ચરિયં નો રચનાકાળ લગભગ સમાન છે, એટલે તેમણે રામાયણમાંથી આ હકીકતો લીધી નથી, પણ તેમની પાસે પરંપરાગત જે વસ્તુ આવી તેમાંથી લીધેલી છે; તાત્ત્વ કે રામ ઐતિહાસિક હતા, એમ માનવું યુક્તિયુક્ત છે.

રામાયણના બાલકાંડમાં ચૌદમા સર્ગમાં એવો ઉલ્લેખ આવે છે કે દશરથે શ્રમણનો સત્કાર કર્યો, ભૂષણ વગેરે ટીકાકારો તેને જૈન સાધુ હોવાનું માને છે.

જૈન રામાયણમાં ઘણી વસ્તુઓ વાલ્ભીક્રિના રામાયણ કરતાં જુદી પણ પડે છે. તેમાંથી એક વસ્તુ એ કે રાવણ જૈનધર્માની રાજી હતો અને તે જિનેશ્વરની ભક્તિ ઘણા ભાવથી કરતો. એ રીતે તેણે તીર્થકર નામ કર્મ બાંધું હતું. બીજું વાલ્ભીક્રિ રામાયણમાં રાવણને રાક્ષસ તરીકે વર્ણવવામાં આવ્યો છે, પણ જૈન રામાયણમાં તેને વિદ્યામાનવ તરીકે ‘રાક્ષસ’ નામના વંશનો રાજી કહેવામાં આવ્યો છે; અને તે વંશના ઘણા ખરા જૈન ધર્મ પાળતા હતા-એમ કહેવામાં આવેલું છે.

રામનો સમય વીસમાં તીર્થકર શ્રી મુનિસુવત સ્વામીનો ધર્મશાસનકાળ હતો, કે જેમનું સ્મરણ કરવનાનું એક પ્રાચીન તીર્થ આજે ભર્યું વિદ્યમાન છે.

જો રામ ઐતિહાસિક હોય, તો શ્રી મુનિસુવત સ્વામીને ઐતિહાસિક માનવામાં કુદી પણ હરકત ન હોવી જોઈએ.

૪ ઈતિહાસના અજવાળે

(૪)

ઋગવેદમાં ઋષભ શબ્દ અનેકવાર આવે છે. તેના સહુથી જુના ટીકાકાર કાત્યાયન તેની સર્વાનુકમણિકામાં, સદ્ગુરુ શિષ્ય તેની વેદાર્થ દીપિકામાં અને સાયણાચાર્ય તેમના ભાષ્યમાં એ વાતનો સ્વીકાર કરે છે કે આ શબ્દ વ્યક્તિવાચક છે, પણ તે ખરેખર કોનું નામ છે તે જાણવતા નથી. આ શબ્દ માત્ર જૈનોએ માનેલા પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને અંગે કેમ ન હોય? એ વિચારથું ઘટે છે. વળી વેદોમાં અહીંનું શબ્દનો ઉપયોગ પણ અનેક સ્થળે થયેલો છે, તે પણ જૈન ધર્મની પ્રાચીનતા પુરવાર કરે છે.

પ્રા. જે. સી. વિદ્યાલંકાર મહાભારત પહેલાના ધર્મોપદેશકો સંબંધમાં વિવેચન કરતાં જણાવે છે કે ‘હાલના વિવેચકોએ પાર્શ્વનાથની ઐતિહાસિકતા સ્વીકારી છે. બીજા તીર્થકરોને લગતી હકીકતો દંતકથામાં એટલી બધી ભળી ગયેલી છે કે તેમાંથી તેને છૂટી પાડી શકાઈ નથી. પરંતુ એવાં પ્રમાણો ચોક્કસ મળે છે કે ભારતવર્ષમાં વૈદિક મતને ન સ્વીકારનારા સંપ્રદાયો મહાવીર અને બુદ્ધના સમય પહેલાં પણ હતા. બુદ્ધનો જન્મ થયો તે પહેલાં પણ ભારતમાં અહીંતો અને તેમનાં ચૈત્યો હતાં. આ અહીંતો અને તેમના ચૈત્યોને માનનારાઓ વ્રાત્ય કહેવાતા અને તેમનો ઉલ્લેખ અથર્વ વેદમાં મળે છે.’

ગ્રાત્યો સંબંધમાં ડૉ. કે. પી. જ્યસવાલ કહે છે કે ‘તેમને વ્રાત્ય અથવા બ્રાહ્મણને ન માનનારા ક્ષત્રિય કહેવાતા, તેમને પોતાનું લોકશાહી ઢબનું રાજ્ય હતું, તેમને પોતાના મંદિરો હતાં, તેઓ વૈદિક ધર્મ સિવાયની બીજી પ્રાર્થના કરતા, તેમને પોતાના ધાર્મિક ગુરુઓ હતા અને તેઓ જૈનધર્મ પાળતા.’

જૈનધર્મ જુદા જુદા સમયે કયા નામે ઓળખાતો તે સંબંધમાં એક વિદ્ધાને નોંધ કરી છે, તેનું ઉદ્ધરણ અહીં ઉપયોગી થઈ પડશે. તે કહે છે કે ‘સિંધની ખીણાની સંસ્કૃતિના દિવસોમાં એ જૈનધર્મ કહેવાતો. વૈદિક લોકો તેને વ્રાત્ય અથવા અહિસાધર્મી તરીકે ઓળખતા. ઉપનિષદના સમયમાં તે આર્થ્ર ધર્મ કે આત્મ ધર્મને નામે ઓળખાતો, બુદ્ધના સમયમાં તેનો નિર્ણથ ધર્મ તરીકે વ્યવહાર થતો, દીક્ષાચીક અને દીક્ષાસિદ્ધિયન સમયમાં શ્રમણધર્મ કહેવાતો અને હિંદુ સમયમાં તે જૈનધર્મ, સ્યાદ્વાદ મત કે અનેકાંત મત તરીકે ઓળખાવા લાગ્યો.

એટલે વેદના વાંચનારાઓને તેમાં જૈન શબ્દનો સીધો ઉલ્લેખ ન દેખાય એ સ્વાત્માવિક છે, પણ તેમાં પ્રાત્યનો જ્યાં જ્યાં ઉલ્લેખ આવે છે, તે જૈનધર્મનો જ ઉલ્લેખ છે એમ સમજવાનું છે.

ઉપનિષદોમાં પણ જૈન ધર્મ સંબંધી સીધા કે આડકતરા અનેક ઉલ્લેખો આવે છે. છાંદોગ્ય અને મુંડક ઉપનિષદમાં તો જૈનોના ખાસ પારિભાષિક શબ્દનો ઉપયોગ પણ થયેલો છે, અને તેમાં જે ચર્ચા છે, તે પણ જૈન શૈલીને મળતી જ છે. તેમાં અંગીરસ મુનિનું નામ આવે છે, તે પ્રથમ જૈન મુનિ હતા. આ બાબતની ચર્ચા ડો. જાહેન્સ હર્ટલે સારી રીતે કરેલી છે.

પુરાણો પદ્ધીના ગણાય. પરંતુ તેમાંથી જૈન તીર્થકરો, જૈનતીર્થો અને જૈન મંત્રોનાં નામ આવે છે અને ભાગવત પુરાણ જેવામાં તો શ્રી ઋષભદેવનું ચરિત્ર પણ જોઈ શકાય છે.

મોહન-જો-દેરોમાંથી જે સામગ્રી મળી છે, તેમાં કેટલીક મુદ્રાઓ એવી છે કે જેના પર નજર ઋષિની મૂર્તિઓ છે, એટલું જ નહિ પણ તે કાયોત્સર્ગ અવસ્થામાં છે, એટલે વિદ્ધાનોનું માનવું છે કે તે જૈન ધર્મને લાગતી છે. આ રીતે જૈનધર્મ સિંધુ નદીની ખીણાની સંસ્કૃતિ કે જે ઘણી પ્રાચીન ગણાય છે. તે વખતે પણ ફેલાયેલો હતો.

સ્વસ્તિક, ત્રિંદ, ધર્મચક, નંદાવર્ત, વર્ધમાનક, વૃક્ષ, સ્તૂપ, ક્રમણ, વૃષભ; હાથી, સિંહ, કર્યાદ, સર્પ અને એવાં બીજાં કેટલાક રહસ્યમય આકૃતિઓનો ઉપયોગ જૈનો અતિ પ્રાચીન કાળથી કરતા હતા. બ્રાહ્મણો અને બૌદ્ધોએ તેનું પદીથી અનુકરણ કર્યું છે.

હવે કેટલાક પ્રાગ્-ઐતિહાસિક સમયનાં ચિત્રો નિયોલીથીક ગુફામાંથી મળી આવ્યા છે અને જેનો સમય લાખો વર્ષનો ગણાય છે, તે જૈન સંકેતો હોવાનું અનુમાન થાય છે, એટલે જૈનધર્મની પ્રાચીનતા ઘણી જ આગળ વધી જાય છે. (આવી એક ગુફા રાયગઢની પાસે સીંગનપુરમાંથી મળેલી છે

ટૂકમાં ઈતિહાસ પર જેમ જેમ જેજવાનું પડતું જાય છે, તેમ તેમ જૈનધર્મની પ્રાચીનતા બહાર આવતી જાય છે અને એક દિવસ એવો આવશે કે જ્યારે જૈનધર્મ જગતના સહુથી પુરાણા ધર્મ તરીકે જાહેર થશે.

૪ સાધકની મુંજવણમાં માર્ગદર્શન

ધર્મનો સાધક આત્મા કેટલીકવાર ગેરસમજશમાં તથાય છે અને માને છે કે હું તત્ત્વ સમજું છું, પણ એણે ધ્યાનમાં રાખવાનું છે કે આ સમજ વલણના ઘરની જોઈએ.

વલણ એટલે હેય-ઉપાદેયને અનુરૂપ ચિત્તની પરિણિતિ, મનનો ઝોક, દા.ત. પાપ-આશ્વાનો પુરુષાર્થ હેય છે, તો અને અનુરૂપ વલણ, એ આશ્વાનો અને એના પુરુષાર્થ પ્રત્યે જ્વાનિ, તિરસ્કાર, ભય, કંપારો, વસવસો, વગેરે થયું જોઈએ, રહેવું જોઈએ. જ્યાં અનું નામ સંભળાય, એની આબાઈ દેખાય, ત્યાં જ્વાનિ થાય, દયા આવે કે ‘આ બિચારા આશ્વાપીદિત લોકોનું શું થશે?’ સ્વજીવનમાં એના પ્રત્યે અરુચિ અને એના પ્રવેશ વખતે તથા પછી કંપારો થાય, ભય થાય, ‘અહો ! હું માર્યો ! મારું શું થશે ? કેવી દુઃખદ સ્થિતિ મારે ઊભી થશે ?’ આ વલણ હોય તો એના પ્રત્યે પક્ષપાત, એની કવિતા ગાવાનું, એમાં હૂંક અનુભવવાનું, એની દલાલી કરવાનું ન બને. એથી વિપરીત સંવર-નિર્જરના પ્રકાર અને એનો પુરુષાર્થ ઉપાદેય સમજાય, તો એની પ્રત્યે આદર, બહુમાન, પક્ષપાત, પ્રશંસા, હૂંક, હોંશ, ભૂખ, ધગશ, વગેરે ભાવો જાગતા રહે. બાંધી રાખેલા વ્યસનીને વ્યસનથી ચીજ ન મળે છીતાં એના પ્રત્યે દિલમાં કેવી ભૂખ હોય ? રુચિ હોય, આદર-પ્રશંસા હોય ? તલસાટ હોય ? ભારે જ ને ? બસ, એવું સંવર-નિર્જરના, યાને ધર્મ-સ્થાનકોના પ્રકારો માટે જોઈએ. કલ્યાણ ત્યાં જ દેખાય, આશ્વાભૂત બનનારી લક્ષ્મીના ફેર કે વિષયોના સરંજામ પર નહિ ! હરધડી એમ થયા કરે કે આ સંવરનિર્જરના પુરુષાર્થ કયારે આદદું; એની સાથે બીજું તુચ્છ લાગે, વિંબણારૂપ અને નાલેશીભર્યું લાગે.

ટૂકમાં સત્પુરુષાર્થની સમજ એટલે ઉપર્યુક્ત હેય અને ઉપાદેય તત્ત્વો અને અનુરૂપ ભય વગેરે કે રુચિ વગેરે ભાવોની ભાવના (અભ્યાસ) વારંવાર કેળવી તદનુરૂપ વલણ ઊભું કરી દેવું એ. ‘ભાવના ભવનાશિની’ એ મહાપુરુષોનું વચ્ચન છે. ‘વારંવાર ભાવના કરવાથી’ સુસંસ્કાર ઊભા થાય છે, તન્મયતા આવે છે, જે પછી સત્પુરુષાર્થને સુલભ કરે છે. શાસ્ત્રો કહે છે, ‘આહાર-નિદ્રા-ભય-મૈયુનાનિ, સમાનમેતત્ત પશુભિન્નરાણામ્’-અર્થાતું આહાર-વિષય-પરિગ્રહ, નિદ્રાની સંજ્ઞાઓ માણસને પશુના સમાન છે. હવે આપણો એમ કહીએ કે આ મને સમજાય ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

છે, પરંતુ એ તપાસવું જોઈએ કે શું એને અનુરૂપ વલણ આપણું ઊભું થયું છે ? એ થયું હોય, તો જ્યારે જ્યારે આહારની, વિષયની, પરિગ્રહની અને નિદ્રાની સંજ્ઞા નહે, સંજ્ઞા સક્રિય બને, ત્યારે ત્યારે હૃદયને એમ ભાસે, કે ‘હું પશુની કિયા કરી રહ્યો છું ! હું ખોળિયે માનવ પણ હૈયે જનાવર છું, તેથી ખોળિયે માનવ અને હૈયે પશુ કરતાં પણ વધુ ખરાબ, વધુ નુકસાનગ્રસ્ત અને વધુ નાલેશીપાત્ર બન્નું છું. ખોળિયે જનાવર તો કલેશકાષ ભોગવીને પાપ ઓછાં કરે છે. ત્યારે હું ખોળિયે માનવ સગવડ-સાચ્ચિભીમાં પુણ્ય સફાયાટ કરી રહ્યો છું ! આ માનવના ખોળિયાએ મારી આવી પશુની રમત ! પશુનું હૈયું ! માનવનું હૈયું તો જ બને કે ધર્મમાં રમતો હોઉં.’

‘ધર્મો હિ તેષામધિકો મતો યત્ ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ’ । હૈયે માનવને ખરેખર ધર્મ અધિક-ખાસ મણ્યો ગણાયો છે. ધર્મહીન ખોળિયાના માનવ તો પશુ જેવા છે, એટલે આ ભાસ થયા કરવો જોઈએ,-આહારાદિની સંજ્ઞાઓ ખેલતી વખતે જાતમાં પશુપણાનો ભાસ અને ધર્મસાધના વખતે માનવતાનો ભાસ. સંજ્ઞાના ખેલમાં કાયરતા પુરુષાર્થહીનતા અને પાગલતા ભાસે; ધર્મસાધનામાં બહાદુરી, પુરુષાર્થપણું અને શાબાશી-સુજ્ઞતા ભાસે. ધર્મસાધના એટલે આહાર સામે તપ, વિષય સામે શીલ સદાચાર અને ત્યાગ, પરિગ્રહ સામે દાન, અને નિદ્રા સામે શુભ ભાવનાની જાગૃતિ. પહેલો પુરુષાર્થ ઉપર કહ્યું તેમ પશુપણા-મનુષ્યપણાનો ભાસ અને શરમ (કાયરતા) શાબાશી (બહાદુરી)ની લાગણી ઊભી કરવાનો છે, હેય-ઉપાદેયને અનુરૂપ વલણ ઊભું કરવાનો છે.

આ વલણ કરવાની આડે ધનમોહ, શરીરમોહ, કે કુદુંબમોહના અધ્યાસો નડી શકતા નથી. વારંવાર એની ભાવના કર્યા કરવાથી; હૈયે ચોટ લગાડવાથી અને સોનાની જીવનનદી ઊખર ભૂમિમાં, વિખાકત ભૂમિમાં વહી બરબાદ થઈ રહ્યાનો ભારે ખેદ અનુભવવાથી એ શક્ય બને છે.

સમજવું ધટે છે કે સમ્યગદર્શન અને વીતરાગ પરની ગ્રીતિ આ વલણના આધારે છે. જિની જેવી પૂર્વસાધના અને સિદ્ધાન્ત, આપણી દાણિ, આપણું વલણ-હિસાબ-ધોરણ-મનોરથ તેવા જોઈએ.

માનવજીવનનું મૂલ્ય સમજવું એટલે પણ આ વલણ-હિસાબ-મનોરથ ઊભા કરવાના છે. વિષયનાં સુખ-ધનમાલકુદુંબના સુખને ખણજનાં સુખ જેવાં લેખવાનાં છે, મનને ગ્રાસકો પડે, કે ‘અરે ! આ કંચનકાયાકુદુંબની ગોળારી રમતમાં કયાં ફસાયો છું ! એ તો આત્માની ધોરી ખોદી નાખનારાં છે. જેટલે નીચેથી કંમસર ચઢી માનવભવના થાળે આવ્યો છું, તેટલે નીચે એકીકલમે આ પાડનારાં છે !’

વર્ષોની જહેમત પછી કોઈ મહાન શોધક હવે એને જગત આગળ મૂકી મહાન યશ લેવાના અવસરે એમ કરવાને બદલે કોઈને એ શોધ પાંચ રૂપિયા માટે વેચી નાખે તો એ કેવો રંકડો ગણાય ? બસ, જન્મોની જહેમત પછી ગ્રાપ્ત કરેલા આ મનુષ્યભવને જ્ઞાનીઓના ચરણે મૂકી મહાન ઉદ્ય ગ્રાપ્ત કરવાના અવસરે એને એના બદલે તુચ્છ કંચન-કાયા-કુટુંબના સુખ ખાતર વેચી નાખવાનો બાલિશ ધંધો છે; જીવનભરની મહેનતથી શોધને ખોદી નાખેલી હીરાની ખાજાને શિરામણ માટે વેચી નાખવાની મૂખ્યાઈ છે ! ધ્યાન રાખજો કે કોહિનૂર હીરાથી શેર મમરા ખરીદવા હોય તો ન મળે એમ નહિ, મળે, પરંતુ એ ખરીદનારો મહામૂર્ખ કહેવાય; એમ હીરા જેવા મનુષ્યભવથી વિષય સુખો ખરીદવા અને કરોડો-અબજોની પુણ્ય-કમાઈ ગુમાવવી એ મહામૂર્ખાઈ છે.

તમે કહેશો, કે ‘આ મહામૂર્ખાઈ સમજાય તો છે, છતાં કેમ એ છૂટતી નથી ?’ પરંતુ ઉપર કહું તેમ સમજવું એટલે વલણ ઊભું કરવાનું છે. તો શું મૂર્ખાઈની કિયા પ્રયે હૈયે ભારે સંતાપ થાય છે ? ભય લાગે છે ? અકળામણ અનુભવાય છે ? એની પ્રશંસાથી બચાય છે ? એમાં પ્રવર્તતાં ટાંટિયા ધુજે છે ? ખાનદાનને અનાચારમાં તણાવું પડે તો જેવી શરમ લાગે, એવી શરમ લાગે છે ? જો આવું કંઈ નહિ તો સમજ કેવી ?

કહેશો, ‘એમ તો, સત્સંગ, નવકારજાપ, શાસ્ત્રવચનને ધર્મક્રિયા કરવા છતાં, એવી પ્રતીતિ કેમ નથી થતી ?’

પરંતુ મહાનુભાવ ! એ સત્સંગ વગેરે ન કરીને ય આ વલણ ઊભું કરવાનું છે તે તરફ લક્ષ અને પ્રયત્ન કેટલો ? એ જો હોય તો એ સત્સંગના ટાણે હૈયામાં એનો જ તલસાટ અને બાકીના કાળે પણ એના ચાલુ આંદોલન મનમાં ચાલ્યા કરવાં જોઈએ. કિયા બંધ થાય પણ મન ખુલ્લું રહે. સત્સંગ, જાપ, વાંચન ને કિયા પૂરી થયા પછી પણ મનમાં એજ રહ્યા કરે. કહીએ ખરા કે દર્શનમાં બહુ આનંદ આવ્યો પરંતુ શું દર્શન પછી ઘરે જતાં અને કામકાજમાં ગુંથાતા છતાં મૂર્તિ મનમાં રમાયા કરી ? ચૈત્યવંદનમાં ભાવથી સ્તવન બોલ્યા, પણ પછી ઊઠીને ઘરે જતાં એ સ્તવનના ભાવ મનમાં ગુંજ્યા કર્યા ખરા ? ના, ઠેઠ ઘરે જતાં અને ઘરમાં તો શું પણ ચૈત્યવંદન પૂરું કરી ઉઠ્યા ત્યાં પણ એની કોઈ યાદ મનમાં નથી, ત્યાં શી રીતે પ્રગતિ થાય ?

તત્વપ્રતીતિ કરવા માટે તો જરૂર પડ્યે ઠેઠ ચારિત્રની સાધનાઓ સુધી જવું પડે. માટે અધિરાઈ કરવાની જરૂર નથી, માત્ર પુરુષાર્થ ચાલુ રહેવો જોઈએ. એ માટે,

પહેલા કહું તેમ

- (૧) અનુરૂપ વલણ ઘડવા મથામણ કરવાની;
- (૨) પશુતા-માનવતાનો હુખુ ભાસ કર્યા કરવાનો;
- (૩) કેટલે નીચે નિગોદમાંથી કેટલા જંગી કાળે ઊંચે આવ્યા છીએ અને બાધ્યભાવમાં રમતાં, ઠેઠ ત્યાં નીચે એકી કલમે મૂકી દેશે અનો સતત ભય રાખવાનો;
- (૪) માનવભવરૂપી કોહિનૂર હીરો તુચ્છ વિષયો ખરીદવા માટે નહિ પણ મહા-કિંમતી સંવર-નિર્જરાનો માલ ખરીદવા માટે છે એની સતત જગતિ રાખવાની;
- (૫) ધર્મક્રિયા, વાંચન, શ્રવણ વગેરે પુરું થવા છતાં મનમાં એનાં આંદોલન ચાલુ રાખવાના;
- (૬) ઊંચી ઊંચી સાધનાઓમાં પુરુષાર્થ ફોરવા જ કરવાનો, અને
- (૭) બાધક તત્ત્વો ત્યાગ કરતા ચાલવાનું.

બાધક તત્ત્વ એટલે વિકથા, કુથલી, નિષ્ઠળ કે જડ વિષયોના વિચાર વિકલ્પો, બિન જરૂરી બોલ, ખોટી જિજ્ઞાસા-આતુરતાઓ, અનાવશ્યક નિવાર્ય વ્યવહારોમાં તણાવું, પાપવાંચન, બિનજરૂરી જડર્ધન-શ્રવણ,... ઈત્યાદિ ઈત્યાદિ બાધક તત્ત્વ છે. એ દરેકે દરેકને તિલાંજલિ આપી દેવી જોઈએ. કેમ કે બધા તો ગમે તેવા સારા સત્સંગ-વાંચન-જાપ-કિયાઓની સામે જેર છે. તત્ત્વપ્રતીતિ ન થવાની આડે આ બહુ ભાગ ભજવે છે. એને પકડી પકડીને એકે એકને જીવનમાંથી દૂર રાખો, પછી જુઓ કે ખૂબખૂબ સત્સંગ, વાંચન અને ધર્મસાધનાઓ દ્વારા તથા ઉપરોક્ત સાત બાબતોની સહાયથી તત્ત્વપ્રતીતિ અને આત્મ પ્રગતિ થાય છે કે નહિ.

એજ, અનુભવ કરીને જણાવજો.

U

આખી રાત બિલકુલ સૂતા નહિ

V

એક વાર રાત્રે ચાંદનીના પ્રકાશમાં લખવા બેઠા હતા. તેઓશ્રીનો સંથારો પાથરેલો હતો તેની બાજુમાં એક બાલમુનિનો સંથારો હતો. બાલમુનિ તો ઊંઘમાં ખસતાં ખસતાં પૂજ્યશ્રીના સંથારા પાસે આવી ગયા.

મોડી રાતે લખાણ પૂર્ણ થયા બાદ સૂવા માટે પૂજ્યશ્રી પોતાના સંથારા પાસે ગયા તો તેમાં તો પેલા બાલમુનિનો હાથ હતો.

W —“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાસ્ખ

૬ ધાર્મિક ઉત્સવો-મહોત્સવો અંગો

ઉત્સવ-મહોત્સવોનું મહત્ત્વ પ્રથમ પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે, કારણકે એ માનવ સ્વભાવ સાથે જોડાયેલી વસ્તુ છે. કોઈ પણ કારણે સુસ્ત થઈ ગયેલો મનુષ્ય ઉત્સવ-મહોત્સવોથી જાગ્રત થાય છે, આનંદમાં આવે છે અને એક પ્રકારની પ્રસન્નતા અનુભવે છે. ધાર્મિક ક્ષેત્રમાં પણ ધાર્મિક આનંદ અને નવી સ્ફૂર્તિ અર્થે ઉત્સવ-મહોત્સવોની યોજના છે.

કોઈ પણ ધાર્મિક ઉત્સવ-મહોત્સવનું આધોજન થતાં સાધર્મિઓનો સમુદ્દર એકત્ર થાય છે, તેનાથી ધાર્મિક જગ્યાતિ આવે છે, ધર્માન્નતિ અને આત્મોન્નતિને લગતી અનેકવિધ ભાવનાઓ અને પ્રવૃત્તિઓ ગતિમાન થાય છે અને એમાં ભાગ લેનાર આત્માઓ સમ્યક્તવને પામે છે કે સમ્યક્તવને શુદ્ધ કરવા ભાગ્યશાળી થાય છે, ત્યારે એને નિહાળનાર ઈતરો પણ ધર્મપરંસા કરવા દ્વારા ધર્મનું બીજ પામે છે. કાળનું પરિવર્તન થવા છીતાં ઉત્સવ-મહોત્સવો ઘટ્યા નથી, બલ્કે વધ્યા છે, એ એની મહત્ત્વાં સ્ફૂર્તિ છે.

આ ધાર્મિક ઉત્સવ-મહોત્સવો વર્તમાનકાળે શાસનની વિશેષ પ્રભાવના કરનાર કેમ બને ? તે અંગે અહીં કેટલીક વિચારણા રજૂ કરીએ છીએ.

(૧) પ્રથમ તો આ ઉત્સવો-મહોત્સવો ખૂબ વ્યવસ્થાપૂર્વક થવા જોઈએ, જેથી તેમાં શિસ્ત અને વ્યવસ્થિતતાનાં દર્શન થઈ શકે અને તેમાં ભાગ લેનાર સહુ કોઈના આત્મા પ્રસન્ન થાય અને ધર્મભાવનામાં જીવે. ઉત્સવ-મહોત્સવ જેમ મોટો હોય તેમ વધારે સારો ગણ્યાય, એ વાત સાચી છે, પણ તેમાં વ્યવસ્થા બરાબર ન હોય તો ધાંધલ થાય છે, ધમાલ થાય છે અને નાની-મોટી તકરારો ઉપસ્થિત થતાં વાતાવરણ ડાંણાય છે. જે વસ્તુ ધર્મવૃદ્ધિ અર્થે યોજાએલ હોય, તેમાં કલેશવૃદ્ધિ તો ન જ થવી જોઈએ.

(૨) ઉત્સવ-મહોત્સવ એક એવો પ્રસંગ છે કે જ્યારે આપણે સંબંધ સમાગમમાં આવેલા કે માન પ્રતિક્ષા પામેલા અનેક જૈનેતરોને આમંત્રણ આપીને બોલાવી શકીએ અને તેમને શાસનનું ગૌરવ બતાવીને આપણા ધર્મ પ્રત્યે સદ્ભાવવાળા બનાવી શકીએ. આ દિશામાં આજે પ્રયત્નો થાય છે, પણ તે પાંગળા હોવાથી તેમનું જોઈએ તેવું પરિણામ આવી શક્તું નથી.

પ્રથમ તો ઉત્સવ-મહોત્સવ જોવા પધારે તેને આપણે શું બતાવવું અને શું કહેવું, તેનો વિવેક ઓછો છે. ઘણા તો મંડપ, તેનો શાણગાર, વીજળીની રોશની, ઉતારાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, સ્વયંસેવકોની ગોઈવણ એ બતાવવામાં જ ધણોખરો સમય લઈ લે છે, અને તેથી સંતોષ પામે છે, એટલે તેમને જૈનધર્મ કે તેના ગૌરવ સંબંધી ખાસ પરિચય આપી શકતા નથી, માત્ર વ્યાપારીવૃત્તિએ જીવનારા એ પરિચય આપી પણ શી રીતે શકે ? -એ માટે ધાર્મિક સિદ્ધાંતોનું ધાર્મિક હિતિહાસનું સારું જ્ઞાન જોઈએ, એટલે કે દરેક ધાર્મિક ઉત્સવ-મહોત્સવ પ્રસંગે એક-બે સારા જાગ્રતારોને આમંત્રણ આપી, આ કાર્ય તેઓને સોંપવું જોઈએ.

(૩) ઉત્સવ-મહોત્સવની યોજના વખતે તેનો હેતુ સમજવતી અને તેના વિવિધ અંગોનો પરિચય આપતી એકાદ પત્રિકા-પુસ્તિકા તો અવશ્ય પ્રગટ કરવી જોઈએ, જેથી અજાણ જૈનભાઈઓને વસ્તુનું રહસ્ય સમજાય; તેમ જ ત્યાં આવનાર જૈનેતર ભાઈઓને તે આપી શકાય અને તેમને આ ઉત્સવ-મહોત્સવને કઈ રીતે નિહાળવો તેની દસ્તિ સાંપદે. ઉત્સવ બહુ દિવસોનો હોય તો અવારનવાર પત્રિકાઓ દ્વારા ઉત્સવનું વિવિધ મહત્ત્વ પ્રકાશિત કરતા રહેવાથી લોકોમાં નવું નવું તેજ આવે છે.

(૪) આ ઉત્સવ-મહોત્સવમાં અવારનવાર ખાસ જૈનેતરોને, ત્યાં બિરાજતા ગુરુદેવો સાથે વાર્તલાપ કરવાની સગવડ કરી આપવી જોઈએ, જેથી તેઓ ગુરુમુખે જૈનધર્મને લગતી કેટલીક વાતો સાંભળી શકે અને તેનું રહસ્ય પામી શકે.

(૫) આ ઉત્સવ-મહોત્સવમાં ભાગ લેવા આવનારને આપણે બદામ, પતાસાં, લાડુ વગેરેની પ્રભાવના કરીએ તે ઠીક છે, પણ આજે એ કાળ આવી લાગ્યો છે કે ખાસ પ્રભાવના તો ધાર્મિક જ્ઞાનવર્ધક પુસ્તકોની કરવી જોઈએ, જેથી તેઓ જૈનધર્મ અને તેના સિદ્ધાંતો-આચારો વિષે કંઈક જ્ઞાન પામી શકે અને એ રીતે તેમનો ધર્મ પ્રત્યેનો સદ્ભાવ અને ધર્મભાવના વૃદ્ધિ પામી શકે.

(૬) આપણે જ્ઞાનવાળી કિયામાં માનતા હોવાથી દરેક ઉત્સવ-મહોત્સવ જ્ઞાનપ્રદ-જ્ઞાનવર્ધક અને તે દ્વારા તાત્ત્વિક શ્રદ્ધા અને ભાવનાવર્ધક બને તે ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ.

૬ કર્તવ્ય પાલન

કર્તવ્ય-પાલન પર આપણે ત્યાં બહુ પ્રાચીન કાળથી ભાર મુકાતો આવ્યો છે અને આજે પણ મુકાય છે; આમ છતાં આજે આપણા જીવનમાં કર્તવ્ય-પાલનનું પ્રમાણ ઓછું જણાય છે અને તેનું જ એ પરિણામ છે કે આપણે અનેક બાબતોમાં પાછા પડી રહ્યા છીએ.

‘એગો હં નાથી મે કોઇ’ ‘હું એકલો જ છું, આ જગતમાં મારું કોઈ નથી’ એ શાસ્ત્રવચનોને આગળ કરીને કોઈ એમ માનતું હોય કે હું એકલો હોવાથી મારું બીજા કોઈ પ્રત્યે કાંઈ કર્તવ્ય નથી, મારી બીજા કોઈ પ્રત્યે કશી ફરજ નથી, તો એ ગંભીર ભૂલ છે. શાસ્ત્ર-વચનો હંમેશા અપેક્ષાવાળા હોય છે અને અહીં અપેક્ષા વિશેષથી એટલે કે વૈરાગ્યની ભાવના દઢ કરવા માટે જ એકત્વ ભાવના પ્રબોધાયેલી છે, પરંતુ તે સાથે શાસ્ત્રકારોએ મૈત્રી આદિ ભાવનાઓ અને માર્ગનુસારી ગુણો ફરમાવવા દ્વારા એમ સૂચયું છે, કે ‘તમે આ સમસ્ત વિશ્વના એક ભાગ છો અને તમામ જીવો સાથે એક પ્રકારના સંબંધથી જોડાયેલા છો, એટલે તેમના પ્રત્યે તમારું અમુક કર્તવ્ય છે. જો એ કર્તવ્યનું તમે યથાર્થ પાલન કરશો તો જ તમારું ઈહલોકિક અને પારલોકિક કલ્યાણ સાધી શકશો.’ તેમની આ દાણિને લક્ષ્યમાં રાખીને કર્તવ્યના મુખ્ય બે વિભાગો પાડી શકાયઃ (૧) વ્યાવહારિક કર્તવ્ય અને (૨) ધાર્મિક કર્તવ્ય.

વ્યાવહારિક પ્રવૃત્તિઓ અનેક પ્રકારની હોય છે. પોતાનું શરીર સાચવવું, વિદ્યાભ્યાસ કરવો, ધંધો-રોજગાર કરવો, સારી રીતે રહેવું, એ પોતાની જાત માટેની પ્રવૃત્તિઓ છે, અને મનુષ્યે તે બજાવવી પડે છે. જો મનુષ્ય તે તરફ બેદરકાર રહે કે તેનું યથાર્થ પાલન ન કરે તો તેને રોગના ભોગ થવું પડે છે, મૂર્ખમાં ખપવું પડે છે, નિર્ધન હાલતમાં દિવસ પસાર કરવા પડે છે અને અસંસ્કારીની પંક્તિમાં બેસવું પડે છે, પરંતુ મનુષ્ય મોટા ભાગે આમાં ચૂકતો નથી. બીજા શર્ધોમાં કહીએ તો તેનું પ્રથમ કે મૂળ લક્ષ આ તરફ જ હોય છે.

પોતાના માતાપિતા તથા વડીલોની ભક્તિ કરવી, પુત્ર-પુત્રી વગેરે પરિવાર તથા આશ્રિતોનું પાલન-પોષણ કરવું, અને તેમને ધર્મમાર્ગ જોડવા માટે વિવિધ ઉપાયો કરવા એ મનુષ્યનું એક વ્યાવહારિક કર્તવ્ય છે. શ્રી હરિભક્તસૂરીશ્વરજી વગેરે મહાપુરુષોએ ધર્મબિંદુ આદિ ગ્રંથમાં આ બાબત પર સુંદર વિવેચન કરેલું છે. જે

મનુષ્ય પોતાનું આ કર્તવ્ય બજાવતો નથી, તે અધમ કે હુએ ગણાય છે અને તે અનેક પ્રકારની વિટંબણાને પાત્ર બને છે, વળી લોકોમાં તે હલકો ગણાય છે અને તેણે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હોય તે પણ ચાલી જાય છે.

આ જ પ્રમાણે જ્ઞાતિના ઉદ્ય માટે તથા ગ્રામ, પ્રાંત કે દેશની રક્ષા માટે પણ તેણે અવસરોચિત કેટલાંક કર્તવ્યો યથાશક્તિ બજાવવાનાં હોય છે. જો તે યથાશક્તિ આ કર્તવ્યો બજાવે નહિ તો સ્વાર્થી કે એકલપેટો ગણાય છે અને તેનો જ્ઞાતિજ્ઞનો, પંચ, મહાજન કે નાગરિક-મંડળોમાંથી એકડો નીકળી જાય છે. માત્ર ઉદરભરણાર્થે તો કુદ્ર જંતુ-કીડા વગેરે પણ પ્રયાસ કરે છે, તેમાં મનુષ્યની વિશેષતા શી?

મનુષ્યને બીજા પ્રાણીઓ કરતાં ઉત્તમ પ્રકારનું મન મળ્યું છે, તો તેણે પોતાનાં કર્તવ્યોનો ઊંડાશથી વિચાર કરવો જોઈએ અને તેને અમલમાં મૂકવા માટે યથાશક્તિ પ્રયાસ આદરવો જોઈએ. જે મનુષ્ય પોતાનાં કર્તવ્યોનો વિચાર કરતો નથી કે વિચાર કર્યા પછી અમલમાં મૂકતો નથી, તે શીંગડાં-પૂંઘડા વિનાનું બે પગનું પશુ છે, એક જાતનું જાનવર છે, અથવા તો મૂઢ કે ગમાર છે.

ધાર્મિક કર્તવ્યો મુખ્યત્વે ચાર પ્રકારમાં વહેંચી શકાય; (૧) આત્મા પ્રત્યેનું કર્તવ્ય. (૨) દેવ પ્રત્યેનું કર્તવ્ય, (૩) ગુરુ પ્રત્યેનું કર્તવ્ય, અને (૪) સંધ કે શાસન પ્રત્યેનું કર્તવ્ય. વ્યાવહારિક કર્તવ્યો કરતાં ય આ કર્તવ્યોમાં, આજે જોઈએ તો શિથિલતા વધારે દેખાય છે. કેટલાકને તો આ કર્તવ્યનો જ્યાલ જ હોતો નથી, પછી તેના પાલનની વાત રહી ક્યાં?

આત્મા પ્રત્યેનું આપણું પ્રથમ અને મુખ્ય કર્તવ્ય એ છે કે તેને કર્મનાં બંદીખાનામાંથી છોડાવવો, જેથી તે શુદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન થઈ અક્ષય અનંત સુખ માની શકે. કર્મનું બંદીખાનું અતિ બિહામણું છે, તેમાં અનેક પ્રકારની આપત્તિઓ ભોગવવી પડે છે, અનેક પ્રકારની મુશ્કેલીઓ અને વિટંબણા ભોગવવી પડે છે. જો કોઈને બે-પાંચ વર્ષની સખત કેદની સજ્જ થઈ હોય તો તે રાડ પાડી જાય છે, ત્યારે કર્મના બંદીખાનામાં આત્મા લાખો કરોડો વર્ષથી સબીરી રહ્યો છે. તેની હાલત શી થતી હશે? મારા આત્માને ઊંચો લાવું, મારા આત્માનો ઉદ્ધાર કરું, એવી ભાવના જોરદાર થયા વિના આત્મા પ્રત્યેનું કર્તવ્ય બજાવી શકતું નથી.

(૬) (૨)

આત્મા પ્રત્યેનું કર્તવ્ય બરાબર સમજવામાં આવે તો જ દેવ, ગુરુ અને સંઘ કે શાસન પ્રત્યેનું કર્તવ્ય સમજાય છે અને તે બજાવવાની ભાવના પ્રગટે છે, એટલે ધાર્મિક કર્તવ્યોમાં આત્મા પ્રત્યેના કર્તવ્યને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે.

દેવ-અરિહંત દેવ પ્રત્યે આપણું કર્તવ્ય શું ? જો તેમણે કરેલા ઉપકાર આપણી સમજણમાં ઉત્તરે, આપણાં દિલમાં વસે, તો જ એ કર્તવ્યનું ભાન થાય. શ્રી અરિહંત દેવે સતત પુરુષાર્થ કરીને આત્મવિકાસ સાધ્યો, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને ધર્મદાતા, ધર્મદશક, ધર્મનાયક, ધર્મસારથિ ને ધર્મચક્રવર્તી થઈને જગતને મહામંગળમય અત્યંત કલ્યાણકારી અને સર્વશ્રેષ્ઠ ઉપકાર કર્યો. સંસાર સાગરમાંથી તરવાનું ધર્મ જ એક સાધન છે. તે સિવાય અન્ય કોઈ સાધન નથી. આવું સાધન આપનારનો ઉપકાર કેટલો ?

એક હોડી દરિયામાં ચાલી જતી હોય, તે પવનનાં વાવાડોડામાં સપડાય, તેનાં પાટિયાં તૂટે અને મુસાફરો દરિયાના અગાધ જળમાં પડી દૂબકાં ખાવા મંડે ત્યારે જો એક કુશળ નાવિક પોતાની નૌકામાં બેસીને ત્યાં આવી પહોંચે અને તેમને બચાવી લઈ સુરક્ષિત કિનારે પહોંચાડે તો તેનો ઉપકાર કેટલો ગણાય ? તો પછી ભવરૂપી સાગરમાંથી જે આપણને દૂબતાં બચાવે અને સહીસલામત સામા કિનારે એટલે મોક્ષમાં લઈ જાય, તેનો ઉપકાર તો અનંત જ માનવો રહ્યો. શ્રી અરિહંત દેવ આપણા અનંત ઉપકારી છે, તેમણે સાચા લોકનાયક તરીકે ધર્મનો યોગશૈમ કરીને આપણા પર અનંત ઉપકાર કરેલો છે, તેથી આપણે તેમની જેટલી સેવા-ભક્તિ-આરાધના-ઉપાસના કરીએ તેટલી ઓછી જ છે, એ વાત આજે આપણાં દિલમાં બરાબર વસાવાની જરૂર છે. તો જ આપણે તેમના પ્રત્યેનું કર્તવ્ય બરાબર બજાવી શકીશું.

ગુરુ પ્રત્યેનું કર્તવ્ય પણ આજે આપણાં દિલમાં બરાબર વસ્યું નથી. તેઓ આપણી હદ્યગુહામાં બ્યાપેલા અધર્મ, અજ્ઞાન ને મોહરૂપી અંધકારનો નાશ કરવા માટે દીપક સમાન છે, આપણી સ્બરૂપાઓ-ભૂલો સુધારવા માટે માતા-પિતા સમાન છે, આપણને સાચી ખબર આપવા માટે ભિત્ર સુહૃત્ત સમાન છે. શ્રી અરિહંત દેવોએ પરમ તારક એવા ધર્મની જે પ્રરૂપણ કરી તેનું ખરું રહસ્ય આપણે તેમની પાસેથી જ પામી શકીએ છીએ, એટલે તે આપણા ગુરુ છે, સન્માર્ગ-દર્શક ભોગ્યિયા

છે, આપણા પર ઉપકારની વર્ષી કરનારા એક સાચા પરોપકારી મહાપુરુષ છે. તેમના હદ્યમાં આપણા માટે જે હિતભાવના વસેલી છે, જે કલ્યાણકામના ભરેલી છે, તેનો બદલો આપણે કોઈ વસ્તુથી વાળી શકીએ એમ નથી. એટલે તેમની સતત સેવા-ઉપાસના કરવી અને તેમની યોગ સાધનામાં-ધર્મરાધનામાં બને તેટલા સહાયભૂત થવું એ આપણું અગત્યનું ધાર્મિક કર્તવ્ય છે.

સંઘ કે શાસન પ્રત્યેનું કર્તવ્ય આપણે શાંત ચિંતે કદી વિચાર્યુ છે ખરું ? અને વિચાર્યુ હોય તો તે બજાવવા માટે કોઈ પ્રયાસો કર્યા છે ખરા ? સર્વજ્ઞ અને સર્વદર્શી એવા તીર્થકર પરમાત્માએ સ્થાપેલું આ શાસન એક વટવૃક્ષ સમાન છે. તેની શીળી છાયામાં બેસીને અનેક આત્માઓ પોતાનું કલ્યાણ સાધી શકે છે. તેની કોઈ પણ ડાળ ભાંગે, અરે એક પાંદડું પણ તૂટે તો આપણા હદ્યમાં ચોટ લાગવી જોઈએ, પારાવાર દુંબ થવું જોઈએ, ખાવું પીવું હરામ બની જવું જોઈએ. શું એ સ્થિતિ આજે જોવામાં આવે છે ખરી ?

શાસન પર મહાન આફિત આવી હોય તો પણ આપણે આપણી રોજની ઘરેડ પ્રમાણે જીવન જીવ્યા કરીએ છીએ અને જાણે કંઈજ બન્યું ન હોય એમ માનીને સંઘળો સ્વાર્થવ્યવહાર ચલાવ્યે રાખીએ છીએ. નથી તેની ચિંતા, નથી તેની ફિકર કે નથી તેને માટે કંઈ પણ કરી છૂટવાની તમના ! લગ્નમાં આંદબર કરવો હોય કે વ્યવહારમાં મોટાઈ દેખાડવી હોય તો હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવે અને શાસન પર આફિત આવી હોય ત્યારે એકબીજાનાં મોઢાં સામું જોઈ રહે ! ‘તમે લખાવો, તો હું લખાવું. તમે નથી આપતા તો હું શા માટે આપું ? તમે અને અમે સરખા ન ગણાઈએ-હવે આટલું બસ છે...’ આવા આવા ઉદ્ગારો ત્યાં સાંભળવા મળે ! જો આપણી સંઘ કે શાસન પ્રત્યેની કર્તવ્ય-બુદ્ધિ જાગૃત હોય અને કર્તવ્યપાલનની તમના હોય તો તેનો બધો ખર્ચ આપવા માટેની ઊંઘામણી કેમ ન બોલવી જોઈએ ?

ધર્મનું કામ પહેલું, સંસારનું કામ પછી, એવી ભાવના જ્યારે આપણામાં પૂરેપૂરી જાગૃત થશે, ત્યારે આપણો અભ્યુદય દૂર નહિ હોય.

૬ ભ્રમ-નિવારણ

જર્મનીના પ્રચાર મંડી ડૉ. ગોબેલ્સે એક વખત કહ્યું હતું, કે ‘એક વાત ભલે જૂઠી હોય, પણ વારંવાર તેનું ઉચ્ચારણ કર્યા કરો એટલે લોકો તેને સાચી માની લેશે અને તમારું કામ થઈ જશે.’ સૈદ્ધાંતિક દાખિએ આ વાત સાચી નથી, પણ તેમાં કેટલુંક વ્યાવહારિક તથ્ય છે. જૂઠી વાતનું વારંવાર ઉચ્ચારણ થવાથી તે વાત સાચી હોવાનો લોકોને ભ્રમ થાય છે અને તેથી તેઓ એક સાચી વસ્તુ છોડીને અસત્ય વસ્તુ પકડવા મથે છે.

આજથી કેટલાંક વર્ષો પહેલાં કોઈક જૈનના ગ્રંથો ફિરકાઓની એકતા કરવા અંગે વાત વહેતી મૂકી, કેટલાકે તેને જીલી લીધી અને ત્યારપણી તે અંગે વારંવાર ભાષણો થતાં રહ્યાં, એટલે ઘણાને આજે એમ લાગવા માંડ્યું છે કે જૈન સમાજના ઉદ્ધારનો કોઈ સાચો ઉપાય હોય તો તે આજ છે.

હમણાં ગ્રંથને બદલે ચાર ફિરકાની વાત વહેતી થઈ છે, કારણ કે તેરાપંથની પણ એક નોંધ લેવાલાયક ફિરકા તરિકે ગણના થવા માંડી છે.

હવે વિચારવાનું એ છે કે જો ગ્રંથ કે ચાર ફિરકાઓનું ઐક્ય શક્ય હોય તો અનેક વાર તેની હિમાયત કરવા છતાં તે સિદ્ધ કેમ નથી થતું ? થોડાં વર્ષ પહેલાં શ્રી વિજયવલ્લભસૂર્ણિણી નિશામાં એક મહોત્સવ ઉજવાયો હતો, ત્યારે જૈનોના ચારેય ફિરકાઓની એક સમિતિ નીમવામાં આવી હતી અને તે વખતે થયેલાં પ્રવચનો પરથી એમ લાગ્યું હતું કે હવે જૈનસમાજનો ઉદ્ધાર હાથ-વેંતમાં છે, પરંતુ એ સમિતિની બેઠક મળી અને બંધારણનો પ્રશ્ન આવ્યો કે અનેક મતભેદોનું પ્રદર્શન થયું અને બીજી વાર સમિતિની બેઠક જ મળી નહિ ! તાત્પર્ય કે તેનું અકાળ અવસાન થયું અને ચારે ફિરકાનાં ઐક્યની વાત હવામાં ઊડી ગઈ.

આજે કેટલાંક સ્થળે સામાન્ય બાબતોમાં ચારે ફિરકાના ભાઈઓ સાથે મળીને કામ કરે છે ખરા, પણ તેથી વિશેષ કર્ય જોવામાં આવતું નથી. આ પરિસ્થિતિ પર ગંભીર વિચાર કરીને કોઈ પણ નિર્ણય કરવાને બદલે ફરી ફરીને એ જ વાત રજૂ કરવામાં આવે છે, કે ‘ચારે ફિરકાનું સંગઠન થવું જોઈએ. તેની એક સમિતિ રચાવી જોઈએ.’ તેનો શો અર્થ છે ?

શેતાભરોથી દિગ્ભરો જુદા કેમ થયા ? શેતાભરોથી સ્થાનકવાસીઓ અલગ

કેમ પડ્યા ? સ્થાનકવાસીઓમાંથી તેરાપંથીઓને અલગ થવાનું શું કારણ ઉપસ્થિત થયું ? મૂળમાંથી જુદા પાડનારી આ માન્યતાઓનો આગ્રહ ઘટ્યો છે ખરો ? તેમાં ભૂલ સમજવાની ઉદાર દાખિ પેદા થઈ છે ખરી ? જો એના જવાબ નકારમાં હોય તો એકતાની વાત આપણે કયા મોઢે કરીએ છીએ ?

જો દિગ્ભરો આગમો ન માનવાનો આગ્રહ રાખ્યા જ કરે અને તીર્થો અંગે પોતાની ધૂસણિયાખોરીનો કક્કો ખરો કરવાનું છોડે નહિ. સ્થાનકવાસીઓ પોતાનામાંના કેટલાયને જિનમંદિર જતા જાણવા છતાં મૂર્તિપૂજાનો વિરોધ ચાલુ રાખે અને તેરાપંથીઓ દાનદયાના પોતાના વિચારામાં કંઈ પલટો આણે નહિ, તો ઐક્ય થાય ખરું ? અને એ થાય તો એ કેવું થાય ?

આજે કોંગ્રેસ એમ કહે છે ખરી કે, પ્રજાસમાજવાદી, સામ્યવાદી વગેરે બધાનું સંગઠન થાય તો જ અમે કંઈ કામ કરી શકીશું ? જો તે એમ કહેતી ન હોય અને માત્ર પોતાની કાર્યશક્તિ પર જ મદાર રાખતી હોય તો આપણે પણ વિરુદ્ધ મંત્રવોવાળા સંપ્રદાયને એક કરવાની વાત બાજુએ રાખી પોતાની કાર્યશક્તિ વધારવાનું ઈષ્ટ નથી ?

આજે ચારે ફિરકાઓમાં શેતાભર મૂર્તિપૂજક સમાજ ધણો મોટો છે અને લાગવગ તથા કાર્યશક્તિમાં પણ ધણો આગળ પડતો છે. તે એક જ જો પોતાના ધરનું સંગઠન સાધે તો ગમે તેવું દુર્ઘટ કરી શકે તેમ છે, તેથી ખરી જરૂર તો તેમાં સંગઠનની છે. એ વાત ઊભી રાખી ચારે ફિરકાની રચાયેલી એક સમિતિ પર કાર્યનો મદાર બાંધિશું તો આપણે જે કંઈ કરીએ છીએ તે પણ થશે નહિ અને વધારે ખરાબ સ્થિતિ આવી પડશે, એમ નકી માનવું.

હમણાં રિલિજિયસ ટ્રસ્ટબીલનું નિમિત્ત લઈને કેટલાકે એ અશક્ય પૂરવાર થયેલી વસ્તુને ફરી અમલમાં મૂકવા અંગે સૂચનો કર્યા છે, તેથી જ જણાવવું પડે છે કે એ એક મૃગતૃષ્ણિકા છે, બમ છે. એ સિદ્ધ થવાની હાલ કોઈ શક્યતા નથી. તેથી આપણી શક્તિ પર વિશાસ રાખીને આગળ વધવું એ જ શૈયસ્કર છે.

૧૦ સ્વાધ્યાય અંગ શોચનીય સ્થિતિ

શાસ્ત્રકાર ભગવંતોએ કહું છે કે ‘ગૃહસ્થોએ ધર્મ, અર્થ અને કામ એ ગ્રણ વળને પરસ્પર બાધા ન આવે તે રીતે સાધવા.’ પરંતુ આજનો આપણો વ્યવહાર તો સ્પષ્ટ કહી રહ્યો છે કે, ‘આપણે ધર્મને ભૂલી રહ્યા છીએ અને તેના ભોગે અર્થ અને કામની સાધના કરી રહ્યા છીએ.’

ગૃહસ્થોએ ધર્મની આરાધના નિમિત્તે રોજ ષટ્કર્મ કરવાનાં છે, એટલે કે છ પ્રકારનાં કર્તવ્યો બજ્જવવાનાં છે, પણ ઘણા ભાગ્યશાળીઓને તેના નામની પણ બબર નહિ હોય. (૧) દેવની પૂજા, (૨) ગુરુની ઉપાસના, (૩) સ્વાધ્યાય, (૪) સંયમ, (૫) તપ અને (૬) દાન એ તેનાં શુભ નામો છે. આ છય કર્તવ્યો અંગે ઘણું કહેવા જેવું છે. પણ તેમાં સ્વાધ્યાયની સ્થિતિ વધારે શોચનીય હોવાથી તે અંગે અહીં કેટલુંક વિવેચન કરવું ધાર્યું છે.

સ્વાધ્યાય એટલે શાસ્ત્રોનું ‘પઠન-પાઠન’ કરવું કે સદ્ગ્રંથોનું વાંચન કરવું. તેનાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, તત્ત્વબોધની પ્રાપ્તિ થાય છે અને આત્માનો અભ્યુદ્ય સાધી શકાય છે. શાસ્ત્રોમાં આવતાં વણનો પરથી એમ જ્ઞાનવા મળે છે કે આગળના શ્રાવકો આ વિષયમાં ઘણા કુશળ હતા અને તેથી જ ઉચ્ચ પ્રકારનો તત્ત્વબોધ પામી પોતાના આત્માનું હિત સાવી શક્યા હતા. આ શ્રાવકો કેટલીક વાર આચાર્ય ભગવંતો વળેને એવા પ્રશ્નો પૂછતા કે તેનાં જવાબ આપવા માટે ઊંડો વિચાર કરવો પડે.

આજે તત્ત્વબોધ તો બાજુએ રહ્યો, પણ ધર્મના વિષયનો સામાન્ય બોધ પણ ઘણો ઓછો થઈ ગયો છે. અને તેનું મુખ્ય કારણ સ્વાધ્યાયનો અભાવ છે, યેનકેન પ્રકારેણ પૈસો કમાવો અને તેમાંથી થોડો સારા માર્ગ ખર્ચવો. એટલે આપણે ફૂટકૂટ્ય થઈ ગયા, એવી માન્યતાનો આજે જોરદાર મચાર છે અને તેનું જ પરિણામ સ્વાધ્યાય પ્રત્યેની ઉપેક્ષામાં આવ્યું છે.

જ્યાં સ્વાધ્યાય કરવાનું માનસિક વલણ નથી, ત્યાં સારા ગ્રંથો ખરીદીને વાંચવાનું તો બને જ ક્યાંથી, આજે એક શ્રીમંત હવેલી બંધાવે તો તેમાં દીવાનખાનું હશે, ભોજન ખંડ હશે, રસોદું હશે, સ્નાનગૃહ અને સંડાશ હશે. પરંતુ એક વસ્તુ નહિ હોય અને તે સાદું પુસ્તકાલય. કદાચ સાદું પુસ્તકાલય હશે તો પણ તેમાં જૈન

ધર્મના ગ્રંથોનો સંગ્રહ તો અતિ અલ્ય જ હશે, એ પછી એ ગ્રંથોનો સ્વાધ્યાય કરવા માટેનો જુદો ખંડ તો હોય જ ક્યાંથી?

આપણા ત્યાંની નિઃસ્પૃહી મુનિવરોએ અંખડ જ્ઞાનોપાસના કરીને હજારો ગ્રંથોનું નિર્માણ કર્યું છે, પણ આજે આપણે તેને વાંચવા-વિચારવાની વૃત્તિ બહુ ઓછી દર્શાવી રહ્યા હીએ. કેટલાક તે માટે સમયનું કારણ બતાવે છે, પણ એ તો એક પ્રકારનું બહાનું જ છે. જો સમય નથી તો છાપાઓ, નવલકથાઓ શી રીતે વંચાય છે? અને નાટક-સીનેમા તથા કિકેટની મેચો જોવા માટે કલાકો શી રીતે કઢાય છે?

જો સ્વાધ્યાય કરવાનું માનસિક વલણ વધે તો આપણા ધાર્મિક ગ્રંથોનું વાસ્તવિક મૂલ્ય સમજાય અને તેને પ્રકાશમાં લાવવાની પ્રબળ ભાવના પ્રકટે. પછી તે માટે ગમે તેટલો ધનનો વય કરતાં કે પરિશ્રમ ઉઠાવતાં સંકોચ થાય નહિ. પરંતુ આજે સ્વાધ્યાયની વૃત્તિ રહી નથી, એટલે આપણા એક બહુ મૂલ્ય ઉત્તમ ગ્રંથનું પ્રકાશન કરવા માટે પણ અનેક રીતે સમજાવવા પડે છે.

સાધુ વળમાં સ્વાધ્યાયનું પ્રમાણ એકંદર સાદું છે, પણ તેમાંય વાચના, પૂછના અને પરાવર્તનાથી આગળ વધવાનું વલણ બહુ ઓછું જોવામાં આવે છે. સ્વાધ્યાયનું ચોથું પગથિયું અનુપ્રેક્ષા કે તત્ત્વચિન્તન છે. તે કાયોત્સર્જનું પ્રમાણ વધે તો દેહ અને મતિની જડતા નાશ પામે અને સૂત્ર-સિદ્ધાંતની પાછળ ભાવનો જ ભવ્ય ભંડાર ભર્યો હોય તે જોવામાં આવે. જોણે કાયોત્સર્જના સતત અભ્યાસથી અનુપ્રેક્ષા સિદ્ધ કરી છે, તે જ ધર્મકથાનો અન્યને સુંદર વિશિષ્ટ રીતે વિનિયોગ કરી શકે છે. અને સ્વકલ્યાણ સાથે પરકલ્યાણની સાધના કરી શકે છે.

સ્વાધ્યાયની આ શોચનીય સ્થિતિ સુધારવા માટે જલ્દી જાગવાની અને જાગીને કર્મે લાગવાની અત્યંત આવશ્યકતા છે.

૧૧ પરોની મહત્ત્વાન ભૂલીએ

પરોની સંસ્કૃતિના રક્ષક છે, ધર્મમાર્ગ પ્રવૃત્તિ કરાવનારા છે અને ઉચ્ચ કોટિનો આધ્યાત્મિક આનંદ આપનારા છે. આમ છતાં આજે તેની મહત્ત્વાની જાય છે, એ જોઈ કોને બેદ નહિ થાય ?

કટલાક કહે છે કે ‘આપણે તો બધા દિવસોને સરખા માનીએ છીએ, એટલે કે વર્ષનો અમુક દિવસ નાનો કે સામાન્ય અને અમુક દિવસ મોટો કે વિશેષ એમ માનીને વર્તતા નથી,’ આ શબ્દો પર કદાચ કોઈ તમને સમદાચિવાળા પુરુષ માની લે તો એ ગંભીર ભૂલ છે, કારણ કે આ શબ્દો સમદાચિમાંથી નહિ, પણ અજ્ઞાનમાંથી ઉદ્ભવેલા છે અને ધાર્મિક આચારો પ્રત્યે ઉપેક્ષા કે તિરસ્કારવૃત્તિ દર્શાવનારા છે.

જ્યાં નાના અને મોટા સામાન્ય અને વિશેષનો વિવેક કરવાનો હોય, ત્યાં સમાનતાની વાત કરવી અને જ્યાં સમાનભાવે વર્તવાનું હોય, ત્યાં નાના-મોટા કે સામાન્ય-વિશેષનો બેદ ઉપસ્થિત કરવો એ અજ્ઞાનનું પરિણામ છે અને ઉપર્યુક્ત શબ્દોમાં તેનો જ પડ્યો પડે છે.

જેમના સુધી સંસ્કૃતિનો પ્રકાશ પહોંચ્યો નથી કે ઘણો ઓછો પહોંચ્યો છે, તેઓ પણ જ્યારે વર્ષના અમુક દિવસોને સામાન્ય અને અમુક દિવસોને વિશેષ માની પોતાના પરોની ઊજવે છે, ત્યારે જેઓ સંસ્કૃતિનો પૂરો પ્રકાશ પાયા છે અને જેઓ કોઈ પણ વસ્તુના સામાન્ય અને વિશેષપણાને સારી રીતે પારખી શકવાની શક્તિ વાળા છે, તેમણે વર્ષના બધા દિવસોને સરખા માનીને પોતાનો જીવનવ્યવહાર ચલાવવો, એ ખેખર ! ઘણું જ અનુચિત છે.

મનુષ્યમાં હામ-દામ-ઠામ બૂધું હોય, પણ કર્તવ્યનો વિવેક ન હોય તો એ બધાનું મૂલ્ય શું ? મનુષ્યની વાસ્તવિક મહત્ત્વા, તેણે પ્રાપ્ત કરેલી લક્ષ્મી કે તેણે પ્રાપ્ત કરેલા અવિકાર પરથી નહિ, પણ તેનાં કર્તવ્યપાલન પરથી અંકાય છે, એટલે જે મનુષ્યો પોતાના કર્તવ્યોનું બરાબર પાલન કરે છે, તે ઉત્તમ ગણાય છે. જે અમુક અંશે પાલન કરે છે, તે મથ્યમ ગણાય છે, અને જે બિલકુલ પાલન કરતા નથી તે કનિષ્ઠ કે અધમ ગણાય છે. આ પરથી સર્વ દિવસોને સરખા માની ધાર્મિક કર્તવ્યો પ્રત્યે ઉપેક્ષા કરનારા કઈ કોટિમાં આવે તે સમજ શકશે.

પરંતુ હાલ તો પરિસ્થિત એવી છે કે ‘આપણું ધાર્મિક કર્તવ્ય શું ?’ એનો ખ્યાલ પણ ભૂલાતો જાય છે. થોડા દિવસ પહેલા બનેલી એક સત્યઘટના જેવું ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

વર્ણન એક પ્રસિદ્ધ લેખકે કરેલું છે, તે વાંચવાથી આપણાને આ વસ્તુ નો બધારે ખ્યાલ આવશે. તેઓ જણાવે છે કે-

‘થોડા બધત પહેલા અમારે એક કામ પ્રસંગે એક જૈનકુટુંબમાં જવાનું થયું. આ કુટુંબમાં પતિ-પત્ની અને બે બાળકો હતા. ધરમાં કામ કરવા માટે રસોઈયો તથા ધરધાટી રાખેલા હતા. પતિ અને પત્ની બંને સુશિક્ષિત હતા અને સ્વભાવે પણ ઘણાં માયાળું હતા. અમે ત્યાં ગયા ત્યારે પતિ ધરમાં ન હતા, એટલે પત્નીએ અમારું સ્વાગત કરીને પૂછ્યું કે ‘શું લાવું ? ચાહ બનાવું ?’

અમે કહ્યું : ‘ચાહ તો આ જિંદગીમાં હજુ સુધી પીધી નથી અને હવે પછી પીવાની પણ નથી.’

તો કોઝી લેશો ? તેમણે પૂરા વિનયથી પૂછ્યું.

અમે કહ્યું : ‘કોઈકવાર કોઝી લઈએ છીએ ખરા, પણ આજે તો એ પણ લેવી નથી, કારણ કે તેનો ત્યાગ કરેલો છે.’

‘તો ટમેટાનો સૂપ લેશો ? અમને કંઈક તો આપવું જ જોઈએ, એ વિચારથી તેમણે આ ગીજી દરખાસ્ત રજૂ કરી.’

અમે કહ્યું : ‘એ પણ નહિ ચાલે, કારણ કે આજે અણ્ણી છે.’

તેમણે કહ્યું : ‘ઓહ ! આજે તો અણ્ણી છે, ખરું ને ? આપણા લોકો તે દિવસે કંઈ લીલોતરી લેતા નથી. વારુ તો હું ગાજરનો સૂપ બનાવું છું, એ પુષ્ટિકારક હોય છે અને સ્વાદમાં પણ સારો લાગે છે.’

આ શબ્દો સાંભળી અમારાં દિલમાં ઊરી વેદના થઈ. એક સુશિક્ષિત (હાલની શિક્ષા પામેલા) કુટુંબમાં ખાનપાનનો કેવો વ્યવહાર ચાલી રહ્યો છે, તેનો ખ્યાલ આવ્યો. બધારે વેદના તો એ થઈ કે અણ્ણી-ચતુર્દશી જેવી મોટી તિથિઓનું પણ વિસ્મરણ થઈ રહ્યું છે અને લીલોતરી કોને કહેવાય ? કંદમૂળ કોને કહેવાય ? તેમાં શું ફેર ? કેટલો દોષ વગેરે ભૂલાઈ રહ્યું છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૨૦, તા. ૨૮-૧-૧૯૬૧

૧૨ (૨)

અમારી એ વેદના દબાવી અમે કહ્યું : ‘ગાજર લીલોતરી નહિ કે ?’

તેમણે કહ્યું : ‘એમાં પાંદડાં વગેરે ક્યાં હોય છે ? વળી ઘણા લોકો ઉપવાસ કરે છે, ત્યારે શાકભાજ નથી ખાતા, પણ ગાજર-સુરણ ખાય છે, એટલે મેં તમને આમ પૂછ્યું.’

અમે સમજ ગયા કે એક બાજુ માતા-પિતાના દ્વારા ધાર્મિક સંસ્કારો નથી અને બીજી બાજુ વૈષ્ણવ, સનાતનીઓ વગેરેનો વિશેષ પરિચય છે, તેનું જ આ પરિશામ છે. પરંતુ આજે તો શાળામાં, સામાજિક પ્રવૃત્તિઓમાં જ્યાં જોઈએ ત્યાં એ પરિચય ફરજિયાત જેવો થઈ પડ્યો છે. વળી વિભક્ત કુટુંબની પ્રથા વિશેષ પ્રમાણમાં દાખલ થતી જાય છે, એટલે કુલકમાગત આચારોમાં પણ શિથિલતા આવી રહી છે અને ત્યાં પોતાના સાધ્રીકોનો પરિચય પણ હોતો નથી. આ સ્થિતિ તેને આચારહીન જીવન ગાળવાનું નિભિત પૂરું પાડે છે.

અમે કહ્યું : ‘બહેન ! જેટલી વનસ્પતિ જીવંત હોય, અર્થાત્ લીલી હોય તે બધી જ લીલોતરી કહેવાય. એટલે ગાજર પણ લીલોતરી જ ગણાય. વળી તે જમીનમાં પેદા થાય છે, એટલે કંદમૂળ કહેવાય. તે ખાવામાં સામાન્ય લીલોતરી કરતાં ઘણું વધારે પાપ લાગે છે, એટલે તે આડા દિવસે પણ ન ખવાય, તો પછી પર્વના દિવસે તો ખવાય જ કેમ ?’

તેમણે કહ્યું : ‘બીજી લીલોતરી કરતાં કંદમૂળમાં વધારે પાપ કેમ ? આપણા ઋષિ-મુનિઓ તો માત્ર કંદમૂળ અને એવું જ ખાઈને રહેતા હતા.’

અહીં અમને વિચાર આવ્યો કે ‘જો નાનપણથી આ બહેન પાઠશાળામાં ગયા હોત અને જીવવિચાર ભણ્યા હોત તો આ પ્રશ્ન પૂર્ણવાનો વખત આવત જ નહિ. વળી આપણા અને અન્ય દર્શનીઓનાં ખાન-પાનમાં વિચારોમાં કેવો તફાવત છે ? તે સમજી શકત. પરંતુ માતા-પિતાઓને આજે પોતાના પુત્ર-પુત્રીઓને પાઠશાળામાં મોકલવાનો આગ્રહ નથી અને વ્યાવહારિક કેળવણી આપવાનો અતિ મોહ છે. તેનું જ આ પરિણામ છે.’

અમે કહ્યું : ‘બહેન ! જેમ માણસ-માણસમાં ફેર હોય છે, તેમ વનસ્પતિ-વનસ્પતિમાં પણ ફેર હોય છે. તેના પ્રત્યેક અને સાધારણ એવા બે ભાગો છે. પ્રત્યેક વનસ્પતિમાં એક ફલ, એક બીજ કે એક પાંદડે એક જીવ હોય છે. અને સાધારણ અનંત જીવોનું એક શરીર હોય છે. તેથી સાધારણ વનસ્પતિને અનંતકાય કહેવામાં આવે છે અને તે વાપરવામાં મોટો દોષ મનાયેલો છે. ગાજર, બટાટા, સૂરણ વગેરે તમામ કંદમૂળો વાપરવામાં આ પ્રકારનો દોષ છે.’

તેમણે કહ્યું : ‘વારુ મારા ખ્યાલમાં આવ્યું, તમે ગાજરનો સૂપ ન લેતા હો તો સૂકો મેવો લાવું દું. એમ કહી એક રકાબીમાં થોડા કાજુ અને દ્રાક્ષ લઈ આવ્યા અને તે અમારી સમક્ષ મૂક્યાં.’

અમે તેમનો આ પ્રકારે સ્વાગત કરવા માટે આભાર માન્યો અને કહ્યું : ‘એક વાત પૂર્ણવાનું મન થાય છે. તે તમે કહો તો પૂર્ણીએ.’

તેમણે કહ્યું : ‘ખુશીથી પૂછો’

અમે કહ્યું : ‘તમે મહિનામાં કોઈ પર્વતિથિ પાળો છો ખરાં ?’

તેમણે કહ્યું : ‘હું જુહું નહિ બોલુ, અમે કોઈ પર્વતિથિ પાળતા નથી. હું નાની હતી ત્યારે મારા પિયરમાં અમુક તિથિઓ પાળતી હતી, પણ ધીમે ધીમે એ બધું છૂટી ગયું અને હવે તો એ બાબતનો કાંઈ વિચાર પણ આવતો નથી.’

અમે કહ્યું : ‘આ તો ઉપર ચડવાની સીડીનાં પગથિયાં તૂટ્યાં ગણાય. પર્વો એ ઉપર ચડવાની સીડી છે. તે આપણાં મનમાં ધર્મની ભાવના જાગ્રત કરે છે, ધાર્મિક મહાપુરુષોનાં જીવનની યાદ આપે છે અને ધાર્મિક આચારણ કરવાનો ઉત્સાહ પેદા કરે છે. પર્વને ભૂલીએ એટલે ધર્મને ભૂલાય અને ધર્મને ભૂલીએ એટલે બધું ભૂલાય, પછી જીવનમાં બાકી શું રહે ? વધારે નહિ તો મોટી પર્વતિથિઓ તો અવશ્ય પાળવી જોઈએ.’

અમારી આ વાત સાંભળી કંઈપણ વધારે દલીલ કર્યા વિના તેમણે કહ્યું : ‘વારું તો તમે એક ભીતિયું જૈન પંચાગ મોકલી આપજો. હવેથી હું મોટી પર્વતિથિઓમાં લીલોતરી બિલકુલ નહિ વાપરું.’

અમે એ વાતનો સ્વીકાર કર્યો, એવામાં તેમના પતિ આવી ગયા. અમે તેમની સાથેનું કામ પતાવ્યું અને ઘરે પાછા ફરી પહેલું કામ તેમને ભીતિયું જૈન પંચાગ મોકલવાનું કરી આપ્યું.

આ પરિસ્થિતિ પર સહુ વિચાર કરે અને પર્વોનું મહાંજ ન ભૂલાય એવું વાતાવરણ ઉત્પન્ન કરે.

ઊંઘના કલાક ન ગણો

પૂજ્યશ્રીએ મને સવારે વહેલો ઊઠાડ્યો : “ઊઠ, સ્વાધ્યાય કરવા ઊઠવું છે ને ?”

“રાત્રે હું મોડો સૂતો હતો...હજુ ઊંઘ આવે છે.”

“એ તો તું ઊંઘના કલાક ગણો છે એટલે ઊંઘ આવે છે. શરીરનું તો એવું છે કે સૂતા એટલે ઊંઘ અને જાગ્યા એટલે સ્કૂર્ટ. ઊંઘ અને ભૂખ વધારીએ એટલા વધે ને ઘટાડીએ એટલા ઘટે...”

પૂજ્યશ્રી અસાધારણ કોટિનો અપ્રમત્તાભાવ કેવી રીતે આત્મસાત્ કરી શક્યા હશે તેનું રહસ્ય મને ત્યારે સમજાયું.

W -“ભુવનભાનું એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્યા

૧૩ જપ અંગો કેટલીક વિચારણા

(૧)

શાસ્ત્રોમાં કહ્યું છે કે - પૂજાકોટિસમં સ્તોત્રં, સ્તોત્રં કોટિસમો જપઃ-કોડવાર પૂજા કરવામાં આવે તેટલું ફળ સ્તોત્રનું છે અને કોડવાર સ્તોત્ર બોલવામાં આવે તેટલું ફળ જપનું છે, એટલે જપ એ કોઈ સામાન્ય કે સાધારણ વસ્તુ નથી. પણ એક ઉત્તમ કોટિની વસ્તુ છે અને તેથી જ તે ધાર્મિક આચારો કે અનુષ્ઠાનમાં અતિ માનભર્યું સ્થાન પામેલ છે.

અભ્યંતર તપમાં ગ્રાયશીલ પછી વિનયનો, વિનય પછી વૈયાવૃત્યનો અને વૈયાવૃત્ય પછી સ્વાધ્યાયનો અધિકાર આવે છે. આ સ્વાધ્યાય શુરૂતના અભ્યાસરૂપ પણ હોય છે અને મંત્રપદના જપરૂપ પણ હોય છે, એટલે તે કર્મનિર્જરાનું એક કારણ છે અને તેથી સર્વ મુખ્યાઓએ નિત્ય કરવા યોગ્ય છે.

જપ મંત્ર જે કરાય છે, અથવા જેનો જપ કરવામાં આવે છે, તેને મંત્ર કહેવાય છે, આ મંત્ર એક અક્ષરથી માંડીને અનેક અક્ષરનો હોય છે. તેમાં ય જે મંત્ર સિદ્ધ અને સાધ્ય કોટિનો હોય તે ઉત્તમ ફળ આપે છે, એટલે તે જ ગ્રહણ કરવો જોઈએ. બાકીના ગ્રાય પ્રકારના મંત્રોમાં સુશુદ્ધનું ફળ મધ્યમ. શરૂનું ફળ કર્નિષ્ઠ અને મૃત્યુદાયીનું ફળ ઘણું જ ખરાબ હોય છે, એટલે છેલ્લા બે ગ્રહણ કરવા યોગ્ય નથી.

મંત્રજપ કરનાર કેવો હોવો જોઈએ ? તે માટે શાસ્ત્રોમાં પર્યાપ્ત વિવેચન થયેલું છે. શ્રી ભદ્રગુપ્તાચાર્ય વિદ્યારત્નમહાનિધિમાં કહ્યું છે કે મંત્ર ગ્રહણ કરવા માટે અર્થાત્ જપ કરવા માટે તે જ વ્યક્તિ યોગ્ય છે જે દક્ષઃ એટલે ચતુર હોય, જિતેન્દ્રિયઃ એટલે પાંચેય ઈદ્રિયો પર કાબૂ રાખનાર હોય, ધીમાન્ એટલે બુદ્ધિશાળી હોય -સારાખોટાનો વિવેક કરી શકે તેવો હોય, કોપાનલજલોપમઃ એટલે કોધરૂપી અગ્નિને શમાવવા માટે જલ જેવો હોય, સત્યવાદી એટલે સત્ય બોલનારો હોય, વિલોભઃ એટલે લોભથી રહિત હોય, માયામદ-વિર્વજિત એટલે કપટ અને મદ વિનાનો હોય, માનત્યાગી એટલે અહંકારનો ત્યાગ કરનારો હોય, દયાયુક્તઃ એટલે દ્યા કરુણા કે અનુકૂળપાના પરિણામવાળો હોય, પરનારી સહોદરાઃ એટલે પોતાની પણ સિવાય અન્ય સર્વ સ્ત્રીઓને બહેન સમાન ગણનારો હોય અને જિનેન્દ્રગુરુભક્તઃ

એટલી શ્રી જિનેશ્વર દેવ અને નિર્ગ્રથ ગુરુઓ પ્રત્યે અત્યંત ભક્તિ ધરાવનારો હોય.

આજે કેટલાક ફરિયાદ કરે છે કે મંત્રનો ઘણો જપ કરવા છતાં અમને કોઈ ફળ દેખાતું નથી, તેમણે આ વસ્તુ પર ખાસ લક્ષ આપવું જોઈએ. યોગ્યતા વિના ગમે તેવો સુંદર કે પ્રભાવશાળી જપ પણ ફળદાયી થતો નથી. અષ્ટાંગ્યોગમાં જે મહત્વ યમ-નિયમોનું છે, તે જ મહત્વ મંત્ર જપમાં આ નિયમોનું છે. એટલે મંત્ર જપ કરનારે આ ગુણો કેળવવા તરફ ખાસ લક્ષ આપવું જોઈએ.

જે મંત્ર યોગ્ય ગુરુ પાસેથી વિધિપૂર્વક ગ્રહણ કરેલો હોય તેજ ફલદાયી થાય છે, તેથી મંત્ર જપ કરનારે તેને ગુરુ પાસેથી વિધિપૂર્વક ગ્રહણ કરવાની કાળજી રાખવી જોઈએ. પુસ્તકમાંથી મંત્ર વાંચીને તેનો જપ કરવા બેસી જવું એ મંત્રજપ કરવાની સાચી રીત નથી. નમસ્કાર મંત્ર પણ ગુરુ આગળથી વિધિપૂર્વક ગ્રહણ કરીને પછી જ તેનો જપ કરવો જોઈએ.

જપ દેવતાની સંસુખ કરવો જોઈએ. એટલે જપ કરનારે કોઈ મંદિરમાં કે જ્યાં દેવતાની છબી વગેરે હોય ત્યાં કરવો યોગ્ય છે. વિકલ્પે સ્વચ્છ જળવાળા જળશયોની આગળ કે પત્ર-પુષ્પ-ફલથી લચી પડેલાં વૃક્ષોવાળાં વન પ્રદેશમાં પણ કરી શકાય.

જપ કરવા માટે જે સ્થાનનો ઉપયોગ કરવાનો હોય તે સ્થાન શુદ્ધ હોવું જોઈએ, એટલે કે તેની નીચે યા તેની આસપાસ કોઈ મૂત્રપાણીનું કલેવર પડેલું ન હોવું જોઈએ કે રૂધિર, માંસ, અસ્થિ તથા બીજા અશુચિવાળા પદાર્થ હોવા ન જોઈએ.

મંત્રજપ કરતી વખતે શરીર, વસ્ત્ર, આસન તથા માળા શુદ્ધ હોવા જોઈએ, જે આસન કે માલા બીજાએ વાપરેલા હોય તે ઉપયોગમાં લેવા નહિ. તે માટે પોતાનું ખાસ આસન અને ખાસ માળા જ હોવી જોઈએ. માળાનો ઉપયોગ કરતાં પહેલાં તેને દૂધ વગેરેથી ધોઈ સુગંધી ધૂપથી ધૂપી લેવી જોઈએ અને વિશિષ્ટ મંત્રોચારથી શુદ્ધ કરી લેવી જોઈએ. ચિત્તશુદ્ધિ માટે શેતરંગની માળા જ વિશેષ પસંદ કરવા યોગ્ય છે.

મંત્રજપ કરનારે પૂવાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસવું જોઈએ અને મુદ્રા વળેરેનું જ્ઞાન અગાઉથી યોગ્ય ગુરુ પાસેથી મેળવી લેવું જોઈએ. માણા કરતાં મુદ્રાદિ વે કરાયેલા જપ વધારે ફલદારી થાય છે.

જપ બને ત્યાં સુધી એકાંતમાં બેસીને જ કરવો જોઈએ અને તે કોઈપણ ‘તપશ્ચર્યાપૂર્વક કરવો જોઈએ. જે દિવસે ભોજન કર્યું હોય, તે દિવસે જમીને તરત જપ ન કરતાં કેટલુંક અંતર પાડીને જપ કરવો જોઈએ.’

જપ કરવા માટે ત્રિસંધ્યાનો સમય ઉત્તમ છે. તેમાં પણ પ્રાતઃસંધ્યા એટલે સૂર્ય ઉંઘા પહેલાંની ૨૪ મીનીટ અને સૂર્ય ઉંઘા પછીની ૨૪ મીનીટનો સમય વધારે ઉત્તમ છે. નમસ્કાર જેવો સિદ્ધ મંત્ર ગમે ત્યારે જપી શકાય છે. છતાં ઉપર જગાવેલો સમય વધારે ઉપયોગી છે.

મંત્રજપ બોલીને, બોલ્યા વિના, તેમજ માત્ર મનની વૃત્તિએ પણ થાય છે, તેમાં જે મંત્રજપ મંત્રપદોના શુદ્ધ-સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક બીજા સાંભળી શકે તે રીતે બોલીને કરવામાં આવે છે, તેને ભાષ્ય, વાચિક કે શાષ્ટ કહેવામાં આવે છે. પ્રાથમિક ભૂમિકાવાળાને આ જપ ધણો ઉપયોગી છે. તેનો ખાસ લાભ એ છે કે તેથી મંત્રની ઉચ્ચારશુદ્ધિ થઈ જાય છે અને મનનો વિક્ષેપ ધટાડવામાં ઠીક ઠીક મદદ મળે છે. જે આ જપનો અભ્યાસ કર્યો વિના બીજા કે ગીજા પ્રકારનો જપ કરવા લાગે છે, તેમનો એ જપ જોઈએ તેવો શુદ્ધ થઈ શકતો નથી.

બોલ્યા વિના એટલે હોઠ હલાબ્યા વિના મંત્રનો જપ કરવો તેને ઉપાંશુ કે મૌન જપ કહેવામાં આવે છે. આ જપ પહેલાં કરતાં ઉચ્ચ કોટિનો છે અને તેનું ફળ ધણું વધારે છે.

માત્ર મનની વૃત્તિએ જપાતાં જપને માનસ જપ કે ચિત્તસ્થ જપ કહેવામાં આવે છે. તે પ્રમાણમાં ધણો કઠિન છે, પણ અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે. આ જપ પ્રથમના બંને પ્રકારો કરતાં શ્રેષ્ઠ ગણાય છે.

ઉપાંશુ જપ અને માનસ જપ વચ્ચે સાર્થ જપની એક ભૂમિકા છે, તેનો પણ અહીં નિર્દેશ કરવો જોઈએ. સાર્થ જપ એટલે જે મંત્રપદ બોલાતું હોય, તેના અર્થ સાથેનો જપ દાખલા તરીકે જપમાં ‘નમો અરિહંતાણ’ પદ બોલાતું હોય તો એ પદ બોલતાની સાથે અંતર્યક્ષુ સમક્ષ સમવરસરણામાં બેઠેલા શ્રી અરિહંત ભગવંતનું ચિત્ર ખંડું થવું જોઈએ. સુંદર અશોકવૃક્ષ, દેવતાઓએ કરેલી પુષ્પની વૃષ્ટિ, ચાલુ

દિવ્યધ્વનિ, બંને બાજુ વીજાઈ રહેલા શેત ચામરો, રત્નમય સુંદર સિંહાસન, પ્રભુના મુખારવિદની પાછળ તેજસ્વી ભામંડળ, દેવ-હુદુભિનો નાદ અને માથે ઉપરાઉપર ત્રણ છતનું ધરાતું વગેરે આઠે પ્રતિહાર્ય સહિત ભગવંતની મૂર્તિ નજર સમક્ષ આવી જાય ત્યારે ‘નમો અરિહંતાણ’નો સાર્થ જપ થયો કહેવાય.

ચિત્તને એકાગ્ર કરવા માટે આ જપ ધણો ઉપયોગી છે. તેનાથી વિચાર, લાગણી અને ભાવનાઓ ઉપર ધણી મોટી અસર થાય છે અને તે સિદ્ધિના માર્ગ લઈ જવામાં ઉપયોગી નીવડે છે.

માનસ જપ પછી પણ એક ભૂમિકા છે કે જેને ધ્યેયક્ય જપ કહેવામાં આવે છે, પરંતુ આ જપમાં રટણ જેવું તો કાંઈ હોતું જ નથી. તેમાં મંત્રજપ કરનારો આત્મા ધ્યેયમાં એકાકાર થઈ જાય છે અને તેથી મંત્રજપ કરનારને અનિર્વચનીય આનંદનો અનુભવ થાય છે.

આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે મંત્રગૈતન્ય પ્રકટ થાય છે અને તેના દ્વારા અપૂર્વ સિદ્ધિનો લાભ મળે છે.

શાસ્ત્રમાં જપના તેર પ્રકારો પણ વર્ણિવેલા છે. જેમ કે (૧) રેચક, (૨) પૂરક, (૩) કુંભક, (૪) સત્ત્વ, (૫) રજસ્, (૬) તમસ્, (૭) સ્થિરકૃતિ, (૮) સ્મृતિ, (૯) હક્કા, (૧૦) નાદ, (૧૧) ધ્યાન, (૧૨) ધ્યેયક્ય અને (૧૩) તત્ત્વ. પરંતુ સામાન્ય આરાધકોને તો અમે ઉપર જપના જે ત્રણ તથા પાંચ પ્રકારો વર્ણિવ્યા તે જ અતિ ઉપયોગી છે.

જપમાં મુખ્ય વાત ચિત્તની એકાગ્રતાની છે, એટલે મુમુક્ષાએ મુખ્ય લક્ષ્ય ચિત્તની વૃત્તિઓ આમ તેમ દોડે નહિ, એવી સ્થિતિ પેદા કરવા તરફ આપવાનું છે, અને શાસ્ત્રકારોના અભિપ્રાયથી એવી સ્થિતિ તો જ પેદા થાય છે કે જ્યારે મનુષ્યનું મન વિષયભોગ તરફથી પાછું વળી આત્માનો સાક્ષાત્કાર કરવા તરફ રૂચિવાળું થાય, એટલે મંત્રજપ કરનારે વેરાંય અને સત્સંગ કેળવવાની પણ અત્યંત આવશ્યકતા છે.

સહુ કોઈ મંત્રજપને લગતી આ વસ્તુ જ્યાલમાં રાખી પોતાનું અભીષ્ટ સાધે, એ જ અભ્યર્થના.

૧૫ ‘સાધર્મિક-વાત્સલ્યમાં’ ઉત્સાહ દાખવો

સાધર્મિક-વાત્સલ્ય, સાધર્મિક ભક્તિ કે સાધર્મિક સેવા એ જૈનાચારનો એક ભાગ છે. દર્શનાચારમાં તેને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયેલું છે અને તેના પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. અને તેનું જ એ પરિણામ છે કે આજ સુધીમાં અનેક મહાનુભાવોએ તેની પાછળ ઘણું ધન બચ્યું છે અને ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે.

કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો પાઠણ શહેરમાં પ્રવેશ હતો. ભારે સામૈયું ચહેરું હતું. બહોંતેર રાજાઓ અને અઢાર હજાર શ્રાવકો એ સામૈયામાં સામેલ હતા. મહારાજા કુમારપાળ મોખરે ચાલતા હતા. તેમણે આગળ વધી આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત કર્યું અને વિષિપુરઃસરવંદના કરી. આ વખતે તેમનું ધ્યાન આચાર્યશ્રીએ ઓછેલ ખાદીના એક જાડાં કપડાં તરફ ગયું. એ તેમનાથી રહેવાયું નહિ. તેમણે વિનન્દ્ર ભાવે કર્યું ‘ભગવન્ ! આપ તો મારા ગુરુ ગણાઓ અને આવાં જાડાં વસ્ત્રો ધારણ કરો તે ઠીક નહિ, એથી મને ઘણી શરમ આવે છે.’

આચાર્ય મહારાજે કહ્યું : રાજન ! આ વસ્ત્ર તારા એક સાધર્મિક બંધુએ વહોરાયું છે અને તે અમે ધારણ કર્યું છે. અમને મુનિઓને શું ? અમને તો અલ્ય મૂલ્યવાળાં અને જીર્ણ વસ્ત્રો શોભે !

કુમારપાળ આ ઉત્તર સાંભળી વિચારમાં પડ્યો. ‘પોતાનો એક સાધર્મિક બંધુ આવા મહાન આચાર્યને આવું કપું કેમ વહોરાવે તે સમજાયું નહિ. તેણે પ્રશ્ન કર્યો ભગવન્ ! શું આ વસ્ત્ર મારા એક સાધર્મિક બંધુએ વહોરાયું છે ? આટલું જાડું ! આટલું ખરાબ !’

આચાર્ય મહારાજે કહ્યું : રાજન્ ! જેની પાસે જે હોય તે વહોરાવે. જ્યાં આજીવિકા ચલાવવાના પણ ફાંફા હોય ત્યાં બીજું શું બને ? તું પૃથ્વી પર રાજ કરે છે, પણ તારા સાધર્મિક બંધુઓ કેવી હાલતમાં રહે છે, તે કદી ધ્યાન પૂર્વક જોયું છે ખરું ? એવી સાધર્મિકોની સ્થિતિથી જો તેને શરમ નહિ તો અમારાં જાડાં વસ્ત્ર ઓછવાથી તારે શરમાવાનું શું ? તેજ વખતે કુમારપાળે નિર્ણય કર્યો કે મારે દરેક વર્ષ સાધર્મિક-વાત્સલ્ય કરવું અને નિરાધાર શ્રાવકને હજાર સોનામહોર આપવા, આ પ્રમાણે સાધર્મિક-વાત્સલ્ય કરવા માંડયું. ત્યારે એક વર્ષની લગભગ એક કરોડ સોનામહોરનો ખર્ચ થયો પણ તેને પૂરી પ્રસન્નતા હતી કે મારા હાથે એક સુંદર

અતિ સુંદર કાર્ય થઈ રહ્યું છે. ચૌદ વર્ષ સુધી તેણે આ રીતે સાધર્મિક-વાત્સલ્ય કર્યું અને ચૌદ કરોડ સોના મહોરનો ખર્ચ કર્યો.

વસ્તુપાળ તેજપાલે તો સાધર્મિકના પગ ધોવામાં પણ ગૌરવ માન્યું હતું. આભૂશાહ, પેથડકુમાર, જગતુ શાહ વગેરેની વાત પણ આપણા હદ્યમાં સાધર્મિક-વાત્સલ્યની ભવ્ય ભાવના પેદા કરે તેવી છે. આમ છતાં આજે આપણી સાધર્મિક-વાત્સલ્યની ભાવના કેમ મંદ પડી રહી છે ? એ અમને સમજાતું નથી.

સાધર્મિકોને જમાડવાની પ્રવૃત્તિ તો આજે પણ ચાલે છે, પણ તેટલાથી સાધર્મિક-વાત્સલ્યનું કાર્ય પૂર્ણ થઈ જતું નથી. આજે હજારો સાધર્મિકો કફોડી સ્થિતિમાં આવી પડ્યા છે. કેટલાકના ધંધા ખોરવાઈ ગયા છે, કેટલાકને ખાવા-પીવા તથા રહેવાની સગવડ નથી. કેટલાકને પોતાનાં બાળકોને ક્યાં કેવી રીતે ભજાવવા ? એ મોટો પ્રશ્ન છે. શું આ બધા પ્રત્યે આપણે વાત્સલ્ય દર્શાવી, તેમને સહાયભૂત થઈએ છીએ ખરા ? કેટલા અંશે ? કેવી રીતે ? આ બધું વિચારણીય છે.

સાધર્મિક એ પારકો નથી. પોતાનો છે તે ધર્મના સંબંધથી આપણી સાથે જોડાયેલો છે. તેનો અને આપણો સંબંધ એક એવી જાતનો સંબંધ છે કે જેની અન્ય સંબંધો સાથે સરખામણી થઈ શકે નહિ, પરંતુ આ વસ્તુ ભૂલાઈ રહી છે, અને કદી જ્યાલમાં હોય તો પણ આપણે એ માટે જેટલો ઉત્સાહ દર્શાવવો જોઈએ તેટલો દર્શાવતા નથી. આનું પરિણામ શું આવશે, તેનો ગંભીરતાથી વિચાર કર્યો છે ખરો ?

‘સાધર્મિકથી સંધ ટકે છે અને સંધથી ધર્મ રહે છે’ એ વાત આપણા પૂર્વચાર્યોએ કહી છે. અને તે આપણે બરાબર લક્ષ્યમાં રાખવા જેવી છે. તે પ્રત્યેની બેદરકારી કેવાં માઠાં પરિણામ લાવશે, એ આજે દેખાવા માંડયું છે. અને નહિ ચેતીએ તો વધારે માઠાં પરિણામો દેખવાનો વખત આવશે, માટે સાધર્મિક-વાત્સલ્યમાં ઉત્સાહ દાખવો અને આપણું કર્તવ્ય અદા કરો.

૧૬ સમાજની મહાન સેવા

એક વિચારક કહે છે કે ‘દીવા તરફ જેમ પતંગિયાં આકર્ષય છે, તેમ શહેરોના બાબ્ય ઝગમગાટથી આકર્ષણીને લાખોની સંખ્યામાં, ગામડામાંથી અહીં ચાત્યા આવતા ગરીબ અને મધ્યમવર્ગના માનવપ્રવાહને જોઈ નવાઈ લાગે છે. ધરબાર વગર, ખાવા પીવાનાં ઠેકાણાં વગર, સખ અને દુયાપાત્ર નોકરી કે મહેનત મજૂરી કરવા છતાંય શહેરને વળગી રહેવા હથ્થતો આ સમુદ્દરય આખરે કઈ આશાનાં બળ પર ધરબાર, મા-બાપ, પત્ની, કુટુંબ-કબીલો છોડીને અહીં પડ્યો રહે છે, તે ભાગે જ સમજ શકાય તેમ છે. શહેરોની આ મોહિનીને નષ્ટ કરી, ગામડાંઓમાં જીવનનું આકર્ષણ ઊભું કરવું તે વાત આજે સૌથી વધુ જરૂરી છે.’

શહેરોમાં બેફામ રીતે ફાલતા ફૂલતાં વિલાસનાં સાધનો અને રીતરસમો, અનાત્મવાદી પાણીમીય સંસ્કૃતિનો મોહ, હિંસાદિ દુરાચારોના પ્રચાર વગેરે જોતાં અમને લાગે છે કે આ શબ્દો સાવ સાચા છે, પણ ગામડામાં આકર્ષણ ઊભું શી રીતે થાય ? એ એક ગંભીર પ્રશ્ન છે. તે માટે આજ સુધીમાં નાનીમોટી અનેક યોજનાઓ બહાર પડતી રહી છે, પણ તેથી પરિસ્થિતિ સુધરી નથી. એટલું જ નહિ પણ તે વિશેષ બગડવા પામી છે, અને આજે પણ બગડવાનું ચાલુ છે. જે શહેરોમાં આજથી દશ વર્ષ ઉપર બે લાખની વસ્તી હતી, ત્યાં આજે વસ્તીનો આંકડો આઠ, દશ કે બાર લાખ સુધી પહોંચ્યો છે. એટલે જે યોજનાઓ રજૂ થાય છે, તે ખામી ભરેલી છે અને તેનો વધારે ઊંડાણથી વિચાર કરવાની જરૂર છે. જો રોગનું નિદાન જ સાચું હોય તો ઔષ્ણ અસરકાર શી રીતે નીવડે ?

સાદું-સીધું જીવન ગાળતી ગામડાની પ્રજાને શહેરોનું આકર્ષણ થવાનું એક મુખ્ય કારણ ભૌતિકવાદે ઊભી કરેલી ભ્રમણ છે. ‘સુખ સાદાઈમાં નથી, રંગરાગમાં છે અને તેનાં સાધનો શહેરમાં પુષ્ટ છે. આપણે ત્યાં તેમાનું કશું નથી. માટે ચાલો શહેરમાં.’ તેની આ ભ્રમણ જ્યાં સુધી ભાંગે નહિ, ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ જ રહેવાની.

આજે ભૌતિકવાદનો ભયંકર પ્રચાર થઈ રહ્યો છે. દૈનિકપત્રો, અઠવાડિકો, માસિકો ત્રૈમાસિકો બધામાં તેનાં ગુણગાન આવે છે. શાળાનાં પાઠ્યપુસ્તકોમાં પણ એ જ સ્થિતિ છે. નેતાઓનાં પ્રવચન અને સમાજસુધારકોનાં વ્યાખ્યાનો પણ આજે

સીધી કે આઉકતરી તેની જ હિમાયત કરે છે. પરિણામે લોકોનાં મનમાં એવી હવા પેદા થઈ રહી છે કે ‘આ જીવનમાં જેટલી મોજમજાહ કરી લેવાય તેટલી કરી લેવી.’ અને શહેરમાં તેનાં વિવિધ સાધનો ગોઈવાયે જ જાય છે. વૈજ્ઞાનિક શોધઘોળો તેમાં મદદ કરે છે. અને જેઓ સમાજના આગેવાન કહેવાય તે આમાં પૂરી દિલયસ્પી ધરાવે છે.

‘જે મોટા કરે તે નાના કરે’ એ ન્યાયે ગામડાના લોકોને એમ લાગે છે કે સુખી થવું હોય તો પણ આજ રીતે જીવનું જોઈએ. એટલે ખરી જરૂર વિચાર પરિવર્તનની છે. જે લોકોનાં મનમાં ધૂસી ગયેલા મિથ્યા વિચારો દૂર થાય તો જ તેમની પ્રવૃત્તિમાં ફર પડે.

શહેર એટલે આધુનિક વિજ્ઞાન, ગામડું એટલે ભારતની પ્રાચીન સંસ્કૃતિ. એ રીતે વિચાર કરીએ તો આ પ્રક્રિયા ભારતની પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવાનો છે. એ દિશામાં આજે શું થઈ રહ્યું છે ? અલબત્ત, આપણા સાધુમહારાજો એ માટે ઉપદેશ આપી રહ્યા છે, પણ તે ગામડામાં ઓછું ફર છે, આથી ગ્રામ્ય લોકોના સહવાસમાં ઓછા આવે છે. તેમનો વિહાર જો ગામડામાં થાય અને તેઓ લોકોને આ માટે જોરદાર ઉપદેશ આપતા રહે, તોય પરિસ્થિતિમાં ઘણો ફરક પડી જાય.

બીજી બાજુ સંયોગો જોતાં દેખાય છે કે ખેતીવાડીની ઉપજમાં ઘટાડો અને નાના ઉદ્યોગોમાં નાશ પામવાથી ગ્રામવાસીઓમાં પણ કનિષ્ઠ ગણાતી નોકરીના નાદ લાગ્યા છે. પછી લોકોને શહેર તરફ ઢોરી જવાનું મન થાય, એ સહજ છે. લોકોની આ સમજણ સુધારવી જોઈએ. વળી ડોશીમાનું વૈદું અને આયુર્વેદના ઉપાયો મૂકી આજની ડાકટરી એલોપથીની ખર્ચાળ અને અભક્ષય સુધીની પદ્ધતિનો લાગેલો મોહ પણ નીકળી જાય એની સમજણ તથા યોજના થવી જોઈએ.

આ બધું અમે એટલા માટે લખી રહ્યો છીએ કે સમાજમાં ધર્મ-સંસ્કૃતિ અને ધાર્મિક આચારવિચાર ટકી રહે, માટે ભૌતિકવાદના વિકાસની સામે સવેળા ચેતી જઈ ધર્મ-સંસ્કૃતિના રક્ષણ માટે ભરપૂર પ્રયત્ન કરવાની અતિ આવશ્યકતા છે.

આ માટે મુખ્ય વાત તો અમે ઉપર જણાવી તે જ છે કે લોકોની સમજણમાં પરિવર્તન લાવો. લોકોની દણ્ણ સુધારો. સમાજની એ મહાન સેવા છે.

૧૭ જિન શબ્દનું રહસ્ય

(હાલમાં જૈનધર્મ-દર્શન નામનો એક મહત્વનો ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. તેમાં જૈનધર્મ અને દર્શનની વિશેષતાઓ પર સુંદર પ્રકાશ પડવા સંભવ છે, જૈન-જૈનેતર સર્વે અને રસપૂર્વક વાંચે અને જૈનધર્મ-દર્શનનું વિશેષ મહત્વ સમજે એ શૈલિએ તૈયાર થઈ રહ્યો છે. તેનાં ધર્મ પ્રવર્તક પ્રકરણમાંથી નીચેનો ભાગ પાઠકોની જાણ માટે અહીં રજૂ કરવામાં આવે છે. સં.)

જિન શબ્દ જિ (જીતવું) ધાતુ પરથી બનેલો છે, એટલે તેનો અર્થ જિતનાર થાય છે. શું જિતનાર ? તે અહીં અધ્યાહાર છે, પણ જૈન શાસ્ત્રોમાં અવલોકન પરથી તેનો ખુલાસો મળી રહે છે. પ્રસિદ્ધ જિજ્ઞાગમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે-

અપ્પા ચેવ દમેયવો, અપ્પા હુ ખલુ દુદમો ।

અપ્પા દન્તો સુહી હોઇ, અસ્સિસ લોએ પરત્થ ય ॥ (૧. ૩૫)

‘આત્મા જ દમવા યોગ્ય છે. આત્મા જ બરેખર ! દુર્દ્ય છે, જે આત્માનું દમન કરે છે, તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે.’

અહીં આત્માથી પોતાની જાતનું સૂચન છે કે જેમાં અનેક પ્રકારની દુષ્ટ વૃત્તિઓ છૂપાઈને રહેલી છે. આ દુષ્ટ વૃત્તિઓનું દમન કરવું તે આત્મદમન.

જો સહસ્રં સહસ્રાનં, સંગામે દુજ્જએ જિએ ।

એણ જિણેજ્જ અપ્પાણ, એસ સે પરમો જાઓ ॥ (૧. ૩૪)

જે દુર્જ્ય સંગ્રામમાં સહભ્ર-સહભ્ર યોગ્યાઓને-શત્રુઓને જિતે છે, (તેને અમે ખરો જ્ય માનતા નથી.) એના કરતાં એક આત્માને જ જિતવો, તે જ પરમ જ્ય છે.’

આ પરથી સ્પષ્ટ થાય છે કે જિતનાર એટલે પોતાના આત્માને જિતનાર, પોતાના અંત:કરણમાં રહેલી દુષ્ટવૃત્તિઓને જિતનાર. આગળની ગાથા આ સંબંધમાં વધારે પ્રકાશ પાડે છે.

અપ્પાણમેવ જુજ્જાહિ, કિંતે જુજ્જેણ બજ્જાઓ । અપ્પાણમેવ અપ્પાણ જિત્તા, સુહમેહાપ ॥ (૧. ૩૫)

‘હે પુરુષ ! તું પોતાની આત્માની સાથે જ યુદ્ધ કર. તું ભાવ શત્રુઓ સાથે

યુદ્ધ શા માટે કરે છે ? જે આત્મા વડે આત્માને જીતે છે, તે સુખ મેળવે છે.’

આ પરથી એટલું નક્કી થાય છે કે અહીં ભાવ શત્રુઓ સાથે લડીને તેમને જીતવાની વાત નથી, પણ આંતરિક શત્રુઓ સાથે લડીને તેમને જીતવાની વાત છે. આ લડાઈ કેમ કરવી, તે પણ અહીં દર્શાવેલું છે. આત્મા વડે આત્માને જીતવો, એટલે પોતાનું આત્મભળ વધારીને-સંકલ્પશક્તિ વધારીને અંત:કરણમાં રહેલી દુષ્ટવૃત્તિઓ પર કાબૂ મેળવો. કોઈ એમ માનતું હોય કે ‘એમ કરવા જતાં આપણે હુઃખમાં ભેરવાઈ પડીએ.’ તો મહાપુરુષો પોતાના અનુભવ પરથી ભાતરી આપે છે કે આ રીતે પોતાનાં અંત:કરણની દુષ્ટવૃત્તિઓને જીતનાર સુખી થાય છે.

તાત્પર્ય કે જે પોતાના અંતરશત્રુઓને જીતી લે છે, તે જિન કહેવાય છે.

હજ થોડું વધારે. તે સિવાય જિન શબ્દના વાસ્તવિક રહસ્ય સુધી પહોંચી શકાશે નહિ.

અંતરના શત્રુઓની ગણના અનેક પ્રકારે થાય છે. પણ જૈનધર્મનાં અભિપ્રાયથી અંતરનો મોટામાં મોટો શત્રુ મોહ છે, કારણ કે રાગ, દ્રેષ, કામ, કોધ, માન, માયા, (કપટ), લોભ (તૃષ્ણા) વગેરે દુષ્ટવૃત્તિઓ તેના લીધે જ ઉદ્ભબવે છે, એટલે મોહનો સર્વથા નાશ કરી નિર્મોહી કે વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરવી અને આત્મભાવમાં સ્થિર રહી પરમ શાંત દશાનો અનુભવ કરવો, એ ‘જિન’-અવસ્થાનું સાચું રહસ્ય છે. જે આ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે અવશ્ય પરમાત્મપદને પામે છે.

ભગવદ્ ગીતામાં આ વાતનું સમર્થન થયેલું છે, તો અમે તેના જ શબ્દોમાં રજૂ કરીશું. છંડા અધ્યાત્મમાં નીચેના શ્લોકો આવે છે.

ઉદ્ઘરેદાત્મનાત્માન, નાત્માનમવસાદયેત । આત્મૈવદ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ॥

પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો, (પણ) પોતાને અધોગતિએ ન લઈ જવો, કેમ કે પોતે જ પોતાનો બંધુ છે અને પોતે જ પોતાનો શત્રુ છે.

જિતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ ।

શીતોળસુખદુઃખેષુ તથા માનાપમાનયો: ॥

‘ટાઠ-તાપ, સુખ-દુઃખ, તથા માન-અપમાનમાં જેણે આત્મા જીત્યે છે, તેવા અતિ શાંત પુરુષનો આત્મા પરમાત્મા થાય છે.’

ભગવદ્ગીતા સર્વ ઉપનિષદોના દોહનરૂપ છે, એ વાત ‘સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલનન્દનઃ’ એ શબ્દો વડે પ્રકટ થાય છે, એટલે આ અવસ્થાને ઉપનિષદો પણ અભિનંદે છે, એમ માનવું અયોગ્ય નથી.

યોગવાસિએ તો પ્રકટ શહેરમાં જિન અવસ્થાનું બહુમાન કરેલું છે. વૈરાગ્ય પ્રકરણમાં તે શ્રીરામના મુખમાં નીચેના શબ્દો મૂકે છે.-

नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः ।

शान्तिमास्थातुमिच्छामि स्वात्मन्येव जिनो यथा ॥

‘હું રામ નથી, મારે કોઈ વસ્તુની ઈચ્છા નથી, હવે પદાર્થોમાં મારું મન રમતું નથી. જેમ જિન પોતાના આત્મામાં શાંત ભાવથી રહે છે, તેમ હું પણ શાંત ભાવથી રહેવા ઈચ્છા છું.’

સાચી હક્કિકત એ છે કે પ્રાચીન કાળમાં ભારતની અધ્યાત્મ અને યોગગ્રિય પ્રજાને જિનપદનું ભારે આકર્ષણ થયું હતું અને તેથી જે કોઈ અધ્યાત્મ કે યોગમાં ધણા આગળ વધી જતા તેઓ પોતાને જિન કહેવડાવવામાં ભારે ગૌરવ સમજતા હતા. આજ્ઞવિક સિદ્ધાંતોના પ્રચાર કરનાર ગોશાલકે આવા જ કારણોસર ૧૬ વર્ષ સુધી જિનપદ ધારણ કર્યું હતું.

શ્રી હેમચંદ્રાચાર્ય અનેકાર્થ સંગ્રહ (૨-૩૭૮)માં જિનોરહ્દ્દ-બુદ્ધ-વિષ્ણુષુ એ સૂત્રવડે એમ સૂચન કર્યું છે કે જૈનો પોતાના ઉપાસ્ય દેવ અહૃતને માટે, બૌદ્ધો પોતાના ઉપાસ્ય દેવ બુદ્ધને માટે અને હિંદુઓ પોતાના ઈશ્વરી અવતાર વિષ્ણુને માટે આ શબ્દનો પ્રયોગ કરતા હતા. જિનપદનું ગૌરવ પ્રકાશવા માટે આથી વધારે વક્તવ્યની અપેક્ષા રહે છે ખરી ?

દ્વારા વિતરણ કરું છે

એકવાર પૂજ્યશ્રીની પાટ ફેરવવાની હતી. મેં બાજુમાં બેઠેલા શાવકોને કહીને તેમના દારા પાટ મુકાવી. પૂજ્યશ્રીનું લખતાં લખતાં ધ્યાન ગયું. તેઓશ્રીનું હૃદય વલોવાઈ ગયું. “આ શાવકોએ પાટ મૂકી, તે પુંજશે કોણ ? યતના કોણ પાળશે ?”

પૂજયપાદશ્રી ખૂબ જ વયાંતું બની ગયા. તે રાતે પાટનો ઉપયોગ કર્યો જ નહિં. નીચે જ સંથારો પાથરીને સૂતા.

અપ્રમાજ્ઞના અને અયતના જોઈને તેઓશ્રીનું હિદય એકદમ વલોવાઈ ગયું.

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારુ

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૩૨, તા. ૨૯-૪-૧૯૬૧

૧૮ રસત્યાગ

(q)

તપનું વિધાન તો જગતના લગભગ બધા જ ધર્મોમાં થયેલું છે, પણ તે સંબંધી જેવી અને જેટલી ઊરી વિચારણા જૈન ધર્મ કરી છે, તેટલી બિજી કોઈપણ ધર્મ કરી નથી.

જેન ધર્મે શારીરિક-બાધ અને માનસિક-આભ્યંતર એ બંને તપશ્ચયાનો સ્વીકાર કરેલો છે, એટલે જેઓ એમ કહે છે કે જેનધર્મે માત્ર કાયદડ અથવ્તુ શારીરિક તપશ્ચય સ્વીકારી છે, એ વાત તદ્દન ખોટી છે. આત્મશુદ્ધિ માટે આ બંને તપશ્ચયાનો અગત્યની છે. જેઓ શારીરિક તપશ્ચયને ગૌણ કરી માત્ર માનસિક તપશ્ચય પર ભાર મૂકે છે, તેઓ વાસ્તવિક આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી શક્યા નથી. શરીર માતેલું હોય, ઈદ્રિયો જોર કરી રહી હોય, ત્યાં મનને શાંત અને સ્વસ્થ રાખવું એ નિતાન્ત અશક્ય નહિ તો દુઃશક્ય તો છે જ. ઉપવાસાદિ તપશ્ચયને દિવસે મન જેટલું શાંત અને સ્વસ્થ રહે છે, તેટલું ભારે કે ભર્યા પેટે હોતું નથી, એ આપણો દરેકનો અનુભવ છે. તાત્પર્ય કે મનની શુદ્ધિ માટે શારીરિક શુદ્ધિ જરૂરની છે અને તેથી બાધ તપશ્ચય પણ અત્યંત આવશ્યક છે.

બાધ્યતપશ્વર્યના અનશન, ઊનોદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એવા છ પ્રકારો છે અને તે વિશેષ રીતે સમજવા યોગ્ય છે, પણ અહીં તો તેમાંથી રસત્યાગ અંગે જ કેટલીક વિચારણા રજુ કરવા ઈથીએ છીએ.

સામાન્ય માન્યતા એવી કે રસવાળું અર્થત્તું સ્વાદવાળું ભોજન કરીએ તો ખાવામાં વિજગત આવે, તેથી ખોરાક સારી રીતે લેવાય અને પરિણામે શરીર સારું રહે, અર્થત્તું બળ, બુદ્ધિ અને કાંતિમાં વધારો થાય. તેથી જનસમાજની પ્રવૃત્તિ રસવાળું અર્થત્તું સ્વાદવાળું ભોજન લેવા તરફ વિશેષ રહે છે. પરંતુ જીણવાની જરૂર છે કે કોઈ પણ રસ અધિક માત્રામાં લેતાં શરીરને-આરોગ્યને નુકશાન થાય છે. તે માટે અહીં આયુર્વેદનાં સિદ્ધ ભંતયોનો ઉલ્લેખ કરવો ઉપયોગી લેખાશે.

મધુર રસનું અધિક સેવન થાય તો ખાંસી, શાસ, આલસ્ય, વમન, મુખમાધૂર્ય, કંઠવિકાર, કુમિરોગ, કંઠમાળ, અર્બુદ, શ્વીપદ (હાથીપણું), બસ્તીરોગ (મીઠી પેશાબ અને મૂત્રાશયના બીજા રોગો) તથા અભિષ્ટંદ (નેત્રરોગ) વર્ગેરે રોગો ઉત્પન્ન થાય છે.

અમ્લરસનું અધિક સેવન થાય તો દંતહર્ષ (દાંતોનું જકડાઈ જવું), નેત્રબંધ (આંખોનું મીઠાઈ જવું), રોમહર્ષ (વારંવાર ઝુંવાં ખડાં થવા), કર્ફનાશ તથા શરીર શૈથિલ્ય ઉત્પન્ન થાય છે અને કંઈ, ધ્યાતી તથા હૃદયમાં દાહ પેદા કરે છે.

લવણ્યરસનું અધિક સેવન થાય તો ખુજલી, કોઢ કે શોથ અર્થાત્ સોજો ઉત્પન્ન થાય છે. ચામડીનો રંગ બગડે છે. પુરુષાર્થનો નાશ થાય છે. આંખ વગેરે ઈન્દ્રિયોનો વ્યવહાર મંદ પડે છે તથા મુખપાક, નેત્રવ્યથા, રક્તપિત્ત, વાતરકત અને ખારા ઓડકાર વગેરે દુષ્ટ રોગોનો જન્મ થાય છે.

તિક્તરસ (કડવા રસ)નું અધિક સેવન ભ્રમ, મદ, કંઠશોષ, તાલુશોષ, ઓષ્ઠશોષ, ગરમી, બલક્ષય, કંપ અને હાથ, પગ તથા પીઠમાં શૂળ ઉત્પન્ન કરે છે.

કંડુરસ (તીખા રસ)નું અધિક સેવન કરવાથી ડેકની નસો જકડાય છે, નારીઓ બેંચાય છે, શરીરમાં વ્યથા ઉત્પન્ન થાય છે, કળતર અને કંપ થવા લાગે છે તથા ભૂખ મંદ પડી જાય છે.

કષાયરસ એટલે તુરારસનું અધિક સેવન થાય તો મુખશોષ, આધ્માન (આફરો), નસોનું જકડાવું, કંપન, શરીર સંકોચ આદિ રોગો ઉત્પન્ન થાય છે.

એટલે રસગૃદ્ધિ કે રસલોલુપતા આરોગ્યની દસ્તિએ પણ હાનિકારક છે અને તેથી સમજુ મનુષ્યોએ તેનો ત્યાગ કરવો આવશ્યક છે.

પશ્ચિમના આહારશાસ્ત્રીઓએ પણ એ વાત કબૂલ કરી છે કે કોઈ પણ રસનું અધિક માત્રામાં સેવન કરવું એ હાનિકારક છે. ડૉ. બ્લોયે તો સ્પષ્ટ શર્દીમાં કહું છે કે ‘મીઠાઈઓના શોખનો કુપ્રવૃત્તિઓ સાથે સંબંધ છે. જે બાળકો મીઠાઈનાં અતિ શોખીન હોય છે, તેમનાં પતનની સંભાવના વધુ છે.’

U ઓઘો પૂંજવા માટે છે V

સુરતના ચાતુર્માસમાં સાંજે પૂજ્યશ્રી જાપની તૈયારી કરી રહ્યા હતા. મેં જાપનો સામાન ગોઠવ્યો અને જલ્દી બારીઓ બંધ કરવાની શરૂ કરી. તુરત જ પૂજ્યશ્રીએ મને ટકોર કરી : “રવિ ! ઓઘો બગલમાં રાખવા માટે નથી હોં ! પૂંજવા માટે છે !” પૂજ્યશ્રી ધણાં કામોમાં વ્યસ્ત હોવા છતાં જીણી જીણી બાબતની ચોક્સાઈ ખૂબ હતી.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૩૪, તા. ૧૩-૫-૧૯૬૧

૧૬ રસત્યાગ

(૨)

રસનો ત્યાગ કરવો, એટલે સ્વાદને જિતવો. અર્થાત્ લિજજતદાર વાનગીઓના મોહમાં ન પડતાં સાદા સાત્વિક ખોરાકથી ચલાવી લેવું. કોઈ એમ સમજતુ હોય કે એથી આરોગ્ય બગડી જાય અને શરીર દૂબળું પડે તો એ સમજ બરાબર નથી. વધારે સ્પષ્ટ કહીએ તો એ સમજ ઉલટી છે. ઘણો મસાલેદાર ખોરાક લેવાથી આરોગ્ય બગડે છે અને સાદો સાત્વિક ખોરાક લેવાથી આરોગ્યનું રક્ષણ થાય છે. વધારામાં સંયમ સાધના સુલભ બને છે અને તે આ જીવનનો સહુથી મોટો લાભ છે.

પરંતુ આજે તો આપણા આહારમાં રસની-સ્વાદની વૃદ્ધિ કરવા માટે જ મીઠું, મરચાં, હળદર, ધાણાં, જીરું, અજમો, આંબલી, કોકમ, રાઈ, હિંગ, મેથી, મરી, લવિંગ વગેરે અનેક મસાલાઓ વપરાય છે અને તેના પ્રમાણમાં કંઈપણ ન્યૂનતા થાય તો તરત બૂમ ઉઠે છે. આ પરિસ્થિતિ ઈચ્છવા યોગ્ય નથી. સ્વાદ એ ટેવની વસ્તુ છે, એટલે તેને કેળવી કેળવાય છે. કદાચ પ્રારંભમાં થોડી મુશ્કેલી લાગે, પણ આપણી આ ટેવનું પરિવર્તન કરવા ધારીએ તો જરૂર કરી શકાય છે.

રસનો બીજો અર્થ આસક્તિ છે. તે જોરદાર બને તો તૂંપિન નજીક આવી શકતી નથી. તાત્પર્ય કે આસક્તિ વધતાં એક વસ્તુ વધારે ને વધારે ખાવાની ઈચ્છા રહ્યા કરે છે અને તેથી પ્રમાણનું ભાન રહેતું નથી. આથી મનુષ્યને રોગના ભોગ થવું પડે છે અને ઘણી વખત તો પ્રાણહર સંકટ પણ ઉભું થાય છે. કંડરિકે આસક્તિથી વિવિધ વાનીઓનું ભોજન કર્યું તો તેને પેટપીડા ઉપડી, સખત જાડા થયા અને એક જ રાતમાં તેનું પ્રાણપંખેરું ઊરી ગયું. શાસ્ત્રના ઈતિહાસમાં આવા અનેક દાખલાઓ નોંધાયેલા છે.

આહાર લૂંખો સૂકો હોય તો પણ તેનું આસક્તિથી ભોજન ન કરવું, એ જૈન ધર્મની સુંદર શિક્ષા છે અને તે દરેક સંયમમસાધકે બરાબર લક્ષમાં રાખવાની છે.

રસનો ગીજો અને ખાસ અર્થ શરીરમાં વિકૃતિ પેદા કરે તેવા દશ પ્રકારના પદાર્થો છે. જે વિકૃતિ પેદા કરે તેજ વિકૃતિ, એ ન્યાયે આ દશ પ્રકારના પદાર્થોને વિકૃતિ કહેવામાં આવે છે, જેનો પ્રાકૃત સંસ્કાર ‘વિગંઠ’ છે. દશ વિગંઠાઓનાં નામ નીચે મુજબ છે : (૧) મધ, (૨) મદિરા, (૩) માખણ, (૪) માંસ, (૫)

દૂધ, (૬) દહી, (૭) ધી, (૮) તેલ, (૯) ગોળ અને (૧૦) કડા (પકવાન્). તેમાંથી પ્રથમની ચાર વિગઈ એટલે મધ, મદિરા, માખણ, અને માંસના તદ્વાર્ણના અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હોવાથી તેમજ તે તામસિક ભાવો અને વિકારો પેદા કરનાર હોવાથી સર્વથા ત્યાજ્ય છે અને બાકીની વિગઈઓનું આરાધક આત્માએ બને તેટલું ઓછું સેવન કરવાનું છે. આમાંથી જેટલી વિગઈઓનો ત્યાગ થાય તે પ્રમાણે રસત્યાગ કર્યો કહેવાય. તાત્પર્ય કે સ્વાદ, આસક્તિ અને વિકૃતિ પેદા કરે તેવા પદાર્થોના ત્યાગથી રસત્યાગનું સ્વરૂપ સંપૂર્ણ બને છે અને તે આત્માની શુદ્ધિ કરવામાં અતિ અગત્યનો ભાગ ભજવે છે.

રસત્યાગની તાલીમ લેવા માટે આયંબિલની તપશ્ચર્યા ઉત્તમ છે અને તેથી જ શાસ્ત્રોમાં તેને મંગલ નામથી ઓળખવામાં આવે છે.

આયંબિલની તપશ્ચર્યાથી અનેક જીતના રોગો મટે છે અને શારીરિક તથા માનસિક શુદ્ધિ સારી રીતે થાય છે. વળી તેનાથી સ્મૃતિ, મેધા તથા ધૂતિમાં પણ ઘણો સુધારો થાય છે. તેનો સહુથી મોટો લાભ તો એ છે કે મન સંયમ તરફ જલ્દી વળે છે અને ત્યાગના પરિણામ દઠ બને છે.

જૈન સંધમાં એવા પણ મહાપુરુષો થઈ ગયા છે કે જેમણે જીવનભર આ રસત્યાગનું ક્રત પાળ્યું હોય અને પરિણામે આત્મશક્તિનો અપૂર્વ વિકાસ સાથ્યો હોય.

આયંબિલમાં પણ વર્ધમાન આયંબિલનો મહિમા ઘણો છે, કારણ કે તેથી લાંબા સમય સુધી રસત્યાગ થઈ શકે છે અને એ રીતે ઈદ્રિયો તથા મન પર કાબુ મેળવી શકાય છે.

રસત્યાગનું આ રહસ્ય સમજ સહુ કોઈ તેનું યથાશક્તિ પાલન કરે, એ જ અભ્યર્થના.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૩૫, તા. ૨૦-૫-૧૯૬૧

૨૦ ધાર્મિક શિક્ષણની પરિસ્થિતિ સુધારવાની જરૂર

ધાર્મિક સંસ્કારોનું આરોપણ કરવામાં, પોષણ કરવામાં અને તેની પ્રતિદિન વૃદ્ધિ કરવામાં ધાર્મિક શિક્ષણ અતિ અગત્યનો ભાગ ભજવે છે. તેથી તેની અગત્યા સહુએ એકી અવાજે સ્વીકારી છે, પણ તે માટે આપણી હાલની વ્યવસ્થા પૂરતી નથી. ઘણાં સ્થળો એવાં છે કે જ્યાં ધાર્મિક શિક્ષણ માટે કંઈ જ વ્યવસ્થા નથી. આ સ્થાનોમાં નાની નાની પાઠશાળાઓ ખોલવાની ખાસ જરૂર છે.

શહેરો વગેરેમાં હાલ જે પાઠશાળાઓ ચાલે છે, તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઠીક હોય છે, પણ તેનો મોટો ભાગ બહેનોનોજ હોય છે. પુરુષ વર્ગ તેનો બહુ ઓછો લાભ લે છે. શું તેમને પોતાની જીવન સુધારણા માટે ધાર્મિક શિક્ષણની જરૂર નથી લાગતી? વિદ્યાર્થીઓ દશમાં ધોરણમાં આવ્યા કે મોટા ભાગે પાઠશાળા છોડી જાય છે અને ધાર્મિક અભ્યાસ આગળ વધતો નથી.

જે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પાઠશાળામાં શિક્ષણ લે છે, તેમને એ શિક્ષણ જોઈએ તેવા બહોળા ને રસમય સ્વરૂપમાં મળતું નથી. એ પણ એક ચિંતાનો વિષય છે. શિક્ષક શિક્ષિકાઓ તેમને સ્કૂલો ગોખાવવા ઉપરાંત જૈનધર્મ સંબંધી કંઈ પણ માહિતી આપતા નથી. એટલું જ નહિ પણ જે સ્કૂલો રોજ ઉપયોગના છે તેના અર્થ-ભાવાર્થ શિખવવામાં પણ જોઈએ તેવી કાળજી બતાવતા નથી.

તાજેતરમાં મુંબઈ જૈન ધાર્મિક શિક્ષણ સંધ તરફથી પરીક્ષા લેવાઈ, તે અંગે પરીક્ષકોના અભિપ્રાયો સંધના મુખ્યપત્ર તરીકે પ્રગટ થતી જૈન શિક્ષણ-સાહિત્ય પત્રિકાના નવમાં અંકમાં પ્રકટ કરવામાં આવ્યા છે. તે જોવાથી આ વસ્તુની ખાતરી થાય છે. એક પરીક્ષક લખે છે, ‘કથાવિભાગ તેમજ પ્રશ્નોત્તરી વિભાગમાં વિદ્યાર્થીઓ ગોખીને લખે છે અને તેથી તેમાં છબરડા વળે છે. અહિસાની વ્યાખ્યા કરતાં એક વિદ્યાર્થી (૨૬૩) એ લખ્યું છે કે, ‘મુક્તિના અભાવને અહિસા કહેવાય.’ બ્રહ્મચર્યની વ્યાખ્યા કરતાં એક વિદ્યાર્થી (૩૦૭) લખે છે કે ‘નવે પ્રકારના પરિગ્રહોનો ત્યાગ કરીને મૂળરાહિત થતું તેને બ્રહ્મચર્ય કહે છે.’ પૌથધના ઉપકરણમાં. સંથારાને બદલે કંસારાની જરૂર વિષે પણ લખવામાં આવ્યું છે. ભગવાન નેમિનાથે લગ્ન કર્યા હતા. અને માતાપિતાને ખરાબ ન લાગે તે લગ્નનું કારડા હતું, એમ પણ એક વિદ્યાર્થી (૧૪૪૨) એ લખ્યું છે. ક્ષમાની વ્યાખ્યા આપતાં એક વિદ્યાર્થી

(૪૭૪) એ જ્ઞાનના અભાવને ક્ષમા તરીકે વર્ણવેલ છે, વગેરે. આ રીતે તેણે બીજા પણ કેટલાક દાખલા આપ્યા છે.

ભાષાશુદ્ધિ, જોડણી વગેરેની ફરિયાદ તો ઘણા ખરાએ કરી છે અને તેના ઉપાય તરીકે વિદ્યાર્થીઓ પાસે સૂત્રો લખાવવાની હિમાયત કરી છે, પણ તેનો અમલ થતો નથી. અમે તો અમે માનીએ છીએ કે દરેક પાઠશાળામાં જૈન લિપિનો સુંદર નકશો હોવો જોઈએ અને દરેક વિદ્યાર્થીને પ્રારંભમાંજ એ શીખવી દેવો જોઈએ. વળી મોન્ટેસોરી પદ્ધતિમાં હોય છે તેમ એ દરેક અક્ષરના છૂટા કાર્ડ કે પાઠિયાના ટુકડા પણ રાખવા જોઈએ જેથી વિદ્યાર્થીઓને એનો સારો પરિચય થઈ જાય. અને સૂત્રો લખાવવા તે એ અક્ષરોમાં જ લખાવવા જોઈએ. જ્યાં આ રીતે સૂત્રો લખાવવાની પદ્ધતિ અજમાવવામાં આવી છે, ત્યાં તેનું પરિણામ સુંદર આવ્યું છે અને એ વિદ્યાર્થીઓ થોડા વખતમાં હસ્તપ્રતિઓ વાંચતા થયા છે, તાત્પર્ય કે સૂત્રો લખાવવાની પદ્ધતિ જેટલી વહેલી અમલમાં આવે તે ઈચ્છવા યોગ્ય છે.

અર્થ શિખવવા માટે પણ એક ચોક્કસ પદ્ધતિ હોય છે. માત્ર તેનો પર્યાપ્ત શરૂદ કહી જવાથી તો અર્થ પણ સૂત્રની જેમ ગોખવો જ પડે છે. અને તેનું જ એ પરિણામ છે કે જ્યારે તે સંબંધી થોડું પણ લખવાનો પ્રસંગ આવે છે, ત્યારે આવી ભૂલો થાય છે. પરીક્ષક મહાશયે જે દાખલા આપ્યા છે તેમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓને કંઈક યાદ છે, કંઈક યાદ નથી. અહિંસા એ કોઈ વસ્તુનો અભાવ છે, એ યાદ છે, પણ શેનો અભાવ છે? તે યાદ નહિ આવવાથી મુક્તિનો અભાવ તે અહિંસા એમ લાઘ્યું છે. અર્થ બતાવતાં આ વસ્તુ થોડી વધારે સ્પષ્ટ કરી હોય તો વિદ્યાર્થીઓને જરૂર યાદ રહી જાય અને આવું લખવાનો વખત આવે નહિ.

આશા છે કે ધાર્મિક શિક્ષણની આ પરિસ્થિતિ પર સમાજ ગંભીરતાથી વિચાર કરશે અને તેને સુધારવા માટે બનતા પ્રયત્નો કરશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૮-૮, અંક-૩૬, તા. ૩-૬-૧૯૬૧

૨૧ રાષ્ટ્રપતિએ આપેલી

ચરમજિનપતિ શ્રી મહાવીર સ્વામીને ભવ્ય શ્રદ્ધાજલિ

ચરમજિનપતિ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે ભારતના પાટનગર દિલ્હીમાં એક જાહેર સમા યોજાઈ હતી તેમાં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે હાજરી આપી હતી અને શ્રી મહાવીર સ્વામીને ભવ્ય શ્રદ્ધાજલી સમર્પિયા હતી. અત્યાર પૂર્વે તેઓ અનેક વખત શ્રી મહાવીર સ્વામીને તથા તેમણે પ્રચારેલી અહિંસાને શ્રદ્ધાજલી સમર્પિત કરી ચૂક્યા છે, પરંતુ આ શ્રદ્ધાજલી તેમાં ભાત પાડે એવી હતી.

તેમણે કહ્યું ‘શ્રી મહાવીર સ્વામી વ્યક્તિગત રીતે ઘણા મહાન હતા. તેમના વ્યક્તિત્વની મહાનતા સમય સાથે વધતી જ જાય છે. તેઓએ જે સિદ્ધાંતોનું ઉદ્ભોધન અઢી હજાર વર્ષ પહેલાં કર્યું હતું, તેનું મહત્વ પણ દિવસે વધતું જતું હોય તેમ લાગે છે.’

સંસારનું કાલચક ગમે તે ગતિએ ફરતું હોય અને માનવીનો વિકાસ ગમે તે દિશામાં થયો હોય, પરંતુ આજે સમાજમાં જેટલી જરૂરત અહિંસા, આત્મ સંયમ, અનુશાસન અને વિનયની છે, તેટલી પહેલાં કદી નહિ હોય. જેમ જેમ માનવીનો (ભૌતિક) વિકાસ વધતો જાય છે (એ માર્ગ) બુદ્ધિ સેતેજ થતી જાય છે અને પ્રકૃતિના જ્ઞાન સંબંધી સીમાઓ વધારેને વધારે વિસ્તૃત થતી જાય છે, તેમ તેમ આ ગુણોની આવશ્યકતા અને આદેશોની અલૌકિકતા વધારે ને વધારે પ્રકાશમાં આવતી જાય છે.

વિવેકશીલ માનવી આ સિદ્ધાંતોની વધારે કદર કરવા લાગ્યો છે અને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જીવનમાં તે નવા જ દાખિકોણથી તેની ઉપાદેયતાને જોવા લાગ્યો છે,

શ્રી મહાવીર સ્વામીના વ્યક્તિત્વ અને તેમણે પ્રચારેલા સિદ્ધાંતોથી રાષ્ટ્રપતિ કેટલા પ્રભાવિત છે, તે આ શર્દી પરથી જાળી શકાય છે.

વિશેષમાં તેમણે કહ્યું : ‘આજના માનવને તો ધર્મભીરુ કહી શકાય કે ન તો ધર્મિય. નજીકમાં પૂર્વમાં માન્યતાઓનાં તત્ત્વનું શિક્ષણ માત્ર ઉચ્ચ વિચારકો અને દાર્શનિકો સુધી સીમિત હતું ત્યાં (તેની જગતો) હવે આ તત્ત્વનો સંબંધ

સીધો જીવન સાથે સ્થાપિત થવાનાં કારણે તેમાં અસાધારણ રસ ઉત્પન્ન થઈ રહ્યો છે. આ દણિએ આજનો માનવ પરોક્ષરૂપમાં ધાર્મિક અથવા આધ્યાત્મિક સિદ્ધાંતોની બિલ્કુલ નજીક આવી ગયો છે. વર્ષો સુધી ભૌતિકવાદનું અનુસરણ કર્યા પછી તેને પોતાની સાધન સંપન્નતા અને ક્ષમતામાં કંઈક અભાવનો ભાસ થવા લાગ્યો છે. જેની પૂર્તિ માત્ર ‘આધ્યાત્મિકવાદ’ જ કરી શકે તેમ છે. આ અભાવની પૂર્તિની શોધ માનવને ફરી પ્રાચીન તત્વદર્શનીઓ અને વિભૂતિઓ તરફ લઈ જઈ રહી છે. આવી વિભૂતિઓમાં ભગવાન મહાવીર સ્વામીનું સ્થાન અગ્રગણ્ય છે. કઠોર તપશ્ચર્યા અને મહાન ચિંતન બાદ તેઓ જે પરિણામો પર પહોંચ્યા અને જેમાં સફળ રહ્યા, તેની સચ્ચાઈ આજે આપણે નવીન પ્રકાશનાં રૂપમાં જોઈ રહ્યા છીએ. વિવેકશીલ લોકો સમજવા લાગ્યા છે કે અહિસા અને શાન્તિ પૂર્ણ સહયોગ અથવા સામસામા યુક્તશી દૂર રહેવામાં જ માનવ જીતનું પરમ કલ્યાણ છે. વિજ્ઞાનની આશા યુક્ત પ્રગતિ અને માનવી દ્વારા પ્રકૃતિના રહસ્યોનું ઉદ્ઘાટન આ મહાન સત્યથી આપણાને દૂર લઈ જવાને બદલે વધારે નજીક લઈ આવ્યું છે.’

રાષ્ટ્રપતિએ અહીં પરિસ્થિતિની જે સમાલોચના કરી છે, તે વિચારનું નવું દણિબિન્દુ આપે છે. સામાન્ય માન્યતા એવી છે કે ભૌતિકવાદના પરિણામે માનવી ધર્મથી બહુ દૂર નીકળી ગયો છે અને તે પ્રાચીન મહાપુરુષોએ પ્રતિપાદિત કરેલા સિદ્ધાંતોને માન આપતો નથી. પણ રાષ્ટ્રપતિ કહે છે કે આજનો માનવી આપણે ધારીએ છીએ તેટલો ધર્મથી દૂર ગયો નથી. વળી ભૌતિકવાદની અપૂર્ણતા જોયા પછી તેની દણિ પ્રાચીન મહાપુરુષોના મંત્ર્યો તરફ વિશેષ વળી છે અને તે મહાપુરુષોમાં શ્રી મહાવીર સ્વામીનું સ્થાન અગ્રગણ્ય છે. એટલે શ્રી મહાવીર સ્વામીનાં અહિસા અને સ્થાદ્વાદ પ્રધાનના સિદ્ધાંતો આજની અશાંત પીડિત માનવ જીત માટે આશીર્વાદરૂપ નીવડે તેમ છે, એમ આજના વિચારકોને લાગવા માંડયું છે.

જૈન સમાજે આ તક ઝડપી લેવી જોઈએ અને શ્રી મહાવીર સ્વામીના જીવન તથા ઉપદેશને એવી રીતે બહાર લાવવા જોઈએ કે જેનો વિચારક વર્ગ પર મહાન પ્રભાવ પડે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૩૭, તા. ૧૦-૬-૧૯૬૧

૨૨ એક આવકારદાયક યોજના

શાસન પ્રેમી વર્ગમાં હમણાં એક યોજના વિચારવા લાગી છે. તેનું જે સ્વરૂપ જ્ઞાનવા મળ્યું, તે પરથી એમે તેને આવકારદાયક કહીએ છીએ અને સમાજને તેથી લાભ થશે એમ માનીએ છીએ.

આ યોજના હવાખાવાનાં સ્થળે જ્યાં જ્યાં જિનમંદિરો ન હોય ત્યાં ત્યાં નાનાં નાનાં જિનમંદિરો બાંધવાની છે. દેખાદેખીથી કહો, આરોગ્ય સુધારવાની દણિએ કહો કે શાંતિ મેળવવાનાં નિમિત્ત કહો પણ આજ કાલ આપણા ઘણા ભાઈઓ પોતાનાં કુટુંબ સાથે હવા ખાવાનાં સ્થળોએ જાય છે, અને ત્યાં પાંચ પંદર દિવસ કે અનુકૂળતા હોય તો માસ-બે માસ પણ સ્થિરતા કરે છે. અહીં અન્ય દરેક વાતની અનુકૂળતા હોવા ધતાં એક વાતની મોટી ખામી રહે છે, તે એ કે પરમાત્માનાં દર્શનનો લાભ તેમને મળી શકતો નથી.

આત્મવિકાસની જડ આત્મદર્શનમાં છે અને સાચું આત્મદર્શન પરમાત્માનાં દર્શનમાં છે. આ વસ્તુ આપણા પૂર્જાના હૃદયમાં બરાબર ઠસી હતી, એમ આજે ઠેર ઠેર દેખાતાં ભવ્ય અને આલિશાન જિન મંદિરો પરથી આપણે બેધડક કહી શકીએ છીએ. આ વિષમ કાળમાં ભવસાગર તરવાનું એ એક મહાન સાધન છે અને તેથી જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

શાસ્ત્રકારોએ આ વસ્તુ લક્ષમાં રાખીને એમ કહ્યું છે કે દરેક શ્રાવકે વિશેષ ન બને તો અંગુષ્ઠ પ્રમાણ પણ જિનમૂર્તિ ભરાવવી જોઈએ અને સો રૂપિયાની મૂડી- વાળાએ પણ ગૃહચૈત્ય રાખવું જોઈએ. પ્રાચીનકાળના સો રૂપિયા આજનાં હજાર કે દોઢ હજારની મૂડીવાળાને આ કથન લાગુ પડે છે.

ઘણા ભાગ્યશાળી આત્માઓ પોતાને ત્યાં ગૃહચૈત્ય રાખે છે અને શ્રી જિનેશ્વર દેવની નિત્ય પૂજા કરીને અલૌકિક આનંદ મેળવે છે, પરંતુ તેઓ પણ હવા ખાવાનાં સ્થળે માસ-બેમાસ માટે ગૃહચૈત્ય ઊભું કરી શકતા નથી. એમ કરવામાં આવે તો સહુને પરમાત્માનાં દર્શન-પૂજનનો લાભ મળી શકે અને તેથી એક મોટી ખોટ પૂરી થાય.

આ ગૃહમંદિરો એવી રીતે બાંધવા જોઈએ કે નીચેના કે બાજુના ભાગમાં એક ખાલી હોલ રહે અને ઉપરના કે મુખ્ય ભાગમાં ગૃહમંદિરની સ્થાપના થાય,

જેથી ખાલી હોલમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકો ઈચ્છા થતાં સામાયિક, પ્રતિકમણ, પૌષ્ઠ વગેરે આત્મ કલ્યાણકારી કિયાઓ કરી શકે અને ત્યાં રાખવામાં આવેલા સુભોધદાયક પુસ્તકો વાંચીને પોતાનો આત્મા ઉજ્જવલ બનાવી શકે. વળી ત્યાં સાધુ, સાધ્વીઓનું આગમન થાય તો તેમને સ્થિર થવા માટે પણ એ કામ લાગે.

અત્યારે હવા ખાવાનાં સ્થળે સાધુ-સાધ્વીઓનું આગમન ભાગ્યે જ થાય છે, પણ આ પ્રકારની સગવડ હોય તો આગમન જરૂર થાય અને પરમાત્માનાં દર્શન સાથે તેમનાં વ્યાખ્યાન શ્રવણ તથા સત્સંગનો લાભ મળી શકે. એટલું જ નહિ પણ અહીં ફુરસદનો સમય વિશેષ હોવાથી જૈનેતર મિત્રોને પણ ત્યાં લાવી શકાય અને તેમને જૈન ધર્મનાં તત્ત્વજ્ઞાન તથા કિયાઓમાં રસ લેતા કરી શકાય.

હવા ખાવાનાં સ્થળે જૈનમંદિરની ધજા ફરકતી હોય તો તે જૈન સંઘ માટે ગૌરવરૂપ છે. મૈત્રીભાવનાનો મહાન ઉપદેશ એ ધજામાં રહેલો છે અને અહિસાનો સંદેશ તો એ ધજામાંથી પ્રતિક્ષણે સંભળાયાજ કરે છે. વળી વિલાસનાં સ્થાનમાં એ તપ-ત્યાગની છાયા પાડનાર બને એ પણ ભૂલવાનું નથી.

આવા મંદિરોમાં સુખી ગૃહસ્થોની ઉદાર ભાવનાથી કે તે અંગેના ખાસ ફંથી ઊભા થઈ શકે અને તેનો વહીવટ-વ્યવસ્થા કરવા માટે તે સ્થાન કે તેની આસપાસના સ્થાનમાંથી પાંચ-સાત ગૃહસ્થોની એક સમિતિ નીમી શકાય.

જાણવા મળ્યું છે કે ત્રાણેક મંદિર માટેની રકમની વ્યવસ્થા થઈ છે. તો વધુ માટેની રકમોની ઉદારતા શક્તિ સંપન્ન ગૃહસ્થોએ કરવાની ઉત્તમ તક છે.

આ યોજનાનું સંચાલન કરવા માટે મુંબઈ-અમદાવાદ જેવા શહેરમાં અનુભવીઓની તથા લાગવગ ધરાવનારાઓની એક ખાસ સમિતિ રચાય અને કાર્યની શરૂઆત કરવામાં આવે તો અમે માનીએ છીએ કે તેને પૂરતો સહકાર મળી રહેશે. શુભ કામમાં વિલંબ શો ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૪૦, તા. ૮-૭-૧૯૬૧

૨૩ યોગસાધના

યોગ, એ જૈન ધર્મનું મહત્વનું અંગ છે અને તેથી જ આજ સુધી તીર્થકરો આચાર્યો અને મુનિપુંગવો તેમની સાધના કરતા આવ્યા છે. પણ અહીં યોગનો અર્થ શો કરવો ? એ પ્રશ્ન છે, જો અહીં યોગ શબ્દથી કોઈ આસન સિદ્ધિ, ગ્રાણાયામ કે ક્રોરી ધ્યાનની ક્રિયા સમજતું હોય તો તે યથાર્થ નથી.

શ્રી હરિભદ્રસૂરિજી મરાહાજે યોગવિશ્વકામાં સ્પષ્ટ કર્યું છે કે પ્રણિધાનથી અત્યંત શુદ્ધ થયેલો એવો ધર્મ વ્યાપાર મોક્ષમાર્ગમાં જોડનારો હોવાથી યોગ છે. શ્રી હેમચંદ્રચાર્ય મહારાજે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્યારિત્રની આરાધનાને યોગ કર્યો છે. એટલે દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા સંપન્ન થઈને સમ્યગ્જ્ઞાનની ઉપાસના કરવી તથા ઉત્તમ પ્રકારનું ચારિત્ર ઘડવું એ જ સાચો યોગ છે.

પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાને માનવ સમાજને સંસ્કૃતિનું દાન કર્યા પછી યોગ સાધના સ્વીકારી હતી અને તેને મક્કમ મને આગળ વધારી હતી. એ સાધનામાં અનેક પ્રકારનાં વિધ્યો આવ્યાં, ઇતનાં તેમણે એ સાધના છોડી ન હતી કે તેમાંથી ચલિત થયા ન હતા. તેમણે એ વિધ્યોનો જ્ય કર્યો, પરિણામે તેમની પ્રજ્ઞા ઋતંભરા બની અને તેઓ સર્વલોકાલોકનો પ્રકાશ કરનારું કેવળજ્ઞાન પામ્યા.

શ્રી ઋષભદેવ ભગવાનની આ યોગસાધનાનાં વિશિષ્ટ તત્ત્વો સંવર અને નિર્જરા હતા, તે આપણે ભૂલવાનું નથી. સંવરને સિદ્ધ કરવા માટે તેઓ પાંચ મહાવતોનું નિરતિચાર પાલન કરતા હતા. અષ્ટપ્રવચન માતારૂપ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું અનન્ય મને આરાધન કરતા હતા. વારંવાર અનિત્યાદિ બાર ભાવનાઓનો આશ્રય લેતા હતા અને આત્મપરિણામો વિશુદ્ધ કરતા હતા. વળી ક્ષમાદિ દશ પ્રકારના યત્થિધર્મને સેવતા હતા, બાવીશ પ્રકારના પરીષહોનો જ્ય કરતા હતા અને ચારિત્રને ઉત્તરોત્તર ઉત્તમ બનાવવા માટે પ્રમાણનો પરિહાર, કણાયનો જ્ય, તથા કઠોર તપ કરવામાં અદ્ય પુરુષાર્થ દાખવતા હતા. નિર્જરાને સિદ્ધ કરવા માટે તેઓ વિવિધ અભિગ્રહયુક્ત તપશ્ચર્યાનું આલંબન લેતા હતા. શરીર પ્રત્યે તેઓ તદ્દન નિઃસ્પૃહ હતા અને મોટો ભાગ કાયોત્સર્ગધ્યાનમાં જ રહેતા હતા.

આપણી સામે યોગસાધનાનો આ ઉજ્જવલ આદર્શ છે અને તેને

અપનાવવામાં આપણું શ્રેય છે. યોગસાધનાનો મૂળ પાયો યમ-નિયમ છે, એ આપણે ભૂલવાનું નથી. યોગદર્શનકાર શ્રી પતંજલિએ પણ યોગસાધના માટે યમ-નિયમની આવશ્યકતા સ્વીકારી છે અને તેને યોગનાં પ્રથમ તથા બીજા અંગમાં ગણેલ છે. યમોમાં પણ અહિસા અને સત્યનું મુખ્યસ્થાન, છે તે ભૂલવાનું નથી, એટલે યોગસાધના કરવા ઈચ્છનારે સહૃથી પ્રથમ અહિસાવૃત્તિને ઊંચી હેઠ કેળવવી જોઈએ અને તે માટે સમિતિમાં જે જે નિયમો બતાવ્યા છે, તેનું ખૂબ કાળજીથી પાલન કરવું જોઈએ. સાથે સત્યશોધનની જિજ્ઞાસાને અતિ તીવ્ર બનાવવી જોઈએ. સત્ય માટે પ્રીતિ-ભક્તિ કેળવવી જોઈએ અને તેને માટે ગમે તેવો ભોગ આપવો પડે તો આપવાની તૈયારી પણ રાખવી જોઈએ.

નિયમોમાં બાધ્યતપ, ઈન્દ્રિયનિગ્રહ, જિનેશ્વરદેવની ભક્તિ, મન:શૌચ તથા શ્રુતાભ્યાસ વગેરે પર પૂરતું લક્ષ આપવું જોઈએ પરંતુ આજે સ્થિતિ શોચનીય છે. જ્યાં જમાનાનો નાદ લાગ્યો છે ત્યાં આગમ-પરિશીલનનાં સ્થાને છાપાં વાંચનનો શોખ જાગ્યો છે. શરીર સાચવવાનાં બહાને રસનું અર્થાત્ વિગઈનું સેવન વધ્યું છે તથા આયંબિલ-એકાશનમાં પણ અખાડા થવા લાગ્યા છે, વળી દેવદર્શન તથા ચૈત્યવંદનની કિયા, જે યોગની કિયા છે અને સહસ્રો ભવનું સાથે મંથન કરનારી છે, એ શુષ્ણ હૃદયે થઈ રહી દેખાય છે. તેમજ માન-આકંક્ષા તથા ઈર્ઝાનું પ્રમાણ વધ્યું છે. આ સંયોગોમાં યોગસાધના થાય શી રીતે ? એ વિચારવાનું છે.

ઉપદેશપદમાં લખ્યું છે કે ઉચિત અનુષ્ઠાન સાચવ્યા પછી જ ધ્યાનાદિ વિહિત છે. અહીં ઉચિત અનુષ્ઠાનમાં સ્વાધ્યાય, સુત્રાર્થપરાવર્તન તથા અનુપ્રેક્ષાદિનો સમાવેશ છે, તે યાદ રાખવું ઘટે છે, જેઓ પાયાને પાકો કર્યા વિના મોટી ઈમારત ચાણવાની ભાવના રાખે છે કે પ્રવૃત્તિ કરે છે તે નિષ્ફળતાને વરે છે, આટલી વાત યોગસાધના અંગે હાલ ધ્યાનમાં લેવા જેવી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૪૧, તા. ૧૫-૭-૧૯૬૧

૨૪ શું આ પ્રશ્ન મહત્વનો નથી ?

સર્વ જીવો જિનશાસનને પામે અને તે દ્વારા પોતાનો અભ્યુદય સાથે એ જૈન ધર્મની મહાભાવના છે. આ મહાભાવનાથી પ્રેરાઈને જૈન શ્રમણો તથા શ્રમણીઓએ કઠિન વિહારોમાં ગમે તેવી કારમી મુશ્કેલીઓનો સામનો કરીને પણ જૂદા જૂદા દેશની પ્રજાને જૈન ધર્મનો સંદર્શો સંભળાવ્યો છે તથા તેના ઉત્તમ આચાર-વિચારનો પ્રશસ્ત પરિચય આપ્યો છે. ઉત્તરમાં હિમાલય પર્વતની તળોટીથી માંડીને દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને પૂર્વમાં બંગાળથી માંડી પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધીનો કોઈપણ પ્રદેશ એવો નથી કે જ્યાં આ પૂજ્ય શ્રમણ-શ્રમણીઓનાં પગલાં થયાં ન હોય, પરિણામે આ બધા પ્રદેશોમાં જૈન ધર્મને પાળનારની તથા જૈન ધર્મને ચાહનારની વિશાળ સંખ્યા ઉત્પન્ન થઈ હતી અને સ્થળે સ્થળે સૂત્રો, જિનમંદિરો, પૌર્ખ શાળાઓ, જ્ઞાન ભંડારો તથા જીવદ્યાને પોતાંત્રાં ખાતાંઓ સ્થપાયા હતા.

સ્થાપત્યના એક નિષ્ણાત કરે છે કે, ‘ભારતની ભૂમિનો કોઈપણ ભાગ લ્યો અને તેની ૨૫ માઈલના આસપાસના પ્રદેશનું અવલોકન કરો કે અમુક સ્થળે ખોદકામ કરો તો તમને ત્યાંથી જૈન ધર્મનો કોઈપણ પ્રાચીન અવશેષ સિક્કા, તાપ્રાપ્ત, લેખ, મૂર્તિ, મંદિરના સ્થંભ, કે તોરણ યા અન્ય પ્રકારે મળી આવશે.’

આ પરથી પ્રાચીન કાળમાં જૈન ધર્મની જાહેજલાલી કેવી હતી તેનો જ્યાલ આવી શકશે. પરંતુ મધ્યયુગના મંડાણ થયાં અને પરિસ્થિતિએ પલટો લીધો, એક બાજુ ચૈત્યવાસીઓ જોર પર આવ્યા અને તેઓ સ્વાર્થ પ્રેરિત અસત્ય સિદ્ધાંતોનો પ્રચાર કરી સુવિહિત માગને મોટો ફટકો મારવા લાગ્યા. બીજી બાજુ મતમતાંતરોએ જોર પકડ્યું અને અનેક પક્ષો અસ્તિત્વમાં આવ્યા. ત્રીજી બાજુ અન્ય ધર્માઓના આકષણ થવા લાગ્યાં અને ચોથી બાજુ મુસ્લિમાનો તરફથી જોરદાર હલ્લા શરૂ થયા. આમ ચારે તરફથી સ્થિતિ બગડતાં જૈન ધર્મના પ્રચારને મોટો ફટકો પડ્યો અને તેના અનુયાયીઓની સંખ્યા સારા પ્રમાણમાં ઘટી જવા પામી. આમ ઇતાં તે સંખ્યા લાખોની હતી અને તે ભારતના સર્વ ભાગમાં પ્રસરેલી હતી, એટલું નિશ્ચિત. પરંતુ પછીના કાળમાં દુર્ઘટના એ બની કે જૈન ધર્મના મુખ્ય કેન્દ્રો આ બધા ભાગો સાથે સંપર્ક જાળવી શક્યા નહિ અને તેથી લાખો જેનો ધૂટા પડી ગયા.

આજે પણ ભારત વર્ષના અનેક ભાગોમાં આવા લાખો ભાઈઓ વસે છે.

તેઓ શ્રી મહાવિર સ્વામી તથા શ્રી પાર્શ્વનાથને ઈષ્ટદેવ લેખે છે, નવકારમંત્ર બોલે છે અને જૈન ધર્મના બીજા પણ થોડા સંસ્કારો જીળવી શક્યા છે, પણ તેમની ગણના જૈનમાં થતી નથી. ખુદ જૈનો પણ તેમને જૈન માનતા નથી કે જૈન તરીકે તેમનો સ્વીકાર કરતા નથી !

મદ્રાસ ઈલાકામાં પેરિયા તરીકે ઓળખાતા લગભગ આવા અઢી લાખ માણસો છે, પણ હજુ સુધી તેમની સારસંભાળ કોઈએ લીધી નથી અને લેવાય તેવાં કોઈ ચિન્હો નથી.

રત્નાગિરિ જિલ્લામાં આજથી ગ્રીશ-ચાલીશ વર્ષ ૧૫૨ ૪ જૈનોની સંખ્યા ૪૦,૦૦૦ જેટલી હતી, તે હવે ૮૦૦-૧૦૦૦ પર આવી પહોંચી છે. ત્યાં કેટલાયનું ધ્યાન ખેંચાયું છે અને છાત્રાલય, જૈન મંદિર વગેરેની વ્યવસ્થા થઈ છે, પણ જેઓ જૈન ધર્મ છોડી ગયા છે, તેમને પોતાના ધર્મમાં સ્થિર કરવાના ઉપાયો લેવાયા નથી.

સમેત શિખરની આસપાસ સરાક જાતિના અનેક લોકો વસે છે, તે બધા એક કાળે જૈન હતા. આ હકીકત બહાર આવ્યા પછી કેટલાક મુનિરાજેના પ્રયાસથી ત્યાં થોડું કાર્ય થયું, પણ તેને જૈન સમાજ તરફથી વેગ મળ્યો નથી.

ઉત્તર પ્રાંતના મેરઠ જિલ્લામાં પણ આવીજ સ્થિતિ પ્રવર્તે છે. પરંતુ ત્યાં પણ કોઈ સંગીન કામગીરી થઈ નથી. ધૂટા છવાયા પ્રયાસો અવશ્ય થયા છે, પણ તે કારગત શું થાય ?

ગુજરાતમાં ચાંપાનેરથી બોડેલી-છોટાઉંડેપુર વિસ્તારમાં પરમાર ક્ષત્રિયોની આશરે ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ ની વસ્તી છે. તે બધા જ પ્રથમ જૈન ધર્મ પાળતા હતા. આજે શ્રી પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભાના પ્રયાસથી તેમાંના ૮૫૦૦ ભાઈઓ જૈન ધર્મ પાળતા થયા છે. અહીં વ્યવસ્થિત પ્રયાસ ચાલુ છે અને જૈન સમાજ ટેકો આપે સુંદર પરિણામ આવવા સંભવ છે.

હમણાં જાણવામાં આવ્યું છે કે ઓરીસામાં લગભગ ૩૬,૦૦૦ મનુષ્યો એવા છે કે જે શ્રી પાર્શ્વનાથ તથા શ્રી મહાવિર સ્વામીની જોડિયા મૂર્તિઓ ઘરમાં રાખી તેની પૂજા કરે છે. નવકારમંત્ર બોલે છે અને રાત્રે ખાવામાં પાપ માને છે વગેરે, પરંતુ તેની તપાસ કોણ કરે ? એ જાતની આપણે ત્યાં કોઈ સંસ્થા જ નથી. શું જૈન સમાજ આ પ્રશ્નને મહત્વનો ગણતો નથી ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૪૨, તા. ૨૨-૭-૧૯૬૧

૨૫ ધર્મપ્રચારનાં આવશ્યક અંગો

પ્રચાર એક કલા છે, પછી તેનો ઉપયોગ ધાર્મિક ક્ષેત્રમાં થતો હોય, સામાજિક ક્ષેત્રમાં થતો હોય, આર્થિક ક્ષેત્રમાં થતો હોય કે રાજકીય ક્ષેત્રમાં થતો હોય, જેમને કલા સાધ્ય નથી તેઓ અભિમત વસ્તુનો પ્રચાર કરી શકતા નથી.

પ્રચારની કલામાં સહૃથી અગત્યનો ભાગ મનોવિજ્ઞાન (Psychology) ભજવે છે, કારણ કે તેમાં સામાનું મન પારખીને કામ લેવાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો માણસનાં મન પર જેની વધારે અસર થતી હોય તે સાધનોને કામમાં લેવાની જેને આવડત હોય તે જ પ્રચાર કરી શકે છે.

ધર્મ પ્રચારમાં મુખ્ય વસ્તુ જ્ઞાન અને કિયાનો પ્રચાર છે, આમ છતાં તેમાં કથા અને ચરિત્રોનો ઉપયોગ થાય છે, કારણ કે લોકોનાં મન પર તે સચોટ અસર કરવાની શક્તિ ધરાવે છે, એક સ્થળે તત્વજ્ઞાનનો ઉપદેશ અપાતો હોય અને તેમાં માત્ર સિદ્ધાંતોની જ છણાવટ થતી હોય તો એ ઉપદેશ ધણાને નિરસ લાગશે અને તેઓ ઝોકાં ખાવા મંતી પડશે. પરંતુ એ જ ઉપદેશનું સમર્થન કરવા માટે વચ્ચે વચ્ચે દણાંતો દેવાતાં હોય, કોઈ સુંદર શ્લોકોનું અવતરણ આપી તેનો ભાવ સમજવવામાં આવતો હોય અને તે અંગેના પ્રચલિત ખ્યાલોનું પણ નિરાકરણ થતું હોય તો એ ઉપદેશ રોચક બને છે અને સામાને તેની સચોટ અસર થતાં તેના જીવનનું પરિવર્તન થવા પામે છે. શ્રી આચારાંગ સૂત્રમાં તો એમ કહ્યું છે કે જે સાધુ હેતુ અને આહરણ એટલે દણાંતોનો ઉપયોગ કરવામાં કુશલ હોય તેણે જ ધર્મ કથા કરવી.

મધ્યકાલીન યુગમાં રાસ રચાયા, તેમાં લોકભોગ્ય લગભગ દરેક કથાને ગુંથી લેવામાં આવી, એટલું જ નહિ પણ તેમાં લોકપ્રિય થયેલી દેશીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. એકલી ગુજરાતી ભાષામાં રચાયેલા રાસોમાં આવી ૨૨૦૦ ઉપરાંત દેશીઓ વપરાયેલી છે. શું આને કારણે ધર્મપ્રચારની એક સુંદર કળા ન ગણી શકીએ ?

સંગીત પણ મનુષ્યનાં મનનું આકર્ષણ કરે છે. તેનો પણ ધર્મ પ્રચારમાં સફળતાથી ઉપયોગ થઈ શકે છે. જ્યાં તેવી શ્રોતાઓની સભા કે પરિષદ હોય ત્યાં પ્રારંભમાં જ થોડાં ધર્મ ભાવનાના પ્રેરક ગીતો ગવાય છે, તેથી વાતાવરણ શાંત

બને છે અને તેની મન પર ભારે અસર થાય છે. પછી મહાપુરુષોના જીવન પ્રસંગોના કોઈ ગીત અદ્ભુત સ્વરે ગવાય તો શ્રોતાઓનાં દિલ ડોલી જાય છે. અને તેમને ખૂબ અસર થાય છે. નેમરાજુલની હોરીઓએ, વસંતોએ તથા મહિનાઓએ આજ સુધીમાં લાખો આત્માને ભાવસંવેદન જગાડ્યું છે અને આજે પણ જગાડે છે. અન્ય મહાપુરુષ-સતીઓનાં જીવન પ્રસંગોનું પણ તેમજ સમજવું.

પૂજા એક ગંભીર વિષય છે. તેનું મુખ્ય ઈષ્ટેવને પોતાની જાતનું સમર્પણ કરવાનું છે. આમ છતાં તેમાં સંગીતને સ્થાન પ્રાપ્ત થયું છે, એ શું બતાવે છે? જે એ રીતે આત્મા ભાવમાં તલ્લીન થતો હોય તો તેમાં કંઈ ખોઢું નથી.

માત્ર મનોરંજનને ખાતર થતું સંગીત ઈષ્ટ લેખાતું નથી, પણ ભક્તિભાવની જમાવટ કરવા માટે થતું સંગીત ઈષ્ટ લેખાય છે અને તે માનવ હૃદયને ભારે અસર કરે છે. રાવણે તીર્થકરનામ કર્મ બાંધ્યું. તેમાં સંગીત નિમિત્તભૂત હતું. આજે ઉત્સવ-મહોત્સવોમાં સંગીતની પ્રધાનતા રહે છે, તેનું કારણ શું? કારણ એજ કે તે લોકોનું આકર્ષણ કરે છે અને તેમને ભાવમજન બનાવે છે.

પ્રચારમાં આકૃતિ અને રંગ પણ બહુજ અગત્યનો ભાગ ભજવે છે. એક વાત મોઢેથી કહેવામાં આવે અને તેજ યોગ્ય આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે તો તેમાં ધારો ફેર પડે છે. તેમાંથી એ આકૃતિમાં વિવિધ રંગોની પૂરણી કરી હોય તો દર્શકનું ધ્યાન તેના તરફ તરત બેંચાય છે. અને તે જોવામાં એ તલ્લીન બને છે. વિદ્યાર્થીઓ આગળ પાંચ સાત પુસ્તકો મૂડો તેમાં બે ત્રણ પુસ્તકો સચિત્ર રાખો, પછી જુઓ કે તે પહેલી કયા પુસ્તકની પસંદગી કરે છે? તે નવાણું ટકા સચિત્ર પુસ્તકની જ પસંદગી કરશે અને પ્રથમ તેનાં ચિત્રો જ જોઈ લેશો. એ પુસ્તક વાંચવાનું પછી શરૂ કરશે.

જૈન પ્રણાલિકામાં નિકેપને અધિકારે નામ પછી સ્થાપનાનો વિષય આવે છે, તેમાં આ સિદ્ધાંતનું સમર્થન થયેલું છે. શિષ્યને કોઈ વાત સમજાવી હોય તો માત્ર નામથી સમજાવી શકતી નથી. જો તેના સ્થાને સ્થાપના કરવામાં આવે અને તે પણ તદાકાર હોય તો વસ્તુની તરત સમજણ પડે છે. મૂર્તિવિધાનની પાછળ પણ આ જ સિદ્ધાંત રહેલો છે. તેના વડે શ્રી જિનેશ્વર દેવનું સ્મરણ થાય છે અને તેમણે આપેલો ઉપદેશ મનમાં તાજો થાય છે.

ધર્મ-પ્રચારમાં સાહુજીવન અને ઉચ્ચ ચારિત્ર એ મુખ્ય બળો છે, પણ સાથે આ બધી વસ્તુઓ તેમાં અગત્યનો ભાગ ભજવે છે, તે આપણે ભૂલવાનું નથી.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૪૩, તા. ૨૯-૭-૧૯૬૧

૨૬ જૈનાશ્રિત ચિત્રકલા

તત્વજ્ઞાનનાં ક્ષેત્રમાં જૈનધર્મનું સ્થાન અતિ ઉન્ત રહ્યું છે. સાહિત્યનાં ક્ષેત્રમાં જૈનધર્મે ઉત્તમ યશકલગી પહેરી છે, તેજ રીતે કલાનાં ક્ષેત્રમાં પણ તેણે ઘણું મોટું નામ પેદા કર્યું છે.

કલા એ દેખીતી રીતે ધર્મનું અંગ નથી, પણ ધર્મભાવના વક્ત કરવામાં તે ઘણી ઉપયોગી છે, તેથી જ જૈનધર્મને તેને ઉદારતાભર્યો આશ્રય આપ્યો છે. જૈનધર્મના આશ્રયે ચિત્રકલા ખીલી છે. લિપિકલાનો વિકાસ થયો છે અને શિલ્પ તથા સ્થાપન્ય કલામાં નહિ ધારેલી એવી પ્રગતિ સધાર્ય છે. સુંદર સ્તૂપો બાંધવામાં તથા ગુફા-મંદિરો બનાવવામાં પણ જૈનધર્મની સહાય ઓછી નથી.

આજે ચિત્રકલામાં અજંતાની બૌદ્ધ ગુફાઓનું નામ મોખરે આવ્યું છે, પણ અજંતાની ગુફાઓમાં ચિત્રકામ થયું તે પહેલા ઘણાં વખતથી જૈન રાજાઓએ ગુફાઓ વગેરેમાં સુંદર ચિત્રો દોરાવવાની શરૂઆત કરી હતી. મધ્યહિન્દના સરગુજા રાજ્યમાં આવેલ લક્ષ્મણપુરથી ૧૨ માઈલના અંતરે રામગિરિ નામનો પહાડ છે, તેમાં ‘જોગીમારા’ નામની ગુફાઓ છે. આ ગુફામાં જૈનાશ્રિત ચિત્રકલાના સહૃથી પ્રાચીન નમુના મળી આવ્યા છે. તેમાં પુરુષ, શિશુસમૂહ, પક્ષી, વૃક્ષ, અભ્યર્થ-સમૂહ આદિનાં ચિત્રો છે. આ ચિત્રો સંભવતઃ સંપ્રતિ રાજાએ ચિત્રરાવેલ છે. સંપ્રતિ રાજાએ હજારો જૈન મંદિરો બંધાવ્યા હતા, પણ તેમણે ગુફાઓમાં ચિત્રકામ કરાવ્યાનો આ દાખલો કદાચ પહેલો મળી આવે છે, જૈન વિદ્વાનોએ આ ગુફાઓની મુલાકાત લઈ તે અંગે વિશદ માહિતી આપતા લેખ લખવાની જરૂર છે.

દક્ષિણ હિન્દમાં પુદુકોટા રાજ્યમાં રાજ્યાનીથી ૮ માઈલ ઉત્તરમાં એક જૈન ગુફામંદિર છે, જે ‘સિતન્નવાસલ’ નામથી ઓળખાય છે. સિતન્નવાસલ નામ સિદ્ધાંશવાસ-સિદ્ધનિવાસનું અપભંશરૂપ છે. આ ગુફાઓમાં પલ્લવ રાજાઓની શૈલિનાં ચિત્ર છે. પલ્લવ રાજાઓ જૈન ધર્મા હતા. તેમાં સાહિત્યના મહાન સંરક્ષક અને પ્રસિદ્ધ કલાકાર રાજા મહેન્દ્રવર્મા પહેલો કે જેનો સમય ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ૬૨૫ ની આસપાસ મનાય છે, તેણે બનાવેલાં છે. આ ચિત્રો પ્રાચીન પણ છે અને સુંદર પણ છે. જોગીમારમાં ચિત્રોનું સંરક્ષણ જોઈએ તેવું થઈ શક્યું નથી, જ્યારે આ ચિત્રો પ્રમાણમાં સારી હાલતમાં છે અને તેના પરથી પ્રાચીન જૈન ચિત્રકલાનો સારો ઝ્યાલ આવી શકે છે.

૫૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

આ ચિત્રોની વિશેષતા એ છે કે ઘણી થોડી રેખાઓમાં અતિ સુંદર આકૃતિઓ નિર્માણ કરવામાં આવી છે. આખી ગુફા કમળોનાં ચિત્રથી અંકિત છે. તેમાં સમવસરણાની રચના પણ જોઈ શકાય છે. સ્થંભો પર નર્તકાઓનાં ચિત્ર છે. છતનાં મધ્ય ભાગમાં પુષ્કરિણી (એક જાતની વાવ) નું ચિત્ર છે. જલમાં પશુ-પક્ષીઓ વિહાર કરી રહ્યા છે. તેમાં જે મનુષ્યાકૃતિઓ દોરાયેલી છે, તે પણ પ્રમાણોપેત અને સુંદર છે.

આવા ચિત્રો ઓરીસાના ભુવનેશ્વરનાં મંદિરમાં જોવામાં આવે છે, એટલે તેની તુલનાપૂર્વક થોડા લેખો લખાય તે જરૂરી છે.

બારમીથી સોળમી સદીમાં જૈન ચિત્રકલા ખૂબ વિકાસ પામી છે. આ વખતે તાપત્રો પર સુંદર ચિત્રો ચિત્રતરાયાં છે, તેમજ કાગળ, કાષપદિકા, વસ્ત્રપટો વગેરે પર પણ મનોહર ચિત્રો અંકિત થયા છે. ‘આ કળાનો ગુજરાતમાં વધારે વિકાસ થયો અને તેમાંથી રાજ્યપૂત અને મૌગલ શૈલીનો ઉદ્ભવ થયો, એમ કલાવિવેચકોનું માનવું છે.’

મદ્રાસ ગવનમેન્ટ ખુલ્લિયમ તરફથી Tirupatti Kunram તિરુપતિ કુરનરમ્મ નામનો એક મૂલ્યવાન ગ્રંથ શ્રી ટી.એન. રામયંત્રન દ્વારા લખાઈને પ્રસિદ્ધ થયો છે. તેના પરથી દક્ષિણ ભારતની જૈન ચિત્રકલાની પદ્ધતિનો સારો જ્યાલ આવી શકે છે. તેમાંનાં અધિકાંશ ચિત્રો ભગવાન ઋષભદેવ અને શ્રી મહાવીરસ્વામીની જીવનઘટનાઓ પર પ્રકાશ પાડે છે. એના પરથી એ વખતના પોશાક, નૃત્ય કલાનો પણ પરિચય થાય છે.

અમદાવાદ શ્રી સારાભાઈ નવાબે પ્રકાશિત કરેલું જૈન ચિત્રકલ્પદ્રુમ પણ આ વિષયમાં સારો પ્રકાશ પાડે છે. ચિત્રકળાના માન્ય વિદ્વાન શ્રી નાનાલાલ સી. મહેતાએ કહ્યું છે કે ‘જૈન ચિત્રકળામાં એક પ્રકારની નિર્મણતા, સ્કુર્ત અને ગતિવેગ હોય છે, આ ચિત્રો એ વખતની સભ્યતાનો સુંદર પરિચય મળે છે.

જૈન વિદ્વાનો ચિત્રકળા અને તેના વિકાસમાં પણ રસ લે તો કેવું સારું ! જૈન સંસ્કૃતિનો પ્રકાશ કરવાનું એ પણ એક સુંદર સાધન છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૮-૮, અંક-૪૪, ૪૫, તા. ૫-૭-૧૯૬૧

૨૭ સુધારણાની સાચી દિશા

સુધારણા અમને ગમે છે, સુધારણા અમને પસંદ છે, સુધારણાને અમે હદ્યથી આવકારીએ છીએ, પણ એ સુધારણા સાચી હોય તો, સાચી દિશામાં સાચી રીતે થઈ રહી હોય તો.

અહીં અમે તેર મણનો ‘તો’ એટલા જ માટે વાપરીએ છીએ કે આજે સુધારણાનાં નામે કેં કેં ચાલી રહ્યું છે. સુધારણાના અંયળાની ઓથે દુષ્કૃત્યોનો બચાવ થઈ રહ્યો છે અને લોકોની આંખમાં ધૂળ નંખાઈ રહી છે, સુધારણાનો ઢોલ પીઠીને બેફામ બગાડની બહુરૂપી આચરણાઓ થઈ રહી છે.

બગડેલું સુધારવું, જેનાથી નુકશાન થઈ રહ્યું હોય તેને સુધારવું, અથવા જે અનિષ્ટ હોય તેને સુધારવું, એ સાચી સુધારણા છે, પરંતુ એક સારી વસ્તુને બગડેલી માનીને તેને વિકૃત કરવી કે ખરેખર લાભ કરનારી વસ્તુને નુકશાન કરનારમાં લેખાવી તેનો ઉચ્છેદ કરવા તૈયાર થવું, એ ખોટી સુધારણા છે. સુધારણાનાં નામે એક ભંયકર પ્રતારણા છે.

જો સુધારણા કરવી હોય તો પ્રથમ તટસ્થભાવે એ વિચારવું જોઈએ કે ક્યાં બગડ્યું છે ? શું બગડ્યું છે ? કેટલું બગડ્યું છે ? અને તે કેમ સુધરી શકે ? પરંતુ એમ કરવાની હુરસદ બહુ થોડાને છે. મોટો ભાગ તો ગતાનુગતિકતાના પ્રવાહમાં જ તાણાઈ રહ્યો છે.

અમારી સમજ પ્રમાણે આજે મોટો બગાડો આપણા સંસ્કારમાં થઈ રહ્યો છે. વહેલું ઉઠવું, ઉઠીને પંચ-પરમેણિનું સ્મરણ કરવું, પછી આત્મચિત્તન કરી મારે શું કરવા યોગ્ય છે ? શું છોડવા યોગ્ય છે ? તેમાંથી મેં કેટલું કર્યું ? કેટલું છોડ્યું ? એની વિચારણા કરવી અને ષડવશ્યકરૂપ પ્રતિક્રમણ યા સામાયિક, પચ્ચકભાષા કરી જ્ઞાન-દર્શન ચારિત્રને નિર્મણ કરવા, તથા જિનમંદિરે જઈ દેવદર્શન કરી, ગુરુવંદન પચ્ચકભાષા કરી, નવકારશી હોય તો તે પતાવીને ગુરુ મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરી, અષ્ટ પ્રકારની પૂજા કરી ભોજન પતાવી કામથેંબે લાગવું એ પ્રથમનો કાર્યક્રમ હતો. તેમાં આધ્યાત્મિક સંસ્કૃતિની આભા હતી. વ્યક્તિનો વિકાસ થાય એવી ગોઠવણ હતી. સમાજનું વાતાવરણ ધાર્મિક બન્યું રહે એવી સુંદર વ્યવસ્થા હતી. તેના સ્થાને આજે ‘સુધરેલો’ કાર્યક્રમ દાખલ થયો છે, તે એ કે સાત વાગે

પથારીમાંથી ઉઠવું, ઉકીને તરત જ ચાહ પીવી, પછી શૌચાદિ તથા મુખપ્રભાલનથી પરવારીને હાથમાં વર્તમાન પત્ર લેવું અને ચોરી, બળાત્કાર, ખૂન સંસારના વિવિધ પ્રકારનાં કજિયા, છેતરપ્રોતીઓ, રાજદ્વારી ઉથલોપાથલો, ભાવની હેરાફેરી વગેરેના વિચારો મનમાં ભરવા. પછી વ્યવસાય સંભાળવો અને એનકેન પ્રકારેણ પૈસા કેમ મળે ? એવી પ્રવૃત્તિઓ કરવી. આ આજનો સુધારો !

પ્રથમ ભોજન સાંદું સાત્ત્વિક કરવા તરફ લક્ષ્ય હતું. તેમાં કંદમૂળ કે બીજી અભક્ષ્ય વસ્તુનો ઉપયોગ બિલકુલ કરવામાં આવતો નહિ, તેના સ્થાને આજે તીખી તમતમતી અને માત્ર સ્વાદની દાખિએ પસંદ કરાયેલી વસ્તુનો વપરાશ વધ્યો છે. કંદમૂળનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો છે અને બીજી પણ અનેક પ્રકારની અભક્ષ્ય વસ્તુઓ લેવામાં કોઈ સંકોચ દર્શાવવામાં આવતો નથી.

પ્રથમ વડીલોનું ખૂબ માન સચવાતું, વ્યવહારનાં દરેક કાર્યમાં તેમની સલાહ લેવાતી અને તે માન્ય રખાતી. આજે વડિલોને એવા જવાબો મળે છે કે ‘તમે શું સમજો ? અમને બધી ખબર પડે છે. બધું અમે પતાવી લઈશું તમે બેઠા બેઠા જોયા કરો વગેરે.’

પ્રથમ સમાન-કુળશીલવાળા પણ અન્ય ગોત્રીયથી વિવાહ કરવાનો આગ્રહ રહેતો. એ નિયમનું ચુસ્ત પાલન થતું. લગ્નને સંયમી જીવનની એક શાળા ગણવામાં આવતી અને વિધવાએ પોતાનો સમય ધર્મધ્યાનમાં ગાળવો એ ગૌરવ ગણાતું. આજે કુળ કે શીલ કંઈ જોવામાં આવતું નથી. આગળ વધીને હવે તો તે સ્વગોત્રીય છે કે પરગોત્રીય છે, તેનો વિચાર પણ કરવામાં આવતો નથી. લગ્ન એ જીવનની મોજ માણવાનું સાધન ગણાય છે અને વિધવાએ તો ફરી પરણી જ જવું જોઈએ એવો આગ્રહ રખાય છે ! કેવો યુગ ? ધર્મસંસ્કૃતિના પ્રેમીઓને જ્યારે એવું સાંભળવા મળે કે સુધારકવાદ અને કેળવણીની હિમાયત સાથે હવે એ શિરસ્તાની છૂટ છે કે મોટો છોકરો ગુજરી જાય તો તેની વિધવા પત્નીને નાના છોકરા સાથે પરણાવી દેવી, જેથી તેને અલગ જીવાઈ કે મિલકતમાંથી ભાગ આપવો પડે નહિ, ત્યારે પારાવાર હુંખ થાય છે.

આ સુધરેલા કાર્યક્રમોમાં ઈશ્વર-પ્રભુ-ભગવાનનાં સ્મરણ-દર્શન-સેવા-પૂજાને સ્થાન નથી. આત્મહિત કે આત્મકલ્યાણની કોઈ વિચારણા નથી, પાપ-પુણ્યનો વિવેક નથી કે પરલોકનો ડર નથી. જો સુધારો જ કરવો હોય તો પહેલા તો આ બગડી રહેલા સંસ્કારોમાં સુધારો કરવો જોઈએ અને તે વહેલી તકે.

સુધરવાની સાચી વિધાઓ છે, બાકી બધી માયાજળ છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૮, અંક-૪૬, તા. ૧૨-૮-૧૯૬૧

૨૮ ઉગરવું હોય તો જૈન સંસ્કૃતિને અપનાવો

જૈન સંસ્કૃતિ એ શુદ્ધ આર્થ સંસ્કૃતિ છે. તેનું મુખ્ય લક્ષ્ણ દ્યા, કરુણા કે અનુકૂળા છે. ક્ષમા, ઉદારતા, સહનશીલતા, સેવાવૃત્તિ, પરોપકાર પરાયણતા એ બધા ગુણો તેમાંથી પાંગરે છે અને સ્વપરનું કલ્યાણ કરવામાં સમર્થ નીવડે છે.

જૈન સંસ્કૃતિએ પોતાની સમક્ષ સપ્ત મહા વસનના નિષેધનો આદર્શ રાખ્યો છે, એટલે તે જુગાર, મધ્યપાન, માંસભક્ષણ, ચોરી, વ્યાભિચાર (પરસ્ની-ગમન), વેશ્યાગમન અને શિકારનો નિષેધ કરે છે. પ્રજા આ મહાવસનોમાંથી મુક્ત રહે એવા પ્રયાસો કરવામાં તે પુરુષાર્થની સાર્થકતા લેખે છે. મહારાજા સંપ્રતિ, મહારાજા કુમારપાળ, મહારાજા આમ વગેરે અનેક જૈન રાજાઓ આ આદર્શને અનુસર્યા છે અને તેમનાં રાજ્યો પ્રજાને શાંતિ આપનારાં તથા કલ્યાણકારી નીવડ્યાં છે. તાત્પર્ય કે પ્રજાનું સાચા અર્થમાં કલ્યાણ કરવું હોય તો કોઈ પણ રાજ્યે આદર્શ અપનાવવા જેવો છે.

જ્યાં દ્યા-કરુણા-અનુકૂળા નથી, પાપ પ્રત્યે કોઈ પ્રકારની સૂણ નથી, બીજાની લાગણીનો વિચાર નથી, માત્ર પોતાની હલકટ સ્વાર્થવૃત્તિને પોષવાની જ પ્રવૃત્તિ છે, તે અનાર્થ સંસ્કૃતિ છે, પછી તેણે ગમે તેટલાં ઉજાંના કપડાં ભલે પહેર્યા હોય, પણ્ણિમની સંસ્કૃતિ કે ભૌતિક સંસ્કૃતિ આ પ્રકારની છે.

ભારત લાંબા સમય સુધી પરાધીનતા ભોગવીને આજાદ થયું છે અને ધારે તો પોતાની પ્રાચીન આર્થ સંસ્કૃતિને આગળ વધારી સાચાં કલ્યાણ રાજ્યની સ્થાપના કરી શકે છે, પણ પરિણિતિ બેદજનક છે. દેશનેતાઓ પણ્ણિમની સંસ્કૃતિથી પૂરેપૂરા રંગાયેલા છે અને તેનાથી જ જનકલ્યાણ થવાનું હોય એમ માનીને તેના ચીલે ચાલી રહ્યા છે. પરિણામે આ દેશમાં હિંસાનું પ્રમાણ ઘણું વધી જવા પામ્યું છે અને અસત્ય, ચોરી, લાંચરુશ્યત, વ્યાભિચાર, સંધરાખોરી વગેરે દૂષણોએ પણ પગદ્દો જમાવ્યો છે. પ્રજાનું નૈતિક ધોરણ ઘણું નીચે ઉત્તરી ગયું છે અને તેથી કોઈપણ જાહેર કાર્યો સારી રીતે કે સાંગોપાંગ પાર ઉત્તરતા નથી. છાશવારે ને છાશવારે ઔદ્ઘોગિક વિકાસનાં બણગાં ઝૂક્વામાં આવે છે, પણ ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં થયેલા ભયંકર ઝાસનો તેમની પાસે કોઈ જવાબ નથી.

પણ્ણિમની સંસ્કૃતિ આજે અમેરિકામાં પુર બહારમાં ખીલી છે પણ ત્યાંની

ભીતરી હાલત કેવી છે, તે તો જુઓ. ત્યાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જ રહ્યું છે અને ગયા વર્ષે તો તેણે આગલા સર્વ વર્ષોનો રેકર્ડ તોડ્યો છે. ગયા વર્ષમાં ત્યાં દર ૫૮ મીનીટે એક ખૂન અને દર ૩૪ મીનીટે એક બળાત્કારનો બનાવ બન્યો છે. આ વસ્તુ ધી ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર મી. જોએડગાર હુવરે રજૂ કરેલા વાર્ષિક વૃત્તાંતમાંથી બહાર આવવા પામી છે.

તેઓ એ અહેવાલમાં જણાવે છે કે '૧૯૫૦ થી ૧૯૬૦ નાં ૧૦ વર્ષો દરમિયાન દેશની વસ્તીમાં ૧૮ ટકાનો વધારો થયો છે, જ્યારે ગંભીર ગુનાખોરીમાં ૭૮ ટકાનો વધારો થયો છે.'

૧૯૬૦માં ૧૮,૬૧,૩૦૦ ગંભીર ગુનાઓ થયા હતા. જે ૧૯૫૮ થી ૧૪ ટકા વધારે હતા. જેમાં દર ૩૮ સેકન્ડે એક ઘર ફોડવાનો અને દર બે મીનીટે એક કારની ચોરીનો સમાવેશ થતો હતો.

અગાઉના વર્ષો કરતાં ખૂનોમાં ૬ ટકાનો વધારો થયો હતો અને બળાત્કારના બનાવો ૧૯૫૮ કરતાં ૩ ટકા વધારે હતા.

૧૯૫૦ કરતાં ૧૮ વર્ષની અંદરના ગુનેગારોની ધરપકડની સંખ્યા લગભગ બેવડી થઈ ગઈ હતી. એ સમયમાં યુવકોની સંખ્યા અર્ધા ટકાથી ય ઓછી વધી હતી.

જે વસ્તુ આજે અમેરિકા કે યુરોપમાં બને છે, તે આવતી કાલે ભારતમાં બને છે, એટલે ભારત શાસકોએ ચેતવું ઘટે છે.

પશ્ચિમની સંસ્કૃતિમાં આત્મા, પરલોક કે પુણ્ય-પાપનો સ્વીકાર નથી. એટલે તેને અનુસરનારાઓ વર્તમાન જીવનને જ સર્વસ્વ માનીને ચાલે છે અને એ જીવનને તેમની કલ્પના પ્રમાણેનું સુખ આપવા માટે અનેક જીતનાં પાપો કરે છે. તેમને પરિણામનો ઉર તો છે જ નહિં, એટલે તેમને નીતિમાન કે સત્યવાદી બનવા માટે અપાતો સર્વ ઉપદેશ નિરથક નીવડે છે.

અમે ભારપૂર્વક કહીએ છીએ કે પ્રજાજીવન અધ્યપતન તરફ સરકી રહ્યું છે તેમાંથી ઉગરવું હોય તો જૈન સંસ્કૃતિને અપનાવો. પરલોકદિષ્ટ જગાડો અને સપ્ત મહાવ્યસનના નિષેધનો કાર્યક્રમ બનતી ત્વરાએ અમલમાં મૂકો.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૨, તા. ૮-૮-૧૯૬૧

૨૬ ચોરવૃત્તિને દૂર કરો !

(૨)

(અંક ૪૭, તા. ૧૯-૮-૬૧ “ચોરવૃત્તિને દૂર કરો !”ના અનુસંધાનમાં)

લડાઈના સમયમાં ઘણા માણસો કાળાં બજાર કરીને કમાયાં, તેમાંથી કેટલું ધન રહ્યું ? તે એક યા બીજા રસ્તે પંજો માપી ગયું. વળી તે આવ્યું ત્યારથી ઘરમાં કેટલી માંદગી વધી, કેટલો કલેશ વધ્યો, બીજી પણ કેટલી ખરાબી થઈ, તેનો હિસાબ કાઢો !

એક ઇન્જિનિયરે નદી પર પૂલ બાંધવાનો કોન્ટ્રેક્ટ લીધો. તેમાં ગોલમાલ કરીને બે લાખ રૂપિયા ખાઈ ગયો અને પૂલનું કામ કાચું રાખ્યું. કાયદેસરની બધી વિધિમાંથી તે પસાર થઈ ગયો, એટલે તેને નિરાત હતી કે હવે તો મારી પાસે બે લાખ રૂપિયા આવી ગયા છે, અને તેનો મન માન્યો ઉપભોગ કરીશ. તે એક હવા ખાવાનાં સ્થળે ગયો અને તે પસંદ પડતાં પોતાનાં આખાં કુટુંબને ત્યાં આવવાનું જણાવ્યું. કુટુંબે તૈયારી કરી અને રેલવે પકડી. હવે તે રેલવે ધસમસ્તી પેલા પૂલ પર આવી કે પૂલ તૂટ્યો અને તેનાં કુટુંબનાં બધા માણસો તેમાં માર્યા ગયા. એક પણ જીવતું રહ્યું નથી. જ્યારે આ સમાચાર ઇન્જિનિયરને મળ્યા, ત્યારે તે ચક્કર ખાઈને ભોય પર પડ્યો. જ્યારે તે શુદ્ધિમાં આવ્યો, ત્યારે બોલી ઉઠ્યો; ‘મારું પાપ મને જ નહિં, ખરેખર ! હકની કમાણી રહે છે છે, અણાહકની કમાણી રહેતી નથી.’

શું બીજાઓ એમ માને છે કે અમે ગમે તેટલું અણાહકનું લઈશું, તો પણ અમને કંઈ થવાનું નથી ? જે દશા ઇન્જિનિયરની થઈ, તેજ દશા બીજાની થવાની, પછી એનું સ્વરૂપ ભલે ભિન્ન પ્રકારનું હોય, અને એટલેથી ય પત્તાનું નથી, પરલોકનાં ભયંકર હુંબ તો ઊભાં જ છે !

હજી પણ ચોરી અંગે વિશેષ સમજવાનું છે શાસ્ત્રકારોએ કહ્યું છે કે-

(૧) જે મનુષ્ય સ્વયં ચોરી કરે છે, તે ચોર છે.

(૨) જે મનુષ્ય બીજા પાસે ચોરી કરાવે છે, તે પણ ચોર છે.

(૩) જે મનુષ્ય ચોરી કેમ કરવી ! તેની સલાહ આપે છે, તે પણ ચોર છે.

(૪) જે મનુષ્ય ચોરીનો ગુપ્ત ભેદ જાળવી રાખે છે, તે પણ ચોર છે.

- (પ) જે મનુષ્ય ચોરી લાવેલી વસ્તુઓને વેચી આપે છે, તે પણ ચોર છે.
 (હ) જે મનુષ્ય ચોરને રોટલો આપે છે, તે પણ ચોર છે.
 (જ) અને જે મનુષ્ય ચોરને ઓટલો આપે છે, તે પણ ચોર છે.

શાસ્ત્રમાં તો એમ કહ્યું છે કે જે ચોરને કુશળ સમાચાર પૂછે છે, હાથ-પગની સંજ્ઞાથી માર્ગ દેખાડે છે, ‘ચોર ક્યાં ગયો ?’ એમ પૂછતાં બરાબર જવાબ આપતા નથી, તેને સૂવા માટે શય્યા આપે છે, બેસવા માટે આસન આપે છે, પગે ચોળવા તેલ આપે છે, રસોઈ પાણી કરવાની સગવડ કરી આપે છે, ધૂપાવા માટે જગા આપે છે. ઢોરોને બાંધવા દોરા-દોરડાં આપે છે, તેમજ તેમને સારું સારું ખાવા-પીવા આપે છે. તે બધા ચોરને ઉતેજન આપનારા હોઈ ચોર જ છે.

ચોરી માટે કહ્યું છે કે ‘અભિનિશખાઓનું પાન કરવું સારું, સર્પના મુખને ચુંબન કરવું સારું અથવા હળાહળ જેરને ચાટી જવું સારું, ‘પણ પારકાનું દ્રવ્ય હરણ કરવું સારું નહિ.’

કોઈ તર્કવાદી પ્રશ્ન કરે કે ‘શા માટે ?’ તો શાસ્ત્રકારોએ તેનો સચોટ ખુલાસો કરેલો છે. તેઓ જણાવે છે કે દ્રવ્ય એ મનુષ્યનો અગિયારમો પ્રાણ છે, કારણ કે ગૃહસ્થજીવનનો સઘણો વ્યવહાર તેના આધારે જ ચાલે છે. આવા અગિયારમા પ્રાણ સમાં ધનનું હરણ કરવાથી તેના માલીકને સખત આધાત થાય છે, કોઈ વાર તો એ આધાત એટલો મોટો હોય છે કે તેના લીધે મૂર્છા આવી જાય છે, ઉન્માદ લાગુ પડે છે કે પ્રાણપંખેરું જ ઉડી જાય છે. તેથી કોઈના પણ દ્રવ્યનું હરણ કરવું એ ભયંકર પાપ છે.

વળી ચોરી કરતાં બંધને બંધાવું પડે છે, લાઠી વગેરેના માર પડે છે, જેલમાં જવું પડે છે અને ત્યાં મીઠા પાયેલા ચાબુકોનો માર સહન કરવો પડે છે. ઘણીવાર ચોરી કરતાં તલવારના ઝટકથી કે બંદુકની ગોળીથી મરણ પણ થાય છે અને ગતિ બગડી જાય છે. આ રીતે મરનારની સફ્રગતિ ક્યાંથી થાય ?

કેટલાક ચોરી કરીને ધન મેળવે છે અને પછી તેને વાપરવામાં ઉદાર બને છે. ધનભૂષ્યા લોકો તેની વાહ વાહ કરે છે અને વર્તમાનપત્રોમાં તેના દાનવીર તરીકે ફોટા છપાય છે, પણ આ રીત સાચી નથી, ભૂલ ભરેલી છે. પાપ કરીને તેને ધોવાનો પ્રયત્ન કરવો, એના કરતાં પાપ જ ન કરવું એ માર્ગ વધારે શ્રેષ્ઠ નથી ?

પૂર્વ મહર્ષિઓએ પોકારીને કહ્યું છે કે, ‘ચોરવૃત્તિને દૂર કરો.’ અને એમે પણ એમના પગલે પોકારીને કહીએ છીએ કે ચોરવૃત્તિથી દૂર રહો.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૪, તા. ૩૦-૯-૧૯૬૧

૩૦ તીર્થયાત્રા

(૧)

તીર્થયાત્રા જીવનને સુધારનારી છે; જીવનને ઉન્નત બનાવનારી છે; જીવનને શુદ્ધ-નિર્મણ-પવિત્ર કરનારી છે. તેથી જ સર્વ મહાપુરુષોએ તેની અગત્યતા સ્વીકારી છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિમાં અગત્યનું સ્થાન આપ્યું છે. જૈન શાસ્ત્રોનું તો સ્પષ્ટ ફરમાન છે કે શ્રાવકોએ વર્ષમાં એક વાર નાના-મોટા કોઈ પણ તીર્થની યાત્રા અવશ્ય કરવી. આવી તીર્થયાત્રા ભૂતકાળમાં પણ થતી અને આજે પણ થાય છે. પરંતુ આ બંને યાત્રાઓ વચ્ચે મોટું અંતર પડી ગયું છે, તે અમે પાઠકોનાં ધ્યાન પર લાવવા હૃદ્યીએ છીએ.

પ્રથમ યાત્રા પગપાળા કે ગાડામાં બેસીને થતી, ત્યારે તે વિકટ ગણાતી, કારણ કે રસ્તામાં નદી, નાળા, જંગલો પસાર કરવા પડતાં, અનેક અજાણ્યા પ્રદેશો વટાવવા પડતા, ચોર-લંટારુંનો ભય રહેતો અને માર્ગમાં આવતાં નાનાં નાનાં રાજ્યોને દાણ-કર-ભેટ-સોગાદ વગેરેથી સંતોષવા પડતાં. પરંતુ આ વિકટતા સામે લાભો પણ ઘણા હતા. તેથી જીવનમાં ખડતલતા આવતી, બહાદુરી પ્રકટતી, નવા નવા પ્રદેશો જોવાતા, અને વિશેષે કરીને નવાં નવાં જિનમંદિર, ધર્મસ્થાન તથા સંધોના દર્શન થતાં, લોકસંપર્કમાં અવાતું, તેથી ભાષાજ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ થતી અને જીવનનો રંગ બદલાઈ જતો. મહાન લાભ તો એ થતો કે દીર્ઘયાત્રાકાળ દરમિયાન હૈયે ધર્મ ભાવના રમ્યા કરતી અને યાત્રિકો સાથે ધર્મ ચર્ચા ચાલ્યા કરતી. ઘર છોડ્યું એટલે તેની સાથે કોઈ સંબંધ ન રહેતો, ધંધાધાપાની વાત સાવ ભૂલાઈ જતી અને તીર્થની-તીર્થધિપતિની જ મુદ્રા હદ્યમાં અંકાઈ જતી. સવાર, બપોર, સાંજ તેનો જ જાપ અને ધ્યાન ચાલતું અને દરેક સ્થાને તેની જય બોલાતી.

પરંતુ તીર્થયાત્રાનો ખરો ચયત્કાર તો છ’-રીમાંથી જન્મતો અને એ વખતે છ’-રીનો લાભ પણ ખૂબ લેવાતો. પાદ વિહારી બનવું એ પહેલી રી ગણાતી. એનાથી શરીર કસાતું, નાના મોટા રોગો નષ્ટ થઈ જતા અને વિષય-વિકારનું પ્રમાણ પણ ઓછું થઈ જતું. રાત્રે ઊંઘ ગુલાબી આવતી અને દિવસભરનો શ્રમ હરાઈ જતો. સમભાવપૂર્વક કાયાને પડતું કષ સહન કરી લેવું એ કાયકલેશ નામનું તપ છે, એટલે તેમને આ તપનો લાભ મળતો.

એકાહારી બનવું એ બીજી રી ગણાતી. એનાથી છૂટા મ્હોએ ખાવાનું બંધ

થતું, જિબવા પર કાબૂ આવતો અને સંયમસાધનામાં સહાય મળતી, એક વાર પેટને ભાડું આપી દીધા પછી ફરી તે સંબંધમાં કોઈ ચિંતા કરવાની રહેતી નહિ.

અચિત્તાહારી થવું એ ગ્રીજા રી ગણાતી. એનાથી સર્વ સચિત વસ્તુનો ત્યાગ થતો, અહિસાની ભાવના વૃદ્ધિ પામતી અને રસનેન્દ્રિય પર કાબૂ આવતો. રસનેન્દ્રિય પર કાબૂ આવ્યો કે બીજી ઇન્દ્રિયો પણ સરલતાથી વશ થઈ જતી.

ભૂમિ સંસ્તારકારી થવું એ ચોથી રી ગણાતી એટલે સૂવાનું ભૌંય સંથારે રહેતું. ભૌંય પર સાદડી-ચારાઈ કે શેતરંજી પાથરીને તેનો સૂવા માટે ઉપયોગ કરાતો. આથી સ્પર્શનેન્દ્રિય પર કાબૂ આવતો, તિતિક્ષા શક્તિ વધવા પામતી અને બ્રહ્મચર્યના પાલનમાં મદદ મળતી.

બ્રહ્મચારી થવું એ પંચમી રી ગણાતી. બ્રહ્મચર્ય સર્વ પ્રતોમાં ઉત્તમ છે અને તેના લાભો અગણિત છે. તેનાથી આત્મદર્શન થવામાં જે સહાય મળે છે, તેવી અન્ય કશાથી મળતી નથી.

શુદ્ધ સમ્યક્તવધારી થવું એ છઢી રી ગણાતી. આ લાભ તો બધા લાભો કરતાં ચડી જાય એવો હતો, કારણ કે તેમાંથી દેવ ગુરુ-ધર્મની શ્રદ્ધા દઢ થતી અને ભવભ્રમણની મર્યાદા બંધાઈ જતી. જેને શુદ્ધ સમ્યક્તવ પ્રાપ્ત થયું તે વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળમાં તો અવશ્ય મોક્ષ જવાનો.

યાત્રા જયારે આ પ્રકારની થતી, ત્યારે તીર્થધામમાં દૂરથી દર્શન થતાં જ હૈયામાં હર્ષની હેલી ચંડતી. શ્રીફળ અને સોનાં રૂપાનાં ફૂલોથી તેનાં વધામણાં થતાં. ચેત્યવંદનાદિ કિયા ભારે ઉલ્લાસપૂર્વક થતી.

તીર્થધામ સમીપ આવતું ત્યારે આનંદ અને ઉલ્લાસનો પાર ન રહેતો. ત્યાં તીર્થોપવાસ થતો, સંઘની ભક્તિ થતી, ચૈત્યનાં જીર્ણોદ્વારાદિ કાર્યોનો વિચાર થતો. તે માટે સ્વોપાર્જિત દ્રવ્યનો ઉછળતાં હૃદયે સદ્ગ્રદ્ધય થતો. દાનાદિ બીજાં કાર્યો પણ સારાં પ્રમાણમાં થતાં. આ રીતે એક જ મોટી યાત્રા આખા જીવનનું પરિવર્તન કરી નાભતી, જીવનમાં ધર્મ ભાવના ઠાંસીને ભરી દેતી.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૫, તા. ૭-૧૦-૧૯૬૧

(૩) (૨)

આજે તીર્થયાત્રા રેલવે અને મોટરો દ્વારા થાય છે અને કેટલાક ભાગ્યશાળીઓ તે માટે વિમાનનો ઉપયોગ પણ કરે છે. આથી અંતર જરૂરથી કપાય છે એ તીર્થધામમાં જલદી પહોંચી શકાય છે. રસ્તામાં ખાસ હાલાકી વેઠવી પડતી નથી.

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૬૩

જે થોડી વેઠવી પડે છે, તે નામ માત્રની હોય છે. આથી આજની યાત્રા સરળ અને સગવડભરી મનાય છે.

પરંતુ તેથી બહુ આનંદ પામવા જેવું નથી. સરલતા અને સગવડ મેળવવા જતાં આપણે ધણા લાભોથી વંચિત બન્યા છીએ. જીવનમાંથી ખડતલતા ચાલી ગઈ છે. થોડું ચાલવું પડે, થોડો બોજો ઉંચકવો પડે કે કેટલુંક કામ હાથે કરવું પડે તો મોટું સક્રિય આવી પડ્યું હોય તેવી લાગણી થઈ આવે છે. વીરતા તો બિલકુલ દેખાતી નથી. પાંચ મવાલી કે ગુંડા સામા મળ્યા હોય તો પણ ગભરાટ છૂટે છે અને ભાગંભાગ થઈ પડે છે. તેમાં સ્ત્રી અને બાળકોનું રક્ષણ કરવાનું પણ બાજુએ રહી જાય છે. રસ્તામાં કેવા પ્રદેશો આવ્યા, કેવા લોકો આવ્યા, તે કંઈ જાણી શકતું નથી. પારસલનું એક સ્ટેશનથી બુકિંગ થયું હોય તે સરનામાવાળાં સ્થાને ઉત્તરી જાય તેના જેવો ઘાટ હોય છે. આ જાતના પ્રવાસમાં પણ, પક્ષી, વનસ્પતિ કે ભાષાનાં જ્ઞાનમાં કંઈ અભિવૃદ્ધિ થતી નથી. જીવનનો રંગ એવો ને એવો જ રહે છે. એ જ ટેવો, એ જ આદતો, એ જ બોલીચાલી ને એ જ જીવનની બબદ્ધબ. તેમાં કંઈ પણ પરિવર્તન થતું નથી. સાચું પૂછ્યો તો પ્રભુભક્તિના લાભ સિવાય પદ્યાત્રાના બીજા લાભોની દસ્તિએ તો ‘હીરો ઘોધે જઈ આવ્યો અને તેલે હાથ દઈ આવ્યો’ તેના જેવી સ્થિતિ દ્રેન થાય છે.

યાત્રાએ આવ્યા છતાં ધણાનું મન ધંધામાં ચોટેલું રહે છે, તેથી તાર-ટપાલ ચાલુ રહે છે અને વારંવાર ફોનનો પણ આશ્રય લેવાય છે. તેમાં લેતી દેતી ચાલુ રહે છે કે નવાં નવાં કામો માટે આદેશ અપાય છે.

પ્રથમ વડનાં જાડ નીચે નાની સરખી ચટાઈ કે સાદડી પાથરી તે પર પડ્યા રહેવામાં આનંદ મનાતો. આજે આલિશાન ધર્મશાળાઓ હોવા છતાં ઉત્તરાની ચિંતા રહે છે, ધારી ઓરડી મેળવવા માટે ધમાલ થાય છે અને મુનીમ-ગુમાસ્તાઓ જોડે લડવા-ઝઘડવાના પ્રસંગો પણ બને છે. વાસણ-ગોદાં ઓછાં મળ્યાં કે વાહનની ધારી સગવડ ન થઈ તો નાકનું ટીચું તરત ઊંચું ચે છે અને ‘નોનસેન્સ’ શર્ષ મુખમાંથી બહાર નીકળી પડે છે.

તીર્થોપવાસ દૂર રહ્યો, એકાશન પણ દૂર રહ્યું અને સચિત ત્યાગ પણ દૂર રહ્યો, અહીં મનભાવતાં ભોજનો તૈયાર કરવાની યોજના થાય છે અને તીર્થયાત્રા એક આનંદપર્યટનમાં ફેરવાઈ જાય છે.

જ્યાં મનોવૃત્તિ આ પ્રકારની હોય ત્યાં ભક્તિનાં પૂર ચે ક્યાંથી ? ત્યાં ભાવમાં મસ્તી આવે ક્યાંથી ? સેવા-પૂજા બધું યંત્રવત્ ! જલદી તીર્થયાત્રા કરીને ધર ભેગા થઈ જવાની વૃત્તિ ! નહિ જીર્ણોદ્વારાની ચિંતા, નહિ સંઘ ભક્તિ, નહિ

૬૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

કોઈને છૂટા હાથે દાન, જે કરવાનું તે માત્ર વ્યવહારથી-બાધ્ય ભાવે કરવાનું.
આમાં તીર્થયાત્રાનો ચમત્કાર દેખાય શી રીતે ?

‘નહિ તીર્થયાત્રા’ કરતાં આ તીર્થયાત્રા સારી છે, પણ તેનો અર્થ એ નથી કે એમાં વિચારવા જેવું કંઈ નથી. પ્રથમ તો તીર્થયાત્રાનો ઉદેશ ઘ્યાલમાં રાખવો જોઈએ કે અહીં પાપથી મુક્ત થવા જઈએ છીએ, મન વચન કાયાને પવિત્ર કરવા જઈએ છીએ. એટલે તેમાં કોઈ પણ પાપનું સેવન થાય નહિ, થઈ જાય તો દિલગીર થવું ઘટે અને બીજુ આજુ આત્મવિકાસની કિયાઓમાં સંલગ્ન થવું ઘટે. પ્રભુસ્મરણ ધર્મજાગરિકા, ઉભય ટંક આવશ્યક, જિનભક્તિ, ગુરુભક્તિ, અભક્ષનો સંપૂર્ણ ત્યાગ, વિકથામાંથી નિવૃત્તિ, યથાશક્તિ તપ અને યથાશક્તિ દાન, આ બધી વસ્તુઓ તીર્થયાત્રામાં અવશ્ય કરવા જેવી છે, તેથી જ તીર્થયાત્રા સરળ થાય છે.

તીર્થભૂમિને સ્પર્શ કરતાં અધમનો પણ ઉદ્ધાર થાય છે, પરંતુ સ્પર્શ કરવાનો ય વિધિ છે; એ આપણે ભૂલવાનું નથી.

હવે તીર્થયાત્રાની સ્પેશયલો નીકળવા માંડશે, તેમણે પણ આ વસ્તુઓ પર ખાસ વિચાર કરવાની જરૂર છે.

સાધગીમાં સંચય

જયપુરમાં પૂજ્યશ્રી સાંજે રોજ નીચે દેરાસરે દર્શન કરવા જાય. એક હાઈક્લાસ કામળી પૂજ્યશ્રી માટે શિષ્યોએ કાઢીને રાખેલી - પણ પૂજ્યશ્રી એ ઓછે નહીં, એના બદલે શિષ્યની લાલપણીની કામળી માંગીને ઓઢીને જાય. તપાસ કરતાં વર્ષો પછી ખબર પડી કે સ્વ. પૂ. ગુરુવર પ્રેમસ્કૂરીશ્વરજી મ. સાહેબ, પૂ. આ. શ્રીયશોદેવસ્તૂરિમહારાજ અને પૂ.પ. ભાનુવિજયજી મ. ત્રણેયએ નિયમ કરેલો કે બહુ ભારે મૂલ્યવાળી કામળી બને ત્યાં સુધી ન ઓઢવી, લાલ પણવાળી કામળી જ મળે ત્યાં સુધી ઓઢવી. (અમુક અપવાદ સિવાય) પૂજ્યશ્રીએ આ નિયમ છેવટ સુધી પાળીને ગુવજ્ઝાને વફાદાર રહાા. ઘન્ય છે પૂજ્યશ્રીની નિઃસ્પૃહતા અને વૈરાગ્યને.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્ણ

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૬, તા. ૧૪-૧૦-૧૯૬૧

૩૨ સંઘપતિ કેવા હોય ?

(૧)

સંઘવી એ સામાન્ય, સાધારણ કે મામુલી શર્ષ નથી, પણ અતિ મહત્વનો માનભર્યો પદવીસૂચક શર્ષ છે. આ શર્ષ પોતાનાં નામની પાછળ લગાડવાનો હક્ક તેને જ પ્રાપ્ત થાય છે કે જેમણે પોતાના જીવનમાં કોઈ પણ તીર્થનો યાત્રિક સંઘ કાઢ્યો હોય અને તેના નાયક બનીને પોતાની જવાબદારી બરાબર અદા કરી હોય. સંઘપતિમાંથી સંઘવર્ષ શર્ષ બન્યો અને સંઘવર્ષ શર્ષમાંથી સંઘવી શર્ષ બન્યો, એટલે સંઘવીનો અર્થ સંઘપતિ, સંઘનાયક કે સંઘ કાઢનાર મહાનુભાવ છે.

સંઘવી થનારમાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અનન્ય શ્રદ્ધા જોઈએ, ઉદારતા જોઈએ, સહનશીલતા, સેવાવૃત્તિ અને નમત્રતા જોઈએ. નહિ તો સંઘવી પદ શોભે નહિ. આ સાથે તેનામાં નીડરતા અને બહારુરી પણ જોઈએ. જેથી સંઘનું રક્ષણ કરી શકે અને તેને સહીસલામત તીર્થયાત્રા કરાવી શકે. અહીં અમને સં. ૧૯૭૦નો એક પ્રસંગ યાદ આવે છે કે જે શ્રી જશકીર્ત મુનિજીએ સમેત શિખરના રાસમાં નોંધેલો છે.

આગરાના સુપ્રસિદ્ધ સંઘપતિ કુવરપાલ અને સોનપાલ લોઢાએ શ્રી સમેતશિખર ગિરિરાજનો સંઘ કાઢ્યો હતો. તેઓ જુદાં જુદાં તીર્થધામોની યાત્રા કરતાં કરતાં પટણા આવ્યા અને ત્યાંથી વિહાર (આજનું બિહારે શરીફ) પહોંચ્યા. અહીં રાજ રામદેવના મંત્રીએ આવી નમસ્કાર કર્યા અને કાર્ય પૂછ્યું, સંઘપતિએ કહ્યું ‘તમે કોલ (વચન) મંગાવો તો અમે ગિધૌરના માર્ગ આવીએ. આથી મંત્રીએ માણસ મોકલીને રાજ રામદેવ પાસેથી કોલ મંગાવ્યો.

ત્યાંથી પાવાપુરીની યાત્રા કરી સંઘ નવાદા આવ્યો. અહીં સાદીક મહમ્મદભાનનો પુત્ર મીરજા હુલ્લાહ સંઘપતિને મળ્યો. સંઘપતિએ તેને પહેરામણી કરી. ત્યાંથી પ્રયાણ કરી તેઓ સબરનગર આવ્યા કે જ્યાં રાજ રામદેવ રાજ્ય કરતો હતો. સંઘનું આગમન થેબું જ્ઞાની મંત્રી સામે આવ્યો અને ઉચિત સ્વાગત કરીને તેમને સારી જગાએ ઉતારો આપ્યો.

અહીં ચાર દિવસનો મુકામ કરી સંઘે નજીકમાં રહેલ સિંહ ગુફામાં શ્રી વર્ધમાન સ્વામીના દર્શન કર્યા. પછી સંઘપતિ રાજાને મળ્યા અને કહ્યું; ‘હવે અમને તીર્થયાત્રા કરાવો, અર્થાત્ આગળ ચાલી ગિરિરાજનો માર્ગ બતાવો.’ રાજાએ કહ્યું;

‘ચાર દિવસમાં જ આપ થાકી ગયા આપની પહેલાં જે જે મોટા સંઘપતિઓ અહીં આવ્યા, તે તો મહિનો-મહિનો રહેલા છે.’

સંઘપતિ સમજુ ગયા કે આ બ્રાહ્મણ રાજુ ધનલોભી છે. સંઘને જોઈ તેની નજર ફૂટી ગઈ છે અને તેથી જ તે આવાં પ્રકારનાં વચનો બોલે છે. તેમણે રાજાને કહ્યું; અમને ધણા દિવસો થઈ ગયા. માલગંજ કંઈ પાસે પડ્યું નથી, માટે અમને રસ્તો બતાવો.’ એ વખતે માલગંજથી સમેતશિખરજીની યાત્રા થતી. કે જે મધુબનથી દ-૭ માઈલનાં અંતરે આવેલું છે.

રાજુ રામદેવે કહ્યું; ‘હું માગું તે મને આપો.’ સંઘપતિએ કહ્યું; ‘હું તમને રાજુ કરીશ; પણ બળજબરીથી કામ નહિ ચાલે. કંઈક અત્યારે લો, કંઈક પણીથી લેજો.’ રામદેવે કહ્યું; પણી શું બને? હું માગું તે મને અત્યારે જ મળવું જોઈએ.’ રાજુ રામદેવ એમ સમજતો હતો કે સંઘ હવે મારી હદમાં આવી ગયો છે. તેને મોં માંગ્યા પૈસા આપ્યા વિના ચાલવાનું નથી, એટલે તેણે આ દરખાસ્ત કરી હતી. પરંતુ સંઘપતિ સ્વમાની હતા, સાથે નિરા અને બહાદુર પણ તેવા હતા. તેમણે કહ્યું; ‘તમે તમારું વચન ચૂકી ગયા છો, માટે તમને ધિક્કાર છે. જો હું તમારા મસ્તક પર પગ મૂકીને માલગંજ પહોંચું તો મને ઓસવાલ જાણજો.’

આ સંઘ સાથે ૫૦૦ સુભટો હતા અને પ્રસંગ પડ્યે અનેક યાત્રીઓ પણ લડી શકે એવા હતા. આ વખતે તેમની પાસે ધન ધર્યું હતું, વસ્ત્રાદિ સામગ્રી પણ ધર્યી અને અનાજની ૧૨૦૦ પોઠો હતી.

સંઘપતિએ પાછા ફરીને નિશાન વગડાવ્યું અને પ્રયાણની તૈયારી કરી. નગરમાં ખળભળાટ મચ્યો. લોકો તરેહ તરેહની વાતો કરવા લાગ્યા. અને હવે શું બને છે? તેની રાહ જોવા લાગ્યા.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૭, તા. ૨૧-૧૦-૧૯૬૧

(૩૩) (૨)

રાણી ડાહી હતી. તેણે રાજાને હપકો આપ્યો કે તમે આ શું કર્યું? આમ કરવું તમને બિલકુલ શોભતું નથી. હજુ પણ કંઈ બગડી ગયું નથી. તમે સંઘપતિને સમજાવી લો ને તેઓ આ માર્ગ જ પોતાનો સંઘ લઈ જાય તેવું કરો.’

આથી રાજાએ પોતાના મંત્રીને સંઘપતિ પાસે મોકલ્યો. તેણે ધણો અનુનય-વિનય કર્યો અને જણાવ્યું કે આપ રાજુ થશો તેમ કરીશું. પણ સંઘને અહીંથી પાછો ન ફેરવશો. સંઘપતિએ કહ્યું: ‘મને તમારામાં વિશ્વાસ નથી, હવે હું તમને

આ નિભિતે ફૂટી દમડી આપવા પણ તૈયાર નથી, અમે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ, તો કોઈ પણ ઉપાયે તીર્થયાત્રા કરીશું. પણ તમારા જેવા બે વચનીઓને તો હરગીઝ નમતું નહિ જ આપીએ.’

ત્યાંથી સંઘ નવાદા પાછો આવ્યો. અહીં સંઘપતિ મીરજા અભુલ્લાને મળ્યા અને બનેલી બધી હકીકત કહી સંભળાવી. તેણે કહ્યું: ‘આપ કોઈ વાતની ચિંતા કરતા નહિ. ગોમાનો રાજુ ત્રિલોકચંદ્ર હોશિયાર છે. તેને હું તરત જ બોલાવું છું.’ આમ કહી તેણે પોતાનો મેવડો દૂત ગોમા મોકલ્યો.

રાજુ ત્રિલોકચંદ્રને સંદેશો મળતાં જ તે પોતાના સૈનિકોને એકઠા કરવા લાગ્યો. આ જોઈ રાણીએ પૂછ્યું કે વાત શું છે? ત્યારે તેણે નવાદાથી આવેલ સંદેશાની વાત કરી. આ સાંભળી રાણીએ કહ્યું: ‘તમે રામદેવ જેવા ન થતા. સંઘપતિ તો બહુ સારા માણસ છે, તેમને સંનાનપૂર્વક સારી રીતે યાત્રા કરાવો.’

રાજુ ત્રિલોકચંદ્ર સસૈન્ય મીરજાની પાસે પહોંચ્યો. મીરજા એને સંઘપતિ પાસે લઈ ગયો અને જણાવ્યું કે ‘આ મોટા વ્યાપારી છે. તેમની પાસે હજરત (દિલ્હીના બાદશાહ)ના હાથ દસ્તકનું ફરમાન છે. જો કોઈ તેમને કંઈ પણ તકલીફ પહોંચાડે તો અમારો ગુનેગાર થશે.’

રાજુ ત્રિલોકચંદ્ર કહ્યું: ‘કોઈ ફીકર કરશો નહિ. તેમને એક દમડીનું પણ નુકશાન થશે નહિ. જો નુકશાન થશે તો હું ભરપાઈ કરી દઈશ. હું તેમને યાત્રા કરાવીને સુખરૂપ નવાદા પહોંચાડી દઈશ.’ આથી સંઘપતિ પ્રસન્ન થયા અને તેમણે મીરજા તથા રાજુ ત્રિલોકચંદ્રને વસ્ત્રાલંકાર, ઘોડા, સોનેયા, જહાંગિરી રૂપિયા તથા બીજી પણ કેટલીક ઉમદા વસ્તુઓની ભેટ કરી.

ત્યાંથી સંઘે રાજાની સાથે પ્રયાણ કર્યું. તે પાંચથાટીનું વિષમ સ્થાન ઓળંગી સકુશલ ગોમા નગરે પહોંચ્યો. ત્યાં સારાં સ્થાનમાં પડાવ કર્યો અને રાજુ ત્રિલોકચંદ્ર સુંદર સ્વાગત કર્યું. સંઘપતિએ રાણીને માટે સુંદર વસ્ત્રાભરણો ભેટ મોકલ્યા.

ગોમાથી બીજા પણ ધણા પૈદલ સૈનિકો સાથે લીધા, કારણ કે અહીંથી ગિરિરાજનો રસ્તો ધણો વિષમ હતો, બંને બાજુ પહાડ અને વચનમાં વિકટ વનો હતાં, જેમાં જંગલી પશુઓ મોટાં પ્રમાણમાં વસતાં હતાં. જુંપડીઓવાળાં ગામમાં મુકામ કરીને તેમણે આ વિકટ પ્રદેશ પસાર કર્યો. ત્યાંથી ચેતનપુર, અજિતપુર, મુંદુંદપુર જતાં ત્યાંના રાજાઓએ ઉચિત સ્વાગત કર્યું, અહીં ગિરિરાજનાં દર્શન થતાં સંઘ અતિ હર્ષ પાય્યો અને સોના-ચાંદીનાં પુષ્પો વડે તેનાં વધામણાં કર્યું.

અહીં રાજુ રામદેવનો મંત્રી ફરી સંઘપતિને મનાવવા આવ્યો. રાજુ ત્રિલોકચંદ્ર અને અજિતપુરનો રાજુ પૃથ્વીસિંહ આગળ માર્ગ બતાવતા હતા. અનુકમે તેમણે

ગિરિજાની અત્યંત ઉલ્લાસથી યાત્રા કરી અને ત્યાં મહામહોત્સવ મનાવ્યો. એ હતો વૈશાખ વદિ ૧૧ ને મંગળવારનો પવિત્ર દિન. સંધે આ ગિરિજાનાં સર્વ પવિત્ર સ્થાનોની યાત્રા કર્યા બાદ કુંવરપાલ અને સોનપાલને તિલક કરીને સંઘપતિ પદ અર્પણ કર્યું અને તેઓ સંઘપતિ તરીકે-સંઘવી તરીકે વિઘ્યાત થયા.

આ પરથી સંઘપતિ કેવા હોય ? તે બરાબર સમજી શકાશે. જૈન ધર્મનો ઈતિહાસ આવા સંઘપતિઓની યશોગાથાથી પૂર્ણ છે અને તે માટે જેટલું ગૌરવ લેવા ધારીએ તેટલું લઈ શકીએ તેમ છીએ; તેમ આજે એ આદર્શ પુનઃ જીવંત થવાની જરૂર છે.

U

ગરવી લઘુતા

V

વ.સ. ૨૦૪૮ના ફાગણ માસમાં શિર્ડી અંજનશલાકા પ્રસંગે પૂજ્યપાદશ્રી પદ્માર્થી હતા. વિશાળ શ્રમણ સમુદ્દર્ય ઉપસ્થિત હતો. એક મુનિરાજશ્રી ખૂબ બિમાર પડી ગયા. અવરનવર તેમના આસને જઈ પૂજ્યશ્રી તેમની શાતા પૂછતા તથા તેમને માંદગી સમાધિપૂર્વક સહન કરવા ખૂબ હિંમત આપતા.

એક દિવસ સવારે દેરાસર જવા માટે પૂજ્યશ્રી તૈયાર થયા.

“લાવ, ગલાનની શાતા પૂછી આવું...” તેમ બોલીને ઉપરના માઝે ગલાન મુનિશ્રીના આસને ગયા. મુનિશ્રીનું પ્રતિકમણ ચાલતું હતું. પૂજ્યશ્રીએ તુરત જ ઈરિયાવહી કરી લીધી અને મુનિશ્રીના વસ્ત્રોનું, પડિલેહણ કર્યું. બીજા મુનિઓએ ઘણું કહ્યું : “ગુરુદેવ, આપ રહેવા દો, અમે કરીએ છીએ...”

“કેમ, ગલાનની સેવા તમારે જ કરવાની ? મારે નહિ કરવાની ?” એમ જવાબ આપ્યો. પડિલેહણ થઈ ગયા પછી મુનિશ્રીને કહ્યું :

“તું સ્ફૂર્ઠ જા, હું શરીર સરસ દબાવી આપું. હોરું લાગશે.” આમ કહીને ૫-૧૦ મિનિટ સુધી મુનિશ્રીનું શરીર દબાવી આપ્યું.

ત્યારે પૂજ્યશ્રીની ઊંમર હતી ૮૧ વર્ષ...

પૂજ્યશ્રીનો સંયમપદ્યાર્થ હતો પ૭ વર્ષ...

કેવી ગલાનસેવા ! કેવું શ્રમણવાત્સલ્ય ! કેવી ગરવી લઘુતા !

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાખરા

W

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૮, તા. ૪-૧૧-૧૯૬૧

૩૪ શું આપણાં ધાર્મિક હિતો સલામત છે ?

(૧)

ભારતના લોકશાહી બંધારણાની રપ્મી કલમ તેના દેરેક નાગરિકને પોતાની હિંદુ મુજબનો ધર્મ પાળવાની, પ્રચારવાની તથા તેને લગતી સંસ્થાઓ ચલાવવાની છૂટ આપે છે. આથી સામાન્ય જ્યાલ એવો પ્રવર્તે છે કે આપણાં ધાર્મિક હિતો સલામત છે અને તે અંગે કંઈ ચિંતા કરવા જેવું નથી. પરંતુ સામાજિક, આર્થિક વગેરે સુધારાઓને નામે વખતો-વખત જે બીલો લોકસભા અને પ્રાંતીય ધારાસભાઓ સમક્ષ લાવવામાં આવે છે, તેનું વાંચન કરતાં આપણો એ જ્યાલ સાચો છે કે કેમ ? એવી શંકા ઉત્પન્ન થાય છે.

થોડા સમય પહેલાં મુંબઈની ધારાસભા સમક્ષ બાળદીક્ષાની અટકાયત કરતું એક બીલ સામાજિક સુધારાનાં નામે લાવવામાં આવ્યું હતું. જો આ બીલ ૨૪ થયું તેવા જ સ્વરૂપે પસાર થયું હોત તો આપ બાળજીવોને આત્મોદ્ધારક ત્યાગમાંથી વંચિત રહેવું પડત તથા આપણી શ્રમણ સંસ્થાને ગંભીર ફટકો પડત અને પરિણામે આપણી ધર્મપ્રયારની જે વ્યવસ્થા છે, તે પણ પૂરેપૂરી જોખમાઈ હોત.

ત્યારબાદ આ વર્ષે દિલ્હીની લોકસભામાં ધાર્મિક ટ્રસ્ટોનો વહીવટ સુધારવાનાં નામે એક બીલ ૨૪ થયું છે અને તે પ્રથમ વાંચનમાંથી પસાર થઈને પ્રવરસભિતિને સોંપાયું છે. આ બીલ પણ આપણી ધાર્મિક સ્વતંત્રતા પર કુઠારાધાત કરનારું છે, તથા જો એ એનાં મૂળ સ્વરૂપે પસાર થાય તો આપણાં ધાર્મિક ટ્રસ્ટોનો વહીવટ કરવા માટે કોઈ સારો માણસ આગળ આવે નહિ અને જેઓ ટ્રસ્ટી છે તે પણ રાજીનામું આપીને છૂટા થઈ જાય. પરિણામે ધાર્મિક ટ્રસ્ટોની આવકને ગંભીર ફટકો પડે અને તેની અસર આપણી દાનભાવના તથા આપણા ધાર્મિક આચારને લગતી પ્રણાલિકાઓ ઉપર પૂરેપૂરી થાય.

વળી આજ વર્ષે આવક વેરાને લગતા અટપટા કાયદાને સુધારી તેને સરલ બનાવવાના હેતુથી તથા તેમાં જુદા જુદા સમયે થયેલા સુધારાઓને સંકલિત કરી એક સર્વગ્રાહી કાયદો ઘડવાની નેમથી આવકવેરાને લગતું બીલ લોકસભા સમક્ષ ૨૪ થયું અને તે પ્રથમ વાંચનમાંથી પસાર થઈને પ્રવરસભિતિને સોંપાયું. ત્યાં મૂળ ખરડામાં ન હતા એવા સુધારા થઈ ગયા અને એક કલમ એવી દાખલ કરી દેવામાં આવી કે જેથી હવે પછી થનારા બધાં ધાર્મિક ટ્રસ્ટોને આવકવેરા તથા સુપરવેરાની

મર્યાદામાં આવવું પડે અને તેને પોતાની આવકનો ૩૦ ટકા જેટલો ભાગ સરકારી તિજોરીને આપી દેવો પડે. આનો એક અર્થ એ, કે શુદ્ધ અહિસક ધર્મની ભાવનાથી દીધેલાં નાણાંમાંથી મત્સ્યોદ્ઘોગ વગેરે આયોજનમાં વપરાય.

પ્રવરસમિતિના સુધારા સાથે આ બીલ ફરી લોકસભા સમક્ષ આવ્યું, ત્યારે ધાર્મિક અને કોમી ટ્રસ્ટોને આવક તથા સુપરવેરાની કલમો લાગુ પડેલી જોઈને ઘણા સત્યોને આશ્રય થયું અને તેમણે તેની સામે પોતાનો વિરોધ દાખબ્યો તથા આ બાબત મૂળ બીલમાં ૨૪૦ થઈ ન હતી અને સીધી પ્રવરસમિતિની ભલામણરૂપે આવે છે, માટે હાલ તેની વિચારણા મુલતવી રાખી, તે અંગે લોકમત જાણવો એવી દલીલ થઈ હતી, પણ સરકારે તેને કંઈ પણ દાદ ન આપતાં ઊલદું સામી દલીલ એવી કરી કે કોઈ પણ પ્રકારનાં ધાર્મિક તથા કોમી ટ્રસ્ટોને ઉતેજન આપવું યોગ્ય નથી. અને તેણે પોતાની બહુમતિથી એ બીલ પસાર કરી દીધું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

કહેવાનું તાત્પર્ય એ છે કે એક બાજુ ભારતનાં બંધારણમાં ધાર્મિક સ્વતંત્રતાનો કોલ અપાયો છે અને બીજી બાજુ નવા નવા કાયદાઓ દ્વારા એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે કે આપણાં ધાર્મિક હિતોને ગંભીર ફટકો પડે અને આપણે ઘણી જ કંઠગી સ્થિતિમાં મૂકાઈ જવું પડે.

તો કરવું શું ? એ પ્રશ્ન આપણી સમક્ષ ખડો થાય છે અને તે ગંભીર વિચારણા માગે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૮, તા. ૧૧-૧૧-૧૯૬૧

(૩૫) (૨)

એક બીજી વસ્તુ પણ ગંભીર વિચારણા માંગી લે છે અને તે લેખકો દ્વારા જૈન ધર્મ પર થઈ રહેલાં આકમણાની ધર્મનંદ કૌસંબીએ બુદ્ધચરિત્રમાં શ્રમણ ભગવાન મહાવીર પર માંસાહારનું દોષારોપણ કર્યું. આ વાત અસત્ય અને કલ્પિત હોવા છતાં આપણે તે પુસ્તકમાંનો એ ભાગ દૂર કરાવી શક્યા નહિ. આગળ જતાં આ પુસ્તક ભારતની સાહિત્ય અકાદમીમાં સ્થાન પામ્યું, ત્યારે આપણા સમાજ તરફથી થોડી હો-હા થઈ અને તેને સંતોષવા માટે સાહિત્ય અકાદમી તરફથી એક નોંધ મૂકવામાં આવી, જે અમારી દિણિએ સાવ નિરથક છે, કારણ કે તે જૈનોને થયેલા અન્યાયનું કિંચિત્ પણ નિવારણ કરતી નથી. આ પુસ્તકનું હાલ દશ ભાગાંમાં ભાગાંતર થઈ ચૂક્યું છે, એટલે તે લાખો લોકોના હાથમાં પહોંચે

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૭૧

ગયું છે. તેના વાંચનની તેમનાં મન પર શી અસર પડતી હશે ? તે આપણે વિચારવું રહ્યું.

આજ રીતે બીજા અનેક લેખકો પણ વારંવાર જૈન ધર્મ, જૈન સંસ્કૃતિ, જૈન સાધુ તથા જૈન સાધીઓ પર હુમલા કરી રહ્યાં છે અને તેની અસર લોક માનસ પર ઘણી ખરાબ થઈ રહી છે. પૂર્વ પવિત્ર બાળબ્રહ્મચારી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમયંડ્રસૂરિજી ઉપર મુનશીની નવલકથામાં કલ્પિત મંજરીનું પાત્ર ખું કરી અયોગ્ય આરોપ ચઢાવવામાં આવ્યો હતો, તાજેતરમાં ઈશ્વર પેટલીકર નામના એક વાર્તા લેખકે સંસાર માસિકના સપ્ટેમ્બરના અંકમાં ‘ભગવતી દીક્ષા’ નામની વાત લખીને જૈન સાધીઓની ભયંકર બદનક્ષી કરી છે અને ગુજરાતમાં ઘણી પ્રતિજ્ઞા પામેલું સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય પણ આ દોષમાંથી મુક્ત રહી શક્યું નથી. તેણે પ્રગટ કરેલાં ‘કથાનકો અને કહેવાતો’ નામનાં પુસ્તકમાં અનેક સ્થળો જૈનોને હુલકા પાડવામાં આવ્યા છે અને જૈન સિદ્ધાંતોની ઠેકડી કરવામાં આવી છે.

આજે મુસલમાન કે શીખધર્મ સામે કંઈ પણ લખતું હોય તો લેખકો ડરે છે, કારણ કે તેનું પરિણામ શું આવશે ? તેની તેમને સ્પષ્ટ કલ્પના છે. જ્યારે જૈનોને તેઓ બોડીબામણીનું બેતર સમજે છે અને તેના પર મનગમતા હુમલા કરવામાં એક જાતનો આનંદ પામે છે. તેઓ જાણે છે કે જૈનો શરૂઆતમાં થોડી હો હા કરશે, પણ તેથી અધિક કંઈ કરવાના નથી. અને એથી કદાચ મામલો આગળ વધશે તો ‘અમારી ભૂલ થઈ ગઈ’ એમ કહીને ધૂટી જઈશું. છેલ્લાં થોડાં વર્ષોમાં આમ જ બન્યું છે. એટલે તેમની આ ગણના ખોટી નથી.

ભારતના સમાજમાં પ્રથમ આપણો મોભો કેટલો હતો ? અને આજે કેટલો રહ્યો છે ? તે શાંત ચિત્તે વિચારવાની જરૂર છે. વળી આજે જે થોડો ઘણો મોભો રહ્યો છે, તે પણ આ જાતનાં આકમણોથી તૂટી રહ્યો છે. આ પરિસ્થિતિ થોડી વધુ લંબાશે તો આપણી ગણના એક મામુલી-સત્ત્વહીન સમાજમાં થશે, એમાં કોઈ શંકા રાખવી નહિ. પછી આપણાં ધાર્મિક હિતો શી રીતે સચવાશે ?

અમને જણાવતાં દિલગીરી થાય છે કે આ વસ્તુ આજે કેટલાક વખતથી ગાઈ વગાડીને કહેવામાં આવે છે છતાં આપણા આગેવાનોની ઉંઘ ઉડતી નથી અને આપણી સંસ્થાઓ રગણિયાં ગાડાંની ઢબ છોડી મોટર કે એરોપ્લેનની ઝડપ બતાવતી નથી. પરિણામે આપણને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે અને આપણી સ્થિતિ વધુ નિર્બંધ બની રહી છે.

આ પરિસ્થિતિમાંથી ઉગરાવવાનો માર્ગ શો ? તે આપણે ગંભીરતાથી વિચારવાનું છે. અને તે માટે જે શક્ય ઉપાયો હોય તે અમલમાં મૂકવાના છે.

૭૨

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

(૩)

પ્રથમ તો એ સમજ લેવાની જરૂર છે કે આપણી સામે પડેલું કાર્ય ઘણું જવાબદારીવાનું અને ભગીરથ છે. જો આપણે તેને સામાન્ય કે સાધારણ માની લઈશું તો આ કાર્ય માટે જે પ્રચંડ પુરુષાર્થ કરવો જોઈએ, તે કરી શકીશું નહિ અને આપણો હેતુ બર આવશે નહિ.

આજે આવું કાર્ય માત્ર વ્યક્તિગત પ્રયાસોથી જ સિદ્ધ થઈ શકે નહિ. અલબત્ત, તેમાં કેટલીક લાગવગવાળી વ્યક્તિઓ ઘણી ઉપયોગી થઈ શકે પણ સમગ્ર રીતે વિચાર કરતાં તે માટે એક ખાસ સંસ્થાની જરૂર રહે છે કે જેનું મુશ્ય કાર્ય જ સરકારી બીલોનો અભ્યાસ કરવાનું, તેમાંથી વાંધા પડતી કલમો તારવી કાઢવાનું, તેની આપણા ધાર્મિક હિતો પર ક્યાં કેવી અસર થાય છે, તે નક્કી કરી સમાજને તેમની માહિતી આપવાનું, આકમણકારી લેખકો પર ચાંપતી નજર રાખવાનું, તેમના આકમણનો યોગ્ય જવાબ આપવાનું તથા આ બધાં કાર્યો અંગે જે જે પગલાં ભરવા જરૂરી લાગે તે ભરવાનું હોવું જોઈએ.

આ સંસ્થામાં સમાજના માનનીય આગેવાનો, રાજદ્વારી લાગવગ ધરાવનારાઓ તથા ચુનંદા કાર્ય કર્તાઓને જોડવા જોઈએ અને તેઓ અમુક વખતે મળતા રહે તેવી ગોઠવણ કરવી જોઈએ.

આ સંસ્થાના સ્ટાફ ઉપર અનુભવી, ચપળ અને કર્તવ્યપરાયણ માણસોની જ નિયુક્તિ કરવી જોઈએ કે જે બધું કાર્ય સમયસર અને વ્યવસ્થિત ચલાવે, અન્યથા જે હાલત આજે બીજી સંસ્થાઓમાં જોવામાં આવે છે, તે જ હાલત અહીં થવાની અને તેનો ઉદેશ બર આવવાનો નહિ.

બીજી મહાત્વની વાત એ છે કે આ સંસ્થાને પૂજ્ય આચાર્ય મહારાજે તથા મુનિવરોએ પૂરેપૂરો ટેકો આપવો જોઈએ અને તેના તરફથી જે સાહિત્ય તથા પત્ર-પત્રિકાદિ બહાર પડે તેનો બહોળો ફેલાવો કરવામાં યથાશક્ય મદદ કરવી જોઈએ. પરંતુ સમાજના હુભુંયે આજે એવી સ્થિતિ જોવામાં આવે છે કે જો કોઈ આચાર્ય મ. કે મુનિવર એક સંસ્થાને ઉપયોગી જાણી તેને મદદ કરવા બહાર આવે છે, તો એમ માની લેવામાં આવે છે કે ‘આ સંસ્થા તેમની છે.’ એટલે બીજા બધા ઉદાસીન બની જાય છે. આથી એ સંસ્થા આગળ વધી શકતી નથી અને સમાજ તથા રાજ્ય પર જે પ્રભાવ પાડવો જોઈએ, તે પાડી શકતી નથી. ઘણી સંસ્થાની હાલત અમે આ પ્રકારની થયેલી જોઈ છે, તેથી જ આટલો પ્રાસંગિક નિર્દેશ અહીં કર્યો છે.

તો શું આપણી હાલત આવી જ રહેશે અને તેમાં કંઈ સુધારો નહિ થાય ? શું આપણે બધા કોઈ સંસ્થાની જરૂર છે એમ બૂમો મારી પાછા ચૂપ થઈ જઈશું અને કાળને તેનું કામ કરવા દઈશું ? જો બધી વસ્તુ કાળ પર જ હોડવાની હોય તો આપણા પુરુષાર્થનું મહાત્વ શું ? અમને સ્પષ્ટ કહેવા દો કે આપણી નિષ્કર્મણ્યતા છે અને તેનું પરિણામ ભયંકર જ આવશે.

અમો ઈચ્છાએ છીએ કે સમાજના આગેવાનો, પૂજ્ય આચાર્યવરો તથા મુનિરાજો આ વિષયમાં પોતાના વિચારો નિખાલસપણે પ્રકટ કરે, જેથી આપણું તત્કાલીન કર્તવ્ય સમજાય અને આપણાં ધાર્મિક હિતોની રક્ષા કરવાને આપણે સમર્થ થઈએ.

U

સંઘવાત્સલ્ય

V

સુરતના અંતિમ ચાતુર્મસ બાદ છેલ્લે અમદાવાદ પદ્ધાર્ય ત્યારે ૭-૮ મુનિ ભગવંતોને ચાતુર્મસમાં શ્રી ભગવતીસ્કુત્રના જોગ કરાવવાનો નિર્ણય કર્યો હતો. ભારતભરના અનેક સંઘો ચાતુર્મસ માટે સાધુ ભગવંતોને મોકલવા પૂજ્યપાદશ્રીને ખૂબ વિનંતીઓ કરી રહ્યા હતા. સંઘોની વિનંતીને ધ્યાનમાં રાખીને પૂજ્યપાદશ્રીએ મુનિઓના જોગની આરાધના મુલત્વી રખાવી ને ચાતુર્મસમાં મુનિભગવંતોને મોકલવાની અનેક સંઘોની વિનંતી સ્વીકારી લીધી.

ઘણીવાર ગોચરી આવી ગઈ હોય અને કંડી થતી હોય ત્યારે ગામના કે બહારગામના સંઘના ભાઈઓ સંઘના, શાસનના કે અંગત આરાધનાના કામ માટે પૂજ્યપાદશ્રીની પાસે બેઠેલા હોય, પણ મોટેભાગો તેમનું કાર્ય પતાવીને જ ઊભા થતાં. નાના બાળકને કે સાવ સામાન્ય જણાતી વ્યક્તિને પણ પ્રેમથી સાંભળતા અને યોગ્ય પ્રત્યુત્તર આપતા.

આવું તો અદ્ભુત હતું પૂજ્યપાદશ્રીનું સંઘવાત્સલ્ય.

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર X

W

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૩૭ પાઠશાળાના કાર્યવાહકોની જવાબદારી

શ્રી જૈન ધાર્મિક શિક્ષણસંધ-મુન્દુરી તરફથી પ્રકટ થતી જૈન શિક્ષણ-સાહિત્ય-પત્રિકાના નવેમ્બર માસના અંકમાં તેના વિદ્વાન સંપાદકે પાઠશાળાના કાર્યવાહકો અંગે એક મનનીય લેખ લખ્યો છે. તેમાં તેમણે જણાવ્યું છે કે ‘પાઠશાળાની સ્થાપના થવાથી જ ધાર્મિક શિક્ષણની અભિવૃદ્ધિ થઈ જતી નથી. તે માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા છે. (૧) યોગ્ય શિક્ષક, (૨) યોગ્ય શિક્ષણક્રમ અને (૩) યોગ્ય કાર્યવાહકો.

આજે સામાન્ય માન્યતા એવી છે કે પાઠશાળાના કાર્યવાહકો તેને જોઈતાં નાણાં મેળવી આપે, એટલી તેની જવાબદારી પૂરી થાય છે તેથી તેઓ પોતાની વ્યાપારી કુનેહ વાપરી એટલાં નાણાં લાવી આપે છે, પણ તેથી અધિક કંઈ કરતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તો તેઓ પાઠશાળામાં ભાગ્યે જ આવે છે, અથવા આવે છે તો આડી-અવળી થોડી વાતો કરીને ચાલ્યા જાય છે અને બધી જવાબદારી શિક્ષક પર નાંખી દે છે !’

આગળ ચાલતાં તેઓ જણાવે છે કે ‘અમારા અનુભવમાં એવું પણ આવ્યું છે કે પાઠશાળાનો શિક્ષક ખંતીલો હોય, ઉઘમી હોય અને પાઠશાળાને આગળ વધારવા માટે ધણો ઉત્સુક હોય, પણ કાર્યવાહકોને તેની સાથે વાતચીત કરવાની ફુરસદ હોતી નથી’ શિક્ષક બે-ચાર કે તેથી વધારે વાર ધક્કા ખાય ત્યારે તેની વાત સાંભળે અને તે પણ ઉપર ટપકે ! તેમાં ક્યા પ્રશ્નનો ઉકેલ આવે અને કઈ યોજના ગતિમાન થાય ? આપણી પાઠશાળાનો મોટો ભાગ આજે રગશિયા ગાડાંની ગતિએ ચાલી રહ્યો છે, તેનું મુખ્ય કારણ પાઠશાળાઓના કાર્યવાહકોની તેના પ્રત્યેની બેદ્રકારી છે. અને તેથી જ અમને સ્પષ્ટ કરવાની ફરજ પડે છે કે કોઈ પણ મહાનુભાવ પાઠશાળાની કમીટી પર હોંશે આવ્યા હોય, લોકલાજે આવ્યા હોય કે કોઈનાં દબાણથી આવ્યા હોય, પણ કમીટી પર આવ્યા એટલે તેમણે પોતાનું કર્તવ્ય પહેલી તકે સમજ લેવું જોઈએ અને તેનાં પાલન માટે પૂરેપૂરી તત્પરતા દર્શાવવી જોઈએ. જેઓ પાઠશાળાની કમીટી પર આવવા છતાં પોતાનું કર્તવ્ય સમજ લેતા નથી કે તેનાં પાલનમાં ઉપેક્ષા કરે છે, તેઓ પાઠશાળાનું અહિત કરે છે અને તેથી સંધ કે સમાજના અપરાધી બને છે.’

પછી તેમણે કોઈ પશુને પાળિને તેને ઘાસ-પાણી ન આપીએ કે છોડ વાવીને પાણી ન પાઈએ તો કેવું પરિણામ આવે છે ? તેનું દાંત આપીને આ વસ્તુ વધારે સ્પષ્ટ કરી છે અને પાઠશાળાનું તંત્ર છેક બગડી જાય કે પાઠશાળા બંધ પડે ત્યાં સુધી કાર્યવાહકો ધ્યાન આપતા નથી, અનો દાખલો આપીને જણાવ્યું છે કે ‘પાઠશાળાના સંચાલન માટે જે કમીટી નિમાય તેમાં માત્ર પૈસાદાર કે આગેવાન ગણાતી વ્યક્તિઓને ન લેતાં સેવાભાવી કાર્યકર્તાઓને લેવા જોઈએ અને મંત્રી પદે તો તેમાંથી જ કોઈ સુયોગ્ય વ્યક્તિને નિમવી જોઈએ.’

પછી તેમણે પાઠશાળાના મંત્રી થનારમાં ડેવી યોગ્યતા હોવી જોઈએ ? તેનું વિવેચન કરતાં જણાવ્યું છે કે ‘પાઠશાળાના મંત્રી થનારમાં નીચેની વસ્તુઓ અવશ્ય હોવી જોઈએ. (૧) ધર્મ શ્રદ્ધા અને ધાર્મિક જ્ઞાન (૨) પાઠશાળાના કામ પર દેખરેખ રાખી શકે તેટલી ફુરસદ. (૩) કામ લેવાની આવડત અને (૪) વિવેક-નમ્રતા આદિ ગુણો.

જેનામાં ધર્મશ્રદ્ધા કે ધાર્મિક જ્ઞાન ન હોય તે પાઠશાળાનું સફળ સંચાલન શી રીતે કરી શકે ? ગોળ કાણામાં ચોરસ ખીલાની જેમ તેવાની નિમણૂક આવાં સ્થાને નિરર્થક જ ગણાય. વળી ધર્મશ્રદ્ધા અને ધાર્મિક જ્ઞાન હોવા છતાં પાઠશાળાએ આવવાની ત્યાં બેસવાની, તથા બેસીને બધું કામ ઝીણવટથી તપાસવાની ફુરસદ ન હોય તો તેનાથી પાઠશાળાને શો લાભ થાય ? જો મંત્રીમાં કામ લેવાની આવડત ન હોય તો શિક્ષક કે વિદ્યાર્થીઓ પાસેથી ધાર્યું કામ લઈ શકે નહિ, ફળનાં સુંદર પરિણામ આવી શકે નહિ. તેમજ મંત્રીમાં વિવેક, નમ્રતા આદિ ગુણો ન હોય તો એ કમીટીના સભ્યોનો ચાહ મેળવી શકે નાહિ કે સારા શિક્ષકોને સાચવી શકે નાહિ.’

છીવટે તેમણે જણાવ્યું છે કે ‘પાઠશાળાનું સંચાલન એ એક પવિત્ર જવાબદારી છે, એટલે તેનું પાલન યથાર્થપણે થવું જોઈએ. જેઓ એ જવાબદારીનું યથાર્થ પાલન કરે છે, તેઓ સમ્યગ્દર્શનની શુદ્ધિ કરવામાં તથા સમ્યક્ ચારિત્રની પુષ્ટિ કરવામાં સુંદર હિસ્સો નોંધાવે છે અને તેથી પુણ્યાનુંધી પુણ્ય ઉપાર્જન કરીને પોતાનું જીવન સફળ કરે છે.’

પાઠશાળાના કાર્યવાહકોએ આ પરથી પોતાની જવાબદારી સમજ લેવી ધટે છે.

૩૬ ચારિત્રનિર્માણનું પ્રથમ પગથિયું

જૈન શાસ્ત્રોએ ફરી ફરીને એ વસ્તુ સ્પષ્ટ કરી છે કે એક મનુષ્ય ગમે તેવો શ્રદ્ધાળું કે જ્ઞાની હોય, પણ ચારિત્રથી રહિત હોય તો તે મુક્તિ પામી શકતો નથી. એટલે જે મનુષ્ય મોક્ષ પ્રાપ્તિની આશા-ઈચ્છા-અભિલાષા રાખતો હોય તેણે ઉત્તમ પ્રકારનાં ચારિત્રનું નિર્માણ અવશ્ય કરવું જોઈએ.

‘ઉત્તમ પ્રકારનાં ચારિત્રનું નિર્માણ શી રીતે થાય ?’ તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું છે કે ‘કોધ, માન, માયા અને લોભ એ ચાર મહાન આધ્યાત્મિક દોષો છે, તેને જીતવાથી ઉત્તમ પ્રકારનાં ચારિત્રનું નિર્માણ થાય છે.’

આ આધ્યાત્મિક દોષને માટે પ્રચ્યલિત શબ્દ કખાય છે. એટલે કખાયોને જીતવાની કિયા એજ ઉત્તમ પ્રકારનાં ચારિત્રનું નિર્માણ છે. વધારે સ્પષ્ટ કહીએ તો મનુષ્ય જેમ જેમ કખાયોને જીતતો જાય છે, તેમ તેમ તેનું ચારિત્ર ઉન્નત થતું જાય છે અને જ્યારે તે કખાયોને પૂરેપૂરો જીતી લે છે, ત્યારે તે ઉત્તમોત્તમ ચારિત્રવાન બની જાય છે.

ચાર કખાયોમાં પ્રથમ નિર્દેશ કોધનો કરવામાં આવ્યો છે, કારણ કે તે ભયંકર માનસિક વિકાર છે અને મનુષ્યનું કાણ માત્રમાં પતન કરે છે. આજે ઘરઘરમાં લડાઈ-ઝડા-ટંટા-દ્વેષ-ધિક્કારની જે ભાવના ફેલાઈ રહેલી છે, તેનાં મૂળમાં આ કોધ જ બેઠેલો છે.

વ્યક્તિનો કોધ સમાજમાં ફેલાય છે, સમાજનો કોધ રાષ્ટ્રમાં ફેલાય છે અને રાષ્ટ્રનો કોધ દુનિયામાં ફેલાઈ વિશ્વયુદ્ધને નજીક ઘસડી લાવે છે. તેમાંથી કેવી ભયંકર તારાજ સર્જય છે, તે આપણે છેલ્લાં બે વિશ્વયુદ્ધો પરથી બરાબર જ્ઞાની શક્યા છીએ. આમ છતાં કોધને કાઢવા માટે આપણે કેટલા પ્રયત્નશીલ રહ્યા છીએ ?

આપણા સ્વાર્થમાં ઊણાપ આવે, આપણા આરામમાં ખલેલ પહોંચે, આપણાં અભિમાનને ડેસ વાગે કે આપણી ઈચ્છા અને અભિરુચિથી કંઈક વિપરીત બને તો તરત આપણને કોધ આવી જાય છે અને વૈર લેવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ તે આપણી કેવી કંગાલ મનોદશા ?

આ કોધની બૂરી અસર સહૃથી પહેલાં તો આપણા ઉપર જ પડે છે.

આપણું મુખ વિકૃત બની જાય છે, શરીર કંપવા લાગે છે, ન બોલવાના શબ્દો મુખમાંથી નીકળી જાય છે અને આપણાં જ્ઞાનતંતુઓને ભારે ધક્કો પહોંચે છે. પણ આપણો આ વાતનો વિચાર કરીએ છીએ ખરા ?

હવે તો વિજ્ઞાન શાસ્ત્રીઓ અને ડોક્ટરોએ જાહેર કર્યું છે કે કોધ કરવાથી અનેક પ્રકારની બિમારીઓ થાય છે. જેમાં સ્નાયુની દુર્બલતા, લોહીનું દબાણ, ચકરી, બેહોશી, પાગલપણું આદિ મુખ્ય છે. વળી પ્રયોગોથી એ પણ સિદ્ધ કરવામાં આવ્યું છે કે કોધયુક્ત માતાનું દૂધ પીવાથી બાળકનાં શરીર પર ધરી માઠી અસર થાય છે અને તેનું મૃત્યુ પણ નીપજે છે.

કોધ કરવાથી નુકશાન ઘણું છે, લાભ કશો પણ નથી, તો પછી કોધને તિલાંજલિ કેમ ન આપવી ! કેટલાક કહે છે કે ‘કોધ એ ઘણી ખરાબ વસ્તુ છે એ અમે જીણીએ છીએ, પણ તે અમારાથી છૂટતો નથી.’ જો પરિસ્થિતિ આવી જ હોય તો તેમણે જ્ઞાનીઓનાં વચ્ચે પર લક્ષ આપવું જોઈએ અને તેમણે કોધને જીતવાના જે જે ઉપાયો બતાવ્યા છે, તેનું પાલન કરવું જોઈએ.

કોધને જીતવાનો મુખ્ય ઉપાય ક્ષમાગુણને કેળવાય તેટલો કેળવવો જોઈએ.

કોધમાંથી બચવા માટે નીચેના ઉપાયો પણ અજમાવવા જેવા છે :-

- (૧) ગાળનો જવાબ ગાળથી આપવો નહિ.
- (૨) મૌન ધારણ કરવું.
- (૩) પ્રસ્તુનાં નામનું સમરણ કરવું.
- (૪) ‘ॐ શાંતિः ॐ શાંતિः’ એ મંત્રનો જાપ કરવા માંડવો.
- (૫) પ્રસંગને બદલી નાખવો.
- (૬) સ્થાન છોડી ચાલ્યા જવું.
- (૭) શીતળ જળથી હાથ-પગ તથા મ્હોં ધોઈ નાખવું કે સ્નાન કરી લેવું.
- (૮) કખાયથી આવનારાં ભયંકર પરિણામોનો વિચાર કરવો.
- (૯) સામા ઉપર કરુણા ઊભી કરવી.

કોધને જીતવો એ ચારિત્રનિર્માણનું પ્રથમ પગથિયું છે, એ વાત કદી પણ ભૂલવી નહિ. જેણે આધ્યાત્મિક વિકાસ સાધવો છે, તેણે કોધને અવશ્ય જીતવો જ જોઈએ.

૩૬ સદ્વિચારોનું સેવન (લેખાંક-પહેલો)

જીવનને પ્રગતિમય બનાવવું હોય, સફળ બનાવવું હોય, સુખી બનાવવું હોય તો આપણે વિચારોનું મહત્વ બરાબર સમજી લેવું જોઈએ.

કેટલાક એમ માને છે કે ‘વિચારોમાં શું ? એ તો જળના પરપોટાની જેમ ઉત્પન્ન થાય અને લય પામે. એનું વાસ્તવિક મહત્વ કંઈ જ નથી.’ પણ આ મંત્વ ભૂલભરેલું છે, અયોગ્ય છે, કારણ કે વિચાર એ આપણાં જીવન પર ઊંડી અસર કરનારી વસ્તુ છે.

જો, આપણાં મનમાં અસદ્વ વિચારો રમતા હોય, તો આપણી વાણીમાં કર્કશતા, કઠોરતા, અસભ્યતા કે ઉચ્ચંખલતા અવશ્ય આવવાની અને આપણાં વર્તન પણ અસમંજસ કે અનુચિત થવાનું. તેજ રીતે જો આપણાં મનમાં સદ્વિચારો રમતા હોય તો આપણી વાણીમાં વિવેક, વિનય તથા મધુરતાનાં દર્શન અવશ્ય થવાનાં અને આપણાં વર્તન પણ યોગ્યતા કે ઉચિતતાને ધારણ કરવાનું.

કેટલાક કહે છે કે સિદ્ધિ કે સફળતાનો મુખ્ય આધાર કિયા પર છે, એટલે વિચારોને તેના જેટલું મહત્વ આપી શકાય નહિ. પણ પ્રત્યેક કિયાનાં મૂળમાં વિચાર રહેલો હોય છે, એટલે અપેક્ષાએ કિયા કરતાં પણ વિચારનું મહત્વ વધારે છે. બીજ બગડેલું હોય તો તેમાંથી સુંદર વૃક્ષ ઉત્પન્ન થઈ શકતું નથી, તેમ વિચારો અશુદ્ધ કે અપરિપ્કવ હોય તો તેમાંથી શુદ્ધ કે સત્કિયા ઉત્પન્ન થઈ શકતી નથી. તે માટે તો સદ્વિચારોની જ જરૂર રહે છે અને તેથી આધ્યાત્મિક દણિએ તેનું મૂલ્ય વિશેષ છે.

કિયાનાં મૂળમાં વિચાર શી રીતે હોય છે, તેનું પણ અહીં સ્પષ્ટીકરણ કરીશું. પ્રથમ આપણાં અંતઃકરણમાં સૂક્ષ્મ વિચારો ઉત્પન્ન થાય છે, પણ તે અવ્યક્ત હોવાથી તેનું ભાન આપણાને થઈ શકતું નથી. પછી તે વિચારો કંઈક સ્થૂલતા ધારણ કરે છે અને વ્યક્ત થાય છે, ત્યારે આપણાને એવું ભાન થાય છે કે મને અમુક વિચાર આવ્યો. પછી તે અંગે ઈચ્છા ઉત્પન્ન થાય છે અને તે અનુસાર કિયા થાય છે. એટલે પ્રત્યેક જગત કિયાનાં મૂળમાં વિચાર રહેલો હોય છે, એ નિર્વિવાદ છે.

વિચારોમાં પણ બળ છે, શક્તિ છે, અદ્ભુત તાકાત છે, એ વાત ધણાનાં

ગળે ઉત્તરતી નથી, પણ અનુભવ અને પ્રયોગો એ વસ્તુને સત્ય હરાવે છે, તેથી આપણે તેમાં શ્રદ્ધાન્વિત થવું જોઈએ.

સૂતરના એક નાનકડા તાંત્રણામાં કંઈ બળ કે શક્તિ હોય એમ આપણાને લાગતું નથી, પણ એવા અનેક તાંત્રણ ભેગા કરી તેનો દોરો બનાવીએ તો તેમાં બળ કે શક્તિ હોવાનો જ્યાલ આવે છે; અને એવા ધણા દોરા ભેગા કરીને તેનું એક દોરદું બનાવીએ તો તેમાં તરત જ પ્રયેંડ બળ કે શક્તિનાં દર્શન થાય છે. એ દોરદું મોટા હાથી જેવા બળવાન પ્રાણીને બાધી રાખે છે અને લોખંડના મોટા ગડરોનો ભાર ઉપાડે છે.

વિચારોની પણ આ જ સ્થિતિ છે, જ્યારે તે ધૂટા ધૂટા હોય છે, ત્યારે તેમાં કંઈ બળ કે શક્તિ હોય એમ લાગતું નથી, પણ જ્યારે એ વિચારોની એક ધારા બને છે, ત્યારે તેનાં બળનો કે તેની શક્તિનો અનુભવ થાય છે. જો શુભ વિચારો ધારાબદ્ધ થાય તો તેનું પરિણામ ધણું સુંદર આવે છે અને અશુભ વિચારો ધારાબદ્ધ થાય તો તેનું પરિણામ ધણું ભયંકર આવે છે.

૪૦ (લેખાંક-બીજો)

અનુભવી પુરુષોએ એમ કંઈ છે કે જો મનુષ્ય નિરંતર કે વારંવાર સદ્વિચારોનું સેવન કરતો રહે તો એ અવશ્ય ઊંચો ચરી જાય છે અને પોતાનું જીવન સાર્થક કરી શકે છે. જ્યારે નિરંતર કે વારંવાર અસદ્વિચારોનું સેવન કરનારો નીચે પટકાય છે અને ભયંકર નાસીપાસી કે નિરાશાનો અનુભવ કરે છે.

વિચારો અથવા અધ્યવસાયોનું બળ બતાવવા માટે જૈન શાસ્ત્રોએ પ્રસન્નયંદ્રાજર્ષિનાં જીવનની એક નોંધ સાચવી રાખી છે, તે આપણે ખૂબ ખૂબ વિચારવા જેવી છે.

એક વાર ત્રિભુવનતારક ચરમ તીર્થકર શ્રી મહાત્મા પ્રભુ રાજગૃહી નગરીની બહાર ઉધાનમાં સમવસર્યા તેમની સાથે તપસ્વી, જ્ઞાની અને ધ્યાની મુનિવરોનો મોટો સમુદ્ધાય હતો. તેમાં પ્રસન્નયંદ્ર નામના રાજર્ષિ ધ્યાનના અભ્યાસી હતા. તેમણે ઉધાનના એક છેડે ધ્યાન લગાવ્યું. તેમાં એક પગે ઊભા રહ્યા, બંને હાથ ઊંચા રાખ્યા અને દણિ સૂર્યની સામે સ્થાપન કરી આતાપના લેવા લાગ્યા.

શ્રેણિક રાજાને સમાચાર મળ્યા, એટલે તેઓ મોટી સવારી કાઢીને પ્રભુના દર્શને ચાલ્યા. રસ્તામાં તેમણે ધ્યાનમળ મુનિને વંદન કર્યું, પછી તેઓ પ્રભુ

મહાવીરની સમીપે પહોંચી તેમની ધર્મ દેશના સાંભળવા લાગ્યા.

અવસર જોઈ શ્રેણિક રાજાએ શ્રી મહાવીર પ્રભુને પૂછ્યું કે ‘હે પ્રભો ! મેં રસ્તામાં ધ્યાનમણ પ્રસન્નચંદ્ર રાજ્યિને વંદન કર્યું. જો તેઓ કદી એ સ્થિતિમાં કાલધર્મ પામ્યા હોત, તો કઈ ગતિએ જાત !’ પ્રભુએ કહ્યું ‘સાતમી નરકે.’

આ જવાબ સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પડ્યા. મુનિને નરકગમન હોય નહિ અને આ મુનિ તો ધ્યાનમણ છે છતાં પ્રભુએ આમ કેમ કહ્યું ? તેમણે ફરી પ્રશ્ન કર્યો ‘હે પ્રભો ! પ્રસન્નચંદ્ર રાજ્યિ કદી હમજાં કાલધર્મ પામે તો કઈ ગતિમાં જાય ?’ પ્રભુએ કહ્યું ‘તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.

આ ઉત્તરે શ્રેણિક રાજાનાં મનમાં ભારે ગડમથલ ઊભી કરી દીધી : એવામાં ત્યાં દેવદુંહુભિ વાગવા લાગી અને જ્યનાદ થવા લાગ્યા, એટલે શ્રેણિક રાજાએ પૂછ્યું : ‘હે પ્રભો ! આ દુંહુભિ શેની વાગી ? અને આ જ્યનાદ શેના થાય છે ?’

પ્રભુએ કહ્યું : ‘હે રાજન્ન ! પ્રસન્નચંદ્ર રાજ્યિને કેવળજ્ઞાન થયું, તેથી દેવો દુંહુભિ વગાડે છે અને જ્યનાદ કરે છે.’

આ જવાબ સાંભળી શ્રેણિક રાજાનું આશર્ય અનેકગણું વધી ગયું. તેમણે એનું સમાધાન મેળવવા પ્રભુને કહ્યું : ‘પ્રભો ! આ બધી આશર્યકારી ઘટનાઓ મારાથી સમજાતી નથી. કૃપા કરીને તેનું રહસ્ય સમજાવો.

પ્રભુએ કહ્યું : ‘રાજન્ન ! તું અહીં વંદન કરવાને આવી રહ્યો હતો, ત્યારે તારી સવારીના મોખરે ચાલનારા બે સિપાઈઓએ અરસપરસ વાત કરી કે આ રાજ્યિએ ઘરે મૂકેલ નાના પુત્રનો દગ્દો કરી મંત્રીએ રાજ્ય પડાવી લેવાનું કર્યું છે. પ્રસન્નચંદ્ર રાજ્યિ એ સાંભળી ધ્યાન ચૂક્યા. એ વખતે તેમને એટલો ગુસ્સો આવ્યો કે ‘જેમનો મેં આજ સુધી પૂરો વિશ્વાસ કર્યો, તે જ આવા બેવજા નીવડ્યા ? હું એ દુષ્ટોની સાન ડેકાશે લાવી દઈશ.’ આવો વિચાર કરતાં પોતાનું સામાયિક પ્રત ચૂકી મનોમન મંત્રીઓ જાણે પોતાની સામે ખડા હોય એમ એમની સાથે લડાઈ કરવા લાગ્યા. એક પછી એક શસ્ત્રો ફેંકતાં બધાં શસ્ત્રો ખૂટી ગયાં, ત્યારે તેમણે વિચાર કર્યો કે મારાં મસ્તક પર લોહનો ટોપ પહેરેલો છે, તે ફેંકીને હું આ સામે ઊભેલા ધિક્કા દુશ્મનનો નાશ કરું. હે શ્રેણિક ! બરાબર આજ વખતે તેં એમને વંદન કર્યું, એટલે તારા પ્રથમ પ્રશ્નનો ઉત્તર મેં એમ આખ્યો કે ‘તે સાતમી નરકે જાય.’

ત્યાર પછી તેમણે ટોપ લેવા જેવો હથ મૂક્યો કે મુંદું મસ્તક જણાયું અને

તેમનો કોધ ઉતરી ગયો; તે વિચારવા લાગ્યા કે મેં તો જીવનભરનું સામાયિક પ્રત લીધું છે અને આ શું કર્યું ? પછી તેઓ ભૂલનો અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યા. હે રાજન્ન ! જ્યારે તેઓ આ પ્રકારે પશ્ચાત્તાપ કરી રહ્યા હતા. ત્યારે તેં બીજો પ્રશ્ન કર્યો, એટલે મેં કહ્યું કે ‘તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.’

પછી પણ એમના વિચારોની-અધ્યવસાયની શુદ્ધિ ચાલુ રહી હતી; એટલે તેઓ ક્ષપક શ્રેણી પર આરૂપ થયા, તેમનાં ઘાતી કર્માંનો નાશ થયો અને તેઓ કેવળજ્ઞાન પામ્યા.

પ્રભુ મહાવીરનો આ ઉત્તર સાંભળી શ્રેણિક રાજાનાં મનનું સમાધાન થયું અને આત્મા અશુભ વિચારોથી કેટલો પડે છે તથા શુભ વિચારોથી કેટલો ચેતે છે, તેનો બોધ પામ્યા.

દેવદર્શન, પ્રભુ-પૂજા અને તીર્થયાત્રા, તથા ત્યાગ, તપસ્યા અને પ્રતો, તેમજ અસદ્ગુરુ સમાગમ અને વ્યાખ્યાન શ્રવણ અને શાસત્રસ્વાધ્યાયનો હેતુ પણ એ જ કે આપણે અસદ્વિચારોથી બચીએ, આપણી ભાવનાઓ અને વિચારધારા સુધરે અને આપણે સન્માગમાં સ્થિર થઈ આધ્યાત્મિક પ્રગતિ સાધી શકીએ.

આપણાં અંતરમાં જન્મજન્મની જે અનેકવિધ વાસનાઓ એકઠી થયેલી છે, તે નિમિત્ત મળતાં અસદ્વિચારોને જન્મ આપે છે અને તે આપણાં જીવનનો નકશો મળિન બનાવી દે છે. આ અસદ્વિચારોને દબાવી દેવાનો, હઠાવી દેવાનો કે નાશ કરવાનો એક રામબાણ ઉપાય સદ્વિચારોનું નિરંતર સેવન છે. જૈન શાસ્ત્રોમાં અનિત્યાદિ બાર પ્રકારની તથા મૈત્રાદિ ચાર પ્રકારની જે ભાવનાઓ દર્શાવવામાં આવી છે, તે પણ સદ્વિચારોનાં સેવનરૂપ જ છે અને તેનું પરિણામ ઘણું સુંદર આવે છે. કોઈ કોઈ વાર તો આત્માઓ તેમાંથી બળ પામી જાય છે કે તે જ ક્ષણે ઘાતીકર્માંનો નાશ કરી કેવળજ્ઞાન પામીને મોક્ષગામી બની જાય છે.

૪૧ પ્રશસ્ત વાણીવ્યવહાર

સર્વજ્ઞ અને સર્વદર્શી એવા અરિહંત પરમાત્માએ જે ઉપદેશ આપ્યો, તે ગણધર ભગવંતોએ જીલી લીધો અને તેને શબ્દોમાં ગુંથ્યો. આ રીતે જે શાસ્ત્રો રચાયાં, તેને આપણે આગમો કે ધર્મશાસ્ત્રો કહીએ છીએ. એટલે તેમાં જે વચનો લખેલા હોય, જે મત કે અભિપ્રાય દર્શાવિલો હોય, જે તત્ત્વ અને સિદ્ધાંત વર્ણવ્યા હોય, જે હિતશિક્ષા આપેલી હોય, તેને આપણે છેવટનો શબ્દ સમજવાનો છે. જેઓ તેની યથાર્થતા વિષે સંદર્ભ ધરાવે છે, શંકા ઉઠાવે છે કે તેમ માનવાની આનાકાની કરે છે, તે સાચા અર્થમાં શ્રાવક નથી અને જૈન પણ નથી. જે જિનોને અનુસરે નહિ, તેમનાં વચનોને માને નહિ, તે જૈન શાનો ?

આ ધર્મશાસ્ત્રોનો અભિપ્રાય એવો છે કે જ્યાં સુધી મનુષ્યનો વાણીવ્યવહાર સુધરે નહિ, તે સુંદર-શ્રેષ્ઠ પ્રશસ્ત બને નહિ, ત્યાં સુધી તે મોક્ષપ્રાપ્ત યોગસાધનામાં આગળ વધી શકતો નથી.

વાણીવ્યવહાર સુધરવાનો અર્થ એ છે કે તેમાં જે કઠોરતા-કર્કશતા-પરુષતા હોય તે નીકળી જવી જોઈએ; કંઈ અહિતકર ન હોય તેની સાવધાની રાખવી જોઈએ. અને મૂળ વાત મરડાઈ ન જાય કે જુદા સ્વરૂપે સમજાઈ ન જાય તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ વસ્તુનું અધિક સ્પષ્ટીકરણ કરતાં ધર્મશાસ્ત્રો જણાવે છે કે ‘કોઈ મનુષ્ય કાણો હોય, તો તેને ‘એય કાણિયા !’ એમ કહેવું નહિ. કોઈ મનુષ્ય નસુંસક હોય તો તેને ‘અલ્યા નસુંસક !’ એવું સંબોધન કરવું નહિ. તેજ રીતે રોગી મનુષ્યને ‘અલ્યા રોગિયા !’ અને ચોરને ‘અલ્યા ચોર !’ એવા શબ્દોથી બોલાવવા નહિ, કારણ કે આ રીતે બોલાવવાથી તેમને ઘણું દુઃખ થાય છે, ઘણો સંતાપ થાય છે અને આ રીતે કોઈને પણ દુઃખ કે સંતાપ ઉપજાવવો એ અહિસાધમની શોભતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો કઠોર વચન એ સામાના દિલની હિંસા છે, તેથી આત્માર્થી જનોએ તેનો અવશ્ય ત્યાગ કરવાનો છે.

ભારતના હાલના નાણામંત્રી શ્રી મોરારજી દેસાઈએ એક વખત પોતાના અનુભવો રજૂ કરતાં જણાવ્યું હતું કે ‘કે પ્રથમ હું એમ સમજતો હતો કે જેવું હોય તેવું કહી દેવું, પછી સામાને ભલે કરવું લાગે. પરંતુ અનુભવે હું સમજ્યો છું કે આ વસ્તુ બરાબર નથી, સાચી વસ્તુ પણ સારા શબ્દોમાં જ રજૂ કરવી જોઈએ, એથી અસર વધારે સારી થાય છે અને બીજડુરી કડવાશ ઉત્પન્ન થવાનો

પ્રસંગ આવતો નથી.’

કોઈને કડવાં વચનો કહેતાં આપણે પણ કડવાં વચનો સાંભળવા પડે છે અને તેમાં આપણું ભૂષણ જળવાતું નથી. આ દેશમાં રેશનાંગ દાખલ થયું, ત્યારે અમુક ભાગમાં તેની વ્યવસ્થા બરાબર ન હોવાને લીધે ત્યાંના લોકોને સમયસર અનાજ મળતું નહિ, આથી લોકો ત્રાસી ગયા અને ઉપરી અધિકારી પાસે ગયા. તેમણે કહ્યું ‘તમારી રેશનાંગની વ્યવસ્થા બરાબર નથી, એટલે અમને અનાજ મળતું નથી. બોલો, અમે શું ખાઈએ ?’ ઉપરી અધિકારીએ તુમાઝી મિજાજથી કહ્યું : ‘અનાજ ન મળતું હોય તો ધાસ ખાઓ.’ આ શબ્દોમાં તુચ્છતા હતી, ઘમંડ હતો અને બેપરવાઈ ભારોભાર ભરેલી હતી. આમ છતાં લોકો ચૂપ રહ્યા, કંઈ બોલ્યા નહિ, પરંતુ એક માણસથી આ વસ્તુ બિલકુલ સહન થઈ નહિ. તેણે કહ્યું કે-‘તમે કે તમારા બાપે કોઈ વાર ધાસ ખાઈ જોયું છે ખરું ?’ અને એ અધિકારીનું મોહું તરત જ પડી ગયું. તેને લાગ્યું કે ‘મારે આવા શબ્દો બોલવા જોઈતા ન હતા.’

જેથી બીજાનું અહિત થાય, બીજાને નુકસાનમાં ઉત્તરવું પડે એવાં વચનો બોલવા પણ યોગ્ય નથી. કેટલાક માણસો માર્મિક વચનો બોલવામાં, બીજાના છિદ્રો બોલવામાં કે બીજાને ઉલ્લુભ બનાવવામાં આનંદ માને છે, તે આ દસ્તિએ અયોગ્ય છે.

ગયાં મારવાં, અતિશયોક્તિ કરવી કે જૂદું બોલવું એ પણ વાણીનો વિકાર જ છે, તેથી સુજાજનોએ તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.

ધર્મશાસ્ત્રો સ્પષ્ટ ફરમાન કરે છે કે આત્માર્થી સાધકે સત્ય, પરિમિત, અસંદિગ્ય, વાચલતા રહિત અને કોઈને ઉદ્દેગ ન થાય તેવી જ વાણી બોલવી જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૧૬, તા. ૬-૧-૧૯૬૨

૪૨ (લેખાંક-બીજો)

(તંત્રીનોંધ- આ લેખાંક ૧લો ગયા અંકમાં પ્રસિદ્ધ થયેલ અગ્રલેખની પહેલાં પ્રસિદ્ધ કરવાનો હતો, પરંતુ ટપાલખાતાની ગફ્ફલતના કારણે પ્રેસ પર સમયસર નહિ પહોંચવાથી આ અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.)

વિચારો જેમ સુંદર-શ્રેષ્ઠ-પ્રશસ્ત હોવા જોઈએ, તેમ વાણીવ્યવહાર પણ સુંદર-શ્રેષ્ઠ-પ્રશસ્ત હોવો જોઈએ. તે સાથે વર્તનમાં પણ સુંદરતા, શ્રેષ્ઠતા કે પ્રશસ્તતાનાં દર્શન થવા જોઈએ. વધારે સ્પષ્ટ કહીએ તો જે મનુષ્યને ઉન્નતિ,

પ્રગતિ, વિકાસ કે અભ્યુદ્યની સાધના કરવી છે, તેણે માત્ર સદ્ગિત્યારોનું સેવન કરીને અટકી જવાનું નથી, પણ પોતાનાં વાણીબ્યવહારને વિશિષ્ટ રીતે ઘડવાનો છે અને પોતાનાં જીવનની સમસ્ત પ્રવૃત્તિઓને સુંદર રીતે વિકસાવવાની છે.

‘વિચાર પ્રમાણે વાણી અને વાણી પ્રમાણે વર્તન’ એ મહાપુરુષોનું એક વિશિષ્ટ લક્ષણ મનાયું છે. તે આપણે ભૂલવાનું નથી. આ દણિએ વાણીબ્યવહાર અંગે અહીં કેટલીક વિચારણા કરવી ધારી છે.

મહાકવિ કાલિદાસે એક સ્થળે કહ્યું છે કે ‘મનુષ્ય જેમ જેમ વચનોરૂપી બાણને છોડતો જાય છે, તેમ તેમ તેના કુલ અને જાતિ સંબંધી પ્રમાણો મળતાં જાય છે. તાત્પર્ય કે જો એ મનુષ્યની વાણીમાં વિવેક, નમતા, શિષ્ટતા, સંસ્કાર, મધ્યસ્થતા આદિ ગુણો દેખાય તો એમ સમજવું કે તે ઊંચા કુલનો છે, ઊંચી જાતિનો છે. અને જો એ મનુષ્યની વાણીમાં તુચ્છતા, ધમંડ, અક્કડાઈ, અશિષ્ટતા; પૂર્વગ્રહ આદિ દેખાય તો એમ સમજવું કે તે હલકા કુળનો છે; હલકી જાતિનો છે.

પરંતુ આજે તો ઊંચા કુળ અને ઊંચી જાતિના લોકોની વાણીમાં તુચ્છતા-ધમંડ-અક્કડાઈ વગેરેનાં દર્શન થવા લાગ્યાં છે, તે કેટલું ખેદકારક છે ! એક શેર પોતાના હાથ નીચે કામ કરનાર સારા માણસોને મૂર્ખ બેવકૂફ-ગષેડા-લુચ્યા-પાણ, નાલાયક વગેરે શબ્દો વારંવાર કહે ત્યારે શું સમજવું ? આ એક પ્રકારની ભયંકર કુટેવ છે અને તે સુધારવી જ જોઈએ.

નીતિકારોએ સ્પષ્ટ કહ્યું છે કે ‘પુરુષને જેટલો સંતાપ કઠોર અક્ષરોવાળી વાણીથી થાય છે, તેટલો સંતાપ શત્રુ, રોગ-વિષ કે દારુણ મહાવ્યાધિથી પણ થતો નથી.’

મહાભારતની આ વાત છે- પાંડવોએ સુંદર મીનાકારીવાળો મહેલ બનાવ્યો અને તેની ફરસબંધી કાચ વડે કરી. પછી કૌરવોને તે મહેલ જોવાનું આમંત્રણ આય્યું, ત્યારે કૌરવો આવ્યા અને તેમણે ‘નીચે પાણી ભરેલું છે’ એમ માનીને કપડાં ઊંચા લઈ ચાલવા માંડ્યું, તે વખતે દ્રૌપદીએ કહ્યું કે ‘અંધળાના તો અંધળા જ હોય ને ?’ આ કઠોર વચનો કૌરવોની છાતીમાં સોંસરા ઉતરી ગયા અને તેનાથી જે સંતાપ થયો તે ભયંકર યુદ્ધમાં પરિણામ્યો; એટલે સુશ્ર મનુષ્યે કઠોરવાણીનો પ્રયોગ કરવો નહિ.

એક કવિ કહે છે કે- ‘જ્યાં સુધી પોતાની વાણી સર્વ જનોને આનંદ આપે તેવી મધુર થતી નથી, ત્યાં સુધી કોયલ મૌનમાં દિવસો પસાર કરે છે. તેવી રીતે મનુષ્ય બીજાને આનંદ ઉપજાવે તેવી વાણી ન બોલી શકે તો તેણે પોતાના દિવસો મૌનમાં પસાર કરવા સારા.’

એક બીજો કવિ કહે છે કે ‘સર્વ પ્રાણીઓ પ્રિય વાણી વ્યવહારથી પ્રસન્ન થાય છે. તેથી તેવો જ વ્યવહાર કરવો. વચનમાં દરિદ્રતા શા માટે રાખવી ?’ લોકભાષામાં પણ એમજ કહેવાયું છે કે-

અંધાને અંધો કહે; કડવા લાગે વેણ; ધીરે ધીરે પૂછીએ, શાથી ખોયાં નેણ ?

સાધુ પુરુષો કોઈને પણ સંબોધન કરતાં ‘મહાશય’, ‘મહાનુભાવ’, ‘દેવાનુપ્રિય’ વગેરે શબ્દો વાપરે છે, તેમ ગૃહસ્થોએ પણ ‘આપ’, ‘શ્રીમાન’- ‘મહાશય’ વગેરે સારા શબ્દોથી સંબોધન કરવું જોઈએ અને બને ત્યાં સુધી કોઈને કડવો શબ્દ ન કહેવાય તેની કાળજી રાખવી જોઈએ. હિતશિક્ષા માટે કોઈને કડવા શબ્દો કહેવા પડે છે, પણ તેમાં હેતુ જુદો છે. એટલે તેને આમાં અપવાદરૂપ ગણવો જોઈએ. ધાર્મિક દણિએ કર્દ વાણી પ્રશસ્ત ગણાય, તેનો વિચાર ગયા અંકે બતાવવામાં આવ્યો છે.

જયપુર - આત્માનંદ જૈન સભા ભવનમાં પૂજ્યશ્રી ચાતુર્મિસ બિરાજતા હતા. બે મુનિઓને વ્યાકરણ ભણાવવા માટે પંડિતજી બોલાવેલા. પંડિતજી ચંડીપ્રસાદજી રોજ બપોરે બે વાગે આવે, ચાર વાગે જાય. ચોમાસું પુરું થવા આવ્યું. એકવાર પંડિતજીએ હૃદય ખોલ્યું - મહારાજજી ! કેસી બડી વિભૂતિ હૈ આપ કે ગુરુદેવ ! એસા સાધુ કહીં ભી આજ તક હમને નહીં દેખા ! ચાર માહ સે આતા હું, જાતા હું - દેખતા હું - આપ કે ગુરુદેવ કો, તનિક ભી પ્રમાદ નહીં, દોપહર કભી સોટે નહીં, સારે દિન અપને ચિન્તન ઔર લેખન કાર્ય મેં વ્યસ્ત રહતે હું, કોઈ આડબર ભી નહીં રખા, અવધૂત હૈ સચ્ચે અવધૂત ! મેરા સિર ઝુક જાતા હૈ ઉન કો દેખકર !

પૂજ્યશ્રીના ત્યાગ-વૈરાગ્ય-અપ્રમાદથી વગર ઉપદેશે વિકાન્ બ્રાહ્મણ પંડિત ખૂબ ભાવિત-પ્રભાવિત થઈ ગયા હતા.

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

(૪૩) આફતો ટાળવાનો સાચો ઉપાય

માનવજીવન સીધી કે સરસ લીટીએ ચાલતું નથી. તેને અનેક અટપટા કે વિચિત્ર સંયોગોમાંથી પસાર થવું પડે છે. તેમાંથી કેટલાક સંયોગો તો એવા ખતરનાક હોય છે કે જે માનવ જીવનને સમૂહું નષ્ટભણ કરી નાખે. આવા પ્રસંગે તેણે શું કરવું ? એ એક ગહન પ્રશ્ન છે.

કોઈ એમ માનતું હોય કે આવા પ્રસંગે આપણે પૂરાં બળથી લડીએ તો આપણો બચાવ થઈ શકે, પણ આપણું શારીરિક બળ ઘણું મર્યાદિત છે. તેનાથી મહાન ભયો કે પ્રચંડ ઉપદ્રવોનું નિવારણ થઈ શકતું નથી. દાખલા તરીકે આપણે એક શેરીમાંથી ચાલ્યા જતા હોઈએ અને એક મદ્દોન્મત હાથી સામો આવી જાય, ત્યાં આપણે લડી-લડીને કેટલું લડીએ ? તેનો એક જ સપાઠો આપણને જમીન દોસ્ત કરવાને પૂરતો હોય છે. અથવા આપણે એક જંગલમાંથી પસાર થતા હોઈએ અને કોઈ દુર્દાત વાધ કે સિંહનો ભેટો થઈ જાય, ત્યાં આપણે શારીરિક બળ કેટલું વાપરી શકીએ ? કોઈ કોઈ પુરુષોએ વાધ કે સિંહની સામે લડાઈ કરીને તેમાં જાય મેળવ્યાના દાખલાઓ ઈતિહાસનાં પાને નોંધાયેલા છે, પણ તેને અપવાદરૂપ ગણવા જોઈએ. સામાન્ય મનુષ્યોની સ્થિતિ તો આ વખતે અત્યંત કંદંગી થઈ પડે છે અને તેઓ પીપળાનાં પાનની જેમ પ્રૂજવા લાગી જાય છે. તેઓ આ અતિ બળવાન કૂર પ્રાણીઓના પંજામાંથી છટકી શકતા નથી.

કોઈ એમ માનતું હોય કે આવા પ્રસંગે બુદ્ધિબળ વાપરીએ તો આપણો બચાવ થઈ શકે, તો આ માન્યતા પણ બરાબર નથી. આપણે બુદ્ધિબળથી દુઃખ, કષ્ટ કે મુશીબતને નિવારવાના ઉપાયો યોજ શકીએ છીએ ખરા, પણ તેનેથી ઘણી મર્યાદા છે. પૂનામાં પાણીનું એકાએક પ્રચંડ પૂર આવ્યું, તે વખતની એક ઘટના છે. એક મારવાડી ગૃહસ્થે વિચાર કર્યો- બુદ્ધિ દોડાવી કે પાણીનું પૂર આવી-આવીને કેટલું આવશે ? માટે ચાલો, બધા મકાનના બીજા માળે ચડી જઈએ; અને તેઓ પોતાના કુટુંબીજનો સાથે મકાનના બીજા માળે ચડી ગયા. પરંતુ પાણી ઊંચે ચડવા લાગ્યું અને તે જોતજોતામાં બીજા માળને આંખી ગયું. એટલે તે ગૃહસ્થે બધાને ત્રીજા માળે ચડી જવાનું કહ્યું. બધાએ તેમ કર્યું, એ ગૃહસ્થની બુદ્ધિ એમ કહી રહી હતી કે પાણી આથી તો વધારે ઊંચું ચડશે જ નહિ. અહીં બધા સલામત છીએ. પણ એ ગણતરી ખોટી પડી. પાણી ઊંચું ચડનું જ રહ્યું અને તે ત્રીજા માળ સુધી ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

આવી પહોંચ્યું. પેલા ગૃહસ્થે બુદ્ધિ દોડાવી અને એક મોટા ટેબલ પર ચડી જઈને આશ્રય મેળવ્યો. બીજા કુટુંબીજનો પણ ત્યાં ચડીને ઉભા રહ્યા. એવામાં આખુંયે મકાન કડડભૂસ તૂટી પડ્યું અને બધા પાણીમાં ગરકાવ થઈ ગયા. કહેવાનું તત્ત્વયે એ છે કે દરેક આફતનો માત્ર બુદ્ધિથી બચાવ થઈ શકતો નથી, તે માટે બુદ્ધિ બહુ ટૂકડી પડે છે, અને તેથી જ ‘આવા પ્રસંગે મનુષ્યે શું કરવું ?’ એ એક ગહન પ્રશ્ન બને છે.

આપણા જ્ઞાની-અનુભવી-ઉપકારી પુરુષોએ આ પ્રશ્નનો ઉત્તર આપતા જણાયું છે કે ‘આવા પ્રસંગે નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક સ્મરણ કરવાથી મનુષ્યનો કોઈ પણ રીતે બચાવ થાય છે.’ અને તેમણે એનાં સચોટ દાણાંતો પણ આખ્યાં છે. આ વસ્તુનો અનુભવ આજે પણ ઘણાને થઈ રહ્યો છે.

આયંબિલનો તપ અને શ્રી જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ પણ આવા પ્રસંગે ઘણી સહાય કરે છે. એટલે અષ્ટગ્રહોની યુતિથી આવી રહેલી આફતોને ટાળવા માટે પ્રત્યેક શ્રદ્ધાળું આત્માએ નમસ્કાર મહામંત્રનો બને તેટલો જપ કરવો, યથાશક્તિ આયંબિલો કરવા અને શાન્તિસનાત્રાદિ ભણાવવા એવો અમારો પ્રબળ અનુરોધ છે. મુંબંદમાં વિશ્વશાંતિ જૈન આરાધના સત્રની ઉજવણી આ દણિને લક્ષમાં રાખીને થઈ રહી છે, તેને અમે સંપૂર્ણ સફલતા હીચીએ છીએ.

U જૂની પોસ્ટનો કોરો ભાગ ચે પૂજ્યશ્રીનું લેટરપેડ

પોસ્ટમેન ટપાલો આપી ગયો. બધી ટપાલો પૂજ્યપાદ ગુરુદેવશ્રીના ટેબલ પર રાખવામાં આવી. પાસે રહેલા સાધુ પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે ટપાલ ફોડીને આપવાના આશ્રયથી આટ્યા અને પૂજ્યપાદશ્રીની આજા લઈ કવર ફોડવા માંડયા...હજી પહેલું જ કવર અડધું ફોડયું ત્યાં પૂજ્યપાદ ગુરુદેવશ્રીની નજર ગઈ...સાધુને કહ્યું ‘અલ્યા, આમ કવર ફોડય ?...આમ અડધેથી કવર ફોડવામાં ક્યારેક અંદર રહેલો કાગળ પણ ફાટી જાય...અને કવર કશા ઉપયોગમાં આવે નહિ...લે આ ચશમા...જો કવરની ઘાર પર નાનું કાણું કરી ચશમાની દાંડી અંદર ઘુસાડી દે...એટલે એક બાજુથી કવર ફાટી જશે...અંદર કાગળ પણ સલામત રહેશે અને કવરનો બાકીનો ભાગ અખ્યાંડ રહેવાથી લખવામાં કામ આવશે...’

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્યX

૪૪ શેઠ માણેકલાલ ચુનીલાલનું મનનીય ભાષણ

તાજેતરમાં મુંબઈ ખાતે વિશ્વશાંતિ જૈન આરાધના સત્રની ઉજવણી ભારે ધામધૂમથી થઈ. તેનું ઉદ્ઘાટન તા. ૧૪-૧-૬૨ના રોજ પ્રાતઃકાળના ૮-૩૦ વાગતાં મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ શ્રી શ્રીપ્રકાશે કર્યું હતું. તે પ્રસંગે વિશ્વશાંતિ જૈન આરાધના સમિતિના પ્રમુખ શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલે મનનીય ભાષણ કર્યું હતું, અને આગામી અશુભ યોગો અંગે આપણું કર્તવ્ય શું છે? તે બહુ સારી રીતે સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે-

‘ભારતની આર્થસંસ્કૃતિનું એ મંતવ્ય છે કે કોઈ પણ રાષ્ટ્રની પ્રજાનું જીવન અહિસા, સત્ય, સદાચાર અને સંયમથી વિમુખ બની હિસા, અસત્ય, દુરાચાર અને અસંયમ તરફ વધુ પ્રમાણમાં ટણે છે ત્યારે એ પ્રજાનાં જીવનરૂપી મહાસાગરમાં પાપોદ્યની અમર્યાદિત ભરતી આવે છે. જેની અસર એકલા પૃથ્વી-પાણી ઉપર નહિ, પરંતુ ઠેઠ નભો મંડળ સુધી પહોંચે છે, અને દેવયોનિ તરીકે ગણાતા નક્ષત્ર-ગ્રહમંડળ વગેરે જ્યોતિષ-ચક્કમાં પણ અનુકૂલ યોગનાં સ્થાને અશુભસૂચક પ્રતિકૂલ યોગ ઊભા થાય છે.

એક બાજુથી જ્યારે દુનિયાના દેશોની પ્રજામાં અશાંતિનું જોરદાર ભયાનક વાતાવરણ હોય, અને તેમાં અશુભ સૂચક આઈ ગ્રહનો યોગ આપણી સામે ખડો થાય. ત્યારે ‘દુઃખ પાપાત્ સુખં ધર્માત’ ‘દુઃખ પાપથી અને સુખ ધર્મથી છે.’ આવા સર્વદર્શન-સંમત સિદ્ધાંત ઉપર શ્રદ્ધા રાખનાર હરકોઈ વ્યક્તિની એ અનિવાર્ય ફરજ થઈ પડે છે કે અહિસા, સત્ય અને સંયમધર્મને પોતાનાં જીવનમાં અપનાવવા તૈયાર બનાવું અને તે માટે આપણા ગ્રાચીન મહર્ષિઓના ઉપદેશ પ્રમાણે ખાનપાન, મોજશોખ વૈભવ વિલાસના રંગરાગની અનુચ્ચિત પ્રવૃત્તિઓને ઘટાડી તપ, જપ અને પ્રભુભક્તિમય પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનોમાં જુકી પડવું જોઈએ. આવી કલ્યાણકારી આરાધનાઓ, યથોચિત વિધિસર કરવામાં આવે તો તેમાં એકાતે અવશ્ય લાભ જ છે.’

ત્યાર બાદ તેમણે આયંબિલના તપમાં, મહાપ્રભાવક નવકાર મહામંત્રના જાપમાં અને વિશ્વના ઉપકારી અરિહંત ભગવંતના વિશિષ્ટ ભક્તિભાવભર્યા

મહાપૂજન વગેરે અનુમોદનીય અનુષ્ઠાનોમાં યથાશક્તિ લાભ લેવા તથા એ તપ-જપ-અનુષ્ઠાનની મંગળ પ્રવૃત્તિ સાથે જીવનમાં મૈત્રી, પ્રમોદ, કારુજ્ય અને માયસ્થ્ય ભાવનાની પવિત્ર જ્યોતિ પ્રકટાવવા અને ‘શિવમસ્તુ સર્વજગતઃ’ વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાઓ એ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા અપીલ કરી હતી.

આ પ્રમાણે હજારો હૈયાં દિલના સાચા ભાવથી ભારતની પવિત્ર સંસ્કૃતિને જીવનમાં અપનાવશે તો અશુભ અને અનિષ્ટ તત્વોની ભરતીમાં ઓટ આવશે. પુષ્યની ભરતીના કલ્યાણ માંડશે. દેશના સર્વત્ર શાંતિની છાયા પ્રસરણે અને અશુભ સૂચક ગ્રહોના યોગનું ઓછું વધુ ભયજનક વાતાવરણ પણ ખૂબ હળવું બનશે.’

આગામી ભયજનક પરિસ્થિતિ અંગે સકળ સંધનું શું કર્તવ્ય છે, તે આથી સ્પષ્ટ સમજાય છે. જૈનશાસન તો વિશ્વનો આધાર છે. વિશ્વના સ્થૂલ-સૂક્ષ્મ સમસ્ત જીવોની ઓળખ અને દયા જૈનશાસન શીખવે છે. પ્રાણીમાત્રના કલ્યાણ અર્થે શ્રી તીર્થકર દેવોએ આ મહામંગળ શાસનની જગતને ભેટ કરી છે. એવા જૈનશાસનને અનુસરનાર જૈન સંધને આજના અવસરે એક મહાન તક સાંપરી છે એમ કહી શકાય. એવી કલ્યાણ તકને સફળ કરવા માટે શ્રી સંધની પ્રત્યેક વ્યક્તિએ સ્વાત્માના, શ્રી સંધના અને વિશ્વના કલ્યાણ અર્થે તન-મન-ધનની શક્તિઓ કામે લગાડી દેવી જોઈએ. નમસ્કાર-મહામંત્ર, લોગસ્, ઉવસગગહર, શ્રી શાંખેશ્વર પાર્શ્વનાથ, વગેરેના ભરપૂર જ્ઞાપ, આયંબિલ-નીવી વગેરે તપસ્યાઓ, સ્નાત્ર-મહાસ્નાત્ર-શાંતિસ્નાત્રો, પૂજા ભાવનાઓ, નવસ્મરણાદિ સ્તોત્રપાઠ, ઈત્યાદિ અનેકાનેક ધર્મપ્રવૃત્તિઓ ચારે બાજુએ ગાજતી થઈ જવી જોઈએ.

જૈનશાસનની આરાધનાઓ વિશિષ્ટ કોટિની હોય છે, નક્કર મંગળરૂપ હોય છે, લોકોત્તર વિધાન અને શુભ આશયવાળી હોય છે. એ લક્ષમાં રાખી,

(૧) ‘સૌ કોઈ દુઃખથી મુક્ત થાઓ, સૌને સદ્ગ્રાવના પ્રાપ્ત થાઓ, સૌના અપમંગળ ટળો, સૌ કોઈ પરહિતરક્ત બનો, સૌનું કલ્યાણ થાઓ...’ ઈત્યાદિ ઉચ્ચ શુભ ભાવના વારંવાર કરવાની;

(૨) તેમજ શાસનની શૈલીએ તપ-જપ-શાંતિકાર્યોની આરાધના કરવાની;

(૩) આરાધનાના ઉતેજક બળો તરીકે બ્રહ્મચર્યપાલન, સત્ય વચન, ન્યાય-નીતિ, સૌભ્ય વત્તિવ, કલેશત્યાગ, નિંદાત્યાગ, જીવજતના વગેરે ખાસ સાચવવા.

૪૫ ભવનિર્વદ એ ભગવદભુમાન શી રીતે ?

અરિહંત ભગવાનને અભયદાતા ચક્ષુદાતા વગેરે કહેવામાં આવે છે. તો પ્રશ્ન થાય કે ભગવાન અભય-ચક્ષુ વગેરેના દાતા શી રીતે ?

આ સમજવા માટે પહેલાં આધ્ય સાધનાથી માંડી મોક્ષ પર્યન્તની પ્રક્રિયા અતિસંક્ષેપમાં જોઈએ. જીવને આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનંતાનંત પુદ્ગલપરાવર્ત જેવા જંગી કાળ વીતી ગયા. જ્યારે મોક્ષે જવા પૂર્વે છેલ્લા પુદ્ગલપરાવર્ત (ચરમાવર્ત) કાળમાં જવ આવે છે ત્યારે જ એને સંસારનો રસ, રુચિ, પક્ષપાત તૂટી સંસારવાસ પર ઉદ્ઘેગ, અરુચિ, અનાસ્થા પ્રગટ છે, એટલે કે ભવનિર્વદ જાગે છે.

ભવનિર્વદ કેવો અને શાથી :- ભવનિર્વદ એટલે ભવ પર કંટાળો, સંસાર પર અરુચિ, સંસારવાસ કારાગારમાં વસવા જેવો ઉદ્ઘેગકારી લાગે. અનું કારણ, સંસાર મુખ્યતયા ઠીક ઠીક શરીર, વૈભવ અને મનગમતા સ્નેહીઓ વગેરેના સંયોગ પર મીઠો લાગે છે. પરંતુ એ ગ્રાણેયની દુર્દીશા દેખાય છે. ‘કાયઃ સંનિહિતાપાયઃ સંપદઃ પદમાપદામ् । સમાગમાઃ સાપગમાઃ સર્વમ् ઉત્પાદિ ભંગુરમ् ॥ અર્થાત્ શરીર એવું છે કે જેને અનેક ઉપદ્રવ અને નાશ નિકટમાં છે, સંપત્તિ વૈભવ એ આપદાઓનું ઘર છે, અને ઈષ સ્નેહીઓ વગેરેના સમાગમ એ નક્કી વિખરવાના છે. કહો કે ઉત્પન્ન થનારું બધું જ નાશવંત છે. હવે એ ગમે તેટલા રૂડા લાગી સંસાર મીઠો લાગવા જાય, પરંતુ ઉપદ્રવ આપદા અને વિયોગની ખાસિયતવાળા હોઈને, રૂડા લાગેલા એ એક દિ’ રોવરાવવાના છે, તો એના પર શી આસ્થા, હુંફ ને રુચિ રહે ?

શરીર છે માટે જ ભૂખ-તરસ, ટાઢ-તડકો, શ્રમ-સુસ્તી, અપમાન-અનાદર અને નાના મોટા અનેક રોગ વગેરે ઉપદ્રવ જાગે છે; તેમજ મૃત્યુ અવશ્ય નજીકમાં છે. શરીર ન હોય તો આમાનું કશું ય શાનું હોય ? પણ શરીર છે અને ‘આવું કાંઈ આવવાજ દઉં નહિં’ એવી સત્તા કોઈ ચલાવી શકતું નથી. ત્યારે એ કોઈ ગમતી વાત પણ નથી.

એમ, સંપત્તિ-વૈભવ એ લુંટારાનાં સન્માનની જેમ આપત્તિઓથી ભરેલા છે. ‘અર્થાતામ् અર્જને દુઃખમ् અર્જિતાનાં ચ રક્ષણે । આયે દુઃખં વ્યયે દુઃખં ધિરાર્થા

દુઃખભાજનમ् ॥ સંપત્તિ કમાવવામાં કષ છે, કમાયેલાને સાચવવામાં કષ છે, મોહવશ એ કષદુરૂપ લાગે નહિ એ જુદી વાત; બાકી ધનમાલના આવવામાં ય દુઃખ છે અને જવામાં ય દુઃખ છે. ધિક્કાર છે દુઃખ-આપત્તિ-સંતાપના ધરસમા આ સંપત્તિ વૈભવને ! ! મોહના કેફમાં ઉન્મત બનેલા હૃદયને આની પરવા ન હોય એ જુદી વાત, છતાં સરવાળે આપદા જ છે અને એક દિ’ એ જવાનાં જ છે. આ ગમતી વાત નથી.

હવે રવ્યા સ્નેહીઓ વગેરેના સંયોગ એ વળી વિયોગમાં પરિણમનારા છે. ગમે તેવા સારા અને સશક્ત પરિવાર એક દિ’ રવાના થાય છે; અને ત્યારે ભારે શોક અને ઉદ્ઘેગ જન્મે છે; ‘કાંઈ ગમતું નથી પણ પછી હૃદય ધિહું બનવા માંડે છે. પાછું બધું ય ગમવા માંડે છે ! ‘વાલેસર વિના એક ધરી, ગોઠે નહિ ય લગાર રે; (પણ) તે વિશ જન્મારા વહી ગયા, ગોઠ્યું બધું ય સંસાર રે ! ’ ‘જાગ જાગ મતિમંત, મોહતણા રણિયા ભમે, લૂંટે જગતના જંત (જંતુ) રે...’ કેવળ સ્નેહીના જ સંયોગ શું, સંયોગમાત્રના અંતે વિયોગ છે. સંયોગથી ચેઢેલાને અવશ્ય પડવાનું. નાસ્તિકને ય એટલે તો માનવું જ પડે કે બધું મૂકીને એકલાને મરવાનું ! બધું ઊભું રહે, ને પોતે ખલાસ ! સંયોગ એટલે વિયોગ નક્કી. વિયોગનો કલ્યાંત ભારે. મોટી મહેલાતો અને સંપત્તિઓ, તથા મોટા પહેલવાનો અને પાદશાહો, કઈ ઊરી ગયા ! સંસાર એટલે કાયા, સંપત્તિ અને સમાગમો; એ ઉપદ્રવ આપત્તિ અને વિનાશના કલંકથી કલંકિત છે... તો એના પર હૈયાનાં હેત શા ? દિલની આસ્થા શી ?

ભવનિર્વદ એ ભગવદ્ભુમાન :- ભવ્યાત્માને આવા સંસાર પર અભાવ જાગે, અરુચિ થાય એ ભવનિર્વદ આવ્યો. એ આવે તો જ ભગવાન પર બહુમાન થાય. વળી ભગવાન વીતરાગ છે, અને ભવ રાગાદિ ઉપર સર્જય છે. હવે જો ભવ એટલે કે રાગાદિની પ્રત્યે અરુચિ થઈ, તો એનો અર્થ જ એ કે વીતરાગતાનું આકર્ષણ થયું, એટલે કહેવાય કે રાગાદિભર્યા ભવ પર નિર્વદ એ જ ખરું વીતરાગ ભગવાન પર બહુમાન. સંસાર પર ઉદ્ઘેગ થાય, નિર્વદ જાગે ત્યારે જ વીતરાગ સર્વજ્ઞ ભગવાન પર બહુમાન જાગે છે, પક્ષપાત થાય છે. જો ભવનિર્વદ નથી, સંસાર પર લેશ પણ ઉદ્ઘેગ નથી, અને કહે કે ‘મને ભગવાન બહુ ગમે છે,’ તો એ કથન પોકળ છે. ભવનિર્વદ વિના વાસ્તવિક ભગવદ્-બહુમાન હોતું નથી. એટલે એમ કહી શકાય કે ભવનિર્વદ પ્રગટ્યો એ ભગવદ્-બહુમાન થયું.

ભગવદ્-બહુમાનથી વિશિષ્ટકર્મ-મિથ્યાત્વમોહનીયાદિ કર્મનો ક્ષયોપશમ થાય છે, ત્યાં અભય, ચક્ષુ, માર્ગ, શરણ વગેરે ધર્મની પ્રાપ્તિ થાય છે. તે થાય તો જ

૮૧

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

પછી સમ્યગ્રદર્શનાદિ મોક્ષોપયોગી ધર્મની યાને મોક્ષમાર્ગ સ્વરૂપધર્મની પ્રાપ્તિ થઈ શકે તે વિના નહિ. એટલે આ બધું સિદ્ધ થવામાં ભગવદ્-બહુમાન પહેલું જરૂરી છે, અને બધામાં એ વણાયેલું રહેલું જોઈએ.

ખૂબી આ છે કે બહુમાન બીજા કોઈ પ્રત્યે નહિ કિન્તુ અરિહંત ભગવાન પ્રત્યે ધરવામાં આવે તો જ અભયાદિ ધર્મથી માંડીને ઠેઠ ઉપર સુધીનાં કલ્યાણ પ્રાપ્ત થઈ શકે છે. અચિંત્ય પ્રભાવ એ ભગવાનનો જ છે કે એમના જ બહુમાન ઉપર અભયાદિ કલ્યાણ સિદ્ધ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એ જ પ્રભુ અભયાદિનું પ્રદાન કરે છે, માટે અરિહંત ભગવાન અભયદાતા વગેરે કહેવાય છે.

(પરમતેજ ભા.૨ માંથી)

U ચૌવિહાર ઉપવાસનું પચ્યકખાણ કરી લીધું V

સં. ૨૦૨૩ ની સાલના જેઠ મહિનાનો આ પ્રસંગ છે. સવારે ઘાટકોપરથી વિહાર કરીને મુલુક જવાનું હતું. વિહારની તૈયારી ચાલતી હતી. તેવામાં પૂજ્યશ્રીની નજર પોતાની તરપણી પર ગઈ.

“મારી તરપણીની ટોક્સી કેમ બદલાયેલી છે ?”

“હાજુ ગુરુદેવ ! આપની ટોક્સી નમૂના તરીકે બતાવવા એક શ્રાવકને આપી છે, આજે આવી જશે.”

“ક્યારે આપી ?”

“ગાઈકાલે સવારે.”

“સવારે તેનું પડિલેછણ થઈ ગયું હતું ?”

“હાજુ”

“બપોરે તેનું પડિલેછણ કોણે કરવાનું ? ટોક્સીનું પડિલેછણ રહી જાય તે ચાલતું હશે ? પૂછ્યું જોઈએ ને ?”

ટોક્સીનું એક ટંક પડિલેછણ રહી ગયું તેનું પૂજ્યશ્રીના હદ્યમાં એટલું બધું દર્દ થયું કે ૧૪ કિ.મી. નો વિહાર કરીને પણ સખત ગરમીમાંચ તે દિવસે પ્રાયશ્ચિત્ત રૂપે ચૌવિહાર ઉપવાસનું પચ્યક્ખાણ કરી દીધું.

કેવી પાપભીરુતા ! કેવું સંયમ !

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૨૨, તા. ૧૭-૨-૧૯૬૨

૪૫ જૈન ધર્મની ભક્તિપ્રધાનતા

(૧)

જૈનધર્મ જેવો ભાર અહિંસા, સંયમ અને તપ ઉપર મૂક્યો છે, તેવો જ ભાર ભક્તિ ઉપર પણ મૂક્યો છે. આ સ્પષ્ટતા અહીં એટલા માટે કરવામાં આવે છે કે કેટલાકને આ વાત સમજાઈ નથી. તેઓ એમ માની રહ્યા છે કે જૈનધર્મ ઈશ્વરને માનતો નથી, પછી તેમાં ભક્તિને સ્થાન ક્યાંથી હોય ? અથવા તો જૈનધર્મમાં ભક્તિ પણથી આવી, વૈષ્ણવ સંપ્રદાયનાં અનુકરણરૂપે આવી, વગેરે.

પરંતુ આ માન્યતાઓ પાયા વિનાની છે. પ્રથમ તો માની લેવામાં આવે છે તેમ જૈનધર્મ નિરીશ્વરવાદી નથી, તે ઈશ્વરને માનનારો છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારો છે, પરંતુ ઈશ્વર સૂષ્ટિનો સર્જક, પાલક કે સંહારક હોય, એ વસ્તુને તે સ્વીકારતો નથી. તેનું મંત્ર એવું છે કે આ વિશ્વમાં અનંત આત્માઓ છે, આ દરેક આત્મામાં ઈશ્વરત્વ ધૂપાયેલું છે. જો યોગ્ય પ્રયાસ-પ્રયત્ન-પુરુષાર્થ કરવામાં આવે તો એ ઈશ્વરત્વ પ્રગટ થાય છે અને આત્મા તે પરમાત્મા-પરમેશ્વર બની જાય છે. આ સૂષ્ટિનું સર્જન કોઈએ કર્યું નથી અને તેનો સંપૂર્ણ નાશ કરી થવાનો નથી, અર્થાત્ તે શાશ્વત છે. તેનું બધું કાર્ય સ્વયં સંચાલિત છે.

જૈન ધર્મ ઈશ્વરનું સ્વરૂપ બે પ્રકારનું માન્યું છે. સાકાર અને નિરાકાર. જેમાં જે આત્માઓ વીતરાગ સર્વજ્ઞ બની વિશિષ્ટ અતિશયોથી યુક્ત થઈને અહૃતપ્રદ પામે છે તે સાકાર ઈશ્વર ગણાય છે - અને જે આત્માઓ સકલ કર્મનો નાશ કરી સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે, તે નિરાકાર ઈશ્વર ગણાય છે, કારણ કે આ ઈશ્વરને દેહ, રૂપ, રંગ આદિ કંઈ હોતું નથી.

અહીં એ જણાવવું જરૂરનું છે કે જૈનધર્મમાં દેવ, શુરુ અને ધર્મની ત્રિપુરીનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે, ત્યાં દેવ શબ્દ ઈશ્વરનું સૂચન કરનારો છે.

કેટલાક એવો પ્રશ્ન પણ કરે છે કે ‘જો જૈન ધર્મ ભક્તિને મહત્વ આપતો હોય તો તેનો મોક્ષનાં એક સાધન તરીકે ઉલ્લેખ કેમ કરતો નથી !’ આ પ્રશ્ન કરનાર મહાનુભાવોએ જાણવાની જરૂર છે કે જૈનધર્મ મોક્ષનાં વિવિધ સાધનોનો સ્વીકાર કર્યો છે, તેમાં સમ્યગ્રદર્શન કે સમ્યક્તવ એ ભક્તિપ્રધાન સાધન છે. જેને દેવ, શુરુ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી, ભક્તિ નથી; તેને સમ્યક્તવ સંભવતું નથી, વળી જિનાગમોમાં નીચેના શબ્દો પણ પ્રગટપણે દેખાય છે : ‘ભતીઝ જિનવરાણાં

ખિજ્જંતિ પુવ્વસંચિઆ કમ્મા' અર્થાતુ જિનેશ્વરદેવની ભક્તિ કરવાથી પૂર્વસંચિત કર્મનો નાશ થાય છે. એટલે જૈનધર્મે ઈશ્વરભક્તિ કે પ્રભુભક્તિનો મોક્ષનાં એક સાધન તરીકે સ્પષ્ટ સ્વીકાર કરેલો છે.

ભક્તિની પરિભાષા ઘડી વિશાળ છે. તે બરાબર સમજવામાં આવે તો આ વિષયમાં કોઈ વાંધો રહે તેમ નથી. અનન્ય શ્રદ્ધા એ ભક્તિ છે, વિનય અને વૈયાવૃત્ત્ય પણ ભક્તિ છે; સદ્ગ્રાવ, સેવા અને સમર્પણ એ પણ ભક્તિ છે; અને વંદન, પૂજન સત્કાર અને સન્માન એ પણ ભક્તિ છે; યાવત્ત વચન-પ્રતિપત્તિ એ ભક્તિ છે. શું આ વસ્તુઓ જૈન ધર્મે ઉપદેશેલી નથી? જો ઉપદેશેલી છે, તો જૈન ધર્મમાં ભક્તિ પછીથી આવી એમ કયા આધારે કહેવાય છે?

અમે ડિઝિમ નાદે એમ જાહેર કરીએ છીએ કે જૈન ધર્મમાં ભક્તિને જેવું અને જેટલું સ્થાન અપાયું છે, તેવું અને તેટલું સ્થાન બીજા ધર્મમાં ભાગ્યે જ અપાયું હશે. હવે પછીનું વિવેચન પાઠકોને આ વસ્તુની પ્રતીતિ કરાવશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૨૩, તા. ૨૪-૨-૧૯૬૨

(૪) (૨)

શ્રી નમસ્કાર મહામંત્ર જૈન ધર્મનો સાર ગણાય છે, તેમાં દેવભક્તિ-ઇશ્વરભક્તિ અને ગુરુભક્તિ સિવાય બીજું શું છે? ‘નમો અરિહંતાં’ અને ‘નમો સિદ્ધાં’ એ બે પદો દેવની-ઇશ્વરની ભક્તિ સૂચવનારાં છે અને ‘નમો આયરિયાં’ આદિ ત્રણ પદો ગુરુભક્તિ સૂચવનારાં છે.

જૈન ધર્મે દેવ અને ગુરુની ભક્તિ ઉપરાંત શુતભક્તિ, સંધભક્તિ અને સાધર્મિક ભક્તિનો ઉપદેશ પણ જોરશોરથી આપેલો છે. અને ભક્તિના આ પ્રકારો રૂઢી રીતે આરાધવામાં આવે તો તેનાથી તીર્થકર નામ કર્મ બંધાય છે, એમ પણ જણાવેલું છે. જૈન ધર્મની ભક્તિપ્રધાનતા માટે આથી વિશેષ પ્રમાણો કયાં જોઈએ?

કેટલાક એમ માને છે કે ‘જૈન ધર્મમાં ભક્તિ તો હતી, પણ તેનું સ્વરૂપ જોઈએ તેવું વિકાસ પાયું ન હતું. એનો વિકાસ તો વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિ જોયા પછી જ થયો.’ આ મંત્વ્ય પણ નિરાધાર જ છે. સત્ય હકીકત એ છે કે જૈન ધર્મમાં ભક્તિનાં વિવિધ અંગો અતિ પ્રાચીનકાલથી ખીટાં હતાં અને આજ પર્યત તે બરાબર જળવાઈ રહ્યા છે. અમારી સમજ મુજબ આ અંગો નીચે મુજબ છે:

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૮૫

(૧) સ્મરણ : પંચપરમેણિનું સ્મરણ કરવું. ચોવીસ તીર્થકરોના નામ યાદ કરવાં. આવું સ્મરણ બરાબર થઈ શકે તે માટે જ જૈન બાળકોને નાનપણથી શ્રી નમસ્કાર મહામંત્ર તથા ચોવીસ તીર્થકરોના નામ કંદર્થ કરાવવામાં આવે છે.

(૨) પ્રણિપાત : વંદન, પ્રણામ અને પ્રણિપાત એ એકાર્થી શબ્દો છે. આ પ્રણિપાત અનેક પ્રકારે થઈ શકે છે, તેમાં જૈન ધર્મે પંચાંગ પ્રણિપાતનો સ્વીકાર કરેલો છે. બે હાથ, બે ધૂટૂણ તથા મસ્તક અને પાંચ અંગો ભૂમિ પર અડે એ રીતે જે પ્રણિપાત કરવો, પ્રણામ કરવો તે પંચાંગ પ્રણિપાત કહેવાય છે. દરેક જૈન, દેવ અને ગુરુ પ્રત્યે ભક્તિ બતાવવા માટે તેમને આવો પંચાંગ પ્રણિપાત કરે છે. ‘ખમાસમણ’ સૂત્રની યોજના તે માટે જ થયેલી છે.

(૩) સ્તવન : અહીં સ્તવન શબ્દથી ભજન, કીર્તન, સ્તુતિ, સ્તોત્ર આદિ સમજવાના છે કે જેમાં મુખ્યત્વે પ્રભુનાં ગુણોનો અનુવાદ-પ્રશંસા કે પ્રાર્થના હોય છે. ભક્તિનાં આ અંગની ખીલવણી જૈન ધર્મમાં વિશાળ પાયા પર થઈ છે, પ્રાકૃત, સંસ્કૃત, અપબંશ, ગુજરાતી, રાજસ્થાની, હિન્દી, મરાઠી, બંગાળી, તામીલ, તેલુગુ, ફારસી, ઉર્દૂ વગેરે અનેક ભાષામાં જિન સ્તવનો રચાયેલાં છે અને તેમાં કાવ્યનો પ્રાસાદ પણ સારી રીતે ઉત્તરેલો છે. વળી તેમાં અનેકવિધ ચમત્કૃતિઓ પણ નજરે પડે છે. પ્રભુનાં દર્શન-પૂજન કરતી વખતે પ્રત્યેક જૈન આવાં સ્તુતિ-સ્તવનો ખૂબ ભાવપૂર્વક ગાય છે. વળી જ્યારે પણ સમય મળે ત્યારે તે આવાં સ્તવનો લલકારવામાં આનંદ માને છે.

(૪) પ્રાર્થના : જૈન ધર્મે ભક્તિનાં એક વિશિષ્ટ અંગ તરીકે પ્રાર્થનાને પણ સ્થાન આપેલું છે. પ્રસિદ્ધ લોગરસ સૂત્રની છેલ્લી ત્રણ ગાથાઓ પ્રાર્થનારૂપ છે. વળી ચૈત્યવંદન કરતી વખતે ‘જ્યવીયરાય’ સૂત્ર બોલવામાં આવે છે, તે પણ પ્રાર્થનારૂપ જ છે. અહીં એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે આવી પ્રાર્થનામાં મુખ્યત્વે મુક્તિ, મોક્ષ કે સિદ્ધિની જ માગણી હોય છે અને કેટલીક વાર તેનાં સાધનોનો પણ નિર્દેશ હોય છે. વીતરાગ પરમાત્મા આગળ પૌદ્રગલિક સુખ સાધબીની માગણી કરવી નહિ, એવી જૈન ધર્મની સ્પષ્ટ આશ્ચર્ય છે. જેઓ આવી કોઈ કામનાથી દેવ-ગુરુની ભક્તિ ભરે છે, તેને મિથ્યાત્વનો દોષ લાગે છે, એમ જૈન શાસ્ત્રોએ સ્પષ્ટ જણાવેલું છે.

પ્રસંગવશ એટલું સ્પષ્ટ કરીએ કે વીતરાગને પ્રાર્થના કેમ જ કરાય? અને એ ફળ શી રીતે આપે? એ સંબંધમાં ‘શ્રી લલિત વિસ્તરા’ વગેરે શાસ્ત્રોમાં વિચારણા થયેલી છે. એમાં જણાયું છે કે આ પ્રાર્થના સાધકની શુભ આશંસા અને પ્રણિધાનરૂપ છે તેથી પ્રભુના વીતરાગપણાને બાધ નથી આવતો, તેમજ જેમ

૮૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

ચિંતામણી રતથી ઈચ્છિત ફળ મળે છે, એમ વીતરાગ પ્રભુની સુત્તિ, ભક્તિ આદિ કરવાથી ફળ મળે છે. આમ હોવાથી જૈન ધર્મ વીતરાગ પરમાત્માની ભક્તિનાં અનેકાનેક અનુષ્ઠાનો ફરમાવે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૨૪, તા. ૩-૩-૧૯૬૨

(૪) (૩)

(૫) નમસ્યા : પૂજા, અર્ચા અને નમસ્યા એ ત્રણે સમાન અર્થવાળા શબ્દો છે. જૈન ધર્મમાં ભક્તિનું આ અંગ ઉત્તમ પ્રકારે ખીલ્યું છે. જિનેશ્વરદેવની મૂર્તિ બનાવવી, તેની વિધિસર પ્રતિષ્ઠા કરવી અને તેનું નિત્ય ત્રિકણ પૂજન કરવું એ જૈન ધર્મની પ્રાચીન પરંપરા છે. જિન મૂર્તિઓ પાપાણની, આરસની, ધાતુની, સુવર્ણની તેમજ રતની પણ બનાવવામાં આવે છે. આજે સ્ફટિક તેમજ વિવિધ રત્નોની બનાવેલી પ્રતિમાઓ ભારતવર્ષના જૈન મંદિરમાં મોજુદ છે. તેનાં નિર્માણની પાછળ જૈનોએ કોડો રૂપિયા ખર્ચ્યા છે. તે ભક્તિના અતિશય વિના કેમ બની શકે ? વળી આ પ્રતિમાઓની સુંદર ભક્તિ માટે ભવ્ય મંદિરો પણ નિર્માણ કરવામાં આવ્યા છે અને તેમાં અવિક ભક્તિવશ વિવિધ પ્રકારની કલાઓને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જો હૃદયમાં ભક્તિનો પ્રવાહ જોરથી વહેતો ન હોય તો આવા કલામય મંદિરો હરગીઝ નિર્માણ થાય નહિ.

જૈન ધર્મમાં જિનેશ્વરદેવની પૂજા કરવામાં આવે છે, તે તેઓ સાક્ષાત્ બિરાજતા હોય એમ માનીને કરવામાં આવે છે અને તે વખતે સ્નાત્રથી માંડીને આત્મ-ત્રદ્વિ-પ્રાપ્તિ સુધીની સર્વે ભાવનાઓને હૃદયમાં જાગ્રત કરવામાં આવે છે. જૈન ધર્મનો ભક્તિનો અતિશય તો જુઓ ! તે જિનેશ્વરદેવનાં સધળાં અંગોને પવિત્ર માની તેની અનન્ય મને પૂજા કરે છે અને તે વખતે એ અંગ દ્વારા જે ભવ્ય લોકોપકાર થયો, તેનું સ્મરણ કરે છે. જિનેશ્વરદેવની અંગપૂજા થયા પછી અગ્રપૂજા અને ભાવપૂજા કરવામાં આવે છે, તે પણ જૈન ધર્મ વિકસાવેલી ભક્તિનું ભવ્ય સ્વરૂપ રજૂ કરે છે.

(૬) જ્યુ : જૈન ધર્મ પ્રભુનાં નામને મહામંગલકારી માન્યું છે અને તેનો જ્યુ કરતાં સર્વ દુઃખોનું નિવારણ થઈ જાય છે, એમ પ્રતિપાદન કર્યું છે. એટલે ભાવિક જૈનો પ્રતિદિન પંચપરમેષ્ઠિનો તથા તીર્થકરોનાં નામનો જ્યુ કરે છે. ભક્તિના અતિશય વિના આ જ્યુ કિયા કેમ થઈ શકે ? વળી જૈન મહાત્માઓએ જ્યુ કરવાની જે વિવિધ રીતો (આવતીદિ) બતાવી છે; તે પણ એમ સૂચવે છે કે જૈન

ધર્મ ભક્તિનાં વિવિધ અંગો ખીલવવામાં ઘડ્યો ઉંડો રસ દાખવ્યો છે.

(૭) સતત સેવા : પ્રભુની ભક્તિમાં બને તેટલો વધારે સમય ગાળવો, મનોવૃત્તિને તેમાં સતત જોડી રાખવી, તીર્થયાત્રાદિ પ્રવૃત્તિઓનાં મૂળમાં આ જ વસ્તુ રહેલી છે.

(૮) શરણાગતિ : આ ભયાનક ભવસાગરમાંથી કોઈ પણ તારી શકે તેમ હોય તો તે અરિહંત, સિદ્ધ સાધુ અને કેવલિપ્રજ્ઞપત્ર ધર્મ છે, માટે તેમનાં શરણ જવું. શરણાગતિમાં આજ્ઞાની વફાદારી આવી જ જાય છે. શરણાગતિ માટે જૈન ધર્મમાં નીચેનો મંત્ર પ્રસિદ્ધ છે : ‘ચત્તારિ સરણ પવજ્જામિ । અરિહંતે સરણ પવજ્જામિ । સિદ્ધે સરણ પવજ્જામિ । સાહૂ સરણ પવજ્જામિ । કેવલીપનતં ધર્મં સરણ પવજ્જામિ ।’ બૌદ્ધ ધર્મમાં ત્રિસરણ મંત્ર પ્રસિદ્ધ છે. તે આ મંત્રનાં અનુકરણરૂપે છે. વધારે સ્પષ્ટ કહીએ તો બૌદ્ધ ધર્મ પ્રાચીન જૈન ધર્મમાંથી જે કેટલીક વસ્તુઓ અપનાવી છે, તેમાંની આ પણ એક વસ્તુ છે.

ભાવિક જૈનો જીવનના છેલ્લા શાસે પણ આ ચાર શરણો જ અંગીકાર કરે છે, તે એની દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની અનન્ય ભક્તિનો સચોટ પૂરાવો છે.

(૯) ધ્યાન : શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન ધરવું અને તેમની પ્રશભરસથી ભરેલી મૂર્તિને હૃદયમાં સ્થાપન કરવી, ધીમે ધીમે તેમાં એકાકાર થવું અને છેવટે સર્વ મનોવૃત્તિઓનો તેમાં લય કરી નાંખવો.

જૈન ધર્મની આ નવધા ભક્તિનો પ્રભાવ અન્ય સંપ્રદાયો પર બહુ ભારે પડ્યો છે અને તેમણે એનું અનુકરણ કર્યું છે. આટલી વસ્તુ જાણ્યા પછી જૈન ધર્મમાં ભક્તિ પદ્ધીથી આવી કે વૈષ્ણવ સંપ્રદાયનાં અનુકરણરૂપે આવી એમ કહેવાની હિંમત કોણ કરશે ?

જૈન ધર્મ મૂળથી જ ભક્તિ પ્રધાન છે અને આજે પણ ભક્તિ પ્રધાન રહેલો જ છે.

૪૬ જ્ઞાન ખજનાનો લાભ હ્યો

(લેખાંક-પહેલો)

નિર્ગ્રથ પ્રવચન એ જ્ઞાનનો ખજાનો છે, જ્ઞાનનો ભંડાર છે, જ્ઞાનનો અમૂલ્ય નિધિ છે. આજ સુધીમાં અસંખ્ય મનુષ્યોએ-મુમુક્ષુઓએ તેનો લાભ લીધો છે અને તેના વડે પ્રજ્ઞાનો પૂર્ણ પ્રકાશ પામી આનંદધન સ્થિતિનો અનુભવ કર્યો છે. તો આપણે પણ આ અપૂર્વ જ્ઞાનખજનાનો લાભ લેવા ઉત્સુક કેમ ન બનીએ ?

આ જ્ઞાનખજનાનો લાભ લેવા માટે ગ્રણ વસ્તુઓ આવશ્યક છે : શ્રવણ, મનન અને નિર્દિષ્ટાસન.

તેનો અહીં ટૂકમાં પરિચય કરાવીશું.

શ્રવણ એટલે સદ્ગુરુનાં મુખેથી શાસ્ત્ર વચ્ચનોને વિધિપૂર્વક સાંભળવાં. એક વાક્ય પુસ્તકમાંથી-ગ્રન્થમાંથી વાંચીએ અને એ જ વાક્ય સદ્ગુરુનાં મુખેથી સાંભળીએ તો તેની અસરમાં ઘણો ફેર હોય છે. તેનું કારણ એ છે કે સદ્ગુરુનાં વચ્ચની પાછળ ત્યાગનું-ચારિત્રનું બળ હોય છે, જીવતો-જીગતો અનુભવ હોય છે અને સામાનું હિત કરવાની પરમ કલ્યાણવૃત્તિ હોય છે. સદ્ગુરુના મુખેથી શાસ્ત્ર વચ્ચનો સાંભળતાં કેવો લાભ થાય છે, તે ભગવતી સૂત્રમાં ‘સવણ નાણ વિનાણે’ આદિ પદોથી શરૂ થતી ગાથમાં બહુ સુંદર રીતે જ્ઞાનવેલું છે.

કેટલાક કહે છે કે ‘આજે સદ્ગુરુ જોવામાં આવતા નથી, પદ્ધી કોની પાસે જઈએ અને શાસ્ત્ર વચ્ચનોનું શ્રવણ શી રીતે કરીએ ?’ પણ આમ કહેવું ઉચિત નથી. સદ્ગુરુઓ આજે પણ વિદ્યમાન છે, તેમનો આ જગત પરથી સર્વથા લોપ થયેલો નથી. અલબંદ, તેમની સંખ્યા ઘણી ઓછી છે, પણ હુંઠનારને-શોધનારને તે પ્રાપ્ત થાય છે અને તેમની પાસેથી શાસ્ત્રવચ્ચનો સાંભળી શકાય છે, કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે યોગશાસ્ત્રમાં સદ્ગુરુનાં લક્ષણો આ પ્રમાણે બતાવ્યા છે :

મહાવ્રતધરા ધીરાઃ, ભૈક્ષમાત્રોપજીવિનઃ ।

સામાયિકસ્થા ધર્મોપદેશકા ગુરુવો મતાઃ ॥

‘જે (પાંચ) મહાત્રતોને ધારણ કરનાર હોય, ઉપસગ્ણો તથા પરીષહોને જીતનારા હોય, માત્ર લિક્ષણવૃત્તિ ઉપર નભનારા હોય, સમભાવમાં સ્થિર રહેલા હોય અને ધર્મનો ઉપદેશ આપનારા હોય તેમને સદ્ગુરુ સમજવા.’

સદ્ગુરુનું આગમન સાંભળી તેમની સમીપે જવું, વિનયપૂર્વક વંદના કરવી અને બે હાથની અંજલિ જોડી તેમનો ઉપદેશ શ્રવણ કરવો એ શાસ્ત્ર શ્રવણનો વિધિ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવાં શાસ્ત્રશ્રવણને એક દુર્લભ યોગ કર્યો છે, અર્થાત્ એ જીવનની એક અણમોલ તક છે, એમ માનીને તેમાં પ્રવૃત્ત થવું જોઈએ.

પાંચસો પ્રકરણ ગ્રન્થના પ્રાણોતા વાચક શેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે જો જીનેશ્વરદેવનું એક પણ વચ્ચન અંતરમાં બરાબર ઉત્તરે છે, તો ભવસાગરને તારનારું થાય છે, આ પરથી શાસ્ત્રશ્રવણનો મહિમા સમજી શકાશે.

મનન એટલે સાંભળેલાં શાસ્ત્રવચ્ચનો પર વિચાર કરવો, તેનો અર્થ ચિંતવવો, તાત્પર્ય વિચારવું, તેના પૂર્વિપર સંબંધથી પરિચિત થવું. કેટલાક સદ્ગુરુનાં મુખેથી શાસ્ત્રવચ્ચનો સાંભળે છે ખરા, પણ તેને એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે છે. આવાઓને શો લાભ થવાનો ? સાચી વાત તો એ છે કે સદ્ગુરુના મુખમાંથી જે વચ્ચનો નીકળે તેને રત્નતુલ્ય માની પ્રેમપૂર્વક જીલી લેવા જોઈએ અને બહુમાનની લાગણીપૂર્વક સ્મૃતિપટમાં જડી નાખવા જોઈએ. પછી કંઈક નિરાંત મેળવી-કુરસદ મેળવી તેના પર ચિંતન-મનન કરવું જોઈએ. તો જ તેનો અર્થ સમજાય, તો જ તેનો ભાવ સમજાય અને તો જ તેના પરમાર્થ સુધી પહોંચવાનો માર્ગ મોકળો બની જાય.

ચિલાતીપુત્રને ધાર્મિક જ્ઞાન ન હતું, તત્ત્વનો બોધ ન હતો, છતાં તેમણે ઉપશમ, વિવેક અને સંવર એ ગ્રણ પદ્ધો પર ચિંતન કર્યું તો બગડેલી બાજુ સુધારી શક્યા અને અધ્યાત્મનો પ્રવિત્ર પ્રસાદ પામી આત્મકલ્યાણ સાધવાને સમર્થ થયા.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૨૬, તા. ૧૭-૩-૧૯૬૨

૪૭ (લેખાંક-બીજો)

પરંતુ આજે શાસ્ત્ર વચ્ચનો પરનું-સૂત્રો પરનું ચિંતન-મનન ઘટ્યું છે અને તેથી તત્ત્વોનો-તત્ત્વભૂત પદાર્થોનો જેવો અને જેટલો સ્પષ્ટ બોધ થવો જોઈએ, તેટલો થતો નથી. દશ સ્ત્રીને કે દશ પુરુષોને ભેગા કરી સામાન્ય સૂત્રોના અર્થ પૂછો કે તે પર થોડા પ્રશ્ન કરો તો તેઓ એના સંતોષકારક ઉત્તરો ભાગ્યે જ આપી શકશે.

જેઓ ખાસ ધાર્મિક શિક્ષણ લે છે અને શિક્ષક શિક્ષીકા થવાની તેયારી કરે છે, તેમની ચિંતિ પણ લગભગ આવી જ છે, કારણ કે આ સૂત્રો પર ચિંતન મનન કરવું જોઈએ, એવું તેમને ભારપૂર્વક કોઈએ કહ્યું નથી, યા તેમણે કર્યું નથી.

થોડા વર્ષ પહેલાં આપણા સમાજના એક વિદ્વાન આપણી એક સંસ્થાની મુલાકાતે ગયા કે જ્યાં ધાર્મિક શિક્ષિકાઓને તૈયાર કરવામાં આવતી હતી. ત્યાંનું બધું કામ જોયા પછી આ વિદ્વાનને તેમનું ધાર્મિક જ્ઞાન તપાસવાની હંચા થઈ, એટલે તેણે એકત્ર થયેલી બેનોને પ્રશ્ન કર્યો કે ‘ખમાસમણા કોને કહેવાય તે જાણો છો?’ એટલે એક બહેને ઉત્તર આપ્યો કે ‘આપણે ખમાસમણો દઈએ તેને ખમાસમણ કહેવાય.’ ફરી પેલા વિદ્વાને પૂછ્યું કે ‘ખમાસમણ શર્ઝનો અર્થ શો!’ એટલે ઘણી ખરી બહેનો વિચારમાં પડી ગઈ. પણ તેમાંથી એક બહેને ઉત્તર આપ્યો કે ‘ખમાસમણા એટલે ક્ષમાશ્રમણ’. તે બહેનને ફરી પૂછ્યવામાં આવ્યું કે ‘ક્ષમાશ્રમણનો અર્થ શો?’ એટલે તેણે કહ્યું : ‘ક્ષમાવાળા સાધુજી.’

પ્રતિકમણના ચાલુ પુસ્તકોમાં આ પદનો અર્થ આવો જ આપ્યો હોય છે અને તેથી અધિક વિવેચન કર્યું પણ હોતું નથી, એટલે તે બહેને આપેલો ઉત્તર યથાર્થ ગણાય, પેલા વિદ્વાનને તેથી સંતોષ થયો નહિ. તેને તો એજ જાણવું હતું કે આ બહેનો તેનો વાસ્તવિક અર્થ સમજ્ય છે કે નહિ! એટલે તેણે એ બહેનને પૂછ્યું કે ‘સાધુઓમાં તો અનેક ગુણો હોય છે. તેમાંથી અહીં ક્ષમાનો જ નિર્દેશ કરવાનું કારણ શું?’ આ પ્રશ્નોનો ઉત્તર એ બહેન આપી શકી નથી. જો તેણે આ પદ પર થોડુંય ચિંતનમનન કર્યું હોતો તો તે જરૂર કહી શકત કે સાધુએ ક્ષમાદિદશ પ્રકારનો યતિર્ધમ પાળવાનો હોય છે, માટે અહીં ક્ષમાનો મુજ્ય નિર્દેશ કર્યો છે. ક્ષમાશ્રમણ એટલે ક્ષમા પ્રધાન દશ પ્રકારનો ધર્મપાળનાર સાધુમહાત્મા.

જેઓ પંચપ્રતિકમણ, ગ્રાણ ભાષ્ય અને છ કર્મગ્રંથ ભાષ્યાનું કહે છે, તેઓ પણ અર્થચિંતનની બાબતમાં ઘણા પછાત જણાય છે. આવા વિદ્યાર્થીઓને એક વાર એમ કહેવામાં આવ્યું હતું કે ‘લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથામાં વિશેષ્ય અને વિશેષણાં પદો જુદાં કરી બતાવો’ ત્યારે તેમાં ગરબડ થઈ હતી. ફરી તેમને આ ગાથામાં વપરાયેલાં ચાર વિશેષણોની સંગતિ કરવાનું જરૂર્યાંથું, ત્યારે બધા એક બીજાનાં મોઢાં સામું તાકી રહ્યા હતા અને એક બે હોશિયાર વિદ્યાર્થીએ બુદ્ધિ વાપરી તેનો જવાબ આપવા પ્રયત્ન કર્યો હતો પણ તેમણે આ વસ્તુ પર વ્યવસ્થિત ચિંતન કરેલું નહિ હોવાથી એ જવાબો સંતોષકારક નીવડ્યા ન હતા. જો તેમણે વ્યવસ્થિત ચિંતન કર્યું હોતો તો તેઓ જરૂર કહી શકત કે આ ચાર વિશેષણો ચાર મૂળ અતિશયોને સૂચવનારાં છે. ‘લોગસ્સ ઉજ્જોઅરો’ એ પદથી જ્ઞાનાત્િશય સૂચવાયો છે, ‘ધર્મ તિત્થયરે’ એ પદથી ધર્મતીર્થની સ્થાપના અને તે દ્વારા વચ્ચાત્િશય સૂચવાયો છે, ‘જિણે’ પદથી અંતર અને બાહ્ય અપાયોનો અપગમ સૂચવાયો છે અને ‘અરિહંતે’ પદથી ત્રિલોકની પૂજારૂપ પૂજાતીશય સૂચવાયો છે.

જેમ ગાય, બેંસ વગેરે પશુઓ એક વાર ચરી ગયેલું નિરાંતે વાગોળે છે, ત્યારે જ તેમને ઘાસનો સાચો સ્વાદ આવે છે, તેમ સાંભળેલાં શાસ્ત્ર વચ્ચાનો પર નિરાંતે ચિંતન-મનન કરવામાં આવે તો જ તેનો વાસ્તવિક તાત્પર્ય-અર્થ સમજાય છે અને તેથી આપણાને ઘણો આનંદ ઉપજે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખમૂત”

વર્ષ-૧૦, અંક-૨૭, તા. ૨૪-૩-૧૯૬૨

(૫૧) (લેખાંક-ત્રીજો)

સદ્ગુરુનાં મુખેથી સાંભળેલાં શાસ્ત્રવચ્ચાનો પર વારંવાર ચિંતન-મનન કરવું, એકધારું ચિંતન કરવું કે અતિસૂક્ષ્મ ચિંતન કરવું, તેને નિદિધ્યાસન કે અનુપ્રેક્ષા કહેવામાં આવે છે, તેનાથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે, અર્થાત્ પરમાર્થ સુધી પહોંચી શકાય છે.

જૈન શાસ્ત્રોમાં સ્વાધ્યાયના પાંચ પ્રકારો દર્શાવેલાં છે, તેમાં વાચના, પૃથ્ઘના અને પરાવર્તના પછી અનુપ્રેક્ષાને મૂકવામાં આવી છે. તે એમ બતાવે છે કે ઉપાધ્યાય અથવા વિદ્યાગુરુ પાસેથી સૂત્રાર્થ યથાર્થ ગ્રહણ થયા બાદ તેના પર વારંવાર ચિંતન-મનન કરવું જોઈએ. આ રીતે સૂત્રાર્થ પર ચિંતન-મનન કરવામાં આવે તો જ જ્ઞાનાવરાઙ્ગીય કર્મનો ક્ષય થાય અર્થાત્ અજ્ઞાનનો પડદો ઉંચકાય અને પ્રજ્ઞાનો પ્રકાશ જગહળવા લાગે.

અનુપ્રેક્ષાને એક પ્રકારની યોગ ભૂમિકા કહીએ તો પણ ખોટું નથી, કારણ કે તેમાં મનને અંકુશમાં રાખી એક જ વિષય તરફ દોરવાનું હોય છે. અણાંગયોગમાં છુંં અંગ ધારણાનું છે, તેની અને અનુપ્રેક્ષાની ભૂમીકા લગભગ સમાન છે. ધારણા સિદ્ધ થયે ધ્યાન સિદ્ધ થાય છે, તેમ અનુપ્રેક્ષા સિદ્ધ થયે ધ્યાન સિદ્ધ થાય છે. અને તે જ કારણે પ્રાચીન કાળમાં નિર્ગંધ મુનિવરો કાયોત્સર્ગનું આલંબન લઈ કોઈ પણ એક સૂત્ર પર અનુપ્રેક્ષા કરતા, અને કમે કમે ધ્યાનાવસ્થામાં આરૂઢ થઈ જતા.

શ્રી જિનભદ્ર ગણી ક્ષમાશ્રમણે ધ્યાન શતકમાં મનની ત્રાણ અવસ્થાઓ બતાવી છે. (૧) ચિત્ત, (૨) ભાવના કે અનુપ્રેક્ષા અને (૩) ધ્યાન. તેમાં મનનું યત્ર તત્ત્વ ભમવું અર્થાત્ પ્રક્રિયા વિચારો કરવા એ ‘ચિત્ત’ની અવસ્થા છે, કોઈ એક જ વિષય પર ધારાબદ્ધ વિચાર કરવો તે ભાવના કે અનુપ્રેક્ષાની અવસ્થા છે, અને એક જ વિષય પર એકાગ્ર થઈ જવું એ ધ્યાનની અવસ્થા છે. એટલે અનુપ્રેક્ષા એ ધ્યાનની પૂર્વભૂમિકા છે, એ નિશ્ચિત છે.

જેમ ધારણા સુધી પહોંચેવા માટે યત્ત, નિયમ, આસન, પ્રાણાયામ અને

પ્રત્યાહાર જરૂરી છે, તેમ અનુપ્રેક્ષા સુધી પહોંચવા માટે શ્રદ્ધા, મેધા, ધૂતિ અને ધારણા જરૂરી છે, શ્રદ્ધા એટલે દેવ-ગુરુ-ધર્મ પરની દઢ શ્રદ્ધા અથવા અનન્ય આત્મવિશ્વાસ. મેધા એટલે નિર્મળ બુદ્ધિ. ધૂતિ એટલે ચિત્તની સ્વસ્થતા અને ધારણા એટલે ચિત્તવૃત્તિઓનું એક જ પદાર્થ તરફ વહેવું. આ બધી વસ્તુઓ કમશઃ પ્રાપ્ત થાય છે, એટલે કે શ્રદ્ધાનું પ્રમાણ વધતા નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થતાં ચિત્તમાં સ્વસ્થતા આવે છે, અને ચિત્તમાં સ્વસ્થતા આવે છે એટલે મનની વૃત્તિઓ એક જ પદાર્થ તરફ વહેવા લાગે છે. જ્યાં મનની વૃત્તિઓ એકજ પદાર્થ પર વહેવા લાગી એટલે અનુપ્રેક્ષા સિદ્ધ થાય છે અને અનુપ્રેક્ષા સિદ્ધ થઈ કે ધર્મધ્યાન તથા શુક્લધ્યાન પર શીધ આરોહણ કરી કર્મકટકનો નાશ કરી શકાય છે.

આજે તો તાત્ત્વિક પદાર્થો પરનું ચિંતન-મનન જ ઓછું થઈ ગયું છે, ત્યાં નિહિદ્ધાસનની વાત ક્યાં કરીએ ? પણ આ બંને વસ્તુ આપણાં જીવનમાં ફરી દાખલ કરવાની જરૂર છે. જો એ દાખલ થશે તો જ આપણે નિર્ગ્રથ પ્રવચનરૂપી મહાન જ્ઞાનાનો લાભ લઈ શકશું અને સિદ્ધિસાધના કરવામાં સમર્થ થઈશું.

U નિર્દોષ ગોચરી કાજે V

કલકતા તરફનો વિહાર હોય કે કોઈમબતુર તરફનો, પૂજ્યશ્રી બધે નિર્દોષ ગોચરીના જ આગાહી હતા. દક્ષિણા વિહારોમાં ૧૦૦-૧૫૦ કિ.મી. સુધી જેનોનાં ઘર ન મળે તો, કણ્ણટક અને તામિલનાડુમાં લિંગાયત વગેરેનાં ઘરોમાંથી વહીરેલા જાડા ભાતા, જાડા રોટલા, ગોળ આદિથી ચલાવી લેતા. નવલગુંડથી ૧૨ કિ.મી.નો વિહાર કરી અમે એક સ્થાનમાં રોકાયા, ત્યાં માત્ર થોડાં ઝૂંપડાં હતાં. ગોચરી પાણી નરગુંડથી શ્રાવકો લઈને આવવાના હતા. પૂજ્યશ્રીને ખબર પડી કે જ કિ.મી. પર એક મોટું ગામ છે ત્યાં લિંગાયત, દિગંબર આદિનાં ઘરો છે. તેઓશ્રી તો ત્યાં પહોંચી જવા દાંડો લઈને વિહાર કરવા માંડયાં, જેથી નિર્દોષ ગોચરી મળી જાય. બધાનાં ખૂબ દબાણને કારણે એક ફર્લાંગથી આગળ ન જઈ શક્યા. પણ ખાખરો અને ગોળ જેવા એક-બે સૂકાં ક્રવ્યો વાપરીને જ ચલાવી લીધું.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્ખ

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૦૭-૧૦, અંક-૨૮, તા. ૭-૪-૧૯૬૨

૫૮ સર્વ ધર્મ સમભાવ અંગે કેટલીક વિચારણા

(લેખાંક-પહેલો)

હાલમાં ઘણા રાષ્ટ્રનેતાઓ, લેખકો, પત્રકારો તથા સમાજસેવકો ‘સર્વ ધર્મસમભાવ’ શબ્દનો ધૂટથી ઉપયોગ કરી રહ્યા છે અને તે ઉદારચિત્ત કે વિશાળ ભાવનાનું પરિણામ હોય એવો દેખાવ થઈ રહ્યો છે. આ વર્ગની પાસે પ્રચારનાં વિપુલ સાધનો હોવાથી તેનું પ્રતિપાલન વિધવિધ રીતે થવા લાગ્યું છે અને તેથી સમાજનો કેટલોક વર્ગ એમ માનવા લાગ્યો છે કે ‘આપણે સર્વ ધર્મને સારા માનવા, કોઈને ખોટો કે ઉત્તરતો માનવો નહિ.’ આ વસ્તુસ્થિતિ ગંભીર વિચારણા માગે છે અને તેથી જ તે અંગે અહીં કેટલોક પરામર્શ કરવામાં આવ્યો છે.

પ્રથમ તો એ જ્ઞાનવાની જરૂર છે કે પ્રાચીનકાળમાં ધર્મ સંબંધી-ધર્મના સ્વરૂપ સંબંધી ઘણા વાદ-વિવાદો થયા હતા. તેનાં પરિણામે વિદ્વાનોએ એ વાત નક્કી કરી કે ધર્મ ગમે તે નામ ધારણ કરીને આપણી સામે આવ્યો હોય, તો પણ તેની કસોટી-પરીક્ષા કરવી, કારણ કે પરીક્ષિત વસ્તુ જ ઉપયોગી-હિતકર નીવડે છે. તેમણે કોઈ પણ ધર્મની કસોટી-પરીક્ષા કરવા માટે ચાર વસ્તુ નક્કી કરી હતી. (૧) પ્રથમ તો તે કેવાં શાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે તે જોવું. (૨) તેમાં કેવા શીલનો ઉપદેશ અપાયો છે તે જોવું. (૩) તેમાં તપશ્ચર્યા પર કેટલો ભાર મુક્યો છે તે જોવું અને (૪) તેમાં અહિસા-ક્ષમાદિ ગુણોનું કેવું પ્રતિપાદન કરાયું છે તે જોવું.

શાસ્ત્રોની પરીક્ષા સંબંધી તેમણે એ ધોરણ બાંધું હતું કે જે શાસ્ત્રો સર્વજ્ઞનાં રચેલા હોય તે પૂર્વાપર વિરોધી રહિત હોય છે, માટે તેમને પ્રમાણિક માનવા. એક સ્થળે એક વાત, ને બીજા સ્થળે એને અસંગત બીજી વાત હોય તે મનુષ્યને પ્રતીતિ ઉપજાવી શકતી નથી. અસર્વજ્ઞે-ધ્યાને આપમતિએ રચેલા શાસ્ત્રો પ્રાય: આવાં જ હોય છે, તેથી તેમને પૂરેપૂરા વિશ્વસનીય ગણી શકાય નહિ. તાત્પર્ય કે જે ધર્મ સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોને માનતો હોય તે જ ઉત્તમ ગણાય એથી સહજે બીજી ધર્મો તેનાથી ઉત્તરતી કક્ષાના સિદ્ધ થાય છે.

શીલની પરીક્ષા સંબંધી તેમણે એવું ધોરણ બાંધું હતું કે જે ધર્મ વિશુદ્ધ ચારિત્ર ઉપર ખૂબ ભાર મૂકતો હોય અને તે અંગેના નિયમોનું પાલન ખૂબ દેઢતાથી કરવાનો આગ્રહ સેવતો હોય, તેને જ ઉત્તમ માનવો, અને બીજા અપૂર્ણ ચારિત્ર

નિયમને માનનારને ઉત્તરતી કોટિના માનવા. તેમાં જે ધર્મ દુરાચારને મંજૂર રાખતો હોય અને તેના સેવનથી કલ્યાણ બતાવતો હોય તેને અધમ કોટિનો માનવો અને તેનાથી ચેતતા રહેવું.

તપની પરીક્ષા સંબંધી તેમણે એવું ધોરણ બાંધું હતું કે જીવનશુદ્ધિ માટે બાધ્ય અને અભ્યંતર એ બંને પ્રકારનાં તપો જરૂરી છે, તેથી જેઓ આ બંને પ્રકારની હિમાયત કરતા હોય તેને ઉત્તમ ધર્મ માનવો અને જેઓ માત્ર બાધ્ય તપ ઉપર કે માત્ર અભ્યંતર તપ ઉપર ભાર મૂકતા હોય તેને ઉત્તરતી કોટિના માનવા. વળી જે ધર્મ તપ પર બિલકુલ ભાર જ મૂકતો ન હોય અને માલમલીદા ઝાપટવા છીંતાં આત્મકલ્યાણ થઈ શકે છે, એવું પ્રતિપાદન કરતો હોય તેને અધમ સમજ તેનાથી દૂર રહેવું.

અહિસાદિ ગુણોની પરીક્ષા માટે તેમણે એવું ધોરણ બાંધું હતું કે જે ધર્મ અહિસાને ખૂબ મહત્વ આપતો હોય અને તેને જીવનવ્યાપી બનાવવાની આજ્ઞા કરતો હોય, તેમજ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહને પણ જીવનવિકાસ માટે અતિ ઉપયોગી માની તેની હિમાયત કરતો હોય તેને ઉત્તમ માનવો. અને જેઓ આ ગુણોને સામાન્ય મહત્વ આપતા હોય કે તેના પ્રત્યે ઉપેક્ષા કરતા હોય તેને કનિષ્ઠ કોટિના સમજવા અને નવગજના નમસ્કાર કરવા.

ધર્મની પરીક્ષા કરવાની ના પાડવી કે તેના ગુણ-દોષ સમજવાનો ઈન્કાર કરવો એ આપણને પ્રાપ્ત થયેલી બુદ્ધિનું-વિવેકશક્તિનું અપમાન કરવા બરાબર છે. તેમાંએ જે મનુષ્યો ઉદાર ચિત્ત હોવાનો, વિશાળ માનસ હોવાનો કે કાંતિકારી વલણનો દાવો કરે છે, તેનાથી તો કોઈ પણ વસ્તુના ગુણદોષ જોવાનો ઈન્કાર કરી કેમ શકાય ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૨૮, તા. ૧૪-૪-૧૯૬૨

(૫૩) (લેખાંક-બીજો)

આપણે બુદ્ધિમાન પુરુષ તો તેને જ કહીએ છીકે કે જે સારા-ખોટાનો વિવેક કરી શકે. તે માટે આપણે ત્યાં હંસનું ઉદાહરણ અપાય છે. જેમ હંસ ભેગાં થઈ ગયેલાં દૂધ અને પાણીને છૂટાં પાડે છે, તેમ બુદ્ધિમાન-વિવેકી પુરુષે સાચા અને ખોટાને જુદાં પાડવા જોઈએ, તેનો વિવેક કરવો જોઈએ.

જેઓ ગોળ અને ખોળને સરખાં માને છે, સોના અને પિતળને સમાન લેખે છે કે હીરા અને પોખરાજના ભાવમાં કઈ તફાવત કરતા નથી, તેને આપણે

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૧૦૫

ઉદારચિત કે વિશાળ ભાવનાવાળો કહેતા નથી, પણ મૂર્ખ કે બેવકૂફ કહીએ છીએ. એક રાજાને એમ લાગ્યું કે બધી વસ્તુનાં જુદાં મૂલ્ય શા માટે હોવાં જોઈએ ? બધી વસ્તુઓ એક સરખાં મૂલ્યથી વેચાય તેજ ઈષ છે અને તેણે એ પ્રકારનો હુકમ બહાર પાડ્યો. તેનાં નગરમાં ખાજાં અને ભાજી એક ભાવે વેચાવાં લાગ્યાં. આથી તેનું નગર અંધેરી નગરી તરીકે અને તે પોતે ગંધુ તરીકે પ્રસિદ્ધ થયો. તાત્પર્ય કે વસ્તુ જે પ્રકારની હોય તે પ્રકારનું જ તેનું મૂલ્ય અંકાવું જોઈએ અને તેમાં જ ડાપણ મનાવું જોઈએ.

સારાને ખોટું માનવું કે ખોટાને સારું માનવું કે સારા-ખોટાનો વિવેક કરવાનો ઈન્કાર કરવો એ ત્રણેય માનસિક દોષો છે અને તે સત્યની પ્રાપ્તિમાં મહાન અંતરાય ઊભો કરે છે, તેથી જ શાસ્ત્રકારોએ તેની ગણના મિથ્યાજ્ઞાનમાં-મિથ્યાત્વમાં કરેલી છે.

એક માણસને અ નામનાં શહેરમાં જવું છે. તે એ શહેર ભાડી પ્રયાણ કરે છે. હવે રસ્તામાં ચાર માર્ગો ફાંટે છે. તો તેણે બધા માર્ગોને સમાન માનીને ગમે તે માર્ગ જવું કે તેમાંના સત્ય માર્ગનો નિર્ણય કરીને આગળ વધવું ? બહુ સમજવા જેવી વાત છે. બધાં માર્ગોને સમાન માની ગમે તે માર્ગ જવાથી આપણું ધ્યેય સિદ્ધ થતું નથી, પણ સત્ય માર્ગને શોધી, તેને અનુસરવાથી જ આપણું ધ્યેય સિદ્ધ થાય છે.

ધર્મ એટલે મુક્તિ, મોક્ષ, શ્રેયસ્, સિદ્ધિ, નિર્વાણ કે પરમપદને પામવાનો માર્ગ. તેમાં અનેક ફાંટા જોવામાં આવે તો કયો ફાંટો સાચો છે, તેનો નિર્ણય કરવો જ જોઈએ, અન્યથા મુક્તિ, મોક્ષ શ્રેયસ્, સિદ્ધિ નિર્વાણ કે પરમપદને કઢી પણ પામી શકાય નહિ.

સર્વધમને સરખા માનવાનું એક અનિષ્ટ પરિણામ એ આવે છે કે તેને કોઈ પણ ધર્મ પ્રત્યે આગ્રહ રહેતો નથી, એટલે તે કોઈ પણ ધર્મનું અનુસરણ કરતો નથી અને પ્રાય: ધર્મહીન અવસ્થામાં જ પોતાનું જીવન વ્યતીત કરે છે. તાત્પર્ય કે જે ભવમાં ધર્મનું આરાધન કરીને આત્માના અભ્યુદ્યની સિદ્ધિ કરવાની મહાન તક રહેલી છે, તેને એ ગુમાવી દે છે અને તેથી તેનું જીવન કરુણ નિષ્ઠળતામાં પરિણામે છે. શું આપણે આવી સ્થિતિ ઈચ્છાએ છીએ ખરા ?

જો એનો જવાબ નકારમાં હોય-હોવો જ જોઈએ-તો આપણું એ કર્તવ્ય છે કે ધર્મોની પરીક્ષા કરવી. તેમાં જે ધર્મ સત્ય જ્ઞાન તેને આચરવો અને આપણાં જીવનને ધર્મપરાયણ બનાવી મોક્ષ પ્રાપ્ત આગળ વધવું.

જૈન ધર્મ તો સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી આત્માને સત્યની રૂચિ ન થાય,

૧૦૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

સત્યનો આગ્રહ ન બંધાય, ત્યાં સુધી તેના આધ્યાત્મિક વિકાસના મંડાણ થતાં નથી. જ્યારે આત્માને સત્યની રુચિ થાય છે, સત્યનો આગ્રહ બંધાય છે, ત્યારે તે સાચાં તારક તત્ત્વો કયાં ? તેની શોધ કરે છે અને એ તત્ત્વો મળી આવતાં તેના આનંદનો પાર રહેતો નથી. એ સત્ય તારક તત્ત્વોને સમર્પિત થઈ જાય છે અને તેથી તેનો ઉદ્ઘાર ધણો નજીક આવે છે.

આપણે કોઈ પણ ધર્મનો તિરસ્કાર ન કરીએ, પણ તે કેટલા અંશો સાચો છે, તેની પરીક્ષા તો જરૂર કરીએ.

અમને આશા છે કે આટલાં વિવેચનથી સર્વધર્મ સમભાવના સિદ્ધાંતમાં રહેલી પોકળતા સમજાઈ જશે.

વાત્સલ્યસાભર પૈયાવરચ્ચ

જેઠ મહિનો, અંધેરીથી મલાડ તરફ વિહાર. પૂજ્યશ્રી સાચો એક નૂતનદીક્ષિત બાલમુનિ માંડ માંડ ચાલતા હતા. ખૂબ નાજુક શરીર, પગે પડેલા ઊરડા, દદ થાય પણ બાલમુનિ બોલે નહિ. પૂજ્યશ્રી પારખી ગયા. રોડ ઉપર બાજુમાં ફૂટપાથ ઉપર બેસી ગયા. એક કપડાંનો લાંબો ટુકડો ફાડીને પાટો જાતે બનાવ્યો. દફ્તરમાંથી દવા-મલમ કાઢીને પગના તળીયે લગાડ્યો, ૩ મૂક્યું. પાટો બરાબર બાંધ્યો બાળમુનિ ઝુશ થઈ ગયા.

રસ્તા વચ્ચે આ રીતે બાળમુનિની વૈયાવરચ્ચ કરવામાં પૂજ્યશ્રીને શરમ નર્ડી નહીં. બાળમુનિઓના ઘડતર માટે અવસરે કઠોર પણ થયા છે તો મુલાયમ રહીને અપાર વાત્સલ્ય પણ ખૂબ પાયું છે.

"-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારાં

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૩૦, તા. ૨૧-૪-૧૯૬૨

૫૪ પ્રાથમિક શિક્ષણાની જરૂર

શાસ્ત્રકારો ધર્મના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, એમ બે રીતે વિભાગ બતાવી ધર્મનું વર્ણન કરે છે. એ સૂચવે છે કે પ્રથમ ભૂમિકાનો ધર્મ સામાન્ય ધર્મ છે, ને એ પ્રાથમિક ભૂમિકાના સામાન્ય ધર્મની જીવનમાં ઘડી ઉપયોગિતા છે.

સામાન્ય ધર્મ તરીકે માર્ગનુસારીતાના પાંત્રીસ ગુણો લેવામાં આવ્યા છે. એમાં ન્યાયસંપન્ન વિભવ, આયોચિત વ્યય, માતાપિતાની પૂજા, પરોપકાર વગેરે ગૃહસ્થ જીવનને શોભાવનારા અનેક ગુણો, કર્તવ્યો, વિશેષ સાધના અને દોષત્યાગને સંગૃહીત કરવામાં આવ્યા છે. પ્રાથમિક ભૂમિકાનો ગૃહસ્થ પણ આ સામાન્ય ધર્મને સાધી શકે એવી એમાં સરળતા છે.

જીવનમાં આ માર્ગનુસારી ગુણોનું પાલન જીવનને એક નવી તાજગી આપે છે. જીવનમાં અપૂર્વ સુખ શાંતિનો અનુભવ કરાવે છે, અને જીવનના ઠેઠ અંત સુધી માનસિક બાદશાહીમાં જીલાવે છે.

આ સંબંધમાં એક દાખલો યાદ આવે છે. અમને એક ભાઈએ વાત કરી કે અમે સમેતશિખરજીની સ્પેશ્યલ લઈને ગયેલા. વચ્ચે એક જંકશન સ્ટેશન બીજી ગાડીઓની કોઈ અનિયમિતતા થઈ જવાથી અમારી ગાડીને રોકાઈ જવાનો પ્રસંગ આવ્યો. પરંતુ તેથી અમારા આગળના નક્કી થયેલા કાર્યક્રમમાં ફેરફાર થઈ જવાથી આગળની યોજનામાં ખમણું પડે એવી સ્થિતિ ઊભી થઈ. એટલે હું મુખ્ય સ્ટેશન માસ્તર પાસે પહોંચી ગયો. વિનંતી કરી ત્યારે એ કહે કે આજની અમારી પરિસ્થિતિમાં તમારી ગાડીને વહેલી જવા દેવાય એમ નથી.

મેં અમારી મુશીબત સમજાવી ત્યારે માસ્તરે સહદ્યતાથી અમારી ગાડી સમયસર ઉપાડવાની સગવડ કરી આપી. ત્યારબાદ પછીથી હું ફળ-મિઠાઈ વગેરે લઈ માસ્તરના ઘરે ગયો એમનો ખૂબ આભાર માની મેં એ કર્દીયો અને સારી રકમ ધરવા માંડી.

માસ્તર કહે, ‘શું છે આ ?’

મેં કહ્યું કાંઈ નહિ સાહેબ ! આ તો છોકરાઓને જરા મોહું મીહું કરાવવા લાયો છું !

સ્ટેશન માસ્તર કહે ‘એ વાત બોલશો નહિ. લઈ જાઓ પાછું.’

મેં કહું, ‘પણ સાહેબ ! આ કાઈ લાંચ નથી. કામ તો આપે પહેલાં જ કરી આખ્યું છે, આ તો ભાઈ ભાઈનો વહેવાર છે.’

માસ્તર કહે ‘તમને ખબર નથી. હું અહીં વર્ષાથી નોકરી કરું છું. પણ જીવનમાં એક પાઈની લાંચ લીધી નથી. મારા ગોઠિયા કહે ‘માસ્તર ! અવસર ઓળખો. તમે ક્યાં માગો છો ? સામો ખુશીથી આપવા આવે છે, તો લઈ લેવા.’ પણ હું કહેતો કે અન્યાયનો એક પૈસો મને ન બપે. એમ લઉં તો ભગવાનનો ચોર થાઉં. આવા ઉત્તમ મનુષ્ય અવતારમાં આ પાપ ? છદ્ર નહિ જોઈએ, પૈસાની શી કિંમત છે ? કિંમત ન્યાય-નીતિની છે, મારી હરોળના કઈ લાંચો ખાઈ તગડા બનવા ગયા પણ કુદરત ક્યાં સાંચે છે ? બીજે રસ્તે એ બિયારાને દુબળા કરી નાખ્યા. હું મસ્તીથી જીવું છું.

ભાઈ અમને કહે કે હું દિંગ થઈ ગયો.

આ તો એક ગુણ-ન્યાયસંપન્નની વાત થઈ. તો પાંત્રીસે ગુણની શી વાત ?

સંસ્કારી જીવન માટે આ પાંત્રીસ ગુણોના ગ્રાથમિક શિક્ષણની જરૂર છે, કેમ કે અસંસ્કારી માણસો બાળક જેવા છે. એ વાત વાતમાં બાંધો ચઢાવે છે, કલેશ કંકાસ કરવામાં મગરૂબી માને છે. તેઓ ડગલે ને પગલે જૂહુ બોલે છે, પછી કોઈ સ્વાર્થ સધાતો હોય કે ન સધાતો હોય. તેઓ કોઈના પર આશેપો કરતા કે ગમે તેવું આળ મૂકતા અચકાતા નથી. ઘન કમાવું અને તે ગમે તે રીતે કમાવું એ તેમનો મુદ્રાલેખ હોય છે અને તે માટે તેઓ ગમે તેવું કૂડકપટ કરે છે, તેમને આરંભમાં આનંદ આવે છે, પરિગ્રહથી પ્રમોદ ઉપજે છે અને માનેલી મોટાઈ મળતાં ફૂલશાળ થઈને ફરે છે. તેમની કામવાસનાને આરો નથી જ્યાં સુંદરરૂપ જોયું, થોડી ટાપટીપ જોઈ કે થોડો હાવભાવ જોયો ત્યાં તેમની મનોવૃત્તિ ઉશ્કેરાય છે, અને તેને ટૃપ્ત કરવા માટે ગમે તેવો અનર્થ કરવા ચુકતા નથી. આવાઓને માર્ગનુસારિતાના સંસ્કરણની જરૂર છે.

નિર્ગ્રથ મહર્ષિઓએ ધર્મરાધનની ચાર ભૂમિકાઓ બતાવી છે :

- (૧) માર્ગનુસરણ અથવા નીતિમય જીવન.
- (૨) સમ્યગદાસ્તિનું જીવન.
- (૩) દેશવિરતિ અથવા શ્રાવકધર્મ.
- (૪) સર્વવિરતિ અથવા સાધુધર્મ.

આનો અર્થ એમ સમજવાનો કે માર્ગનુસરણ અથવા નીતિમય જીવન એ ધર્મનું ગ્રાથમિક શિક્ષણ છે અને તેથી ધાર્મિક ક્ષેત્રમાં આગળ વધારવા માટે એ શિક્ષણ બરાબર આપવાની જરૂર છે, કેમ કે જો માર્ગનુસારી ગુણોનું ઠેકાળું નથી

તો ધાર્મિક જીવનમાં જે ઉજજવલતા દેખાવી જોઈએ તે દેખાતી નથી.

આજે પ્રજાનું નૈતિક ધોરણ ઘણું નીચું ઉતરી ગયું છે, તે જોતાં પણ અમને એમ કહેવાનું મન થઈ આવે કે કમમાં કમ જૈનોને એમાંથી બચાવી લેવા માટે માર્ગનુસારી ગુણોના શિક્ષણની બહુ જરૂર છે.

U

અદ્ભુત શ્રમણ ધડતર

V

એક વાર મેં પૂજ્યપાદશ્રીને પૂછ્યું : “હે ગુરુદેવ ! આજ કાલ દેવો પૃથ્વીતલ પર કેમ નથી આવતાં ?” એક સિમત વેરીને પૂજ્યપાદશ્રીએ મારા પ્રશ્નનું સુરસુરિયું કરી નાખ્યું.

હવે, બે દિવસ પછીનો એક પ્રસંગ. પાણી ગાળીને મેં ગળણું દોરી પર સૂકવ્યું. ઘડા બરાબર ઢાંકયા, પરાતો ભીતનો અઢેલીને મૂકી. હોલમાં વચ્ચે પાટ પર બોઢેલા પૂજ્યપાદશ્રી આ બધું જોઈ રહ્યા હતા. તેઓશ્રીએ ઈશારાથી મને બોલાવ્યો. મને કહ્યું : “બે દિવસ પહેલાં તું જ પૂછતો હતો ને કે દેવો કેમ નથી આવતા ?” મેં કહ્યું : “હા જી.” “પાડ માન દેવોનો કે નથી આવતા. સાધુઓનું ઔડિટિંગ કરવા અહીં આવતા હોત તો તારો આ ઓધો જ લઈ લેત. તો અત્યારે ભીતને અઢેલીને જમીન પર પરાત મૂકી તે પહેલાં ભીત ઉપર અને જમીન ઉપર આ ઓધાથી પૂંજ્યું હતું ? પૂંજવાના અનુપયોગથી કેવી જીવ વિરાધના થઈ જાય ? ઓધો બગાલમાં રાખી મૂકવા માટે સ્વજનાઓએ વહોરાવ્યો છે ?”

બે દિવસ પહેલાના મારા પ્રશ્ન સાથે સંબંધ જોડીને મારી આજની ભૂલનું સંમાર્જન કરવાની પૂજ્યપાદશ્રીની કુશળતા પર હું તો વારી ગયો.

W X
—“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

૧૧૦

૫૫ માતાપિતાની સેવાભક્તિ

જૈન ધર્મે ભારતવર્ષની પ્રજાને નીતિના સુંદર પાઠો પડાવ્યા છે. તેમાંનો એક પાઠ એ છે કે ‘તથા માતાપિતૃપૂજેતિ-માતા પિતાની પૂજા કરવી.’ અહીં પૂજા શબ્દથી વિનય, સેવાભક્તિ અને બહુમાન અભિપ્રેત છે.

માતાપિતાની સેવાભક્તિ શા માટે કરવી ? તેનો ઉત્તર એ છે કે ‘તેમનો ઉપકાર આપણા ઉપર ધણો મોટો હોય છે. બાલ્યાવસ્થામાં જ્યારે આપણે લગભગ મૂઢ જેવા હોઈએ છીએ, ત્યારે તેઓ આપણે સારસંભાળ લે છે અને અનેક પ્રકારનાં કણો ઉઠાવીને પણ આપણાને ઉછેરે છે. પછી આપણાને ભણાવે-ગણાવે છે, ધંધે લગાડે છે, આપણામાં સદાચારોનું સંસ્કરણ કરે છે, વળી આપણાં ક્ષેમકુશળની ચિંતા તેમનાં હૈએ હરદમ હોય છે, તેથી આપણે તેમની સેવાભક્તિ કરવી જોઈએ.’

માતાપિતાની સેવાભક્તિ કેવી રીતે કરવી ? તેનું વર્ણન કરતાં જૈન શાસ્ત્રોએ જણાવ્યું છે કે ‘નવાં ફૂલ, નવાં ફળ કે સુંદર વસ્ત્રાભૂપ્રણ માતાપિતાને ભેટ ધરવાં; તેમને જોઈતી તમામ વસ્તુઓ લાવી આપવી; તેમને જમાડીને જ જમુંબું; ધર્મકર્મની તેમને અનુકૂળતા કરી આપવી, વૃદ્ધાવસ્થામાં તેમની પૂરેપૂરી કાળજી રાખવી. અને તેમને પવિત્ર તીર્થોની યાત્રા કરાવવી...’ વગેરે.

અહીં એ સ્પષ્ટતા કરવાની જરૂર છે કે સંસાર વ્યવહારની સર્વ પ્રવૃત્તિ માતાપિતાની આજ્ઞા પ્રમાણે કરવાથી આપણો વિનય નામનો મૂળગુણ સચ્ચાય છે, તેમની મુરબ્બી વટ જળવાઈ રહે છે, તેમને સંતોષની લાગણીનો અનુભવ થાય છે અને તેથી એ આપણી સર્વ પ્રવૃત્તિઓમાં સફલતાનું ચિંતન કરવારૂપે આશીર્વદ વરસાવે છે.

‘માબાપ તો હવે ઘરડા થયા !’ ‘તેઓ આપણી વાતમાં શું સમજે ?’ ‘તેઓ આપણા જેટલું ક્યાં ભણ્યા છે ?’ ‘બિચારાં ભલાભોગાં છે’ વગેરે વચ્ચન પ્રયોગો વિનીત પુત્ર-પુનીઓનાં મુખમાં જરા પણ શોભતા નથી. તેના બદલે એમ વિચારનું ઘટે કે ‘માબાપ અનુભવી છે’ ‘તેઓ આપણા કરતાં વધારે સમજે છે.’ ‘તેઓ ભણ્યા છે ઓછું, પણ ગજ્યા છે વધારે.’ ‘તેઓ જે કંઈ કહેતા હશે તે આપણાં હિતની ખાતર જ કહેતાં હશે.’ ‘તેઓ આપણા મહા ઉપકારી છે...વગેરે.’

અનુભવીઓની એ ઉદ્ઘોષણા છે કે જ્યાં માતાપિતાની મુરબ્બીવટ જળવાતી

નથી કે તેમની સાચી સલાહને તરછોડવામાં આવે છે, ત્યાં શ્રી અને સૌભાગ્ય કદી પણ રહી શકતાં નથી.’

પરંતુ આજે ઉછર્તૃ પ્રજાનો વરીલો પ્રત્યેનો વિનય ધટ્ટો છે અને માબાપ પ્રત્યેની સેવા ભક્તિમાં મોટી ઓટ આવી છે. માતાપિતાને ત્રણ વાર પ્રણામ કરવાનું તો દૂર રહ્યું, પણ તેમને સામા ઉત્તરો આપવામાં આવે છે અને ‘તમારા કરતાં અમને વધારે સમજણ પડે છે’ એમ કહીને તેમને તરછોડવામાં આવે છે. યુવાન પુત્ર પત્નીના પ્રેમમાં પાગલ બને છે અને તેની દોરવણી મુજબ, યા તેની સ્વચ્છંદતા ખાતર ટૂંક સમયમાં જૂદું ધર માંડીને માતાપિતાની સેવાને બલા સમજ એ બલા (?)માંથી મુક્ત થાય છે. માતા બિમાર હોય કે પિતા પથારીવશ હોય, ત્યારે તેમને વૈદ્ય-ડોક્ટરોને ભળાવી દેવામાં આવે છે અને તેમનું બીલ ચૂક્યાથી સેવા કર્યાનો સંતોષ માનવામાં આવે છે, પણ જે રીતે પોતાની સગીર વયમાં માતાપિતાએ સ્વકાયાને કસીને, મનમાં ઉત્સાહ લાવીને સેવા કરી હતી તે રીતે હવે પોતે બિમાર માબાપની સેવામાં નિરંતર હાજર રહેવાનું ભાગ્યે જ જોવામાં આવે છે ! કેટલાક બલાદુર બેટાઓ માતાપિતા પાસે પણ પોતાનું કામ કરાવવા ચૂક્યા નથી ! અગર માબાપને સોંપાયેલું કામ બરાબર ન થયું કે ઓછું ઉત્ત્યુ તો તેમની પૂરેપૂરી ખબર લઈ નાખે છે ! કેટલાક માતાપિતાને માંડ માંડ રોટલો ખવડાવે છે, પણ સાથે કેટલાય ટોણાં-મેણાં મારે છે, ત્યારે કોક વળી તેમને ધરમાંથી બહાર કાઢી અશક્તાશ્રમમાં રહેવાની ફરજ પાડે છે. જ્યાં માબાપો પ્રત્યેનું વર્તન આવું કૂતધન હોય, ત્યાં સુખ અને શાંતિ ક્યાંથી અનુભવાય ? ત્યાં ઉન્તિ અને પ્રગતિ ક્યાંથી આવે ? ત્યાં વિજય અને સફળતાની આશા કેવી રીતે રખાય ?

તાત્પર્ય કે માતાપિતાની સેવાભક્તિ કરવાનો પ્રાચીન શિષ્ટાચાર પુનઃ વેગ પ્રાપ્ત કરે, એ આજના કાળે અત્યંત જરૂરી છે.

૫૬ કેટલીક મનનીય વિચારણા

ગત તા. ૨૮ અને ૨૯ મી એપ્રિલે મળેલા ભારતીય જૈન સ્વયંસેવક પરિષદનાં દર્શનમાં અધિવેશનમાં અધ્યક્ષસ્થાનેથી મુંબઈના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી હિરાલાલ હાલચંદ દલાલ બાર-એટ-લોએ પોતાના ભાપજામાં જૈન સંઘને લગતા પ્રશ્નોની કેટલીક મનનીય વિચારણા રજૂ કરી હતી.

સાધ્ર્મિક-સેવાના સંબંધમાં બોલતાં એમણે આજે દરેક ગામ કે શહેરમાં કેટલાય માણસોને કઈ કઈ જતના હુંબ છે તેનું હૂબહૂ ચિત્ર રજૂ કરી એના નિવારણ માટે કેટલાક સચોટ ઉપાય રજૂ કર્યા હતા. એમણે જણાવ્યું હતું કે

“જે ભાઈઓ બેકાર છે, જેમને કામ કરવું છે, એમને કામ મળતું નથી, અથવા ક્યાં મળશે એની ખબર નથી, એમને મદદ કરવાની ખાસ જરૂર છે. આપણા દેશમાં કેટલેય ડેકાઝે Employment Exchanges (કામધંધો મેળવી આપવા માટેની સંસ્થાઓ) છે. આપણા સમાજમાં એવા Employment Bureau બેકારી નિવારવા માટે સ્થાપવાના પ્રયત્નો થયા છે. પણ એમાં આપણને કામયાબી મળી નથી.. જ્યાં સુધી આપણે આવો Employment Bureau ન કાઢી શકીએ, ત્યાં સુધી આવા સરકારી કે બીન સરકારી Employment Bureaus કે Exchanges હોય તેની સાથે સંપર્કમાં આવી ક્યાં ક્યાં આવી સંસ્થાઓ છે, તેની માહિતી મળવવી જોઈએ. અને એવી સંસ્થાઓમાં કેવી માંગ છે, કેવી લાયકાતવાળા માણસોની જરૂર છે, એ જાણી લઈ આપણા બેકાર ભાઈઓને એના સંપર્કમાં મૂકી એમને નોકરી ધંધો મેળવવા મદદ કરી શકીએ... ”

“વળી કેટલાય નાના નાના ઉઘોગો છે, જેમાં કામ કરવાની તાલીમ આપણા ભાઈઓને આપવી જોઈએ. આપણે ઉઘોગગૃહો ખોલી એવા ધંધાઓ શીખવી શકીએ. ભરત, ગુંથણ, સીવણ, કટીંગ, શોર્ટહેન્ડ, નામું, ટાઇપરાઈટીંગ, બુક્ઝાઈન્ડીંગ, રેઝિઓરીપેર, રમકડાં બનાવવાનું, બીજી ઘરગઢું ચીજો બનાવવાનું... વગેરે ઘણી બાબતોમાં તાલીમ આપવાનો પ્રબંધ કરી શકીએ. સ્વીટ્યર્લેન્ડમાં ઘડિયાળો બનાવવાનો ધંધો હોમ ઇન્ડસ્ટ્રી તરીકે ચાલે છે. જેની જેવી યોગ્યતા હોય તેને તેવી તાલીમ આપીને ધંધે લગાડી શકીએ.

“હવે ધંધો કરવા કે ન્હાના ઉઘોગ ચલાવવા પૂરતા પૈસા ન હોય તેવાઓને સહકારી ધોરણે કામ કરવા પ્રેરણા કરીને એમની મુશ્કેલીનો ઉકેલ લાવી શકીએ. ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

આજે આપણી સરકાર, સહકાર અને સહકારી સોસાટીઓને આવકારે છે. એવી સોસાયટીઓને સરકાર સારી મદદ પણ કરે છે. સહકારી સોસાયટીઓ શું છે, તેને કેવી રીતે બનાવી શકીએ, તેનો વહીવટ કેમ ચલાવવો અને સહકારી મદદ કેમ, ક્યાંથી અને કેવી રીતે મળે છે, તેનું જ્ઞાન પહેલાં તો આપણે મેળવવું જોઈએ. સહકારી મંડળીઓ બનાવવા માટે તાલીમ ને માહિતી આપવી જોઈએ..

“હવે કોઈ માણસ તદ્દન નિરાધાર, અશક્ત અને ખાવાપીવાનું હુંબ હોય, એને ક્યાં અને કોની પાસે જવું એની ખબર ન હોય, અથવા ત્યાં જતા એ શરમાતો હોય, એવા શખ્સોની બરાબર માહિતી મેળવી જે સખીગૃહથો હોય તેમને આ પરિસ્થિતિથી વાકેફ કરી આવા માણસની જરૂરીયાત ખરી છે એની ચોક્કસ ખાતરી કરીને જેમને મદદ કરવાની ભાવના છે, એમને ખાતરી આપી મદદ મેળવી પ્રયત્ન કરવો જોઈએ... ”

“સેવાના અનેક પ્રકાર છે. જેવું હુંબ, જેવો પ્રશ્ન, જેવી મુશ્કેલી, જેવા સંજોગો, તેવા સેવાના પ્રકાર. સેવા ધનથી જ થઈ શકે એમ નથી. જોકે ધન ઓ જરૂરી વસ્તુ છે, પણ સેવા જાતમહેનતથી વધારે થઈ શકે. સેવા સલાહ સૂચનાથી થઈ શકે. દરેક માણસ પોતાની શક્તિ, સંજોગ અને ઈચ્છા પ્રમાણે સેવા આપી શકે.

“અહીં સેવાના અનેક પ્રકારની નોંધ લેવા મન લલચાય છે. જેનો રિપોર્ટ એકાદ મહિના ઉપર ફી પ્રેસ જનરલ નામના પેપરમાં હતો. વેસ્ટ જર્મનીમાં એક (Occulist) ચશમાવાળાએ એક ચર્ચ (મંદિર)ના, પ્રિસ્ટી દેવળના અધિકારીને વાત કરી કે હિંદમાં ઘણા લોકોને ચશમાની જરૂર છે. પરંતુ એમની પાસે પૈસા નથી, તેથી તેઓ તકલીફ ભોગવે છે. તરત જ દેવળના અધિકારીએ ત્યાંના બોયસ્કાઉટ્સને એ વાત કરી. અને બોયસ્કાઉટ્સને એ વાત ઉપાડી લીધી. પછી બોયસ્કાઉટ્સોએ ઘેર ઘેર ફરીને ૩૦૦૦ ચશમાની જોડ ભેગી કરી. હવે ત્યાંના ચશમાવાળાઓ ચશમાના કાચના નંબર વિગેરેનું વર્ગીકરણ કરે છે. અને તેના ઉપર નંબર વિગેરે ઉપયોગી વિગતનાં લેબલ લગાવી હિંદ મોકલી આપવાના છે.

“સેવાનો આ કેવો પ્રકાર ! કેવી તાત્કાલિક વ્યવહાર અને બીન ખર્ચની સેવા ! આપણાં જૈન શાસ્ત્રોમાં પણ સેવાનું અજોડ દણાંત છે. જૈન શાસ્ત્રકથાઓમાં શ્રી નંદિષેણ મુનિનું જવલાંત દણાંત છે. (અહીં દણાંત વર્ણવીને કહ્યું કે)

“સેવાધારીને કેટલો ભોગ આપવો પડે ! કેટલો સ્વાર્થ ત્યાગ કરવો પડે ! ગમે તે કષ પડે પણ સેવા ચૂકે નહિ, એવો સચોટ આદર્શ આપણાં શાસ્ત્રો પૂરો પાડે છે. આપણે જૈન ધર્મના અનુયાયીઓ, આવા અમૂલ્ય ખજનાના વારસદારો

૧૧૪ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

કંઈ ને કંઈ સેવા કરી છુટીએ, એવી ભાવના રાખવી જોઈએ.

“આપણે આપણી દિનચર્યામાં ચૈત્યવંદન કરી ‘જ્યવીયરાય’ નું સૂત્ર બોલીએ છીએ. ત્યારે આપણે માગ્યોએ છીએ, ‘ગુરુજ્ઞાપૂઆ પરત્થકરણાંચ’ વિગેરે વિગેરે. એમાં પરથકરણાં એટલે પરની સેવાને સ્થાન છે. ‘મન્જહજ્જિજ્જાણાં’ની સજાયમાં પણ શ્રાવકે કરવાના કાર્યો છે એમાં પરોવયારો એટલે પરોપકાર અર્થાત્ બીજની સેવા પણ આવે છે.”

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૩૩, તા. ૧૯-૫-૧૯૬૨

(૫૭) (૨)

આગળ ચાલતાં શ્રી હીરાભાઈએ સમાજમાં મતમતાંતરો અંગે જણાવતાં કહ્યું કે એ મારા મનથી નજીવા અને ગૌણ છે. પરંતુ એનો ઉકેલ લાવી શકતો નથી; અને પરિણામે જુદા જુદા વિભાગો વચ્ચે કડવાશ અને વૈમનસ્ય વચ્ચું છે. અને કોઈ પણ સાંકું કામ કરવા માટે સંગઠિત પ્રયત્નો થવા જોઈએ, તેવા પ્રયત્નો આપણે કરી શકતા નથી.

આપણે સરળતાથી અને પ્રામાણિકપણે, ઉકેલ લાવવા મથીએ તો જરૂર ઉકેલ આવે.

હાલની પરિસ્થિતિથી શ્રી હીરાભાઈનું હદ્ય ઘવાયું છે અને તેથી જ તેમણે આ ઉદ્ગારો કાઢ્યા છે.

વિશેષમાં તેમણે તિથિનો મતભેદ મિટાવવા અપીલ કરી હતી. શેઠ કસ્તુરભાઈ જેવા આ જઘડામાં લવાદ થયા, છિતાં તેનું સુખદ પરિણામ આવ્યું નહિ. અમદાવાદમાં બીજું સાધુ સંમેલન ભરાયું અને તેમાં આ જઘડાનો સફળ અંત લાવવા પ્રયત્નો થયા, પણ શાસ્ત્રો વિચારવાનો જ ઈન્કાર થવાથી તે એળે ગયા. એટલે સમાજના કેટલાક ભાગમાં નિરાશ ફેલાય, એ સ્વાભાવિક છે. પરંતુ અમને લાગે છે કે એમાં નિરાશ થવાનું કોઈ કારણ નથી. જે કામ બે પ્રયત્નોએ ન બની શક્યું, તે ત્રીજા પ્રયત્ને બની શકે છે. માત્ર તે માટે શુભ નિષા અને યોગ્ય પુરુષાર્થ જોઈએ.

શ્રી હીરાલાલભાઈએ તીર્થોના જઘડાનો પણ નિર્દેશ કર્યો છે. તેમણે પોતાનાં ભાષણમાં જણાવ્યું છે કે ‘કેસરિયાજી તીર્થ, મક્ષીજી તીર્થ, અંતરિક્ષ પાર્શ્વનાથજીનું તીર્થ વિગેરે તીર્થો અંગે શેતામ્બર અને દિગ્મભર ભાઈઓ વચ્ચે મતભેદ છે અને તેથી જઘડા છે. અંતરિક્ષજી તીર્થ માટે સને ૧૯૦૫ થી તે સને ૧૯૬૦ સુધી,

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૧૧૫

એટલે લગભગ અર્ધા સદી સુધી આપણે બંને પક્ષો લડ્યા. પ્રીવી કાઉન્સીલના નિર્જયથી તેનો છેવટનો ફેસલો થયો. તે પછી એ કોર્ટના નિર્જયની બજવણીમાં કેટલોક સમય ગયો અને ગયા વર્ષે તેનો અંત આવ્યો, ત્યારે તુરત જ આપણા દિગ્મભરી ભાઈઓએ અંતરિક્ષજી તીર્થ એમનું છે, અંતરિક્ષ પાર્શ્વનાથની મૂર્તિ એમની છે, માટે એ ફરી કરાવી આપો અને એ મૂર્તિ મંદિર અને વહીવટ-મિલકત વિગેરે અમને સૌંપી દો, એવી મતલબનો દાવો ત્યાંની કોર્ટમાં માંડ્યો છે.

કોર્ટમાં લડી ઉકેલ લાવવો એમાં સમય, શક્તિ અને ધનનો કેટલો હુદ્દ્ય બંને પક્ષોને કરવો પડે છે ? આનો ઉકેલ સલાહસંપથી, પરસ્પરની સહિષ્ણુતાથી સરળ, નિર્ઝક, પ્રામાણિકભાવે ન લાવી શકાય ? આ દિશામાં પણ એકબિજા ઉપર જીત મેળવવાની દાખિએ નહિ, પણ ન્યાય દાખિએ ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવા બહુ અગત્યના છે.

અમે જાણીએ છીએ ત્યાં સુધી આવા વિચારો આગળ પણ કેટલીક પરિષદોમાં પ્રકટ થયેલા છે અને શેતામ્બર મૂર્તિપૂજક સમાજના આગેવાનોએ શાંતિભર્યો ઉકેલ લાવવા માટે પ્રયાસો કર્યો છે, પણ તેમને સામા પક્ષ તરફથી જોઈએ તેવી દાદ મળી નથી. આ માટે તો દિગ્મભર આગેવાનોએ જ સમજવાની જરૂર છે. પ્રીવી કાઉન્સીલનો ચૂકાદો આવી ગયા પછી પણ લડવાની વૃત્તિ રહે અને એક સામટા સાત કેસો કોર્ટમાં દાખલ થાય ત્યાં શું સમજવું ?

શ્રી હીરાભાઈએ પોતાના દીર્ઘ અનુભવ પછી કોર્ટમાં લડીને ઉકેલ લાવવામાં સમય, શક્તિ અને ધનના હુદ્દ્ય તરફ ઈશારો કર્યો છે, પણ બીજી બાજુ સમાધાનથી આગળ વધવામાં જે અંતરાય ઊભો થાય છે, તેનો વધારે વ્યવહારુ અને સ્પષ્ટ ઉકેલ જણાવ્યો હોત, તો આ બાબતમાં આપણે શું કરવું તેની સમજ પડત.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૩૪, તા. ૨૬-૫-૧૯૬૨

(૫૮) (૩)

શ્રી હીરાભાઈ દલાલે છેવટે ૧૯૬૨ ના નવા ઈન્કમટેક્ષ અંગે વિવેચન કરતાં જણાવ્યું કે- ‘આ એપ્રિલની ૧ લી તારીખથી એનો અમલ શરૂ થયો છે. એમાં આપણાં ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોની આવક ઉપર ઈન્કમટેક્ષ નાખ્યો છે. અત્યાર સુધી ધાર્મિક કે સખાવતી ટ્રસ્ટોની આવકો ઈન્કમટેક્ષમાંથી મુક્ત હતી. આ વર્ષે એ આવકો ઉપર ટેક્ષ નાખવામાં આવ્યો છે. આ એકટની વાંધા પડતી કલમો ૧૧-૧૨ અને ૧૩ છે. એક કલમ તો એવી છે કે જે વર્ષે આવક થઈ હોય તે સધળી

૧૧૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

એક જ વર્ષમાં ખર્ચ થઈ જાય તો એના પર ટેક્ષ નહિ; પરંતુ જો તેમાંથી તમો બચત કરો તો તે બચતના ઉપર રકમ ઉપર ઈન્કમટેક્ષ લાગુ પડે છે.

સીલેક્ટ કમીટી આગળ આ કાયદો હતો, ત્યારે આ કલમની ગંભીરતા અને મુશ્કેલી ઉપર ધ્યાન ખેંચવામાં આવ્યું હતું. ત્યારે સીલેક્ટ કમીટીએ એવો સુધારો કર્યો કે રૂ. ૧૦૦૦૦ સુધી વધારો કરી શકો એટલે ૨૫ ટકા અથવા રૂ. ૧૦૦૦૦, બેમાંથી જે વધારે હોય તેટલી રકમની ટેક્ષમાંથી મુક્તિ, બીજી બચત ઉપર ટેક્ષ લાગે, એવો હવે કાયદો છે.

હવે આપણા કેટલાય ટ્રસ્ટો એવા છે કે ખાસ કરીને આવા મોંઘવારીના સમયમાં એની એક જ વર્ષની આવક એના ઉદ્દેશોને સારી રીતે અમલમાં લાવવા પૂરતી નથી. એ ઉદ્દેશો માટે ખર્ચવા કેટલાય વર્ષ સુધી આવક બેગી કરીને જ ખર્ચ શકાય. મુશ્કેલીનો આ ઉકેલ સીલેક્ટ કમીટીએ લાવવા પ્રયત્ન કર્યો છે અને હવે સુધારેલા કાયદામાં એવી જોગવાઈ કરી છે કે ઈન્કમટેક્ષ ખાતાના ખાસ અધિકારીની મંજૂરીથી દશ વર્ષ સુધી અમુક શરતોએ કોઈ ખાસ કામ માટે આવક બચાવી શકો અને એના ઉપર ટેક્ષ નહિ, પણ એવું સખત નિયમન મૂકવામાં આવ્યું છે કે જો દશ વર્ષ પછી અગિયારમા વર્ષે એ સધળી રકમ ન ખરચી શકો તો એ વર્ષની આવક છે એમ ગણી ઈન્કમટેક્ષ ભરવો પડે.

આ તો બહુ વધારે પડતી સખ્તાઈ છે. જો ટ્રસ્ટીઓ રકમ ન ખરચે તો હાલના પદ્ધતીક ટ્રસ્ટ એકટના કાયદાઓ એવી રકમો ખર્ચાવી નાખવા ટ્રસ્ટીઓ ઉપર ફરજો પડે છે અને એ કૂરતા છે. આવી સખ્તાઈ શા માટે છે ?”

આમ જાણાવીને શ્રી હીરાભાઈએ ધાર્મિક-ધર્માદા ટ્રસ્ટોને કેવી મુશ્કેલી પડશે, તેમજ દેરાસરો સાર્વજનિક હોવાની માન્યતા કેવી ભૂલ ભરેલી છે તેને સ્પષ્ટ કરતાં કહ્યું કે—“હવે ઉપર બતાવ્યા પ્રમાણો જે થોડી પણ રાહત છે, તે રાહત નવા દેરાસરો, નવા ઉપાશ્રયો, નવી સંસ્થાઓ અને નવા ટ્રસ્ટો કોમી હોય તો મળતી નથી. દેરાસરો તે સાર્વજનિક હોઈ શકે જ નહિ. એ તો કોમી કે વિભાગી રહેવાના જ. એની આવક ઉપર ટેક્ષ પડશે. મારા નમ્ર મંત્ર્ય પ્રમાણો આ ધર્મ ઉપરના ટેક્ષ છે, જે બીજી બંધારણીય છે અને ધાર્મિક સ્વતંત્રતા ઉપર ગ્રાપ મારે છે.

વળી આપણામાં તો પરંપરાથી એક દેરાસર બીજા દેરાસરને મદદ આપે છે, અને એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને મદદ આપે છે. આ નવા કાયદા પ્રમાણો આ મદદ જે ટ્રસ્ટને મળે છે, તેની આવક ગણાશે અને તેના ઉપર ટેક્ષ લેવાશે. આ કેટલું ભયંકર છે, તેનો આપ ખ્યાલ કરો. આને માટે પણ સત્ત્વર પગલાં લેવાની જરૂર

છે. આપણે બધા ય મળી સંગઠિત અવાજ ઉઠાવવો જરૂરનો છે.”

આપણા રાજકર્તાઓના કોમ વિષેના ખ્યાલ ભામક હોવાનું જાણાવતાં શ્રી દલાલે બહુ દુઃખ સાથે કહ્યું કે—“કોમવાદ મીટાવતાં કોમ અને કોમની સંસ્થાઓ મિત્રાવી દેવાના જે પ્રયાસો થાય છે, તે ભયંકર છે. કોમ, ધર્મ, જ્ઞાતિ એ ઔતિહાસિક તત્ત્વો છે. એમાંથી નીપજતા અનિષ્ટો જરૂર નાબુદ કરો. પણ કોમ કે ધર્મનો નાશ કરવાનો આડકતરો પ્રયત્ન કરો તે યોગ્ય નથી, તેની જરૂર પણ નથી. એક કોમ બીજી કોમનો લાભ લે, એનું શોષણ કરે અને અન્યાય કે જુલમ કરે એ મનોવૃત્તિ ખતરનાક છે, અને એને ઉખેડી નાખવી જોઈએ. પણ એક કોમ પોતપોતાની જરૂરીયાત પ્રમાણો પોતપોતાનું કામ કરી લે તો તેમાં વિક્ષેપ કરવો અથવા એવું કામ અટકાવવા પ્રયત્ન કરવા એ ભયંકર છે.

આપણી ભાવનાઓ તો હંમેશાં બીનકોમવાદ જ અને વિશ્વબંધુત્વની છે તે નીચેના શ્લોકમાં જોઈ શકશો.

શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ ।

દોષાઃ પ્રયાન્તુ નાશાઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ ॥

શ્રી હીરાભાઈએ રજૂ કરેલી મનનીય વિચારણાઓ પર શ્રી જૈન સંધે ધ્યાન દેવા જેવું છે.

U

નિર્દોષ આહાર એટલે મિષ્ટ ભોજન

V

બંગલોરથી ભજાવતી અંજનશલાકા - પ્રતિષ્ઠા માટે વિહાર ચાલુ હતો. રસ્તામાં ઘણાં ગામોમાં જૈનોનાં ઘર ન મળે. અજૈનનાં ઘરોમાં પણ ગોચરી ઉપલબ્ધ ન થાય. ત્યારે પૂજ્યશ્રીની ઊભર ૮૦ વર્ષની છતાં આગ્રહ નિર્દોષ ગોચરીનો જ.

એક વાર એક ગામમાં નિર્દોષ ગોચરી ઉપલબ્ધ ન થતાં માત્ર નિર્દોષ કેળાં લઈ ચલાવી લીધું. આખા દિવસમાં તે સિવાય બીજું કાંઈ ન લીધું. શિષ્યોએ ખૂબ વિનવણી કરી કે - ગુરુદેવ, વિહાર કરવાનો છે, વ્યવસ્થિત ભોજન લેવાય તો પોષણ મળે. પણ પૂજ્યશ્રીને તો નિર્દોષ ભોજન એ જ મિષ્ટ અને પૌષ્ટિક ભોજન હતું.

W

—“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાસ્ત્ર X

૫૮ જૈન ધર્મ સંબંધી માહિતી ફેલાવવાની જરૂર

(૧)

જૈન ધર્મ મંગલમય છે, કલ્યાણકારી છે અને બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે, એવી આપણી આંતરિક શક્તિ છે; તેથી જ આપણે એ ભાવનાનું વારંવાર સ્મરણ કરીએ છીએ અને તેના ઉચ્ચારણથી આનંદ તથા ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પરંતુ આપણી આસપાસ વસતા જૈનેતર લાખો મનુષ્યો જૈન ધર્મ વિષે કેટલું જ્ઞાન ધરાવે છે કે જૈન ધર્મ વિષે કેવા જ્યાલો બાંધી બેઠા છે, તેનો વિચાર આપણે કદી ગંભીરતાપૂર્વક કર્યો છે ખરો ?

કોઈ એમ માનતું હોય કે ‘એવો વિચાર કરવાની આપણે શી જરૂર છે ? તેઓ જૈન ધર્મ વિષે કંઈ જાણતા હોય તો પણ ભલે અને ન જાણતા હોય તો પણ ભલે, અથવા તેઓ જૈન ધર્મ વિષે સારો-ખોટો જે કંઈ જ્યાલ ધરાવતા હોય તે તેમને મુખરાક હો.’ તો એ માન્યતા બરાબર નથી, ઉચ્ચિત નથી, યોગ્ય નથી. અમે તો આગળ વધીને એમ પણ કહેવા ઈચ્છાએ છીએ કે વિદેશી લોકોમાં પણ જૈન ધર્મ સંબંધી જરૂરી માહિતી ફેલાવવાની આજે જરૂર છે. જો તેઓ જૈન ધર્મ સંબંધી કંઈ પણ જાણતા હશે, તો તેમાં વિશેષ રસ લેશો, કેટલાક તેના પ્રત્યે આદરવાળા અને કેટલાક વળી તેને સમર્પિત પણ થશે અને એ રીતે જૈન ધર્મનો પ્રભાવ ધીમેધીમે સારાએ વિશ્વમાં વિસ્તાર પામશે; કમમાં કમ જૈન ધર્મથી વિરુદ્ધ વાતોના કે જૈન ધર્મની હલકાઈના પ્રચારને તેઓ કદી ઝીલશે નહિ.

વિદેશી લોકો જૈન ધર્મ સંબંધમાં કંઈ પણ જાણતા નહિ હોવાથી ઘણીવાર તે અંગે છબરડા વાળે છે. એક વિદેશીએ કેટલાક વર્ષો પહેલાં લખ્યું હતું કે ‘જૈન ધર્મ એ બૌદ્ધધર્મની એક શાખા છે અને મહાવીર એ ગૌતમબુદ્ધના શિષ્ય હતા. જૈન લોકો આત્મહત્યા કરીને મરવાનું વધારે પસંદ કરે છે’ વગેરે. જો કે ત્યારપણી ડો. હર્મન યાકોબી વગેરે કેટલાક વિદ્વાનોએ જૈન ધર્મનો અભ્યાસ કર્યો અને તે સંબંધમાં કેટલાક નિબંધો લખ્યા, એટલે એ જ્યાલમાં સુધારો થયો, પણ વિદેશી લોકોનો નવાણું ટકા ભાગ હજુ પણ જૈન ધર્મથી અજાણ છે. બે વર્ષ પહેલાં મેઝિસ્કોના ડો. એફ. પાર્ટિન્સ સાથે પત્રવ્યવહાર થયો, ત્યારે તેમણે લખ્યું હતું કે ‘અહીંના લોકોને જૈન નામનો એક ધર્મ જગતમાં અસ્તિત્વ ધરાવે છે, તેની પણ ખબર નથી. અલબંત, બુદ્ધ વિષે તેઓ ઠીક ઠીક માહિતી ધરાવે છે.’

વિદેશી લોકોનું જૈનધર્મ અને તેના આચાર વિષેનું અજ્ઞાન કેટલીકવાર કેવી મુંજવણ ઊભી કરે છે, તે પણ અહીં જણાવીશું.

મુંબઈમાં ભિક્ષાપત્રિબંધક બીલ આવ્યું તેની કલમો એટલી વ્યાપક હતી કે જૈનસાધુઓનો સમાવેશ ભિક્ષુકોમાં-ભીખારીઓમાં થઈ જાય અને તેઓ ગોચરી પાણી માટે ઘરેઘરે જઈ શકે નહિ. આથી એક જૈન આગેવાને તે વખતના ગવર્નરના મંત્રીની મુલાકાત લીધી અને તેને આપણી વાત સમજાવવા માંડી. થોડી વાત સાંભળીને એ યુરોપિયન મંત્રીએ કહ્યું : ‘તમે લોકો શ્રીમંત હો, છતાં તમારા સાધુઓને ઘરે ઘરે જઈને ભિક્ષા શા માટે માગવી પડે છે ? તમે એમને રેશનીંગ કર્ડ કઢાવી આપો, એટલે બધી માથાકૂટનો અંત આવી જાય.’

જૈન આગેવાને કહ્યું : ‘જુદા જુદા ઘરેથી ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવવી એ તેમનો આચાર (નિયત થયેલો નિયમ) છે. એટલે તેમને રેશનીંગ કર્ડ આપી શકાય નહિ. વળી તેઓ અનાજ કે ફળકૂલને અડતા પણ નથી, તેનો સંગ્રહ કરતા નથી કે દીવાસળી સળગાવી ચૂલો પેટાવતા નથી. એટલે તેઓ રેશનીંગ કર્ડ લઈને શું કરે ?’

પેલાને આ ખુલાસો સાંભળી ભારે અજાયબી લાગી. તેણે કહ્યું : ‘કોઈ રેશનીંગ કર્ડ કઢાવી આપે તે ન લેવા અને ઘરે ભિક્ષા માગવાનો આગ્રહ રાખવો, એ તો ઘણું અજાયબ કહેવાય.’

આવો બીજો પણ ઘણો સંવાદ થયો હતો, જે સાંભળીને આપણને હસવું આવે, પણ જ્યાં જૈન ધર્મના આચાર-વિચાર સંબંધી કોઈ માહિતી જ ન હોય, ત્યાં બીજી કઈ આશા રાખી શકાય ?

૬૦ (૨)

કોઈ એમ માનતું હોય કે વિદેશમાં જૈન ધર્મ વિષે ભલે અજ્ઞાન હોય, પણ ભારતવર્ષમાં સ્થિતિ છેક આવી નથી, તો એ માન્યતા પણ સુધારવા જેવી છે. ભારતવર્ષમાં પણ કોડો મનુષ્યો એવા છે કે જે જૈન ધર્મ વિષે કંઈ પણ જાણતા નથી અને તેના વિષે ભળતા જ જ્યાલો બાંધી બેઠા છે. ભારતનો શિક્ષિત વર્ગ કે જેની પાસેથી આવા જ્ઞાનની આશા રાખી શકાય તે પણ જૈન ધર્મના જ્ઞાનથી લગભગ વંચિત છે. બાળ દીક્ષા પ્રતિબંધક બીલ વખતે અનેક અધિકારીઓને તથા ધારાસભ્યોને મળવાના પ્રસંગો આવ્યા હતા, ત્યારે આ વસ્તુ સ્પષ્ટ થઈ હતી.

(૧) એક ધારાસભ્યે કહ્યું હતું કે ‘તમારો ધર્મ તો બૌદ્ધ ધર્મમાંથી નીકળેલો છે અને (૨) બુદ્ધ તો મોટી ઉમરે ગૃહત્યાગ કર્યો હતો, તો તમે નાની ઉમરમાં દીક્ષા શા માટે આપો છો ?’

(૩) એક ધારાસભ્યે કહ્યું હતું કે ‘બાળ સાધુને રાતે પાણી પીવાની તરસ લાગે અને તમે લોકો એને પાણી પીવા ન દો તો એ મરી જાય કે નહિ ?’

(૪) એક અધિકારીએ કહ્યું હતું કે ‘તમારા ઉપવાસ તો ધણા કરક છે. તે અમારા જેવાથી પણ થતા નથી, તો બાળ સાધુઓથી શી રીતે થાય ? તમે લોકો એમની પાસે ફરજિયાત ઉપવાસ કરાવો છો, તે ઠીક થતું નથી, અમે આવો જુલમ બંધ કરવા માટે જ બાલદીક્ષા પ્રતિબંધક બીલની હિમાયત કરીએ છીએ.’

(૫) એક અધિકારીએ જૈનોમાં કેટલા સંપ્રદાય છે, તેમની શી માન્યતા છે, વગેરે અંગે પણ પ્રશ્નો કર્યા હતા, કારણ કે તે અંગે તેઓ કશું જાણતા ન હોતા.

હવે ઉપરના પ્રશ્નો જોઈએ તો સામાન્ય ગેરસમજના છે. કેમ કે (૧) જૈનધર્મ બૌદ્ધ ધર્મથી કેટલો ય પ્રાચીન છે એ ઐતિહાસિક પ્રમાણથી પણ સિદ્ધ થયેલું છે. (૨) પૂર્વના મહાન પ્રભાવક કેટલાય જૈનાચાર્યો નાની ઉમરમાં દીક્ષિત થયા ત્યારે જ પ્રભાવક સિતારા બન્યા છે એ ઈતિહાસ કહી રહ્યો છે. (૩) બાળ સાધુ સંયમ જીવનમાં એવા નિયમિત ખાનપાનમાં ટેવાઈ જાય છે કે એમને રાતે તરસ લાગતી નથી. અભ્યાસ એ મોટી વસ્તુ છે, એ વાત અભ્યાસ વિનાનાની કલ્પનામાં ક્યાંથી આવે ? વળી બાળ સાધુ એવા સંસ્કારી બને છે કે ક્યારેક તરસ લાગે તો પોતે જ પાપક્ષય માની સ્વેચ્છાએ આનંદ્યી એને સહી લે છે. વળી આજે જે બાળ દીક્ષિતો થયા છે, એમાંથી એક પણ દાખલો તરસથી મરી ગયાનો બન્યો નથી. (૪) બાળ સાધુને ફરજિયાત ઉપવાસ કરાવાતા જ નથી. ઊલટું એને ઉપવાસ ન કરવાનું કહેવા છતાં પોતે જ આત્મકલ્યાણની જંખનાથી કરવા ઉત્સાહિત થાય છે, અને આનંદ્યી એ પસાર પણ કરે છે. આ પણ ખાસ અભ્યાસથી સિદ્ધ કરેલું હોય છે. (૫) જૈન ધર્મના સંપ્રદાયો છે જ નહિ. માત્ર મહાવીર પ્રભુના પછી દિગંબર વગેરે નવા નવા પક્ષ ઊભા થયા એટલે આજે જૈન ધર્મસંધ જૈન શેતાંબર મૂર્તિપૂજક સંધ તરીકે ઓળખાય છે.

આવી આવી જૈનધર્મની સરળ સરળ માહિતીનો પણ વ્યાપક પ્રચાર હોય તો ઉપરોક્ત ગેરસમજો દૂર થાય.

બાકી ગેરસમજોના બીજા પણ અનેક દાખલાઓ આપી શકાય તેમ છે, પણ તે બધા અહીં રજૂ કરીને અમે લેખનું કલેવર વધારવા માગતા નથી. કહેવાનું

તાત્પર્ય એ છે કે આજે પ્રધાનમંડળમાં, ધારાસભ્યોમાં, અધિકારીઓમાં, નગરપાલિકાઓમાં, લોકલબોર્ડમાં, શાળા-મહાશાળાઓમાં, સાહિત્ય અને પત્રકારિત્વના ક્ષેત્રમાં જૈનેતરોનું-ખાસ કરીને હિંદુઓનું જ વર્યસ્વ છે અને તેઓ જૈન ધર્મ અંગે ખાસ માહિતી ધરાવતા નથી, એટલે આપણા પ્રશ્ન વખતે છબરડા વળે છે અને આપણે ભારે મુશ્કેલીમાં મૂકાવું પડે છે.

આનું મુખ્ય કારણ એ છે કે આજની શાળાઓમાં હિંદુ ધર્મ વિષે ધણું કહેવાય છે, બૌદ્ધ ધર્મ વિષે ધણું કહેવાય છે, ઈસ્લામ અને પ્રિસ્ટી ધર્મ વિષે અમુક કહેવાય છે, પણ જૈન ધર્મ વિષે તો કંઈ જ કહેવાનું નથી, એટલે જૈનોના છોકરા પણ શું જાણે ? તેમજ આજના જૈનેતર શિક્ષિત વગ્ને જૈન ધર્મ સંબંધી પ્રમાણભૂત માહિતી ક્યાંથી હોય ? કોઈ પણ પ્રાંતના પાઠ્ય પુસ્તકો એકઠા કરો અને તેનું નિરીક્ષણ કરો તો અમારા કથનની યથાર્થતા સમજશે.

આ પરિસ્થિતિ તાત્કાલીક સુધરે એમ નથી, એટલે આપણા માટે તો એક જ ઉપાય રહે છે કે જૈન ધર્મ સંબંધી જરૂરી માહિતી આપનારું સાહિત્ય તૈયાર કરી તેનો વ્યાપક પ્રચાર કરવો. આ સાહિત્ય સુંદર અને રોચક બનાવવા તરફ પણ લક્ષ રાખવું, જેથી એ બરાબર વાંચવા પામે અને આપણો મૂળ ઉદ્દેશ સચ્ચવાઈ રહે.

આપણે ત્યાં સુકૃતોમાં ધણું ય ખરચાય છે, તેમજ વ્યાવહારિક કેટલાય ખર્ય અવસરે અવસરે થતા રહે છે, પણ જો આ તરફ દાખ્લી રાખી શક્ય દ્રવ્યનો આ માર્ગ ઉપયોગ થાય, તો થોડા વખતમાં ધાર્યું કામ થઈ શકે અને તેનું પરિણામ સુંદર આવી શકે, પણ તે માટે આગેવાનોએ બહાર આવીને પહેલ કરવી જોઈએ.

અમે જૈન સમાજના આગેવાનોનું તથા પૂજ્ય આચાર્યાદિ મુનિવરોનું આ તરફ લક્ષ જેંચીએ છીએ. આશા છે કે તેનું પરિણામ શીધ અને સુંદર આવશે.

૬૧ ભારત બહાર જેન ધર્મનો પ્રચાર

આજે એવી માન્યતા ફેલાયેલી છે કે જૈન ધર્મ ભારતની બહાર ગયો નથી, પણ એ માન્યતા ભાંત છે. બૌદ્ધ ધર્મની જેમ જૈન ધર્મ પણ ભારતની બહાર ગયો હતો અને ત્યાં તેણે જિનોપદિષ્ટ અહિસા, સંયમ, તપ તથા વિશ્વબંધુત્વની ભાવનાનો પ્રચાર કર્યો હતો.

શ્રી વિશ્વભર પાંડેએ અહિસાની પરંપરાની ચર્ચા કરતાં લઘું છે કે ‘ઈ.સ.ની પહેલી શતાબ્દીમાં અને તેની પછીના હજાર વર્ષો સુધી જૈન ધર્મ મધ્યપૂર્વના દેશોમાં કોઈ ને કોઈ રૂપમાં યહુદી ધર્મ, ઈસાઈ ધર્મ અને ઈસ્લામ ધર્મને પ્રભાવિત કરતો રહ્યો છે.’

પ્રસિદ્ધ જર્મન ઈતિહાસ લેખક વાન કોમરના કથન અનુસાર મધ્ય પૂર્વમાં પ્રચલિત ‘સમાનિયા’ સંપ્રદાય ‘શ્રમાણ’ શબ્દનો અપબ્રંશ છે.

ઇતિહાસ લેખક જી.એફ.મૂર લખે છે કે ‘હજરત ઈસાના જન્મની શતાબ્દી પૂર્વે ઈરાક અને પેલેસ્ટાઈનમાં જૈન મુનિ અને બૌદ્ધ બિક્ષુ સેંકડોની સંખ્યામાં ફેલાયેલા હતા.’

‘સિયા હત નામ એ ના સિર’ના લેખક લખે છે કે ‘ઈસ્લામ ધર્મના કલંદરી સંપ્રદાય પર જૈન ધર્મનો ઘણો પ્રભાવ પડેલો છે. કલંદર ચાર નિયમોનું પાલન કરે છે. સાધુતા, શુદ્ધતા, સત્યતા અને દરિદ્રતા. તેઓ અહિસા પર અખંડ વિશ્વાસ રાખે છે.’

મહાત્મા ઈશુ પ્રિસ્ત જૈન સિદ્ધાંતોના સંપર્કમાં આવ્યા અને એનો પ્રભાવ લઈ ગયા. રામસ્વામી આધ્યર એ પ્રસંગની ચર્ચા કરતા લખે છે કે ‘યહુદીઓના ઇતિહાસ લેખક ‘જોજકસ’ના લેખથી સ્પષ્ટ થાય છે કે પૂર્વકાળમાં ગુજરાત પ્રદેશ દ્રાવિડોના તાબામાં હતો અને ગુજરાતનું પાલીતાણા નગર તામિલનાડુ પ્રદેશને આધીન હતું. એજ કારણ છે કે દક્ષિણથી દૂર જઈને પણ યહુદીઓએ પાલીતાણાના નામથી પેલેસ્ટાઈન નામનું નગર વસાયું અને ગુજરાતનું પાલીતાણા પેલેસ્ટાઈન બની ગયું. ગુજરાતનું પાલીતાણા જૈનોનું પ્રાચીન અને પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. લાગે છે કે ઈશુ પ્રિસ્તે આ પાલીતાણામાં આવીને બાઈબલમાં લખેલા ૪૦ દિવસના જૈન ઉપવાસ દ્વારા જૈન શિક્ષાનો લાભ લીધો હતો.’

પુરાતત્વ-વિદ્વાન પી.સી. રામ ચૌધરીએ એક સ્થાને કહ્યું છે કે ‘આ ધર્મ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

ધીમે ધીમે ફેલાયો કે જે રીતે જ્ઞિસ્તી ધર્મનો પ્રચાર યુરોપમાં ધીમે ધીમે થયો. શ્રેણીક, કૂણિક, ચંદ્રગુપ્ત, સંપ્રતિ, ખારવેલ તથા અન્ય રાજાઓએ જૈન ધર્મને અપનાવ્યો. એ શતાબ્દી ભારતના હિંદુ શાસનનો વૈભવપૂર્વ યુગ હતો, જે યુગમાં જૈન ધર્મ જેવો મહાન ધર્મ પ્રચાર પામ્યો.

અમે એક વાર અમેરીકાના એક મેગેજીનમાં દક્ષિણ અમેરિકાના એક પછાડ પરના ભગ્ન મંદિરોના ફોટો જોયા હતા, ત્યારે અમને એમ લાગતું હતું કે આ કોઈ જૈન મંદિરના ધંસાવશે લાગે છે, પણ ત્યાં જઈને તપાસ કોણ કરે ?

કેટલાક વર્ષ પહેલાં યુરોપમાં આવેલ ઓસ્ટ્રીયા દેશના એક ખેતરમાંથી નીકળેલ જૈન પ્રતિમાનો ફોટો અહીંના કોઈ માસિકમાં પ્રસિદ્ધ થયો હતો, તે એમ બતાવે છે કે જૈન ધર્મ એક કાળે યુરોપમાં પણ ફેલાયેલો હશે.

કેટલાક વર્ષ પહેલાં જૈન ઐતિહાસિક પરિષદની એક બેઠક થયેલ કે જેમાં સદ્ગત બાબુ પૂરણચંદ્ર નાહિર વગેરેએ ભાગ લીધેલો ને ઈતિહાસ તથા પુરાતત્વના વિષય પર રસ લેનાર જૈન વિદ્વાનોની કમીટી નીમાયેલી, પણ પછી શું થયું ? તેની ખબર નથી. જો આવી એકાઉ સંસ્થા આપણે ત્યાં હોય તો આવી બાબતો પર ખૂબ પ્રકાશ પડે અને જૈન ધર્મના ગૌરવમાં વધારો થાય. શું એ દિશામાં આપણા વિદ્વાનો પગલું ભરશે કે ?

U

સતત જયણાની જગૃતિ

V

પૂજ્ય ગુરુદેવશ્રી એક ગામમાં બિરાજમાન હતા. વરસાદના દિવસો પાસે હતા તેથી વાદળનાં કારણે અવારનવાર અંધારું છવાઈ જતું હતું.

એક વાર પૂજ્યશ્રીએ એક મુનિને પૂછ્યું : “બહાર વરસાદ ચાલુ છે ?”

“હાજી સાહેબ ! કાંઈ કામ હતું ?”

“ના, આ તો માત્રું કરવાની શંકા હતી, હમણાં વરસાદ ચાલુ હોવાથી વિરાધના થશે. તીવ્ર શંકા નથી તેથી વરસાદ બંધ થયા પછી જ કરીશ.”

વરસાદ બંધ થયા પછી જ પૂજ્યશ્રીએ માત્રું કર્યું જેથી ચાલુ વરસાદે પરઠવવું ન પડે. કેવી સૂક્ષ્મ સાવધાની !

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

(૫) જૈન ધર્મ સહુ પાળી શકે એવો છે

(૧)

સર્વ કોટિના મનુષ્યો ધર્મમાર્ગમાં આવી જાય, ધર્મનું પાલન કરતા થઈ જાય અને ધર્મમાર્ગ આગળ વધી પોતાનું કલ્યાણ સાધી શકે તે માટે અરિહંત ભગવંતોએ ધર્મનો ઉપદેશ આપ્યો.

આ ઉપદેશ એટલો વ્યાપક હતો, એટલો સરલ હતો કે કોઈ પણ દેશ, જાતિ કે વર્જનો મનુષ્ય તેનું સરલતાથી પાલન કરી શકે, તેમાં મુખ્ય મુદ્દા ચાર જ હતા.

- (૧) તમે દેતાં શીખો.
- (૨) તમારું આચરણ સુધારો.
- (૩) તમારી ઈચ્છાઓ પર કાબૂ રાખો. અને
- (૪) નિરંતર સદ્ગુણારોનું સેવન કરો.

આમાંનો પ્રથમ મુદ્દો દાનધર્મ ગણાયો, બીજો મુદ્દો શીલધર્મ ગણાયો, ત્રીજો મુદ્દો તપોધર્મ ગણાયો અને ચોથો મુદ્દો ભાવધર્મ ગણાયો. તેનો વિસ્તાર અને પ્રતિવિસ્તાર ઘણો થયો, પણ આ દરેક મુદ્દાની પાછળ જે આશય હતો, તે આપણે બરાબર સમજી લેવો જોઈએ.

(૧) જ્યાં સુધી મનુષ્ય લેવાની વૃત્તિ રાખે છે, પણ દેવાની વૃત્તિ રાખતો નથી, ત્યાં સુધી તે સાચા અર્થમાં આગળ વધી શકતો નથી. લેવું ખરું, પણ દેવું નહિ, એ ક્યાંનો ન્યાય ? મનુષ્ય કુદરત પાસેથી, સમાજ પાસેથી કેટલું બધું લે છે અને બદલામાં શું આપે છે ? માટે તેણે પોતાની પાસે સંપત્તિ, વિદ્યા, કલા કે કોઈ વિશિષ્ટ શક્તિ હોય તો તે હિતબુદ્ધિથી બીજાને આપવાની વૃત્તિ રાખવી જોઈએ. તેમાં કેટલું દેવું એનું માપ નથી. જેની પાસે જેટલું હોય, તેમાંથી યથાશક્ય આપે. સાધુપુરુષો પાસે જ્ઞાન કે અનુભવનો સંગ્રહ હોય છે, તે હિતબુદ્ધિથી બીજાને આપે. મનુષ્યમાં જ્યાં સુધી એવી સમજણ પેદા ન થાય કે મારી બીજાઓ પ્રત્યે પણ કંઈ ફરજ છે, ત્યાં સુધી તે ધર્મમાર્ગમાં આવી શકતો નથી. માત્ર સ્વાર્થી કે એકલપેટા મનુષ્યની આ જગતમાં શું કિંમત છે ?

તીર્થકરો સંસારના ત્યાગ કરતા પહેલાં બાર માસ સુધી લખલૂટ દાન આપે

છે, તેનો એક હેતુ એ છે કે દાનધર્મની પ્રતિષ્ઠા કરવી, દાનધર્મનું મહાત્મ્ય પ્રકાશવું અને સર્વ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે દાનધર્મનું અનુસરણ કરે એવી જોરદાર હવા પેદા કરવી.

(૨) મનુષ્યનાં વ્યક્તિત્વનો આધાર તેના રૂપરંગ કે વસ્ત્રાભૂષણ પર નથી, પણ તેના આચરણ ઉપર છે; તેથી તેણે પોતાનું આચરણ સુધારતા રહેવું જોઈએ અને જયારે તે ઉત્તમ કે શ્રેષ્ઠની કોટિમાં પહોંચે ત્યારે જ સંતોષ માનવો જોઈએ. જો મનુષ્યનું આચરણ ખરાબ હોય, હલકું હોય તો તે દુષ્ટ વ્યક્તિ બને છે અને સહુનો તિરસ્કાર પામે છે.

આચરણ સુધારવા માટે નીચેની પાંચ વસ્તુઓ ખાસ લક્ષ્યમાં રાખવાની છે :

- (૧) જીવની લિંસા કરવી નહિ.
- (૨) જૂદું બોલવું નહિ.
- (૩) ચોરી કરવી નહિ.
- (૪) સદાચાર છોડવો નહિ અર્થાત્ કુળાંગગામી બનવું નહિ.
- (૫) પોતાને માટે ધનધાન્યાદિનો વિપુલ સંગ્રહ કરવાની લાલસા રાખવી નહિ.

આ પાંચ વસ્તુ આચરણમાં ઉત્તી કે બીજા અનેક ગુણો આપોઆપ ઉદ્ભબે છે અને મનુષ્યની જીવન વાટીકાને નંદનવન સમી રણિયામણી બનાવી દે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૦, અંક-૪૦, તા. ૭-૭-૧૯૬૨

(૬) (૨)

(૩) ઈચ્છાઓ પર કાબૂ ન હોય તો મનુષ્ય સુખી થતો નથી. તેને આજે એક વસ્તુની ઈચ્છા થાય છે, કાલે બીજી વસ્તુની ઈચ્છા થાય છે, અને ત્રીજી દિવસે ત્રીજી વસ્તુની ઈચ્છા થાય છે. આ ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે તે વિવિધ પ્રકારના પ્રયાસો કર્યા જ કરે છે. તેમાં અનેક જાતનાં કષ્ટો ઉઠાવવા પડે છે, અનેક જાતની મુશ્કેલીઓ જીલવી પડે છે અને અનેક જાતની મુંજવાણોમાંથી પસાર થવું પડે છે.

આમ છીતાં તેની બધી ઈચ્છાઓ તૃપ્ત થતી નથી. વધારે સ્પષ્ટ કહીએ તો બહુ થોડી ઈચ્છાઓ પૂરી થાય છે અને ઘણી ઈચ્છાઓ અધૂરી રહે છે. આથી તેને

શોક, સંતાપ, ઉદ્ઘેગ આદિનો અનુભવ થાય છે. તો પછી ઈચ્છાઓને જ કેમ ઘટાડવી નહિ ?

મનુષ્યની ભોગેચ્છા ઘટે તો જ વૈરાગ્યાદિ મહાન ગુરૂઓ ઉત્પન્ન થાય છે અને તે એને સંયમસાધના કે યોગસાધના પ્રત્યે દોરી જાય છે, તેથી ભોગેચ્છાને ઘટાડવી એ ઘણું જરૂરનું છે.

આહારેચ્છાને પણ મનુષ્યે કાબુમાં રાખવી જોઈએ અને તે કાબુ મેળવવા માટે જ વિવિધ પ્રકારના તપોની યોજના છે. જે તપ કરતો નથી, તેની ઈચ્છાઓ કાબુમાં આવતી નથી, અને જેની ઈચ્છાઓ કાબુમાં આવતી નથી, તે લેશ પણ સુખનો અનુભવ કરી શકતો નથી.

(૪) મનુષ્ય જેવો વિચાર કર્યા કરે છે, તેવો તે થાય છે, વધારે સ્પષ્ટ કહીએ તો જે મનુષ્ય દુષ્ટ-હલકા વિચારોનું સેવન કરે છે, તે દુષ્ટ-હલકો થાય છે અને સદ્ગ્વિચારોનું સેવન કરે છે, તે સત્પુરુષ સજ્જન બને છે. દુષ્ટ વિચારો કરનાર સત્પુરુષ બને કે સદ્ગ્વિચારો કરનારો દુષ્ટ-દુર્જન બને એવું કદી થયું નથી - થતું નથી-થવાનું નથી.

મનુષ્યનું મન અતિ ચંચળ છે, તે વિચારોને અહીંતહીં દોરી જાય છે અને જ્યાં કદી પણ જવા જેવું ન હોય ત્યાં પણ ધેલી દે છે. આથી મનુષ્ય નિરંતર સદ્ગ્વિચારોનું સેવન કરી શકતો નથી.

પણ તે સત્સંગ કેળવે, સારાં સારાં પુસ્તકો વાંચે, સારા મિત્રોની સોભતમાં ફરે અને ધાર્મિક અનુષ્ઠાનો વગેરેમાં મળ રહે, તો સદ્ગ્વિચારોનું સેવન સારી રીતે કરી શકે છે અને તેનાં મધુર ફળોની પ્રાપ્તિ થોડા જ વખતમાં કરવાને શક્તિમાન થાય છે.

જો સાધુપુરુષોને જોઈ હવ્યમાં હર્ષ થાય, જો ધર્મ કે મોક્ષની વાત સાંભળી અંતરમાં આનંદ પ્રકટે અને સારાં સારાં કામો કરવાની તાલાવેલી જાગે, તો સમજવું કે સદ્ગ્વિચારોનું સેવન પરિપક્વ થયું છે, અને તેનું ફળ શીଘ્ર આવશે.

જેણે સદ્ગ્વિચારોનું સેવન લાંબા સમય સુધી કર્યું હોય તેને જ ઉત્તમ ભાવના પ્રકટે છે અને તે એનો મુક્તિભણીનો માર્ગ સરલ બનાવી દે છે.

આ ચાર મુદ્દાઓ પર રચાયેલો જૈન ધર્મ પાળવામાં અધરો છે, એવું કોણ કહી શકશે ? અમે તો ડિગ્રીમ નાદે કહીએ છીએ કે જૈન ધર્મ સહુ પાળી શકે એવો છે, ઘણો સરળ છે અને શીଘ્ર પોતાનું ફળ બનાવનારો છે.

ડૉ. એડવર્ડ થોમસે જૈન ધર્મની પ્રાચીનતા અંગે દલીલ કરતાં કહ્યું હતું કે-

“જે ધર્મ ઘણો સાદો-સરળ હોય તે પહેલાં ઉદ્ભવેલો હોવો જોઈએ અને જે ધર્મ વધારે અટપટો અને ગુંચવણવાળો હોય તે પછી ઉદ્ભવેલો હોવો જોઈએ. જૈન ધર્મ ઘણો સાદો અને સરલ છે, એજ એની પ્રાચીનતાનો મોટો પુરાવો છે.” અને

મેજર જનરલ ફલોંગે જગતના સહુ વિદ્વાનોને પ્રશ્ન કર્યો હતો કે- “જગતમાં ઉપાસના, કિયાકાંડ અને નૈતિક ઉપદેશમાં જૈન ધર્મથી અધિક સરલ કોઈ ધર્મ હોય તો મને બતાવો !”

જૈન ધર્મ આવો સરળ અને સચોટ હોવાથી જ તે વિશ્વધર્મ થવાને યોગ્ય છે.

U

કેવી નિર્મણ આંતર-પરિણાતિ !

V

કલકત્તાથી કાનપુર તરફ વિહાર થયો ત્યારે પૂજ્યશ્રીની ગોચરી લાવવાની જવાબદારી મારી હતી કારણ કે પૂ. જયસોમ વિજય મ. નું ચોમાસું ઝરીયા હોવાથી કલકત્તા રોકાઈ ગયા હતા. પૂજ્યપાદશ્રી તો સંપૂર્ણ નિર્દોષ ગોચરીનાં આગવી. જૈનેતરોનાં ધરોમાં સૂકો આટાર કે કાચા - પાકા ભાત સિવાય બીજું શું મળે ? રોજના 3-3 પિહાર ચાલતા હતા. આટલા બધા શ્રમમાં ગુરુદેવ થોડું ગરમ પ્રવાહી જેવું વાપરે તો ઠીક રહે તેમ વિચારી કુલ ૫ થી ૭ વાર મેં દોષિત પ્રવાહી નિર્દોષ કહીને પૂજ્યશ્રીને વપરાવ્યું. કાનપુર પહોંચ્યા પછી મેં પ્રાયશ્ક્રિતા માંગ્યું : “ગુરુદેવ ! વિહારમાં ૫/૭ વાર નિર્દોષ કહીને દોષિત પ્રવાહી મેં આપને વપરાવ્યું છે.” આ સાંભળતા ગુરુદેવની આંખ આંસુથી ભીની થઈ ગઈ : “નિષ્કરણ આ રીતે મને દોષિત શા માટે વપરાવ્યું ? જરૂર હોત તો હું જ કહી દેત...”

પૂજ્યશ્રીની કેવી નિર્મણ આંતર-પરિણાતિ !

W

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

૧૨૮

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

જૈન ધર્મ અને સંસ્કૃતિ પર અનેક પ્રકારના આક્ષેપો કરતું સ્વ. ધર્મનંદ કૌસંબીનું બીજું પુસ્તક

૬૪ પાર્શ્વનાથકા ચાતુર્યમિ ધર્મ

(૧)

જૈન ધર્મ પર થતા આક્ષેપોનો સપ્રમાણ પ્રતિકાર થવો જોઈએ, એ વસ્તુનો સ્વીકાર તો આપણા સંઘે ઘણા વખતથી કર્યો છે, અને તે અંગે કેટલાક પ્રયાસો પણ કર્યો છે, પરંતુ લગભગ બધાયે પ્રયાસો અલ્પજીવી અને અસર્મર્થ નીવડ્યા છે. પરિણામે આજે પણ જૈન ધર્મ પર ભયંકર આક્ષેપો થવાનું ચાલુ છે અને તેનો કોઈ સપ્રમાણ પ્રબળ થતો નથી.

સ્વ. ધર્મનંદ કૌસંબીએ બુદ્ધચરિત્રમાં અહિસાના સાક્ષાત્ અવતાર સમાભગવાન મહાવીર પ્રભુ પર માંસાહારનો આરોપ મૂક્યો, તેથી આપણા સંઘમાં ખળભળાટ થયો, પણ તેનો પ્રતિકાર આપણે કેટલા અંશે કરી શક્યા ? તેના સામે જેવો પ્રૌઢ ગ્રંથ પ્રકટ થવો જોઈતો હતો, તે હજુ સુધી થયો નથી, સાહિત્ય અકાદમી આગળ આપણે ધા નાખી, ત્યારે એ લખાણો નીચે એક નોંધ મૂકવાનું નક્કી કર્યું, જે એક રીતે આપણી લાગણીની ઠેકડી ઉત્તાવનારી હતી. તાત્પર્ય કે એથી આપણો મૂળ હેતુ જરા પણ સર્યો નહિ. આજે એ પુસ્તકનું ભારતની જુદી જુદી દશ ભાષાઓમાં ભાષાંતર થયું છે અને તેની નકલો છૂટથી પ્રચાર પામી રહી છે.

સ્વ. ધર્મનંદ કૌસંબીએ આથી અનેકગણું વધારે ખરાબ એક બીજું પુસ્તક પણ લખેલું છે, પરંતુ જૈનોનું ધ્યાન તેના તરફ ખાસ જેંચાયું હોય તેમ લાગતું નથી. આ પુસ્તકનું નામ છે,-‘પાર્શ્વનાથનો ચાતુર્યમિ ધર્મ,’ ઈ.સ. ૧૯૫૭માં તેનું હિન્દી ભાષાંતર પ્રકટ થેલું છે, એટલે તે પહેલાં તેમણે તે મરાઈ ભાષામાં લખેલું જણાય છે. આ પુસ્તક હેમચન્દ્ર મોદી પુસ્તકમાલાના નવમાં પુષ્પ તરીકે મુંબઈના હિન્દી ગ્રંથરલય લીમીટેડ સવા દ્વિપણાની કિંમતે પ્રગટ કરેલું છે. આ પુસ્તકના પ્રારંભમાં કાકા કાલેલકરે ‘સાચો સમાજ ધર્મ’ એ નામનો એક લેખ લખી આ પુસ્તકનું મહત્વ સમજવવા પ્રયત્ન કર્યો છે, અને લેખ કે તેની પ્રસ્તાવનામાં બુદ્ધચરિત્રનું પ્રકરણ યાદ કરીને જૈન સમાજની લાગણીને વિશેષ આધાત પહેંચાડવાનો પ્રયાસ કર્યો છે.

આ પુસ્તક કુલ ત્રૈવીશ પ્રકરણોમાં વહેંચાયેલું છે, અને તેમાંના અનેક પ્રકરણોમાં જૈન તીર્થકરોની, જૈનાચાર્યની તથા જૈનસંધની ધર્મવિષયક ભાવનાની પૂરી વગોવણી કરવામાં આવી છે. આમ છતાં આજ સુધી નથી તો તેની કોઈ સમર્થ સમાલોચના થઈ કે નથી તો તેમાંના કોઈ આક્ષેપોના ઉત્તરો આપવાનો પ્રયત્ન થયો. જૈન સંધમાં આટાટલા પૂ.આચાર્ય મહારાજાઓ પૂ. મુનિવરો હોવા છતાં આવું ચાલે છે એ આશ્વર્ય સાથે બેદકારક છે.

આપણી આ જાતની ઉપેક્ષા, આ જાતની બેદરકારી આપણા ધર્મને અને આજની સ્કૂલ કોલેજોમાં કેળવાતી આપણી નવી પ્રજાને કઈ સ્થિતિએ લાવી મૂક્યો ? તેનો ગંભીર વિચાર કરવાની જરૂર છે.

હાલ ચાતુર્યમાસનો સમય છે અને તેમાં પૂ. મુનિમહારાજો સ્વકલ્યાણની સાધના ઉપરાંત જૈન સંધનું કલ્યાણ થાય એવી અનેક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે, તેમાં આ પુસ્તકનો સચોટ દાખલો આપવાની પ્રવૃત્તિનો પણ સમાવેશ થવો જોઈએ, એમ અમને લાગે છે.

આ પુસ્તકમાં વાંધાભરી બાબતો ક્યાં ક્યાં છે, તેનો અવતરણ સાથેનો નિર્દેશ અમે આગામી અંકમાં કરીશું.

૬૫ (૨)

ધર્મનંદ કૌસંબી પ્રસ્તુત પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે બૌદ્ધ અને જૈન ધર્મોની વર્તમાન દુર્દશાનું કારણ છે સંપ્રદાયોનો પરિગ્રહ.

આ સાંપ્રદાયિક લોક નિર્થક વાતાને મહત્વ આપી ધર્મરહસ્યથી દૂર ચાલ્યા ગયા છે, એનો એક દિલચસ્પ અનુભવ મને પણ થયો છે.

બુદ્ધ કાલમાં માંસાહારની પ્રથા કેવી હતી, એ દેખાડવા માટે ‘પુરાતત્વ’ નામની ત્રૈમાસિક પત્રિકામાં મેં એક લેખ લખ્યો એ લેખમાં મેં પ્રમાણો સાથે એ બતલાવ્યું કે એ સમયમાં સર્વ પ્રકારના શ્રમણોમાં માંસાહાર પ્રચલિત હતો અને એ લેખમાં થોડું પરિવર્તન કરીને ‘ભગવાન બુદ્ધ’નો ઉત્તરાર્થ, જેમાં આ અધ્યાય આપ્યો છે, તે નાગપુરના સુવિચાર-પ્રકાશન-મંડલ તરફથી સન ૧૯૪૧ માં પ્રકાશિત થયો. કેટલાક દિગ્ભર જૈનોએ આ અધ્યાય વાંચ્યો અને તેમણે યવતમાલ (વિદભ)માં એક સંસ્થાની સ્વાપના કરીને તેના દ્વારા મારા પર નિંદા-નિષેધની વર્ષા શરૂ કરી દીધી, અને અદાલતમાં કાયદેસર કામ ચલાવવાની ધમકી આપી. અંતમાં મેં નાગપુરના

‘ભવિતવ્ય’ (સાપ્તાહિક)માં એક પત્ર પ્રકાશિત કરીને મારા આલોચનાને સ્પષ્ટ ઉત્તર આપી દીધો. ત્યારથી વિદર્ભમાં ચાલતું તે આંદોલન હુંકું પડી ગયું.

પરંતુ આપણા સનાતની જૈન ભાઈઓ ચૂંપ બેઠા નહિ. સન ૧૯૪૪ માં કલકત્તાથી માંડીને કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) સુધી અનેક સભાઓ ભરીને તેમણે મારા પ્રત્યે વિરોધના ઠરાવો પસાર કર્યા. એમાં સંતોષની વાત એ હતી કે પરસ્પર સદા જઘડતા રહેતા મૂર્તિપૂજાજક શ્વેતામ્બર, સ્થાનકવાસી શ્વેતામ્બર અને દિગ્ભાર મારા વિરોધને માટે એક થઈ ગયા. મારી સાથે વાદ-વિવાદ કરવા માટે પણ અનેક જૈન સાધુ અને ગૃહસ્થ તેયાર થઈ ગયા. આ બધાને અલગ અલગ ઉત્તર આપવાનું અસંભવિત હતું. તેથી મેં ગુજરાતી દૈનિક ‘જન્મભૂમિ’ દ્વારા પ્રાર્થના કરી કે તેઓ હાઈકોર્ટના કોઈ ગુજરાતી જગ્નને સરપંચ ચૂંટે અને એની સામે બધા આક્ષેપો મૂકે, પછી હું મારા પક્ષનું સમર્થન કરીશ. એ સાંભળીને સરપંચ પોતાનો નિર્ણય આપે. જો એ નિર્ણય મારી વિરુદ્ધ હશે તો હું જૈનોની જાહેર રીતે માફી માગીશ અને જો તે જૈનોથી પ્રતિકૂળ હશે તો એ નિર્ણય સમાચાર પત્રોમાં પ્રકાશિત કરી દેવામાં આવે, જેથી ભવિષ્યમાં આ વાદ જ ન રહે. પરંતુ જૈનોને આ વાત પસંદ આવી નહિ અને આખરે એ આંદોલન પોતાની મેળે જ ખત્મ થઈ ગયું. તો પણ વચ્ચે-વચ્ચે કોઈને કોઈ સનાતની જૈન મનફાવતો પત્ર લખવાની તસ્દી લેતો જ રહ્યો.

પરંતુ મારા આ જૈન ભાઈઓ એક ક્ષણ માટે પણ એ વિચાર નથી કરતા કે જૈન ધર્મનું રહસ્ય માંસાહાર ન કરવામાં છે કે ચાતુર્યામ ધર્મમાં ? જો ચાતુર્યામ ધર્મમાં હોય તો શું એ અનુસાર આ સમયના જૈન સાધુઓ ને ગૃહસ્થ આચરણ કરે છે ખરા ? ઉદ્યપુરના કેસરિયાનાથ નામના જૈન મંદિરમાં શ્વેતામ્બરો અને દિગ્ભારોએ એક્ઝબીજા પર ગોળીઓ ચલાવી હત્યા કરી. સમેતશિખરના પાર્શ્વનાથ મંદિરની પૂજાને માટે હંમેશાં મુકદમો ચાલતો રહે છે. અને તે આખરે પ્રીવી કાઉન્સિલ સુધી જાય છે. આજ સુધી લાખો રૂપિયા ખર્ચ થયો છે અને કોઈ કહી શકે તેમ નથી કે આગળ કેટલો ખર્ચ થશે ? ગિરનાર આદિ સ્થાનોમાં પણ આ જઘડા ચાલી રહ્યા છે. પરંતુ કોઈ સનાતની જૈન એ નથી વિચારતો કે આ (બધુ) ચાતુર્યામ ધર્મ સાથે કેટલું સંગત છે ? તેમણે મારા પર ઘણા તહોમતો મૂક્યાં, તો પણ એમના પ્રત્યે મારો પ્રેમ કાયમ છે.’

ધર્મનંદ કૌસંબીની આકમણકારી અસત્ય કલમ કેવી-કેટલી ચતુરાઈથી ચાલે છે, તેનો આ નાદર નમૂનો છે. તેમણે જૈનોએ રજૂ કરેલી સત્ય ડકીકતોને તો લક્ષમાં લીધી નહિ, પણ તીલટા તેમને સાંપ્રદાયિક જન્મનથી ભરેલા, નિર્થક વાતોને મહત્વ આપનારા તથા પરસ્પર સદા જઘડતા રહેનારા કહી તેમની પૂરેપૂરી નાલેશી

કરવાની અનિશ્ચનીય પ્રયત્ન કર્યા છે ! અને આમ છતાં તેઓ એક મહાન તટસ્થ વિચારકમાં ખેપે છે !

ગતાંકમાં પ્રસ્તુત પુસ્તકના પ્રકાશક તરીકે હિંદી ગ્રંથ રતન કાર્યાલય લીમીટેડ, મુંબઈ ૪ નું નામ જણાયું છે, તે તેના સોલ એજન્ટનું નામ સમજવું. એ પુસ્તકના પ્રકાશક છે શ્રી નથુરામ પ્રેમી, તેઓ શ્રી હેમચંદ્રમોહી-પુસ્તકાલય ટ્રસ્ટના એક ટ્રસ્ટી છે અને હિરાબાગ, મુંબઈ ૪ એ સ્થળેથી તેમણે આ પુસ્તક પ્રકટ કર્યું છે.

જૈન સમાજનું દુર્ભાગ્ય એ છે કે આવું પુસ્તક એક જૈનના હાથે જ પ્રકાશિત થયું છે.

U

V

શરીર જીર્ણ થયું, તપ-લાલસા જીર્ણ ન થઈ

એક દિવસ પૂજ્યશ્રીને આયંબિલ કરવાની ભાવના થઈ. સાથે રહેલા મુનિ ભગવંતે ભક્તિભાવથી કહ્યું : “ગુરુદેવ ! આપે તો ૧૦૮ ઓળી કરી છે, અત્યારે આપની ૮૨ વર્ષની ઉંમર છે શરીર પણ અસ્વસ્થ છે. હવે શરીરની સંભાળ રાખીને અમ પર ઉપકાર કરો.”

ગુરુદેવ સસ્મિત વદને બોલ્યા : “મેં ૧૦૮ ઓળી કરી તે મોટી ભૂલ કરી, નહિ ? ૧૦૮ ઓળી કરી એટલે તમે માનો છો કે તપ પૂરો થઈ ગયો. માટે જચારે મને વિશેષ તપ કરવાની ભાવના થાય છે ત્યારે તમે ના પાડીને અવરોધ ઊભો કરો છો. પણ મેં જો ૧૦૦ ઓળી કરીને ફરી પાયો નાંખ્યો હોત તો સારું થાત ને ? ઓળી નાની હોય એટલે મનને એમ થાય કે હજુ આઠ જ ઓળી થઈ છે, ચાલો આગળ વધીએ. તપ નિરંતર ચાલું રહે. અને નાની ઓળી હોય તેથી તમે પણ અવરોધ ન કરો.”

W

X

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત” વર્ષ-૧૦, અંક-૪૬/૪૭/૪૮, તા. ૨૫-૮-૧૯૬૨
જૈન ધર્મ અને સંસ્કૃતિ પર અનેક પ્રકારના આક્ષેપો કરતું સ્વ. ધર્મનંદ કૌસંબીનું બીજું
પુસ્તક

૬૬ પાર્શ્વનાથકા ચાતુર્યમિ ધર્મ

(હપ્તો ત્રીજો-અનુસંધાન તા. ૨૮-૭-૬૨)

ધર્મનંદ કૌસંબીકૃત આ પુસ્તકમાં તીર્થકરોની માન્યતાને કાલ્યનિક જ્ઞાવી છે, શ્રી પાર્શ્વનાથનું પ્રચલિત ચરિત્ર બનાવટી છે એમ જાહેર કરાયું છે અને જૈનાચાર્યો શ્રી કાલકસૂરિજી, શ્રી બણ્ણભિંસૂરિજી તથા શ્રી હેમચંદ્રસૂરિજીના જીવનચરિત્રોનો ટૂંકસાર આપી તેનો નિર્જર્ખ કાઢતાં જ્ઞાયું છે કે આ આચાર્યો કેટલાક મંદિરો અને ઉપાશ્રયો બનાવી ગયા, તે સિવાય તેમણે વિશેષ કંઈ કર્યું નથી. વળી તેઓ રાજ્યાશ્રયનો સ્વીકાર કરી શિથિલાચારી બની ગયા હતા વગેરે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શ્રી સિદ્ધહૈમ વ્યાકરણ બનાવ્યું, તે અંગે પણ તેમની કલમમાંથી ઝેર નિર્યું છે.

આ ગ્રંથમાં આવી બીજી અનેક બાબતો રજૂ કરવામાં આવી છે, જે વાંચીને પાઠકોને એમજ લાગે કે જૈન ધર્મમાં કંઈ છે જ નહિ, અને તેના અનુયાયીઓ સાંપ્રદાયિક ઝનુનથી ભરેલા છે.

આ બધા આક્ષેપોનો વ્યવસ્થિત ઉત્તર આપવા માટે તો એક ખાસ ગ્રંથની જ જરૂર ગણાય, કે જેની રચના કોઈ વિવ્દાન અવશ્ય કરશે. આમ છતાં અમે અહીં એટલું જ્ઞાવવા ઈથીએ છીએ કે શ્રી કૌસંબીએ આ નિબંધ લખીને એક સંશોધક ને તટસ્થ વિચારક તરીકેની પોતાની પ્રતિજ્ઞાને ઘણી જાંખી પાડી છે.

તેમણે ભગવાન બુદ્ધના ઉત્તરાર્થમાં એમ લખ્યું કે એ વખતે સર્વ શ્રમણોમાં માંસાહાર પ્રચલિત હતો, એ વાત સત્યથી તદ્દન વેગળી છે. જૈન શ્રમણોને કદી પણ માંસાહાર કરવાની છૂટ અપાઈ ન હતી અને તેમણે કદી પણ માંસાહાર કર્યો નથી. જૈન શાસ્ત્રોના અનેક ઉલ્લેખો આ વાતની સાક્ષી પૂરે છે.

આ પ્રકરણ ચાલતું હતું ત્યારે શ્રી વિનોબા ભાવેએ જ્ઞાયું હતું કે શ્રી મહાવીર સ્વામીએ કોઈ પણ વખત માંસાહાર કર્યો હોય એ વાત મારા ગણે ઉત્તરતી નથી. જો તેમણે માંસાહાર કર્યો હોત, તો તેમના દ્વારા અહિંસાનો આટલો

વ્યાપક પ્રચાર થયો ન હોત, તેમજ આજે તેમના અનુયાયીઓને માંસાહાર પ્રત્યે જે ભારે સૂગ છે તે પણ ન હોત. પરંતુ કૌસંબીને તો યેન કેન પ્રકારેજ પોતાનો કક્કો ખરો કરવો હતો, એટલે તેઓ આવી તટસ્થ વિચારણાને ધ્યાનમાં શાની લે ?

પ્રથમ સદ્ગત પૂજ્ય આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ આ બાબતમાં ચેલેન્જ આપી હતી, પણ તે વખતે માંસાહારનું સમર્થન કરનાર કોઈ માઈનો લાલ આગળ આવ્યો ન હતો. પછી તે સંબંધમાં પૂ. મુનિરાજ શ્રી દર્શનવિજ્યજી તથા પૂ. મુનિરાજ શ્રી સુશીલવિજ્યજી વગેરેએ સપ્રમાણ ઉત્તરો આપતાં પુસ્તકો પ્રકટ કર્યા હતાં, છતાં કૌસંબીએ ‘ના, હું તો ગાઈશ’ એ ન્યાયે પોતાની હઠ છોડી નહિ અને આ મંત્રયમાં સુધારો કરવાનું કહેનારને સાંપ્રદાયિકતાથી ભરેલા, નિર્થક વાતોને મહત્વ આપનારા વગેરે કહી તેમની વગોવણી કરવામાં પોતાની કલમની સાર્થકતા માની.

કુહાણે હાથા મળી જાય, એટલું તેનું જોર વધે, એ દેખીતું છે. આ પ્રકરણમાં પણ એમ બનેલું છે અને તે જૈન સમાજ બરાબર જાણે છે.

શ્રી જિનશાસન તો અવિચ્છિન્ન પ્રભાવશાલી છે અને ત્રિકાલાબાધિત છે, એટલે આવા હલકટ હુમલાઓથી તેની જડ હાલવાની નથી, પણ આપણી ફરજ છે કે આવા લખાણોથી અન્ય આત્માઓ અધર્મ પામી ન જાય માટે તેનો વ્યવસ્થિત પ્રતિકાર કરવો.

છેવટે જૈનધર્મ અને સંસ્કૃતિ પર થતાં આક્ષેપોનો વ્યવસ્થિત પ્રતિકાર કરવા માટે એક સબળ સંસ્થાની જરૂર છે, એટલું જ્ઞાયી આ લેખમાળા સમાપ્ત કરીએ છીએ.

૫૭ કેન તીર્થો અંગો રાજસ્થાનમાં સર્જયેલી ગંભીર પરિસ્થિતિ

(‘પાશ્ચનાથનો ચાતુર્યમિ ધર્મ’ અંગે લેખમાળા ચાલુ છે, તેનો ત્રીજો હપ્તો આ અંકે પ્રગટ થવાનો હતો, દરમ્યાન તાત્કાલિક જરૂરનો લાગવાથી આ લેખ પ્રકટ કરવામાં આવ્યો છે. - તંત્રી)

તીર્થો આપણી મોંબેરી મિલકત છે. તે આપણી ધર્મભાવનાને ટકાવી રાખે છે, એટલું જ નહિ પણ તેની વૃદ્ધિ કરવામાં ઘણો મહત્વનો ફાળો આપે છે, તેથી જ આપણે આજ સુધીમાં તીર્થોનાં સર્જન સંરક્ષણ માટે કોડો રૂપિયા ખર્ચ્યા છે. વળી આપણા સંઘે અગમચેતી વાપરીને ભવિષ્યમાં આ તીર્થોના હિતને કોઈ નુકસાન ન પહોંચે તે માટે આણંદજી કલ્યાણજીની પેઢી સ્થાપી છે અને તે આજ સુધી આ પ્રકારનું કાર્ય કરતી આવી છે. પણ હમણાં હમણાં તેની કાર્યવાહી કેમ કંઈક સુસ્ત બની ગઈ છે એ સમજાતું નથી.

આ હાલતમાં જૈન સંઘની ફરજ થઈ પડે છે કે તેણે પોતાનાં તીર્થોનું રક્ષણ કરવા માટે પૂરેપૂરી જગૃતિ બતાવવી અને જે દિશામાંથી તેના પર પ્રહારો થતા હોય તે દિશામાં આગળ વધી તે પ્રહારોને રોકી લેવા. જો તેમાં આગસ કે ઉપેક્ષા કરવામાં આવશે તો પરિણામ ભયંકર આવશે.

સને ૧૯૫૮ ના ઓક્ટોબર મહિનામાં રાજસ્થાન સરકારે ‘રાજસ્થાન ટ્રસ્ટ એક્ટ-૧૯૫૮’ પાસ કર્યો હતો, પણ તેની અગત્યની કલમો હાલમાં તા. ૧ લી જુલાઈ અને ૧૯૬૨ થી લાગુ કરવામાં આવી છે. તેમાં બીજા પદ્ધીક ટ્રસ્ટ એક્ટોની જેમ ટ્રસ્ટ રજીસ્ટર કરાવવાની, સરકાર નક્કી કરે તે રીતે હિસાબ રાખવાની, હિસાબ ઓડિટ કરવાની, કાયદા પ્રમાણે નાણાનું રોકાણ કરવાની, કમીશનરની મંજૂરી વિના અમુક જાતની મિલકતની હેરફેરી નહિ કરવાની અને મંજૂરી વિના મિલકતનું વેચાણ કે લાંબું લીઝ નહિ કરવાની, ટ્રસ્ટીઓ સામે સમરી હુકમનામું કરવાની વગેરે કલમો તો છે જ, ઉપરાંત એક વધારે અને ભયંકર કલમ દશમાં પ્રકરણમાં રાખેલી છે. તે કલમ અનુસાર રૂપિયા દશ હજારથી ઉપરની વર્ષિક આવકાળાં ટ્રસ્ટોનો મિલકત વગેરેનો સધળો વહીવટ ટ્રસ્ટીઓ અને વહીવટદારો પાસેથી છીનવી લેવામાં આવે છે અને સરકારે નીમેલી ‘કમીટી ઓફ મેનેજમેન્ટ’ હસ્તક સોંપી દેવામાં આવે છે.

આ રીતે રાજસ્થાન પ્રાંતમાં આવેલ આપણા મોટાં તીર્થો જેવાં કે આબૂ-દેલવાડા, રાણકપુર, કેસિરયાજી, નાકોડાજી, કાપરડાજી વગેરે ઘણાં તીર્થોનો વહીવટ સંઘે નીમેલા ટ્રસ્ટીઓ પાસેથી લઈ લેવામાં આવશે અને સરકારે નીમેલ અને સરકારને જ આધીન કમીટી તેનો વહીવટ કરશે. આ કમીટીમાં જૈન, તેમજ જૈનેતર પણ હશે. જૈનેતરોને જૈનશાસ્ત્ર, સિદ્ધાંત, પ્રણાલિકા તથા રીતિનીતિનો શો ખ્યાલ હોય ? એવાઓના હાથમાં આ બધો વહીવટ જતાં એમાં કેટલી દખલગીરીઓ અને મુશ્કેલીઓ વધશે એની કલ્યાણ કરવી પણ મુશ્કેલ છે.

આવી રીતે વહીવટ લઈ લેવાથી બંધારણના આર્ટિકલ ૨૫ અને ૨૬ માં આપાયેલી ધાર્મિક સ્વતંત્રતાનો છહેચોક ભંગ થઈ રહ્યો છે. આ સિવાય પણ બીજી કેટલીક કલમો ટ્રસ્ટીઓના ઉપર બહુ ખોટું અને સખત નિયમન કરનારી છે.

આ પ્રકરણ અંગે રાજસ્થાનમાં એક કમીટી નિમાયાનું તથા કાયદેસર પગલાં ભરવાની કંઈક હીલચાલ થઈ રહી છે, એવું બહાર આવ્યું છે, પણ તે અંગે કોઈ સત્તાવાર નિવેદનો પત્રમાં આવ્યા નથી કે ભારતવર્ષના જૈન સંઘને તે અંગે કોઈ માહિતી નથી, એટલે જૈન સંઘની એ ફરજ થઈ પડે છે કે તેણે આ રીતે લાગુ પાડવામાં આવેલી કલમોનો સૈદ્ધાંતિક જોરદાર વિરોધ કરવો અને રાજસ્થાન સરકાર પર મોકલી આપવો. જો સ્થળે સ્થળેથી વિરોધ જશે, તો પરિસ્થિતિમાં ઘણો સુધારો થશે, એમ ભૂતકાળનો અનુભવ કહી જાય છે. આપણા પૂજ્ય આચાર્યો તથા મુનિવરોએ આ બાબતમાં સક્રિય બનવાની ખાસ જરૂર છે.

U

ટોક્સી લૂધીને મૂકો

એક વાર પૂજ્યપાદશ્રીની તરપણીમાં મેં પાણી ભર્યું અને તેના ઉપરની ટોક્સી લૂધી નહીં. ટોક્સીમાં પાણીનું એકાદ ટીપું રહી ગયું હતું. પૂજ્યશ્રીની નજર જતા તુરત મને કહ્યું : “જો આ ટોક્સી લૂધીએ નથી અને તેમાં કોઈ જીવાત આવીને ચોંટી જશે તો ! આપણા માટે એક ટીપું છે પણ સૂક્ષ્મ જંતુ માટે તો તે મોટું તણાવ છે. હવે ટોક્સીથી પાણી લીધા પછી ટોક્સી લૂધી લેવાનો ખાસ ઉપયોગ રાખજો.”

પૂજ્યપાદશ્રીની આટલી સૂક્ષ્મ કણજી જોઈને હું તો ઓવારી જ ગયો.

W

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્ક્ષ

V

ધર્મના સાચા અધિકારી બનવા માટે શાસ્ત્રે એક ‘લોકપ્રિયતા’ ગુણને આવશ્યક કહ્યો છે. આ બહુ મજેનો ગુણ છે; કેમકે આપણે જો લોકને પ્રિય છીએ તો આપણા ચિત્તમાં લોક પ્રત્યે ધર્મભાધક દ્વેષ વગેરે નહિ ઉઠે, તેમજ લોકને પણ આપણા ધર્મની અરુચિ-નિંદા કરવાનું નહિ બને. જો લોકપ્રિયતાને બદલે લોકોની આપણા પ્રત્યે અપ્રીતિ હશે તો એ અનર્થ નીપણવાનો ઘણો સંભવ છે.

આ લોકોની આપણા પ્રત્યે અપ્રીતિ હશે તો એ અનર્થ નીપણવાનો ઘણો સંભવ છે.

આ લોકપ્રિયતા કાંઈ યેનકેન પ્રકારે સારું લગાડવાથી નથી આવતી કે લોકોની ભાટાઈ કરવાથી નહિ, કિન્તુ આપણી ઉચિતવૃત્તિથી આવે છે. ઉચિતવૃત્તિ એટલે યોગ્ય જીવનવ્યવહાર, લોકોને ખરેખર વલ્લભ તે જ લાગે કે જે આજીવિકા વ્યવસાયા અને બીજી જીવનચર્ચા યોગ્યરીતે વહન કરતો હોય.

આ ઉચિત વ્યવહાર માટે દરેક પ્રસંગમાં વિવેકી સંભાષણ, વિવેકી વ્યવહાર અને શુદ્ધ નીતિ-ન્યાયભરી લેવડેવડ જોઈએ. પોતાનું જે કુટુંબી તરીકેનું સ્થાન હોય, સમાજની જવાબદારીનું સ્થાન હોય, એને યોગ્ય રીતે અજવાળવું જોઈએ. પત્નીને સંભાળો ને માતાને નહિ, કે મિત્રને સાચયો પણ સગાભાઈની ખબર પણ ન લો, એવું નહિ; બધા જ સંબંધ યોગ્ય જવાબદારી વહન કરવાપૂર્વક સાચવવા જોઈએ. કોઈના પાડોશી હોઈએ તો એના પ્રત્યે, ભલે આપણે શ્રીમંત છતાં, ખામોશ, સમવેદન અને નમ્ર ભાષા રાખીએ અને અવસરોચિત સહાય-સહકાર કરીએ. એમ જુદા જુદા સંબંધોમાં ઔચિત્ય જાળવવાનું. સધળી જીવનચર્ચા એવી વિવેકભરી ને પ્રશાન્ત હોય કે રસ્તે જનારને પણ અપ્રીય ન થઈએ. આવા વ્યાપક ઔચિત્યથી લોકપ્રિયતા ગુણ સિદ્ધ થાય છે.

આપણા ઉચિત-વિવેકી-પ્રશાન્ત વર્તન-વ્યવહારથી લોકને અપ્રીતિ કરવાનું કે આપણું યા આપણા વડેરા કે ધર્મનું ઘસાતું બોલવાને કે નિંદા કરવાને કોઈ કારણ રહેતું નથી. લોકપ્રિયતા છે કે કેમ એ એના પર મપાય છે. ધ્યાનમાં રહે કે લોકપ્રિયતા મોટા ધન-વંધા પર નિર્ભર નથી. એમાં તો કદાચ એ બહારથી મીહું

લગાડે, પણ અંદરખાને કચવાટેય હોય, લોકપ્રિયતા એટલે તો લોકના દિલમાં વસી જવું. લોકો હૃદયના કોઈ ખૂણામાં આપણી પ્રત્યે અરુચિ ન ધરે, આપણું વિરુદ્ધ કે ખરાબ ન ચિંતવે, પીઠ પાછળ ઘસાતું ન બોલે.

સાચી લોકપ્રિયતા આ છે. જ્યારે આજે તો સગી પત્ની અંગે ને પતિ પત્ની અંગે ઘસાતું બોલતા દેખાય છે. એમ ભાઈ ભાઈ અંગે, દિકરા બાપ અંગે, નોકર શેઠ અંગે... વગેરે ચાલુ છે. આમાં એ હલુદું બોલનારો જ વાંક છે એવું નથી, કિન્તુ સામાની ઉચિત વર્તનની ખામી પણ કારણભૂત છે. જીવન તો એવું ઔચિત્યથી ઉચિત વાણી-વર્તાવ-મુદ્રા અને યોગ્ય વ્યવહારથી ભર્યું ભર્યું જોઈએ કે કોઈને ય આપણી વિરુદ્ધ બોલવાનું મળે જ નહિ. પાડોશી સાથે ઉચિત વર્તાવ હોય પણ ધરમાં અનુચિત, તો વાતાવરણ બગડે. લોક કહે ‘જોયો ? ધરનાને કકળાવી પારકાને સારું મજાવવા નીકળી પડયો છે !’ એમ ધરનાને બહુ સાચવે પણ પાડોશી સાથે બગાડે તો ય લોકપ્રિયતાને બદલે લોકનિંદા પામે.

લોકપ્રિયતાની બેપરવાઈ ન કરાય. જગતમાં ગુણની કિંમત છે, ગુણ સામાના હૃદય સુધી પહોંચે છે. લોકો માથે ફૂલ ચડાવે છે, કુચરો નહિ, શરીરે ચંદન ચોપડાય છે, કાદવ નહિ. પ્રશંસા ગુણીયલ ઘોડાની થાય છે, અવળચંડા ગઘેડાની નહિ. વિજ્યવરમાળા મર્દનાગી દાખવનારને મળે છે, બાયલાને નહિ. તો મનનો નિર્ધાર જોઈએ કે ‘હું ગુણસંપન્ન બની લોકપ્રિયતા બન્યો રહું.’

લોકપ્રિય બનવા માટે અનુચિતતા ટાળવી જોઈએ. જરા જરામાં ઉકળી ઉઠવું, જે તે વાતો જ્યાં ત્યાં કહેતા ફરખું. ખમી ખાવાની વાત નહિ, તુચ્છ વર્તન કરવું, તોછી વાણી બોલવી, કોઈના ય કામમાં ન આવવું, અહંત્વ તો સાથે જ, માયા કપટનો વ્યવહાર...આ બધું અનુચિત છે. એ ટાળી મુખ-મુદ્રા-વાણી અને હૃદયમાં સૌખ્યતા, બીજા પ્રત્યે સહદ્યતા-સહાનુભૂતિ, ખામોશ, નમતા, ગાંભીર્ય, દિલાવર દિલ, નિષ્કપટ અને પ્રૌઢ વાણી-વર્તાવ, વગેરે ગુણોનો જ ખપ રાખવો. તો લોકપ્રિયતા સુલભ થાય.

લોકપ્રિયને સંકટમાં સહકાર મળે છે, સારા પ્રસંગને શોભાવનારા મળે છે, સારા માણસો પાસેથી અવસરોચિત કિંમતી સલાહ-સૂચન ને સહાય મળે છે, ઊંચા હોદ્દા કે સ્થાન લોકપ્રિયને મળે છે. લોકપ્રિયતા કેળવવામાં જ્ઞાનીની આજ્ઞાનું પાલન થાય છે..વગેરે વિચારણા લોકપ્રિય બનવા સારું પ્રેરે છે.

(‘પરમતેજ’ ભા.-૧ પરથી)

૬૬ શું શોક-ઉદ્ઘેગ એ મોટો દુર્ગુણ છે ?

શોક, ઉદ્ઘેગ એક એવી મોહિની છે કે એમાં ફસાયેલા માણસને ભાગ્યે જ લાગે છે કે ‘આ હું કોઈ મોટો દુર્ગુણ સેવી રહ્યો હું યા કોઈ મોહું પાપ કરી રહ્યો હું !’ ત્યારે હવે એનું જરા પૃથ્વકરણ કરી જોઈએ કે એની આગળ, પાછળ અને ભીતરમાં કેવા કેવા ભાવ રહેલા છે.

ચિત્ત શોકમજન બને છે, બેદમય બને છે ત્યાં પહેલું તો એ જોવું ભૂલી જાય છે કે ‘જે બગડવા પર શોક કે બેદ થાય છે એ વસ્તુ સિવાય બીજું સાંદું મને કેટકેટલું મળેલું છે ?’ એ જો જુએ તો તો એમ દેખાય કે ‘અહો ! હજ તો મારા હાથમાં આવો સુંદર મનુષ્ય ભવ છે કે જે અસંઘ કીડા પણ પંખી વગેરે જીવોને નથી મળ્યો. ઉપરાંત એમાં વળી અતિ અતિ અમૂલ્ય માનસિક વિચારણા-વિવેક-ભાવના વગેરેની શક્તિ મળી છે. બીજ પણ કેટલીય-પશુદુર્લભ મહાન પુણ્યાઈ, મહા અનુકૂળતાઓ મળી છે. ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ મળ્યા છે. હજ કાણ કાણ ઉત્તમ વિચાર-ભાવનાઓ કરી ગજબનાં પુણ્ય ઉપાર્થ શકાય એવી લાખો કાણોભર્યું આયુષ્ય મારા હાથમાં છે.’ આ બધું સાંદું જુએ તો એકાદ કાંઈ બગડેલાનો શોક શા સાંદું થાય ?

હવે જુઓ કે એમ છતાં શોક, બેદના આવેશમાં રહેનાર શું કરે છે ? જે સાંદું છે તેને જાણે કિંમત વિનાનું ગણે છે ? એનો અર્થ તો એ જ થયોને કે દેવ-ગુરુ-ધર્મ મળેલા પણ વિસાતમાં નથી ? તો શોક-ઉદ્ઘેગ શું કર્યું ? સંભવ છે દેવ-ગુરુ-ધર્મનાં પણ મૂલ્યાંકન ઓછાં કરાવ્યાં ! તો જેમ ધનનો ગાઢ લોભ બીજાનાં અવમૂલ્યાંકન કરાવે તેથી મહા દુર્ગુણરૂપ તેમ આ શોક-ઉદ્ઘેગ પણ મહા દુર્ગુણરૂપ કેમ નહિ ?

બીજું બાકીનું સાંદું મળેલું જે અરિહંત પ્રભુના ઉપકારના લીધે જ મળ્યું છે, માટે જ એમની પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જીવંત રાખવાનો છે, તે જ અરિહંત પ્રત્યે શોક-ઉદ્ઘેગના આવેશમાં કૃતજ્ઞભાવ મોળો પડવાનો; કેમકે બાકીના સારાની જો બહુ કિંમત નથી, તો એના ઉપકારકની કિંમત શી રહે ? કદરદાની શી બજાવાય ? આમ કૃતજ્ઞભાવ જે પાયાનો ગુણ છે એ મંદ પડે છે. એ મંદ પાડનાર શોક મહાપાપ કેમ નહિ ?

વળી જુઓ કે શોક, ઉદ્ઘેગના ઉછળાને લીધે ચિત્ત વિબલ રહેવાથી દેવદર્શન,

નવકાર સ્મરણ વગેરે કોઈપણ ધર્મસાધનામાં સ્થિર, તન્મય અને ઉછળતા ભાવોલ્લાસવાળું બની શકતું નથી. અર્થાતું જેવી રીતે કામાંધતા, વિષયાંધતા વગેરે ચિત્તને તન્મય બનાવી ધર્મસાધનામાં ચોટવા ન દેતા હોવાથી મહાદુર્ગુણરૂપ છે, એમ આ શોક અને ઉદ્ઘેગ પણ મહાદુર્ગુણરૂપ કેમ નહિ ?

વળી એમાં દેખાવ નીસાસાનો છે, પરંતુ સાથે બગડેલી વસ્તુ પર દિલમાં કેટલું ગાઢ મમત્વ ને આંધળો રાગ છે ? તો એ બગાડનાર પર લેશ્યા કેવી ખરાબ થવાની ? એમાં સામા પર વૈરવૃત્તિ ય જાગે, દ્વેષની આગ પણ વરસે, એનું કાંઈ બગડે એમાં રાજ્યો ય આવે, અને કદાચ એનું બગાડવાના ય વિચાર આવે. આવું બધું જે શોક-ઉદ્ઘેગમાં થાય એ મહાપાપ નહિ ?

એમ બગડેલી વસ્તુ પર વધારે પડતો રાગ હતો, દા.ત. પૈસા પર કે કાયા પર, અને હવે એ ખોવા-બગડવા પર ઉદ્ઘેગ થાય છે, શોક થાય છે, એટલે બાકી બચેલપૈસા કે કાયાની શક્તિથી સુકૃત કરવામાં કસર કરવાનું મન થશે,- ‘પૈસા પડી ગયા છે, હમણાં દાન-બાન ઓછું કરો, કાયા દુબી પડી છે, હમણાં ધર્મની દોધામ ઓછી કરો’; એ કરાવનાર કોણ છે ? શોક અને ઉદ્ઘેગનો આવેશ. તો સુકૃત ભૂલાવનાર બીજ પાપ બુધ્યની જેમ આ શોક-ઉદ્ઘેગ પણ પાપિણ ખરા કે નહિ ? આ બધું વિચારી શોક કે બેદને પડખે ન ચડવું.

U દેહાધ્યાસથી સદા દૂર V

સુરતમાં ડૉ. મુકરજીએ કહું છતું કે મહારાજજીને મગજમાં પાણી ભરાય છે તેથી શરીરની સમતુલા ચૂકી જવાય તેવી શક્યતા છે માટે એકલા ઊભા થવું નહિ. ડૉક્ટરની આવી સૂચના છતાં રાત્રે બીજાની ઊંઘમાં ખલેલ ન પડે માટે ઘણીવાર જતે જ ઊભા થઈ જતા, અને પ્રતિકમણ પણ ઊભા ઊભા જ કરતાં.

પેરાલીસીસના એટેક વખતે સુરત હોસ્પિટલમાં દાખલ કર્યી ત્યારે ડૉક્ટરની સૂચનાથી પલંગ ઉપર સૂવાડચા પણ તેઓશ્રીને તે જરા પણ ન રુચ્યું. પલંગ કઢાવીને તેના સ્થાને પાટ મૂકાવી, પાટ ઉપર જ તેઓશ્રી સૂતા.

કેવો અદ્ભૂત વિજય હતો પૂજ્યશ્રીનો દેહાધ્યાસ ઉપર !

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર X

૬૦ જહેર નમ્ર વિનંતી

“-એ લોહીનો વેપાર અને લોહીનો રોટલો ભારતને નથી ખપતો”

ભૂતકાળમાં કદીય ન હતો એટલો ભય ભારતીય સંસ્કૃતિ પર આજે તોળાઈ રહ્યો છે.

ભારતે ધણાં આકમણો જોયાં, રાજ્ય પલટા અને રાજકીય પરિવર્તનો જોયાં, પરધમીઓનાં શાસન પણ જોયાં, પરંતુ ક્યારેય દેશનાં વિકાસ યોજનાના અંગ તરીકે લોહીનો વેપાર શરૂ કરવાનું ભારતે વિચાર્યું પણ હોય, એવું બન્યું નથી.

અહિંસા એ ભારતનું બીજું નામ છે. ભારતનાં તમામ ધર્મોની ભાવનામાં અહિંસાનો રણકાર છે. જીવદ્યા એ ભારતીય સંસ્કૃતિનો ધબકાર છે.

ધર્તીનાં પટ પર કદાચ આ એક જ એવો દેશ છે કે જ્યાં ગ્રાણીમાત્ર પ્રત્યેની દયા, અનુકૂળ લોકોના જીવન વ્યવહાર સાથે વણાઈ ગયેલ છે. જ્યાં પશુ-પક્ષીઓ સાથેનાં સંબંધો કદી પૈસાં અને લાભની દાખિએ જોવાયાં નથી. આ દેશનાં માનવોની અર્થ રચનામાં, ગાયને ધાસ, કુતરાને રોટલો, પારેવાને જાર, કીડિને લોટ-ખાંડ, વાંદરાને ચણા, માછલાને દાળીયાનો હિસ્સો જળવાતો આવ્યો છે. ભાવનાની ઉદાત્તતા તો એ છે કે ભારતીય જીવ-દયા કેવળ ઉપયોગી પશુ-પક્ષીઓ પૂરતી જ મર્યાદિત નથી, એ તો સર્વ જીવોને પોતાનો વિષય બનાવે છે.

ભારતીય સંસ્કૃતિની પરાકાણા તો એ છે કે પશુ-પક્ષીઓને દયાથી જીવાડતા હોય તેવા ભાવથી ભારતે કદી વિચાર્યું નથી. પશુ-પક્ષીઓને દેવ દેવીનાં વાહન કલ્પી, પૂજ્ય દાખિએ નિહાળ્યાં છે. નિર્બળ-મૂંગા-અજ્ઞાન પશુ-પક્ષીઓને મારવામાં ભારતે અર્ધમ માન્યો છે, ગૌ પૂજા-નાગ પૂજાને તહેવારોમાં ગૂંઠી ભારતીય ભાવનાને ચિરસ્મરણીય બનાવી છે.

ધરડાં અપંગ મા-બાપને પાળે એટલા પ્રેમથી અને ચીવટથી ભારતે ખોડાઢોરની પાંજરાપોળો નિભાવી છે.

ભારતે જીવન વ્યવહારમાં પશુ-પક્ષીઓને ક્યાંય ઓદ્ધું-ઉદ્ધું સ્થાન આપ્યું નથી. પશુ-પક્ષીઓનાં રક્ષણ-માવજત-સંવર્ધન અને પાલનનાં કાયદાઓમાં ભારતનો વિશ્વમાં વિકિ છે. ભારત એથી જ ઉન્નત છે.

નિર્બળ અને આશરે રહેલાને મારવામાં ભારતે સદાય હિણપત માની છે.

અરે ! શિકારીની ઝપટમાંથી છૂટી-ગુડીને ખોળમાં ફફડાટથી પડેલા તેતર પક્ષીને શિકારીને પાછું ન સોંપવા ખાતર પોતાના પુત્રોને ધર્મયુદ્ધે પ્રેરનાર માતાઓ આ દેશમાં જન્મી છે.

ભારતનો ઈતિહાસ આવી ગૌરવ ગાથાઓથી ભરપૂર છે.

“દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરબ હવે તું હિન્દુસ્તાન” એ સૂત્ર તો હજુ તાજૂજ છે. માનવીઓ સાથે એકમેક થઈને પશુ-પક્ષીઓ ભારતમાં નિર્ભયતાથી જીવતાં આવ્યાં છે. ભારતના તમામ લોકપ્રિય શાસનકારો દરમ્યાન પશુ-પક્ષીઓની હિંસાનો પ્રતિબંધ કરતાં કાયદાઓ થયાં છે. એ ભાવનાનાં સીમાચિન્હ સમું અશોક ચક આજે પણ આપણાં રાષ્ટ્રધ્વજ અને રાજ્ય મુદ્રામાં અંકિત છે, અને તે એટલા માટે કે ભાવનાનાં સ્મલનની કોઈ નબળી પળે એ મુદ્રા આપણને પ્રેરક અને બોધક બને.

ભારતીય ભાવનાનાં સ્મલનની પળ આજે ઉભી થઈ છે.

જે ભારતમાં “ગોબ્રાલ્ભા પ્રતિપાલ”નાં ઈલ્કાબો અપાતા એજ ભારતની ધર્તી પર, મહારાષ્ટ્રને આંગણે, મુંબઈથી આશરે ૧૮ માઈલ દૂર થાણાખાડી વિસ્તારમાં ચેમ્બુર નજીકનાં દેવનાર ગામે એકસો છવીસ એકર જમીન પર, અંદાજ રૂપીઆ બે કરોડનાં ખરચે, તેન્માર્કના નિષ્ણાતોની સલાહ મુજબનું, માત્ર છ કલાકમાં જ આશરે છ હજાર ગ્રાસો પશુઓને રહેસી શકે તેવું - રાક્ષસી યાંત્રિક કલખાનાં, ભારતની વિકાસ યોજનાના એક ભાગ તરીકે શરૂ કરી, પશુઓનાં હાડમાંસ-જીબ-ચામડા, આંતરડા, વગેરેની પરદેશી પેઢીઓનાં સહકારથી નિકાસ દ્વારા, અર્થ ઉપાર્જન કરવાનું આપણી ભારતીય સરકાર-મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ કોર્પોરિશને સંયુક્ત રીતે વિચાર્યું છે.

આ ગોઝારા મહા પાપયજનો ઠરાવ પ્રાથમિક કક્ષાએ થયો છે એથી હજુ કાંઈ બગડી ગયું નથી.

આ યોજનાનો આ ત્રીજો ઉથલો છે.

સને ૧૯૮૨માં પહેલી વાત ઉપડી, વિરોધ થયો. વિરોધથી વાત પડતી મૂક્ખી પડી. સને ૧૯૮૩માં ફરી ઉપડી, ત્યારે પણ એમજ બન્યું. આજે એ વાત ફરીને ઉભી થઈ છે.

સને ૧૯૮૪-૧૯૮૫માં આપણે પરાધીન હતાં, આજે સ્વાધીન છીએ. બાપુ ચીથા માર્ગ જનારું રાજ્ય એ વખતે ન હતું, અશોકયકુનું ચિન્હ અને ‘સત્યમેવ જ્યતે’નું પ્રેરક સૂત્ર એ વખતે રાજ્ય મુદ્રામાં અંકિત ન હતાં, પંચશીલનાં સિદ્ધાંતો

હુનિયાને બેટ કરી શકે એવું ભારતનું આગવું ગૌરવવંતુ સ્થાન પણ હુનિયામાં ન હતું. એ વખતે પણ પડતા મુકાયેલા વિચારને પુનર્જીવન આપવાની કુબુદ્ધિ આજે સૂઝી છે.

ભારત મરતાં શીખ્યું છે. મારવાનાં પ્રકરણો હજુ ભારતનાં ઈતિહાસમાં લખાયા નથી. શીલ, ધર્મ, ગૌરવ અને આબરું કરતાં ભારતે પૈસાને કદી ઘારો ગણ્યો નથી. જીવનનાં ઉમદા તત્ત્વોના લિલામ ભારતે કદી નિહાળ્યા નથી. ભારત નામ સાથે જેને નિસબ્ધત હશે, એવા કોઈ ભારતવાસી નહીં હોય કે આવા કલંકને આવકારે. આવી પતનની પરાકાણાની હિમાયત કરનાર ગમે તેટલો મહાન હોય તો પણ તે બહારથી ભારતવાસી છતાં અંતરથી પરદેશી જ છે.

આવા કતલભાનાની હિમાયત કરનારા ભારતનાં કુલદીપકો એક વાર જાહેર કરો અને કહો :-

કહો કે :- રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈશ્વર, મહમદ, નાનક, ગાંધી વગેરે યુગપુરુષો અમારા કરતા ઓદ્ધું જાણતાં હતાં.

કહો કે :- એવા પુરુષોએ પ્રબોધેલા હુનિયાનાં બધા ધર્મો ધતીંગ છે. માનવ જીવન સાથે અને લેવા દેવા નથી.

કહો કે :- લોકોની ધર્મ ભાવનાને અનુરૂપ હિંસાનો પ્રતિબંધ કરનારા કુમારપાળ, અશોક, અકબર વગેરે શાસનકર્તાઓ નિર્બણ અને સમજ વિનાનાં હતાં.

કહો કે :- અહિસાનાં ગાણાં એ ફટાણાં છે.

કહો કે :- પૈસો મેળવવા માટેની કોઈ પ્રવૃત્તિ પાપ નથી, પાપ હોય તો પરવા નથી, લાંઘન હોય તો શરમ નથી.

કહો કે :- પૈસા કરતાં ધર્મને પ્રાધાન્ય આપનાર આપણા વડવાઓ મૂર્ખ હતા, પદ્ધત હતા.

કહો કે :- ભારત ખેતીપ્રધાન દેશ નથી, પશુધનની ભારતને જરૂર નથી.

કહો કે :- નિર્બણ પશુઓને મારવામાં મર્દનગી છે.

કહો કે :- પશુ જીવનને રક્ષણ આપતી આપણાં બંધારણની કલમ ૪૮ નકામી છે.

કહો કે :- આ કતલભાનું નહીં થાય તો ભારત પર કટોકટી આવી પડવાની છે.

કહો કે :- આ મહાન રાષ્ટ્રીય નિર્ણય છે.

કહો કે :- ઓછામાં ઓછા સમયમાં અને વધુમાં વધુ પ્રમાણમાં મુંગા પશુઓને મારવાનો આ મહાઉદ્યોગ-એ અમારો રાષ્ટ્રીય ઉદ્યોગ છે, એ અમારો મહાન વિકસન છે.

કહો કે :- લોહીનાં વેપાર જેવો ગૌરવવંતો બીજો કોઈ વેપાર નથી.

કહો કે :- લોકલાગણીને પરધર્મી અને પરદેશી શાસનમાં જે સ્થાન હતું તે આજે નથી.

કહો કે :- ધર્મ ભાવના જેવી કોઈ વસ્તુ નથી. હોય તો અમે એ રહેવા દેવા માગતા નથી.

કહો કે :- દેવનારનું કતલભાનું એ ભાખરાનાંગલ જેવું રાષ્ટ્રીય તીર્થ છે. અમારી પંચવર્ષીય યોજનાનો આ નીચોડ છે.

કહો કે :- આજે અમને કોઈ કહેનાર નથી, અમે બેફામ બન્યા છીએ, ભારતીય આબરુનાં ચીર અમારા હાથે જ અમે ખેંચવા માંગીએ છીએ.

એમ ન હોય તો કરોડો આશ્રયે રહેલાં મુંગા, અજ્ઞાન, નિરાધાર, પામર પશુઓનાં લોહી છાટીને રોટલા ખાવાનો ભાવ ન થાય; ભારતીય ભૂમિમાંથી પશુધનનાં નાશનો આવો પરશુરામી નિર્ણય ન થાય.

આવો આકરો નિર્ણય લીધો છે ત્યારે આ કહેવું પડે છે.

દીલમાં દ્યા હોય તો કરગરીને કહીએ છીએ, મનમાં અભિમાન હોય તો નમીને કહીએ છીએ, હૃદયમાં સાચું સમજવાની દણ્ણ હોય તો પોકારીને કહીએ છીએ કે આ પાપનો માર્ગ છે. પતનની પરાકાણા છે. કૃપા કરી પાઢા વળો. જીવો અને જીવવા દો. એ લોહીનો વેપાર અને લોહીનો રોટલો ભારતને નથી ખપતો.

ભારતીય સંસ્કૃતિમાં માનનાર તમામ ભારતવાસીઓનો આ અંતરનાદ છે, એની નોંધ લેશો.

લિ. ભારતીય સંસ્કૃતિના ચાહક
શાહ રત્નલાલ જીવનલાલ અભજીભાઈનાં
જ્યાહિન્દ (વઠવાણ)

૭૧ પ્ર.- જીવનમાં ધર્મની શી જરૂર છે ?

૩.- જીવનમાં જેટલી સુખની જરૂર છે એટલી જ ધર્મની જરૂર છે; કેમકે સુખ ધર્મથી જ મળે છે. ‘સુખ ધર્મથી, દુઃખ પાપથી’- ‘સુખ ધર્મત દુઃખ પાપાત્મ’ આ સનાતન સત્ય છે. ધર્મ પરલોકને તો સારો કરે છે, ઉપરાંત અહિ પણ સુખ દેખાડે છે; કેમ કે સુખ અંતરના અનુભવની વસ્તુ છે, અને તે ધર્મથી જ થાય છે. સુખ બાધ્ય પદાર્થોનો ધર્મ નહિ એટલું ધ્યાનમાં રહે; કેમકે બાધ્ય ધનના ઠગલા હોવા છતાં પણ ચિત્ત જો કોઈ ચિત્તાથી સંગળી રહ્યું હોય તો સુખ શું ? ટૂંકી બુદ્ધિવાળા માને છે સુખ ધનમાં છે, સ્ત્રીમાં છે, મેવા-મીઠાઈમાં છે, માન-પાન અને સત્તા-સાહ્યબીમાં છે, પણ જગતમાં જુઓ તો દેખાય છે કે કેટલાકને ધનમાલ ઓછા છે છતાં વધારે સુખી છે, અને કેટલાકને વધારે છે છતાં એમની પાસે સુખ-શાંતિ ફરકતી નથી. બીજી વાત એ છે કે જો સુખ ધનમાલનો ગુણ હોત તો ધન આદિની અધિકતામાં સુખનો અનુભવ વધત, પરંતુ એક-બે લાડુ ખાતાં સુખ થાય છે, પણ અધિક ખાવામાં આવતાં ઊલટી જેવું થાય છે. એક પણી કરીને જે સુખ લાગે છે તે સુખ બે, ત્રણ કરવા જતાં વધવાને બદલે ઊલટું ઘટી જાય છે. તો સુખ એમાં શાનું કહેવાય ? એકની એક ચીજથી પોતાને સુખ અને બીજાને દુઃખ લાગે છે. તેમ પોતાને એક વસ્તુ એકવાર સુખરૂપ અને પછી દુઃખરૂપ લાગે છે. તો ચીજ-વસ્તુમાં ચોક્કસ સુખ કે દુઃખ શું ? કશું નહિ. સુખ એ બાધ્ય વસ્તુનો ધર્મ નથી; એ તો આત્માની ચીજ છે. પરંતુ એ ત્યારે જ અનુભવમાં આવે છે કે જ્યારે કોઈ ચિંતા ન હોય, ભય ન હોય, સંતાપ નહિ, અંજંપો ન હોય, પરંતુ નિશ્ચિતતા હોય, નિભયતા હોય, શાંતિ હોય, મસ્ત અને માતબર હોય ધર્મ આ સ્થિતિ ઊભી કરી આપે છે. એટલે પછી જેમ વન વગડામાં અત્યંત ભૂખ્યાને સુકો રોટલો પણ મહા આનંદ આપે છે, તેવી રીતે ધર્મતામને દુન્યવી સામાન્ય સંયોગમાં પણ મહાન આનંદ રહે છે, જેમ કે સાધુ મહર્ષિને. ઉપરાંત ધર્મ એ એવા પુણ્યના થોક આપે છે કે જીવને પરભવમાં સારી દેવ-મનુષ્યાદિ ગતિ, સારું કુળ, આરોગ્ય ઋષિ, સમૃદ્ધિ અને ધર્મસામશ્રી આપે છે. બસ, અને ભવિષ્યમાં સુખ જોઈએ છે, તો ધર્મ આરાધવાની ખાસ જરૂર છે. કહ્યું છે :

વ્યસનશતગતાનાં કલેશરાગાતુરાણાં ।

મરણભયહતાનાં દુઃખશોકાર્ડિતાનામ् ।

જગતિ બહુવિધાનાં વ્યાકુલાનાં જનાનાં ।

શરણમશરણાનાં નિત્યમેકો હિ ધર્મઃ ॥

સેંકડો સંકટ પ્રાપ્ત થયેલાને, કલેશ અને રોગથી પીડાતાને, મરણના ભયથી વિહૃવળ બનેલાને, દુઃખ શોકથી દુઃખિતાને, અનેક પ્રકારે આકૂળ-વ્યાકૂળ લોકોને અને નિરાધારને જગતમાં હંમેશા એક માત્ર ધર્મ જ શરણભૂત છે.

U

અજબ-ગજબની ચતના

V

સૂરિમંત્રનો જાપ કરતાં પહેલા પાણીથી હાથ-પગની શુદ્ધિ કરવી પડે. તેઓશ્રી જાપ કરવા બેસે તે પહેલા અમે તેઓશ્રીના હાથ-પગ પાણીથી શુદ્ધ કરી આપીએ. એકવાર હાથ-પગ ધોવા મેં સહેજ વધારે પાણી લીધું. તરત પૂજ્યશ્રી બોલી ઉઠ્યા :

“અરે, આ શું કર્યું ? આટલું બધું પાણી લેવાનું ? અસંખ્ય જીવોના કચ્ચરઘાણ બાદ આ પાણી આપણાં માટે બનતું હોય છે ! વળી, પગ એકદમ ઘસીને સાફ કરીએ એટલે વિભૂષા પોષાય... આ રીતે પગ સાફ કરવા હોય તો ઊભો થઈ જા. હું મારી જાતે સાફ કરી લઈશ.”

પૂજ્યશ્રી કહેતા કે માત્ર પા (૧/૪) ખોબો પાણી લઈને બંને હાથ ઘસી બંને પગ પર લગાવવાથી શુદ્ધિ થઈ જાય. પગે લગાવતી વખતે હાથ ઉપરથી નીચે લઈ જવાનો, જેથી નીચેનો મેલ ઉપર ન ચડે. પછી રોજ એ રીતે માત્ર ૮ થી ૧૦ ટીપાં પાણીથી બંને પગ સાફ કરાવતાં.

પગ સાફ કર્યી બાદ અમે કપડાથી પગ લૂછવા જઈએ ત્યારે ઘસીને લૂછવાની ના પાડે. માત્ર કપડું અડાડોને પાણી લૂછી લેવાનું કહેતા. પૂજ્યશ્રી કહેતા કે - ઘસીને લૂછવામાં શરીરમાં મેલ નીકળી જાય, મેલ તો સાધુનો અલંકાર છે. લૂછવાનું એ રીતે કે પાણી ચુસાઈ જાય અને મેલ ન નીકળો.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

(૭૨) બીજાને સારું મનાવવાના પાપમાં

“મુખ બોલ્યો મીઠી વાણી, ધન કીસું ધૂળધાણી, જીતી બાજી ગયો હારી રે”...

કવિની આ ઉક્તિમાં ગંભીર ચેતવણી ભરી છે. માનવને વાણીની મહાકિંમતી લબ્ધ મળેલી છે, જેના પર એ ઐહિક અને પારલોકિક અને અનર્થોથી બચી શકે અને અનેક સિદ્ધિઓ મેળવી શકે; પરંતુ તેનો દુરુપયોગ ન થાય અને સદુપયોગ થાય તો જ.

વાણીનો દુરુપયોગ થવામાં અજ્ઞાન, અવિવેક, અહંત્વ, આવેશ, અપરિમિતતા, વગેરે અનેક કારણો છે, એમાં એક કારણ બીજાને સારું મનાવવાની કાયમી લાલસા છે. અલબજ્ઞ આનો અર્થ એ નથી કે ત્યારે બીજાને સારું લાગે એવું બોલવું જ નહિ; ના, આ કહેવું નથી. કિન્તુ કહેવાનું એ છે કે ગમે તે ગમે તે રીતે બીજાને સારું મનાવ્યા કરવું પછી ભલે એ માટે જુદું બોલવું પડે, નિંદા કરવી પડે, આપ બડાઈ ફૂટવી પડે...વગેરે, આ અનુચ્છિત છે, ખતરનાક છે. અહંત્વ અને માનાકંશા પોષી અવનતિ તરફ એ જીવને ઘસડે છે.

મૂળમાં, ગમે તે પ્રકારે બીજાની દિલ્લિમાં સારા લાગીએ, વહાલા લાગીએ, એ વૃત્તિ અનેક અનર્થો મચાવે છે, મોટા ભાગે એ ‘બીજાઓ’ અજ્ઞાન છે, મોહમૂઢ છે, એવાની દિલ્લિમાં આપણે વાતે વાતે સારા લાગીએ માટે, એ જો નિંદા શરૂ કરે છે તો, એમાં ટાપસી પૂરવી પડે છે, અગર આપણી પાસે આવી બેઠા છે તો એવી વાતો કરવાની થાય છે કે જે લગભગ કુથલી હોય, વિકથા હોય કોઈની નિંદા, ઘસાતું બોલવાનું હોય. કેટલીકવાર એ બીજાઓ આગળ પોતાની હોશિયારી, સત્તાધીશતા વગેરે દેખાડ્યા પેલાના દેખાતાં જ પોતાના કુટુંબી, કે નોકર વગેરેને ધમકાવવાનું કે ઉતારી પાડવાનું થાય છે. શા સારું આ બધું? બીજા માને કે આ સારા છે. હોશિયાર છે, એટલા માટે જ ને?

ત્યાં એ વિચાર નથી રહેતો કે, ભલે કદાચ એણે આપણને સારા માન્ય પણ પછી કંઈ ઈનામ પરખાવું? પાંચ પેસા આપી જશે? સંકટમાં સહાય કરશે? બિમારીમાં સેવા કરવા આવશે? સદ્ગતિ નક્કી કરી આપશે? ના, આમાનું કશું જ નહિ, ત્યારે બીજી બાજુ જે આપણે નિંદા સાંભળી કે કરી, એનું પરિણામ જેની

નિંદા કરી તેને જો સામો જ કે બીજો કોઈ કહી આવશે તો આપણે એક વિરો ઊભો કર્યો સમજો. તેમ કદાચ ન બન્યું. તો પણ આપણને નિંદાની કુટેવ દઢ થશે, દિલમાં બીજા ગ્રત્યે દ્વેષ અને આપણી જત માટે ઉત્કર્ષ-અહંત્વ થશે, એના ગ્રત્યાધાત આ જીવનમાં ય બીજી પ્રવૃત્તિઓ પર ખરાબ પાડવાના! અને પરલોકમાં ય નીચ ગોત્ર, દેઢ-ભંગી-તર્યાર્યાના અવતાર સાથે બીજા કેટલાય દુઃખ મળવાના! ત્યારે કુટુંબીઓ કે નોકર વગેરેને ખોટા ધમકાવવા-ઉતારી પાડવામાં તો એ જ જે આપણા હુંમેશના ઉપયોગી છે. સહકારી છે. એમના હૃદય ભાંગવાનું, ને એમને દુર્ભાવ કરવાચી વિરોધી બનાવવાનું થવાનું. તેમ બીજાને સારું મનાવવા ખાતર કુથલી-વિકથા કરવામાં કેટલાય પોષાવાના! ઉપરાંત પરમાત્મ સ્મરણ-શાસ્ત્ર-વાંચન-સત્સંગ વગેરે મહાકિંમતી સદુપયોગને યોગ્ય માનવકાળ બરબાદ થવાનો.

ઉપરોક્ત કવિવચન એ કહી રહ્યું છે કે મુખથી બીજાને મીહું મીહું લાગે એવું બોલ્યે ગયો, પરંતુ એમાં બે કિંમતી ધન ધૂળધાણી કર્યા, એક તો પૂરવનું પુણ્ય ધન, અને બીજું ઉચ્ચ સદુપયોગ કરવા મળેલ વિશિષ્ટ વાણી, મન અને કાયાની શક્તિઓરૂપી ધન, એ બેને બરબાદ કર્યી. પરિણામ એ આવીને ઊભું કે માનવ જીવનમાં જે આ ઉચ્ચ શક્તિઓ અને પૂર્વની પુણ્યાઈ સાથે દેવ-ગુરુ-ધર્મનો યોગ મળ્યો હતો તે તો જીવનરૂપી બાજી જિતી જવાનો યોગ હતો, પરંતુ એના દુરુપયોગથી બાજુને હારી જવાનું થાય છે. એકેન્દ્રિયપણાં અને કુદ્ર જંતુની યોનિઓમાંથી જીવનબાજી જિતતાં જિતતાં ઊંચે ચઢી ડેઠ માનવયોનિના જીવન સુધી આવી પહોંચ્યો પણ હવે જીવનબાજી હારી જઈને પાછું નીચે હલકી તિર્યાચ્યોનિઓમાં પટકાઈ જવાનું થાય છે. આ બીજા, બીજા કારણો એ તો બને જ છે, પણ ગમે તે રીતે બીજાને સારું મનાવવાના પાપે પણ બને છે.

એટલે સારું એ છે, કે માણસ જો બીજાને વાતે વાતે મનાવ્યા કરવાનું છાડી જાતે સારા કેમ બનાય એનો વિચાર અને વર્તાવ રાખે તો ઉપરોક્ત અનર્થોથી બચી શકે.

૬૩ ધર્મ-ઉત્સાહ કેમ વધે ?

આજે કેટલાય માણસોની ફરિયાદ રહે છે કે, અમને ધર્મનો ઉત્સાહ કેમ વધતો નથી ? રોજંદી કુળાચાર પ્રમાણેની ધર્મપ્રવૃત્તિ કરીએ છીએ ખરા, પણ એવો ઉલ્લાસ નથી દેખાતો કે ‘લાવ આ ધર્મ કરું, તે ધર્મ કરું’ આનું શું કરવું ?

ધર્મમાં ઉત્સાહ વધારવા માટે આમ તો અનેક ઉપાય યોજવા જરૂરી છે; જેમ કે -

(૧) સત્સંગ બહુ સેવવો, સાધુ પુરુષોના સમાગમમાં રહ્યા કરવાથી પહેલું તો ધર્મનું વાતાવરણ વારંવાર મનપર આવ્યા કરે છે, અને બીજું એ કે એમની પાસેથી ધર્મની વાતો, તત્ત્વની વાતો અને મહાપુરુષોના જીવન પરાક્રમ સાંભળવા મળ્યા કરે છે, એ બધું પાછું વાગોળવું. ઉપરાંત,

(૨) સારાં ધાર્મિક શાસ્ત્ર પુસ્તકનું વાંચન જરૂરી છે. આ વાંચન પણ એમજ ગબડાવી જવાનું નહિ, કિન્તુ વાંચનમાંથી નોંધ કરતા જવાનું અને આગળ આગળ વાંચવાનું. આ નોંધ રોજ એકવાર જોઈ વિચારી જવાની.

(૩) એથી આગળ જયારે સારું વાચન અને નોંધની ઉપસ્થિતિ થઈ જાય એટલે વિચારશક્તિ વધે, પછી એ વાંચનના આધારે કાંઈક નિબંધરૂપે લખવાનું. એ લખતાં લખતાં નવી નવી સ્હુરણા થશે. આમાં એ ધ્યાનમાં રાખવાનું કે એ સ્હુરણા શાસ્ત્રબાધિત ન હોય, જૈન માર્ગના વિરોધમાં ન હોય. આમ વાંચન-લેખનથી મન પર ભારે જવાબદારી આવે છે કે ‘આ હું શું લખી રહ્યો છું ? કોના માટે લખી રહ્યો છું ? મને લાગુ પડે છે કે નહિ ?..., વગેરે એથી ધર્મ-ઉત્સાહ વધે છે.

(૪) વળી ધાર્મિક ભિત્રોનો સંસર્જ-પરિચય રાખવો. એમાં નિદા, કુથલી, વિકથા, ગામગપાટા ન ચાલે એ તકેદારી રાખવી, નહિતર એ સંસર્જ છોડી દેવો.

(૫) ભાવપ્રેરક તીર્થોની યાત્રા અને ધર્મ-ઉત્સવોમાં હાજરી પણ ધર્મમાં ઉત્સાહ વધારે છે.

(૬) કુટુંબીઓને, સોહિઓને ધાર્મિક બનાવો, વૈરાગ્યજનક દુન્યવી કોઈ પ્રસંગો, મહાપુરુષોનાં ચરિત્ર ધર્મ અને તત્ત્વની વાતો કહેતા રહેવું. એથી ધર્મમાં ઉત્સાહ વધે છે, મન પર ભાર આવે છે.

(૭) અનિત્ય, અશરણ વગેરે ભાવનાઓ ભાવવાનો ખૂબ અભ્યાસ રાખવો.

(૮) ભગવાન આગળ ખરા દિલથી આત્મઈકરાર કરવો, દિલનાં આધ્યાત્મિક દર્દ રોવાં અને ગદ્યગદ બની ધર્મ ઉત્સાહની પ્રાર્થના કરવી.

આમ અનેક ઉપાયો યોજવા જરૂરી તો છે જ;

(૯) પરંતુ એક વિચાર આ કરવા જેવો છે કે આપણને એહી જે માનવભવ, પંચેન્દ્રિય પદૃતા, આરોગ્ય અને ખાનપાનાદિની અનુકૂળતાની પુણ્યાઈ મળી છે, તેમજ જે વિશિષ્ટ મન-વચન-કાયાની શક્તિ મળી છે, અને સંસારના ચરણે આંખ મીચીને અર્પિત કરતા રહીએ છીએ તો શું એ અનુપમ પુણ્યાઈ અને શક્તિઓ ઉપર સંસારનો અધિકાર છે ? અને દેવ-ગુરુ-ધર્મનો અધિકારજ નથી ? ભૂલવા જેવું નથી કે એ બધું દેવ-ગુરુ-ધર્મના પ્રતાપે જ મળ્યું છે.

વિષય કષાયમય સંસારના પ્રભાવે નહિ. તો જે દેવ-ગુરુ-ધર્મનો એ મળવામાં અનન્ય અને અતુલ ઉપકાર છે, એવા ઉપકારે મળેલું અપકારી સંસારના ચરણે ધરવાનું કે ઉપકારીના ચરણે ?

વળી, દેવ-ગુરુ-ધર્મ મહાગુણિયત્વ છે એ દણિએ પણ ગુણીના ચરણે આપણી પુણ્યસામગ્રી અને શક્તિઓનાં અર્પણ કરવા ઉલ્લાસ રહેવો જોઈએ. બસ, આ વિચાર જોઈએ કે ‘સંસારના ચરણે તો મેં અનંતાકાળ હોયશું, એહી પણ આજ સુધી હોયે રાખ્યું, હવે તો મારા દેવ-ગુરુ-ધર્મ દીધેલી પુણ્યાઈ અને શક્તિઓ એમનાં ચરણે અર્પિત કરું.’ આથી ધર્મ-ઉત્સાહ વધશે.

U

કગલે કગલે દદ્યા

V

સુરત ચાતુર્મસમાં તિથિના દિવસે બાજુના દેરાસરમાં ચૈત્યપરિપાટી કરવા ગયા હતા. પાછા વળતાં પગાણિયામાં પ્લાસ્ટિકની પાણીની ટચૂબ હતી. એ પગાણીયું આવ્યું કે પૂજ્યશ્રીએ પગલું મોટું ભરીને ટચૂબને ઓળંગી લીધી. સાથે રહેલા શ્રાવકે પૂજ્યશ્રીને : “ગુરુદેવ ! ટચૂબ પર પગ મૂક્યો હોત તો શું વાંધો હતો ?”

“પગ મૂકવાથી ટચૂબ દબાય અને પાણીમાં રહેલા જીવોને કેટલી કિલામણા થાય... વિરાધના થઈ જાય.”

પૂજ્યપાદશ્રીની સૂક્ષ્મ દદ્યા જોઈને પેલા શ્રાવક સ્તબ્ધ બની ગયા.

W

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

૭૪ મૃત્યુ સુધારવા શું કરવું ?

અંતકાળે મન બગડે તો ગતિ બગડે છે, પછી ભલે પૂર્વ ધર્મસાધના કરી પણ હોય. પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં થયેલ શ્રાવક નંદમણિ માટે પાછળથી મન બગડું તો મરીને દેડકાનો ભવ પામ્યો. એટલે આ લક્ષ અત્યં જરૂરી છે કે અંતકાળે મન ન બગડે.

ત્યારે પ્રશ્ન એ છે કે મન શી રીતે ન બગડે ?

આ રીતે જીણવા માટે પહેલાં એ જુઓ કે મન બગડે છે ?

મન બગડવાનું કારણ એ, કે કોઈ ને કોઈ તકલીફ આત્માને પીડી રહી છે, ચાચ્ય તે શારીરિક હોય, યા માનસિક હોય. માનસિક તકલીફનાં કારણ ઘણાં, પૈસાની ચિંતા, પત્નીની ચિંતા, પુત્ર-પુત્રીની, પરિવારની, આબરુની, અપજશ, અપમાન...આવી કોઈ ને કોઈ ચિંતા-પ્રતિકૂળતા-વિટંબણા એ કારણ છે. એ મન પર વસી જાય, મનનો કબજો કરી લે તો માનસિક તકલીફ ઉભી થઈ મન બગડે છે અને જીવનભર એ કારણોએ મન બગડયા કર્યું હોય, પછી અંતકાળે કોઈ ને કોઈ કારણ તો મળી જ રહે છે, એટલે મન કેમ નહિ બગડે ?

બીજી વાત એ છે કે શારીરિક કોઈ કષ, કોઈ રોગ, અશક્તિ વગેરે પણ તકલીફ વિના મૃત્યુ બેટી જાય એ કોઈ વિરલાને ! બાકી તો અશક્તિ, રોગ વગેરેનો સંભવ ઘણો; અને એથી મન બગડતાં વાર ન લાગે.

હવે એ જોવાનું છે કે આવી સ્થિતિ હોય છતાં પણ મન ન બગડે એવો કોઈ ઉપાય છે ? અહીં પણ એ જુઓ કે જીવનભર નાની નાની તકલીફો પર પણ મન બગડવાનો અભ્યાસ છે એટલે સહેજે મૃત્યુ વખતની ભારે તકલીફ પર મન બગડવું બહુ સંભવિત છે. એથી એ માર્ગ નિકળે છે કે જીવનભર એથી ઉલ્લો અભ્યાસ રાખીએ, જેથી અંતે પણ આનો જ અનુભવ રહે. ઉલ્લા અભ્યાસમાં એ આવવાનું પ્રારંભમાં બહુ કુદ્ર તકલીફ, અગવડ, પ્રતિકૂળ બાબતમાં એવી આંતરિક સહિષ્ણુશક્તિ કેળવીએ-ગ્રાગટાવીએ કે એ નજીવી વસ્તુ કે બાબત એમ જ પસાર થઈ જાય, પણ મનને અસર કરે નહિ, વિદ્ધવળ કરે નહિ.

સહિષ્ણુતાની શક્તિ વધારવા માટે,

(૧) ‘જગતની જડ વસ્તુ અને સાંસારિક બાબતો આપણા આત્મા અને આત્મહિત, આગળ તુચ્છ છે, નગણ્ય છે, એની બહુ કિંમત નથી એ ભાવના વારંવાર ભાવવી જરૂરી; અને એનો ખ્યાલ વારંવાર મન મારીને પણ તકલીફમાં શાંતિથી સહન કર્યે જવું.’

(૨) બધું અનુકૂળ મળે એમાં સત્ત્વ વધતું નથી, પ્રતિકૂળ મળે ત્યાં સત્ત્વ વધારવાને ખરો અવકાશ છે. તો એવો અવકાશ મજ્યે ખુશી થવું; વિદ્ધવળ શા માટે થવું ?

(૩) ‘પ્રતિકૂળ કરનારો સામો એક જીવ છે, અને જીવમાત્ર દયાપાત્ર છે, દ્વેષપાત્ર નહિ,’ માટે એના પર દયા ચિંતવવી.

(૪) ‘પ્રતિકૂળ તો પૂર્વકર્મના ડિસાબે બન્યું, પણ વિદ્ધવળતા નવાં કર્મને નોંઠરે છે.’

(૫) ‘ખરી પ્રતિકૂળ બાબ્ય બાબત કે વસ્તુ નથી, પણ આંતરિક રાગ, દ્વેષ, અશાન્તિ વગેરે છે. તો એને જ ન રોઉં કે બહારનું રોવા બેસવું પડે ?’

(૬) ‘સહિષ્ણુ લોખંડી બને છે, સુવાળો કાયર. માટે સહિષ્ણુતાને અવસર આપનાર તકલીફ એ સારું નિમિત મળ્યું માનું.’

(૭) ઉપરની વિચારણા સાથે સહવા ઉપરાંત ખૂબ ખૂબ વ્રત-નિયમ, ત્યાગ-તપસ્યા, સંયમ-સત્કૃત્યો આચરવા જોઈએ. એથી સહિષ્ણુતા વધે છે.

આમ અભ્યાસ વધારતાં મન બગડતું નથી, અંતકાળે પણ મન સ્વસ્થ પ્રકૃતિલિત રહે છે.

U

માંદગી ગંભીર પણ ઉપયોગ તીવ્ર

V

છેલ્લે તબિયત બગડી ત્યારે પૂજ્યશ્રીને હાર્ટના દુઃખાવાની તકલીફ ઘણી હતી. અસ્વસ્થાતાને કારણો વિસ્મૃતિ પણ થઈ જતી હતી. મેં તેઓશ્રીને પ્રતિકમણ કરાવ્યું. થોડી વાર પછી મને કહ્યું : “મારે પ્રતિકમણ બાકી છે, મને કરાવ.”

“થોડી વાર પહેલાં જ આપે પ્રતિકમણ કર્યું, મેં જ કરાવ્યું.”

“ક્યારે થયું ? મને ઉપયોગ નથી રહ્યો. ફરીયી કરાવ.”

અંતિમ ગંભીર માંદગીમાં પણ કેટલી કાળજી !

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

W

૭૫ ભાગ્ય : sis છોકરો અને નવો છોકરો

રામચંદ્રજી વનવાસમાં એક વડ નીચે ચોમાસું ગાળવાનું નક્કી કરે છે ત્યાં અનેક યક્ષોનો માલિક ગોક્રું નામનો યક્ષ મોટી નગરી ઉભી કરી દે છે, અને રામને કહે છે, ‘હું અને મારો પરિવાર આપની સેવામાં રહીશું.’ ઘરે સારા માણસ આવ્યા હોય તો સેવામાં ઉભા ને ઉભા રહેવાનું મન થઈ જાય ને ?

અહીં રામે આગળથી કહેવરાવું નથી પ્રાર્થના નથી કરી, યોજના નથી ધરી, છતાં આ એકાએક કેમ બની આવ્યું ? કહેવું જ પડશે ભાગ્યના જોર પર. માણસની મહેનત જે નથી કરતી, તે ભાગ્ય કરે છે. આ સમજનાર મહાન આત્માઓ-રામ, લક્ષ્મણ અને સીતા વનમાં નીકળ્યા તે પોતાની મહેનતના ભરોસે. ગાંડા-સામાન-ધન-માલ-નોકરો લઈને નહિ, પણ ભાગ્યના ભરોસે નીકળ્યા; કેમકે ભાગ્ય કરશે તે મહેનત-હોશિયારીથી નહિ થાય.

પ્ર.- ભાગ્ય તો હોય, પણ બજારે જવાની ને વેપાર કરવાની મહેનત-હોશિયારી તો કરવી પડે છે ને ?

૩.- આ પ્રશ્ન આના જેવો છે કે ભલે સારો દૂધપાક સારા દૂધમાંથી બનતો હોય, પરંતુ તપેલું, ચૂલો, કડછો તો જોઈએ છે ને ? ભલે માખણ દહીમાંથી નીકળતું હોય, પરંતુ એ દહી વલોવવા પાણી તો નાખવું પડે છે ને ? આ કહેવાનો અર્થ તો એ થાય કે દૂધપાક તપેલા કડછાથી બને, માખણ પાણીથી બને ! આમ કહેવાય નહિ, કેમકે તપેલા-કડછાથી તો ખીચું ય બને છે. તેથી સારો દૂધપાક બનવામાં વિશેષતા એની ન ગણાય. પાણી તો કોદરી રાંધવામાંય જોઈએ છે, એટલે ખાસ માખણ એની બનાવટ ન કહેવાય. એમ અહીં બજારમાં મહેનત તો કેટલીય વાર ખોટ પણ દેખાડે છે, અથવા રખડવામાં ય ઉપયોગી થાય છે; તેથી ખાસ ધનપ્રાપ્તિ એનું કાર્ય ન ગણાય. એ તો સારાં ભાગ્યનું કાર્ય છે. વિવેક જોઈએ કે કોની ખાસ વિશેષતાએ કયું કાર્ય થાય છે ?

પ્ર.- પરંતુ ભાગ્ય પણ આપણી મહેનતથી જ ઉભું થયેલું ને ?

૪.- હા, એ ઠીક પૂછ્યું ! તો તો હવે એમ કરો, નરસા ભાગ્યના ઉદ્ય વખતે એને કહી દો કે ‘બેસ હેઠું, તને મેં જ ઉભું તો કર્યું છે ને ?’ અજ્ઞા-ઉલ્ટીને કહો કે ‘તને મેં જ ઉભા કર્યા છે, માટે હમણાં બેસી જા, હમણાં બીજું મિષ્ટાન્ન

હું ખાઈ લઉં છું.’ ભાગ્ય આપણી જ મહેનતે ઉભું થયું તેથી શું ? અત્યારે જોર એનું કે આપણું ? એ વિવેક કરવા જેવો છે.

છોકરાને બહુ લાડમાં ઉછેરી એ ઉદ્ઘત અને ડાડ બન્યા પછી આપણો ઉભો કરેલો છતાં એના પર આપણું નથી ચાલતું. એટલે તો પછી બીજા નવા છોકરા માટે એમ થાય છે કે ‘હવે આને બરાબર કેળવું’ અને એ સારો કેળવાય છે તો શાન્તિ આપે છે. એમ અહીં પણ જૂનું ભાગ્ય ડાડ છોકરા જેવું છે, એ કાંઈ આપણું સાંભળે નહિ. પરંતુ નવાં સારા ભાગ્યને ઉભું કરવું એ આપણા હાથની વાત છે. મહેનત લગડવી હોય, મહેનતના ભરોસે રહેવું હોય તો ત્યાં રહેવાય.

મનને કહી દેવું જોઈએ કે ‘ડાડ ભાગ્યના પૂછાડાં આમણ્યે, ભાગ્ય વિરુદ્ધ મહેનત કર્યે કાંઈ નહિ વળે. સુખ-દુઃખ, ઓદ્ધું સુખ-વધુ સુખ-ઓછી સગવડ, વધુ સગવડ કે અગવડ, બધું ભાગ્યની પહોંચ મુજબ જ મળવાનું એ બાબતમાં તો ભાગ્યના ભરોસે છું. આવવા દો જે સુખ-દુઃખ આવે તે. પરંતુ ભાગ્યનાં ગમે તે ફળ વખતે, પેલા ડાડ છોકરાની સામે નવા છોકરાની જેમ, સારું ભાગ્ય કેમ ઉભું કરવું એની જ ત્રેવડમાં રહીશ.’

સારું ભાગ્ય ઉભું કરવાનો પહેલામાં પહેલો અને સસ્તામાં સસ્તો ઉપાય આ કે મનના વિચાર અને હૈયાની લાગણી બગડવા દેવી નહિ, અર્થાત્ કોઈ દીનતા, શોક કે હર્ષાન્માદની, કોઈ રોષ, રોઝ કે માયા-માનાકંશાની, અથવા વૈર-વિરોધ, સ્વાર્થધિતા યા તીત્ર રાગદ્રેષ મોહની નહિ એવી કોઈ લાગણી ઉભી નહિ કરવાની, તેમ હિંસા-જૂહ-અનીતિ વગેરેના વિચાર નહિ ચલાવવાના. એથી ઉદ્ધું, લાગણી અને વિચારો પવિત્ર ધાર્મિક કેળવવાના, ક્ષમા-ધીરતા-સહિષ્ણુતા, દયા-પરોપકાર, ઉદારતા-ગંભીરતા, સંયમ-સુકૃત-દેવગુરુધર્મની સેવા વગેરેની જ લાગણી તથા વિચાર વહેતા રાખવાના.

૭૬ દેવ-ગુરુ-ધર્મ પર સાચા રાગ માટે

આપણને દેવ, ગુરુ અને ધર્મ તથા ધર્મના અંગો તીર્થ, મંદિર, ઉપાશ્રય, શાસ્ત્રો, સંઘ વગેરે પર રાગ છે એવો દાવો રાખીએ છીએ. અહીં વિચારવા જેવું છે કે આ રાગ ખરેખર જીગ્યા પછી ધર્મપ્રતિપક્ષી સંસાર અને પાપસ્થાનકો પરના રાગને ફટકો પડ્યા વિના રહે ? રાગને ઘસારો ન લાગતો આવે ? જો એ નથી તો ક્યાં ખામી છે એ શોધી કાઢી ખામી દૂર કર્યે જ ધૂટકો છે.

ખામી તો કોઈ પ્રકારની હોય છે, પરંતુ અહીં એક ખામી પર ધ્યાન દેવાનું છે. તે એ છે કે દેવ-ગુરુ-ધર્મ-ધર્મઅંગો પર રાગની પાછળ કાંઈ ને કાંઈ જોખવાનું, કોઈ ને કોઈ ભોગ આપવાનો રાખ્યો નથી. પ્રવાસમાં કોઈ સાથે સામાન્ય મિત્રાચારી કરવી હોય છે તો ચાહનું કોણિયું ધર્તું પડે છે; નહિતર ‘ભાઈ તમે બહુ સારા માણસ લાગો છો, તમે બહુ ગમી જાઓ એવા છો. તમારો વિવેક, તમારું ડહાપણ, બધું પ્રશંસનીય છે,’ એમ બોલતા રહીએ અને ચાહનો કપ એકલા જ પીતા રહીએ તો પ્રેમી નહિ, વાચણમાં ખપીએ.

રાગ ભોગ માગે છે. પત્ની, પુત્ર, પૌત્ર વગેરે પર કોરા રાગ જામે છે ખરા ? ના, બહુ બહુ તન-મન-ધનના ભોગ આધ્યાથી એ જામે છે. શેઠનો પ્રેમ મેળવવા સારી નોકરી ઉપરાંત શેઠનું કામકાજ બજાવવું પડે છે. પ્રેમ માટે ભોગ ક્યાં નથી આપવો પડતો ? તો જ સામાને પ્રેમ થાય છે.

પ્ર.- અહીં વીતરાગને ક્યાં પ્રેમ થાય એમ છે ?

ઉ.- આ ય સમજવા જેવું છે. શેઠનો પ્રેમ એટલે શું ? શેઠની નજરમાં નોકર સારો લાગે એ. વિદ્યાર્થી પર માસ્તરનો પ્રેમ એટલે એમની નજરમાં વિદ્યાર્થી સારો લાગે તે. એમ અહીં પણ આપણે વીતરાગની જ્ઞાનદિષ્ટી-વીતરાગની નજરમાં સારા લેખાવું છે. તે ત્યારે બને કે પેલા નોકર કે વિદ્યાર્થીની જેમ સારો ભોગ આપીએ.

બીજી વાત એ છે કે આપણા દિલમાં પણ દેવ-ગુરુ-ધર્મ પર સાચો રાગ જામવાનું આપણે ભોગ આધ્યાથી બને છે. દુનિયામાં ય જે વસ્તુ પાછળ બહુ ભોગ આધ્યો હોય છે તેના પર સારો રાગ જામે છે. જાતે મહેનત કરીને બનાવેલ ભોજન, મકાન, શાંગાર વગેરે પર વિશેષ રાગ થાય છે. આપણે પૈસા ખર્ચી કોઈ

દર્દને સારો કર્યો હોય તો એના પર દિલમાં વિશેષ લાગણી રહે છે.

બસ, આ રીતે જો દેવાવિદેવ, સદ્ગુરુ અને ધર્મના અંગો-સ્થાનો-ક્ષેત્રો માટે ધનનો ભોગ અને મનનો ભોગ આપીએ તો એમના પર આપણા દિલમાં સાચો રાગ જામે છે. મંદિર અને ભગવાન તો બધા સરખા છે, પરંતુ પોતે પૈસા ખર્ચી અગર દેખરેખ રાખી બનાવેલ મંદિર કે પધરાવેલ ભગવાન તરફ હૈયું ખૂબ આકષ્યિલું રહે છે ન ? એ જ રીતે બધે સમજવાનું છે.

સાધારણના દૂધ કેશરથી પૂજા અને પોતાના દૂધ-કેશરથી પૂજામાં આદ્દાદનો ફેર મોટો પડે છે. જાતનું ખરચીએ તો ભાવ વધે છે. સાચો રાગ, સાચો ભાવ ભોગ માગે છે; એ ભોગ અપાવ્યા વિના રહેતો નથી. રાજી શ્રેણીકે ૧૧-૧૧ લાખ સોનૈયાની રતનકંબળ ખરીદવા ના પાડી, પણ મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લાવનારને મોટાં ઈનામ દઈ દેતા, કેમ કે પ્રભુ પર રાગ હતો. શ્રીમંતો દેવની, ગુરુની, ધર્મની પ્રશંસા ગાનાર ભાટ વગેરેને મોટી ભેટ આપી દેતા.

બસ, વાત આ છે કે દેવ-ગુરુ-ધર્મ પર સાચો રાગ જમાવવો હોય તો વાતવાતમાં ભોગ આપવાનું રાખો. નવા તીર્થની યાત્રા મળી, તો ઉપવાસ કરી દેવાનો. નવાં પ્રભુદર્શન મળ્યા, તો ભંડારમાં ઠીક નાણું પધરાવી દેવાનું. કોઈ અચિત્ય સુપાત્રદાનનો લાભ મળ્યો, તો ૨-૪ સામાયિક કે ૨૦૦-૫૦૦ નવકાર-જાપ જેવું કંક કરી આપવાનું. સારું પ્રેરક વ્યાખ્યાન સાંભળવા મળ્યું, ત્યાં શુભની કે જ્ઞાનની પેટીમાં નાણું નાખવાનું. સાચા રાગનો આ ઉપાય કે ભોગ આપો.

U

આત્માને ઉજળો કરો

V

પૂજ્યશ્રી પોતાના કપડાનો કાપ જલ્દી કાઢવા નહોતા આપતા. કોઈ જલ્દી કાપ કાઢવાનો આગ્રહ રાખે તો પૂજ્યશ્રી ઠપકો આપતા :

‘પાણી ઉકાળવા પાછળ કેટલી વિરાધના થાય છે, ખબર નથી ? લોકોને ઉજળાં કપડાં બતાવવાથી શું વળવાનું છે ? અંદરનો આત્મા ઉજળો કરવાનો છે, કપડાં બહુ ઉજળાં રાખવાથી રાગ થાય.’

આમ કહીને પૂજ્યશ્રી કોઈને જલ્દી કાપ કાઢવા નહોતા આપતા. કપડાંને કાપ કાઢવાને કેટલા દિવસ થયા છે તે પોતે બરાબર થાએ રાખતા.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સામાજિક

૧૫૬

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૭૭ ઉત્તમતા અને સમ્યગદર્શનનો એક ઉપાય

રામચંદ્રજીને વનમાં સરોવર કાંઠે કલ્યાણમાલા નામના રાજાનો ભેટો થયો. એ રાજા એમને વિનંતિ કરે છે કે આપે જેમ વજકર્ણ રાજાની આપત્તિ ટાળી એમ મારી પણ ટાળી આપો. રામચંદ્રજીને એમ નથી થતું કે ‘આ એકનું કર્યું એટલે ત્યો વળી બીજાનું કરો.’ કેમ નથી થતું ? એટલા જ માટે કે એ ઉત્તમ છે.

ઉત્તમ આત્માઓ બીજાનું દુઃખ જોઈ એના દુઃખે દુઃખી થાય છે, દુઃખ ટાળવા શક્ય પ્રયત્ન કરે છે. દુઃખી પ્રત્યે તિરસ્કાર, નિહુરતા, એ અધમતા સૂચવે છે. અધમ મટી ઉત્તમ બનનું હોય તો દુઃખીને જોઈ જરૂર સહાનુભૂતિ જોઈએ, તે પણ એમ નહિ કે એક બે દુઃખીને સહાનુભૂતિ બતાવી અને પછી ત્રીજો દુઃખી આવ્યો એટલે કંટાળ્યા અને ચીડ ચડી. આ ઠીક નહિ. સહાનુભૂતિ અખંડ રહેવી જોઈએ.

સમકિતી આત્મા જ્યારે જગતના જીવો તરફ દાખિ નાખે છે ત્યારે એમના ઘોર દુઃખો જોઈને એનું દિલ દ્રવિત થઈ જાય છે. ‘અરેરે બિચારા જીવો કેવા દુઃખી !’ એમંય અલબંત નરકના જીવ જેવાના દુઃખો જોઈ હૈયું એ જીવો પર વિશેષ દ્રવિત બને છે, પરંતુ એથીય વિશેષ તો જીવોની પાપપરિણિતિ અને પાપાચરણ જોઈ દ્રવિત થાય છે, જીવો પ્રત્યે કરુણા ઉત્તરાય છે. કારણ સ્પષ્ટ છે કે શારીરિક દુઃખ એ દ્રવ્યદુઃખો છે, અને પાપપરિણિતિ અને પાપાચરણ એ ભાવદુઃખો છે. ભાવદુઃખ એ દ્રવ્યદુઃખ કરતાં કર્દિગુણા ભયંકર છે, કેમ કે એમાંથી દુઃખદ દીર્ઘ દુર્ગતિ સર્જય છે.

અધમ જીવોને બીજાનાં દ્રવ્યદુઃખની ય બેપરવાઈ હોય છે તો ભાવદુઃખની તો વાતેય શી ? એમને તો બીજાના ભોગે પણ જીતની સુખસગવડ ખ્યે છે; અરેરાઠીનું નામ નથી. યોગદાનિ શાસ્ત્ર કહે છે જીવોનો રાગદ્રોષનો અનાદિ સહજ મળ હ્રાસ પામે ત્યારે જ એને દુઃખી પર દયાળુણ પ્રગટે છે.

અહીં એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સમકિતી આત્માને જીવોનાં પાપ, અધર્મ જોઈ એમની દ્રાય આવવાનું કારણ એ છે કે પહેલાં પોતાને જ પોતાનાં ભાવદુઃખ ખટકે છે. દરિક્તા, રોગ, વગેરે એને જેવા નથી ખટકતા, એથી કઈ ગુણા વધુ ભાવદુઃખ અર્થાત્ પોતાના રાગદ્રોષ, આરંભ-પરિગ્રહ, વગેરેની રિબામણ ખટકે છે. કહો, એ બદલ એનાં હૈયે કકળાટ હોય છે; કેમ કે એનાં દુઃખદ પરિણામો નજર સામે તરવરે છે. એથી જ એને બીજાનાં પણ ભાવદુઃખ જોતાં દ્રાય ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

ઉત્તરાય છે. ત્યાં મોટા શ્રીમંત, રાજા કે દેવો પણ હોય તોય તે એની દ્રાયાના વિષયમાંથી બાદ નથી રહેતા.

પોતાનો કષાય-રાગદ્રોષ-હર્ષશોક ડિસ્ટા-જૂઠ-અનીતિ-માયામૂળચર્ચા વગેરે પર હૈયામાં કકળાટ હોય. મનને થતું હોય કે ‘તીર્થકર ભગવાને આ પાપો કેવાં હુઃખ બતાવ્યાં છે, ને હું કેમ એને વળગી રહ્યો છું ! કેમ એથી સર્વનાશ નોતરી રહ્યો છું ?’ આવો કકળાટ હોય એ સમ્યક્તવની નિશાની છે.

સમ્યક્તવ પામી ગયાના ગુમાન કે આત્મસંતોષ કરી લેતાં પહેલાં આ તપાસવા જેવું છે કે તાવ, ક્ષય આદિ રોગ, ગાળ-અપમાન વગેરે દ્રવ્યદુઃખ પર દિલ કકળે છે, પરંતુ દોષ ગુણો, પાપો,-કષાયો પર હૈયામાં કકળાટ થાય છે ખરો ? એ ન દેખાતો હોય તો પણ સમ્યક્તવ લાવવા માટે ય ઉપાય આ છે કે દિલમાં ભાવદુઃખ,-પાપ, અધર્મ, કષાય, દુર્ગણો આદિ પર કકળાટ ઊભો કરવો.

પાપ પર કકળાટ થાય એનો તો મોટો પ્રભાવ છે. મહાન પાપી આત્માઓનું પણ હૈયું થઈ ગયેલ પાપ પર, કકળી ઉઠ્યું એમાં કકળાટ વધી જવાથી એ આત્મા સર્વ પાપ અને પાપનાં નિમિત્તભૂત સંસારથી એવા અલિન અનાસક્ત બની ગયા કે એમાં એ વીતરાગ દશા સુધી પહોંચી ગયા ! બસ, સમ્યગદર્શનની પ્રાપ્તિ અને વિકાસનો આ ઉપાય, આપણાં ભાવદુઃખનો જોરદાર કકળાટ રહે,- એ આત્મસાત્ર કરવો જરૂરી છે.

માંસાહાર કે નાશાહાર ?

લે. એન. કે. ગાંધી

જૈન ધર્મમાં તો અહિસાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ શુદ્ધ અને સ્પષ્ટ રીતે બતાવેલું છે અને ઠેકાણે ઠેકાણે લખેલ છે કે પંચેન્દ્રિયનો વધ કરનાર તથા માંસ ખાનાર નરકમાં જાય છે. બધા ધર્મમાં પણ માંસાહારનો પ્રતિબંધ છે. જુઓ :-

મહાભારત :- ‘યાવંતિ વસુરોમણિ વસુગાત્રોણાં ભારતઃ તાવદ્ર્ષ સહસ્રાણિ પચ્યતે નરકે નરઃ’ અહિ બતાવ્યું છે કે પશુનો વધ કરનાર માંસાહારી પશુના ઝંવાઢાથી હજારગણા વર્ષો સુધી નરકમાં મહાદુઃખ ભોગવે છે.

મહાભારત (પુરાણસાર) :- ‘તિલ સર્વ માત્રં તુ, યો માંસ ભક્તાને નરઃ, તે યાવંતિ નરકં ધોરં યાવચંદ્ર દીવાકરો’ તલ અને સરસવના દાઢા જેટલું માંસ ખાનાર ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી ધોર નરકમાં રહે છે.

શ્રી ભાગવત પુરાણ સ્કંધ ૪, અ. ૨૫, શ્લોક ૭-૮ માં નારદજી બહી રાજાને કહે છે કે હે રાજા તેં વજનમાં મારેલા હજારો પ્રાણીઓ તને મારવા માટે રાહ જોઈ રહ્યાં છે તે તું જોઈ લે.

રાવજી (લોટીઆ) વોરાના ધર્મ પુસ્તકમાં લખ્યું કે ‘ફલા તજ અબૂલુટૂન કુમ મકાબરલ હૃયવાનાત્ર’ એટલે તું પશુ પક્ષીઓની કબર તારા પેટમાં કરીશ નહિ.

કુરાને શરીરના સુરાઅવ-આમ-ની આયાત ૧૪૨માં અલ્લા તાલ્લાએ ફરમાવ્યું છે કે ‘મિલન અન ઓમે હમૂ લતં વ ફસાં કુળુ મિમ્મા રાજક કુમુઢલાહે’ તેનો ભાવાર્થ એ છે કે ભાર ઉપાડવા માટે અલ્લાએ પેદા કરેલા ચોપગાં જાનવરો માટે વનસ્પતિ અને અનાજ ઉગે છે તો તમારે વનસ્પતિ અને અનાજ ખાવાં.

કુરાનમાં સુરાહજની ઉહ મી આયાતમાં પણ લખ્યું છે કે માંસ અગર લોહી મને પહોંચશે નહિ પણ એક પરહેજગારી પહોંચશે. એમ અલ્લા તાલ્લા ફરમાવે છે. કુરાન પણ એમ જ કહે છે. ‘વમામિનુ દાખ્બતિનૂ ફિલ અર્દેવલા, તૈંનું, યતીરોબજ નાહીયે ઈલ્લામમૂન અમસલાકુમ્’

પદ્યગંબર હજરત મહેમદ નબી સાહેબના ખલીફા હજરતઅલી સાહેબે ફરમાવ્યું છે કે ‘તું પશુ કે પક્ષીની કબર તારા પેટમાં કરીશ નહિ.’

પારસી ભાઈઓના શાહનામા પુસ્તકમાં લખેલ છે કે બેત :- ‘નીસ્ત ઝંડ ખુરોને જાનવરજુ, ચનીન અસ્તદીને ઝર હુસ્તનેકુ’ એટલે અમારો જરથોસ્તી ધર્મ એવો નેક છે કે પશુઓને મારીને ખાવાં નહિ અને જાનવરોનો શિકાર કરવો નહિ.

પારસી ભાઈઓનાં ધર્મપુસ્તક ઈજરને મધ્યે કહ્યું કે જેઓ દુનિયાની પેદાસ ઉપર દયા લાવતા નથી તેઓ વગર દયાના દેવો તથા દોજખી આદમીઓ છે.

જરથોસ્તનામાં લખ્યું છે :- ‘બંદુશતન નીયારંદ કસ્કુ દરેહ, ન આગુસફંડા કે બાસદ બરેહ’ અહિ નાનું બચ્યું, મોટું કે વૃદ્ધ કોઈ પ્રકારના જીવતા પ્રાણીને મારવાની સાફ મનાઈ છે.

બાઈબલ : પ્રકરણ ૨૦ માં કહેલું કે તું હત્યા કરતો ના. (ધાઉ શેલ્ટ નોટ કીલ) પ્રકરણ ૨૨માં કહેલું છે કે તું મારી તરફ પવિત્ર રહેજે. વગડાના પશુને મારી તેનું કોઈ પણ જાતનું માંસ ખાતો નહિ. પહેલા જેનીસીસમાં લખેલ છે કે પૃથ્વી ઉપર જે ભાજ્યાલો તથા ફળ તને મેં આપેલા છે તેનો તું ખોરાક તરીકે ઉપયોગ કરેજે.

માંસાહારથી નુકસાન : ડૉ. ટી.એલ. નીકોલ્સ એમ.ડી. કહે છે કે માંસ ખોરાક ફૂત્રિમ જુસ્સો ઉત્પન્ન કરે છે તેથી માણસ વિષય લુબ્ધ થઈ થાક પામે છે. થાક દૂર કરવા પાછો માંસ ખાય છે આવી રીતે જેરી કુંડાળું ફર્યું કરે છે અને વિનાશનું કામ ચાલ્યા કરે છે.

માંસ ખાનારને પ્રાણીમાં રહેલા તમામ દરદો મળે છે, વળી તેને તામસી વૃત્તિ ઉપજે છે. જેથી નીતિભ્રષ્ટ થાય છે અને મરીને નરક ગતિમાં જાય છે. માંસ

ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૧૫૮

ને ખોરાક બંધ થાય એટલે પ્રાણીઓ ઉપર દયા આવે તો મનુષ્ય જાતિ ઉપર દયા આવે જ અને બધાં વિશ્વયુદ્ધો અટકી જાય.

સંસારના વ્યવહારમાં સરકાર એ એક સૌથી વધારે પ્રતિષ્ઠિત સંસ્થા ગણાય. માંસનો વ્યાપાર ખાટકીનો વ્યાપાર છે તે સૌથી હલકો વ્યાપાર ગણાય. માટે માંસનો વ્યાપાર સરકારથી થઈ શકે નહિ. લોકોમાં સરકાર પ્રત્યે ભયની દસ્તિ ન હોવી જોઈએ પણ અંતરથી ખરા માનની દસ્તિ હોવી જોઈએ અને તે દસ્તિ રહે તે માટે સરકારે પ્રતિષ્ઠા સાચવવાની હોય. ખુશામત તો સ્વાર્થની દસ્તિ છે. ખુશામતખોરો વાસ્તવિક રીતે કૃતજ્ઞ હોતા નથી. તેનું પરિણામ સર્વત્ર નુકશાનકારક છે.

પ્રતિષ્ઠાવાળી ખુનિસિપાલિટીઓથી પણ માંસનો વ્યાપાર થઈ શકે નહિ. તેઓને ફક્ત બે બાબતથી સેનીટેશન ન બગડે તે જોવાનું છે.

માંસાહાર અને તેના દેશાંતર વ્યાપારથી દેશાંના પશુ રૂધિરનો છેવટે નાશ થાય છે તેથી ગ્રામ્ય જેતીને નુકસાન પહોંચે છે અને ચોખ્ખા ધી દૂધથી મળતાં સત્ત્વો બંધ થવાથી અને બનાવટી ચીજો વાપરવાથી લોકોમાં અનેક જાતના રોગો થાય છે.

યંત્રોનો ઉપયોગ વધારવાથી મજૂર વગને સામૂહિક રીતે નુકસાન પહોંચે છે. એક યંત્ર ઘણા મજૂરોને કામમાંથી છૂટા કરે છે. અને તેમની રોજને લૂંટી લે છે. યંત્રો લાવવા અને બનાવવામાં પરદેશીઓને પોષવા પડે છે તેટલી દેશને હાનિ થાય છે.

હિંદુસ્તાનમાં શાકાહારી સેન્ડા થઈ ગયા છે. દાળ, ભાત, રોટલી, શાકમાં જેટલા સત્ત્વો છે તેટલા માંસમાં નથી. તેથી લોકોના શરીરની હાનિ થાય છે અને રોગોની ઉત્પત્તિ થાય છે.

કુદરતમાં એકલા મનુષ્યો જ નથી, બીજા પ્રાણીઓ પણ છે, જો માણસો પ્રાણીઓને ખાવા માંડે તો કુદરતી રીતે કોઈ બીજો જ રસ્તો નીકળે કે જેથી મનુષ્યોની હાનિ થાય છે. અતિવૃદ્ધિ, અનાવૃદ્ધિ, વિશ્વયુદ્ધ, ધરતીકંપ, ચેપીરોગ વગરે કુદરતી કોપ છે. એવી જાતના પ્રાણીઓ ઉત્પન્ન થાય કે જે મનુષ્યોમાં હાનિ પહોંચાડે.

મનુષ્યના બધા અવયવો જોતાં તેનો ખોરાક વનસ્પતિ જ છે. ઘણી જાતના પશુઓનો ખોરાક પણ વનસ્પતિ જ છે. સિંહ આદિ માંસાહારી પ્રાણીઓ મુકાબલાની અપેક્ષાએ બહુ થોડાં છે એટલે વિશ્વનો કુદરતી ખોરાક વનસ્પતિ જ છે એમ કહીએ તો ચાલે. જરૂરીયાત પ્રમાણે વનસ્પતિ આહાર ઉપજે છે. તેથી મનુષ્ય માંસાહાર છોડી શાકાહારી થાય તો કુદરત તેનું કામ કરેજે.

૧૬૦ ભુવનભાનુ એન્સાઈલોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૭૮ ધર્મ સાધનાનું એક પ્રેરક તત્ત્વ

રાજી વાલી સાથે યુદ્ધ કરતાં રાવણને ફાવટ આવી નહિ, બધાં શસ્ત્રો નિષ્ફળ ગયાં, એટલે હવે જુએ છે કે ‘મારી પાસે શ્રેષ્ઠ શસ્ત્ર ચંદ્રહાસ ખડુગ છે, એ વાલી પાસે નથી માટે લાવ હવે એનાથી એનો ઘાત કરી નાખું, એમ વિચારીને ચંદ્રહાસ સાથે વાલીને મારવા દોડ્યો. પરંતુ અતુલભળી વાલીએ રાવણને આખો ને આખો ઉપાડી બગલમાં લગાવીને પૃથ્વીને પ્રદક્ષિણા આપી. પછી યુદ્ધભૂમિ પર લાવી ખડો કર્યો !

રાવણનું શું માન રહ્યું ? રંકડાની જેમ શ્યામ મૌંઢું નીચું કરી ઊભું રહેવું પડ્યું ! કેમ આમ ? પુષ્યનો અધિક પડતો વિશ્વાસ. વાલી સાથે અનેક શસ્ત્રયુદ્ધોમાં હારી ગયો હતો તેથી વિચારનું જોઈતું હતું કે ‘મારું તેવું પુષ્ય નથી, તો હવે ચંદ્રહાસના પુષ્ય પર પણ ભરોસો ન રખાય.’ પરંતુ એ ન વિચાર્યું, એ તો ‘મારી પાસે ચંદ્રહાસ ખડુગ છે ને ? એ શ્રેષ્ઠ શસ્ત્ર છે ને ? બસ, આમ વાલીને પૂરો કરું છું.’ એવા ભરોસે દોડ્યો. જોયું નહિ કે વાલી અત્યાર સુધી હારતો જ નથી, તો એનું પુષ્ય વિશિષ્ટ છે, એ પુષ્ય આગળ મારા પુષ્યને મારે અધિક શા માટે માનવું ? ન જોયું, અને કુટાયો.’

પુષ્ય અને પુષ્યની સામગ્રીનો વધુ પડતો ભરોસો વિવેક ચુકાવે છે. વિવેક એ કે ‘જે પગાંનું મારું છું તે ચોક્કસ લાભકારક છે કે નુકસાનકારક ? અને પુષ્ય કેટલું પહોંચે છે ?’ એનો પહેલેથી વિચાર. ત્યારે વિવેક ન હોય તો સત્યુરુધાર્થ, સત્કૃત્ય વગેરે પણ ક્યાંથી ઊભવા પામે ? અગર સુકૃત વિવેક હીનપણે થાય તો ય એમાં શુદ્ધ અને જોશ ક્યાંથી આવે ? વિવેક જેટલી માત્રામાં જવલંત, તેટલી માત્રામાં કાર્યમાં જોસ અને નિર્મળતા આવે છે. મુનિઓ ઉપર ઉપરના શુણસ્થાનકની પાયરીએ ચેદે છે, તપ-સંયમ સ્વાધ્યાયને અધિકારિક જવલંત બનાવે છે, તે વિવેકને અધિકારિક તેજસ્વી બનાવવા પર.

જડ અને ચેતન, જડહિત-ચેતનહિત, આચાર અને અતિચાર, જાગૃતિ ને પ્રમાદ, આહાર અને તપ... ઈત્યાહિ વચ્ચેનાં સ્વરૂપ અને ફળના ભેદનું સચોટ આંતર સંવેદન જેમ જેમ વધતું જાય તેમ તેમ વિવેક વધ્યો કહેવાય.

આ વિવેકની વૃદ્ધિએ સાધનામાં જોસ વધે, નિર્મળતા વધે. સાધના દેખીતી એક સરખી હોય, એજ દેવદર્શન-પૂજા, પરમેણિ ધ્યાન-સ્મરણ, એજ દાન, એજ

પ્રત-નિયમ-તપસ્યા, એજ સામાયિક-સ્વાધ્યાય, પરંતુ વિવેક કમ તો એ સાધનાનું જોસ કમ; વિવેક જોરદાર, તો જોસ ભારે, શુદ્ધ ભારે અને એનું ફળ ગજબનું. શાલિભ્રતના જીવ સંગમનો પૂર્વભવે વિવેક ભારે હતો માટે ફળ ગજબ આવ્યું !

આ વિવેક તો જ પ્રગટે કે જો ભૌતિક પુષ્ય, પુષ્ય સામગ્રીના ખોટા ભરોસે ન રહેવાય. માણસ એના વિશ્વાસે તશ્યાય છે તેથી આત્મહિત-અહિતનો વિવેક નથી કરી શકતો. ‘હજી તો યુવાની છે, ધંણું જીવવાનું છે,’ એવા ભરોસે રહે છે એટલે વિવેક ચૂકે છે. ‘કોને ખબર મૃત્યુ વહેલું આવ્યું તો ? શક્તિ વહેલી નાશ પામી તો ? કોઈ રોગમાં ફસાયો તો ? સંયોગ તદ્દન વિપરીત બની ગયા તો ?’ આમ પુષ્ય પર વિશ્વાસ ઉઠી જાય તો ઝટ થાય કે ‘ઉભો રહે ત્યારે સારાસાર જોવા દે; સાર શેમાં, અસાર શેમાં ? હિત શું, અહિત શું ? મારું શું, પારું શું ?’ આ વિવેક પ્રગટ્યો એટલે પછી હિત-સાધના સુલભ છે. એમ ‘આજે તો પૈસા છે, પણ કાલની કોને ખબર ? આજે સારી ભાવના થાય છે પણ કાલની કોને ખબર ?’ આમ પૈસા કે ભાવનાદિનો ખોટો ભરોસો મૂકી દે, તો સાચો વિવેક જાગી જાય, અને આજે હાથમાં રહેલી પુષ્ય સામગ્રીથી પુષ્યમાર્ગ પુરુષાર્થ કરવામાં લાગી પડે એથી વિવેક પાછો જોરદાર બનતાં સાધના જોરદાર બનતી જાય.

U

દોષથી તો ખૂબ ડરતા

સુરત ઊંકારસૂરિ આરાધના ભવનમાં છેલ્લું ચાતુમર્સિ રોકાયા હતા તે ઉપાશ્રયનાં ભૌંયતળિયે પાણી ઉકાળવાની વ્યવસ્થા હતી. પૂજયપાદશ્રી સવારે દેરાસરજી પદ્ધારે ત્યારે પાણી ઉકાળવાનો ભટ્ટો ચાલુ હોય. તે જોઈને તેમનું હૃદય અત્યંત રડી ઉદ્ધતું. સાધુઓને ટકોર કરતા : જુખો આ તમારા નામનું કંતલખાનું... આવા આપણાં માટે ખાસ ઉકાળેલા પાણીનો ઉપયોગ કરવો પડે તો ય શી રીતે કરાય ? થોડા થોડા દિવસે કાપ કેવી રીતે કાઢી શકાય ? આ જ પાણીથી મારાં કપડાંનો કાપ નીકળે તે મારાથી નથી જોવાતું, મારાં કપડાંનો કાપ પણ મહિના પહેલા કાઢવાની શી જરૂર છે ?

W

-“ભુવનભાનું એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

૭૬ દુઃખ ન લાગવાની ચાવી

સીતાજી રામની જોડે વનમાં ચાલ્યા. વચ્ચમાં થાકી જાય છે એટલે જંગલમાં ઝાડ નીચે વિસામો લે છે. ક્યાં મેનાપાલભી અને રથમાં આરામથી ફરનારી આ એક વખતની રાજી જનકની લાઠિલી પુત્રી તથા હાલ રામચંદ્રજીની પત્ની? અને ક્યાં અત્યારે પગે ચાલતી અને થાકી જતી રામપત્ની! પાછું ‘ભોજન-પાણીના ઠેકાણાં નહિ! સેવા શુશ્વા કરનાર દાસીઓ નહિ! કે પોઢવા મખમલના ગાદલાં તો શું, રૂની સામાન્ય પથથારી પણ નહિ!

આટલું બધું છતાં અમના મનને કોઈ બેદ નથી કે ક્યાં આ દહાડા જોવાના આવ્યા! કોઈ દુઃખ નથી લાગતું કે ‘આ પતિ તે કેવા મળ્યાં? આ બાપે ક્યાં નાખી? આ કેદ્યે કેવી મળી?’ ના, મનને આવો કોઈ બેદ નથી. શું કારણ?

કારણ સ્પષ્ટ છે કે એક તો અનામાં સત્ત્વ છે, અને બીજું એ, કે એ જૂનું કશું યાદ નથી કરતી. આ મહત્વની વસ્તુ છે. સીતાને ‘હું તો આવા વૈભવમાં ઉદ્ઘરેલી! મોટી રાજકન્યા અને રાજકુમારની પત્ની! મોટા શેઠિયાના ઘર કરતાં ય ઊંચા મહેલવાસનાં સુખ ભોગવનારી!’ એવું કાંઈ જ મનમાં આવતું નથી. એ તો એક જ વાત છે કે જ્ઞાનો નવો જન્મ લીધો એટલે નવા સંયોગમાં ટેવાઈ જવાનું. સંયોગ આપણાને અનુકૂળ નહિ, પણ આપણે સંયોગને અનુકૂળ થઈ જવાનું, ગમે તેવા ય સંયોગ અનુકૂળ જ છે એમ માની ચાલવાનું.

અહીં ગરીબના ઘરમાં જન્મ પામનાર સુખેથી જીવી શકે છે ને? કેમ વારુ? કહો પૂરવનું યાદ નથી. હમણાં જો પૂર્વનો કોઈ દેવભવ કે શ્રીમંત મનુષ્યભવ યાદ આવી જાય તો? દુઃખ લાગ્યું સમજો. આનો અર્થ જ એ છે કે ગરીબી દુઃખ નથી, પરંતુ પૂર્વનું સુખ યાદ આવે તે દુઃખ કરાવે છે. એમ વર્તમાનમાં બીજા સુખીની સામે પોતાની તુલના દુઃખ કરાવે છે.

આજે કેટલાય માણસો મનથી દુઃખી દુઃખી કેમ રહે છે? કારણ એ છે કે જૂનું સુખ નજર સામે તરવરે છે. બિમારીથી દુઃખ લાગે છે કેમ કે પૂર્વનું આરોગ્ય યાદ છે,-‘હું આવો નીરોગી અને મને રોગ?’ એમ વજન ઘટે તો દુઃખ લાગે છે કેમ કે પોતાનું વધુ વજન યાદ આવે છે. જન્મથી જ ઓછા વજનવાળાને કોઈ એવું દુઃખ થતું નથી. કેમ કે પૂર્વનું સારું કાંઈ યાદ કરવાનું નથી.

એમ અપમાન-તિરસ્કાર-ટોણાં-ઠપકાથી દુઃખ લાગે છે, કેમ કે એ જ્યાલ છે કે ‘હું તો માનભેર જીવનારો...’ વગેરે એમ અગવડ પડતાં દુઃખ થાય છે કેમ કે એ જ્યાલ રહે છે કે આપણો તો સગવડમાં જીવનારા, તે વળી આ લપ ક્યાં આવી?’ જો સમજી લે કે ‘હુનિયામાં ઘણા જીવો અપમાન વગેરેમાં જ જીવે છે, અગવડમાં જ જીવન નભાવે છે, એમ આપણે પણ આ નવું જીવન છે, તો ચાલવા દો આમ જ ચાલવાનું હશે, તો દુઃખ નહિ લાગે.

સારાંશ જૂનું યાદ ન કરે અને બીજા સુખી સાથે પોતાની તુલના ન કરે તો દુઃખ નહિ.

તુલના કરવાથી પણ માણસ દુઃખી થાય છે,-‘ફ્લાણાને મોટર છે, બંગલો છે, આપણે હીનભાગી, આપણી પાસે કશું નહિ?’ ખરી રીતે તો એ તરફ જોવું જ ન જોઈએ. કદાચ દેખાઈ જાય તો એ વિચાર આવે કે ‘એને એના કર્મ-અનુસાર છે, મારે મારાં કર્મ-અનુસાર. બાકી જો એ ધર્મહીન છે તો એના કરતાં તો હું ભાગ્યશાળી છું. એ બિચારો દ્યાપાત્ર છે. ત્યારે જો એ પેસા પર સારું દાન વગેરે ધર્મ કરે છે, તો હું અની અનુમોદનાથી પણ ઉત્તમ પુણ્ય ઉપાર્જ શર્કું છું. અનું એક દાન એક જ વાર થશે, મારી અનુમોદના અનેકવાર ચાલી શકશે! તો મારે દુઃખ લગાડવાં જેવું છે શું?’

બસ, દુઃખી ન રહેવા, ૧. જૂનું યાદ ન કરો, ૨. બીજા સાથે તુલના ન કરો. બાકી તુલના કરવી હોય તો પોતાના કરતાં ઘણાં દુઃખથી રીબાતાની તુલનામાં જતને જુઓ.

U

પૂજ્યશ્રીનો પ્રોજેક્ટ

V

સં. ૨૦૪૫માં મદ્રાસના ચાતુર્માસમાં સંઘના ટ્રસ્ટીઓ ગુરુદેવ પાસે આવ્યા : “સાહેબ ! સંઘમાં ભંડોળ મોટું છે, આપનો કોઈ પ્રોજેક્ટ હોય તે જણાવો, પૂરો કરી દઈશું.”

“મારો પ્રોજેક્ટ પૂરો કરી દેશો ? મારે તો સંયમનો પ્રોજેક્ટ છે. મારો પ્રોજેક્ટ પૂરો કરવો હોય તો કમસે કમ ૨૫ દીક્ષા કરી આપો...”

જીવોને સંસાર-કારાવાસમાંથી છોડાવીને સંયમપંથે લાવવાની પૂજ્યશ્રીની તીવ્ર તાલાવેલી હતી.

W

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

(૮૦) મુંજવણ વખતે તાત્ત્વિક વિચારણા

સંસાર આપત્તિઓનું ઘર છે, એટલે એમાં જીવન જીવતાં ક્યારે આપત્તિ આવે એનો પતો નથી લાગતો. બીજુ બાજુ ગમે તેટલી સુખ સામગ્રી મળી હોય અને લાલા સુખ ચેન કરતા હોય પરંતુ આપત્તિ આવતાં જીવને મુંજવણ ખડી થાય છે અને એ મુંજવણ કેટલીક વાર અતિશય વધી જતાં દુઃખનો પાર નથી રહેતો. આપત્તિમાંથી છૂટવું એ પુષ્ય જોર કરવા પર અવલંબે છે. પરંતુ એ જીવને શાંતિ મળે એ માટે અહીં તાત્ત્વિક વિચારણાઓ રજૂ કરવામાં આવે છે. તે દરેકને ગંભીરતાથી અને એના હાઈને પકડિને મનમાં પલોટવા જેવી છે.

(૧) આપણાં જ કર્મના ઉદ્ય આપણને પીડે છે. તેથી જ આપત્તિ આવે છે. તેમાં બીજાનો વાંક નથી, આપણા જ પૂર્વના પાપી આત્માનો વાંક છે. તો શાહજોગ શાંતિ રાખવી. વળી વાંકની સજી ભોગવી લેવામાં કર્મનો કચરો દૂર થાય છે. ‘જેટલું ભોગવ્યું તેટલાં કર્મ રવાના’, એ હિસાબ છે, પછી પાપ રવાના થાય એમાં શા માટે જેદ કરવો ?

(૨) ભવિતવ્યતા એવી બળવાન છે કે ભગવાન મહાવીરદેવ જેવા એને અન્યથા ન કરી શક્યા, પોતાના શિષ્યોને ગોશાળો તેજોલેશયાથી બાળી નાખે એવો છે એ પહેલેથી જ્ઞાનવા છતાં પોતે એ પ્રસંગ રોકી શક્યા નાહિ. તો આપણે કોણ માત્ર ? ‘ચાલવા દો, ભવિતવ્યતાના અનંતકાળપટમાં જે બને તે મારે જોયા કરવાનું’-આ વૃત્તિ રાખવાની.

(૩) અનુકૂળતા બધી ભોગવવા તૈયાર થઈએ છીએ, એ જો આપણી હોશયારી છે, તો અવસરે પ્રતિકૂળતા ભોગવી જ્ઞાનવાની હોશયારી કેમ ન રાખવી ? પેસા લઈ જ્ઞાનવાની જેમ દઈ જ્ઞાનવામાં ય હોશયાર રહેતું જોઈએ.

(૪) આપણે જો પૂર્વભવે તેવી જોરદાર ધર્મસાધના નથી કરી તો જ પુષ્યની ખામી અને પાપના ઉદ્યે આપત્તિ આવે ને ? તો પછી પૂર્વની આચારના અને પુષ્યની મૂડી વિના એકલી સુખ-સગવડ અને બધું જ અનુકૂળ અનુકૂળનો અધિકાર જ શા માટે માનવો કે જેથી દુઃખ થાય ? થોડું પ્રતિકૂળે ય આવે, તે પૂર્વના નાશાંનો હિસાબ છે. બાકી તો મનને ઊલદું એમ થાય કે ‘મારા ભરચક દોષો અને મારી અયોજયતા જેતાં તો, બચેલી બહુ અનુકૂળતાઓનો ય હું અધિકારી ક્યાં

છું ?’ છતાં આ મળ્યું છે ટક્કું છે તો ગયેલાનો શોક શા સારુ કરું ?

(૫) પ્રતિકૂળતાને રોઈએ છીએ પણ બહાર જેવા જેવું છે કે ‘જગતમાં જીવોને આપણા કરતાં કેટલી બધી વાતે પ્રતિકૂળતા છે ! તેમાં ય એકેક બાબતમાં પણ કેટકેટલી જોરદાર માત્રામાં દુઃખ અને ત્રાસ છે.’ શારીરિક પીડા, તો નારક-તિર્યચોને જાલિમ ! ધનની તંગી, તો કરોડો મનુષ્યોને ઘણી ! સ્નેહી કે બીજા પ્રતિકૂળ, તે તો કેટલાયને મહાદુશમન જેવા !... કોઈ વાતે ગુલામી, તો લાખો લોકોને અનેક વાતે ભયંકર ગુલામી ! એની આગળ મારું દુઃખ શી વિસાતમાં ? આવી બધી બાબતમાં મારે તો હજુ ધાણું ધાણું સારું છે.’

(૬) વળી કષ, દુઃખ, રોગ આપત્તિ તો કેવી ય ઉગ્ર પૂર્વના મહાન આત્માઓ પર વરસી ગઈ ! છતાં એમણે એ હસ્તાં હૈયે વધાવી ! ‘સનતકુમાર ચક્કવતીને ભયંકર રોગ થયા’ રામ-સીતાને રાજવી ઠાડ છોડી વનવાસ જવું પડ્યું ! છતાં એ કોઈની ય આગળ રોદણું રોવા ન બેઠા કે ‘હાય ! આ અમારે કેવા દહાડા જોવાના આવ્યા !’ ‘મને ચક્કવતીને રોગ ?’ ‘આ કેકેયી કેવી મળી !’

(૭) જો દુઃખ જ પીડતું હોય તો તો જગતના અનંત જીવોનાં દુઃખનું દુઃખ લગાડવું જોઈએ. આપણા એકલાનાં દુઃખને શું રોવું ? એમાં તો સ્વાર્થીધતા છે, દુધ્યાન છે, શોક છે; ત્યારે બીજાનાં દુઃખ પર દ્રવિત થવામાં કરુણા છે, શુભ ભાવ છે.

U

જીવનસંદ્યાએ પણ સંયમઉધા

V

પૂજ્યશ્રીનાં જીવનનાં છેલ્લાં સપ્તાહનો જ આ પ્રસંગ છે. પૂજ્યશ્રીનાં વસ્ત્રોનું પડિલેહણ પૂર્ણ થયું અને એક મુનિ આસન પાથરવા લાગ્યા એટલે પૂજ્યશ્રીની ચકોર નજર તુરત ત્યાં પહોંચી ગઈ. મુનિને પૂછ્યું : “પાટ પૂંજી ?”

તુરત મુનિએ પાટ પૂંજી લીધી અને ફરી નવેસરથી આસન પાથરવા લાગ્યા. પૂજ્યશ્રીની નજર ત્યાં જ હતી.

“પાટ હજુ પૂરી પૂંજી નથી, પાયા પૂંજવાના રહી ગયા.”

જીવનની સંદ્યાએ પણ સંયમનું આટલું સૂક્ષ્મ પાલન જોઈને મારું અંતર પૂજ્યશ્રીને વંદી પડ્યું.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાલાજુ X

૮૧ મીઠાં સંભારણાં : અમર આનંદ

જીવનમાં બે જીતની વસ્તુ મળે છે,-સુકૃત અને દુનિયાદારી; પાપ અને ધર્મ; કલ્યાણમિત્ર અને દુનિયાનાં સ્નેહી; વગેરે. દરેક જોડકામાં એક વસ્તુ આત્મહિતકર છે, અને બીજી આત્મબંધક છે. સુકૃત સેવો, ધર્મ કરો, કલ્યાણમિત્ર-ધર્મમિત્ર રાખો, તો એ બધું આત્માને હિતકારી બને છે. ત્યારે દુનિયાદારી કરી, આરંભસમારંભ વિષય-પરિગ્રહનાં પાપી વિચાર-વાણી-વર્તિવ કર્યા, દુન્યવી સગામાં દૂબ્યા એ આત્માને કર્મથી બાંધે છે. એક શુભ છે, બીજું અશુભ.

હવે આ બે વચ્ચે મોટો તફાવત એ છે કે અશુભ વસ્તુનો આનંદ નાશવંત છે, ત્યારે શુભ વસ્તુનો આનંદ અમર છે. પૈસા કમાયા, દાબી રાખ્યા કે મોજ ઉડાવી, એટલે આનંદનો અનુભવ તો થયો પરંતુ પછી એ સંયોગ ફરતાં કે બીજી કોઈ આપત્તિ યા ચિંતા ઊભી થતાં તે આનંદ સુકાઈ જવાનો. દા.ત. રૂપિયા પચીસ હજાર કમાયા, પણ પછી પાંચ હજાર ગયા યા પેલા કમાયેલા પર કોઈ કલેશ ઊભો થયો અથવા શરીરે એવો રોગ થયો કે જે કમાણી ભોગવવા દેતો નથી, તો આનંદ હૂલ ! ત્યારે, સુકૃત કર્યું પછી જ્યારે જ્યારે એ સંભારીએ ત્યારે, ત્યારે એ આનંદ આપે છે ને કદાચ પૈસા ગયા તો ય એમ થાય છે કે હાશ, સુકૃત કરી લીધું એટલું સારું થયું.

વળી સુકૃત જ્યારે જ્યારે સંભારીએ ત્યારે ત્યારે ધર્મની અનુમોદનારૂપ બને છે અને તેથી પુણ્યની વૃદ્ધિ થાય છે. સુકૃત કર્યું એકવાર, પરંતુ એનું સંભારણું અને અનુમોદના વારંવાર થવાથી વારંવાર પુણ્યવૃદ્ધિ બને છે. એથી ઊલટું દુષ્કૃત્ય-સ્વાર્થ-સહેલસપાટીનાં કાર્ય જ્યારે જ્યારે યાદ આવે કે ‘આ ઠીક થઈ ગયાં’ ત્યારે ત્યારે એ પાપકર્મ બંધાવે છે.

આમ આનંદ અને પુણ્યવૃદ્ધિ બંનેની દર્શિએ સુકૃતનાં સંભારણાં ઉત્તમ વસ્તુ બને છે, યાવત્તુ અંતકાળે પણ એ જબરદસ્ત રાહત આપે છે. મનને થાય છે કે ‘ફિકર નહિ મોત આયું તો, કેમ કે આ જીવનમાં સુકૃત થઈ ગયાં એ સારું થયું છે.’ કેવળ દુનિયાદારી જ બેડી હોય, એ અંતકાળે શાનો આનંદ માણે ?

એટલા જ માટે જીવનમાં તન-મન-ધનથી અને વાણી તથા ઈન્ડ્રિયોથી સુકૃતો ભરપૂર સાધી લેવા જેવાં છે. એ સાચ્ય ! હશે તો જ કોઈ વાર એનાં મીઠાં

સંભારણાં આવશે, નહિ કર્યા તો શું આવે ? એમાં ય ખાસ વિશિષ્ટ સુકૃત કર્યા હોય તો એનું તો અદ્ભુત સંભારણું રહી જાય છે. પણ તે સુકૃત કરે તો થાય, નહિતર શું થાય ?

જમવા બેઠા હો, ભોજનમાંથી બે વસ્તુ ઓછી લો તો એ ત્યાગનું મીહું સંભારણું રહે છે કે ‘વસ્તુ છતી છતાં ત્યાગનો લાભ સારો મળ્યો હતો !’ બધું જ ખપે એને શું સંભારવાનું ? કદાચ એમ થાય કે ભોજન સરસ મળેલું, પછી સવાયું મળતાં આ કૂચા લાગશે; આનંદ ગયો ! અગર એવું ને એવું મળતાં વિરોષતા ચાલી જશે ને જો હલકું મળ્યું તો પેલાના આનંદને બદલે આનો ખેદ થશે કે ‘આવું કેવું ખાવાનું આવ્યું ?’ ભોગીની આ દશા છે. ત્યાગીને દર્શિ જ ત્યાગ ઉપર, એટલે એને આનંદ જ રહેવાનો.

એમ કોઈની સાથે કલેશનો પ્રસંગ આવ્યો પણ ગમ ખાધી, શાન્તિ રાખી સહી લીધું, ગુસ્સો ન કર્યો, તો પાછળથી હાશ થશે ! આનંદભર્યું સંભારણું રહેશે કે ‘ઠીક થયું આપણે ગુસ્સો ન કર્યો નકામા કલેશ અને કર્મબંધનથી બચ્યા !’ પાછું આવું જ્યારે જ્યારે યાદ આવશે ત્યારે આનંદ થવાનો.

એમ જૂદથી બચ્યા, અનીતિ અટકાવી, પર સ્ત્રી પર દર્શિ ય ન જવા દીધી, દાન કર્યું, ત્રટમાં આવ્યા, આ બધાનાં મીઠાં સંભારણાં અને અનુમોદનાનો આનંદ રહે છે.

પ.- કોક વાર એમ થાય છે કે ‘આ આપણે... ભાઈનું બહુ ખમી ખાધું એ જ ખોટું કર્યું ?’ ત્યાં ક્યાં ખમ્યાનો આનંદ રહ્યો ?

(3.- એવું થાય એ અજ્ઞાન દશા છે. ખમ્યું તે સુકૃત થઈ જ ગયું. એનો પુણ્ય લાભ મળ્યો તો મળ્યો જ, ઉપરાંત જ્યારે જ્યારે એનું મીહું સંભારણું કરે ત્યારે ત્યારે નવાં નવાં પુણ્યનો લાભ મળે છે, પછી સહ્યાનો ખેદ શા સારું કરવો ? હા, વર્તમાન સ્થિતિ દુઃખ દેખાય, પણ તો તે આપણાં કર્મને આધીન છે આપણાં જો સૌભાગ્ય નામકર્મ, આદેય નામકર્મ, યશનામકર્મ, વગેરે જોર કરતાં હોત તો સામાના પ્રેમપાત્ર બની જાત. તેથી પૂર્વોપાર્જિત કર્મના અકાટ્ય હિસાબને સમજી રાખી સુકૃતના મીઠાં સંભારણાંને બગડવા દેવાં નહિ.

૮૨ અભાગિયા અને ભાગ્યશાળી

સામાન્ય સમજ એવી છે કે ધન-યૌવન-ચતુરાઈ-આરોગ્ય અને મનવાંછિત પરિવાર જેને મળ્યા હોય એ ભાગ્યશાળી, એથી ઉલટું હોય તે અભાગિયા. પણ આ ગણતરી રાજપુત્રી સુરસુંદરીના જેવી. ત્યારે મયશાસુંદરીનો હિસાબ એ હતો કે જેને વિનય-વિવેક-પ્રશાન્ત મન-શીલ-નિર્મલ દેહ અને મોક્ષમાર્ગનો મેળાપ મળ્યા હોય એ ભાગ્યશાળી, નહિતર અભાગિયા; ભલે પછી પૈસાટકાદિ બહુ મળ્યું હોય-આ સાચો હિસાબ છે. કેમ કે,

ભાગ્યશાળી તે, કે જે ભાગ્યને પુણ્યને પગભર રાખે, પણ પુણ્ય એકલું ભોગવી સફાયટ કરે તે નહિ. પુણ્ય પગભર રાખવાનું વિનય, વિવેકાદિ ગુણ, તથા વ્રત-આચાર, સૌભ્યતા ને દર્શન જ્ઞાન ચારિત્રથી થાય. મળેલ સામગ્રીમાંથી આ સદ્ગુર્યોગ કરી લે તે જ ભાગ્યશાળી છે, ન કરે તે અભાગીયા છે, હીનભાગી છે.

રામ-લક્ષ્મણ-સીતા વનવાસમાં એક વાર પાણી પીવા અર્થે એક બ્રાહ્મણને ત્યાં જઈ ઉભા. બ્રાહ્મણીએ પાણી પાયું, પણ પછી બહારથી બ્રાહ્મણ આવ્યો તે આમને જોઈ પોતાની પત્ની પર તાહુક્યો, ‘રંડા ! આ કેમ તેં ગંદા માણસોને ઘરમાં ઘાલી ઘર અભડાવી નાખ્યું ? અભાગણી મારો અજીંહોત્ર અશુદ્ધી કરી નાખ્યો !’ જુઓ આ બોલનારો અભાગિયો જ ને ? ઉત્તમ પુરુષ સહેજે ઘરે આવી ચઢ્યા છે, એની ભક્તિ-સરભરા-આનંદ નથી સૂઝતો, ને ઉપરથી દ્વેષ-તિરસ્કાર આવડે છે. હવે એને ગમે તેટલા પૈસા ટકા પરિવાર મળ્યા હોય તો ય એ ભાગ્યશાળી કહેવાય ?

ચીજ એની એ, પરંતુ એનો સારો લાભ ઉઠાવે એ ભાગ્યશાળી, ન ઉઠાવે કે ઉલટું નુકસાન ઉલ્લંઘન કરે એ અભાગિયો.

મહાત્માઓના માથે અનાડીઓએ જુલ્દ વરસાવ્યો, મહાત્માને ભયંકર દુઃખ આવ્યું, તો મહાત્મા શું હીનભાગી, અભાગિયા કહેવાય ? ના, સુખ દુઃખ સગવડ અગવડ મળવા ન મળવા પર ભાગ્યશાળીપણું કે અભાગિયાપણું નથી, પરંતુ એનો ઉપયોગ કેવો થાય છે એના ઉપર એ છે.

દુઃખ હોય આપત્તિ હોય, છતાં એનો ઉપયોગ વધુ નાખ, મૂદુ અને દયાળું

બનવામાં કરીએ, દેવ-ગુરુની વધારે ઉપાસના કરવામાં કરીએ તો આપણે ભાગ્યશાળી છીએ, અને સુખ-સગવડની છોળો વચ્ચે પણ અભિમાની, કઠોર અને સ્વાર્થધિ બનીએ, દેવ-ગુરુ-ધર્મની આરાધના ઘટાડનારા, નહિવત્ત કરનારા થઈએ તો આપણે અભાગિયા છીએ.

આ ભાગ્યશાળીપણું ઉત્તમ ભાગ્ય સર્જે છે, ભાવી ઉદ્ય સૂચવે છે, જીવને પાપી જગતમાંથી ઉચ્ચો ઉંચકે છે, માનવ જીવનના ઉચ્ચા થાળા સુધી આવવાની સ્થિતિને સાર્થક કરે છે. આવા મહાન લાભ વિચારી ગરીબી કુટુંબકલેશ, શારીરિક અશક્તિ વગેરે દુઃખ-પ્રતિકૂળતાના અવસરે દમ ખેંચવો જોઈએ કે ‘ફિકર નહિ, આવી સ્થિતિમાં પણ મને ભાગ્યશાળી બનતા આવડે છે, એ મારા હાથની વસ્તુ છે; અને એ ભાગ્યશાળીપણા ઉપર મસ્ત-ખુશખુશાલ રહી મારે ગરીબી આદિ દુઃખ પર દીનતા, રોતલવેડા, નાહિંમત, નિરાશા વગેરે કરવાની જરૂર નથી.’ જીવનનું આ ધોરણ ખૂબ રાહત આપે છે, ખૂબ સત્ત્વ ખીલવે છે, મહાન સદ્ગુણી સદાચારી બનાવે છે. વાત આટલી જ કે સાચા ભાગ્યશાળી બનવા માટેનું પાંડું જીવનધોરણ બનાવી દેવું જોઈએ.

U

આવું ઉપકરણ તો અધિકરણ બની જાય

V

કણાટકનાં ટુમકુર ગામમાં હાર્ટ-એટેક આવતાં પૂજ્યશ્રી હોસ્પિટલમાં હતા. શાતા પૂછવા મુંબઈથી હું ગયો હતો. હોસ્પિટલમાં પણ પૂજ્યશ્રીને લેખન આદિ કાર્ય ચાલુ હતું. મારી પાસે એક બોલપેન હતી તેનો લાભ આપવા પૂજ્યશ્રીને મેં વિનંતી કરી. પૂજ્યશ્રીએ તે હાથમાં લઈને જોઈ, તે અત્યંત આકર્ષક હતી અને જીણી લઈટ પણ તેના ઉપર હતી.

પૂજ્યશ્રીએ તે બોલપેન તુરત મારા હાથમાં પાછી આપી દીધી.

“આવું ઉપકરણ તો અધિકરણ બની જાય, મારે ખપ નથી. બીજા કોઈ સાધુને પણ આ બોલપેન આપતા નહિ.”

સંયમની કેટલી કાળજી ! આશ્રિતોનાં હિતની પણ કેટલી કાળજી !

W

-“ભુવનભાનુ એક સોનેરી પાનુ” પુસ્તકમાંથી સાભાર

X

(૨૩) ધર્મ આચરવા છતાં ધર્મનું જોમ કેમ નહિ ?

જગતમાં દેખાય છે કે શરીરનો વ્યાયામ કરતાં શરીરનું જોમ વધે છે, અને બુદ્ધિનો વ્યાયામ કરતાં બુદ્ધિનું જોમ વધે છે, તો પછી ધર્મનું સેવન કરતાં કરતાં ધર્મનું જોમ વધું જોઈએ. પરંતુ જીવનમાં કેમ એનો અનુભવ નથી દેખાતો ? નથી દેખાતો એ સત્ય હક્કિકત છે; નહિતર ફરિયાદ ન કરવી પડત કે ‘મંદિરમાં સારો સમય કાઢી વીતરાગની ભક્તિ કરીએ છીએ; પરંતુ દિલમાં વીતરાગ ભક્તિનું એવું જોર જીમેલું કેમ નથી દેખાતું ? તપસ્યા અવરનવાર કરતા રહીએ છીએ છતાં સાચી તપની લગની કેમ નથી અનુભવમાં આવતી ? રસના, વિગઈના ત્યાગ રોજ કરતા રહીએ છીએ તો પણ ત્યાગ વૃત્તિનું જોમ કેમ નથી દેખાતું ? ત્યાગ કેમ બહુ મન મનાવીને કરવો પડે છે ?’

જેમ દુનિયામાં પ્રવૃત્તિનો અભ્યાસ વધતાં વધતાં રસ વધે છે, વસ્તુ સ્વાભાવિક જેવી થઈ જાય છે, બાળક પરાણે પણ નિશાળે જવા માંડ્યા પછી ભણવાનું રસિયું થઈ જાય છે, એવી રીતે ધર્મની નિશાળે ભણવા બેઠા પછી અને વરસો સુધી ભણ્યા પછી પણ ધર્મનો સાચો રસ, ધર્મભાવનાનું જોમ, અનુભવમાં કેમ ન આવે ?

આનું નિદાન આ છે કે ધર્મસેવન કરવા છતાં સાથે ધર્મના પ્રતિપક્ષે યાને સામા પક્ષે સંસારની વાત-વસ્તુનાં આકર્ષણ અને મહત્વ હૈયે તેવાં ને તેવાં જ અંકિત રાખવા છે, અરે ! હજ તો વધુ ઘુંટવાં છે, એથી ધર્મનું જોમ ન વધે, ધર્મની સાચી સ્વાભાવિક વૃત્તિ ન ઘડાય, એમાં નવાઈ નથી. સાંસારિક બાબતોના આકર્ષણ એ ભર્સમ રોગ છે. એનો રોગી ધર્મ-સેવન રૂપી ગમે તેટલું ભોજન ખાઈ જાય પણ એમાંથી ધર્મરસ અને ધર્મજીમનું લોહી ન બનવા દે.

મંદિરમાં ભગવાનની ભક્તિ તો બે કલાક કરી, પરંતુ પછી કામરાગ અને સ્નેહરાગ પૂર્વના જેટલા જ જોશ, હોંશ અને ભોગ આપવા સાથે કર્યા, તો એ પેલી ભક્તિની અસર મારી નાખે છે. ‘મનહી મેં વૈરાગી ભરતજી મનહી મેં વૈરાગી’નું રહણ્ય આ છે કે ભગવાન ઋખભદેવના ભક્ત ભરતજીએ મનમાંથી સ્નેહરાગ અને કામરાગના જોશ અને હોંશ કાઢી નાખી હતી, રાગ હતા પણ રાગમાં આંધળિયા નહોતાં, રાગમાં નિશ્ચિન્તતા-નિર્ભયતા નહોતી; ભય રહેતો કે ‘આ રોગથી જે

સ્વાત્મકતલ થઈ રહી છે એથી મારું શું થશે ?’ ત્યારે અહીં જો આપણો વીતરાગને ભજવા છતાં સંસારના પદાર્થ અને પરિવાર પર હોંશો હોંશો રાગ કરવા છે, એનો કોઈ જ ભય નથી, તો પછી વીતરાગની ભક્તિનો સાચો રંગ અને જોમ ક્યાંથી જામે ?

એમ તપ વખતે તપ તો કરી લીધો, પણ બીજી બાજુ ખાનપાનનો ચડસ એટલો જ રાખ્યો, રસને એટલો જ લૂટ્યો. ભોજનની વાતમાં એટલી જ હોંશથી કૂદાં.

ખાતાં પીતાં ક્યારે ય ‘આ પરદેશી સંબંધ મારે શા માટે ? આ આહારસંશોની બલા, આ પુદ્ગલની વેઠ ક્યાં સુધી ?’ એવું કાંઈ જ થયું નહિ. ‘જીવન પૂરું થતાં પહેલાં જો આ સંશો ન કપાઈ, ભોજનની લાગતી સ્વાભાવિકતા ન મરી, એનો પક્ષપાત ન મર્યો, તો એ પરલોકમાં સાથે થશે ત્યાં મારું શું થશે ?’ એવો કોઈ ભય ન કેળવ્યો તો પેલો તપ બિચારો ધર્મનું જોમ અને તપનો જ રસ ક્યાંથી જમાવી શકે ?

એમ રસ-ત્યાગ, વિગઈ-ત્યાગ, કરતા રહ્યા, પણ બાકી ભોગવાના ખુલ્લા રાખેલા રસમાં પેલા ત્યાગનું સાટું વાયું, બીજે દિવસે વારાફરતી બીજો રસ-ત્યાગ કરીને ખુલ્લા કરેલા રસના જમણામાં એટલા ને એટલા જ હોંશિલા બન્યા, જરાય યાદ પણ ન કર્યું કે ‘આ રસ પણ ત્યાજ્ય અને ખતરનાક જ હોવાથી હજ ગઈકાલે તો એનો ત્યાગ કરવાનું ઉહાપણ રાયું હતું તો આજે એની બોલબાલા શી કરવાની ?’ ના, આમાંનું કશું નહિ અને નિર્ભક્કપણે રસના પૂરા રસ કેળવે રાખ્યા, તો પછી પેલો બિચારો રસત્યાગ શી રીતે ત્યાગધર્મનું જોમ આપી શકે ?

એમ, રોજ કે અવરનવાર સામાયિક તો કરાય છે, પરંતુ બાકી સંસાર એટલે અસામાયિક, સાવધ કથલો, ખટકાય જીવોના સંહાર એના પર કોઈ ઘૃણા કોઈ જ અણગમો, કોઈ જ ભય નથી રાખવો, સંસારના મોહભર્યા વ્યવહાર, પૈસાટકા-પરિવાર, ચૂલો-હોલો, ધંધો-ધાપો, વગેરેનું આકર્ષણ જરાય ઓછું નથી કરવું, એનું મહત્વ જરાય હૈયેથી ઉતારવું નથી, પછી પેલું બિચારું સામાયિક નિષ્પાપતાના ધર્મનું જોમ ક્યાંથી આપી શકે ? હોંશ ક્યાંથી કરાવી શકે ?

એમ, વ્રતનિયમ વગેરે કોઈ પણ ધર્મ-અનુષ્ઠાન-આચરણ આચરવા છતાં બીજી બાજુ ઇન્દ્રિયોના વિષયોનો આવેશ અને કોઇ-લોભાદિ કષાયની ભરપૂર આસેવના એટલી જ ઊભી રાખવી છે, વિષયો પ્રત્યે સુગ અને કષાયો પર અરેરાટી અનુભવવી નથી, તો પછી પેલાં ધર્મચરણ ચાલુ છતાં ધર્મનું જોમ અને ધર્મની હોંશ ક્યાંથી કેળવાય ?

સારંશ, ધર્મ-પ્રવૃત્તિ કરવાની જેટલી અગત્ય છે, એટલી જ અગત્ય સંસારના અંગો અને સંસાર પરનાં આકર્ષણ મોળાં પાડવાની છે. હૈયામાંથી એનાં મહત્વ કાઢી નાખવાની છે, અને અર્થ-કામ પર ઘૂણા, અરેરાટી તથા એનો ભય અને કંપ કેળવવાની અગત્ય છે, અતિ આવશ્યકતા છે.

U

પ્રમાદને પોટાડી દીધો

V

ચૈત્ર વદ-૧૩ ના દિવસે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. તેના ૧૨ દિવસ પહેલાનો આ પ્રસંગ છે. ચૈત્રી પૂર્ણિમાની સાંજના અપ્રમત્તાભાવે પ્રતિકમણ - સંથારાપોરિસી આદિ કિયા કરીને રાત્રે સૂતા. હું તેઓશ્રીની સેવામાં હતો. મારો સંથારો તેઓશ્રીની નજીકમાં હતો. રાત્રે ૧ વાગો તેઓશ્રી ઊઠ્યા.

“સાહેબજી, હજુ તો એક વાગ્યો છે, સૂઈ જાઓ.” મેં કહું, “અરે, દિવસે સમય નથી મળતો, લખવાનું ધણું છે. જિંદગી સૂવામાં કાઢવાની છે ?” એમ કહીને પૂજ્યશ્રી તો વીટીયાના ટેકે લખવા બેસી ગયા. મને કહું, તું સૂઈ જા. અસ્વસ્થ તબિયતે પણ તેઓશ્રી રાત્રે જાગીને લખવા બેસી જાય ત્યારે હું કેવી રીતે સૂઈ શકું ? હું જાપ કરવા બેઠો. પૂજ્યશ્રીએ રાત્રે ૧ થી ૩ સુધી લખ્યું. ત્રણ વાગો લખીને ઊઠ્યા એટલે મેં કહું : સાહેબજી હવે આરામ કરો. “હવે તો જાપનો સમય થઈ ગયો છે.” કહીને જાપ કરવા બેઠો. ૩ થી ૫ સુધી જાપ કર્યો. ત્યારબાદ ઊભા ઊભા પ્રતિકમણ કર્યું.

લક્વાની બિમારીને કારણે કદાચ બોલેન્સ ન રહે તો !- તે વિચારથી હું તેઓશ્રીની નજીકમાં ઊભો રહ્યો. તેમણે કહું : “તું તારું પ્રતિકમણ કર. હું પડી નહિ જાઉ, ગભરાઈશ નહિ.”

અપ્રમત્તાભાવે અદ્ભુત પ્રતિકમણ તેઓશ્રીએ કર્યું અને હું તે જોતો રહ્યો.

—“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

W

X

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૧૮, તા. ૮-૨-૧૯૬૩

(૪) જીવન શું ?

જીવન શું ? કઈ કિયાને ઉત્તમ જીવન કહેવાય ? આ એક પ્રશ્ન વિચારણા માગી લે છે. વિચારવું એટલા માટે જરૂરી છે કે જો એનું ચોક્કસ સ્વરૂપ નિશ્ચિત થઈ ગયું હોય તો પછી આપણી બીજી બધી કિયા કરતાં પણ ચોંટ એ અમુક ચોક્કસ પ્રકારની જીવનકિયા ઉપર રહે, અને જરૂર જઈને આપણે મન, વચ્ચન કે કાયાથી ત્યાં ઠરીએ, તેમજ ઉત્તમ જીવન જીવાનો આનંદ રહે, તે યાવત્તુ મૃત્યુકાળે પણ મસ્ત રહીએ કે ‘ફિકર નહિ સારું જીવો છું.’ જો ચોક્કસ પ્રકારની ઉત્તમ જીવનકિયાનો નિર્ધાર નથી, લક્ષ નથી તો જીવવા છતાં સાચો આનંદ નથી, ધરપત નથી, અને અંતકાળ હુંખભર્યો, શોકભર્યો અને હતાશાભર્યો આવે છે.

તો પ્રશ્ન આ છે કે ઉત્તમ જીવન એટલે કઈ કિયા ? કઈ પ્રવૃત્તિ ? માત્ર શાસોચ્છ્વાસ નહિ, એ તો કીડાને પણ છે. કેટલાક એમ માની બેઠા છે કે ‘ખાવું પીવું એ જીવન, કેમ કે ખાધાપીધા વિના જીવી શકાતું નથી, અને વેપારધંધો બધું કર્યા પછી છેવટે નિરાંતે ખાવાપીવાનું જોઈએ છે.’ પરંતુ આ કથન ઠીક નથી. ‘ખાધા વિના ન જીવાય માટે એ જીવન,’- એ તો એના જેવું થયું કે ખાધા વિના વેપાર ધંધો નથી થઈ શકતો. માટે ખાવું પીવું એ જ વેપાર પણ ખરેખર એવું નથી, વેપાર એ ખાવાપીવાથી એક તદ્દન જુદી જ કિયા છે. એક વસ્તુ સાધન હોય, પણ તે કાંઈ મુખ્ય કાર્ય નથી. ખાવું એ સાધન છે, કિન્તુ એ જ વેપાર નથી. વેપાર એક જુદી કિયા છે. એમ, જીવન એક જુદી કિયા છે, અને ખાતાંપીતાં જેમ વેપારીને વેપારનું લક્ષ રહે છે એમ મનુષ્યને ઉત્તમ જીવનકિયાનું લક્ષ રહેવું જોઈએ.

ધ્યાનમાં રહે કે ‘જીવન’ એટલે ઉત્તમ જીવનની આ વાત છે, અધમ જીવનની નહિ. કીડાંકોડા, ‘ખાવું એજ જીવન,’ એમ સમજે છે, અને એમાં જ મશગુલ રહે છે; પણ એ અધમ જીવન છે.

ત્યારે આરામી એ પણ જીવન નથી, કેમ કે દા.ત. ઝડપ પાનના જીવો, યા ‘અ’ વર્ગની જેલ ભોગવનારાઓ આરામીય ધણીય લોગવે છે, છતાં એ પ્રશંસનીય જીવન નથી ગણાતું.

ત્યારે શું વિષયવિલાસ, રંગરાગ એ જીવન છે ? ના, રાજાની રાણીએ પાળેલા કૂતરા-કૂતરીને એ મળે છે, છતાં એવું કૂતરા-કૂતરીનું જીવન કોઈ પસંદ

૧૭૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

નથી કરતું, નથી ચાહતું. માટે એ ઉત્તમ જીવનક્રિયા નથી.

એમ, સ્વતંત્ર જીવનું એ પણ જીવન નથી; કેમ કે વનના સિંહ સ્વતંત્ર જીવે છે, કોઈની તાબેદારી નહિ, છતાં એનું જંગલી અધમ જીવન કહેવાય છે.

કેટલાકો વેપારને જ જીવન બનાવી દે છે. આધા જાય, પાછા જાય પણ લક્ષ વેપાર પર ! ક્યાંક મળવા ગયા, ફરવા ગયા, પણ વેપારની વાત જટ કાઢશે, અગર બીજો વાત કાઢશે તો એમાં ભારે રસ લેશે, કેમ કે મુખ્ય જીવન વેપારને જ માન્યું છે. પણ આ વ્યાજબી નથી. વેપાર વિના ન ચાલે એ એક જુદી વસ્તુ છે; પરંતુ તેથી કંઈ વેપાર એ જીવન નથી. એટલા માટે તો સરભરમાં કે ખોટમાં વ્યપાર ચાલતો હોય છતાં માણસ-એને વેપાર માનવા તૈયાર નથી, કહે છે 'કાંઈ વેપાર નથી ચાલતો, કેવળ મજૂરી ચાલે છે. અગર 'સોના સાઈઠ કરીએ છીએ.' એ તો મન માન્યો નશો મળે તો જ જીવને હુંફ રહે છે કે વેપાર ઠીક ચાલે છે. બસ, જીવન માટે પણ આવું જ કાંઈ છે કે મનગમતો લાભ દેખાય એવી કોઈ ખાસ કિયા એ જીવન બની શકે.

આમાં લાભ પણ નક્કર અને લાંબા ગાળાનો હોવો જોઈશે. વેપારમાં લાભનું પ્રમાણ તો મોટું હોય, પરંતુ જો ઇન્કમટેક્ષ વગેરે ટેક્ષો એમાંથી બહુ તાજી જાય છે અગર પછી એ જ વેપાર કે બીજા વેપાર આ લાભને ખાઈ જાય એવી ખોટ દેખાડે તો જીવને નિરાંત નથી થતી. એ તો સંગીન, સ્થાયી અને ઘડપણે કામ લાગે એવા લાભની જંખના રહે છે તો જ એ લાભ આપનાર વેપારને ઠીક વેપાર તરીકે માને છે. એ જ રીતે જીવન કિયા પણ કોઈ એવી ચોક્કસ પ્રવૃત્તિને અને તે પણ સંગીન સ્થિર અને અંતકાળ તથા પછી પરલોક સુધી પહોંચે એવા લાભને કરાવનારી હોય તો જ એ ઠીક જીવન કિયા છે.

એવી જીવન કિયા કઈ છે ? ખાવુંપિંનું, રંગરાગ ઉડાવવા, વેપારધંધા કરવા, કે આરામી કરવી એ ખાસ જીવનક્રિયા નથી. કીડી સારું ખાય છે. રાણીના ઝૂતરા રંગરાગ ઉડાવે છે, અનાર્યો બહુ મોટા વેપાર અને કમાઈ કરે છે, જંગલી સિંહ આરામી સ્વતંત્રતા ભોગવે છે પણ આ કોઈનાં જીવન ઊંચા જીવન નથી, છેવટ એક જ વાત આવીને ઊભી રહે છે. જીવન તો દાન, શીલ, તપ, ભાવનાની આરાધનાને જ કહેવાય એ જ ઉચ્ચ પ્રશંસનીય માનવ જીવન છે. એમાં જેટલા પ્રવૃત્તિશીલ રહ્યા એટલું જીવન ઉત્તમ જીવ્યા ગણાય. ખાનપાન, વેપાર, આરામી વગેરે બીજી કિયાઓ ચાલે એમાં લક્ષ આનું જ રહેવું જોઈએ, અર્થાત્ એ બધું કરીને દાનાદિ ધર્મને જ પગભર અને પુષ્ટ કરવાના છે.

દાનાદિ ધર્મ એ જીવન હોવાનું કારણ આજ કે આનાથી જીવને નક્કર શાંતિ અને હુંફ મળે છે; અને તે લાંબા કાળ સુધી ચાલી શકે છે; તેમજ અંતકાળ ખુશનુમાં આપે છે; અને પરલોકમાં તો સારી સદ્ગતિ અને આત્માનું ઉધ્વરીકરણ કરે છે, એમાં પૂછવાનું જ શું ? અલબત્ત વેપારમાં કમાઈની જેમ દાનાદિ ધર્મ સાધનામાં આંતરિક આશય વિશુદ્ધિ તથા અધ્યાત્મભાવની વૃદ્ધિ અને પાપથી બચી સતતપૂર્તિ મળ્યાનો નિર્ભેણ અનહદ આનંદ થઈ રહ્યો છે ને એના પર પાકી ચોંટ રહેવી જોઈએ તો જ એ દાનાદિપ્રવૃત્તિ એ ઉત્તમ જીવનરૂપ છે, ક્ષણો ક્ષણો મન, વચ્ચન કે કાયાથી આજ જીવનની તકેદારી રહે; અને એ થયા કરે એમાં જ લાગે કે ખરેખર જીવન જીવી રહ્યો છું.

U

અરિંદતની વફાદારી

એક વાર લાંબો વિહાર કરીને સાંજે એક ગામમાં પહોંચ્યા. ગામમાં જૈનોના ઘર નહોતા. શાળાના મકાનમાં ઉતારો હતો. લાંબા વિહારને કારણે થાકેલા મોટા ભાગના સાધુઓ પ્રતિકમણ બાદ જદ્દી સંથારો કરી ગયા હતા. રાત્રે ગામના જૈનેતર ભાઈઓએ પ્રવચન સંભળાવવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ સરણ અને સરસ શૈલીમાં ૧॥ કલાક સુધી પર્ષદાને ઉચિત પ્રવચન કર્યું.

સવારે મેં પૂછ્યું : “ગુરુદેવ ! આટલો લાંબો વિહાર હતો. આપે આરામ કરવાના બદલે થાકેલા શરીરે પ્રવચન આપ્યું... તેવી શી જરૂર હતી... લોકો તો વિનંતી કરે...”

“જુઓ, ભાઈ, આપણે તો અરિંદતની પેઢીના સેલ્સમેન છીએ. ઘરાક આવે છતાં માલ ન વેચીએ તો શેઠનો વિશ્વાસધાત કહેવાય... આપણો થાક ન જોવાય, શેઠ પ્રત્યેની વફાદારી જોવાની...”

W

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર X

(૭) ધર્મની અવિચ્છિન્ન પરંપરા અને ધાર્મિક શિક્ષણસત્ર

ધર્મના નાયક ધર્મની સ્થાપના કરે છે, પરંતુ તે પછી એ ધર્મની અવિચ્છિન્ન પરંપરા શાના ઉપર ચાલે છે એ ખાસ વિચારવા જેવું છે. વિચારવાનું કારણ એ છે કે આપણા મહાન ભાગ્યોદયે આપણા સુધી તો એ ધર્મપરંપરા ચાલી આવી. પરંતુ હવે આગળ પણ નવી પ્રજામાં એ ચાલુ રહેવામાં ખરેખર ક્રયા ઉપાય કરી રહ્યા હોય છે, એનો જો સાચો નિર્ણય હોય, તો ખાસ એના પ્રયત્નમાં રહેવાય, અને તેથી ધર્મપરંપરા ચાલુ રહેવાનું બની શકે; નહિતર ભળતા ઉપાયના પ્રયત્ન કરવામાં આવે અને એના વામોહમાં સાચા ઉપાય તરફ લક્ષ જ ન દેવાય, તો ધર્મપરંપરા ટકી શકે નહિ.

ત્યારે આ વિચારવાનું છે કે ધર્મની પરંપરા ખાસ કઈ વસ્તુ પર ટકે ?

આજે કેટલાકને મુંજવણ થાય છે કે ‘જુઓ બૌદ્ધ ધર્મ, ખ્રીસ્તી ધર્મ વગેરે કેટલી બધી જાહોજલાલી અનુભવે છે ! જ્યારે આપણો જૈન ધર્મ જાંખો પડી ગયો છે ! આ મુંજવણની પાછળ એ સમજ કરી રહી છે કે ‘ધર્મ એટલે ધર્મનું ખૂબ સાહિત્ય, ધર્મના અનુયાયી તરીકે નામ ગણાવનારાઓની જગ્યા સંખ્યા, મોટા મોટા ભાષણો વગેરેના આઉબર, વગેરે વગેરે. એ જ્યાં દેખાતું હોય તે ધર્મ જાહોજલાલીવાળો ગણાય.’

પરંતુ અહીં મોટો સવાલ તો એ છે કે આ તો સામૂહિક દેખાવની વાત થઈ. પરંતુ ધર્મનો મુખ્ય ઉદેશ તો જીવનાં કલ્યાણના વિકાસનો છે, તો એ કલ્યાણ-વિકાસ થઈ રહ્યો છે કે નહિ એ ખાસ જોવાનું છે. વસ્તુગત્યા ધર્મનું અસ્તિત્વ હોવાનું જીવોના કલ્યાણ-વિકાસના આધારે માપી શકાય; કેમ કે ધર્મ કલ્યાણ-વિકાસની સાથે સંકળાયેલો છે. જો ધર્મનું નામ તો છે, પરંતુ કલ્યાણનો વિકાસ કોઈ જ પ્રકારનો દેખાતો નથી, છે જ નહિ, તો સમજવું પડે કે ત્યાં વાસ્તવિક ધર્મનું અસ્તિત્વ નથી. વાત પણ સાચી છે કે જીવનું અહિત, દુર્દ્શા, અધમ સ્થિતિ, અનર્થ-અનિષ્ટ એટલાં જ તીવ્બાં હોય, કે બલ્કે કદાચ વધેલાં હોય તો ત્યાં એનામાં ધર્મ જેવી ચીજ જ શી હ્યાત ગણાય ?

આજે જોઈએ તો આ દેખાય છે કે બૌદ્ધ-ખ્રીસ્તી વગેરે ધર્મના અનુયાયીઓની સંખ્યા મોટી ગણાય છે, એમનાં થોક સાહિત્ય બહાર પડે છે, મોટા મોટા પ્રચારની

યોજનાઓ, ભાષણો વગેરે થાય છે, પરંતુ મુખ્ય વાત એમનાં વ્યક્તિગત જીવન તપાસો, આત્મકલ્યાણનો વિકાસ કેટલો દેખાય છે ? ને નિરંતર હિસા, યથેચ્છ વિલાસો, લક્ષી પાછળ આંધળી મમતા અને દોટ, નિસ્સીમ આરંભ-સમારંભ, માયા-પ્રાંચ-અહંત્વ-ઈચ્છા પરલોકપરાડુખતા, ઈત્યાદિ કેટકેટલા અનર્થ પ્રસરી રહ્યા છે ? ત્યારે શું ભૌતિક દાસ્તિના આ બધા અનર્થ અને ભૌતિક દાસ્તિ મુક્તપણે વિહરી રહ્યા હોય એનામાં ધર્મ જેવી કોઈ વસ્તુ છે ? આવાઓના આધારે શું ધર્મની જાહોજલાલી માનવી ?

ખરી વાત એ છે કે ધર્મ ભાષણોમાં નથી, સાહિત્યપ્રચારમાં નથી, વિપુલસંખ્યક ધર્મનુયાયી તરીકેના નામ ધરાવવામાં નથી, કિન્તુ પવિત્ર આચાર-વિચારમાં છે. ધર્મ કોઈ મૂર્તિમાન વસ્તુ નથી, ધર્મ એ તો ધર્મત્માના જીવનસ્વરૂપ છે. સાચા ધર્મત્માની પવિત્ર માનસિક-વાચિક-કાચિક પ્રવૃત્તિ કહો, કે વિશુદ્ધ આચારવિચાર કહો, એ જ ધર્મ છે. એ હ્યાત છે તો ધર્મ હ્યાત છે, એ વિશુદ્ધ આચારવિચારની પરંપરા ચાલુ છે તો ધર્મની પરંપરા ચાલુ કહેવાય. એ અટકી જાય, તો ધર્મપરંપરા પણ અટકી ગણાય. હજાર માણસને ધર્મનું ભાષણ સાંભળવામાં જોડ્યા પરંતુ એ સાંભળીને હરામ એમણે જીવનમાં કાંઈ ઉતાર્યું ! ખાલી તાલીઓ પાડી ! તો એના કરતાં ફક્ત દસ જ માણસને જો ધર્મના પવિત્ર આચાર-વિચારમાં જોડ્યા, તો એ ખરેખર ધર્મસેવા છે, ધર્મરક્ષાનું એક નક્કર કાર્ય છે, ધર્મપરંપરાનું પૂરક છે.

ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પછી ધર્મપરંપરા આજ સુધી અવિચ્છિન્ન ચાલી આવી છે તે આનાથી અર્થાત્ ભવ્યાત્માઓમાં પેઢી ઉતાર ધાર્મિક આચારો અને ધાર્મિક વિચારો અંડપણે જીવાતા આવ્યા હોવાથી. આજે પણ જો નવી પ્રજામાં એ પવિત્ર આચાર વિચારો જીવનમાં જીવાતા રહેશે તો ધર્મ જીવંત ગણાશે અને ધર્મની પરંપરા આગળ વધશે.

આજની કેળવણી લેતી નવી પ્રજા જે જાતની આજની પદ્ધતિનું જીવન જીવી રહી છે, એમાં ધાર્મિક આચાર વિચારનું લગભગ મીઠું જ છે એ આજે સ્પષ્ટ દેખાય છે. આર્ય પ્રજાને જો એ આચાર-વિચારનો ખપ નથી તો નવા જમાનાએ પોતાના આચાર-વિચારો ગોઈવી દીધા છે. પરંતુ એમાં આર્યસંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે, અને આર્ય પ્રજા પવિત્ર સંસ્કારથી વંચિત અને ધર્મવિમુખ બની રહી છે. ધર્મપરંપરા પર આ એક જબરદસ્ત ફટકા સમાન છે. આજના નેતાઓને પણ નવી પ્રજામાં આવેલી ગેરશિસ્ત, ઉદ્ઘતાઈ, અનાચાર, ઉચ્છ્રખલતા વગેરે અંગે સરીયામ ફરિયાદ

કરવી પડે છે; અને છાપાના રોજના અહેવાલો અપમંગળ વાતો સુશાવી જાય છે.

અલબત્ત જૂની પ્રજામાંય આચાર-વિચારને ધક્કો નથી લાગ્યો એમ નહિ અને એના પ્રત્િકાર રૂપે ખાસ ઠિલાજ હાથ ધરવા જેવા નથી એમ નહિ, કિન્તુ નવી પ્રજાનો પ્રશ્ન વિશેષ ચિંતાનો વિષય બન્યો છે, કેમ કે ભવિષ્યનો જૈન સંઘ આ ઉગતા જૈન ભાગ્યવાનોનો બનવાનો છે, અને એ ટકાવારીની દસ્તિએ આજથી ૨૫-૩૦ વર્ષ પૂર્વેની નવી પ્રજા કરતાં આચાર-વિચારમાં બહુ પદ્ધત પદ્ધત છે.

એમને ધાર્મિક આચાર-વિચાર તરફ વાળવા માટે અનેક ઉપાયો પૈકી એક મહાન ઉપાય ધાર્મિક શિક્ષણ વર્ગ છે. એમાં રોજ લાભ ન લઈ શકનાર માટે રવિવાર જેવા દિવસોના શિક્ષણ વર્ગ, અને મોટા ગ્રીઝાવકાશ (ઉનાળાની રજાઓ) વગેરેના વર્ગ ચલાવવા જોઈએ. એમાં પણ ખાસ ધ્યાન, ધાર્મિક આચાર-વિચારનું ધડતર એ વિદ્યાર્થીઓમાં થઈ રહ્યું છે ને, એનું રાખવાનું છે.

જાણવા મળ્યું છે કે આ વર્ષે ઉનાળાની રજાઓમાં અચલગઢ પર મે માસમાં એક વિદ્યાર્થી શિબિર યોજવાની છે. તો એમાં ધાર્મિક આચાર-વિચારનું શિક્ષણ-સંસ્કરણ મેળવવાની એક મહાન તક ગણાય. ધર્મપ્રેમી માબાપોની ખાસ ફરજ છે કે આવી તકનો લાભ પોતાના છોકરાઓને ખાસ અપાવવો જોઈએ, જેથી જડવાદી કેળવણીનાં હદ્યમવિષ જેરનું સર્વથા કે અંશેય નિવારણ થાય, અને આધ્યાત્મિકતા, ધાર્મિક વૃત્તિ, તત્વજ્ઞાન, સદ્ગ્યારો ને પવિત્ર ભાવનાઓ વગેરે એમનામાં સ્થાન પામે.

તપ પણ ત્યાગથી અલંકૃત

સંવત ૨૦૧૮ની સાલમાં પિંડવાડા મુકામે પરમારાધ્ય, પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રીની નિશ્રામાં અદ્યયન નિમિત્તો ચાતુર્મસ કરવાનું થયેલ. પૂજ્યપાદ પંચાસજી શ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબને વર્ધમાન તપની ઓળી ચાલુ જ હતી. તેઓશ્રીનો ઓળીમાં ત્યાગ ગજબ હતો. રોટલી અને દાળ ! બીજું કંઈ ન જોઈએ. ધણીવાર તો એકલી રોટલી વાપરી જતા અને ઉપર થોડી દાળ પી લેતા. તેમજ આચંબિલના તપ સાચો આખો દિવસ અપ્રમત્ત જીવન. તોમાં સાધુઓને વાચના આપવાની. વ્યાખ્યાન તથા રાત્રે પણ ચંદ્રમાની ચાંદનીમાં લખવાનું કાર્ય ચાલુ. નિકા બહુ ઓછી...

-“ભુવનભાનું એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૨૨, તા. ૨-૩-૧૯૬૩

૨૬ દસ્તિ સંશોધન અને અજાત સાધનાઓ

માણસ પ્રતિકૂળતા ઊભી થતાં મુંજાય છે, ઉદ્દેગમાં પડે છે, શોક કરે છે, આર્તધ્યાનમાં ચઢી કિંમતી મનને માલિન, સ્વભાવને નિઃસત્ત્વ અને આત્માને કર્મથી ભારે કરે છે. આપત્તિ ભોગવવામાં બે કર્મ છોડતાં દુધ્યનથી બાર કર્મ બાંધવા જેવું કરે છે. આ બધું શાથી ?

કહો, દસ્તિ (૧) મેલી છે, ચોકખી નથી; (૨) ઉપરછલકી છે, ઊંડી નથી; (૩) સાંકડી છે, વિશાળ નથી; ને (૪) એકાંગી છે, અનેકાંગી નથી; તેથી મુંજવણ, શોક, ઉદ્દેગ, દુર્ધ્યાન, કર્મબંધ થાય છે. આને જરા સ્પષ્ટ કરીએ.

(૧) દસ્તિ મેલી એ રીતે કે કેવલ દુન્યાવી સુખનું લાલચૂડાપણું છે, અને કષ સહવામાં અખાડા છે. કયાંક જમવા જાય અને એકલી મિઠાઈ જાપટે, પણ પૂરી-શાક-દાળ-ભાતને ન અડે તો લાલચૂડો ગણાય. કોઈની સાથે યાત્રા-પ્રવાસે જાય અને કામકાજમાં સહકાર ન આપતાં બિસ્તર બિધાવી એકલી આરામી અને માલ ઉડાવવાની દસ્તિ રાખે તો તે મેલી દસ્તિ ગણાય. એમ જીવનમાં એકલું સુખ ખેપે અને કષ આપત્તિ ન ખેપે એ દસ્તિ મેલી છે.

(૨) દસ્તિ ઉપરછલકી એ રીતે કે પ્રતિકૂળતાની પાછળ પોતાનાં જ પૂર્વભવનાં પાપાચરણ અને તેથી ઊભી કરેલ અકાટ્ય કર્મસત્તા કારણ છે, તેમજ પ્રતિકૂળતા મનને લાગવા પાછળ પોતાની જ કાયાદિ પ્રત્યેની રાગદશા કારણ છે, એ જોવું નથી; માત્ર ઉપર-ઉપરનાં નિમિત્ત જોવાં છે.

(૩) દસ્તિ સાંકડી એ રીતે કે માત્ર પોતાની એકલતાની જ પ્રતિકૂળતા જોવી છે, એનું જ દુઃખ કરવું છે, પરંતુ જગતના અસંખ્ય-અનંત જીવો પર વરસી રહેલી કારણી પીડા-પ્રતિકૂળતા જોવી નથી, એનું દુઃખ કરવું નથી.

(૪) દસ્તિ એકાંગી એ રીતે કે આપત્તિ પ્રતિકૂળતા આવી તો ‘મારે વેઠવાનું આવ્યું, ગુમાવવાનું આવ્યું,’- એવી એક જ બાજુ જોવી છે, પરંતુ ‘આમાં ય કમાઈની તક છે, લાભનો અવકાશ છે,’ એ બીજી બાજુ નથી જોવી.

આ મેલી-ઉપરછલકી-સાંકડી-એકાંગી દસ્તિનું સંશોધન કરી ચોકખી-ઊંડી-વિશાળ-અનેકાંગી દસ્તિ બનાવવામાં આવે તો પ્રતિકૂળતા એક જાતની અનુકૂળતારૂપ બની જાય !

(૧) દષ્ટિ ચોકખી એ રીતે કે ‘બીજુ કેટલીય માનવભવ આદિ સગવડો મળી છે તો સાથે કષ-અગવડ પણું વધાવી જ લેવાનાં’ એવું પાંઠ માનસિક ધોરણ રખાય. (૨) દષ્ટિ ઊંડા એ રીતે કે સિંહની જેમ આ આપત્તિનું તીર મૂળ ક્યાંથી છૂટ્યું એ જોવાય; પૂર્વ કર્મ અને વર્તમાન રાગદશા પર જ નજર રખાય. (૩) દષ્ટિ વિશાળ એ રીતે કે ‘આ પીડા તો શું છે ? જગતમાં આના કરતાં અનંતગુણી પીડામાં બિચારા અનંતા જીવો રીબાઈ રહ્યા છે ! એની પીડા ટળો,’ એવી ભાવના રખાય તો (૪) દષ્ટિ અનેકાંગી એ રીતે કે ‘આ પ્રતિકૂળતામાં માત્ર પીડા જ નથી, કિન્તુ આમાં સારી સાધના-આરાધના કમાવાની પણ તક છે,’ એનો વિચાર કરાય. એ સાધના આ રીતે વિચારવાની છે.

માણસ પ્રતિકૂળતામાં રોદણું જ રહે છે ‘મારા પૈસા ગયા ! મારું શરીર બગડી ગયું ! મારે કષ ઊસું થયું !’ પણ ખરી રીતે તો એ જોવું જોઈએ કે આમાં જ ધર્મસાધના અને ગુણસાધનાની સુંદર તક છે. ધર્મની સાધનામાં જેમ દેવદર્શન, અહૃદ્ભક્તિ, દાન, પ્રતનિયમ, તપસ્યા, વગેરે છે, એમ શુભ ભાવનાઓ પરમેષ્ઠિ-સ્મરણ, તત્ત્વવિચારણા, પરીસહસ્રાણ, સકામનિર્જરા, ત્યાગ વગેરે પણ છે. તેમજ ગુણસાધનામાં વૈરાગ્ય, ક્ષમા, તિતિક્ષા-(સહન કરવાની મનોવૃત્તિ), સમભાવ, ધૈર્ય, ગાંભીર્ય, કરુણા, વગેરે આવે. પ્રતિકૂળતામાં આ શુભ ભાવનાદિ તથા વૈરાગ્ય ક્ષમાદિને કેળવવાનો સારો અવસર છે. અરે એમ કહીએ તો ચાલે કે પ્રતિકૂળતા, આપત્તિ, કષ વખતે જ આ સાધનાને ખરો અવકાશ છે; અને આ સાધનાઓ સીધી આત્મસ્પર્શી છે. એમાં આત્માનું ખરેખરું સમ્યગ્ર ઘડતર સંસ્કરણ થાય છે. માત્ર જરા બુદ્ધિ વાપરીને તે તે પ્રતિકૂળતામાં આવું સારું તત્ત્વ શોધી કાઢવું જોઈએ.

દા.ત. તાવ વગેરે બિમારી આવી, તો (૧) છૂટથી એકાગ્ર ચિત્તે ભરપૂર નવકારમંત્ર જપવા ચિંતવવાનો અવસર મળ્યો. (૨) આમ ષડ્રસ-છ વિગઈઓમાંથી એક પણ નહોતી છોડાતી, તે અહીં કદાચ ચા દૂધ લેવાના હોય તો ય ચાર વિગઈના પચ્ચાખાણાની સુંદર તક મળી. વળી, (૩) ધંધાપાણી, આરંભ પરિગ્રહ વગેરે પાપ આશ્રવમાં દોડાડોડ કરતા હતા, તે હાલ અટકવાની તક મળી, (૪) પૂર્વકર્મના ક્ષયનો અવસર મળ્યો...

એમ પૈસા ગયા ત્યાં (૧) એ સદ્ગુરુવિચાર કરવાનો અવસર મળ્યો કે ‘પૂર્વે દાન-સુકૃત કરવામાંથી છટકવાનો પાપી આનંદ માન્યો હતો, પણ હું કેવો અભાગિયો કે પૈસા તો આમેય ગયા, અને પેલી તારક સુકૃતની તક ગુમાવી !’

વળી, (૨) હવે કેટલાક પાપ ખર્ચ ઓછા કરવાની તક મળી.

અપમાન વગેરે થયું ત્યાં (૧) અભિમાન અટકવવાનો અવસર મળ્યો, (૨) જીવોના કર્મની વિચિત્રતા વિચારવા તથા (૩) દયા ચિંતવવા તક મળે.

એમ કોઈ પણ આપત્તિ આવી ત્યાં (૧) ખામોશ-ક્ષમા અજમાવવાનો અવસર મળ્યો. (૨) સમતા-સમાધિનો અભ્યાસ કરવા તક મળી. (૩) સહિષ્ણુ અને ખડતલ બનવા, (૪) ઉદાર અને દયાળું બનવા, (૫) ભગવાનને દિલથી યાદ કરવા, (૬) ધર્મ વધુ કરવાની પ્રેરણ જાગવા, (૭) તૃષ્ણા અને અહંત્વ ઓછું કરવા... વગેરે વગેરે અનેક સુ-સાધનાઓનો અવસર પ્રતિકૂળતામાં મળ્યો માની અને સંઝણ કરવો.

U

રહસ્યોદ્ઘાટન

V

પૂર્વચાર્યાંએ દિવસમાં આપણે માટે ચાર વાર કેમ સજ્જાય ગોઠવી છે તેનું રહસ્ય ખબર છે ? ‘ના...જી...!’

સાંભળો. ભગવાનની આજ્ઞા છે કે ‘આપણે ચાઉક્કાલ (ચારેકાળ) સ્વાદ્યાય કરવો જોઈએ’ પ્રમાદવશ આપણે ચારકાળ સ્વાદ્યાય નથી કરી શકતા તો ભગવાનની આજ્ઞાભંગનો દંડ લાગે છે. તેથી પૂર્વચાર્યાંએ આપણા પર કરુણા કરીને ભગવાનની આજ્ઞાનો સત્યંકાર (પાલન) થાય એ હિસાબથી ચારકાળની ચાર સજ્જાય ગોઠવી છે. એટલે આ સજ્જાય કરતી વખતે આપણને ચારકાળ સ્વાદ્યાય કરવાની ઈચ્છા ઊભી થવી જોઈએ અને એવી આજ્ઞા કરનાર ભગવાન પ્રત્યે ગદ્ગદ ભાવ ઊભો થવો જોઈએ.’

પૂજ્યપાદ ગુરુદેવશ્રીનો સ્વાદ્યાય પ્રેમ, ભગવાનની આજ્ઞા પ્રત્યેનો ગદ્ગદભાવ અને પૂર્વચાર્યાંની કરુણામય દીર્ઘદિષ્ટ પ્રતિ કૃતજ્ઞભાવ આમાં છલકાતા જોઈ શકાય છે. આવા પૂજ્યપાદ ગુરુદેવશ્રીને વારંવાર નમવાનું મન કોને ન થાય ?

W X
-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

૧૮૨

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૂત (ભાગ-૨)

૮૭ વાસનાક્ષયનું અતિ જરૂરી કર્ત્વ્ય

જીવન આશા નિરાશા વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું છે. કોણ કહી શકે એમ છે કે મને કોઈ આશા જ નથી ? મને કોઈ ઈચ્છાજ નથી થતી ? તો એમ પણ કોણ દાવો ધરાવી શકે છે કે ‘મારે તો બધી જ આશા સફળ થાય છે ? કોઈ નિરાશા આવતી જ નથી ?’ કોઈ જ નહિ, સૌને કંઈ ને કંઈ ઈચ્છા થાય કરે છે, અને એ નિરાશામાં પણ પરિણામે છે. આમાં જીવ વ્યાકુળ બને છે. વ્યાકુળતા એ મહાન દુઃખ છે, કેમ કે એ બીજાં સુખ મળ્યાં છતાં એ નથી મળ્યાં એવી સ્થિતિ કરી દે છે. સુખનું સંવેદન ગુમ ! સંતાપનો અનુભવ ઊભો. એમાંથી દુષ્યાન અને એથી અશુભ કર્માનું ઉપાર્જન ! એટલે ભાવી દુઃખોને આમંત્રણ-પત્રિકા !

આમાંથી બચવું હોય, તો ખરું તો આશા-ઈચ્છાઓ જ અટકાવવાનું છે. પરંતુ સાંસારિક જીવન છે, વળી આશાઓ સેવવાનો ભરપૂર અભ્યાસ છે, તેથી એ કંઈ એકદમ બંધ નહિ થાય, તો શું કરવું ?

કરવા જેવું આ છે,- વાસના અને વિકારોને હટાવવા. હટાવવા મથવું, સમસ્ત દુઃખ, કલેશ વિટંબણાનું મૂળ એ છે. ઈચ્છાઓ પણ એના પર ફૂટે છે. પાપો અને અપકૃત્યો એ કરાવે છે. જેને વાસના નથી, વિકાર નથી, એને કોઈ દુઃખ નથી.

વાસના એટલે વિષયોનાં આકર્ષણ; વિકાર એટલે કખાયની લાગણી. ‘અમુક ખાનપાન હોય તો સારું, માન-સન્માન મળે તો સારું, પેસા ટકા ટીક હોય તો સારું, મોજમજહ-સત્તા-આરામી ઈત્યાદિ જોઈએ જ...’ વાસનાના આ ચાળા છે. આની પાછળ રાગ, દ્વેષ, આસક્તિ, દુગંધા, મમતા-માયા, મદ-અહંત્વ, રોષ-રોફ, ઈષ્ય-વેરજેર વગેરે કેટલાય વિકારો જીવને પીડ્યા કરતા રહે છે. જો આને જીવનના છેડા સુધી પોથે જઈએ અને જીવનપટ સંકેલાઈ જતાં પહેલાં આને ભુંસી ન નાખીએ તો સ્થિતિ ખતરનાક છે.

કારણ એ છે કે ભવાંતરે જો વાસનાઓ ઊભી છે, અને એને સંતોષવા પુષ્યાઈ છે નહિ, તો હૈયું બળી-બળીને ખાખ થવાનું થશે ! અને જો પુષ્યસામગ્રી સાથે વાસના છે તો ઉન્માદનો પાર નહિ રહે ! ઉભયથી મરો !

એટલા જ માટે જેની પાસે ધર્મનું બળ નથી, સુકૃતોનું ભાતું નથી, એના

પરભવે બેહાલ છે. કેમ કે ત્યાં પુષ્યાઈ પાસે હશે નહિ, એટલે ચીજ-વસ્તુની અનુકૂળતા મળવાની નથી, અને બીજી બાજુ વાસના જોર કરતી હશે; પછી ત્યાં બધ્યા જ કરવાનું થાય ને ? નાતમાં કન્યાઓ ઘણી છે, પણ હીનભાગી વાંઠાને એક પણ દેવા કોઈ તૈયાર નથી, અને વાસના જોર કરી રહી છે, તો એને દેખી દેખીને બધ્યા જ કરવાનું થશે ! શેઠને ત્યાં ઉમદા ખાનપાન છે, પણ નોકરને એમાનું કશું નથી મળતું અને ખાવાની વાસના જોરદાર છે, તો શું થવાનું ? બળતરાં જ ! વળી બીજું શું ? જિંદગીના છેડા સુધી વાસનાઓ અને લાલસાઓ ઊભી રાખી, તો એ પૂછે પડવાની છે. પુષ્યાઈ કરી નથી એટલે પરભવે અનુકૂળ મળવાના ફાંઝા રહેવાના. પરિણામ વાસનાથી સંતાપ, હૃદયદાહ, અને દુઃખની પોકો !

ત્યારે માનો કે અહીં ધર્મસાધના તો કરી, થોડાં સુકૃત પણ કર્યા, પરંતુ વાસના અને વિકારોનું જોર જરાય ઓછું ન કર્યું, ઊલટું સુકૃતોને અને ધર્મસાધનાને વાસના-વિકારો સાથે સાંકળી લીધી, ઈન્દ્રિયોના મનગમતા વિષયોની વાસનાને ધર્મસાધનાની ઉપર પુષ્ટ કરી, ધર્મના ફળ તરીકે વિષયસુખો ઈચ્છાં, અથવા વ્યક્ત તેવી ઈચ્છા તો ન થઈ, પરંતુ વિષયોની અનુકૂળતા મળતાં માન્યું કે ‘વાહ ! ધર્મ ફળ્યો !’ અથવા બીજાને તેવું મળ્યું દેખી ખીલ્યા કે ‘એને ધર્મ સારો ફળ્યો !’ તો આ વિષયવાસનાનું પોષણ થયું. એમ કખાયના વિકારો પણ ધર્મ કરવા પર પોષ્યા, દા.ત. કંઈક ધર્મ કરી, શાસ્ત્ર ભણી, અભિમાન કર્યું, માનપાન-પૈસાટકાદિનો લોભ કર્યો, તો એ કખાયવાસનાનું પોષણ થયું. હવે જિંદગીના અંત સુધી આમ જ વિષય-કખાયની વાસનાઓ પોષ્યે ગયા, જરા ય એની અફસોસી થઈ નહિ, તો પરિણામ એ આવીને ઊભું રહે કે ધર્મ કર્યો છે એના પુષ્યના ડિસાબે પરભવમાં સુખ-સામગ્રી તો મળે, પરંતુ સાથે આ પુષ્ટ તગડી કરેલી વાસનાઓ લાગુ રહેવાની. તેથી એ સુખસામગ્રીની અનુકૂળતા પર વાસના અને વિકારોનાં ભારે તોફાનમાં જીવના બેહાલ થવાના.

આમ પુષ્ય હોય યા ન હોય, બંને દશામાં વાસનાવિકારોથી જીવને મહાવિટંબણા છે માટે આ ઉચ્ચ માનવજીવનમાં આ એક અતિ આવશ્યક મહાન કર્ત્વ્ય છે કે વાસના અને વિકારોને નાબૂદ કરવા. એમાં રાગાદિ વિકારો પણ વિષયવાસના ઉપર ઊભા થાય છે. સંસાર છોડ્યા પછી પણ જો કાયારૂપી વિષયની સુખશીલતાની વાસના છે તો એના પર પણ રાગ, અહંકાર, વગેરે વિકારો જાગતા રહેવાના. માટે મૂળભૂત વાસનાનો ક્ષય કરવો એ પરમ કર્ત્વ્ય છે.

આ વાસનાના ક્ષય માટે એક પ્રબળ સાધન અનિત્યાદિ ભાવના છે. (૧) જડના સંયોગો અનિત્ય છે, (૨) જીવને વિષમ કર્મના ઉદ્ય અને મૃત્યુ વખતે કોઈ શરણ આપતું નથી, (૩) સંસાર વિચિત્ર છે, (૪) જીવ એકલો જન્મે છે, એકલો મરે છે, એકલો કર્મ ભોગવે છે, (૫) સંસારના જડ અને ચેતન પોતાનાથી પરાયા છે. આ બધી અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ વગેરે ભાવનાઓનું વારંવાર ચિંતન કરી કરીને વાસનાને નિર્બણ, અધિક નિર્બણ કરવાની. સાથે બને તેટલા રાગાદિ વિકારોને દભાવવાના. ચાચ્ય સાંસારિક પ્રવૃત્તિ હોય કે ધર્મપ્રવૃત્તિ, વાસના અને વિકારો ઓછા થતા આવે છે ને ? એ લક્ષ રાખવાનું, એના માટે શુભ ભાવનાઓ વગેરેના ઉદ્યમથી બને તેટલા એને એવા અટકાવતા જવાનું કે જીવનના અંતકણે અપૂર્વ શાંતિ-સમાધિ હોય.

U

લેખનનો વ્યાસંગ

V

વર્ષો પહેલા પૂજ્યશ્રીને જમણા હાથનાં કાંડામાં સામાન્ય ફેફ્યુર થયેલું. તને કારણે દર વર્ષ શિયાળામાં કાંડાનો દુઃખાવો થતો. બેંગલોરમાં પૂજ્યશ્રી બિરાજમાન હતા ત્યારે શિયાળામાં કાંડાનો દુઃખાવો શરૂ થયો. કોઈએ પૂજ્યશ્રીને કહ્યું : “સાહેબજી, આપના આ દુઃખાવા માટે મારી પાસે એક અક્સરી લેપ છે. આપશ્રી એ લેપ કરીને પાટો બાંધો તો આપને ઘણી રાહત રહેશે.”

પૂજ્યશ્રીએ કહ્યું : “જુઓ, આ લેખનકાર્યની મારી દુકાન ધમધોકાર ચાલે છે. આ દુઃખાવો તો વરસોથી દર શિયાળે આવે છે, મને કાંઈ નડતો નથી. હવે પાટો બાંધુ અને તેથી મારું લેખનકાર્ય સ્થગિત થઈ જાય તે મને ન પરવડે...”

“પાટો એવી રીતે બંધાશે કે આપનાં લેખનકાર્યમાં કોઈ અંતરાય નહિ નડે.”

આ રીતે ખૂબ આગ્રહ થતા લેપ કરીને પાટો બંધાવ્યો ખરો પણ લેખનકાર્ય તો યથાવત્ ચાલુ જ રાખ્યું.

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાસ X

W

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૨૪, તા. ૧૬-૩-૧૯૬૩

(૮) ઉન્નતિ માટે એક અતિ આવશ્યક તત્ત્વ

(૧)

રાજી કલ્યાણમાલાના પિતાને ખેઢ્યો પાસેથી છોડાવી લાવવાનું રામચંદ્રજીએ કલ્યાણમાલાને આશાસન આપ્યું, એટલે રાજીને ઘણી શાંતિ વળી. પછી એ વનવાસ નીકળેલા રામ-લક્ષ્મણ-સીતાને મહેમાન તરીકે રાખી ભક્તિ કરે છે. પરંતુ પછી તો થોડા જ વખતમાં રામ પાછલી રાતે વગર કહ્યે નીકળી ગયા. કેમ ? કામથી કામ, એશ આરામથી નહિ.

આત્માને ઊંચો લાવવો હોય તો આ અતિ જરૂરી છે કે કામથી કામ રાખો, મોજ-આરામી કે ગામ-ગપાટાથી નહિ. અલબત્ત રાતે જરૂરી નિદ્રા-આરામી લેવી પડે એ, કે બહુ થાક્યે આરામ કરવો પડે એ, તો પછી અધિક સ્ફૂર્તિ-શક્તિથી કામ કરવા માટે છે. પરંતુ અહીં જે વાત છે તે, -ચંચળ મનને લીધે કામની વચ્ચમાં વચ્ચમાં કરાતી આરામી, કરાતી બિનજરૂરી મોજમજાહદ, કે નવરા પડી કરાતા કુથલી-ગપાટા, વાતો-ચીતો, કામની-વચ્ચમાં વચ્ચમાં મરાતાં ડાઝોળિયાં, કરાતી વાતો કે હસા મશકરી, યા બીજાનીજા વિચારો,... બધું નકામું,’ એ કહેવું છે. એને છોડીને કામથી કામ રાખવું એ ઉન્નતિનો બહુ જરૂરી ઉપાય છે, અને એ સરળ પણ છે.

કામ સિવાયનું આદુંઅવળું છોડી દેવું સરળ એટલા માટે છે કે એમાં પૈસાનો ખર્ચ નથી, શરીરને કષ નથી, કોઈ એવું સહન કરવાનું કે એવી તપસ્યા નથી, કોઈ ખાસ લાભ જતો કરવાનો નથી. કામ વખતે ગપાટા ન મારીએ, આડાઅવળાં ડાઝોળિયાં ન લગાવીએ, બીજાનીજા વિચારો ન કરીએ, એમાં કયાં કશું કષ સહવાનું છે ? કે ભોગ આપવાનો છે ? એમ નવરા પડ્યા એશ-આરામી કે ગપાટાં ન મારતાં પરમાત્મસરણ, ધાર્મિક વાંચન-વિચારણા, યા બીજી સરળ ધાર્મિક પ્રવૃત્તિ કરીએ, એ ય શું મોંદું છે ? માત્ર મન પર લેવાનું છે કે ‘આમાં એક ભયંકર નુકસાન હું વહોરી રહ્યો છું.’ એ નુકસાન શું એ પછીથી વિચારીશું.

તે પહેલાં એ જોઈએ કે ઉન્નતિમાં ‘કામથી કામ, બીજાની નહિ’ એ શોફળો આપે છે ? કેમ એ અતિ જરૂરી છે ? અસ્થિર માણસ ઊંચે ચઢી શકે ખરા ? છ મહિનાના ખાટલેથી હમણાં જ ઉઠેલો પરંતુ હજી પગ લબડે છે એવો માણસ દાદર પર જપાટાબંધ ચઢી જાય ખરો ? ના, બસ એ રીતે અસ્થિર માણસ

ઉંચે ન ચડી શકે, કામથી કામ ન રાખતાં વચ્ચમાં ડાફોળિયાં મારનારો; વાતોચીતો, ઈધર ઉધરના દોઢદહાપણ કે વિચારો કરનારો અસ્થિર છે. એ આગળ ન વધી શકે. ભણતાં અસ્થિર રહેનારો વિદ્યાર્થી શું આગળ વધે? ધરાકી વખતે બીજા ત્રીજા નકામા ગાય્યાંસખ્યાં વગેરેમાં પ્રવર્તનારો વેપારી શું બહુ પામી શકે? ના, એજ રીતે અસ્થિર મન ધર્મસાધનામાં સાચું ચોટે જ નહિ, અને તેથી એની સાથે એકતાન ન થાય. તો એકતાન થયા વિના ધર્મ સાથે સગાઈ ક્યાંથી થાય? ધર્મ એ આંતરિક ચીજ છે, બાબુ ધર્મપ્રવૃત્તિ કરીને અંતરાત્મામાં ધર્મના અધ્યવસાય ઉછળતા કરવાના છે. તે એકતાનતા અને ઓતપ્રોતતા વિના ન બની શકે. એ માટે કામથી કામ, બીજાથી નહિ.’ એ સૂત્રનો બરાબર અમલ જોઈએ. તો જ ઉન્નતિ થાય.

આ ખાસ સમજ રાખવાનું છે કે લોકોને સાંસારિક જીવનમાં આડાઅવળાં ડાફોળિયાં મારવાની, વાતો-કુથલી કરવાની, કે એક કામ કરતાં બીજાતીજાં કામોનો વિચારો કર્યા કરવાની કુટેવ છે, એમને એનો પડધો ધર્મસાધના પર પણ પડે છે. ધર્મપ્રવૃત્તિ વખતે પણ આ ચંચળતા અસ્થિરતા કેડે છોડતો નથી, સાથે જ લાગેલી રહે છે, એટલે પ્રભુદર્શન-ચૈત્યવંદનમાં, સામાયિકમાં, બાધ્યાન સાંભળતાં, નવકારવાળી ગણતાં, કે ભણતાં ભણતાં ડાફોળિયાં ભરાય છે, કોણ આવ્યું, કોણ ગયું, વગેરે તરફ આંખ જેંચાય છે, વાતો કરાય અગર સંભળાય છે. આ ચંચળતા અસ્થિરતા દૂર કરવી હોય તો માત્ર ધર્મકિયામાં જ નહિ, પરંતુ સાંસારિક પ્રવૃત્તિમાં પણ ‘કામથી કામ; આડે અવળે આંખ, કાન, જ્બ કે મન લઈ જવાની શી જરૂર છે?’ આ ધોરણ પાંદું રાખવું જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૨૫, તા. ૨૩-૩-૧૯૬૩

(૧૫) (૨)

બહારમાં મન જવાથી શું નુકસાન?

હવે અહીં પ્રશ્ન એ છે કે,

પ્ર.: ચાલુ ધર્મકિયામાં જરા ડાફોળિયાં મારી લીધા, કે એમ ને એમ પણ જરા નવરા પડ્યા ને ગાય્યાં મારી લીધાં, કે જરા આડા પડી લીધું, યા બહાર આંટો મારી આવ્યા, એમાં શું કોઈ બહુ મોટું નુકસાન છે?

ઉ.: હા, નુકસાન ભારે છે. જો કે આમ તો એમ લાગે, કે ચિત્ત એટલું બહાર ગયું તો એટલી ધર્મસાધના ઓછી થઈ; આટલું જ નુકસાનને? પણ ના, ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૧૮૭

મુખ્ય મોટું નુકસાન સમજવા માટે ‘ચિત્ત એવું બહાર ક્યારે જાય?’ એ ખાસ વિચારવાનું છે. એ તરફની મમતા ને રસ વિના જાય ખરું? ‘લાવો જરા માથું ઊંચું કરી જોઈએ કોણ આવ્યું? કોણ ગયું? પેલા શું કરે છે?...’ વગેરે ઉર્મિ જાગે છે, તે એનો રસ, એની મમતા વિના થોડી જ જાગે છે? ઊલટું કહો કે રૂડી ધર્મસાધનાની વચ્ચેથી એનું મન થયું એ જ સૂચ્યવે છે કે ધર્મસાધના કરતાં એનો રસ અને મમતા વધારે થઈ. માટે એ કિંમતી સાધનાને મૂકી મન ત્યાં દોડયું. ત્યારે આ સમજ રાખવા જેવું છે કે-એવી બહારની અધિક મમતા અને અધિક રસ, એ ધર્મસાધનાની મમતા અને રસ પર ઘા કરે છે, એને હાનિ પહોંચાડે છે.

બહુ વિચારવા જેવું છે કે કદાચ આપણે અનંત કાળે આ ધર્મસાધના પાખ્યા હોઈશું તેથી હવે એના પર મમતા કરવાનો અને રસ જગાડવાનો મહાન મોકો મળ્યો! તો એ ધર્મમમતાને પુષ્ટ કરવાની કે લુલી લંગડી બનાવવાની? ડાફોળિયા, ગાય્યાં સખ્યાં, કુથલી, મજાક-હાસ્ય વગેરેમાં પરોવાતાં તો એની જે મમતા પુષ્ટ થાય છે, એના પ્રત્યાઘાત એવા પડે છે કે ધર્મકિયા પૂરી થઈ અને ઉઠ્યા કે તરત જીવ એ ગાય્યાં, મોજ, રમૂજ અને ડાફોળિયાં વગેરે તરફ જાય છે! એટલું જ નહિ પણ એમાં એને હુંફ વળે છે! જીવને ધર્મસાધનામાં મનને જે આશાએસ ન લાગી હોય તેવી આશાએસ આમાં લાગે છે! જાણો અહીં મન ફોરું થાય છે! પ્રતિકમણ કરતી વખતે હજુ સુસ્તી હશે, પણ પછી બહાર એટલે આવી ગાય્યાં મારતાં એકદમ પ્રહુલિતતા આવી જાય છે! આ શું સૂચ્યવે છે? એ જ કે એનો રસ, મમતા વધારે છે, એટલે ધર્મસાધનાનો નથી. અને ખુદ કિયા વખતે પણ એવા બાબુ રસ મમતા પોષ્યા છે એટલે તો એણે ધર્મરસને મંદો પાડી દીધો છે, ધર્મમમતા એવી રહેવા નથી દીધી, કે જે મનને ધર્મમાં જકડી રાખે. મનને જકડી રાખનાર કોણ છે? રસ, મમતા.

ડાફોળિયાં મારવાં, હસામશક્રી કરવી, ટેલટખ્યાં લગાવવા, વળી ઈધર ઉધર જોંબું-સાંભળવું, એમ આડા અવળા વિચારો કરવા, પરના સંતાપ કરવા, પરની જિજ્ઞાસાઓ કરવી,-આ બધો બાબુભાવ છે; એની પ્રવૃત્તિ એ એનો રસ અને મમતવ એવા પોષે છે કે જીવને ધર્મના રસ મમતવ ઓછા થઈ જાય છે. એ તદ્દન બિનજરુરી બાબુભાવ છે. એ બાબુભાવના રસ ધર્મના આંતરભાવના રસને લગભગ ખત્મ કરી દે છે.

ત્યારે ધર્મ કરીએ છીએ, ને એનો રસ, એનું મમતવ ન રહે, અથવા બહુ મંદ રહે, એ ધર્મમાં સ્વાદ કેવો આવે? આ ધર્મમમતા મંદ કરવાનાં ભાવિ પરિણામ દુઃખદ છે. કેમકે ધર્મ કર્યો એટલે પુષ્ટ તો મળવાનું, ભવાંતરેય એ સાથે આવવાનું,

૧૮૮

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

અને એ સુખ સગવડ પણ દેખાડવાનું. પરંતુ ધર્મની તેવી મમતા નથી કેળવી એટલે એ સાથે નહિ આવે; અને પાપની, બાધ્યભાવની મમતાને બહુ પોષી છે એટલે એ સાથે લાગવાની ! હવે વિચારો કે એક બાજુ પુષ્યથી વૈભવ વિલાસ મળ્યા, અને બીજી બાજુ પાપની મમતા કોટે વળગી, તો જીવડો પાપમાં કેવો કૂદશે ?

U એક માતાએ બાલુડો વહોરાવી દીઘો... V

સંવત ૨૦૩૫ની એ સાલ હતી. પૂજ્યશ્રીની ૧૦૮મી ઓષ્ણિની પૂણ્યહૃતિનો મહોત્સવ લાલભાગમાં ચાલી રહ્યો હતો. આખું મુંબઈ તપના હિલોણે ચડેલું. મોહમયી નગરી તપસ્વી આચાર્ય ભગવંતના પ્રભાવે તપોમયી બની ગયેલી.

પારણાના દિવસે પ્રવચન બાદ પૂજ્યશ્રીને કાંઈક ને કાંઈક ઉપકરણ વહોરાવવા માટે ભાવુકો પડાપડી કરી રહ્યા હતા. કોક પાત્રાની જોડ, કોક વસ્ત્ર, કોક કામળી, કોક તરપણી તો કોક રજોહરણ વહોરાવવા હાથમાં પકડીને લાઈનમાં ઊભા હતા. એક વિધવા બેનના હાથમાં વહોરાવવા માટે એક અનોખી ચીજ હતી.

વહોરાવવા માટે તે બેનનો નંબર આવતા તેમણે પૂજ્યશ્રીને કહ્યું : “ગુરુદેવ ! મારી પાસે વહોરાવવા માટે બીજી કોઈ વસ્તુ તો નથી પણ મારી આ નાનકડી લિક્ષા સ્વીકારો” કહીને પોતાનો ૩-૪ વર્ષનો નાનકડો બાલુડો પૂજ્યશ્રીના ચરણે ધરી દીઘો. તે શ્રાવિકાની ગુરુભક્તિ અને મહાન ત્યાગ જોઈને પૂજ્યશ્રીની આંખમાંથી પણ હર્ષ અને અનુમોદનના આંસુ દરેદ વહેવા લાગ્યા. આખી સભા સ્તબ્ધ બનીને આ વિરલ દશ્ય નિરખી રહી. સહુની આંખો અશ્વુથી છલકાઈ ગઈ.

પૂજ્યશ્રીએ તે બાળકને વહોરીને એ બહેનને પાછો આપતા કહ્યું :

“બહેન ! બાબો આઠ વર્ષનો ન થાય ત્યાં સુધી તમારી પાસે સાચવજો. પછી અમને સાંપજો...”

આજે પણ એ અદ્ભુત દશ્ય નજર સામેથી ખસતું નથી.

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર X

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૨૬, તા. ૬-૪-૧૯૬૩

(૬૦) ‘હું એ તમે ?’ કે ‘તમે એ હું ?’

રામચંદ્રજ વનમાં જતાં પિતા દશરથને કહે છે, ‘શોક કરશો નહિ, ભલે ભરત ગાદીએ બેસે, ભરત એટલે હું જ દું ઓમ માનજો.’ રામ, ભરત, લક્ષ્મણનો આરસપરસ વ્યવહાર કેવોક હશે કે એ ભરત માટે આમ કહી શકે છે ?

‘હું એટલે તમે’ એમ નહિ પણ ‘તમે એટલે હું.’-એ દસ્તિ છે. બેમાં મોટો ફરક છે.

‘હું એટલે તમે’માં સ્વાર્થબુદ્ધિ છે.

‘તમે એટલે હું’માં સમર્પણ છે.

પહેલામાં સ્વની જ મહત્ત્વ છે, બીજામાં પરની મહત્ત્વ છે.

સ્વની મહત્ત્વામાં પોતાને અનુકૂળ બનાવવા માટે જરૂર પડ્યે સામાને નીચોવવાની વાત છે, ત્યારે,

પરની મહત્ત્વ યાને ‘તમે એટલે હું’માં સામાની અનુકૂળતામાં પોતે અનુકૂળ બની ભોગ આપવાની વાત છે.

માતાપિતા પ્રત્યે પુત્ર; ભાઈ પ્રત્યે ભાઈ; કુટુંબ પ્રત્યે વડેરો; મિત્ર પ્રત્યે મિત્ર; આ દરેક જો ‘હું એટલે તમે’ કરીને ચાલે તો પોતાનું કર્તવ્ય અને ઔચિત્ય શુમારશે, નર્યો સ્વાર્થ લેખાશે, અને સંબંધ બગાડશે, કેમ કે એને તો પોતાની અનુકૂળતા માટે સામાને ઘસડવા છે.

ત્યારે જો ‘તમે એટલે હું’ કરીને વર્તશે તો મહા વિવેક, ઔચિત્ય અને કર્તવ્ય-પાલન તથા સેવા બજાવશે, અને સંબંધ ગાઢ થશે.

દેવ અને ગુરુની ઉપાસના પણ આ સાચવીને કરવાની છે કે ‘તમે એટલે હું’ની ગણતરી રાખવાની. ‘હું એટલે તમે’માં તો પોતાની અનુકૂળતા મુજબ દેવ-ગુરુ-ધર્મને વર્તિવવાની વાત છે, એથી એમના પ્રત્યે સાચું બહુમાન નથી પ્રગટતું. બલે અનાદરે ય આવે છે.

‘તમે એટલે હું’ કરવામાં આ આવે છે કે

(૧) તમારી અનુકૂળતા તે મારી અનુકૂળતા;

(૨) તમારી ઈચ્છા તે મારી ઈચ્છા;

- (૩) તમારી દષ્ટિ તે મારી દષ્ટિ;
- (૪) તમારો મત તે મારો મત;
- (૫) તમને જે રૂચે તે મને રૂચે;
- (૬) તમે જેને તુચ્છ ગણો તેને હું તુચ્છ ગણું;
- (૭) તમારા દુશ્મન તે મારા દુશ્મન;... વગેરે.

અરિહંત પરમાત્મા સાથે જો આ મેળ જામી જાય તો વાસ્તવિક સમકિત, સમ્યગ્દર્શન પ્રગાઠી જાય. અથવા કહો સમ્યગ્રદ્ધિત્ત આત્માએ દેવાધિદેવ અને ગુરુ પ્રત્યે આ ભાવ કેળવવો પડે; તો જ એ દેવ-ગુરુ-ધર્મ-ધર્મવિધિ-ધર્મક્ષેત્રોને અનુકૂળ થઈ વર્તે; તો જ સમર્પણ આવે. નહિતર એ બધાને પોતાને અનુકૂળ વર્તાવવા જતાં આશાતના કે વિરાધના કરી બેસશે.

‘તમે એટલે હું’ એ ભાવ કેળવવામાં પછી મન ધાણું ફોરું રહે છે, કેમ કે આપણો પોતાનો સ્વતંત્ર વિચાર ગોઠવવાની પંચાતી નહિ. સામાના વિચારે વિચાર. અલબજ સામાને અર્પિત થતાં પહેલાં એમનું વ્યક્તિત્વ ઉદાર હિતેખીથી અને વિશ્વાસપાત્ર નક્કી કરી લેવું જોઈએ; નહિતર એથી ઉલટામાં તો સમર્પિત થતાં લાભને બદલે અનર્થમાં પડવાનું થાય.

બાકી યોગ્ય પ્રત્યે ‘તમે એટલે હું’નો ભાવ બતાવતાં આપણો મહાન અહંત્વ-દોષ દુબળો પડે છે. અહંત્વનું જોર છે માટે તો ‘હું એટલે તમે’ એવો ભાવ જાગે છે. આ અહંત્વ એ સંસારભમણનું જબરદસ્ત કારણ છે. વીતરાગ દેવાધિદેવ અને સદ્ગુરુ પ્રત્યે ‘તમે એટલે હું’નો ભાવ કેળવી લેવાય તો અહંત્વના ભુક્કા ઉક્યા સમજો. અંતરાત્મામાં એથી અપૂર્વ પ્રકાશ જળહળે છે, ઉન્નતિના માર્ગ આગેકૂચ થાય છે, અને ગમે તેવી વિપત્તિના પ્રસંગમાં ભારે ધૈર્ય રહે છે તથા તિતિક્ષા સુંદર થાય છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૨૭, તા. ૧૩-૪-૧૯૬૩

૬૧ સંતાપ ટાળવાની અદ્ભુત ચાવી

મનુષ્યનું જીવન આજ કેટલું બધું સંતાપભર્યું બની ગયું છે ! આ સંતાપ જે કારણોના લીધે હોવાનું માનવામાં આવે છે એ માનેલાં કારણો પાછા નિવારવાનું ય અશક્ય જેવું દેખાય છે. ત્યારે પ્રશ્ન થાય છે કે ચાલુ સંયોગોમાં સંતાપ ટળે અને શાંતિ મળે એવો કોઈ રસ્તો છે ?

માનસ શાસ્ત્રીઓ કહે છે ‘મન સુધારો.’ અધ્યાત્મવાદીઓ કહે છે ‘આત્માના ભાવ સુધારો.’ નીતિશાસ્ત્ર કહે છે ‘સંતોષ કેળવો’... ઈત્યાદિ, પણ પ્રશ્ન એ છે કે આ બધું કરવું કેવી રીતે ?

આના માટે એક સચોટ ઉપાય એ છે કે આપણું દિલ જ ચાલુ ઘરેડમાં રહીને સંતાપનો અનુભવ કર્યા કરે છે, તો એ દિલને એવો એક ધક્કો લાગવો જોઈએ કે ટપ એ ઘરેડમાંથી જો બહાર નીકળી જાય, તો જ સંતાપથી બચી શકે.

દિલને, હદ્યને ધક્કો લાગવા આ વિચારવાનું છે કે સંતાપ ક્યારે થાય છે ? આંખેથી કાંઈ પણ જોઈએ, કાનેથી એવું કાંઈ સાંભળીએ, કે મનમાં એવો કોઈ વિચાર આવી જાય તો જ સંતાપ જાગે છે. બહાર દુનિયામાં કાંઈ રૂકુંરૂપાણું દેખ્યું કે સંતાપ થયો કે ‘આપણી પાસે આવું નહિ !’ એમ એવું કાંઈ સાંભળ્યું તો ત્યાં પણ આવો કોઈ સંતાપ થાય છે.

અહીં વિચારવાનું એ છે કે શું આ સંતાપ થવાનું કારણ આપણી પાસે વસ્તુની ખામી હોય એ છે ? ના, કોઈ આપણા પર દુશ્મનાવટ રાખે, આપણી ઈર્ઝા કરે, આપણું હલકું બોલે... શું સંતાપના કારણ આ છે ? ના, કેમ કે એ તો ચાલુ હોય, છિતાં ચાલુ સંતાપ આપણને નથી રહેતો; અથવા હોય છિતાં આપણા જાણવામાં કે વિચારવામાં ન આવે ત્યાં સુધી સંતાપ નથી થતો. એ તો આંખ, કાન કે મનથી જોવા-જાણવા-વિચારવામાં આવે ત્યારે જ સંતાપ થાય છે. એનો અર્થ જ એ થયો કે આપણી આંખ, આપણાં કાન અને આપણું મન પોતાની પ્રવૃત્તિ દ્વારા સંતાપ ઊભો કરે છે.

બજાર વચ્ચેથી ચાલ્યા જીઓ, બજારમાં ધાણું ય સાંદું સાંદું હોય, પરંતુ એની સામે નજર નાખો તો જ મનને બેદ થશે કે ‘આપણે કમનસીબ કે આ ખરીદી શકતા નથી !’ કહે છે ને કે ‘જીઓ ને રૂઓ,’ ‘દેખ્યાનું જેર !’ ન દેખો તો એનો કોઈ બેદ નહિ. એમ ન સાંભળો, ન વિચારો, તો કોઈ બેદ નહિ, કાંઈ જેર ચઢવાનું નહિ.

૧૯૨ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

બસ, આ રીતે એક દિવસનો પણ ક્યાસ કાઢતાં દેખાશે કે આંખ, કાન અને મન કેટલાય સંતાપ ઊભા કરે છે ! સગવડની ઓછપ તો આપણા કરતાં બીજા અનેકાનેક જીવને ભારે છે. અગવડ-પ્રતીકૃષ્ણતા પણ એમને ભારોભાર છે એવા જીવને જોતાં તો આપણને ઊલદું એમ થાય છે કે આપણે સુખી છીએ. પંચાતી છે આપણાથી વધુ સુખીને જોવાની, જાણવાની કે વિચારવાની. ત્યાં હદ્ય બળે છે. એટલે હુંખ લાગવાનું કારણ આપણી વર્તમાન સ્થિતિ નહિ, પણ આપણા આંખ, કાન અને મન બને છે. આ કેટલી મોટી મૂર્ખાઈ કે આપણા જ આંખ-કાન-મન પર આપણે સંતાપ ઊભો કરીએ ?

આ કેવીક હુર્દશા ! અમૂલ્ય ગણાતા આંખ-કાન-મન આપણને જોણે હુંખ સંતાપ, હૈયાહોળી કરાવવા જ મળ્યા છે ? અથવા આપણને મળેલ મહાકિમતી આપણાં જ આંખ-કાન-મનનો છૂટથી ઉપયોગ માત્ર સંતાપ લાવનારો કરતાં જ આપણને આવે છે, પછી ભલે તીર્થકર ભગવાનનું મહાશાસન એના ઉચ્ચકોટિના ઉપયોગ શીખવતું હોય !

અંતે, નિર્ધાર આ જરૂરી છે કે ‘શું હું મારી જ આંખ, મારા જ કાન અને મારા જ મનથી સંતાપ ઊભા કરું ? ના, હરગીઝ નહિ. જડ પુણ્યાઈની સગવડોની ઓછપ કરતાં ધર્મ પુણ્યાઈની મળેલી સગવડો તરફ આંખ અને મન લઈ જઈશ. સુખી કરતાં દુઃખી તરફ જોઈશ-વિચારીશ. પછી મારા ભાગ્યવંત લલાટે સંતાપ શાના ?’

શૂક્ર સાવધાની

એક વાર પૂજ્યપાદશ્રીનો મારા પર પત્ર આવ્યો. કવર પર મારું નામ લખેલું હતું - મુનિશ્રી અભયશેખર વિજયજી. તેમાં ‘શ્રી’ અને ‘જી’ બે અક્ષર પૂજ્યપાદશ્રીના હસ્તાક્ષરથી લખાયેલા હતા અને બાકીનું નામ સરનામાનું બધું લખાશ એક મુનિરાજના હસ્તાક્ષરમાં હતું. આ જોઈને હું તરત જ સમજી ગયો કે પૂજ્યપાદશ્રીની સાચે રહેલા મુનિરાજ નામ અને સરનામું લખીને કવર પૂજ્યપાદશ્રીને આપ્યું હશે અને તેઓશ્રીએ નામમાં આગળ ‘શ્રી’ અને પાછળ ‘જી’ ઉમેર્યું હશે.

એક સાવ નાના સાધુ પ્રત્યે પણ પૂજ્યશ્રીના દિલમાં રહેલા બહુમાનભાવ અને બાહી ચોક્સાઈના આવાં તો કેટલાંય જવલંત ઉદાહરણો જોઈ શકાય તેમ છે.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૨૮, તા. ૨૦-૪-૧૯૬૩

૬૨ સમ્યગ્દર્શનનો એક ઉપાય

સંસારમાં માણસની દાણ સહેજે બે ભેદ પાડી દે છે, એક સાર, બીજું અસાર; એક સરસ, બીજું ઠીક યા કુછ નહિ. એક માલ, બીજું સામાન્ય. જવેરાત સાર, તાંબા પિતળ એની આગળ કુછ નહિ. બંગલો એ માલ, જુંપતું એ કચરો, પ્રમુખ કે મંત્રીનો હોદ્દો એ ચીજ, ખાલી સભ્યપદું એટલે ઠીક. છોકરો પરીક્ષામાં પાસ તો થયો પણ છેલ્લા જેવા નંબરે, તો એ બહુ સામાન્ય લાગે છે, પણ જે પહેલા કે બીજા નંબરે પાસ થયો તો મહાન વિશેષ લાગે છે.

સાર-અસારના આ વિભાગ તો અનાદિ કાળથી ચાલુ છે. પરંતુ એ મિથ્યા દાણના વિભાગ છે. જીવને જ્યાં સમ્યગ્દર્શન પ્રગટે છે, ત્યાં એને સારસારના વિભાગીકરણમાં વિવેક જાગ્યો હોય છે. એ વિવેક આ, કે હવે એને ભગવાન જિનેશ્વરદેવ, પંચમહાવ્રતધારી ગુરુ અને જૈન ધર્મ એ જ સારભૂત લાગે છે. બાકી બધું અસાર લાગે છે. જેની પાછળ સરવાળે વિયોગ, વિટંબણા, નિરાધાર દશા વગરે છે તે અસાર છે. એથી ઊલદું છે તે સાર છે.

બીજા શબ્દોમાં કહીએ તો સમ્યગ્દર્શન પામવા માટે આ ઉપાય છે કે આ દેવ, ગુરુ અને ધર્મ એજ સારભૂત માનવા અને બાકીનું બધું અસાર માનવું. માનવાનું એટલે હૈયામાં ઠસી જવું જોઈએ; નાભિમાંથી નાદ નીકળવો જોઈએ કે દેવ-ગુરુ-ધર્મ જ સાર, બાકી બધું અસાર. પછી ભલે મોટી ઈન્દ્રની પદવી હો કે ચક્રવર્તીની શહેનશાહત હો, પણ એ અસાર, તુચ્છ ! દેવ-ગુરુ-ધર્મ આગળ કુછ નહિ.

મન મનાવવાની વાતથી આ નહિ ચાલે; વિચાર-વાણી-વર્તન પર એનો પડવો જોઈશે. દા.ત. એક બાજુ પ્રભુની સુંદર સ્નાતાભક્તિ કરવાનો લાભ મળ્યો, બીજી બાજુ પછી બજારમાં ગયા અને પૈસાનો લાભ થયો, ત્યાં હદ્ય બોલે કે આ પૈસા તો બહુ સામાન્ય વસ્તુ, પણ ખરી ચીજ પેલી અર્હદ્ભક્તિ ! હૈયું એ પ્રભુભક્તિ પર ઓવારી શાય, પૈસા પર નહિ; એવું કરવાનું. અનાદિની વાસનાને લીધે કદાચ તેવા કોઈ વિશિષ્ટ પૌદ્ધગલિક લાભમાં હૈયું પુલકી ઉઠે, ત્યાં મનને સાવધાની પાકી હોય કે ‘આ બધું અસાર છે, એમાં મલકાઈ જવા જેવું કાંઈ નથી. ખબરદાર, ભૂલ્યો તો !’

દેવ-ગુરુ-ધર્મને આપણો સારભૂત માન્યા છે એવો વિશ્વાસ ઉભો કરવા એમાં રસ પેદા કરી દેવાનો છે. ‘જેને જેનો રસ અનું મન ત્યાં જઈ જઈને ચોટે છે,’ એ ન્યાયના અનુસારે આપણું મન વારેવારે દેવ-ગુરુ-ધર્મમાં લઈ જવું જોઈએ. અહીં ‘દેવ’ કહેવાથી મૂર્તિ-મંદિર-તીર્થસ્થાનો પણ આવે, અને ‘ધર્મ’ કહેવાથી ધર્મસ્થાનો, ધર્મક્ષેત્રો, પવિત્ર આચાર-વિચાર સુકૃતો-સદ્ગુણો, શાસ્ત્ર તથા ધર્મત્તમાઓ ય આવે. બસ, ચિત્ત આમાં ને આમાં રોક્યા કરવાનું. એથી એનો રસ હોવાનું નક્કી થાય. દેવદર્શન-ચૈત્યવંદન, જાપ આદિ વખતે ચિત્ત ઉઠી ઉઠીને બહારમાં જાય ત્યાં સમજવું પડે કે જીવને જેવો રસ બહારમાં છે તેવો આ ધર્મક્ષિયાઓ અને દેવાધિદેવમાં નથી. માટે સાવધાન બનવું પડે કે શું મને દેવ-ગુરુ-ધર્મ કરતાં બીજામાં વધુ રસ હોય ? એ કેમ ચાલે ? એને ફેરવી નાખું.

એટલે મૂળમાં એનો રસ હૈયે ઉભો કર્યો હશે તો જ ચિત્ત આમાં વારે વારે જશે, અને ટકશે. એ રસ ઉભો કરવા આટલું વિચારવું ય બસ છે કે ભગવાન અરિહંત પરમાત્મા, નિર્ગંધ ગુરુઓ અને સર્વજ્ઞ જિનેશ્વર-દેવોએ કહેલો શુતર્ધર્મ અને ચારિત્રધર્મ, અર્થાત્ સ્યાદ્વાદમય જીવાદિ તત્ત્વ અને અહિંસાદિ મોક્ષમાર્ગને કહેનાર જિનાગમ તથા દાન-શીલ-તપ-ભાવના અને પવિત્ર પંચાચારમય ધર્મ, - આ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ જ એવું છે કે એનું જ આલંબન કરતાં મન ખૂબ મસ્ત, હૃદય ખૂબ પવિત્ર અને પ્રકાશમય, તથા આત્મા ભારે શાંત, સાત્ત્વિક અને સ્વસ્થ બને છે. જીવનમાં આથી વિશેષ શું જોઈએ ? દેવ-ગુરુ-ધર્મ સિવાય બીજું કાઈ જ આ કરી શકતું નથી. માટે એ જ સાર છે, એજ ઈષ ને આદરણીય છે.’

આમ વિવેકી સારભૂદ્વિ અને રસ સમ્યગ્દર્શનને સુલભ કરે છે, તેમજ વધુ નિર્મળ કરે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૨૮, તા. ૨૭-૪-૧૯૬૩

૬૩ ચિત્તારણની મહામૂડી

માણસ જીવનમાં કેટલીય વસ્તુની કિમત આંકે છે અને એમાંથી પાછી ઓછા-વધુ કિમતીપણાની તુલના કરે છે, પણ ભાગ્યે જ એને પોતાના મહાકિમતી મનની કિમત લાગતી હશે ! જ્યારે, વસ્તુ સ્થિતિએ સ્વસ્થ માનવ મનની કિમત આંકી અંકાય એવી નથી.

પ્રશ્ન થશે કે મન તો જન્મથી મળી ગયેલું અને પોતાની પાસે છે જ, એની શી કિમત લાગે ? પરંતુ વિચારવા જેવું એ છે કે એમ તો પુણ્યના યોગે જીવનમાં બીજું કેટલું ય મળી ગયું હોય છે અને મળે છે છતાં શું એની કિમત નથી લાગતી ? લાગે જ છે, ઉલટું વિચાર કરીએ તો દેખાય છે કે એમાં ય તુલનાથી જોતાં છેવટે સ્વસ્થ મનની કિમત સૌથી ઊંચી આવીને ઉભી રહે છે. દા.ત.

રોટલી કરતાં લાડુ અને લાડુ કરતાં બરફી વધારે કિમતી લાગે છે. પરંતુ જો જીબે જ ચાંદા પડી ગયા હોય, અગર જીભ તાવવાળી બની ગઈ હોય તો બરફીની શી કિમત ? એટલે નિરોગી જીભ વધારે કિમતી ઠરે છે. પરંતુ એ ય હોય છતાં જો મન કોઈ ભારે ઉદ્ઘેગમાં હોય તો એ બધું ફિક્કું લાગે છે. એનો અર્થ એ કે સ્વસ્થ મન વધારે કિમતી છે.

માટીના વાસણ કરતાં પિતળનું, અને તેના કરતાં ચાંદીનો મોટો દાગીનો, અને એના કરતાંથી સોનાનું ઘરેણું વધુ કિમતી લાગે છે. એ કરતાં ય જરૂરતનું અલંકાર વધારે કિમતી લાગે છે. પરંતુ જોવાને આંખ જ ન હોય તો ? માટે આંખ વધારે કિમતી ઠરે છે. એ ય હોય પણ જો કિમત સમજી શકવા જોગું મન જ ન હોય તો ? અથવા મન તો હોય, કિંતુ પુત્રમરણ જેવાના કોઈ ભારે શોકમાં પડ્યું હોય તો પેણું બધું તુચ્છ લાગે છે. એ સૂચવે છે કે સ્વસ્થ મન સૌથી વધુ કિમતી છે.

ધર્મના આરાધકની દાસ્તિએ જોઈએ તો બિખારીને દાન કરતાં મુનિને દાન વધુ કિમતી લાગે છે, એના કરતાં આચાર્ય મહારાજની ભક્તિ વળી વધારે કિમતી લાગે છે. એમ, નવકારસી પોરિસી કરતાં એકાશન, અને એના કરતાં આંબેલ વધુ કિમતી લાગે છે. એથી વધુ કિમતી ઉપવાસ, છંક વગેરે દેખાય છે... એમ ધર્મકથાના વાંચન કરતાં આચાર-ઉપદેશનું અને તેના કરતાં તત્ત્વનું અધ્યયન સ્વાધ્યાય

વधુ કિંમતી સમજાય છે. પરંતુ આ બધું, જો મૂળમાં મન જ કોઈ એવા ઉદ્દેગમાં પડ્યું હોય અગર ચિત્તભ્રમવાળું બની ગયું હોય, તો શું કામનું ? એ સૂચવે છે કે સ્વસ્થ મન ઘણું ઘણું કિંમતી છે. માટે જ એની જેમ જેમ વધુ સ્વસ્થતા, તેમ તેમ આરાધના ઊંચી ઊંચી બને છે.

અહીં એટલું ધ્યાનમાં રહે કે મનને અસ્વસ્થ કરનાર એકલો શોક-ઉદ્દેગ નથી, કિંતુ રાગ, દ્રોષ, ઈર્ષા, લધુતાગ્રંથિ, દિનતા, અહંકાર, દંબ, તૃષ્ણા, મમતા, કામ-કોથ-લોભ વગેરે કઈ આભ્યન્તર રોગો છે. એને સંકલેશ કહેવાય છે; કેમ કે એનાથી મન સારી રીતે પીડાય છે. માટે આચાર્ય ભગવાન શ્રી હરિભક્તસૂર્જિ મહારાજ કહે છે,

‘ચિત્તરલમસંકિલાષ્ટ-માન્તરં ધનમુચ્યતે ।’

રાગાદિના સંકલેશ વિનાનું ચિત્તરતન એ આભ્યન્તર ધન-સંપત્તિ મૂડી કહેવાય છે. આના ઉપર ઠેઠ શુકલ-ધ્યાન, ક્ષપકશ્રેણિ અને કેવળજ્ઞાન સુધીના માલ ખરીદી શકાય છે. તો એથી નીચી કક્ષાની સાધનાઓ, કર્મનિર્જરા અને ગુણો પ્રાપ્ત કરી શકાવાનું તો પૂછવું જ શું ?

શાલિભક્ત, કુમારપાળ, સુદર્શન શેઠ, મેધકુમાર, નંદીષેણ વગેરે પૂર્વ જીવનમાં મનના લોભ-મમતાદિ સંકલેશ દાબવા પર એવા બન્યા છે. તેમ એ પણ સ્પષ્ટ છે કે મનના સંકલેશ દાબવામાં એ શાલિભક્તાદિનાં દાન, પ્રભુભક્તિ, પ્રતનિયમ, જીવદ્યા, ગુરુભક્તિ, વગેરેના પુરુષાર્થ આલંબનરૂપ છે. એટલે સ્વસ્થ અસંકિલાષ મન બનાવવાના ઉપાય તરીકે વિવિધ ધર્મસાધનાઓ ઉપદેશશ્રવણ, ધાર્મિક વાંચન, સત્સંગ વગેરે ખાસ સેવવા યોગ્ય છે. એની ઉપેક્ષા કરી આહાર વિષયો, પરિશહે, આરંભસમારંભો દુનિયાદારી વગેરેમાં રચ્યાપચ્યા રહેનારા ઠગાય છે, અને એ બિચારા સંકલેશવાળા મનમાં ફસાયા રહે છે.

એક મિનિટ પણ ચિત્ત સંકલેશ દબાવી અરિહંતાદિ શરણ તથા નવકાર સ્મરણાદિ સત્પ્રવૃત્તિમાં રહેવાય તો એ મહાન લાભ કરે છે; જ્યારે એક ક્ષણ પણ ચિત્ત સંકલેશમાં ચઢે તો એ ભયંકર આત્મિક નુકસાન ઊભું કરે છે. માટે મનનું મોટું મૂલ્ય આંકી પ્રતિપળ આ સાવધાની રાખવાની છે કે મનને રોગિષ ન બનવા દઈએ, રોગિષ શરીર કરતાં રોગિષ મન કઈ ગુણું ખતરનાક છે. પાછું મન બહુ નાજુક છે, તેથી નાજુક તબીયત કરતાં ય વધારે ચીવટથી એનું આરોગ્ય અસંકલેશ જાળવી લેવા જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૯૧, અંક-૩૦, તા. ૪-૫-૧૯૬૩

૬૪ સાચા સ્નેહી બનો

મદનરેખા મહાસતીને કબજે કરવાના ઈરાદે એના પતિને મોટાભાઈએ તલવારના આટકે મૃત્યુ નજીક લાવી મૂક્યો. મહાસતી સમજ ગઈ, હવે એને અહીં પોતાના શીલ પર ભય છે; વળી આમ જ કદાચ પુત્રમરણનો ભય છે; પાછી એ સગર્ભ છે, રાજશાહી સુખો જોખમાવાનો ભય છે, હવે કોણ બેલી એ મોટો પ્રશ્ન છે. છતાં એ બધો વિચાર બાજુએ રાખી એણે ગુસ્સે ભરાયેલા મરતા પતિની મોટી ચિંતા કરી કે ‘આ જો આમ કોથ અને કૃષ્ણલેશ્યામાં મરે તો નરકે જાય ! ભવની પરંપરામાં ફસાય ! હું ધર્મપત્ની અને મારા નિમિત્ત આમ બને ? ન બનવા દઉં. તરત જ એણે પતિને નિજભણા કરાવતાં કહું ‘શું આ ? જીવન હવે ગણતરીની ક્ષણોનો જેલ છે, એ વખતે કોથ ? ક્યાં લઈ જશે એ ? ભાઈ તો બિચારો એના પાપે મરેલા જેવો છે, મરતા પર ક્ષત્રિય બચ્યો ધા કરે ? તમારે આ દુઃખ પોતાના જ કર્મ આવેલું છે, ભાઈ તો દયાપાત્ર છે. એને બિચારાને કુકૃત્યથી કેવા નરકાદિ કારમા દુઃખ આવશે ! એના પર દયા લાવો, એને ખમાવો, અને જાતે અરિહંતાદિ ચારનાં શરણો જાઓ, નમસ્કાર મહામંત્રમાં લીન બની જાઓ...’ પતિ બુઝ્યો, એમ કર્યું, ને શુભભાવમાં મરીને પાંચમા દેવલોકે ઋદ્ધિસંપન્ન દેવતા થયો.

પણ આ કેમ બન્યું ? પત્નીને ભયંકર આપત્તિમાં પણ પતિના ભાવિ કલ્યાણનો ખપ હતો તેથી. નહિતર પતિનું શું થાત ? પણ એને આ સાચી સ્નેહિની મળી હતી.

જો કુટુંબીને પોતાના સગા પાસેથી એના એકલા પૂર્વના પુણ્યનો માલ આંચકવાનો જ ખપ છે, પણ એના ભાવિ હિતનો ખપ નથી, એ કુટુંબી એનો સ્નેહી કહેવાય ?

જગતમાં ત્રણ જાતના વ્યવહાર હોય છે,-દાન, બદલો અને લૂંટ. એવા માણસ ત્રણ જાતના, દાતાર, શાહુકાર અને લૂંટારો. ‘દાન’માં કાંઈ લેવાનું નથી, દેવાની જ વાત ! ‘બદલા’માં માલ સાટે નાણાં; અને ‘લૂંટ’માં દેવાનું કાંઈ નહિ,-એકલી પડાવવાની જ વાત ! ત્યારે જે સ્નેહિને સામાના પુણ્યનો માલ જ ખપતો હોય, પણ સામાના આત્મહિતમાં કાંઈ ફાળો ન દેવો હોય, નવું પુણ્ય ઊભું કરવા સામાને કોઈ પ્રેરણા, સહાય કે સહાનુભૂતિ ન દેવી હોય, એ કઈ કક્ષામાં

આવે ? દાતાર, શાહુકાર, કે લૂંટારાની ? ને જો લૂંટારાની કક્ષામાં આવે તો એને સ્નેહી કહેવાય ? કે વગર-ઓળખીતા ? કે વૈરી ? વગર-ઓળખીતો આપણને કદાચ નવી પુષ્ય-કમાઈમાં સહાયક નથી બનતો, તો પણ આપણા પૂર્વ પુષ્યના માલને તફફાવતો તો નથી. પરંતુ વૈરી તો નવી પુષ્યકમાણીની આડે આવે છે, અને જૂનું લૂંટવાની વાત રાખે છે.

મહાન આયદિશ આર્થકુળમાં જન્મ મળવા છતાં સગાં સ્નેહી જો એકલા આપણા પુષ્યના માલના જ ખપવાળા હોય અને આપણું આત્મહિત કેમ થાય એની એ કોઈ પરવા જ ન રાખે, ઉલટું કદાચ એ આપણાં આત્મહિત ઘવાય એવા રાગ અને પ્રવૃત્તિમાં તાણ્યા કરે તો એ લૂંટારાનો ધેરાવો ન લાગે ?

સાથે એ પહેલું વિચારવાનું છે કે આપણને પણ આપણા સગાંસ્નેહીના પુષ્યના માલનો જ ખપ હોય, અને એમના નવાં પુષ્ય કેમ વધે અને એ આત્મહિત કેમ સાધે, એની પરવા જ ન હોય, ઉલટું એમને માટે પાપ-પ્રવૃત્તિ અને આપણા રાગ વગેરે પાથરી મૂકી એમાં એમને એવા ફસાયા રાખીએ કે આત્મહિતની સાધના તરફ એમનું લક્ષ જ ન જાય, તો આપણે દાતાર, શાહુકાર કે લૂંટારામાંથી કઈ કક્ષામાં ગણાઈએ ?

મદનરેખા મહાસતીએ પોતાના સુખની કોઈ ચિંતા રાખ્યા વિના પતિને શત્રુ પર ક્રમા, સૌભ્યભાવ, પરમેણી-સ્મરણ વગેરે જે આત્મહિત સધાર્યું, એથી એ લૂંટારણ નહીં પણ સાચી સગી બની, કલ્યાણમિત્ર થઈ. જૈનમાત્રે આ કરવું જરૂરી છે કે પોતે કુટુંબી આદિ પ્રત્યે સાચો સ્નેહી બને; વિશેષે કરીને આજના જડવાદી યુગમાં સંતાનના જન્મથી માંડીને એને પ્રધાનપણે આત્મહિત, આત્મગુણો અને સત્તુ કર્તવ્યોનું ખાસ શિક્ષણ સંસ્કરણ આપે. તો જ એ સાચો સ્નેહી, કલ્યાણમિત્ર બન્યો ગણાશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૩૧, તા. ૧૧-૫-૧૯૬૩

૬૪ એક કલ્યાણમિત્રને પ્રેરણા-પત્ર

...મહાનુભાવ ! વિશ્વના ચોગાનમાં માનવના નામનું પણ મહત્વ છે. અવસરે એ ખૂબ પ્રેરક બને છે. એનો પરમાર્થ વિચારી સજાગ થાઓ.

પૂર્વના મહાપુરુષોએ અદમ્ય એવા પણ મોહશત્રુને જ્ઞાનની સેનાના સહારે દર્શ્યો છે. જ્ઞાનદશા, જ્ઞાનયોગ, જ્ઞાનપ્રકાશ પાખ્યા પછી આત્મા પરથી મોહનો અધિકાર ઉઠી જાય છે, એ ફાવી શકતો નથી. આપણામાં જ્ઞાનદશા પ્રાપ્ત થયેલી છે ? એ માપવા એ પારાશીશી છે.

આપણા દિવલમાં કોઈ પણ વિચાર જર્નયો તે જો નબળો વિચાર છે એવું આપણો અંતરાત્મા કબૂલ કરતો હોય તો એ વિચાર મુજબ તરત પ્રવૃત્તિ કરતાં થોભી જવું; કાલક્ષેપ કરવો એ પહેલું કર્તવ્ય છે. વિચાર વિચારરૂપે રહે ત્યાં સુધી એટલું નુકસાન નથી જેટલું એ પ્રવૃત્તિમાં પરિણિમે છે. ત્યારે તો માણસને ખૂબ પસ્તાવું પડે છે. લોહીના આંસુ સારે, પણ એનું મિથ્યા થવું મુશ્કેલ બને છે.

માટે નબળા વિચારો વિચારે પાડવાનો પ્રબળ પુરુષાર્થ જરૂરી છે. કોઈ પણ ભોગો એને અનુકૂળ પ્રવૃત્તિ કરવામાં ખોરંભે પાડવું જોઈએ. મહાસતીઓએ શીલ સામે આવેલા આકમણ વખતે આકમકને આ ઢાલ પકડાવી હતી; ભોગભૂષ્યા કામાંધ માણસોને ‘હમણાં નહિ, પછી જોઈશું’ એ સૂત્ર પકડાવી કમશા: એના મોહાવેશને, એના કામાવેગને મોળો પાડી એની વિવેકચક્ષુ ઉધાડી આપી હતી; પતિતમાંથી પાવન બનાવી પોતાના પણ શીલની અખંડ રક્ષા કરી હતી.

ત્રાણ ભુવનમાં ત્રાણો કાળમાં આજ બુન્ધ શાશ્વત સનાતન રાજમાર્ગ છે કે પાપના વિચારોને સફળ ન થવા દેવા; જેથી પાપ વિચારોને ધીરે ધીરે ઘસાઈ જ જવું પડે.

કેટલુંય તોઝાન કેવળ મનના કુવિકલ્પોમાંથી ઊભું થયેલું હોય છે. વાસ્તવમાં જોઈએ તો બહાર કશું જ હોતું નથી. એટલે જેવી રીતે પાણીના ધસમસતા પૂર આવે એને યોગ્ય વળાંક આપી નુકસાન થતું અટકાવાય છે, તેવી રીતે માનસિક વિકલ્પોને યોગ્ય માર્ગ વાળી લેવામાં આવે તો બચી જવાય છે. મનને જો યોગ્ય ખોરાક ન આપવામાં આવે તો પારાવાર નુકસાનમાં એ વિકલ્પો ઉતારી દે છે !

મનથી કલ્યાણ સંસાર-સુખમાં જીવ મોહમૂદ બને છે, પરંતુ વિચારવા જેવું

આ છે કે સંસારના માર્ગ કાંઈ ગુલાબની પાંખડીઓથી રચાયેલા નથી. એ તો ઊલદું ઐરી કાંટાઓથી ભરેલા છે. મનનાં તોઝાન ત્યાં ઘણાં ઘણાં વધી જાય છે ! મનને ફાવે તેમ નાચવા હુચ્છે છે, પણ વ્યવહાર એમાં આડે આવે છે. સંયોગો ય એવા બને છે કે મનને પ્રતિકૂળ ઘણું ય નભાવી લેવું પડે છે.

કુંગરા દૂરથી રળિયામણા ! નજીક જઈએ એટલે જુદું જ નીકળે છે. મૃગજળી દૂરથી કેટલું લોભાવનારું ! પણ એ તરફ તૃષ્ણાળું હરણિયાં દોટ મૂકી મૂકીને હાંઝી જાય છતાં ઈચ્છિત મળતું નથી, વધુ શ્રમિત બને છે, ને તૃષ્ણા ઓર વધી જાય છે ! સંસારના કહેવાતા સુખોમાં આવું છે. ઈચ્છા પુરાતી નથી, તૃષ્ણા વધે જાય છે. પણ મનુષ્ય ભુલકણો પ્રાણી એના અનંત દોષો ભૂલીને કશજળવી તુચ્છ ગુણને ગણતરીમાં લે છે.

ભાગ્યવાન ! કાલ્યનિક, કેવળ કાલ્યનિક તુચ્છ સુખની મૃગજળિયા બ્રાન્ટિમાં પડી દુઃખની ખીણમાં પડતું મૂકતાં પહેલાં સો-સો, હજાર-હજાર, લાખ-લાખ વિચાર કરજો. વિચારકને પસ્તાવાનો વખત નહિ આવે.

મન તો આપણાને આશીર્વાદ રૂપ મળ્યું છે, વાળ્યું વળી શકે છે. જો એમ ન હોત તો તો મોક્ષમાર્ગના પુરુષાર્થ જેવી વસ્તુ જ ન રહેત. ઈન્દ્રિયોનાં વિષય-સુખનું આગ્રહી બનેલું મન આજે આપણાને રોક્યું ન રોકાય એવું લાગે; પરંતુ એ કાંઈ મનની નિર્ધારિત કાયમી સ્થિતિ નથી. સદ્ગ્ઝાનની જોરદાર સતત છાલકથી એનો કેફ ઉત્તરે છે. આગ્રહ છૂટે છે. માત્ર, મનના આગ્રહને અમલમાં ન ઉતારતાં મનને યોગ્ય સારવાર આપો. મનના રોગનું અશમોલ ઓષ્ઠદ,-નિર્મોહી વીતરાગ એવા અરિહંત ભગવાનનું વિનભ્ર ગદ્ધગદ ભાવે શરણું સ્વીકારો; એમનું સતત સ્મરણ કરો ધ્યાન કરો. પ્રભુની યોગમુદ્રા એવી લોકોત્તર વૈશિષ્ટ્યવાળી છે કે ભલભલાની હઠિલી મોહનિદ્રાને એણો હટાવી ઉડાડી દીધી છે. આપણા માટે પણ એજ ઉપાદ્ય છે.

‘સમજ સમજ મન ! જા પ્રભુ શરણો.’

આ ધૂન. કલ્યનામાં સિદ્ધગિરિદાદાનો ચોક કે શંખેશરદાદાનો દરબાર ખડો કરીને, ખૂબ જમાવો.

(પુ. મુનિરાજ શ્રી મિત્રાનંદવિજયજી મ. ના પત્રમાંથી)

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૧, અંક-૩૨, તા. ૧૮-૫-૧૯૬૩

૬૬ પાચાથી પરાકાઢા સુધીની સાધનાઓમાં ખાસ જરૂરી (લેખાંક-૧)

જેન ધર્મની આ એક વિશેષતા છે કે એણો આ અપાર સંસાર-પારાવારમાંથી આત્માનો ઉદ્ધાર કરવા માટે મોક્ષમાર્ગની સચોટ કમિક સાધનાઓ બતાવી છે. એ તેવા તેવા જીવની કક્ષાને યોગ્ય તેવી તેવી સાધનાઓ છે. નીચે નીચેની કક્ષાની સાધનાના સાધકે ઉપરની કક્ષાની સાધનાનો ઉદેશ રાખી એ સાધના કરવાની હોય છે. આ ઉદેશ ન રાખતાં ભળતા ઉદેશથી અગર ઉદેશ વિના મૂઢ્પણે સાધના કરનારો ચોક્કસ નિશાન વિના તિરંબાજ જેવું કરે છે, યા નિયત મથક નક્કી કર્યા વિના અંધપ્રવાસ કરે છે. માટે કોઈ પણ સાધનામાં ઉપરની કક્ષાની સાધના પ્રાપ્ત કરવાનો ઉદેશ અવશ્ય નજર સામે રાખવો જરૂરી છે. ‘કેમ મને એ પ્રાપ્ત થાય’ એ અભિલાષા બની રહે. તો જ આત્માનો કમિક વિકાસ થતો આવે.

આ ઉદેશનો હિસાબ આ પ્રમાણે છે,-

સધીય શુભ પ્રવૃત્તિનો અંતિમ ઉદેશ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે, અર્થાત્ સમસ્ત કર્મનો ક્ષય અને આત્માની જડમાત્રથી અલિપ્ત તદ્દન વિશુદ્ધ સહજ સ્વરૂપ પ્રગટ કરવું એ અંતિમ ઉદેશ, અંતિમ પ્રયોજન છે. એ તો જ થાય કે પહેલાં મોહનીય કર્મનો સર્વથા નાશ કરી વીતરાગ સર્વજ્ઞ બનવામાં આવે. એટલે આ મોહક્ષય અને વીતરાગતા-સર્વજ્ઞતા એ એની નીચેની સાધનામાં ખાસ ઉદેશ રહે. એ ઉદેશ સિદ્ધ કરી આપનારી સાધના અસંગ-અનાસક્ત યોગ અને શુક્લધ્યાન છે. એ વળી ઉદેશ બનાવવો પડે એની પૂર્વની સાધનામાં. એ સાધના છે એ ધર્મધ્યાન-પ્રધાન અપ્રમત્ત ચારિત્રયોગની સાધના. એ પણ એની નીચેની સમગ્ર પાપત્યાગ પૂર્વક સ્વીકૃત સર્વ વિરતિ સાથે કરાતી શ્રુતધર્મપ્રધાન પંચાચારપાલનની સાધનામાં ઉદેશ રાખવાનો. ત્યારે આ સર્વવિરતિભાવ સાથે પંચાચાર પાલનની સાધના એની નીચેની શ્રાવકધર્મની સાધનામાં ઉદેશ તરીકે રાખવાની, અર્થાત્ કોઈ પણ શ્રાવકધર્મની સાધના પણ આ ઉપરના ઉદેશથી કરવાની, એની અભિલાષાથી જ કરવાની; કેમ કે સર્વવિરતિ ચારિત્રની ભૂમિકા દેશવિરતિ બાર વ્રત અને શ્રાવકની અગ્નિયાર પડિમા વગેરેની આરાધના સાથે સર્વવિરતિ ચારિત્રની ઉત્કર અભિલાષાથી જ બને છે. એય લાવવા માટે સમ્યક્તવના હજ વ્યવહાર સહિત સમ્યગ્દર્શન સિદ્ધ કરવાનું છે. જેમાં અથાગ મોક્ષરાગ અને તત્ત્વશદ્ધ જાગ્રત રાખવાના છે.

હવે વિચારવાનું આ છે કે શું કોઈ પણ ધર્મપ્રવૃત્તિ કરીએ ત્યારે આ બધા ઉદેશ યાદ આવે જ ? ના, કેમ કે એટલી બધી બાબત સમરાજમાં લાવ્યા કરવાનું કરે તો ચાલુ ગ્રવૃત્તિમાં મુખ્ય લક્ષ શી રીતે રહે ? પણ એટલું ખરું કે નીચે નીચેની આરાધના વખતે ઉપર ઉપરના નજીકના ઉદેશ પર ચોંટ હોય, એ સાધ્ય તરીકે હોય, તો જ એ સપ્રયોજન પ્રવૃત્તિરૂપ બને.

વળી ઉપરનો ઉદેશ રાખવાની સાથે ચાલુ કક્ષાની સાધનામાં એની નીચેના કક્ષાના ગુણ વણાયેલ હોય એ પણ ખાસ જરૂરી છે. દા.ત. અસંયોગમાં નીચેનો ગુણ અપ્રમત્ત ભાવ વણાયો હોય અને અપ્રમત્તભાવમાં એની નીચેનો સર્વવિરતિભાવ, તથા એ સર્વવિરતિ અવસ્થામાં સમ્યગ્દર્શન વણાયેલ હોય. ત્યારે સમ્યગ્દર્શનની અંદર પણ એની નીચેનો અધ્યાત્મભાવ અને ચતુઃશરણ સ્વીકાર સંમિલિત હોય. તાત્પર્ય અધ્યાત્મ ભાવ, ચતુઃશરણ સ્વીકાર અને સમ્યગ્દર્શન ઠેઠ ઉપરની સાધના સુધી વણાયેલા હોવા જોઈએ. આ સમ્યગ્દર્શન આપણામાં છે જ એમ માની લઈ તે અંગેના પુરુષાર્થમાં નિષ્ઠિ રહેવા જેવું નથી. કેમ કે (૧) એક તો સમ્યગ્દર્શન અભ્યાસ-ક્ષુદ્ર-માર્ગ-શરણ અને બોધિના કર્મથી ઉત્પન્ન થાય છે, અને શમ સંવેગ-નિર્વદ-અનુકૂળ-પા-આસ્તિક્યનાં લક્ષણ તથા ત શુદ્ધિ, ત લિંગ, વગેરે ગુણ ધરાવે છે. એવા સમ્યગ્દર્શનનો એમજ દાવો રાખવો, એ વધારે પડતું છે; તેમજ (૨) બીજું એ કે દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ કે જેના પર સમ્યગ્દર્શન છે એ ક્ષયોપશમ કાંઈ એમજ શાશ્વતસ્થાયી નથી. એને ય ટકાવવાનો પ્રયત્ન ચાલુ હોય તો જ એ ટકે માટે સમ્યગ્દર્શનનો દાવો રાખવાને બદલે એના સચોટ સાધનમાં પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ.

સમ્યગ્દર્શન માટે જરૂરી ઉપાય અનેક છે; તેમાં પંચ સૂત્રકાર મહાર્થિ સદાકર્તવ્ય અદ્ભુત અને અતિ આવશ્યક ઉપાય આ બતાવે છે,-

- (૧) અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞ જિનકથિત ધર્મનું શરણ સ્વીકારો.
- (૨) જન્મ-જન્માંતરના દુષ્કૃતોની ગર્હા-નિંદા-જુગુપ્સા કરો, અને
- (૩) માર્ગનુસારી જીવથી માંડી ઠેઠ અરિહંત ભગવાન સુધીના મહાપુરુષોના સુકૃતોની અનુમોદના કરો.

આને ત્રિકાળ કરવાનું અને વિશેષે કરીને જ્યારે જ્યારે રાગદ્રેષના વધુ સંકલેશ થાય ત્યારે વારંવાર કરવાનું ફરમાન છે.

આનાથી પાપનો પ્રતિધાત અને ગુણબીજનું આરોપણ થાય છે, એટલે અપ્રાપ્ત સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે, અને પ્રાપ્ત સમ્યગ્દર્શન વધુ નિર્મળ બની ઉપરના ગુણસ્થાનકને સુલભ અને વિકસિત કરે છે.

ભગવાન અરિહંત પરમાત્માદિ ચારનું શરણ સ્વીકારવાનું સમ્યગ્દર્શિ જૈન, પ્રતધારી શ્રાવક અને મહાપ્રતધારી મુનિવરો માટે પણ નિત્ય આવશ્યક છે, હંમેશાં ત્રિકાળ અવશ્ય કર્તવ્ય છે; અને વિશેષ જ્યારે જ્યારે ચિત્ત આકૃળબ્યાકૃળ થાય સંકલ્પવિકલ્પોથી પીડાય, રાગદ્રેષની આંધિમાં ચેતે ત્યારે ત્યારે ખાસ કરવું જરૂરી છે. હદ્યના ઉંડાણમાંથી એનો નાદ ઉઠે, પોતાની શક્તિહીનતા ભાસે, અરિહંત ભગવાન આદિની અતુલ અચિત્ય શક્તિ પર મન ઓવારી જાય, એજ શક્તિથી સર્વ શુભની સિદ્ધ શક્ય દેખાય, એ રીતે શરણસ્વીકાર કરવો જોઈએ. તે પણ તાત્કાલિક ઈષ્ટસિદ્ધ યા અનિષ્ટ નિવારણના ઉપાયરૂપે નહિ, કિન્તુ સમસ્ત ઈષ્ટસિદ્ધ અને સકલ અનિષ્ટ નિવારણની પ્રાર્થના રૂપે અચિત્ય સામર્થ્ય સંપન્ન તરીકે શરણ સ્વીકાર કરવો જરૂરી છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૩૩, તા. ૨૫-૫-૧૯૬૩

(૬૭) (લેખાંક-૨)

એ શરણનો સ્વીકાર સાચો સંગીન કરવા માટે,

- (૧) એમાં ગર્ભિતપણે દુષ્કૃતગર્હ અને સુકૃત અનુમોદના મેળવવી જોઈએ,
- (૨) પ્રભુના શરણે જતાં પ્રભુની વિશેષતાઓની પાકી શક્તા રાખવી જોઈએ.

તે આ રીતે,-

(૧) “હે નાથ ! આ જન્મ અને જન્માંતરોમાં રાગ, દ્વેષ કે અજ્ઞાનતાથી જે કાંઈ અજુગતું મેં આચર્યુ હોય, આચરાચ્યુ હોય, કે બીજાએ આચરેલામાં ભાગ-લાગો યા ખુશી સંમતિ રાખી હોય, એનો મને બહુ બેદ થાય છે, એની હું નિંદા જુગુપ્સા કરું છું; એ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. દુષ્કૃતથી બચવા પ્રભુ ! મારે તુંજ એક શરણ છે, તું જ પ્રાણ છે, આધાર છે, તારા ઉપદેશના ફળભૂત સિદ્ધોનું મારે શરણ છે. તારા શાસનના રક્ત મુનિઓ અને તારું શાસન જ મારે શરણભૂત છે; કેમ કે તમે દુષ્કૃતોથી પર છો અને સુકૃતોના ભંડાર છે.

હે અરિહંતનાથ ! તમારા અને બીજાઓનાં સુકૃતની હું અનુમોદના કરું છું. જીવનમાં એ જ કર્તવ્ય છે, આપની કૃપાથી એ જ મારું છું. સુકૃત મળવા અને દુષ્કૃતોથી બચવા મારે તારું જ શરણ છે, કેમ કે મારું જાતે શું ગજું ? હે ભગવાન અરિહંત ! તમે, સિદ્ધો, મુનિઓ અને જૈન ધર્મ એ જ મારે તો શરણ છો, મારા તારણહાર છો.”

(૨) આમ આ શરણ-સ્વીકાર કરવાનો, ને તે પણ દરેકની વિશેષતા બરાબર

દિલમાં જ્યાવીને કરવાનો, જેથી હૈયું તેવા શરણ્ય પર પૂર્ણ આસ્થાથી ખરેખર ટચ્યું રહે. નહિતર તો દિલને ખરેખર શરણરૂપ જડ વસ્તુ લાગતી હોય, જરૂર પડ્યે હૈયું ત્યાં જ જતું હોય અને દેવગુરુનું ખાલી નામ લેવાય, એવું બને.

વિશેષતામાં દા.ત. અરિહંત પરમાત્માને ‘અચિંત ચિંતામણિ’ કહ્યાં; તો આપણે એમનું શરણ સ્વીકારીએ તે આ અટલ શ્રદ્ધા સાથે કે ‘પ્રભુ ! આપ જ ભક્તોના કલ્યાણ બહારના ઈચ્છિતના સાચે જ પુરનારા, અતુલ પ્રભાવવંતા ચિંતામણિ છો.’ આ શ્રદ્ધા એ કામ કરે છે કે કહેવાતા હુન્યવી ઉપાયોનાં આકર્ષણ અને વિશ્વાસ ઓછા કરી દે છે. અનેક આપત્તિ-વિપત્તિ અને અસમાધિકારક પરિસ્થિતિમાં અરિહંત પરમાત્મા પર જ એક માત્ર વિશ્વાસ રહે છે. તેમ જ સુખસગવડ સંપત્તિમાં પણ એ જાગૃતિ રહે છે કે પૂર્વે અરિહંત ભજ્યા હશે એથી જ આ અનુકૂળતા મળી છે. માટે એમના પ્રત્યે ફૂટશભાવ ખૂબ બજાવું,”

એમ સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારતાં એમની એક વિશેષતા ‘નિરુમસુહસંગયા’ અર્થાત્ સુખ ખરેખરું આ જગતમાં ક્યાંય ન ભાસે. માત્ર મોક્ષમાં જ સુખ લાગે, તેથી જગતનાં સુખ તુચ્છ લાગે.

વળી સાધુનું શરણ સ્વીકારાય તે એ શ્રદ્ધા સાથે કે એમની જે વિશેષતા કહી, ‘સાવધ યોગોથી વિરામ પામેલા, ધ્યાન અધ્યયનમાં લીન, પરોપકારરકત, ક્રમણી જેમ કર્મકાદવ અને ભોગ જળથી ન્યારા’ વગેરે - એના પર એ શ્રદ્ધા હોય કે ખુસું જીવન તો આ જ બાકી એથી જે ઉલદું, એ તો સનેપાતના ચાળા !

એમ ધર્મનું શરણ લેતાં ધર્મની બતાવેલી વિશેષતાઓ પર અથાગ શ્રદ્ધા હૈયે જળહળે. દા.ત. એક વિશેષતા એ કહી છે ‘જિનોકત ધર્મ એ સમસ્ત કલ્યાણનું સાધન છે,’ કલ્યાણ માટે બીજી કોઈ આળપંપાળ પર મન બેસે જ નહિ.

ભગવાનનું કલ્યાણક ઉજવતાં આ રીતે શરણ સ્વીકાર કરવા સાથે પાપોની ગર્ભ કરવાની છે, અને અરિહંત વગેરેના સુકૃતોની અનુમોદના કરવાની છે. એટલે પ્રભુના ગુણગાન કરતાં સરવાળો આમાં લવાય, કે જગતમાંથી દુષ્કૃતો-પાપો ઘટે, અને સુકૃતો વધે. એમ જગત માટે પણ આમ ઈચ્છાય, કે જગતમાંથી અઠાર પાપસ્થાનક કેમ ઓછાં થાય, અને વિવિધ સુકૃતો કેમ વધે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૮-૧૧, અંક-૩૪, તા. ૧-૬-૧૯૬૩

૬૮ ગુણરથાનકમાં ઊંચે ઊંચે ચટવા,

માનવ ભવની પુણ્યાઈ સાથે ઉત્તમ શરીર, મન, પૈસા વગેરે મળ્યું એ, જે આત્મામાં પાત્રતા હોય તો સ્વ-પરના આન્મોપકારમાં નિમિત્ત બનાવી શકાય છે. પરંતુ જો પાત્રતા ન હોય તો એ જ સાધનો સ્વ-પરના અપકારનું નિમિત્ત બને છે. આ હિસાબે પોતાની પાત્રતા માપવી જોઈએ કે ‘મને પુણ્યયોગે નિમિત્ત તો મળી આવ્યાં, પૈસા મળ્યા, માન મળ્યું, શક્તિ મળી. પાત્રતા કેટલી અને કેવી છે ? જો પાત્રતા કમ છે તો વધારે સાવધાન રહું. જેથી આ જ સામન્ની મારો અને બીજાનો વિનાશ ન કરે.’

પોતાની પાત્રતા માપ્યા કરવાથી ઘણી જાગૃતિ અને સાવધાની રહે છે. શાસ્ત્રોના તત્ત્વ સાંભળતા હોઈએ, મહાપુરુષોનાં જીવન જોવા-સાંભળવા મળતા હોય, મુનિમહારાજાઓના સમાગમ કરતા હોઈએ, એમાંથી નવી નવી ધર્મપ્રેરણા મેળવવાની, ગ્રહણ કરવાની છે. સાથે આ પણ કરવાનું છે કે આપણી પાત્રતાની જાત અને પ્રમાણ માપતા શીખીએ અને માપતા રહીએ. આપણામાં કઈ જાતની પાત્રતા છે અને પાત્રતાનું પ્રમાણ કેટલું છે એ જોતા રહીએ. આ કરવું અધ્યુનું નથી, કેમ કે આપણું દિલ હજી બીજા ન ઓળખી શકે, પણ આપણે ઓળખી શકીએ છીએ. દા.ત. કોઈ સુકૃત કરવામાં રૂપિયા હજાર ખર્ચી નાખ્યાં; પરંતુ જ્યાં નામની પ્રસિદ્ધિ ન મળવાની હોય, ત્યાં આપણે હજાર નહિ તો પાંચસોય ખરચવા તૈયાર બરા ? ચારની વચ્ચમાં બેઠા, પરનારી સામે આંખ નાખવાનું ન કરતા હોઈએ પરંતુ એકલા હોઈએ ત્યારે તેમ વર્તવા મક્કમ બરા ? લાજ-શરમથી કોઈનું કામ કરી નાખતા હોઈએ, પરંતુ જ્યાં કોઈ શરમ નથી પડતી ત્યાં સેવા કરવા તૈયાર બરા ? આના ઉપરથી આપણા સ્વભાવમાં ઉદારતા, સદાચારવૃત્તિ, અને પરોપકારિતા છે કે કેમ એનું માપ કાઢી શકાય કે આપણામાં પાત્રતા કેટલી કક્ષાની છે, કઈ કોટિની છે.

પાત્રતાની જાત અને કક્ષાનું માપ કાઢ્યા પછી સાવધાન રહેવાનું છે. જો પાત્રતા પુષ્ટ નથી, દુબળી છે, એકાંતમાં આંખ વગેરેના દુરાચારથી બચી શકતા નથી તો સાવધાની એ રાખવાની કે એકાન્તનો પ્રસંગ ન આવવા દઈએ, આવી પડે તો કોઈ ગહન વિચારણામાં ચઢી જવું, અગર ગમે તે નિમિત્ત ઊભું કરી ત્યાંથી

ખરી જઈએ. જો ગુપ્ત સુકૃત કરવાની પાત્રતા નથી, તો જાહેર પ્રસિદ્ધ આપે તેવી સુકૃત કરીને પણ ગુમાન ન ધરીએ કે હું સાચો ઉદાર છું. જ્યાં કોઈની લાજશરમ ન પડતી હોય ત્યાં પણ સેવા-પરોપકાર કરવાની તૈયારી હોય એવી પાત્રતા જો નથી તો પોતાની સ્વાર્થપરાયણતાનો અહર્નિશ ખ્યાલ રાખી હજી ગુણીયલ બનવા ધશું કરવાનું છે, એ ખ્યાલ જાગતો રાખીએ.

પોતાની પાત્રતાનો ખ્યાલ કરવો-વારંવાર ખ્યાલ કરવો એ આગળ વધવા માટે પહેલું પગથિયું છે; કેમ કે એમાં પછી સાચો માર્ગ શોધાય છે કે ‘હું કઈ રીતે હવે પાત્રતા વધારું-વિકસાવું. પૂર્વના અને વર્તમાન કાળના મહાપુરુષો કેવી કેવી ઊંચી પાત્રતા ધરતા હતા, એ એમના જીવન-પ્રસંગોમાંથી જોવા મળે છે. તો હું એ રીતનો ઉદ્યમ થોડો પણ કરવા લાગું.’

પાત્રતાનું નિરીક્ષણ અને ખીલવટ કરવાનો પુરુષાર્થ એક મહાન સાધના છે. દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરતાં કરતાં આ કરવાનું ન ભૂલશો. નહિતર ઉપાસનાના કાર્યો ઢગલાંબં કરવા છતાં જીવ ત્યાંનો ત્યાં અટકી જશે. પાત્રતા ખીલવવા પર ધર્મસાધના કેટલી ફળી અનું માપ નીકળે છે. એ પાત્રતા ખીલતી જાય, તેમ ઉચ્ચ ઉચ્ચતર ગુણસ્થાનક સુલભ બનતું જાય છે. એની પરાકાણાએ વીતરાગતાના આંગણે જઈ ઉભા રહેવાય છે. ભવ્યત્વ શું છે ? મોક્ષ જવાની પાત્રતા. એ સંપૂર્ણ વિકસી ઉઠે એટલે મોક્ષ મળે છે. તપ કરો, જપ કરો, દાન દો, દયા પાળો, દેવપૂજા, ગુરુભક્તિ વગેરે કરતા જાઓ, ત્યાં આ લક્ષ રાખ્યા કરો, કે ‘આ આ કરતાં કરતાં મારી જુદી જુદી પાત્રતા વિકસાવતો જાઉં. તપ કરું તો એ જોઉં કે એ કરીને આહાર પ્રત્યે વેઠ માનવાની, વિટંબણા માનવાની મારી પાત્રતા વિકસે છે ને ? સર્વદોષથી મુક્ત સર્વગુણોએ સંપન્ન અરિહંત ભગવાનનો જપ કરું તો દોષથી ભડકવાની અને ગુણોને ઝંખવાની મારી પાત્રતા વિકસતી જાય છે ને ? બધીય ધર્મ પ્રવૃત્તિ અને સુકૃતાચરણ કરવા પાછળ કૃતજ્ઞતા, મૈત્રીભાવ પરાર્થવૃત્તિ, ગાંભીર્ય નિરાશસભાવ, (નિસ્પૃહતા) વગેરે ગુણો ખીલીને અર્થાત્ વધુ ને વધુ વિકસતા રહીને મારી પાત્રતા વિકસતી રહે છે ને ?

ધર્મની સાધના કરતાં કરતાં આપણી પાત્રતા વધારતાં જવાનું ખાસ લક્ષ રાખીએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૩૬, તા. ૧૫-૬-૧૯૬૩

૬૬ સ્વાર્થીની કરુણ દર્શા

અનેક દુર્ગુણોના કારણમાં જુઓ તો દેખાશે કે કેટલાયમાં એક કારણ તરીકે સ્વાર્થનું જોર જામી પડ્યું છે, બીજાનો વિચાર નથી, કેમ કે નજર સામે કર્મનાં વિચિત્ર દુઃખમય સર્જન નથી. બસ તુચ્છ સ્વાર્થ, સ્વાર્થ, ને સ્વાર્થની ધૂમ રમત ચાલી પડી છે ! વાત વાતમાં ‘મારું શું સરે છે ? મને શો લાભ ? આપણે શા માટે ઘસાવું ? હું તે કેટલાનું કરું ? આપણે આપણું સંભાળો...’-આવા ને આવા હિસાબ મનમાં ચાલ્યા કરે છે. જ્યાં બીજાની વેઠ કરવા તો જનાવર સર્જયા છે, માનવને તો પોતાના ને પોતાનાના પેટ-પટારા સંભાળવાના ! કેટલું કારમું અજ્ઞાન ! ત્યારે કદાચ પૂછો,

પ્ર.- જનાવર બીજાની વેઠ કરીને શું બહુ પામે છે ?

૩.- એ નથી પામતું એનું કારણ એ છે કે એ ચાહીને વિના સ્વાર્થ સ્વેચ્છાથી વેઠ નથી કરતું, ચાહીને બીજાનું કરી ધૂટાય તે પણ સ્વાર્થ વિના તો લેખે લાગે, એમ તો સ્વાર્થના માર્યા તો ધણી ય વેઠ કરાય છે; તેમ કદાચ સ્વાર્થ વિના પણ પરાપે દબાયા ચંપાયા. પણ અંતરમાં બડબડતાં બીજાનું કંઈક કરી ધૂટાય છે, પરંતુ એની કિંમત નથી. એ એવી સેવા નથી, પરાપકાર નથી, કે જે સ્વાર્થવૃત્તિને ખકો લગાડે.

એટલે વિચારવા જેવું આ છે કે સ્વાર્થ જતો કરીને બીજાનું કરી ધૂટવું એ કંઈ જનાવરવેડા નથી; એ તો ખરેખર માણસાઈ છે. પરંતુ સ્વાર્થના અનહદ રસમાં એ કંઈ જ સૂજતું નથી. ત્યારે એ રસમાં મન પણ એટલું બહું સંકુચિત અને ધિટ્ટું રહે છે કે અવસર આવે પોતાના કુટુંબીઓ સાથે પણ સ્વાર્થની રમત રમવાનું કોટે વળગે છે; અને ત્યાં પછી સામું સદ્ભાવ-બહુમાન તૂટે છે ત્યારે બહારનાનાં પ્રેમ તો એ સ્વાર્થધિતામાં પામી શક્યો નથી. સરવાળે બધાના ફિટકારનું જીવન બને એ કેવું હોય એ વિચારો.

સ્વાર્થમાં જ રમનારો અવસરે બીજાની સહાય પણ કેવી પામે ? ન પામે ત્યારે દુઃખી કેટલો થાય ?

એમ, સ્વાર્થિલા માણસના લાભમાં ઉભા રહેનાર પણ કોણ હોય ? ઉલટું એના નુકસાનને તાકનાર ઉભા થાય.

આવી બધી પરિસ્થિતિમાં સુખે ખાઈ પી શકવાનું અને ચિત્ત શાંત-સ્વસ્થ-રાખવાનું એના ભાગ્યમાં નહિ. એટલે વર્તમાન જીવનમાં પણ વાસ્તવિક તો એ ૨૦૮ ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

હુંખી જ છે, તો સ્વાર્થની રમતવશ ભવાંતર માટે પુણ્યાઈના અભાવે સુખની વાતે ય શી ?

પ્ર.- પણ સ્વાર્થી જીવ પ્રભુભક્તિ વગેરે કરે એની તો પુણ્યાઈ મળે ને ?

ઉ.- અહીં એ જુઓ કે નરદમ સ્વાર્થની જ લેશ્યાવાળો, એ દેવાધિદેવ સાથે પણ સ્વાર્થની રમત કેમ નહિ રમે ? 'પ્રભુ ! હું તમારી ભક્તિ કરું, પરંતુ ભક્તિ માટે કાઈ ધરના કિંમતી પૂજાદ્રવ્યો લાવવા જ પડે એવું કાઈ નહિ. મંદિરમાં રાખેલી સામગ્રીથી પૂજાભક્તિ થઈ શકે, બાકી સ્તવન સારું લલકારીશ.' આમ, પોતાની નાણાંકોથળી સીલપેક રાખીને પ્રભુની પૂજાભક્તિ કરવા જશે ! એમાં ય પાછો ભક્તિના ફળ રૂપે રાગાદિ દોષ કપાવાનું નહિ ઈચ્છે. જો એ ઈચ્છે તો તો ધનનો રાગ કરીને પ્રભુની ભક્તિમાં પોતાના દ્રવ્યો લાવે નહિ ? પણ ના, એ તો સોદો કરશે કે 'પ્રભુ ! મને તમે આતલું દઈ દેજો,' અગર 'પ્રભુભક્તિથી પુણ્ય ! તું મારા પર રીતી જજે.' આવી નકરી સ્વાર્થની રમતમાં કઈ નક્કર પુણ્યાઈ મળે ?

એટલે કહો કે ધર્મના સંગીન પાયા સ્વાર્થત્યાગની નક્કર ભૂમિ પર મંડાય છે. ત્યારે જ એ સાચો આત્મવિકાસ દેખવા પામે છે. કેવળ સ્વરમત અર્થાત્ પોતાની પૌદ્રગાલિક સુખસગવડ અને સત્તા-સંભાળની રમત એ તો પોતાના આત્માને કચરનાર અને કુવાસનાઓને પગભર રાખનાર બને છે.

સ્વાર્થની રમતમાં બે વસ્તુ છે.

(૧) એક તો હુન્યવી વિષયસુખો, માનપાન, ધનમાલ, આબરુ, આરામી વગેરેની જ લગાની છે. અને

(૨) બીજું એ કે માત્ર જાતનો અને બહુ તો પોતાના કુટુંબનો જ વિચાર છે, બીજાનો વિચાર નથી.

આ બંને સ્થિતિ પોષવા માટે એ બધું કરી છૂટવા તૈયાર રહે છે. પછી એમાં સત્ય, નીતિ, દયા, સરલતા, ઉદારતા, ગંભીરતા વગેરે કશાની પરવા રાખતો નથી. ધન કમાવવું છે માટે જૂઠ બોલતા નહિ અચકાય. અગર બીજાનું ભલું કરી છૂટવું નથી, એટલે તેવા પ્રસંગે માયા રમતા આંચંકો નહિ ખાય. આમ કેટલાય દોષ-હુર્ગણો સ્વાર્થની કાળી લેશ્યા પર ફાલે ફૂલે છે. કહો સ્વાર્થધિતાની ખાણમાં હુર્ગણોનું ભરચક ઉત્પાદન થાય છે.

માટે જો હુર્ગણો-હુષ્ટ્યોથી બચવું હોય તો સ્વાર્થની લેશ્યા મોળી પાડી દેવી જોઈએ. 'હુનિયાનું સારું સારું મારે જોઈએ' અને 'બીજાનું સંભાળવા આપણે નવરા નથી, આપણે પરસેવો પાડી મેળવેલું બીજ માટે નથી'- આ બે કુમતિને દેશવટે દેવો જોઈએ.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૩૭, તા. ૨૨-૬-૧૯૬૩

૧૦૦ શક્તિ, સ્હૂર્તિ અને શાંતિનાં અનુપમ સાધન

નમસ્કારસમો મન્ત્ર: શાત્રુંજયસમો ગિરિઃ ।

વીતરાગસમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ ॥

-આ શ્લોકમાં મનને સશક્ત, સ્હૂર્તિમાન અને શાંત શુદ્ધ કરવાના ત્રણ મહાન ઉપાય બતાવ્યા છે. નમસ્કાર મહામંત્ર ચિત્તને અદ્ભુત શક્તિ અર્પે છે, તીર્થાધિરાજ શ્રી શાત્રુંજય ચિત્તને સ્હૂર્તિ આપે છે. અને દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્મા ચિત્તને નિર્મળ અને શાંત બનાવે છે. એ કેવી રીતે તે અહીં સંક્ષેપમાં જોઈએ.

(૧) માનસશાસ્ત્ર Psychology-નો નિયમ છે કે મનને જેટલા પ્રમાણમાં નિષ્ફળ-નિરર્થક વિચારોથી બચાવી લો એટલા પ્રમાણમાં મનની શક્તિ વધે છે. નમસ્કાર મહામંત્ર એ નિષ્ફળ-નિરર્થક વિચારોથી મનને બચાવી લેવા માટે એક અતિ ઉત્તમ સાધન છે. એના વારંવાર સ્મરણાની એવી જોરદાર ટેવ પાડી દીધી હોય તો પછી જ્યાં મનમાં નકામો વિચાર કે નિષ્ફળ વિચાર ઊભો થવા જાય કે તરત નવકાર મંત્રની રટણા મનમાં ચાલુ થઈ જાય. તે પણ ગણતરીબંધ કે 'આ ત્રણ નવકાર થયા, આ બીજા ત્રણ થયા,...' એમ ગણતરી રાખ્યે જતાં મન એમાં ઓતપ્રોત બને છે, અને તેથી નકામા વિચારો અટકી પડે છે.

બીજું એ પણ છે કે પંચ પરમેષ્ઠી અને નમસ્કારની અચિંત્ય શક્તિ પરની શ્રદ્ધા મનને ખૂબ જ સશક્ત બનાવે છે. અહીં એટલું ધ્યાનમાં રહે કે પરમેષ્ઠી તથા નમસ્કાર પરની શ્રદ્ધા ઉપરાંત એમની અચિંત્ય શક્તિ ઉપર શ્રદ્ધા કેળવવાની ખાસ જરૂર છે. એથી મનને એમ નિર્ધાર થાય કે એમના અચિંત્ય પ્રભાવથી બધું સારું અવશ્ય થવાનું છે. આ નિર્ધારરૂપી શ્રદ્ધાને લીધે મનને આશ્વાસન રહે છે, પાવર (બળ) રહે છે કે 'હુવે કોઈ ફિકર નથી. પરમેષ્ઠી ભગવાન અને નમસ્કારમંત્ર મળ્યા છે તેથી અવશ્ય સારું જ થવાનું છે.' આમ નમસ્કાર મહામંત્રની ઓથે મનનું બળ મનની શક્તિ વધે છે.

વળી ત્રીજું, એ પણ વસ્તુ છે કે પરમેષ્ઠી ભગવંતોએ પોતે કરેલી સાધના એવી જોરદાર છે કે એ આદર્શ, એ લક્ષ્ય મનની સામે રાખવાથી અને એ સાધવી શક્ય હોવાનું માનવાથી પણ મનની શક્તિ ઓર વધે છે. 'હું પણ કેમ ન સાધી

શકું ? પરમેષ્ઠી ભગવંતો પણ બહુ પૂર્વે એક વખત મારા જેવી સ્થિતિમાંથી સાધના કરી ઉંચા આવ્યા હતા તો હું પણ એમ ઉંચે કેમ ન આવી શકું ?' આવી રીતે મનને પ્રેરણા લેવાથી મન શક્તિમાન બને છે.

(૨) મનને સ્ફુર્તિ માટે તીર્થધિરાજ શ્રી શત્રુંજ્ય એ એક ઉત્તમ સાધન છે; તે એ રીતે કે શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (i) આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ ભગવાનથી નવાણું પૂર્વ (૭૦૫૬૦ અબજ ખ ૮૮) વાર સ્પર્શિયો છે; (ii) કાંકરે કાંકરે અનંતા ભવ્યાત્માઓનું મુક્તિનિદાન છે; (iii) નિર્બળ જેવા ભવ્યોથી પણ કઠોર સાધના કરાયાનું પુણ્યક્ષેત્ર છે; (iv) ચોર, દુરાચારી વગેરે પાપિષ જીવોને પણ ઉત્તમ પવિત્ર ધર્મસાધક બનાવનાર છે; (v) અભિજ્ઞ જેવાને પણ કેવળજ્ઞાન પમાણનાર છે; (vi) જૈનતરોને પણ અરિહંતભક્તિના ઉત્ત્વાસી બનાવે એવા પવિત્ર આણુઓ અને વાતાવરણથી વ્યાપ્ત છે; (vii) સકલ તીર્થમાં શ્રેષ્ઠ અને પંદર ક્ષેત્રમાં અનન્ય કોટિનો છે... આવા ગિરિરાજનું દર્શન સ્પર્શના, પૂજન, અને ધેર બેઠા પણ સ્મરણ, ધ્યાન ગુણકીર્તન, ભાવયાત્રા મનને મહાસ્ફુર્તિ આપે છે. જ્યાં એકી સાથે કરોડોની સંખ્યામાં મહાત્માઓએ અંતિમ અનશનના પરાક્રમ બેડી કેઠ વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કર્યા છે, એ આ તીર્થધિરાજનું આલંબન આપણાને પણ ભગીરથ આત્મપરાક્રમ કેમ ન અર્પે ? એવી ઉત્ત્વાસભરી ભાવના એ પરાક્રમ તરફ પ્રેરે છે.

(૩) દેવાધિદેવ વીતરાગ અરિહંત પ્રભુ ચિત્તને નિર્મળ અને શાંત બનાવે છે; કેમ કે ચિત્ત ભાવુક દ્રવ્ય છે, તેવા તેવા આલંબને તે તે પ્રકારના ભાવથી ભાવિત બને છે. જેવી રીતે કપડામાં કુંગળીનો જથો રહે તેની વાસથી અને કસ્તૂરી બંધાયે કસ્તૂરીની સુવાસથી વાસિત બને છે, તેવી રીતે મનમાં રાગાન્ધ સ્નેહી વસ્યે રાગથી અને વીતરાગ પરમાત્મા વસ્યે નિર્મળ શાંત ભાવથી ભાવિત બને એમાં નવાઈ નથી. માત્ર, મનમાં પરમાત્મા વીતરાગના ગુણ અર્થાત્ રાગદ્વેષ-કામ-કોધાર્દ મેલ અને અશાંતતાથી તદ્દન રહિતતાને આગળ કરીને યાદ કરવા જોઈએ. વારંવાર એવી અવસ્થા યાદ કરતાં કરતાં રાગાદિ મેલ અને ઉકળાટ શાંત થતા આવે છે, મન નિર્મળ બને છે, શાન્ત-પ્રશાન્ત થતું આવે છે.

આમ નમસ્કારમંત્ર, શત્રુંજ્ય મહાતીર્થ અને વીતરાગ પરમાત્માના આલંબનથી મન સશક્ત સ્ફુર્તિમાન અને નિર્મળ તથા શાંત બને છે.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

૧૯૧, અંક-૩૮, તા. ૬-૭-૧૯૬૩

૧૦૧ સહશિક્ષણ અને કોલેજની કેળવણી

આજે સહશિક્ષણે યુવક-યુવતીની ઉગતી ઉમરમાંથી ઈન્ડિયોના દુરાચાર ખડા કરી દીધા છે, અને કોલેજની કેળવણીએ સ્વચ્છંદતા, જડવાદિતા, ધર્મની સુગ, વડિલોનો અવિનય, ઉદ્ભબતા, વગેરે કેટલાય અનર્થને જગા કરી આપી છે, આજે દીવા જેવું સ્પષ્ટ છે. આ સંબંધમાં નીચેનો લેખ માર્ગદર્શક બનશે. અલબત્ત પ્રસ્તુત લેખમાંના પત્રમાં છોકરાઓને પણ ધંધે લાગવાના સંયોગ હોય ત્યાં સુધી કોલેજમાં ન જવાની સુંદર સલાહ છે, એથી છોકરીઓ કે જેમને પૈસા કમાવવા જવું નથી એમને માટે તો કોલેજમાં નહિ જવાનું જ અર્થપિત્તિથી પ્રાપ્ત થાય છે, અને અમે પણ એ જ માનીએ છીએ, ઇતાં સહશિક્ષણ અને કોલેજની કેળવણીની અનિશ્ચિન્નિયતા અંગે સારું લખાશ હોઈ નીચે આપીએ છીએ. - તંત્રી

સહશિક્ષણ (લેખક M)

ઉનાળાની લાંબી રજાઓ પછી હવે કોલેજેની નવી ટર્મ શરૂ થશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વખતે એસ.એસ.સી.ની પરીક્ષામાં ધણી બહેનો ઉતીર્ણ થઈ છે, અને તે પૈકીનો મોટો ભાગ આગળ અભ્યાસ અર્થે કોલેજેમાં પણ દાખલ થશે.

માર્ચ ૧૯૮૪માં મારી નાની પુત્રી જે એ વખતે માત્ર પંદર વરસની હતી. તે એસ.એસ.સી.ની પરીક્ષામાં પાસ થઈ મુંબઈની 'સિદ્ધાર્થ કોલેજ'માં દાખલ થઈ. પણ એ વખતે મને એક વિચિત્ર મૂલ્યવણ ઊભી થઈ.

કોલેજેમાં સહશિક્ષણના કારણે યુવાન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પરસ્પર છૂટી હોણે મળે, સાથે હવા ફરવા જાય, અભ્યાસના નિમિત્તે એકાંતમાં બેસે-અને આમ ઇતાં તેઓ નિર્વિકારી રહે અને નાજુક પરિસ્થિતિમાં ન મૂકાઈ જાય, એ વાત એ વખતે મને મુશ્કેલ લાગતી, અને હવે આજના નાટક-સિનેમાનાં યુગમાં એ વાત લગભગ અશક્ય લાગે છે.

જૈનદર્શન નિમિત્ત કારણોને પણ ઉપાદાનનાં ઉતેજક માને છે, અને તેથી જ વ્યક્તિ માત્ર-પુરુષ તેમજ સ્ત્રી બનેને માટે નિમિત્ત કારણોથી સાવધ રહેવા શાસ્ત્રોમાં ભારપૂર જ્ઞાવવામાં આવ્યું છે.

ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ અને બ્રહ્મદત્તની બે જુદી જુદી કથાઓનો ઉલ્લેખ છે. કપિલને વિદ્યાર્થી અવસ્થામાં તેનાં પિતાજીના મિત્રે કોઈ બાઈને ત્યાં જમવા

માટેની સગવડતા કરાવી આપી અને પરિણામે તે બાઈ સાથેના સહવાસના કારણે તે લપસી પડ્યો. બ્રહ્મદાતના પૂર્વ જીવનમાં જ્યારે તે સાધુ હતા. ત્યારે સુનંદા રાણી તેને વંદન કરવા ગયેલા, અને તે વખતે સરતચૂકથી તેના માથાના વાળની એક લટ સરી સાધુ પાસે જઈ પરી, અને તે નિમિત્તના કારણે સાધુએ એવી અનેક સ્ત્રીઓની સાથે ભોગો ભોગવવાનું નિયાણું બાંધ્યું. આના પરિણામે બ્રહ્મદાતના જીવને અધમમાં અધમ યોનિ-એટલે સાતમી નારકીમાં જવું પડ્યું. આવી રીતે નિમિત્તો બહુ બળવાન છે, અને જીવની ઉર્ધ્વગતિ તેમજ અધોગતિમાં તેનું સ્થાન મહત્વનું છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધ બાબતમાં લખતાં સદ્ગત શ્રી કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું છે કે : આધુનિક જીવનમાં બીજાંયે ઘણાં ભયસ્થાનો વધી ગયાં છે. એ ભયસ્થાનો એકાંતવાસથી ઉલટા પ્રકારનાં એટલે અતિ સહવાસનાં હોય છે. અનેક પ્રવૃત્તિઓ અને શહેરી જીવનને અંગે સ્ત્રી પુરુષને એક બીજાનાં અંગોનો સ્પર્શ કોઈ વાર અજાણતાના કોઈ વાર અનિવાર્યપણે, અને કોઈ વાર જોતજોતામાં થઈ જાય છે. ગાડીઓમાં, મોટરોમાં, સભાઓમાં, રસ્તાઓમાં એક બીજા જોડે ભીસાઈને બેસવું પડે છે, વાર્તાલાપ કરવો પડે છે. શિક્ષકોને છોકરીઓ કે બાળાઓને શીખવવું પડે છે. અને એ સર્વે બંનેને માટે ભયસ્થાનો છે. આ બધી પરિસ્થિતિમાં જે પોતાની પવિત્રતા માટે વધારે પડતું ગુમાન રાખે છે તે પડે જ છે, જે જાગ્રત રહે છે તે એ પ્રસંગોને સુખરૂપ નહીં, પણ આપત્તિરૂપ સમજે છે, એમાંથી જેમ બને તેમ તસુભર પણ દૂર રહેવું પણ નજીક ન આવવું એવી મનોવૃત્તિથી રહે છે. તે જ ઈશ્વરની કૃપાથી બચી શકે છે.

હું પોતે પણ આવા વિચારોમાં માનું છું એટલે મારી પુત્રી સિદ્ધાર્થ કોલેજમાં દાખલ થઈ તે ન ગમ્યું. આ પુત્રીની માતા તેમ જ પિતાની બંને જવાબદારી મારા શિર પર હતી પણ તેમ છતાં હક્ક, સત્તા કે અધિકારનો ઉપયોગ કરી સિદ્ધાર્થ કોલેજના બદલે એસ.એન.ડી.ટી. (માત્ર સ્ત્રીઓના માટેની કોલેજ)માં દાખલ કરાવવાનું મને ઉચાટ અને ઉકળાટ ચાલુ જ રહ્યો. મારું વલણ ગેરવાજબી અગર ખોટું હોય એમ પણ બની શકે, એટલે આ સંબંધમાં મારા નિકટના સંબંધી અને હિતેશ્ચ પંડિત બેચરદાસ દોશી જેઓ છેલ્લાં રપ વરસથી અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજના અધ્યાપક છે. તેઓને મારી મુંજવણ જણાવી મને માર્ગદર્શન આપવા વિનંતી કરી.

એ પછી, પંડિતજીએ મારી પુત્રીને પત્ર લખી માર્ગદર્શન આપ્યું અને પરિણામે

સિદ્ધાર્થ કોલેજ છોડી તે પોતે રાજ્યભૂષિથી એસ.એન.ડી.ટી. કોલેજમાં દાખલ થઈ અને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો. ઘણા માબાપો પોતાની છોકરીઓને આગળ અભ્યાસ કરાવવામાં મારી જેમ મુંજવણ અનુભવતાં હોય એમ માની, પંડિતજીના પત્રમાં લખેલી સૂચનાઓ તેઓને ઉપયોગી થઈ પડશે એ દસ્તિએ આ પત્ર અક્ષરશઃ નીચે આપવામાં આવ્યો છે.

૧૨, બ-ભારતીનિવાસ સોસાયરી
એલિસબ્રીજ, અમદાવાદ નં. ૬
તા. ૨-૬-૫૪.

ચિ. અરુણા.

શુભ આશીર્વાદ.

તારા બાપુજીના પત્રથી જાણ્યું કે તું ઘણા સારા ગુણ મેળવીને મેટ્રીકની પરીક્ષામાં પાસ થઈ છે. આ જાણીને અમે બંને બહુ જ રાજી થયા છીએ, અને હવે પછી દિન-પ્રતિદિન તારો અભ્યુદ્ય વધતો રહે એમ જગન્નિયંતા પરમેશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. જો કે મેં તારા પર કદી પત્ર નથી લખ્યો, હા, તને અવારનવાર આશીર્વાદ મોકલવાનું ચાલુ રહ્યું છે. પરંતુ આ ટાંકણે તારા ઉપર પત્ર લખવાનું મને વિશેષ મન થઈ આપે છે, તેને રોકી શકતો નથી. મેટ્રીકમાં પહેલી જ વારને પ્રયાસે પાસ થઈ જવું અને તે પણ સારા ગુણ મેળવીને તે આ જમાનામાં ઘણું વિરલ બને છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં દાખલ હોય, ખંતીલ, હોય તેઓ જ પહેલીવાર જતી જાય છે. તું પહેલી જ વારે જતી ગઈ તે માટે તને અમારા સેંકડો શુભ આશીર્વાદો છે.

જીવનમાં આ એક વિકસનનું પ્રથમ પગથિયું છે. હવે બીજું પગથિયું કયું હોવું જોઈએ ? તે વિષે તને યોદું સૂચન કરવાની મારી ફરજ સમજીને આ લખવા બેઠો છું. અહીની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં હું ૧૫-૧૬ વરસથી ભણાવું છું, તેથી કોલેજ વિષે મારો જે પ્રત્યક્ષ અનુભવ છે તે જ તને જણાવું છું. તું દીકરો હોત અને મારા જ શાસનમાં હોત તો તને તરત જ કહી દેત કે બાપુ ! ધંધામાં ગોઠવાઈ જાઓ, કોલેજમાં જવાનું આપણું કામ નથી. જ્યારથી કોલેજમાં હું દાખલ થયો છું ત્યારથી દિવસે દિવસે તમામ કોલેજો એટલે મુંબઈ પ્રાંતની કે બીજા પ્રાંતની તમામ કોલેજોનું વાતાવરણ હીન, હીનતર, હીનતમ થતું હું પ્રત્યક્ષ નજરે જોયા કરું છું અને કલાસમાં વિદ્યાર્થીઓને કહું છું પણ ખરો કે ભાઈઓ ! શા માટે વખત બગાડો છો અને પૈસાનો પણ શા માટે અપવ્યય કરો છો ? ધંધા ઉદ્યોગમાં લાગી

જાઓ તો તમને અને તમારા કુટુંબને જરૂર ફાયદો થશે. આ ઉપરથી તને કોલેજના છિનતમ વાતાવરણનો ખ્યાલ આવશે. હુર્ગુણો, વસનો અને ઉદ્ઘતાઈના સંસ્કારો વિદ્યાર્થીઓ પૈસા અને વખત બગાડીને મોટે ભાગે કોલેજોમાંથી ખરીદે છે, અને પરિણામ બેકાર બનીને જીવનની નિષ્ફળતા અનુભવે છે. તેમ છતાં તારું જો આગળ અભ્યાસ કરવાનું મન જ હોય અને તારા વડીલોની સંમતિ હોય તો તું ત્યાં કેવળ છોકરીઓની કોલેજમાં જા તો ઉચ્ચિત કહેવાય. કર્વ કોલેજ ત્યાં છે જ,' તેમાં જે અભ્યાસક્રમ છે તે છોકરીઓને ભવિષ્યમાં વિશેષ ઉપયોગી નીવડે એ રીતે ગોઠવેલ છે. ગુહાવિજ્ઞાન, શીવણ, રાંધણ, બાળઉછેર વગેરે વિદ્યાઓ છોકરીઓના જીવનમાં વિશેષ લાભકારક નીવડે છે અને તે સાથે ભાષા, ઈતિહાસ, ભૂગોળ અને ગણિત વગેરે ઉપયોગી વિષયો પણ હોય છે. વળી માનું છું કે તારા ધરથી તે કોલેજ દૂર પણ નથી. જો તારે કોલેજમાં જવું જ હોય તો મારી આ નમ્ર સૂચના-ભલામણ છે. આ સિવાય બીજી કોલેજો આપણા જીવન માટે ભારે ખતરનાક અને જીવનના મંડપને વણસી નાખે એવી મને મારા પ્રત્યક્ષ અનુભવથી દેખાય છે. એકવાર પાલીતાણાવાળા નગરશેઠે તેમના પૌત્ર માટે કોલેજમાં દાખલ થવા વિષે પૂછેલું તેનો મેં જવાબ આપેલો કે ધરનો ધંધો હોય તો તેને તેમાં જ ગોઠવી ધો, અને પૈસા વધારાના હોય તો છોકરાને બગાડવા કોલેજમાં મૂકવો હોય તો ભલે. તારા અભ્યાસ વિષે મારા તરફથી કોઈ સહાયતાની જરૂર હોય તો જરૂર તું મને લખજે. હું તો ઈચ્છાનું કે તું સારું સંસ્કૃત, ગુજરાતી અને અર્ધમાગધી તથા અંગ્રેજી શીખીને એક સારી લેખિકા અથવા સંપાદિકા બની જા; પણ આ જોગ તને કર્વ કોલેજ સિવાય બીજે થવાનો સંભવ નથી. આ પત્ર નિરાંતે વાંચજે અને ગંભીરપણે વિચારજે.

- બેચરદાસ

(જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકામાંથી સાભાર ઉદ્ઘૂત)

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૧, અંક-૩૮, તા. ૧૩-૭-૧૯૬૩

૧૦૨ ભવ્યત્વનો મફત પાસપોર્ટ

ધરીભર નિરાંતે બેસી હદ્યના ઊંડાણમાં વિચારવું ધટે છે કે-‘મેં આ જીવન અનંત કાળથી ચાલી આવતી જડ પુદ્ગલ સંગ્રહની કૂડી કીડા અને વિષયભોગની ગલીચ રમત માટે નથી લીધું. આ જીવન તો મને મફત મળેલ ભવ્યત્વનો પરિપાક કરવા માટે છે. જેથી પૂર્ણ પરિપાકે આ દુઃખમય સંસારમાંથી મારો મોક્ષ થાય.’

ભવ્યત્વ એટલે મુક્ત થવાની લાયકાત, મોક્ષ પામવાની યોગ્યતા, એ હોય તો જ જીવનો મોક્ષ થઈ શકે. દા.ત. વગર શેકેલા ચાલુ મગમાં પાકવાની યોગ્યતા છે, તો એ રંધાતા પાકી જાય છે. કોર્ડનું કે શેકેલા મગમાં યોગ્યતા નથી તો એ પાકતા નથી. એમ ભવ્ય જીવમાં ભવ્યત્વ યાને મોક્ષ પામવાની યોગ્યતા છે તો એનો મોક્ષ થઈ શકે છે, અભ્યવ્યમાં યોગ્યતા નથી તેથી એનો કદી મોક્ષ થઈ શકતો નથી. વળી જેવી રીતે ચુલા પર ચડાવેલ મગમાં પાક્યોગ્યતા પાકતી પાકતી પરાકાણાએ પહોંચે છે તો સંપૂર્ણ પાક થઈ જાય છે, તેવી રીતે ભવ્યત્વ પાકતું આવી પરાકાણાએ પહોંચતાં સંપૂર્ણ પાક થયે મોક્ષ થાય છે.

આ ભવ્યત્વને પક્વવાનું તો જ થાય કે અનાદિની વિષય-પરિગ્રહની ગંદી-કૂડી રમત ઓછી કરવા કમર કસાય. આશ્ર્ય છે કે અનંતકાળની આ રમત જેટલી વહાલી લાગે છે તેટલાં ભવ્યત્વના પરિપાકના ઉમદા ફળો, વહાલાં લાગતાં નથી. તેથી જ ગંદી-કૂડી રમત ખાતર બધું વેદવા તૈયાર થવાય છે, વેદાય છે, તન-મનધનનો ભરપૂર ભોગ અપાય છે. જો ભવ્યત્વપરિપાકનાં મોંદેરા કલ્યાણ ફળ મોઠાં લાગે તો એની ખાતર કેટલો ભોગ ન અપાય ?

ભવ્યત્વ પક્વવા માટે જવે શ્રી જિનેશ્વરહેવની આજ્ઞાઓ માથે ઉઠાવવી જોઈએ. એ ઉઠાવાય તો કમશઃ પક્વ થતાં થતાં આત્મામાં અનેરું અનેરું ઓજસ, સ્વસ્થતા અને પ્રકાશ વિકસતા આવે છે, હલકા ભવ અને મોહમય જીવન બંધ થઈ ઉચ્ચ ભવોમાં મોક્ષ તરફ ઝડપી દોટ, વિકસતા પુરુષાર્થ અને જ્ઞાનમય જીવન ચાલુ રહે છે. એ પરાકાણાએ પહોંચતાં ભવ્યત્વનો સંપૂર્ણ પરિપાક થઈ મોક્ષ થાય છે. તો જે ભવ્યત્વ પરિપક્વ થતાં મોક્ષ સુધીની અંધિત્ય અકલ્ય મહા ઉન્નતિ આપે છે, એવા એનો પરિપાક કરવામાં આગસ કે બેપરવાઈ કેમ જ થાય ?

ધ્યાનમાં રહે કે આ ભવ્યત્વ અભ્યવ્ય જીવ માથું ઝોડીને મરી જાય તો ય તેને

મળતું નથી; ને ભવ્યને મળેલું છે તે કોઈ જ મહેનત કે હોશિયારીથી નહિ કિન્તુ અનાદિ કાળથી સહેજે એની પાસે છે છે ને છે જ. અર્થાત્ જો આપણને ભય કે શંકા પડી થાય છે કે ‘હું ભારે મોહમૂઠ છું; તો શું ત્યારે આ હુંખદ સંસારથી મારો મોક્ષ નહિ થાય?’ તો આપણે નિશ્ચિતપણે ભવ્ય છીએ અને એ ભવ્યત્વ આપણને અનાદિસિદ્ધ મફન્તમાં મળેલું છે. તે મહા કિંમતી છે, એના પર જ મોક્ષની ટિકિટ મળે છે. વળી માનવ જીવન એને પકવવા માટે જ છે. તો વાત પડી સાચી જ છે કે માનવ ભવનો ઉપયોગ ભવ્યત્વને પકવવા સિવાય બીજા શામાં હોઈ શકે? ભવ્યત્વ પકવવા યોગ્ય માનવભવથી બીજો કયો સારો ભવ મળવાનો હતો?

માટે જ આ વિચાર વારંવાર આવવો જોઈએ કે ‘મારાં અહોભાગ્ય છે કે મને વિના પરિશ્રમે સહજ ભાવે આ ભવ્યત્વ મળ્યું છે, અને માનવભવ હાજર છે, તો એને પકવવાનો જ યત્ન કરી લઉં. મોક્ષસાધનાની સ્તીમરમાં બેસવા મફત મળેલા ભવ્યત્વના પાસપોર્ટનો એ ઉપયોગ કાં ગુમાવું? જડ પદાર્થોની સાધના તો ચોરાશી લાખના ચક્કરે ઘુમાવનારી છે, જીવને મૂર્ખ બનાવનારી છે. માટે એની લત હવે છોટું’ એ વિચાર પછી ભવ્યત્વ પકવવા ભારે પુરુષાર્થ જોઈશે. ત્યાં કાયાની સુકોમળતા જાળવ્યે નહિ ચાલે. હૃદયની તિજોરીમાં જગતની માયાને સાચવી રાખ્યે નહિ ચાલે. એને નગણ્ય કરવી પડશે. ભવ્યત્વને પકવવનારી જિનાજ્ઞાની આરાધના સિવાય શાંતિ ન વળે. મોક્ષનું અનંતું સુખ જિનાજ્ઞાપાલન દ્વારા ભવ્યત્વને પકવવાથી જ મળે છે. ભવ્યત્વ એ ધાન્યની યોગ્યતા છે. તેને પકવવા અનિ તે આજ્ઞાપાલન છે. એનાથી એ પાકે એટલે મોક્ષરૂપી રસોઈ તૈયાર થાય.

જિનાજ્ઞાપાલન ભૂલી પાપસ્થાનકના સેવન તરફ આત્મા ધસે ત્યાં વિચારવું કે, ‘આમાં તો કર્મનો ભાર વધી ભવ્યત્વને પકવવાનું દૂર જશે! ઉપરથી વધતી કર્મના ભારે આત્માની કેવી હુદ્દશા! આટલે ઉંચે આવ્યો છું તે તો ઢગલા કર્મનો ભાર ઉતારીને, અને ભવ્યત્વને પકવવાની યોગ્ય પરિસ્થિતિવાળા ભવમાં આવ્યો છું. જો હજ્ય પાપસ્થાનકીની રમત ચાલુ છે તો શું જિનાજ્ઞાપાલન સિવાયનું જ બધું મને ગમે છે? એમાં જ મારી શાબાશી છે? એ તો મને, જેટલા નીચેથી યુગના યુગે આટલે ઉંચે આવ્યો, તેટલે નીચે માત્ર પળવારમાં મને તાણી જશે! માટે હવે તો ભવ્યત્વને પકવવનારી જિનાજ્ઞાને જ તન-મન-ધનથી આરાધું.’ આવી ધગશ, આવો નિર્ધર જોઈએ, નિર્ધર પૂર્વકનો પુરુષાર્થ સતત ચાલુ જોઈએ. એ હોય પછી જગતના પદાર્થ કે પરિવારની શી તાકાત છે કે આપણને નચાવી જાય? જિનના આદેશમાં લયલીન થતાં અટકાવે?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૪૦, તા. ૨૦-૭-૧૯૬૩

૧૦૩ નવકાર શું છે ?

‘જિનશાસણસ્સ સારો ચ઱્દસ પુબ્બાણ જો સમુદ્ધારો ।’

નવકારમંત્ર (૧) જિનશાસનનો સાર છે, અને (૨) ચૌદ પૂર્વોનો ઉદ્ધાર (માખણ) છે. આ બંને શી રીતે તે જોઈએ.

(૧) જિનશાસન એટલે જિનપ્રવચન એનો આધાર સંધ છે, ભગવાનનો ઉપદેશ સંધના હૃદયમાં રહે છે. એ સંધમાં સાર એટલે પ્રધાન છે પંચ પરમેષ્ઠા. માટે પરમેષ્ઠાને સંધમાં સાર એટલે જિનશાસનનો સાર કહેવાય; તો પરમેષ્ઠિમંત્ર નવકારમંત્ર પણ જિનશાસનનો સાર કહેવાય.

અથવા જિનશાસનનો એટલે કે જિનપ્રવચનનો સાર આ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમયંડ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે,- ‘આશ્રવઃ સર્વથા હેય: ઉપાદેયશ સંવરઃ । ઇતીયમાર્હતી મુદ્દિઃ’ અર્થાત્ આશ્રવ સર્વથા ત્યાજ્ય છે અને સંવર ઉપાદેય છે. એ આર્હત્ પ્રવચનનો સંક્ષેપ છે, સાર છે. નવકારમંત્ર એ સવ્વપાવપ્યણાસણો અને પદમં હવેઈ મંગલં છે, અર્થાત્ સર્વ પાપનો નાશક અને શ્રેષ્ઠ મંગળ છે. પાપનો નાશ આશ્રવના ત્યાગની અપેક્ષા રાખે છે, અને શ્રેષ્ઠ મંગળ ભાવમંગળ શુભ અધ્યવસાયરૂપ છે, એ સંવર છે. તેથી કહેવાય કે નવકારમંત્રમાં આશ્રવના ત્યાગની અને સંવરના આદરની વાત ગર્ભિત છે; માટે એ જિનશાસનના સારથી ગર્ભિત છે, જિનશાસનનો સાર છે.

અથવા; જિનનું શાસન એટલે જિનનો આદેશ. આદેશ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો છે, રત્નત્રધીનો છે, અને પંચ પરમેષ્ઠી રત્નત્રધીનો આધાર છે. એમને નમસ્કાર એ જિનના આદેશનો સાર છે, જિનશાસનનું તાત્પર્ય છે; કેમ કે નમસ્કારથી રત્નત્રધી પ્રાપ્ત થાય છે; નમસ્કાર રત્નત્રધીમાં પરિણમે છે. પરાકાણનો નમસ્કાર એટલે પરાકાણના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. માટે કહેવાય કે નમસ્કાર એ સાર અને સમગ્ર જિનશાસન એ વિસ્તાર.

(૨) ચૌદ પૂર્વ એ ઉત્પાદ-બ્યા-ક્રોબ્યરૂપ મહાસત્તાના અહૃદ્વચન પરથી ગણધરોએ એ સત્તાથી અન્વિત જ્વાજ્વાદિ તત્ત્વ સંબંધી રેચેલાં શાસ્ત્ર છે. એ તત્ત્વ શૈય, હૈય, ઉપાદેય ત્રણ પ્રકારે છે. બાળ જીવ, અતિ રોગિજ જીવ કે અશક્ત જીવને એમાંથી માખણ તારવીને આપવું હોય તો ખાસ સરળ અને સચોટ ઉપાદેય તરીકે

પરમેષ્ઠિ-નમસ્કાર અપાય. એથી ઉલટી જડ માયાને હેય તરીકે બતાવી એની મમતાનો ત્યાગ બતાવાય; શૈય તરીકે આત્મા-અનાત્મા દર્શાવાય. નમસ્કારમંત્રમાં હેય, શૈય ગર્ભિત છે, ઉપાદેય સ્પષ્ટ છે. ચૌદ પૂર્વો શૈય-હેય-ઉપાદેયનો દરિઓ છે, નમસ્કારમંત્ર એમાંથી અનુપમ ઉદ્ઘૃત નવનીત છે. પંચ પરમેષ્ઠિને નમસ્કાર ભાવ-નમસ્કાર રૂપ જ વિશેષ મહત્વનો છે. ભાવનમસ્કારમાં પ્રારંભિક અશુભ મનસંકોચથી માંડી હેઠ વીતરાગતા સુધીની પરાકાણ આવે છે. એની શ્રેષ્ઠ ઉપાદેયતાનું પૂછવું શું ? માટે એનો દર્શક નમસ્કારમંત્ર એ ચૌદ પૂર્વનું ઉદ્ઘૃત નવનીત હોવામાં કોઈ શંકા નથી.

બીજી રીતે જોઈએ તો ચૌદ પૂર્વોમાં જે જીવ-અજીવ આદિ તત્ત્વ, અતિ વિસ્તારથી વર્ણવિલાં છે, તેને વિધિ-નિષેધ મુખે સંક્ષેપમાં ઉદ્ઘરતા છેવટે નમસ્કારમંત્રમાં આવીને ઉભા રહેવાય; કેમ કે પરમેષ્ઠી ભગવંતોમાં વિધિમુખે ગુણાત્મક તત્ત્વો ધરવારૂપે અને નિષેધમુખે દોષાત્મક તત્ત્વો ત્યજવારૂપે જીવ-અજીવ આદિ સમસ્ત તત્ત્વોનો અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધ લાગુ થાય છે. માટે પરમેષ્ઠિમંત્ર એ ચૌદપૂર્વનો ઉદ્ઘાર છે.

વળી જોઈએ તો ચૌદ પૂર્વ એ મંત્રોના પણ અગાધ સાગર છે, અને નમસ્કારમંત્ર સર્વ મંત્રોમાં શિરોમણિ છે, સર્વ મંત્રોની ગરજ સારે એવો સમર્થ મહામંત્ર છે; માટે એને મંત્રસાગર ચૌદ પૂર્વનું નવનીત કહી શકાય.

જિનશાસન એટલે કે દ્વાદશાંગી અને ચૌદ પૂર્વના પારગામી મહાત્માઓને પણ અંતકળે નવકારમંત્રનું ધ્યાન-સ્મરણ એ શરણભૂત છે, તો બીજી જીવો માટે તો પૂછવાનું જ શું ? એકાડી પ્રતિમાધારી મુનિઓ પણ આમ જિનપ્રવચનના ચિંતનમાં રહેનારા છતાં સહેજે કે ઉપસર્ગ વખતે અંતકળ આવ્યો જણાતાં પરમેષ્ઠિમંત્ર નવકારમંત્રનું ધ્યાન કરે છે. આ સૂચવે છે કે નવકારમંત્ર ચૌદ પૂર્વનું નવનીત છે, જિનશાસનનો સાર છે, માટે છેવટે એમાં ચિંતને પરોવી દે છે.

નવકાર શું છે ? નવકાર દુઃખીનો ઉદ્ઘારનાર, રોગીનો વેદ, ભૂખ્યાનો અન્નદાતા, દીનહીનનો દિલાસાકાર છે.

ધર્મના રોજિંદા જીવનમાં પણ નવકારમંત્રનું સ્મરણ ઠામ ઠામ કરવાનું કહ્યું છે. પ્રભાતે જાગતાંવેત પહેલું નવકારસ્મરણ, રાત્રે સૂતાં પહેલાં નવકારસ્મરણ; નવકારશી વગેરે પચ્યક્રખાણ પારતા પણ એ જ; ભોજન શરૂ કરતાં ય એ; આજીવિકા માટે ધરની બહાર નીકળતાં પહેલાં પણ નમસ્કારાદિ મંગળ; કોઈ પણ કાર્ય કરતાં પહેલાં નવકારનું સ્મરણ-આમ નવકારમંત્ર બધાં જ પ્રસંગે અગ્રગામી

સેનાપતિ છે, સાર્થવાહ છે. એની છાયામાં અંતરાય-અનિષ્ટો દૂર થઈ જાય છે, ઈષ-કલ્યાણો આવી મળે છે.

આવા નવકારને આપણા જીવનમાં કેટલું પ્રધાન સ્થાન જોઈએ ? કહેવાય કે બિમારીમાં દવા, ભયમાં રક્ષક, થાકમાં વિશ્રાંતિ, કોટિક્સમાં વકીલ, મુસાફરીમાં વાહન વગેરે કરતાં ય નવકારમંત્રને પહેલું અને મુખ્ય સ્થાન જોઈએ.

U

પ્રમાદને પોટાડી દીઘો

V

ચૈત્ર વદ-૧૩ ના દિવસે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. તેના ૧૨ દિવસ પહેલાનો આ પ્રસંગ છે. ચૈત્રી પૂર્ણિમાની સાંજના અપ્રમત્તાભાવે પ્રતિકમણ-સંથારાપોરિસી આદિ કિયા કરીને રાત્રે સૂતા. હું તેઓશ્રીની સેવામાં હતો. મારો સંથારો તેઓશ્રીની નજીકમાં હતો. રાત્રે ૧ વાગો તેઓશ્રી ઊઠ્યા.

“સાહેબજી, હજુ તો એક વાગ્યો છે, સૂર્ય જાઓ.” મેં કહ્યું, “અરે, દિવસે સમય નથી મળતો, લખવાનું ધણ્યું છે. જિંદગી સૂવામાં કાઢવાની છે ?” એમ કહીને પૂજ્યશ્રી તો વીંટીયાના ટેકે લખવા બેસી ગયા. મને કહ્યું, તું સૂર્ય જા. અસ્વસ્થ તબિયતે પણ તેઓશ્રી રાત્રે જાગીને લખવા બેસી જાય ત્યારે હું કેવી રીતે સૂર્ય શકું ? હું જાપ કરવા બેઠો. પૂજ્યશ્રીએ રાત્રે ૧ થી ૩ સુધી લખ્યું. ત્રણ વાગો લખીને ઊઠ્યા એટલે મેં કહ્યું : સાહેબજી હવે આરામ કરો. “હવે તો જાપનો સમય થઈ ગયો છે.” કહીને જાપ કરવા બેઠા. ૩ થી ૫ સુધી જાપ કર્યો. ત્યારબાદ ઊભા ઊભા પ્રતિકમણ કર્યું.

લક્વાની બિમારીને કારણે કદાચ બેલેન્સ ન રહે તો !- તે વિચારથી હું તેઓશ્રીની નજીકમાં ઊભો રહ્યો. તેમણે કહ્યું : “તું તારું પ્રતિકમણ કર. હું પડી નહિ જાઉં, ગભરાઈશ નહિ.”

અપ્રમત્તાભાવે અદ્ભુત પ્રતિકમણ તેઓશ્રીએ કર્યું અને હું તે જોતો રહ્યો.

W

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

૨૧૮

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૂત (ભાગ-૨)

૧૦૪ ધ્યાન-સમભાવ-કરુણાભાવ ક્યાં ?

પ્ર.- મને ધ્યાન બહુ ગમે છે. ધ્યાન કરતાં રહેવું, અને સમભાવ તથા જીવો પર કરુણાભાવ કેળવતા રહેવું, આ મારી પ્રવૃત્તિ છે. ચારિત્ર લેવાનું મન થાય છે, પરંતુ એમાં એકાંત સ્થળે ધ્યાન કરવાનો સંયોગ ન મળે તેથી મન પાછું પડે છે. હવે મારે શું યોગ્ય છે ?

૩.- પૂર્વ ભવના સારા સંસ્કારથી તમને ધ્યાન સમજાય અને કરુણાભાવ ગમે છે. પણ એ કારણે ચારિત્રમાં મન પાછું પડે છે એ આશ્રમ છે; કેમ કે ચારિત્રમાં તો એની સારી સગવડ છે. તમારે એ વિચારવા જેવું છે કે તમો જો જીવો પર ધ્યાભાવ કેળવવા તો મથો છો, તો પછી પહેલું એ જુઓ કે ઘરવાસમાં કેટલી જીવદ્યા પાળવાને અવકાશ છે ? દિવસના ભોજનના એકેક ટંકની એકેક વસ્તુ પાછળ કેટલા અસંખ્ય સ્થાવર જીવોનો કચ્ચયરધાણ નીકળે છે ? તેમ, જીવન-જરૂરિયાતો પાછળ કેટકેટલો જીવસંહાર ચાલુ છે ? જો શક્ય છે કે એ ટાળી શકો, તો મનને એમ કેમ નથી થતું કે પહેલું તો આ સંહારમાંથી બહાર નીકળી જાઉં અને સર્વ જીવને અભયદાન દઈ દઉં ? યાદ છે ને કે જીવ માત્ર આપણા બંધુ છે, તો એને મરણાન્ત કષ્ટ કેમ અપાય ? આપણી જ જેમ જીવમાત્ર સુખના અર્થી છે. જીવવાના હકદાર છે, જીવન પોતાના પુણ્યે પાખ્યા છે, વળી આપણે એને જીવન આપી શકતા નથી, તો એને મારવાનો આપણને શો હક છે ? મનને થવું જોઈએ કે જો જીવમાત્રને અભયદાન દેવાનું મને મળતું હોય તો બીજું બહું ગૌણ કરીને પણ હું એ વધાવી લાંઠ. ચારિત્રજીવનની મહામોટી કિંમત પહેલી તો આ અનંતા જીવોને અભયદાન દેવાના લીધે છે.

બીજું કહો છો કે સમભાવ કેળવવા મયું છું, તો એ વિચારો કે ઘરવાસમાં કેટલીક વાર તો ઈચ્છા નહિ છીતાં બળાત્કારે પણ કેટલા રાગ-દ્રેષ, હર્ષ-બેદ ક્ષાયો વગેરે વિષમભાવ યાને પાપસ્થાનકે સેવવાં પડે છે ? ગૃહસ્થપણું છે માટે ઈચ્છા ન હોય તો ય સ્વાભિમાન, અમુક અહંત્વવાળી પ્રવૃત્તિ, લોભ, મમતા, મોટાઓ સામે સૂક્ષ્મ પણ કલહ, માયા વગેરે કેટલું કરવું પડે છે ને ? આમાં સમભાવ ક્યાં કેળવાશે ? ત્યારે મનને એમ થવું જોઈએ કે સમભાવને ભરપૂર પ્રમાણમાં કેળવવા અને પાપસ્થાનકોથી બચવાનું મળતું હોય તો તો એ પહેલું વધાવું. ચારિત્રજીવન જ આ માટે એક યોગ્ય જીવન છે.

સર્વ જીવોને અભયનું દાન અને પાપસ્થાનકોનો ત્યાગ,- આ બેને ગુમાવીને કરેલા ધ્યાનનું બળ શું, અને ફળ શું ?

હવે ધ્યાન અંગે જુઓ.

એટલું તો માનો જ છો ને કે જ્ઞાનીની આજ્ઞાના પાલનની મોટી કિંમત છે, અને એ વિનાના ધ્યાન-સેવનની કોડીની કિંમત નથી ? જો હા, તો જુઓ શાસ્ત્ર કહે છે કે ‘શું ગૃહસ્થ કે શું સાધુ પોતાના ઉચિત અનુષ્ઠાનને ગૌણ કરીને ધ્યાનમાર્ગના અધીકારી નથી.’ એ વાજબી પણ છે. કેમ કે,

જ્ઞાનીએ ફરમાવેલા ઉચિત કર્તવ્યો તરફ છતી શક્તિએ હુલ્કશ કરે છે, એ

(૧) આપમતિ દ્વારા અહંત્વને પોષે છે.

(૨) કર્તવ્ય પ્રત્યે અરુચિ કરે છે.

(૩) ધ્યાનનો આણાજાતો લોભ સેવે છે, તેમજ

(૪) વિવિધ કર્તવ્યોથી જ જે છાસ પામી શકે તેવા વિવિધ દોષોને ઊભા રાખી રહ્યો છે.

આ સ્થિતિમાં એનું ધ્યાન એ શું ખરેખર ધ્યાન કહેવાય ? સમજ રાખો કે જે ધ્યાન એટલે માત્ર એકાગ્ર ચિંતન નથી; કેમ કે તે તો કામીને, લોભીને, બગલાને ધાંશું ય છે, તો તે શું ધ્યાની છે ? ના, માટે સમજો કે એકાગ્ર ચિંતન સાથે તેવી શુભ પરિણાતિ જોઈએ કે જે જ્ઞાનીઓએ જરૂરી કહી હોય. જ્ઞાનીઓની સામેની આપમતિ અહંત્વ વગેરે દોષ બદબદા હોય ત્યાં તેવી શુભ પરિણાતિ ક્યાં રહેવાની હતી ? માટે ઉચિત અનુષ્ઠાનમાં પહેલા મગન બનવું જોઈએ.

શાસ્ત્રમાં પણ ધ્યાનની ગ્રીજ ભૂમિકા કહી છે. નીચેની પહેલી ભૂમિકા અધ્યાત્મની, અને એના ઉપર બીજી ભાવનાની. એ બેનો પ્રયત્ન પહેલો જોઈએ. ત્યાં અધ્યાત્મનો અર્થ કહ્યો છે કે વિરતિયુક્ત અને ઔદ્યિત્યવાળાનું તત્ત્વચિંતન એ અધ્યાત્મ; તો સાચું ધ્યાન લાવવા માટે આ પહેલું જોઈએ. પછી ભાવના એટલે એવા જ તત્ત્વચિંતનનો વારંવાર અભ્યાસ આ પણ તેટલું જ જરૂરી છે.

બીજું એ છે કે ઊચા ધ્યાન માટે પહેલા ગ્રાથમિક ધ્યાનનો અભ્યાસ જોઈએ. ત્યારે જુઓ કે આપણી ધાર્મિક કિયાઓ જો એકાગ્ર મનથી કરાય તો તેમાં ગ્રાથમિક ધ્યાન સુંદર કેળવાય છે, એની ઉપેક્ષા કરીને કરેલો મનમાન્યો ધ્યાનનો પ્રયત્ન એ કેટલો કારગત નીવિડવાનો હતો ? ‘ધ્યાનશતક’ શાસ્ત્રમાં અંતે ‘જ્ઞાણી જ્ઞેય ચ નિત્ય પિ’ એ વચ્ચનથી કહ્યું કે નિત્ય ધ્યાનને ધ્યાવવું. અહીં ટીકામાં પ્રશ્ન કર્યો કે ‘તો પછી સર્વકિયાનો લોપ થઈ જશે !’ અને એના ઉત્તરમાં કહ્યું કે ‘ના, કિયા ઉડી નહિ જાય, કેમ કે કિયાનું આસેવન પણ પરમાર્થથી ધ્યાન જ છે. એવી કોઈ કિયા

નથી કે જેનાથી સાહુઓને ધ્યાન ન થાય.' અર્થાતું ઉપયોગપૂર્વક કરતી બધી જ ભાવક્ષિયામાં એકાગ્ર ચિંતન રહેવાથી ધ્યાન સધાય જ છે. કિયામાં વિવિધતા હોવાથી અભ્યાસીને સરળતાથી અને વાસ્તવિકરૂપે ધ્યાનની સાધના થાય છે.

प्रतिकूलतामां पण सत्यशीलता

કણાટકમાં ટીપટુરથી વિદાર કરીને ટુમકુર તરફ જઈ રહેલા. સાંજે વચ્ચમાં એક ગામની નિશાળમાં મુકામ કરવાનો હતો. શિષ્યો સ્ટ્રેચર ઉપાડીને ચાલતાં હતાં. એકદમ સ્ટ્રેચરે રસ્તા વચ્ચે દગ્ગો દીધો અને પૂજ્યશ્રી પડી ગયા. માચામાં સખત વાગ્યું. પાંચ-સાત મુનિઓ ઉપાડીને ગામમાં નિશાળે આવ્યા, ત્યારે અંધારું થવા આવેલું - માચામાંથી લોહી નીકળતું હતું. બધાને ચિંતા થઈ. મહિના બે મહિના પહેલાં જ હાર્ટ-એટેક આવી ગયેલો - હવે શું થશે ? નાના ગામમાં અંધારામાં મુનિશ્રી ગુણસુંદર વિ.મ. ફરી વધ્યાં. - કોઈ ડૉક્ટર ન મળ્યા. એક ડૉક્ટર હતા પણ તે બહાર ગયેલા., આવતા વાર લાગે તેમ હતું. કામચલાઉ માચાના ઘા ઉપર મલમપણા કરીને પૂજ્યશ્રીને સંથારામાં સુવાડી દીધેલા.

ના, પ્રતિકમણ તો પહેલાં જ કરી લેવું છે. પૂજ્યશ્રી મક્કમણાં. એક સાધુએ પૂજ્યશ્રીએ કહ્યા.

“સારું સાહેબ ! અમે આપને કરાવી દઈએ છીએ .
સાહેબ ! આપ ઉભા - ઉભા કરશો તો લોહીને માથામાં
પરિષ્ઠમણ કરવામાં વધુ શક્તિ વપરાશે માટે...”

બેસ... બેસ... તું વૈજ્ઞાનિક બનીને આવ્યો... હસતાં હસતાં
પૂજ્યશ્રીએ કહ્યાં. છીવટે માંડ માંડ માન્યા.

વળી રાત્રે પણ અવસર મળ્યો ત્યારે સ્વસ્થ બનીને લેખન
કાર્ય કરી લીધું. કોઈ હાય વોય વગર બે ત્રણ દિવસમાં તો સારું
થઈ ગયું. ધીરજ અને કર્તવ્યપ્રેમની સજાગતા કોને કહેવાય ?

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

“ହିନ୍ଦୁ-ଦର୍ଶନ”-“ଅଗ୍ରଲେଖାମୃତ”

વર્ષ-૧૧, અંક-૪૨, તા. ૩-૮-૧૯૬૩

૧૦૫ નાથને ભુલાવનાર લોથ

પરમાત્માને કરાતી પ્રાર્થના જરૂબુદ્ધી છે. વારંવારની પ્રાર્થના મોહનાં વિષ ઉતારી નાખે છે. એ પ્રાર્થના અનેક પ્રકારે કરવામાં આવે છે; અને એ ઠીક પણ છે; કેમ કે એક જ પ્રકારની પ્રાર્થના કરતાં ઉત્સાહ રહે છે. પરંતુ એટલું ચોક્કસ કે એ પ્રાર્થનાઓ જો કંઈસ્થ હોય તો. કંઈસ્થ સ્તવનની જેમ સતત ધારાએ અસ્થાલિતપણે બોલી શકાય છે; ત્યારે પુસ્તકમાં જોઈને બોલવા જતાં વચ્ચમાં ધારા તૂટવાનો મોટો સંભવ છે. માટે જ સુંદર રૂપમાં રજૂ થયેલી અરિહંત પરમાત્મા પ્રત્યેની અનેક પ્રાર્થના કંઈસ્થ રાખી લેવી જોઈએ અને એનો વારંવાર ગદગાદ દિલે ઉપયોગ કરવો જોઈએ.

અહીં એક મનનીય પ્રાર્થના રજૂ કરવામાં આવે છે

‘હે અરિહત નાથ ! દુનિયામાં ધર્મા તરીકે મેં વર્ષો વીતાવ્યા છતાં આત્માના અનંતા દોષોમાંથી અડધે-ચોથે ભાગે તો શું, પણ કરોડ-અબજમા ભાગે પણ પાછો વળવા મેં કોઈ ઉમળકો-તકેદારી રાખી નથી, કે ઓછા કર્યા નથી, તો શું મારું ધર્મપણું ? ત્યારે આ જીવનની બાજુ સંકેલાતી વખતે નીતરતી શુદ્ધ ભાવનામાં રમવાનું શી રીતે બનશે ? કેમ કે જો જીવનભર દોષોને અકબંધ રાખીશ તો અંતકાળે દોષોના હ્રાસ વિના હદ્યસ્પર્શી શુદ્ધ ભાવનાની તન્મયતા કર્યાંથી બની શકશે ?

‘हे त्रिलोकनाथ ? आ संसार तो मने लोभावी लोभावीने अनेक प्रकारना दौषो अने हुङ्कर्त्योमां रक्त राखे छे; अने अनुं कारण भने तो ए लागे छे के में हज सुधी आपानां निरंजन निराकार, अनंतगुणमय, अनंत-उपकारकारी स्वरूपने में ओणप्यु नथी. ऐनी जो खरेखर ओणाब थई जाय तो तो प्रभु ! आ तुअच्छ, असार, कर्मकराथी भलिन अने आत्मानो अपकारी संसार भने शुं लोभावे ? दौष-हुङ्कर्त्योनी गटरमां हुं केम लोटे ?

‘હે જિનેન્દ્રટેવ મારા નાથ ! હું તે કેવો મૂઠ કે જગત આખાને જોયું, પણ આપના મહામંગળમય સુવિશુદ્ધ-સ્વચ્છ-સ્વરૂપની ઓળખાણ ન કરી ! એ ન કરીને મેં કેવાં કેવાં અકાર્ય કર્યું ! નાથને ઓળખ્યા હોય, મન પર ‘આવા લોકોત્તર નાથને હું માથે ધરનારો !’ એ ભાર ગૌરવ સાથે રાખ્યો હોય તો પછી અકાર્યમાં શાનો રક્ત બનં ?

પરંતુ હે પ્રાણાધાર ! વિકાર છે એવી નિસાર સંસારની લોથને કે જે લોથ મારા જેવા આંધળા જીવો પાસે નાથને ભુલાવી અકાર્યો કરાવે છે ! પછી ભલે એ લોથમાં દેવતાઈ રત્ન-વિમાન હો કે ભવ્ય ખાનપાન-સન્માન હો ! વધુ વિકાર તો મારા જીવને છે કે આપ સરખા નાથને ભૂલી સંસારની લોથમાં ઓતપ્રોત બન્યો ! અને શરમ વિના પાપો સેવાં !

હે ! કૃપાણુદેવ ! મોહની અંધ પરાધીનતામાં સબડતા મારા જીવે આપ જિનેશ્વરદેવની ઓથ ન લીધી, બ્રામક આપમતિ અને દ્રોહી સંયોગોની ઓથ લીધી, તેથી જ અકાર્યોની લોથ ઉચ્કવામાં લાજ કે શરમ રાખી નહિ ! શરમ કોની પડે ? જગતની નહિ, કેમ કે જગત તો અકાર્યમાં ગળાબૂડ ખૂંચેલું છે, તો અકાર્યથી દૂર હટવામાં એવા જગતની શરમ શાની પડે ?

હે કૃપાસાગર ! એથી તો ઉલટું એવું થયું કે શુદ્ધ-સુંદર પરમાત્મ પ્રીતિની સામે બિભાસ કામ અને સ્નેહની શરમ પડવાને લીધે તો પાપથી, અકાર્યથી પાછો ફરવાને બદલે હું એ પાપોમાં રચ્યોપચ્યો રહ્યો અને પરમાત્મપ્રીતિ જમાવી નહિ ! લાખો ફિદ્ગાર એ કામ અને સ્નેહને, તેમ જગતની લોથ ઉપરના મારા પક્ષપાતને કે જેણે મારો અનંતીવાર કચ્ચયરધાણ કાઠવા છતાં હું એનું પડખું છોડી શકતો નથી, હજ્ય છોડતો નથી !

હે મહાવીર પરમાત્મા ! ધન્ય છે આપને કે આપે સંસારની લોથને પારધિની જાળવતું જીવને ફસાવનારી અને પાપોથી વિટાળી દુઃખદ દુર્ગતીની કલેઆમને સોંપનારી દેખી ! તેમ જ જગત જ્યારે મોહની નિદ્રામાં ઘોરતું હતું, જ્ઞાનીને આપના પગલે અનુસરવા તૈયાર નહોતું ત્યારે પણ આપે એકલા પંડે એ લોથને પડતી મૂકી ચારિત્ર લીધું ! ઘોર તપસ્યા અપનાવી ! ભયંકર ઉપસર્ગ-પરિષહ સહર્ષ સહ્યા ! કેવું અદ્ભુત પરાકમ ! કેટલી ઊંચી સતેજ સાત્ત્વિક અને તાત્ત્વિક દાસ્તિ ! જાતે જરાય ન ફસાતા ઉપરથી બીજા અનેકાનેક ભવ્યાત્માઓને પણ ફસાતા બચાવી સંસારથી છોડાવ્યા ! અને મોક્ષ તરફ દોડતા કરી મુક્યા ! શાશ્વત મોક્ષમાં આરૂઢ કર્યા અને સ્વયં આરૂઢ થયા ! ધન્ય મારા વીર ! ધન્ય તારણહાર !

હે નિરંજન નાથ ! હું અશરણ દું, નિરાધાર દું, કર્મવિંભિત અને રાગાદિરોગથી પીડિત દું. આપ જ મારા એક ગ્રાણ છો, શરણ છો, આધાર છો. કર્મ અને રાગાદિ રોગનાં નિવારનાર ધન્યંતરી છો. પ્રાર્થ દું કે આ સંસારની લોથ મૂકાવનારી એવી ઓથ આપજો કે હું નાથમાં જ લીન બની જાઉં !

વહેલી પ્રભાતે ઉઠીને સમજપૂર્વક આ પ્રાર્થના ગદ્ગાદ સ્વરે કરવામાં આવે

તો એ હિલને ભાવોલ્લાસથી ભરી દે એવી છે, અને નવી સુર્તિ નવી પ્રેરણા આપે તેમ છે. આજના ધાંધલિયા અને અનેકાનેક પ્રકારના ખોટા પાપવિકલ્પો કરાવનારા સંયોગો અને પરિસ્થિતિમાં આવી પ્રાર્થના એક જબરદસ્ત આશ્વાસન દેનારી અને શુભ ભાવનાઓ પ્રેરનારી વસ્તુ છે. માટે એનો વારંવાર ઉપયોગ કરવો.

U

દુનિયા પણ કેવી વિચિત્ર છે !

V

ચૌદસની એ પર્વતિથિ હતી. સવારમાં લાંબો વિહાર હતો. તે દિવસે પૂજ્યપાદશ્રીને શારીરિક સ્વરસ્થતા ઓછી હતી તેથી વિહારમાં વચ્ચે બે વાર તો આરામ માટે રોકાઈ જવું પડ્યું હતું. ગામમાં પછોંચતા પહેલાં દેરાસરે જઈ ચૈત્યવંદન કર્યું. મકાને આવ્યા બાદ તુરત ગુરુદેવશ્રી તો કામમાં લાગી ગયા. સેવામાં રહેલા મુનિ ભગવંતે પૂજ્યશ્રીને કહ્યું : “ગુરુદેવ ! નવકારશીની ગોચરી આવી ગઈ છે. પચ્ચક્રખાણ પારો...”

“આજે મારે વાપરવાનું નથી.”

“કેમ ગુરુદેવ ?”

“ચૌદસ છે... ઉપવાસનું પચ્ચક્રખાણ થઈ ગયું છે.”

લાંબો વિહાર, શારીરિક અસ્વરસ્થતા અને વૃદ્ધ શરીર છતાં સત્ત્વ કેવું ! હું તો સ્તબ્ધ થઈ ગયો હતો.

સાંજે વંદન કરીને મેં ગુરુદેવશ્રીને પૂછ્યું : “ગુરુદેવ ! ઉપવાસની શાતા છે ને ?”

“અરે, મારે આજે ઉપવાસ છે, કેમ ? કાઈ ખબર જ પડી નહીં, કેવો સરસ થઈ ગયો ! પછી મારી સામું સસ્મિત વદને જોતા જ રહાં. થોડી વાર રહીને બોલ્યાં. “દુનિયા પણ કેવી વિચિત્ર છે ! વિભાવદશામાં ચાલ્યા જઈએ ત્યારે કોઈ કુશળતાના સમાચાર પૂછવા આવતું નથી, સ્વભાવ દશામાં આવ્યા એટલે શાતા પૂછવા દોડી આવે... ચિંતા તો વિભાવદશામાં કરવી જોઈએ કે-ખાવાનો સ્વભાવ નથી છતાં તમારે દિવસમાં બે-વાર, ત્રણ વાર ખાવું પડે છે... આત્મિક રીતે કેટલી બધી અકુશળતા હશે...”

ગુરુદેવે તપ જ કર્યો નહોતો... તપથી ભાવિત થઈ ગયા હતા.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાજું

૧૦૬ પર્યુષણા પર્વમાં વ્યાપ્ત એક સૂત્ર-‘ઉપશમ’

પર્યુષણાનું પર્વ આરાધક આત્માઓ માટે એક મહાન લહાવો છે. કેમ કે આરાધનાનો જે જોસ આ પર્વમાં આવે છે, એવો વર્ષના બીજા પર્વમાં પ્રાય: નથી દેખાતો. જોઈએ છીએ ને કે આસો ચૈત્રની ઓળી શાશ્વતી છે; વળી એમાં અનંત પ્રભાવશાળી નવપદમય શ્રી સિદ્ધયક્ષજીની અનુપમ આરાધના કરવાની; તે પણ આયંબિલના તપથી ! છતાં સકલ સંધમાં આરાધનાનો જે જોસ, જે ઉલ્લાસ પર્યુષણા પર્વમાં દેખાય છે, એ એમાં નથી દેખાતો માટે તો પર્યુષણા પર્વને મહાપર્વ કહે છે. ત્યારે વિચાર આવે છે કે અહીં આરાધનાના મહાજોસનું શું કારણ છે, શું રહસ્ય છે ? રહસ્ય એવું શોધી કાઢવું જોઈએ કે જે પર્યુષણા પર્વની આરાધનાના બધા પ્રકારોમાં વણાયેલું હોય; જેના પર મન કેન્દ્રિત કરીએ તો સહેજે લાગે કે ખરેખર આ રહસ્ય અજોડ છે. જૈન શાસનની જડ છે, ગુણસ્થાનકોમાં સંગ્રહ સૂત્ર છે, અને એનાથી જગમગતું આ પર્વ મહાપર્વ હોય, તેમ જ આરાધનામાં જોસ લાવી એ રહસ્ય પમાડે, એ યથાર્થ જ છે.

તો એ રહસ્ય શું છે ? ચાર અક્ષરમાં સમાઈ જાય એવું એ ભવ્ય રહસ્ય ઉપશમ છે.

ઉપશમ જૈનશાસનની જડ છે; કેમ કે જૈનશાસન ધર્મને ‘ઉચ્ચસમપભવ’ કહે છે. ધર્મ એ ઉપશમમાંથી ઉત્પન્ન થનારો છે. જેટલા પ્રમાણમાં કષાયોનો ઉપશમ થાય એટલા પ્રમાણમાં આંતરિક ધર્મ આવે. દાનાદિ ધર્મમાં જુઓ કે પોતાની લક્ષ્મી વગેરે વસ્તુ પરનું મમત્વ ઘટે લોભનો ઉપશમ થાય, એટલા પ્રમાણમાં દાન થાય છે. એમ વિષયોની આસક્તિ જેટલી શરે એટલા પ્રમાણમાં શીલ આવે છે. એમ, આહારની વ્યાકૃતતા જેટલી દબાવાય, ઉપશમાવાય, તેટલો તપ કરાય છે. એમ અશુભ ભાવના, ભાવોનો ઉપશમ કરવામાં આવે તેટલી શુભ ભાવનાઓને અવકાશ મળે છે, ભગવાનનાં દર્શન પૂજન કરવા જાઓ ત્યાં પણ એ દર્શન-પૂજન વીતરાગ પ્રભુના કરવાના છે. શા માટે ? વીતરાગ બનવા માટે. એટલે ત્યાં પણ પ્રભુ જેવા વીતરાગ થવાની તીવ્ર અભિલાષાનું પોષણ કરવાનું છે, અને અનુકૂળ શુભ ભાવનો પથ પકડવાનો છે; અને તે ઉપશમના માર્ગ જ ચાલવારૂપ હોય !

ઉપશમ એટલે શું ? એ જ કે જેટલા અપ્રશસ્ત ભાવો છે, ખરાબ ભાવો

છે અનું શમન કરવાનું. એ ભાવોને બંધ કરી દેવાના; અને એની જગાએ પ્રશસ્ત ભાવોને જગાવવાના. દા.ત. કોથ એ ખરાબ ભાવ છે; તો એને આત્માનો વિકાર ગણીને એનો નિગ્રહ કરી ક્ષમાનો ભાવ લાવવાનો. ક્ષમા એ આત્માનું સૌનંદર્ય છે, આરોગ્ય છે, સંસ્કરણ છે, આત્મપુષ્ટિકારક પથ આહાર છે. સત્ત્વવર્ધક વસાણું છે તક મળી તો શા માટે ક્ષમા ન વધારવી ?

કોઈના પર દ્વેષ એ અપ્રશસ્ત ભાવ છે. એને દબાવવાનો અને એની જગાએ સામો જો ભૂલ કરે છે યા તેવો કર્મપીડિત છે તો એની પર ભાવદ્યાનો ભાવ લાવી વિચારવાનું કે ‘એને બિચારાને સદ્બુદ્ધ મળો, પાપથી-દુષ્ટતથી એ છૂટો; તેવાં કર્મથી એ મુક્ત થાઓ.’ ત્યારે જો એની ભૂલ નથી એ ગુણિયલ છે તો એના ગુણની પ્રમોદ ભાવના પ્રગટ કરવાની.

એમ માયાવૃત્તિને ભવોભવના ચીકણાં ગુંચળાં સમજને દબાવી; નિખાલસ પ્રમાણિક નિર્મળ કોટિના વિચાર કેળવવા એ એનો ઉપશમ કહેવાય.

એવું જ લોભ-તૃષ્ણા-મમતા-આસક્તિ-રાગના ભાવ અશુભ છે. એને દબાવી સંવેગ-વૈરાગ્યના ભાવ જગમગાવવા પડે.

વૈરાગ્ય : મનને એમ થાય કે ‘જડ વસ્તુના શા બહુ લોભ કરવા’તા ? એ મળવાનું લોભથી નહિ, પણ પુણ્યથી જ છે, પુણ્ય ટંકું હશે અને લોભ લાંબો કર્યો તો માર પડશે ! વળી જડ લક્ષ્મી વિષયો વગેરે પદાર્થો તો આત્માને જડ જેવો કરનારા છે, શુદ્ધ ચૈતન્યને ગુંગળાવી નાખનારા છે, ધર્મભાવનાનું ગળું ટૂંપનારા છે. એની શી તૃષ્ણા રાખવી ? શી મમતા કરવી ? આ વૈરાગ્યની ભાવના છે.

સંવેગ :- એમ સંસારમાં ભલે ને મોટી કરોડોની સંપત્તિ અને સલ્તનતની ઠકુરાઈ હોય છતાં જ્યાં સરવાળે મૃત્યુ વખતે શૂન્ય છે, મીઠુ છે, તો એ બધું અસાર જ છે. સારભૂત એક માત્ર ધર્મ છે. અહો ! કેવી સુંદર ધર્મબુદ્ધ આપનારો ! એ કેવા મજેનાં સદ્વર્તન કરાવનારો ! ધર્મ હદ્યમાં ઓતપ્રોત થઈ જાય તો એ હૈયાને જેટલી અદ્ભુત શાંતિ, સ્વસ્થતા અને નિર્દોષ આનંદ આપે છે ! પરમ તૃપ્તિ, નિસ્પૃહતાની મસ્તી, અને સાધ્ય-ભાવ આપી ધર્મ અહીં પણ સ્વર્ગથી અધિક સુખ દેખાડે છે. એવા ધર્મની સાધના કરતાં કરતાં અંતે મોક્ષ મળે, ત્યાં તો વળી કોઈ જ પદી કર્મની વિટંબણા-ગ્રાસ-પરાધીનતા જ નહિ ! કાયાની કેદ નહિ ! ઈન્દ્રિયોની ખણજ નહિ ! એક ભવમાંથી બીજા ભવમાં, એક પુદ્ગળ પરથી બીજા પુદ્ગળ પર, એક રાગાદિ ભાવમાંથી બીજા દેખાદિ ભાવમાં, એક યશ-શાતાદિની સ્થિતિમાંથી બીજી અપયશ-અશાતાદિની સ્થિતિમાં ફેંકાડેક થવાની વાત નહિ ! વિશુદ્ધ અનંત જ્ઞાન-દર્શન અને અનંત સુખમાં ઝીલવાનું ! તે ય

શાશ્વત કાળ માટે. કેવો સરસ મોક્ષ !"- આ ભાવના એ સંવેગની ભાવના કહેવાય.

એમ ઉદારતાની, પરોપકારની, સેવાની ભાવના કેળવવાની. 'ખાઈને નહિ પણ ખવરાવીને, લઈને નહિ પણ આપીને, મારું કરાવીને નહિ પણ બીજાનું હું કરીને રાજ થાઉં' એ ભાવના કેળવવી જોઈએ. પછી લોભની, સ્વાર્થની મમતાની લાગણી ઓછી થતી આવે. એ ખરાબ ભાવ દબાવ્યો કહેવાય.

એમ અભિમાન, મદ, અહંકાર, રીસ વગેરેના ભાવ એ ખરાબ ભાવો છે. એને દબાવવા એ વિચારવું કે આ તો મૂર્ખના જેલ છે; કેમ કે જ્યાં અનંતા કર્મના ભાર છે, કર્મની ગુલામી છે, રાગાદિ અનંત દોષો છાતી પર ચઢી બેઠા છે, સધણું સલેપાટ કરનાર મૃત્યુની તલવાર માથે ઝરુમે છે, ત્યાં ગર્વ શા ને ગુમાન શા ? વળી ક્યા એવા મોટા સુકૃત પરોપકાર કર્યા છે કે ક્યા એવા મોટા ગુણો સિદ્ધ કર્યા છે તે અભિમાન કરું છું ? મહાપુરુષો પાસે જે સંપત્તિ, સત્તા, અગાધ જ્ઞાન, ત્યાગ, તપસ્યા વગેરે હતા છતાં ગુમાન નહિ, તો હું શું જોઈને અહંકારમાં તણાઉં છું ?... આમ વિચારી એને દબાવવાનો, નમ્રતા, મૂદુતા, લઘુતાના ભાવ કેળવવાના.

આવા હાસ્ય-મશકરીના ભાવ જીવનને તુચ્છ બનાવનારા, ને જીવને નાદાન ઠેરવનારા સમજી મક્કમ મને દબાવી જ દેવાના. એની સામે ગંભીરતા, કર્મસ્વરૂપ વિચારકતા, ઉદાસીનતા વગેરે ભાવ કેળવવાના.

આ કુ-ભાવોને દબાવવા એ ઉપશમ કહેવાય. એ જૈનશાસનની જડ છે. જૈનશાસનના વિવિધ ધર્મપ્રકારો એમાંથી ઉઠે છે. ધર્મસાધનાઓમાં અશુભ ભાવોનો ઉપશમ કરવાનું આવે છે.

એમ કષાયોનો ઉપશમ વધવા ઉપર ગુણસ્થાનકની ઉપર ઉપરની પાયરીએ ચઢાય છે. મિથ્યાત્વને દબાવો અનંતાનુંધી કષાયોનો નિગ્રહ કરો એટલે ચોથે ગુણસ્થાનકે ચઢાય, અપ્રત્યાખ્યાનીય (પચ્યકખાણ ન આવવા દેનારા) કષાયોને દબાવો એટલે પાંચમું એમ ઠેઠ વીતરાગના બારમે ગુણાણો જવા આ મુખ્ય કાર્ય કષાયો વગેરે ખરાબ ભાવોનો નાશ કરવાનું રહે છે.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૪૩, તા. ૧૦-૮-૧૯૬૩

૧૦૭

શિક્ષણ-શિખામણ કેમ અપાય ?

(લેખાંક-૧)

માણસનું મન કાંઈ ખાલી ઘડા જેવું, અને શિક્ષણ, શિખામણ કે સમજણ કાંઈ પાણી જેવાં નથી, કે એ શિક્ષણાદિને આપણે સામાના મનમાં રેણીએ એટલે એ મન એનાથી ભરાઈ જાય ! મનમા એ સંગ્રહીત થઈ જાય ! કારણ એ છે કે એ ગ્રણેય વિષયો સામાને માત્ર એમ જ આપી દેવાય એવા નથી, પણ સામાને એ લેવા હોય તો જ અપાય એવા છે. એટલે તો મહાન વ્યાખ્યાનશક્તિવાળા પણ જોરદાર વ્યાખ્યાન આપે છતાં જેને લેવાની વૃત્તિ નથી અને એમ જ મજા માટે સાંભળવા આવ્યા છે એવા શ્રોતાના મનમાં એ વ્યાખ્યાન રેડાતું નથી, મન એને સંઘરણું નથી. આવું જ લેવાની જરીકે વૃત્તિવિનાના છોકરાને અપાતી માતાપિતાની શિખામણ કે શિક્ષકનાં શિક્ષણ સંબંધમાં બને છે.

આમ છતાં આપણાને સામાના લેવા કરતાં આપણાનું વધારે ગમે છે; અને એથી એ લેવા તૈયાર હો કે ન હો, પણ આપણો આપણે આપ્યે જઈએ છીએ ! પછી સામો શીખતો-સમજતો નથી તેથી આપણા દિલને ખેદ થાય છે, આપણે કકળીય ઉઠીએ છીએ. મનને એમ થાય છે કે 'હું આટાટલું શીખવું-સમજવું છતાં એ કેમ શીખે નહિ સમજે નહિ ?'

પરંતુ વિચારવા જેવું છે કે આમાં આપણાને સામાની દયા આવે છે કે આપણાને અભિમાન છે ? 'મારું કહેવું ન માને ? આમાં 'મારું' પર ભાર રહે છે એ આપણાનું અહંત્વ છે. જો આપણા હૈયે સામા પર નકરી દયા જ નીતરતી હોય, તો તો એમાં વિચારાય કે બિચારો જવ ! કર્મથી કેવો પીડાય છે કે એના હિતનું એના મગજમાં નથી ઉત્તરતું ! અથવા જરા જેવા તો હે કે મેં સીધુ આપવાનો જ ધંધો કર્યો ? કે એને લેવાની વૃત્તિ થાય અને એ લે, એ ભૂમિકા પહેલી ઊભી કરી ?'

સામો લેવાની વૃત્તિ વિના જ આવ્યો હોય છતાં એમ બને કે આપણી સૌભ્યતા અને પ્રેમભરી મુદ્રા તથા એવા શબ્દો,-અને તે પણ પહેલાં તો એનામાં ઉત્સાહ, આકર્ષણ ઊભાં કરે એવા શબ્દો,-એનામાં લેવાની વૃત્તિ ખડી કરી શકે છે. એને એ મુદ્રા જોઈ તથા એ શબ્દો સાંભળી એમ થાય કે 'લાવ લાવ, આગળ સાંભળવા હે, આ મારા લાભનું દેખાય છે.'

૨૩૦

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

શિક્ષણક્ષેત્ર, શિખામણક્ષેત્ર અને ઉપદેશક્ષેત્રમાં આ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આપણે આપીએ અના કરતાં સામો લે, લેવાને આતુર રહે, એવું કરવું પહેલું જરૂરી છે; કેમ કે સામાન્ય રીતે એ શું કે બીજી, દરેકને પોતાને પોતાનો રસ હોય છે. અને આપણા વિષયની જિજાસા જગાવીને અપાય તો જ એ ગ્રહણ કરે, અથવા અને વ્યાજભી ગણેલું એવું ધારું મનમાં વસી ગયું હોય છે. અમાં અને કાંઈ અનુચ્ચિત લાગે, અને અનાથી અને પ્રતિપક્ષ વાત માટે રસ જાગે તો ત્યાં અને એ અપાતાં એ અંદરનું અનિચ્છનીય કાઢી નાખીને અપાયેલું ગ્રહણ કરશે. અંદરનું ફેંકી દેવા જેવું લાગે તો જ બહારથી મળતું મૂલ્યવાન અને ગ્રાવ્ય લાગશે. માટે તો સાંકું આપતાં પહેલાં એના દિલમાં રહેલું કેવું નરસું છે, નુકસાનકારી છે અને તેથી ત્યાજ્ય છે એ અને પહેલું સમજાવવું પડે છે; પછી જ સારું અપાય છે.

કેટલીક વાર એમ પણ બને છે કે શિક્ષણ શિખામણ અને સારી લાગતી ય હોય છતાં ‘અમુક જણ એ કહે છે ને?’ માટે જ અને ગ્રહણ નહિ કરે, ગ્રહણ કરવા તરફ બેદરકારી રાખશે. આનું કારણ એ સંભવિત છે કે (૧) બોલનારની તોછી કે એવી ભાષા યા કથનપ્રકૃતિ હોઈ એ સાંભળવામાં સામાને પોતાનું વ્યક્તિત્વ હણાતું લાગે છે; અથવા (૨) વર્તમાનમાં અને એનો રસ નથી ને સંભળાવવામાં આવે છે. આ સૂચવે છે કે શિક્ષણ-શિખામણ-સમજણ આપનારે (૧) સામાનું વ્યક્તિત્વને તોડી પાડવાનું નહિ પણ ગૌરવ આપવાનું, અને (૨) એની ભૂખ, એનો રસ ઓળખીને કહેવાનું જેથી એ અભિમુખ બન્યો રહે, ગ્રાહક જરૂર બને. અલબજ્ઞ આવડત હોય તો શ્રોતાના દિલમાં રસ ન હોય તે પણ પેદા કરી દે. પછી અને અનુરૂપ કહેવામાં વાંધો નહિ.

આ બને સાવચેતી રાખ્યા વિના જો શિક્ષણાદિ આપવાનું થાય તો તે ઊંધા કે ઢાંકાયા ઘડા પર વરસાદ વરસાવવા જેવું થાય. અન્માં એ કાંઈ પામે નહિ; આપણી મહેનત વર્થ જાય. કદાચ ઊલટું એમ પણ બને કે સામાનું મન વધારે કલુષિત કરવાનું થાય. સામાને લેતો કરવાને બદલે આપણે આપતા રહેવાનું કરવાથી આ અનિષ્ટો ઊભાં થાય છે, એટલા માટે શિક્ષણ, શિખામણ કે સમજણ આપતાં પહેલાં સામાને લેવાનું હદ્ય બનાવવું જોઈએ.

એ માટે,

- (૧) આપણું હદ્ય અને મુખમુદ્રા સૌભ્ય અને પ્રેમભરી રાખવી;
- (૨) આપણે શબ્દ સૌભ્ય, ઉત્સાહપ્રેરક અને મધુર બોલવા;
- (૩) સામાનું વ્યક્તિત્વ-સ્વમાન ન હણાય એ જોવું;
- (૪) સામામાં રસ, જિજાસા-અભિમુખતા પેદા કરવી.

આમાં પહેલી માન્યતા જાળવવા માટે આપણો આપણા આત્માનાં હિતનો ખાસ વિચાર રાખવો, તે એ કે જો સામાના વાંકે પણ આપણે હૈયું ઉકળાટ-આવેશ-દેખવાણું કરશું તો આપણને કર્મબંધ થશે અને કષાયના સંસ્કાર દેઠ થશે. ઉપકાર કરવા જઈએ અને પહેલી આપણી જ ખરાબી કરીએ એ કેવું? માટે આપણું મન લેશ પણ ન બગડવા દેવું આ નિર્ધાર.

શબ્દ સૌભ્ય અને મધુર બોલવાથી પણ પહેલો તો આપણા જ દિલમાં ઉલ્લાસ રહે છે, તથા સામા પર એની સારી અસર પડે છે, અને પ્રોત્સાહન થાય છે. કઠોર કડવા તીખા શબ્દ સ્વ-પર બંનેને ખોટા ઉશ્કેરે છે. આપણે કહેવા જઈએ સારી ભાવનાથી; ત્યારે બને ઊલટું એવું કે શબ્દ એવાને લીધે સામાના દિલમાં આપણા માટે વિરોધ જાગૃત થાય. માટે શબ્દ સૌભ્ય અને મધુર વાપરવા.

સામાનું વ્યક્તિત્વ-સ્વમાન ન હણાય એ ખ્યાલ રાખવા માટે સામામાં જે કોઈ સારી વિશેષતા દેખાય તેની કદર કરવી, અનું ગૌરવ ગાવું અને પછી જે ત્રુટિ માટે કહેવું તે એમ કહીને કે જો આટલી પૂર્તિ થઈ જાય તો કેવો મહાન લાભ થાય!... વગેરે.

રસ જગાડવા માટે સામાને જે રસ હોવાનું દેખાતું હોય તેની સાથે આપણે કહેવાની વસ્તુની કરી જોડી બતાવવી જેથી અને લાગે કે આપણા લાભની વાત લાગે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૂત”

વર્ષ-૧૧, અંક-૪૬, તા. ૨૪-૮-૧૯૬૩

૧૦૮ (લેખાંક-૨)

(૧) દરેક શિક્ષક, ઉપદેશક તથા શિખામણ આપનારે આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે આમે ય સામાન્ય રીતે વાતચીત કરનારો પણ જો ઉકળી ઉઠીને વાત કરે, અગર વાત કરતાં સામા પ્રત્યે દ્વેષ દેખાડે, તો એ ગમતો નથી; તો પછી આપણે તો બીજાને કાંઈક આપવું છે, તો ઉકળીએ, દ્વેષ બતાવીએ, મુખમુદ્રા બગાડીએ, તો સામાને આદરણીય ક્યાંથી બનવાના? એ નહીં તો આપણું કહેવું ક્યાંથી જીલવાનું? નહિ જ એટલા માટે સૌભ્ય મુખાકૃતિ અને સૌભ્યતા-ભરેલા શબ્દ એ પહેલા જરૂરી છે. એ જાળવનાર શિક્ષક-ઉપદેશક-વડીલ સારા સફળ થાય છે.

પ્ર.-એમ તો વિદ્યાર્થી ડાંડ કે ઉદ્ધત હોય એ બને, ત્યાં સૌભ્યતા શ્રદ્ધા?

૩.-એટલા જ માટે આ સૌભ્યતાનો એ અર્થ નથી કે આપણે નિસ્તેજ માયકંગલા જેવા બનવાનું; આપણું ઓજસ તો દેખાડવું જ જોઈએ, જેથી ડાંડ તો ડરતા જ રહે. અવસર પર એ ઓજસનો એને કોક વાર પડધો બતાવવો ય પડે. પરંતુ એનો એ અર્થ નથી કે હરવખત તપીતપીને બોલવું. એમ બોલતાં તો સારા વિદ્યાર્થીને પણ આપણા પર આકર્ષણ નહિ ઊભું થાય; તેથી આપણે એને ધાર્યું નહિ આપી શકીએ. આપણા તરફ આકર્ષણ, સદ્ગ્રાવ, આસ્થા તો પહેલાં નંબરમાં ટકાવી રાખવાના છે. એ હશે તો સામાને સારું આપી શકીશું, એ લેવા એનું દિલ તૈયાર હશે. માટે જ સૌભ્યતાને હદ્ય, મુદ્રા એને વાળીમાં બરાબર જગ્ઘવવી-ઉલસતી રાખવી જરૂરી છે.

આ માટે આપણા દિલમાં સામા પ્રત્યે ભાવદ્યાનો જ ઝરો વહેતો રાખવાનો. એ બિચારો કર્મપાદિત છે. ભૂલભાલ કરે તો તેવા કર્મ પ્રેર્યા કરે છે એના એ કર્મ હઠી, એને સદ્ગ્રાવ મળો, સદ્ગ્રાવ મળો;- આ જ એક કરુણાભાવના જગ્ઘળતી રહે. જેથી દ્વેષ-ઉકળાટ-અસૂયા જરા ય ન ઉઠે.

(૨) સામાના વ્યક્તિત્વ-સ્વમાન પર પણ ધા ન પડે એ ય ધ્યાન રાખવાનું છે; કેમ કે એમ થવાથી એના હૈયે આધાત લાગે છે, ને એમાંથી એક અવ્યક્ત વિરોધ ઊભો થાય છે. વિરોધ આપણું કહેલું ગ્રહણ કરવા આડે દિવાલનું કામ કરે છે. એ જેવા મળે છે કે પિતાએ પુત્રને વારંવાર ઉતારી પાડી એનું વ્યક્તિત્વ હજી નાખ્યું હોય એને માતાએ સમજાવી ઉત્સાહ પ્રેરી કામ લીધું હોય તો પુત્રના દિલમાં પિતા પ્રત્યે વિરોધ અને માતા પ્રત્યે સદ્ગ્રાવ રહે છે. હવે જો અવસરે પિતા કાંક શિખામણ આપણે તો પુત્ર એને નહિ વધાવે; પણ માતા જો કહેશે તો તો એ જટ વધાવી લેશે.

માટે આ ધ્યાન રાખવાનું છે કે સામાનું વ્યક્તિત્વ હણાય એવી રીતે એને ઉતારી પાડવો નહિ. ખાસ કરીને બીજાઓની સમક્ષમાં એનું હલકું બોલ બોલ કરવાનું નહિ જ થવું જોઈએ. એની ભૂલ એકાંતમાં કહેવી; તે પણ એવી રીતે કે પહેલાં એની ચોક્કસ વિશેષતાઓનું ગૌરવ કરીને પછી પ્રેમભાવે એક સાચા સલાહકાર તરીકે સલાહ રૂપે એને કહેવું.

વિલાયતમાં એક માણસને એના છોકરાની ખાનગીમાં સીગારેટ પીવાની આદત છોડાવવી હતી. કેટલાક દિવસ એ કાંઈ જ એ માટે બોલ્યો નહિ અને પ્રેમાન વ્યવહાર બરાબર જગ્ઘવ્યો. પછી અવસર પામીને એક વાર એ છોકરાને કહે છે કે ‘મેં સાંભળ્યું છે કે તું બહુ સારો સ્પોર્ટ્સમેન (રમતનો ખેલાડી) છે. મને આનંદ થયો એ માટે તારે જે કાંઈ સારાં સાધન જોઈએ એ ખુશીથી વસાવી લેજે.

હું ઈચ્છું હું કે તું દુનિયામાં પ્રસિદ્ધ સ્પોર્ટ્સમેન થા. એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજે કે શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન થવા માટે છાતી મજબૂત જોઈએ, અને ડોક્ટરો કહે છે કે સીગારેટ-ચીરુટ વગેરે એ હાર્ટ-ફેફસા છાતીનું જોર હડી નાખે છે, માટે એમાં કદ્દી ફસતો નહિ.’-પિતાએ પુત્રના વ્યક્તિત્વને સાચવીને સૌભ્ય શર્ધોમાં કહેલી આ શિખામણ પર ત્યાં ને ત્યાં પુત્રે નિર્ધાર જાહેર કર્યો કે ‘હું સીગારેટ વગેરેને બીલકુલ અડીશ નહિ,’ અને જીવનભર એ પ્રમાણે વર્ત્યો.

શિક્ષકોને વર્ગમાં વિદ્યાર્થીઓને કહેવાનો પ્રસંગ આવે છે. ત્યાં એને ઉતારી ન પાડતાં કરેલી ભૂલના કેવા દીર્ઘ અનર્થ ઊભા થાય છે એ સમજાવ્યું હોય અને વિદ્યાર્થીની સાથે હમદર્દી બતાવી એના ભાવિ ઉચ્ચ જીવન, ઉચ્ચ કારકિર્દી જોવાની ભારે લાગણીપૂર્વક આશા દેખાડી હોય તો એના પર સુંદર અસર થાય છે.

(૩) ઉપદેશક પણ શ્રોતાઓને વારે વારે માર્મિક કટાક્ષ, હલકા વિશેષણ, અને એમની એકલી બદભોઈ-આટકણી કરી ઉતારી પાડવાને બદલે એ આટલે ઉંચે આવવા કેવા ભાગ્યશાળી બન્યા છે, અને હવે એમાં અમુક તત્ત્વો ભષ્યા વિના મળેલી ઉચ્ચતા કેવી જોખમાઈ જાય છે, તો એ ખૂટતા તત્ત્વોની કેવી રીતે પૂર્તિ કરવી જોઈએ, એ કરવું કેવું સહેલું છે, અને છતાં ભારે ઉન્તિદાયી છે, ઈત્યાદિ ઉત્સાહપ્રેરક સમજાવ્યું હોય તો શ્રોતાનો સદ્ગ્રાવ, રુચિ, ધગશ તથા પુરુષાર્થ વધશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૧, અંક-૪૭/૪૮, તા. ૩૧-૮-૧૯૬૩

૧૦૮ (લેખાંક-૩)

(૪) ચોથી વાત, આપણે શિખામણ કે શિક્ષણ આપી દેવું છે એમ નહિ, પણ સામાને લેવું છે- માટે આપીએ છીએ એ સ્થિતિ ઊભી કરવા સામાનું ઉર્મિ, રસ, આતુરતા જગાડવી જોઈએ. રસ જાગ્યો હશે તો એ સન્મુખ-અભિમુખ થશે, નહિતર પરાડમુખ રહેશે અને આપણું કહેલું બહેરા કાન પર અથડાવા જેવું થશે. માટે વિદ્યાર્થીને સૂત્રની ગાથામાત્ર પણ આપવી હોય તો ય એનામાં રસ પહેલો ઊભો કરવો જોઈએ. આ માટે કેટલાક ઉપાય છે, દા.ત.

(૧) (i) વિદ્યાર્થીને પહેલાં કોઈ કથા કે કથાનો ટૂચ્કો યા કોઈ પ્રસંગ કહેવો, અને એમાં ખાસ કરીને વચ્ચમાં ય સરવાળે એને સહજભાવે એવું બતાવવું કુ આ ઝૂતરાનું જીવન નથી પણ આ માનવ-જીવન છે. એમાં વડાઈ જ્ઞાનથી છે. એના સુસંકારની મૂડી એ પરલોક અજવાળે છે. માટે જ્ઞાન ખૂબ પ્રાપ્ત કરો.

(ii) અથવા એ બતાવવું કે 'જ્ઞાનસમો કોઈ ધન નહિ' દુનિયામાં પૈસા ટકા વગેરે ગમે તેટલું ધન મેળવો પણ તેથી કાંઈ ભવના ફેરા નહિ ટળે, પાપ નહિ અટકે. ગમે તેટલું એ ધન ગણો કે જીતમાં વાપરો, પુણ્ય ન મળે, ત્યારે જ્ઞાનથી પુણ્ય મળે છે, ભવના ફેરા ટળે છે.

(iii) અથવા એ બતાવવું કે જીવને મિથ્યાત્વ, કષાય વગેરે કેટકેટલી જગાએથી પ્રતિસમય કર્મના તીર ભોંકાય છે. જ્ઞાનધ્યાનમાં રહીએ તો મહાન બચાવ મળે છે.

(iv) અથવા બતાવવું કે આપણે મહાવીર પ્રભુના સંતાન છીએ. આપણને આ અનુપમ મનુષ્યભવ-ઈન્ડ્રિયો-મન-બુદ્ધિશક્તિ અને બીજી પુણ્યાઈ, તથા તત્ત્વ અને મોક્ષમાર્ગનો ઉપદેશ મળવામાં એમનો આપણા પર અનહંદ ઉપકાર છે; માટે આપણે એમની સાથે સંબંધ રાખવો જોઈએ, એ સંબંધ એમનું જ્ઞાન રટવાથી થાય.

(v) અથવા બતાવી શકાય કે અહીં આપણને પશુને કે દેવને પણ ન મળે એવો અને મનુષ્યોમાં પણ બહુ થોડાને મળે એવો મહાદુર્લભ પુરુષાર્થકાળ મળ્યો છે. એનો ઉપયોગ આપણા આત્માના ઉદ્ઘારક અને પવિત્ર જ્ઞાનધ્યાન તથા ધર્મસાધનામાં નહિ કરીએ અને જ્ઞાનાવર કે કીડામંકોડા પણ જે ખાનપાન રંગરાગમાં કરે એમાં જ કરતા રહીશું તો એક તો આપણા ઉચ્ચ બુદ્ધિ શક્તિવાળા મનુષ્યભવને કલંક લાગશે અને બીજું આ મૌંધેરા પુરુષાર્થકાળની મહામૂર્તી બરબાદ જશે ! માટે એનો જ્ઞાનધ્યાનાદિમાં સદ્ગુરૂપ્યોગ અવશ્ય કરવો જોઈએ.

(vi) જગતમાં તે તે સંસ્થાનાં શિક્ષણ માણસો લે છે. તો આપણી ધર્મસંસ્થાનાં શિક્ષણ આપણો લેવું જ જોઈએ, જો આપણને આ સંસ્થા પામ્યાનું ગૌરવ હોય. એનાથી બુદ્ધિ સ્વચ્છ બને છે, તેથી જીવન ઉમદા બને છે અને ઘણા પાપવિચારો વગેરેથી બચી જવાય છે.

આવી આવી પ્રેરણામાંથી ગમે તે પ્રેરણા આપી વિદ્યાર્થીમાં રસ જગાડી શકાય.

(2) એમ, વિદ્યાર્થીઓને સમૂહજ્ઞાન (Chorus) તરીકે પહેલાં જુદા જુદા રાગમાં નવકાર મંત્ર, ચત્તારિ મંગલ, કોઈ સ્તવન-સજ્જાય ગવરાવવાથી પણ એમનામાં સ્ફુર્તિ આવે છે. એ રીતે રસ જાગ્રત કરી શકાય.

(3) અથવા વિદ્યાર્થીઓમાં અરસપરસ પ્રશ્નોત્તરી કરાવવાથી પણ સ્ફુર્તિ આવે છે.

(4) એમ, કોઈ યોજના મૂકવાથી,-દા.ત. આ સપ્તાહમાં કે આજે યા ૨-૩ દિવસમાં આટલી ગાથા કરી આપણે, અથવા ભણાવેલું યાદ રાખી લેશે તેની

પરીક્ષા લઈ ગુણાંક (માર્ક્સ) આપવામાં આવશે અને એના પર ઈનામો અપાશે; આવી યોજનામાંથી પણ રસ પેદા થાય છે. અહીં કદાચ એમ પ્રશ્ન થાય કે 'એમ લાલયથી ભણેલાનો શો અર્થ ? પણ એનો ઉત્તર એ છે કે એક વાર એને રસ જગાડી ભણવામાં પ્રવૃત્તિ કરવા દો, પછી આપણી ફૂનેહથી વચ્ચમાં કોઈ કથા કે સજ્જાયાદિ દ્વારા એવો વૈરાગ્યરસ પોષીએ કે એને તુચ્છ લાલય પર ધૂણા થશે. પરંતુ પહેલાં તો ભણવામાં જોડીએ પછી જ આ સંભવિત ને ? એ આધો ને આધો હશે તો એને શું કહી શકશે ?

(પ) રસ જગાડવા વિદ્યાર્થીઓને કોઈ સમૂહ-સ્નાત્ર, સંગીત, નજીકના તીર્થની યાત્રા, કે નાસ્તારૂપ નાના સાધાર્મિકવાત્સલ્ય વગેરેના કાર્યક્રમમાં જોડવાની પણ આવશ્યકતા છે.

શિક્ષણ માટેના રસની જેમ પુત્રાદિને શિખામણ સાંભળવાનો રસ રહે એ માટે વિશેષ કરીને એ પણ જરૂરનું છે કે એની બીજી ચિંતાઓમાં આપણે રસ રાખીએ, એની જરૂરિયાતો સંભાળી લઈએ; એના રોગ આદિમાં સારી સરભરા કરીએ. એને એમ સચોટ બેસી જાય કે આ મારા પિતા કે ગુરુ પોતાની કાળજી કરતાં મારી કાળજી વિશેષ રાખે છે; મારા પર અથાગ વાત્સલ્ય ધરાવે છે.

ઉપદેશ કે ઉપદેશમાં શ્રોતાને રસ જાગે અને ટક્કો રહે એ માટે પહેલાં પોતાનું જીવન ત્યાગ અને નિસ્વાર્થભાવનાથી ઝગમગતું રાખવાની જરૂર છે. વળી પ્રતિપાદનો દંધાંત, ઉપમા, તર્કભર્યા જોઈએ તે ય શ્રોતાની કક્ષાને યોગ્ય જોઈએ. તેમ આદ્ય વક્તા પરમાત્મા પર ભરપૂર ભક્તિ રાગ જમાવવો જોઈએ. કહેવાતું પાપત્યાગ અને ધર્મસાધના તથા ગુણોપાર્જનનું કહેવાનું છે, માટે શ્રોતાને પરલોક દણ્ણ જવલંત બનાવી આપવી જોઈએ. એમાં એને ભવભ્રમણાનો ભારે ભય અને આત્મ કયરામણાનો ભારે બેદ જાગે, તથા કર્મ તેમ જ રાગદ્વેષ તૃષ્ણા-અહંકારાદિ આંતર શર્નુઓ પ્રત્યે નફરતની પગથી માથા સુધી જાળ લાગે એવું કરવું જોઈએ...વગેરે.

શિક્ષણ-શિખામણ-ઉપદેશ સામો ઈચ્છે અને આપણે આપીએ એવું કરવા ઉપરોક્ત ચાર મુદ્રા બરાબર સાચવવાની જરૂર છે.

અસ્વસ્થતાના વિચારના અનર્થ અને પ્રતિકાર

૧૧૦ આત્માનો ખોરાક અને ઔષધ

આજે એવો કાળ આવી ગયો છે કે ઘણા માણસોને પોતાની ભૂલો, કુટેલો કે નવા જમાનાની વસ્તુઓના કારણે થતી નાની-મોટી શારીરિક અસ્વસ્થતાની ફરિયાદો રહે છે, અને બરાબર ખોરાક લેવાતો નથી, એનું પણ હુંખ રહે છે. આ ફરિયાદ અને હુંખ મનનો એવો કબજો કરે છે કે દિવસમાં વારંવાર એના વિચાર આવે છે, પાછું એ વિચાર પર મન કેન્દ્રિત થઈ જાય એટલી બધી તન્મયતાથી એ વિચાર આવે છે, ત્યારે પ્રશ્ન થાય છે કે,

(૧) શું આ વિચારો કાંઈ આત્મિક અનર્થ કરે છે ?

(૨) કરે છે તો તે ટાળવા કોઈ નક્કર ઉપાય છે ખરો ?

પહેલા પ્રશ્નના ઉત્તરમાં અનર્થ ઘણો કરે છે. (૧) પહેલો તે એ કે શારીરિક ફરિયાદોના અને ખોરાક ધાર્યો નહિ લઈ શકવાના વિચાર એ અશુભ વિકલ્પ અને આર્તથાનરૂપ બને છે. દિવસરાત વારંવાર એ ચાલવાથી વારંવાર દરેક સમયે અનંતા અશુભ કર્મપુદ્ધગલ આત્મા પર ચોટે છે. તે ય લેવા દેવા વિના જ, કેમકે એવાં કુવિકલ્પો અને આર્તથાનથી વળતું કાંઈ નથી, ત્યારે આ બાંધેલા પાપ-કર્મના ઉદ્યે દીર્ઘકાળ સુધી અજ્ઞાનદશા મોઢમૂઢતા, અશાંતા, ઈચ્છાભંગ, અનાદર વગેરે કેદ વિટંબણ વેઠવી પડે છે.

(૨) બીજો અનર્થ એ કે આવા રંકડા દીન-દુભિયારા વિચારો કરવાથી આત્માનું સત્ત્વ હણાઈ રહ્યું છે. જેમ શૂરવીરતાના વિચારમાં સત્ત્વ વિકસે છે. એમ દીનતાના વિચારમાં સત્ત્વ હણાય છે. એથી હાલ આટલી જ વાત અસંખ્ય લાગવા જતાં ક્યારેક ભારે આપત્તિ-પીડામાં રૂદ્ધનો પાર રહેતો નથી. કેમકે લાંબા કાળ સુધી સત્ત્વને હણી હણીને ખત્મપાય કરી નાખ્યું છે. વળી એથી જ હંશપૂર્વક કોઈ ત્યાગ, તપસ્યા વગેરે કરવાનું તો દૂર જ હડસેલાઈ જાય છે.

(૩) ત્રીજો અનર્થ એ છે કે આવા મુફ્લિસ વિચારોમાં માનવજીવનનો મહાકંમતી મળેલો સત્પુરુષાર્થકાળ વેડફાઈ જાય છે. આત્મલક્ષી સારા વિચારો કરવાનો સુંદર સમય ચોરાઈ જાય છે. પાછો એનો પડઘો બાકીના સમય પર પડવાથી ત્યાં પણ એવા જોરદાર શુભ વિચાર લાવવાનું મુશ્કેલ બને છે...આવા અનર્થો છે.

ત્યારે બીજા પ્રશ્નો આ સુધારવાના નક્કર ઉપાય છે ?

હા છે, પહેલું તો એ કે આહારાદિની અનિયમિતતા, રસનાની ગુલામી, પૌષ્ટિક ધી-સાકરનો મોહ, દસ્તનો નિરોધ, ખોટી ચિંતા વગેરે ભૂલો તથા કુટેલોને નિર્ધારપૂર્વક ઓછી ઓછી કરી નાખવી, જરૂરિયાતો પર કાપ મૂકવો, ત્યાગ તપસ્યાનું જોર વધારવું, સદ્વાંચન-શ્રવણ દ્વારા વિચારશુદ્ધ બહુ રાખવી.

બીજુ એ કે વાતવાતમાં મારાથી બરાબર ખોરાક નથી લેવાતો. મારું શરીર આમ બગડી ગયું છે, ને તેમ બગડી ગયું છે, એની દવાઈ સરખી નથી મળતી. આવા આવા દેહના વિચારને બદલે આત્માના સારા ખોરાક અને સારી દવાઈ મળ્યાની ખૂબ ભાવના કરવી.

પ. શું આત્માને ખોરાક જેવું કાંઈ છે ? દવાઈ પણ છે ખરી ?

૩. હા, શુભ ભાવ, શુભ વિચાર, શુભ ભાવના અને શુભ લેશ્યા એ આત્માનો ખોરાક છે. દુષ્કૃતનો ખેદ-સંતાપાદિ એ આત્માનું ઔષધ છે.

આ બંનેમાં ખોરાક અને દવાઈ તરીકેનું લક્ષ નહિ હોવાથી એક બાજુ પેલા શરીરનાં રોદણાં ચાલુ રહે છે અને બીજી બાજુ શક્ય શુભ ભાવ આદિની તક અને શુભ કિયાનો આનંદ ગુમાવવાનું થાય છે. એમ માળા ફેરવતાં કે દેવદર્શનાદિ કરતાં જો ખ્યાલ રહે કે ‘અહો આમાં આત્મખોરાક શુભ ભાવોલ્વાસ અને શુભ વિચાર ચાલી રહ્યો છે,’ તેમ એક પ્રતિકમણમાં ખ્યાલ રહે કે ‘અહો આમાં ઢગલો શુભ ભાવો શુભ વિચારો ચાલી રહેલ છે, અને એ મારા આત્માનો પૌષ્ટિક આહાર છે, એમાં મારા આત્માની તુષ્ટિ પુષ્ટિ થઈ રહી છે !’ આ ખ્યાલ રહે તો એ કિયામાં કેવી સરસ એકાગ્રતા થાય ! કેવો અપૂર્વ આલહાદ આવે ! એમ, જ્યારે-જ્યારે ય શુભ વિચાર કે શુભ ભાવના ચાલે, શુભ લેશ્યા પ્રવર્તે, ત્યારે આત્માનો સુંદર લઈ શકાયાનો હરખ રહે. અને તો એની ધારા ય ચાલુ રહે એ ફરી ફરી કરવાનું મન થાય.

શુભ વિચારો-ભાવનાઓ, શુભ ભાવો, શુભ લેશ્યા, એ આત્માની પૌષ્ટિક ખોરાક છે એ વસ્તુ જો બરાબર ગોખી રાખી મનમાં તરવરતી કરી દીધી હોય તો તો વારે વારે એમ થયા કરે કે ‘લાવને ત્યારે સારા તાત્ત્વિક વિચારો અને સારી અનિત્યાદિ-ભાવના જ કર્યા કરું, સારી જ લેશ્યા રાખું, દિલને સારા દ્યા-ક્ષમાદિ ભાવમાં જ તરબોળ કરું, જેથી આત્માને તુષ્ટિ-પુષ્ટિ તો મળ્યા કરે ! કુપથ્ય જેવા નકામા કચરાપણી વિચારો કરીને શું કામ છે ? મનની લેશ્યા બગાડીને કે રાગદેખાદિના ભાવ લાવીને શું કરવું છે ? એથી તો આત્મા રોગગ્રસ્ત અને દુબળો બનશે, જગતનું બહારનું તો મારા હાથમાં નથી, પણ સારા વિચાર વગેરે રાખવા, સારી

ભાવનાઓ કેળવવી એ તો મારા હાથની વાત છે; એ માટે મગજ પણ મળેલું છે. તો હાથવેંતનો લાભ કાં ન ઉઠાવું ?

આત્માના રોગ તરીકે દુષ્કૃત, દુર્ભાવ, પાપસ્થાનકો છે, એને મટાડવા એની નિંદા-ગર્હિ, પશ્ચાત્તાપ અને આત્મ-જુગુપ્સા કે ‘અરે હું કેવો અધમ કે આ મેં કર્યું !’ તેમ જ શુશ્રેષ્ઠ પાસે આલોચના-પ્રાયશ્ચિત્તા,-આ દવા છે. એનું પણ વારંવાર સેવન જરૂરી છે. એમાં ય પ્રતિકમણના અવસરે તો એકેક પાપ બોલતાં મનમાં એ આચયનો સંતાપ થાય. ‘જીવનમાંથી એ ટણો’ એવી બુદ્ધિ રહે.

આત્માનો ખોરાક સારો લઈ શકવાનો અને દવાઈ, બરાબર ચાલુ રહેવાનો વિચાર પ્રધાન બનાવાય, તો પછી શરીરનો ખોરાક પુણ્ય પાતળું હોવાથી કદાચ ન લઈ શક્યાનો કે દવા લાગુ ન પડ્યાનો વારે, વારે વિચાર અને એદ કર્યા કરવાની શી જરૂર રહે ? શું કામ એ મગજને પીડ્યા કરે ? જો શરીરને આહાર-દવાની જરૂર છે. તો શું આત્માના ખોરાક-ઔષધ અને તુષ્ટિ પુષ્ટિની જરૂર નથી ? શરીરની અલમસ્તતાનું તો એટલું હાથમાં નથી, પણ આત્માનું તો હાથમાં છે. તેમ શરીરના ખોરાક-દવાના વિચાર કર કર કરવા માત્રથી કાંઈ વળતું ય નથી. તો એ શા માટે કર્યા કરવા ? આત્માના આહાર અને ઔષધનો ખૂબ ઉપયોગ રાખવો, અને એથી પુણ્ય વધશે; તો શરીર પણ સારું રહેશે, જીવનમાં રોયા કરવું છે, કે સાધવું છે, એ વિચારવા જેવું છે.

સહાય માટે સદા તત્પર

આજથી લગભગ ૬/૧૦ વર્ષ પહેલાનો પ્રસંગ છે. વિહારમાં પૂજ્યપાદશ્રી સાથે અમે કુલ ૧૦ જેટલા સાધુઓ હતા. વરસાદને કારણે બધા આગણ-પાછળ થઈ ગયા. પૂજ્યશ્રી સાથે અમે ૩-૪ નાના મુનિઓ એક ગામમાં પહોંચ્યા. મકાને પહોંચીને હું પાણી વહોરવા ગયો. તેટલી વારમાં તો પૂજ્યશ્રીએ મારા ઝોળી-પાતરા પડિલેહણ કરીને બધા માટે ગોચરી લેવા નીકળવાની તૈયારી કરી. તેઓશ્રી પગથીયા ઉંતરતા હતા ત્યાં જ હું સામો મળ્યો. મેં પૂજ્યશ્રીના હાથમાંથી ઝોળી-પાતરા લઈ લીધા, જવા ન દીધા. પણ, પૂજ્યશ્રી મુનિઓની સહાય માટે સદા તત્પર રહેતા. ૨૦૦થી અધિક મુનિઓના ગુરુસ્થાને હોવા છતાં સાધુનું નાનામાં નાનું કામ કરવામાં પણ તેઓશ્રીને ક્યારેય શરમ નહોતી નદતી.

—“ભુવનભાનું એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૩, તા. ૨૧-૮-૧૯૬૩

૧૧૧ દુન્યવી ભાગતોમાં લયલીનતાનો રોગ કેમ ટળો ?

મંદિરમાંથી બહાર નીકળ્યા પછી કે બીજી કોઈ ધર્મપ્રવૃત્તિમાંથી પૂરી કરીને ઉઠ્યા પછી એના વિચાર ચાલુ રહે છે ખરા ? કે જટ દુન્યવી વિચારોમાં ઓતપ્રોત થઈ જવાય છે ? લગભગ જવાબ પાછળો જ મળે છે કે દુન્યવી વિચારોમાં લયલીન થઈ જવાય છે. એ પરિસ્થિત હોવાથી મંદિરમાં અને બીજી ધર્મકિયાઓમાં પણ વચ્ચે દુનિયાના વિચાર બહુ આવી જાય છે. આ રોગ છે, એનું નિવારણ કરવાનો એક ઉપયોગ છે.

ઉપયોગ આ છે કે આત્મહિતની પ્રવૃત્તિમાં મનની કિયા, મનનો જોશ જોરદાર રાખવો અને દુન્યવી પ્રવૃત્તિમાં મન માંછુ રાખવું. જોશિલું-વેગિલું નહિ, પણ સુસ્ત દુભાયેલું રાખવાનું. કાયાથી અને વાણીથી ધર્મકિયા ચાલે છે, પરંતુ મન એવું એમાં તેજિલું-ઓજિલું કે આવેગવાળું બની ઓતપ્રોત નથી હોતું એટલે કિયામાં રસ નથી જમતો, એના એવા સંસ્કાર નથી પડતા. પછી એમાંથી ઉઠ્યા પછી એના વિચાર એની અસર ક્યારી ચાલે ? કે જે દુન્યવી પ્રવૃત્તિ અને વિચારને ફિક્સ કરી શકે ?

મન કિયામાં જોશવાળું આ રીતે બનાવાય. દા.ત. એક પ્રભુદર્શનની જ કિયા હોય, પણ તે વખતે ‘અહાઠ ! વાહ ! કેવું ઉત્તમ વીતરાગનું દર્શન મળ્યું !’ શી પ્રશાંત વીતરાગ મુદ્રા ! ક્યાં મળે દુનિયામાં આ મુદ્રા જોવા ? ધન્ય દિવસ ! ધન્ય ઘડી ! બસ, આ વીતરાગ મુદ્રા જોતા જોતાં ‘કેમ મારા રાગાદિનાં ઝેર ઉત્તરતાં જાય !...’ - આ રીતે મન જોશમાં કામ કરતું રહે, પાછું હૈયું ગદ્ગદ થાય, મનની તરબોળતા વધીને શરીરે રોમાંચ ખડા અને આંખે આંસુનું ભરાવું થાય.

એવું જ પરમાત્માની પૂજામાં કરવાનું છે. મનનો જોશ એટલો બધો વધે કે પૂજાની પ્રત્યેક કિયામાં ભારે ઉછરંગ અને તન્મયતા હોય, મનને થાય કે ‘વાહ કેવી મહાપવિત્ર આ કિયા મળી !’ દા.ત. પ્રભુને મોર પીછી કરી કે કેશરપોથો કરી નિર્માલ્ય ઉતારાતું હોય, ત્યાં એમ થાય કે ‘મોહને લીધે દુનિયાના તો કેઈ પ્રેમીના શરીર સાઝ કર્યા. પણ એ તો મોહમુઢ અને દોષો ભર્યાની સેવા ! સેવા ય સ્વાર્થ અને મોહની જ ચેષ્ટા ! ત્યારે આ તો ત્રિલોકતારક અનંત ઉપકારી વીતરાગ અને નિષ્કલંક દેવાખિદેવની સેવા ! સેવા ય આવડે તો મહાન યોગ-સમ્યગુદ્ધનયોગની સાધના !’

‘અહોભાગ્ય કે આ ઉચ્ચ અનુષ્ઠાન મળ્યું ! તે ય ભગવાન વીતરાગ પરમાત્મા બન્યા તો જ મળી શક્યું, માટે એમનો કેટલો બધો અથાગ અમાપ ઉપકાર ! ધન્ય મારા નાથ ! મારા ઉપકારી ! તમે તો મુજ સરખા રાંક પર આવા કેટલાય ગજબ ઉપકાર કર્યા ! કેવા દયાણુ !’ મન જોશમાં આવી આવી ભાવનાના રંગે રંગતું રહેતું હોય એ કિયામાં કેટલો બધો પાવર ચઢાવે ? તન્મયતા કરાવે ? એની આગળ બહારની હુનિયાનું કેટલું લુખ્યું ફિક્કું અને તુચ્છ મનાવે ? શું આ હોય તો મંદિરની બહાર નીકળ્યા પછી આત્મા પર એની ઘેરી અસર ન રહે ?

એવું પ્રક્ષાલ, વિલેપન, તિલક, પુણ્ય આદિ દરેક દરેક કિયામાં હુન્યવી કિયાની તુલનાએ અસાધારણ ઉચ્ચતા, પવિત્રતા, કલ્યાણકારકતા નિહાળી મન જોશમાં ઓતપ્રોત રહે. ‘જગદ્ગુરુના પ્રક્ષાલ વગેરે કરવામાં તો મોટામોટા ઈન્ડ્રો અને રાજા-મહારાજાઓ જેવા પણ કેવાક રાચ્યા-માચ્યા ! એવા પ્રસ્તુ મને મળ્યા ! અને આ ભક્તિ-કિયાઓ મળી ! પછી હું ય શું કામ બાકી રાખ્યું ?’-એ ઊલટ ચઢે, ઉછરંગ ઉછળે, ત્યાં મનનો જોશ વધે.

એજ પ્રમાણે ભાવપૂજા ચૈત્યવંદન, સ્તુતિ, સ્તોત્રમાં અક્ષર અક્ષર પર એકાગ્રતા તથા મનના જોશથી હૈયામાં ઉછળતાં શુભ અધ્યવસાય અને ઉજજવલ લેશાં, ઉછળા મારતો ભક્તિરંગ, એની આગળ હુન્યવી વૃત્તિની અને હુન્યવી આનંદની અતિ તુચ્છતાનું હાર્દિક સંવેદન...આવું બધું હોય તો કિયામાં મનનો જોશ એવો રહે કે એની અસર મંદિરની બહાર પણ ચિરસ્થાયી રહે.

સામાચિક, પ્રતિકમણ, પોષધ, નવકારવાળીથી જાપ, વગેરેમાં પણ યોગ્ય ભાવના ઉછળા, અતિચારસૂત્ર અને સંતાપની તીવ્રતા, સ્તુતિ સૂત્રના અવસરે ભક્તિના ઉછળા...વગેરે,-ચાલુ રહે અને કોઈ મહાન વિદ્યાની સાધના મળ્યાં જેવી તન્મયતા રહે તો જોશ સારો રહે.

સમજવાનું છે કે આમ તો એવાં શુભ ભાવના ઉછળા આવતા નથી, પરંતુ પવિત્ર જિનોકત અનુષ્ઠાનોનાં આલંબને સહેલાઈથી આવી શકે છે. એ મહામૂલા આલંબનોને એમના એમ પસાર થયે જવા દઈએ, અને કિયા કરી લીધાનો સંતોષ માની લઈએ, તો એ ધર્મયાત્રા મોક્ષે શે પહોંચે ? એ ગુણાણો ઊંચે ઊંચે ક્યાંથી ચઢાવી શકે ? એ તો પ્રત્યેક અક્ષર અને પ્રત્યેક કિયાનું અંગભૂત નાનીય કિયા-એણે હૈયે ભાવના ઉછળા લાવવા જ જોઈએ. એવા કે હેણું સંતાપ યા ભક્તિ રંગથી રું રું થતું લાગે ! ભાવના ઉછળા વિના એક અક્ષર કે એક પ્રવૃત્તિ ન જાય, તો જ કિયા મનના જોશવાળી બને અને એની અસર પાછળ પણ સારી ચાલે જેથી હુન્યવી પ્રવૃત્તિ અને વિચારોમાં તેવી મૂઢ લયલીનતાનો રોગ ઓછો થતો આવે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૯૭-૧૨, અંક-૪, તા. ૨૮-૯-૧૯૬૩

૧૧૨ જૈન સંધના ઉદ્યમાં કેટલાંક અવરોધક તત્ત્વ (લેખાંક-૧)

ઇહા આરાની અપેક્ષાએ સુવર્ણ યુગ રૂપ આ પંચમ કાળને કળિકાળ કહીને શા માટે વગોવ્યા કરવો ? જ્યારે ક્યારેય સંધમાં અવનતિની કોઈ બાબત આગળ આવે છે ત્યારે ‘એ તો ભાઈ ! કળિકાળમાં એમ રહેવાનું’-એમ કહીને ‘અવનતિ શા કારણે ? એ મૂળ શાંકા સાચ્ય છે કે અસાચ્ય ? એને મિટાડવા શા ઉપાય હાથ ધરવા જોઈએ...’ વગેરે કરવા યોગ્ય મહત્વની વિચારણા પર ઉપેક્ષા જ કરવામાં આવે છે. પરિણામ એ આવીને ઊભું રહે છે કે મૂળ રોગ એમ જ ચાલ્યા કરે છે યા વધતો રહે છે, અને એથી અવનતિ પગભર રહી, સીદામણ અટકતી નથી, અને જૈન સંધનો ઉદ્ય અવરુદ્ધ બને છે.

અમને વિચાર કરતાં બરાબર લાગ્યું છે કે જૈન સંધના ઉદ્યની આડ ચોક્કસ તત્ત્વો અવરોધ કરી રહ્યા છે. જે જૈન સંધના માથે ત્રિલોકનાથ વિશ્વહિતકારી તીર્થકર ભગવાન શિરછિત હોય, જ્યાં વિશ્વશ્રેષ્ઠ શ્રમણ શ્રમણીઓ અંગભૂત હોય, જેને અનન્ય-હુર્લબ પવિત્ર તીર્થધિરાજ શ્રી શત્રુંજ્ય મહાગિરિનું સાનિધ્ય મળ્યું હોય, જે સંધને લોકોત્તર જિનાગમનાં અમીપાન મળતા હોય, જ્યાં સંયમ, ત્યાગ, તપસ્યા, વ્રતનિયમો અર્હદમહોત્સવો વગેરે પવિત્ર ચર્ચા-અનુષ્ઠાનો પ્રવર્તતા હોય, એવા શ્રી સંધનો ઉદ્ય કેમ જ અટકે ? પણ વર્તમાન પરિસ્થિતિ બતાવી રહી છે કે ઉદ્યનો અવરોધ પ્રવર્તી રહ્યો છે. એ, અમને લાગે છે કે, કેટલીક અત્યંત અનિયતનીય પ્રવૃત્તિઓને લીધે છે. તેમાંથી કેટલીકનો અહીં વિચાર કરવામાં આવે છે.

(૧) કેટલેય ઠેકાણે દેવદ્રવ્યનાં નાણાં સુખી શ્રાવકોને ત્યાં વ્યાજે જમા રાખવામાં આવે છે. પોતાની મૂડી ભેગા એ નાણાં પર વેપારે ચાલે છે જેમાં પેલા વ્યાજના ટકા કરતાં ટકાનો નફો મળે છે. આમાં દેવના નાણાંથી પણ થતા વેપાર અંગેના નફાનોય સમાવેશ થાય છે. એ ચોખી દેવદ્રવ્યની કમાઈ ગણાય, એ તે વેપારી શ્રાવક અને એનું કુટુંબ તો ખાય પણ ત્યાં જનારા મહેમાનો પણ ખાય છે અને ત્યાંથી વહોરી, જનારા સાધુસાધી પણ વાપરે છે. અવસરે એ સાધ્યમિક વાતસ્ય કરે, તેમાં આખો સમૂહ જમે છે. વિચારવા જેવું છે કે આ દેવદ્રવ્યનું પેટમાં ગયેલું એ સદ્બુદ્ધિનો વિકાસ કરે કે બુદ્ધિનો વિકાર કરે ? સંધની ઉન્નતિ કરે કે અવનતિ ?

પ્ર. : પરંતુ બીજે દેવદ્રવ્ય જમે રાખવામાં જોખમ હોય છે, એના કરતાં શ્રદ્ધાળું સદ્ગુર શ્રાવકોને ત્યાં બરાબર સચ્ચવાય ને ?

૩. : પહેલી વાત તો એ છે કે દેવદ્રવ્ય દેનારાઓએ દેવની ભક્તિ માટે દીધું હોય છે, પણ દેવને કોરાધાકોર, દેવના મંદિરને જીર્ણ કે કાળા અને દેવદ્રવ્યની મૂરીને સારી સંગૃહીત રાખવા માટે નહિ. બીજું ભાવી આપત્તિ સામે જરૂરી સંગ્રહ રાખવો પડે તો તે બેંકમાં રાખી કે જૈનેતરના કમમાં કમ તેટલા મૂલ્યના દાગીના સામે ધીરી શકાય છે. એમાં ભય હોય તો એમ જ ભંડારમાં સોના રૂપે રાખી શકાય છે. બાકી જૈન એ નાણાં વ્યાજે રાખી એના દ્વારાના વેપારમાં અધિક ટકા નફો ખાવો જરાય ઉચિત નથી. અરે ! નફા કરતા અધિક ટકા વ્યાજ આપીને પણ શ્રાવકે રાખવા ઠીક નહિ, કેમકે એમાં કોને ખબર કાલે ઉઠીને પોતાની કેવી પરિસ્થિતિ સર્જય ? જો નાણાં ગુમાવે તો પોતે રૂબે અને સંઘ એની સામે એક શ્રાવક હોઈને દાવો ન કરે, અગર એના લાગતાવળગતા તેમ કરવા ન હે. એનો અર્થ એ કે દેવદ્રવ્ય એટલું નષ્ટ ! જ્યારે જૈનેતર સામે તો એવી જરૂર પડયે, કેસ દાવો કરી શકાય, પૈસા વસૂલ કરી શકાય.

(૨) બીજો પ્રસંગ છે પોતાનો માલ નફાથી દેવદ્રવ્યના નાણાં લઈ વેચવાનો, શ્રાવક દેવદ્રવ્યનું નાણાં પોતાના નફા તરીકે લે, ખાય, ખવરાવે એ પણ બધાના મળેલા સંઘનો ઉદ્ય કરે કે અધઃપતન ?

પ્ર. : પણ શ્રાવક પોતાની મહેનતના પ્રમાણમાં લે તો વાંધો શો ?

૩. : ધારો કે કોઈ બાપનો મોટો દીકરો જુદો રહેતો હોય, એની જુદી દુકાન હોય, હવે એની દુકાનેથી બાપ નાના દીકરાને માલ લેવા મોકલે તો આ મોટો દીકરો પોતાની મહેનતના પ્રમાણમાં બાપ પાસેથી નફો લઈ માલ આપે એ શું યોગ્ય લાગે છે ? અરે ! નફાની વાત તો દૂર પણ પડતર ભાવે નાણાં લઈને બાપને માલ આપે એ પણ શું ઠીક છે ? બાપની તો ભક્તિ કરવાની કે બાપ સાથે સોદો ? બસ દેવની સાથેના વ્યવહારમાં આટલું ય સમજાય તો ઘેલા પ્રશ્ન ન ઉઠે.

પ્ર. : તો પછી વહીવટદાર પોતાની દુકાન મૂરી બીજાની દુકાનેથી દેવદ્રવ્યના નામે માલ લે એમાં ભાવ વધુ આપવો પડે તો એ અધિક દેવદ્રવ્ય ખર્ચ કરતાં હૃદય ધિંહું ન થાય ?

૩. : પણ એમ શા માટે કરે ? પોતે જ પડતરથી ય ઠી ટકો ઓછા ભાવે માલ આપી અગર બહારથી અપાવી શકે છે. સવાલ આ જ છે કે જ્યારે મંદિરેથી પૂજા કરીને આવી નખમાંય કેશર ન ચોંટ્યું રહે માટે, રખે દેવદ્રવ્યની કણ્ણીય પેટમાં જાય એ બીકે હાથ બરાબર ધોઈ નખાય છે, તો પછી દેવદ્રવ્યમાંથી સીધો નફો તો

લેવાય જ કેમ ? એ પોતાના ને કુદુંબનાય પેટમાં જાય, અંશે બીજાનાય પેટમાં જાય, ત્યાં એમનો ઉદ્ય શી રીતે થાય ? બૂરી ભાવનાઓ કેમ ન ઉઠે ? બુદ્ધિ ભણ કેમ ન થાય ?

(૩) આવો એક પ્રસંગ સસ્તા ભાડાનું દેવદ્રવ્યનું મકાન વાપરવાનો બને છે, અથવા દેવદ્રવ્યની રકમ સાધારણ ખાતાને ધીરીને એમાંથી ચાલી બાંધી ભાડું વધારે ઉપજાવી દેવદ્રવ્યને એનાથી ઓછા ટકા વ્યાજના અપાય, ને બાકી વધારો ધીરાણ પાછું વાળવામાં કરાય, ત્યાં પણ દેવદ્રવ્ય ભક્તિનો દોષ ઊભો થાય છે, શું શું દેવદ્રવ્ય એ બિચારું છે ? નમાલું છે કે એને વધારે વ્યાજ ઉપજાવતાં નથી આવડતું એટલે વાણિયાળીરી કરી એને ઠગી એના દ્વારા સાધારણનું ભંડોળ ઊભું કરવાનું ? અરે ! એવું ય સાંભળવા મળે છે કે દેવદ્રવ્યની રૂમ પોતે ખાલી કરી બીજાને આપીને હજારો રૂપિયાની પાદ્ધતી ચાંડ કરાઈ ! પણ ‘પાપ પીપળે ચઠીને પોકારે’ એની જેમ એ રકમથી પણ વધુ રકમ કોઈ શરાફ ઘાલી ગયો ! કઈ દશા ? ત્રિલોકનાથ અરિહંતદેવની ભક્તિનાં નાણાં સીધા કે આડકતરા જાતે ખાવા, ને એ ખાવામાં બીજાને ભેળવવા, આવું ચાલતું હોય ત્યાં ઉદ્ય શી રીતે થાય ? બુદ્ધિ મલિન, ભણ કેમ મીટે ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૫, તા. ૫-૧૦-૧૯૬૩

(૧૧૩) (લેખાંક-૨)

(૪) જૈન સંઘના પ્રાણરૂપ અરિહંત ભગવાનની પૂજામાં આજે વાળાંકુંચીનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે એ પરમાત્માની પૂજાને બદલે વિટેબણાનું દશ્ય પૂરું પાડે છે. સવાર પડે એટલે પૂજારીઓ, કુચાંથી લોટા માંજવા કે ઓટલા સાફ કરવાની જેમ, મજબૂત બાવડે વાળાંકુંચીથી ભગવાન પર ખચખચ ખચખચ ચલાવે છે. પરમાત્મા પર આ જુલ્દુ ? કોઈ અટકયાઓ છોકરો એક સળીથી ય ભગવાન પર ગોદા મારતો હોય તો તે વ્યાજબી ન ગણીએ એને આશાતના માનીએ, તો પછી સળીઓના ઝૂંઝારૂપ વાળાંકુંચીથી ગોદા મારવાની કે ઘસાઘસ કરવાની કિયા કેમ જ થાય ? એક તો એ કિયા બેહુદી લાગે છે, વળી સારી રીતે કૂટી-કેળવેલી રાળ વગેરેથી ચોટેલા ચંદ્ર ટીકા ઉત્તરી જવાથી પૂજારીઓ ફરી એને ગરમ કરી ભગવાનને ઉના ડામ જેવા ચોડે છે. વાળાંકુંચીના ભારે આધાતોથી પ્રતિમાજીને ઘસારો પહોંચે છે ! અને નાના ધાતુના બિંબોના તો આંખ, નાક, કાન, મોં સંદંતર ઘસાઈ જાય છે ! સિદ્ધયક્ષ વગેરેનાં આલેખન તો સાવ જ સાફ થઈ જાય

છે ! જ્યાં પરમાત્માની આ વિટંબણા ચાલુ હોય એ સંધનો ઉદ્ય કેવી રીતે થાય ?

(પ) પૂજારીઓને આજે ભગવાન સંચાઈ ગયા છે, પણ એની પાછળ એ કોણ જોવા જો કે એ પૂજારી શિયાળાના દિવસે સ્નાન કરીને પૂજા કરવા પેસે છે ? કે વગર સ્નાને સીધાં પૂજાના કપડાં બદલી પેસે છે ? વળી પ્રક્ષાલ માટેના પાણી અને દૂધ સામે ખુલ્લા પડ્યા છે તે વખતે માં બાંધા વિના ખુલ્લા મોંએ બોલવાનું કરતાં થુંકના કણ એમાં પડે ખરા ? એમ જે ઓરશિયા પર કેસર સુખડ વાટે તે ઓરશિયા ઉપર ઉદ્દર વગરે ફરી ગયા હોય એટલે પહેલાં બરાબર ધોઈ લેવો જોઈએ, તે બરાબર ધોઈ લે છે ખરા ? એમ પહેલાં પોતાના હાથ પગ સારી રીતે સાફ કરેલા હોય છે ? વળી બહાર બીડી ફૂકી આવી સીધો ગભારામાં પેસે છે ખરા ? રાતવાળા અશુદ્ધ કપડે ભગવાનના પ્રક્ષાલનું પાણી ભરી મૂકુવું વગરે કરે છે ખરા ? એનાં પૂજાનાં કપડાં દિવસોના મેલા તથા પસીનાની દુર્ગધભર્યા હોય છે ? પાટપોથો પહેલાં ભગવાન પર ફેરવી પછી એનાથી પબાસણ લુંછે છે ખરા ? જે પબાસણ પર પણ ફૂલ પડી ગયેલું ભગવાનને નથી ચઢવાતું, એ પબાસણ પર અંગલુંઘણા મૂકી રાખી એનાથી ભગવાનના અંગ લુંછે છે ? પૂજારી શરદી વગરેનાં કારણે નીંગળતા નાક હાથેથી લુંછી એ હાથ બરાબર ધોયા વિના ભગવાનને કે કેશર વગરેને અડાડે છે ખરા ? ત્રણ લોકના નાથની જો આ બધી આશાતનાઓ થતી હોય તો એમાં શું સંધ જવાબદાર નથી ? એમાં સંધનો ઉદ્ય શી રીતે થાય ?

(હ) આંશં-કલ્યાણી સંધ વરસોવરસ હજારો-લાખો રૂપિયા દેવભક્તિ અને જ્ઞાનભક્તિમાં આપે છે. આનો ઉદેશ શો છે ? દેવાધિદેવની અને જ્ઞાનની ભક્તિ થવાનો કે ખાલી ધનસંગ્રહ વધારવાનો ? આજે મોટા ભાગના ટ્રસ્ટીઓ-વહીવટદારોને એ મેનિયા લાગ્યો છે કે, ‘મૂકી વધાર્યે રાખો.’ પછી ભલે દેવભક્તિ અને જ્ઞાનભક્તિનાં કાર્યો સીદાતા રહે. મંદિરમાં શિખર કાળા પડી ગયા હોય એમાં ઉજળામણ લાવવાની જરૂર નથી લાગતી એવું દેવદ્રવ્યની મૂકી વધારવા પરથી દેખાય છે. ભગવાનનાં અંગલુંઘણાં કાળા અને કડક બરછટ થઈ ગયા હોય, કેશરપોથા તો વળી નાનકડા ટચુકડા અને રીતસર કેશર પી પીને તંગ થઈ ગયેલા હોય, કળશ વગરે રીતસરના હોય નહિ, ચક્ષુ ટીકા બેડોળ હોય, મંદિરની અંદરની દિવાલો તથા ફરસી શ્યામ પડી ગઈ હોય,...આવી તો કેટલીય પ્રભુભક્તિના વિશાષ કાર્યને બદલે આશાતના અનાદરની બાબતો ચાલુ, તે ય છતે દેવદ્રવ્યની સગવે ! એ કેટલું બધું વિચિત્ર ? આવું ચાલે ત્યાં સંધનો ઉદ્ય કેવી રીતે

થાય ? દેવનાં નાણાં કે જ્ઞાનના નાણાં સંધના વહીવટમાં આવ્યા એટલે શું સંધે એના ધણીધોરી થઈ બેસવાનું ? દેવાધિદેવ અને જ્ઞાન એ શું ગરીબડા અરે બિચારા છે કે એમને પોતાના નાણાં છતાં સંધની દયા ઉપર જીવવાનું ? સંધ વહીવટદાર એ નાણાંમાથી ટૂકડો દેવને કે જ્ઞાનને નાખે તો એમણે ભોગવવાનો, નહિતર એમણે હાથ જોડી સીદાતા બેસી રહેવાનું એમ ને ?

આજે કહે છે કે ટ્રસ્ટો પાસે હજારો રૂપિયાનું જ્ઞાન ખાતું છે પણ ક્યાં ? તો કે ચાલી બાંધી તેમાં રોકાઈ ગયેલું ! અગર સાધારણ ખાતે વપરાયેલું ! અથવા નગદ છતાં પંચના તડાખડાના વિવાદમાં પડેલું !...વગરે આટલી મૂકી છતાં ભંડારમાં પૂરા શાસ્ત્રો વસાવાતા નથી, લખાવવા યોગ્ય શાસ્ત્રો લખાવાતા નથી, સાધુસાધીને ભાષવા માટે છે તેવી સગવડ નથી, જરૂરી શાસ્ત્રોનાં પ્રકાશન કે શાસ્ત્રોના પ્રામાણિક વિવેચનનાં પ્રકાશન થતાં નથી,

...છતે જ્ઞાનદ્વયે જ્ઞાનવૃદ્ધિમાં આ સીદામણ હોય ત્યાં એ જ્ઞાનદ્વય પર હક્કુમત જમાવી બેસનાર સંધનો ઉદ્ય શી રીતે થાય ? ધર્મભાતામાં પૈસા આપનાર એ પૈસાથી ધર્મસેવા થાય એ વિશ્વાસ (ટ્રસ્ટ)થી આપે છે, નહિ કે ખાલી ધનસંગ્રહ થવા. એનો એ ઉદેશ ન સારવો એ વિશ્વાસભંગ છે, Breach of Trust છે.

(૭) જૈન સંધ એટલે તો જિનને, જિનના સિદ્ધાન્તોને અને જિનની માફક પાંચ પરમેષ્ઠાને માનનાર હોય, માન્ય-આદરણીય કરનાર હોય, એ જિનના સિદ્ધાન્તની અંતર્ગત દર્શન-જ્ઞાન-ચારિત્રનો વિરોધ કરે ખરા ? કે પરમેષ્ઠા આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ ભગવંતની નિંદા કરે ખરા ? જો સંધ એટલે કે સંધના સત્ય એવું કરે તો એથી સંધનો ઉદ્ય થાય ? કે ઉદ્ય રુંધાય ? આજે આર્ય સંસ્કૃતિલોપક પાશ્ચાત્ય કેળવણી પર જૈનો પણ એટલો બધો ઝોક આપી રહ્યા છે અને કેટલાઓ તો વળી એને એવું જ્ઞાનના વિકાસ તરીકે ઓળખાવી રહ્યા છે, કે ખરેખર સચ્ચ્યગ્ર જ્ઞાનને તો જઈને પુસ્તકમાં જ બેઠેલું રાખી દીધું છે ! એટલે જ ધરના છોકરા-છોકરી પાઠશાળાએ ન જાય એની ચિંતા નથી, નિશાળે ન જાય તો મોટી ચિંતા છે. એ ચિંતામાં જિનશાસ્ત્રના અધ્યયનને નકામું, શુષ્ણ અને જીવન જીવવામાં નિરૂપયોગી માની લેવામાં આવે છે. તપ, ચારિત્ર, આચાર અને ધર્મકિયાઓની સામે રાત્રિબોજન, અભક્ષ ભક્ષણ, સહશિક્ષણ, પર્વ તિથિની વિરાધના, સિનેમા, રેડિયો, કલબ, ઈલ્યાન્ડ ઈલ્યાન્ડ એટલું બધું ચાલ્યું છે કે એમાં સંધનો વાસ્તવિક ઉદ્ય ગુંગળાઈ રહ્યો છે. ધરમાં કોઈ વૈરાગ્ય અને ચારિત્રની ભાવનાવાળો બને, યા તપસ્યા, બ્રહ્મચર્ય કે બીજા વ્રત નિયમ સ્વીકારે, તો જાણો એણે ગુનો કર્યો એવી એની તરફ કુટુંબની દસ્તિ અને વર્તાવ થાય છે. આમાં ઉદ્ય ક્યાંથી થાય ? તેમ

સાધુ-સાધીજ મહારાજની નિંદા કરાતી હોય, એમનું હલકું-ઘસાતું બોલાતું હોય, યાવત્ સંઘની પણ નિંદા, અવર્ણવાદ કરાતા હોય ત્યાં પણ ઉદ્ય શી રીતે થાય ?

ઉદ્યના આ કેટલાંક અવરોધક તત્ત્વ વિચાર્યા છે, બીજા પણ વિચારી શકાય, એને દૂર કરવામાં આવે તો ઉદ્ય અવશ્ય થાય. બીજાઓ શું કરે છે એ જોયા વિના વ્યક્તિગત દરેકે એ અત્યંત અનિશ્ચનીય બાબતોથી બચી જવું જોઈએ અને તે માટે એની સામે ઉદ્યસાધક કર્તવ્ય અવશ્ય બજાવતાં રહેવું જરૂરી છે.

U

પળે પળ યતના

V

મારા સંયમ જીવનનો એકદમ પ્રારંભકાળ હતો. હું રોજ પૂજ્ય ગુરુદેવશ્રી સાથે દેરાસર દર્શન કરવા જતો. દેરાસર જતાં પહેલાં હું ગુરુદેવને ચશ્મા આપું એટલે તરત મને પૂછ્યા. પડિલેહણ કર્યા ? પૂંજને ખોલ્યા ? રોજ અવશ્ય પૂછ્યે. ત્યારે તો મારે ચશ્મા નહોટા. પછી મારે ચશ્મા આવ્યા એટલે ગુરુદેવે પડાવેલી ટેવને કારણે ચશ્મા લેતા, ખોલતા પૂંજવાનું - પડિલેહણ કરવાનું સહજ થઈ જાય છે.

અત્યારે રોજ ચશ્મા હાથમાં લેતા પૂજ્યશ્રીનો રણકાર સંભણાય છે : દાંડી પૂંજી ?

બારી-બારણાં ખોલતી-બંધ કરતી વખતે કાનમાં ગુરુદેવશ્રીનો અવાજ સંભણાતો હોય તેવું લાગે છે : બરાબર પૂજ્યું ?

પાટ ખસેડતી વખતે પણ એ જ ટકોર : જગ્યા બરાબર પૂંજી ? કેવા યતનાવંત હતા ગુરુદેવશ્રી !

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્ય

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૬, તા. ૧૨-૧૦-૧૯૬૩

૧૧૪

ચાર શરણાંના સ્વીકારનું રહસ્ય

કેરી પકવવાની સ્થિતિમાં આવે પછી જ એના પર પાકનાં સાધનો અસર કરે છે, એને અથ્ય કાળમાં પકવી દે છે. પણ જ્યારે એ મરવો છે ત્યારે પાક માટે અયોગ્ય હોઈ એના પર પાકનાં સાધન અસર કરી શકતા નથી. એવી રીતે સંસારી જીવને ભવસ્થિત પાકવાની યોગ્યતા આવ્યા વિના એના પર પકવવાના સાધન કાંઈ કામ કરી શકતા નથી. અનંતા પુદ્ગલપરાવર્તકાળ જીવ એ દશામાં રહે છે. માત્ર છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં ભવસ્થિત પાકવાની યોગ્યતા ઊભી થાય છે. હવે ત્યાં જો એ પકવવાના સાધન મળી જાય તો એની પાકવાની કિયા શરૂ થાય છે. ત્યાં એવું નથી કે બધા જ જીવને આખો પુદ્ગલપરાવર્તકાળ પૂરો કરવો જ પડે. એ તો હવે ભવસ્થિત અર્થાત્ જીવનો સંસાર સાથેનો સંબંધ પકવવાનો જેનો જેટલો સાધનમાં પુરુષાર્થ, એટલી એની ભવસ્થિત વહેલી પાકે, જેમ કેરી પાકની યોગ્યતામાં આવ્યા પછી જેવો જોરદાર પાકના સાધનમાં મુકાય એટલી એ વહેલી પાકે.

શાસ્ત્રમાં ભવસ્થિત પકવવાનાં પ્રથમ સાધન તરીકે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિ-ભાષિત ધર્મના શરણ-સ્વીકારવા. એટલે તો એ ભાવ કરવો કે મારે અરિહંત શરણા, મારે સિદ્ધો શરણ...વગેરે. એમાં જોરદાર પુરુષાર્થ શો ? કે મંદ પુરુષાર્થ શો ?

આના ઉત્તરમાં ચાર શરણાં સ્વીકારનું રહસ્ય સમજવું આવશ્યક છે.

શરણું સ્વીકારવું એટલે ભાલી બોલવાની વસ્તુ નથી કે ‘મારે આમનું શરણ હો,’ અથવા એવો કોરો ભાવ નથી. પરંતુ અમુક પ્રકારનો આંતરિક ભાવ ઊભો કરવો પડે છે. એ સમજવા આ જુઓ કે,

શું માણસ કે શું પશુપંખી કોઈના શરણે ક્યારે જાય છે ? ત્યારે કે જ્યારે એ કોઈ ભયમાં હોય અગર કોઈ દુઃખમાં હોય, કોઈ ગૂડો કોઈને મારવા જતો હોય ત્યારે પેલો પોલીસ કે મજબૂત માણસને શરણે જાય છે. કહે છે, ‘મને બચાવો ! અને કોઈ બિમારી કે બેકારીથી પીડાતો હોય ત્યારે વૈધ-ડોક્ટર કે શેઠના શરણે જાય છે, કહે છે ‘ભાઈસાહેબ ! મારો આ જીવિમ રોગ મટાડો’ ‘મને મહેરબાની કરીને ધંધો આપો નોકરી આપો.’

બસ અરિહંતાદિ ચારનું શરણું લેવા તૈયાર થઈએ ત્યાં આપણા દિલમાં કોઈ

તેવો ભય યા દુઃખનું સંવેદન હોય અને બીજી કોઈ રીતે એ ટળે તેમ લાગતું ન હોય, એ ભય શાનો ? આ માનવ જીવન એણે વેડફાઈ જવાનો, ભવપરંપરા વધી જવાનો, પાણી દીર્ઘ ભવયકમાં ફસાઈ પડવાનો ભય. ત્યારે દુઃખ કયું ? આત્માના અનંત રોગોનું, કર્મના બંધનનું, વાસના અને વિકારનું દુઃખ. ટૂંકમાં ભવનો ભય અને મોહની ગુલામીનું દુઃખ હૈયાને કોરી રહ્યા હોય, રુંરું કરાવી રહ્યાં હોય, ત્યારે જ અંતર્નીદ ઉઠે કે,

‘હે અરિહંત પ્રભુ ! હે સિદ્ધ ભગવંતો ! હે મુનિ મહારાજો ! હે સર્વજ્ઞભાષિત ધર્મ ! હાય ! આ ભવયક મને ફસાવી દેશે તો મારું શું થશે ! હું એથી ભયભીત છું. આ રાગદ્રેષાદિ દોષો અને હિંસાદિ દુષ્કૃત્યોથી પીડાઈ રહ્યો છું ! મને રક્ષણ આપો, હું તમારા શરાણો આવ્યો છું. મારે તમારું જ શરણ છે.’

અલભત જ્યારે જ્યારે આ શરણ-સ્વીકાર કરીએ ત્યારે ત્યારે આટલા બધા શર્ષણ ન બોલીએ કે ન ચિંતવીએ, પરંતુ એના ભાવનું આવેદન અંતરમાં હોય, ભય અને દુઃખની લાગણીથી શરણું લેવાય અને તે પણ એવી અટલ શ્રદ્ધા સાથે કે એ અરિહંતાદિ આ ભય અને દુઃખથી મુક્ત કરવાનું અનંત સામર્થ્ય ધરાવે છે.

ચારણાં શરણ રોજ ત્રિકાળ તો સ્વીકારવાનાં છે; અને જ્યારે જ્યારે ચિત્તમાં અસમાધિ વધે રાગ-દ્રેષના સંકલેશ ઉઠે, કોઈ દુર્ધ્યાન હલ્લો કરે, ત્યારે ત્યારે વારંવાર સ્વીકારવાના છે. એનું ટૂંકું સૂત્ર આ,-‘અરિહંતા મે સરણાં; સિદ્ધા મે સરણાં; સાહુ મે સરણાં, જિણધમ્મો મે સરણાં.’

જો આ શરણસ્વીકાર ઉક્ત ભય અને દુઃખથી દાંની રહેલા દિલે કરાય, તો ભવસ્થિતિ પકવવાનું બીજું સાધન ‘દુષ્કૃત ગર્હા,’ વાસ્તવિક રીતે થાય, કે જેમાં પૂર્વ જન્મનાં રાગ-દ્રેષ-મોહથી જાણ્યે-અજ્ઞાણે સેવેલાં સમસ્ત દુષ્કૃત્યો, દા.ત. અરિહંતાદિ પૂજ્યો પ્રત્યે આશાતના-અવગણના-અનાદર, જીવો પ્રત્યે વૈર-વિરોધ-અમિત્રભાવ-નિર્દ્યતા. હિંસા-અસત્યાદિ, તથા જડ પદાર્થોના સંગ્રહ ભોગવટા, ટૂંકમાં જિનાજ્ઞા-વિરુદ્ધ વાળી-વિચાર-વર્તાવ,-એ દુષ્કૃત્યોની ભારે હદ્યસંતાપ સાથે નિનંદા ધૂષણ અને એની અસરથી મુક્ત થવા ‘મિચ્છામિદુક્કડં.’-આ કરવાનું છે; શરણસ્વીકાર કહેલ રીતે થાય તો આ દુષ્કૃત ગર્હ બરાબર થાય, અને એ બને તો ત્રીજું સાધન સુકૃત-અનુમોદના, અર્થાત્ અરિહંતથી માંડીને માર્ગનુસારી જીવના ગુણો-સુકૃતોની હાર્દિક પ્રશંસા થાય.

આ ગ્રણે સાધન રોજ ત્રિકાળ અને અસમાધિમાં વારંવાર કરીએ એ મહેશ્ચા.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૭, તા. ૨૬-૧૦-૧૯૬૩

૧૧૫ ભવિતવ્યતા અને પુરુષાર્થ

(લેખાંક-૧)

કેટલાકોને મનમાં એ ગુંચવાયા કરે છે કે ‘જો ભવિતવ્યતામાં નિર્ધારિત થયેલું બનતું જ હોય તો આપણે ગમે તેટલો ધર્મપુરુષાર્થ કરવા જઈએ છતાં મુક્તિ તો ભવિતવ્યતામાં નિર્ણાત થઈ હશે ત્યારે જ થવાની, તો પછી તનતોડ પુરુષાર્થ શા કામનો ? કેમકે એ કાંઈ મુક્તિને વહેલી નહિ બેંચી લાવી શકે. ત્યારે જો નિર્ધારિત ન હોય તો ભવિતવ્યતા શી ? શાની ભગવંતે દીઠેલામાં ફરક તો પડવાનો નથી, એટલે એમણે જોયું હશે તે મુજબ જ મુક્તિ થવાની, પછી આપણે પુરુષાર્થમાં જોર મારવાની શી જરૂર ?’

આના સમાધાનમાં એ સમજવાનું છે કે ભવિતવ્યતા એકલી નિયત જ નથી, પરંતુ આ.શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ પંચાચારના ‘શ્રી આચારપ્રદીપ’ નામના શાસ્ત્રમાં કહે છે તે મુજબ અનિયત પણ છે, અર્થાત નિયતાનિયત છે. અનેકાંતવાદ અહીં પણ લાગુ પડે છે.

ભવિતવ્યતા નિયત એટલે નક્કી થયેલી ખરી, અને અનિયત એટલે નક્કી નહિ પણ થયેલ ખરી.

આમા નિયત એ દૃષ્ટિએ કહેવાય છે કે અમુક જાતનું કાર્ય બનવાના યા અટકવાના સંયોગ-સામગ્રી હાજર હોય છતાં નિયત ભવિતવ્યતા તેમ ન થવા દે.

પ્ર.- શું સામગ્રી મોજુદ હોય તો કાર્ય ન થાય એમ બને ? જો બને તો એ કારણ-સામગ્રી શી રીતે કહેવાય ?

૩.- કારણ-સામગ્રીમાં કાળ, સ્વભાવ, કર્મ-જન્ય નિમિત્તો અને ઉદ્યમની જેમ ભવિતવ્યતા પણ અન્તાર્ગત છે. એટલે અનુકૂળ ભવિતવ્યતા વિનાની બાકીની કારણસામગ્રી હાજર છતાં કાર્ય ન બને એ સહજ છે. એમ કાર્ય અટકવાની બીજી સામગ્રી હાજર છતાં ભવિતવ્યતા જુદી જ નિર્ધારિત હોઈ કાર્ય બની જાય એ પણ બનવા જોગ છે. દા.ત. ગોશાળો મહાવીર પ્રભુ પાસે તેજોલેશ્યાની વિદ્યા માગે છે. પ્રભુ જાણે છે કે એ લાયક નથી, એટલે તેજોલેશ્યા ન શીખવવાના સંયોગ ગણાય. પરંતુ નિયત ભવિતવ્યતા વિચિત્ર હતી તો કાર્ય અટક્યું નહિ અને ભગવાનના મુખેથી તેજોલેશ્યાની વિદ્યાનું શિક્ષણ અને મળ્યું. અહીં ભગવાન ભૂલ્યા નથી કેમકે તીર્થકર દેવોનું અંતિમ સાધકજીવન લોકોત્તર અને ખૂબ જ સાવધાનીભર્યું હોય છે.

૨૪૮

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

પરંતુ ભવિતવ્યતાએ જોર માર્યું, અને કાર્ય થયું.

કાર્ય ન થવાના દાખલા તરીકે જંગલમાં અજિન સળગાવી હંટોડા પર ખીચડીની હાંલ્ટી ચાઢાવી, અહીં ખીચડી તૈયાર થવાની સામગ્રી મળી આવી. પરંતુ ભવિતવ્યતા જો પ્રતિકૂળ હોય છે તો ગમે તે કારણે હંટોકું ખસી જતાં હાંલ્ટી નીચે પડી ખીચડી ધૂળભેગી થાય છે. આ નિયત ભવિતવ્યતા.

એમ ઉદ્ઘમ અને નિમિત્તોએ તે તે કાર્ય નીપજે છે, પરંતુ ચોક્કસ સંયોગ-પરિસ્થિતિમાં કાર્ય નીપજે છે ત્યાં નિયત ભવિતવ્યતા કામ કરે છે. દા.ત. અજિનશર્માને તીવ્ર કષાયમાં નિયાણું બાંધ્યું કે ગુણસેન રાજના જીવને ભવોભવ મારું. અહીં આ કષાયની ગાંઠનું કાર્ય એટલું કે ભવિષ્યમાં ખૂન કરવાના તીવ્ર કષાય ઉઠે. તેમ ગુણસેન સમરાદિત્યના જીવના તેવા કર્માનું કાર્ય એ કે પોતાનું ખૂન થાય. પરંતુ અજિનશર્માના જીવના હાથે જ એ થયા કરે એવી પરિસ્થિતિ કોણ ઊભી કરી આપે છે? જવાબ એ જ કે ભવિતવ્યતા. એ બંનેને જુદા પડ્યે અસંઘ્ય કાળના વહાણાં વહી જવા છતાં પાછા બંનેને એક સગાઈમાં લઈ આવે છે. માટે કહેવાય છે કે, સમરાદિત્યના જીવ રાજ સિંહકુમારના પુત્ર તરીકે અજિનશર્માનો જીવ જ ભવિતવ્યતાના યોગે થાય છે. એવું બીજા ભવોમાં માતા પુત્ર વગેરે તરીકે અજિનશર્માનો જીવ જ થાય એ નિયત ભવિતવ્યતાના યોગે. માણસને નરસા ભાગ્યના યોગે ખરાબ સગો મળવાનો હોય તે તો ગમે તે મળી શકે પરંતુ અમુક જ સગો મળે ત્યાં નિયત ભવિતવ્યતા કારણ ગણાય.

એમ માણસનું ભાગ્ય ખીલવાનું કે રૂઢવાનું હોય ત્યારે ભવિતવ્યતાના યોગે ચોક્કસ પ્રકારના સંયોગમાં મુકાઈ જાય છે. દા.ત. ભાગ્ય દેવતાઈ રોજની નવી ૮૮ પેટી ભોગવવાનું છે તો ભવિતવ્યતાના યોગે પિતા જ એવા મળેલા કે જે દેવ થઈને એ પૂરી પાડે. એમ, ધનાજીના ભાઈઓને ભાગ્ય રૂઢવાનું છે તો ભવિતવ્યતાને લીધે બરાબર તે પૂર્વે ભાગ્યશાળી ધનાજી ચાલ્યા જાય છે. પિતા જ પેટીઓ પૂરી પાડે કે ધનાજી જ જાય તો ભાઈઓ દરિદ્ર થાય, એમાં ભવિતવ્યતાને કારણ કહેવું પડે.

એમ માણસનું ભાગ્ય અજિનમાં સળગી મરવાનું હોય પણ અમુક જ સમૂહની સાથે ગંજાવર આગમાં બળી મરવાનું બને તે ભવિતવ્યતાના યોગે કહેવાય.

અથવા શિકારીએ અમુક પક્ષીને મારવા બાણ તાક્યું, એ પક્ષી પાછળ પાછું બીજું બાજ પક્ષી પડ્યું હતું, હવે અહીં શિકારીને પગે કીડીનો ચટકો લાગવાથી તીર વાકું છૂટ્યું અને એ બાજ પક્ષીને જ લાગ્યું, પાછું છૂટેલું પક્ષી બીજા શિકારીના બાણમાં ફસાયું. આ વિચિત્ર ઘટના ભવિતવ્યતાના યોગે થઈ.

આ નિયત ભવિતવ્યતાની વાત થઈ, હવે એ અનિયત કેવી રીતે તે જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૮, તા. ૨-૧૧-૧૯૬૩

(લેખાંક-૨)

ભવિતવ્યતા અનિયત પણ છે, અનિયત એ રીતે કે પુરુષાર્થનો જોક જેવો બદલાય છે, એના આધારે જ એ બનાવોનું નિર્માણ થાય છે. એ દસ્તિએ ભવિતવ્યતા પહેલેથી નિયત ન રહી. અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પુરુષાર્થ એ કાંઈ ભવિતવ્યતાનો પેટા અંશ નથી, કેમકે બંનેના સ્વરૂપ તદ્દન જુદા છે. અંશ તો તે કહેવાય કે જે મૂળ વસ્તુની ખાસિયત ધરાવતો હોય. દા.ત. હાથ શરીરનો અંશ છે તો શરીરની ખાસિયતો એ ધરાવે છે, જ્યારે ભવિતવ્યતાની ખાસિયત તો એ છે કે નિશ્ચિત થયેલી વસ્તુ છે, પણ પુરુષાર્થ એ કરવાની છે, સહજ થનાર નહિ, જીવને પુરુષાર્થ કરવો હોય તો કરે, ન કરવો હોય તો નહિ, જીવથી એ સહેજે થઈ જવો નથી, કરવો પડે છે, કરે તો થાય.

વળી પાંચ કારણોમાં જેમ ભવિતવ્યતા એ સ્વતંત્ર કારણ છે, તેમ પુરુષાર્થ પણ એક અલગ કારણ છે. અલબજ્ઞ પાંચ કારણોમાં એકને બીજાનો આધાર રાખવો પડતો હોય એવું બને, દા.ત. ભાગ્યને પુરુષાર્થ આદિનો આધાર રાખવો પડે છે, પુરુષાર્થ કરવાથી ભાગ્યનું નિર્માણ થાય છે. તેમ ભાગ્ય જેટલી સામગ્રી આપે એના પ્રમાણમાં જ પુરુષાર્થ થઈ શકે છે. દેવતાને તેવું ભાગ્ય નહિ હોવાથી ચારિત્રનો પુરુષાર્થ એ જરૂરી જાણવા છતાં નથી કરી શકતો. આમાં પુરુષાર્થને ભાગ્ય પર આધાર રાખવો પડ્યો. આમ છતાં ભાગ્ય પણ એક સ્વતંત્ર કારણ છે. પુરુષાર્થનો અંશ નથી. તેમ પુરુષાર્થ એ ભાગ્યનો અંશ નથી. બેના સ્વરૂપ જુદા છે. એ જ રીતે પુરુષાર્થ એ ભવિતવ્યતાનો અંશ ન ગણાય. માટે એમ ન કહી શકતો કે ‘ભવિતવ્યતાએ તેવો પુરુષાર્થ થવાનો હતો તેથી પુરુષાર્થ થયો.’ પુરુષાર્થ જીવ કરે છે તો તેવા બનાવ બને છે, એ દસ્તિએ બનાવ બનવાની ભવિતવ્યતા પહેલેથી નિયત નહિ, અનિયત ગણાય. માટે જ કહેવાય છે કે આવો પુરુષાર્થ કર્યો માટે આવી સ્થિતિ બની.

દા.ત. મહાવીર પ્રભુના જીવ મરીચિએ ત્રીજા ભવમાં ઉત્સૂક ભાષણ કર્યું એથી એમનો સંસાર વધી ગયો.

‘મરીચિ કહે ધર્મ ઉભયમાં, (કપિલ) દીક્ષા લીએ યૌવન વયમાં, એણે વચ્ચે વધ્યો સંસાર એ ત્રીજો કાંચો અવતાર.’

અહીં એ જોવા જેવું છે કે જો એટલો સંસાર હોવાની ભવિતવ્યતા પહેલેથી નિયત હતી તો પછી સંસાર વધ્યો કેમ કહેવાય? વધ્યાનો અર્થ તો એ કે પહેલાં

ટૂકો હતો તે હવે લાંબો થયો. જેટલો લાંબો થયો એટલા સંસારની ભવિતવ્યતા નિયત નહોતી, અનિયત હતી.

પ્ર.- એટલા લાંબા સંસારની ભવિતવ્યતા તો નિયત હતી માટે જ એણે એવો પુરુષાર્થ કરાવ્યો એમ કહેવાય ને ?

૩.- આ તો ધોડા આગળ ગાડી ચાલવા જેવી, કે છોકરાએ પોતાના બાપને જન્મ આય્યા જેવી વાત છે ! એટલા લાંબા સંસારની ભવિતવ્યતાનો અર્થ શું છે ? એ જ કે સંસારના બનાવોની હારમાળાનું થવા પણું. એ તો પુરુષાર્થનું કાર્ય છે, પુરુષાર્થ એનું કારણ છે. એ તો પુરુષાર્થની પછી બનવાની વસ્તુ છે. હવે ભવિતવ્યતાએ અર્થાત્ એ હારમાળાના થવાપણાએ પુરુષાર્થને જન્મ આય્યો એમ કહેવું એ તો કાર્યે કારણને પેદા કર્યું, પુત્રે બાપને પેદા કર્યો એમ કહેવા બરાબર થાય ! ધોડા આગળ ચાલે, પાછળ ગાડી ઘસડાઈ આવે, એમ પુરુષાર્થ પહેલો થાય એની પાછળ એ સંસાર ચાલ્યો આવવાનો. પુરુષાર્થ વખતે તો એનું અસ્તિત્વ જ નથી પછી એ પુરુષાર્થને શી રીતે જન્મ આપી શકે ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૮, તા. ૮-૧૧-૧૯૬૩

(૧૧૭) (લેખાંક-૩)

કાર્યનું કોણ વાસ્તવિક કારણ છે તે તપાસવું પડે. અસત્ત પુરુષાર્થથી જીવ સંસારમાં ડૂબે છે અને સત્ત પુરુષાર્થથી સંસાર તરી જાય છે, એ હકીકત છે, પણ નહિ કે ભવિતવ્યતાથી ડૂબે અને ભવિતવ્યતાથી તરે. એમ હોત તો તો પુરુષાર્થનું કોઈ મૂલ્ય જ ન રહેત. ધર્મશાસનની સ્થાપના, ધર્મશાસ્ત્રોની રચના, ધર્મનો ઉપદેશ, સંધ્યવ્યવસ્થા, વગેરે બધું નિરર્થક ઠરત ! જો ભવિતવ્યતામાં નિયત હોય એ જ બનવાનું હોય તો આ બધું શા માટે ? કોરી ભવિતવ્યતા અને ત્રિકાળી પર્યાયનો ઉપદેશ આપનારે એ ઉપદેશ આપવો પણ નકારો છે. કેમકે એ ઉપદેશથી શું વિશેષ ? નિયત બનવાનું તે બનવાનું જે છે, એમાં મીનમેખ ફેરફાર થવાનો નથી. પછી ઉપદેશ શા સારુ કરવાનો ? તળાવના પાણી પર પશુની પુંછનું પછાડવાની કિયા જેવી એ ઉપદેશની કિયા ગણાય.

કેટલાક કહે છે કે ‘જ્ઞાનીએ દીકું હોય એ જ બને છે તો આવો પુરુષાર્થ પણ એમણે દીકો હશે તો બની જશે.’

પરંતુ આ ખોટું છે, કેમકે આમાં કાર્યકારણની ઊંઘી સમજ છે. જેવી રીતે દર્શનમાં પાણીની ધારનું પ્રતિબિંબ પડતું હોય, ત્યાં પ્રતિબિંબ પડે છે માટે બહાર

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૨૫૩

જલધારા પડે છે એવું નથી, (કેમકે જ્ઞાની ધારા તો એની કારણ-સામગ્રીથી પડે છે.) પરંતુ બહારમાં જળધારા પડે છે માટે દર્શનમાં પ્રતિબિંબ પડે છે. એવી રીતે જ્ઞાની દેખે છે માટે વસ્તુ બની રહી છે એમ નથી. કિન્તુ વસ્તુ પોતાના કારણોથી બને છે માટે જ્ઞાની તેવું દેખે છે. જ્ઞાનીની દર્શિ વસ્તુ બનવામાં કારણ નથી. નહિતર તો ધારો કે કોઈ જીવ નરકમાં ગયો, તો ત્યાં શું જ્ઞાનીએ દેખ્યું માટે નરકમાં ગયો ? એવું હોય તો એવી જ્ઞાનીની દર્શિ કેટલી બધી કૂર ગણાય ? એ તો જીવ એવા આચરણથી નરકમાં ગયો માટે જ્ઞાની તેવું દેખે છે. આ હિસાબે જ્ઞાનીના દેખાવ પર આપણો ધર્મ પુરુષાર્થ નથી બનવાનો, પરંતુ પુરુષાર્થ તો આપણી ધર્મશ્રદ્ધા, ધર્મસમજ, અને ધર્મની ઈચ્છા પર બનવાનો છે, એ ધર્મગરજ વગેરે નહિ હોય તો પુરુષાર્થ ન કરવામાં જ્ઞાનીની દર્શિ, ભવિતવ્યતા વગેરેનું બહાનું કાઢશે.

માટે માનવું જોઈએ કે ભવિતવ્યતા નિયતાનિયત છે તેથી જ પુરુષાર્થનું વર્ચસ્વ છે. શુદ્ધ દિલે સત્ત પુરુષાર્થ કરવા છતાં કોઈ પૂર્વનિયત થયેલ ભવિતવ્યતાવશ કાંક અનિચ્છાનીય બની ગયું, તો પણ કરેલ સમ્યગું પુરુષાર્થનું ફળ આવવાનું જ છે, અને એ જીવને ઊંચે જરૂર લઈ આવશે. નવા પુરુષાર્થને અવકાશ મળશે અને એમ કમશઃ પરાકાણાના સત્પુરુષાર્થને અવકાશ મળી સિદ્ધિ થશે.

એથી ઊલટું ભવિતવ્યતા પર જ આધાર રાખી જો ધર્મ-પુરુષાર્થ ન કર્યો કે કરતા હતા તે છોડ્યો તો શુભ પુરુષાર્થ વિના એકલી ભવિતવ્યતા તો બિચારી અશુભ પુરુષાર્થના સહારે અધઃપતન સિવાય બીજું કાંઈ જ નહિ દેખાડે. દુન્યવી જીવનમાં ભવિતવ્યતા પર આધાર રાખ્યા વિના પુરુષાર્થને મુખ્ય કરીને જ બધું ચલાવાય છે. તો ધાર્મિક બાબતમાં પુરુષાર્થને ગૌણ કેમ કરાય ? જીવ કાંઈ ને કાંઈ પુરુષાર્થ તો કરવાનો જ છે, ભલે માનસિક વિચારનો પુરુષાર્થ, હવે જો શુભ પુરુષાર્થ નહિ કરે તો અશુભ પુરુષાર્થ કોટે લાગવાનો. એનું પરિણામ એકલું અધઃપતન.

એટલે ઉચ્ચ સત્પુરુષાર્થ માટે જ યોગ્ય એવા આ સુંદર માનવજીવનમાં જ્યાં જ્યાં જે જે શક્ય હોય ત્યાં ત્યાં તે તે માનસિક-વાચિક-કાચિક પુરુષાર્થ ચાલુ રાખવામાં જ પોતાનું હિત છે. અહીં ભવિતવ્યતા એ રીતે ઉપયોગી છે કે આમ છતાં આપણી આસપાસ બનતા બનાવ આપણને મુંજવતા હોય તો એમ વિચારવું કે ‘ભવિતવ્યતામાં આવી જ ઘટનાઓ જો નિયત થઈ ગયેલી છે તો એમ બનવા દો, મારે શા સારું એ મન પર લેવી ?’ ભવિતવ્યતાના વિશાળ પટ પર અંકિત થઈ ગયેલ ચિત્રો પર ક્યાંય કોઈનું ય પીંછું અરીય શકે એમ નથી, પછી ફેરફાર

૨૫૪

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

કરવાની શી વાત ? એવું નિર્ધારિત બને છે એમાં મારે ચિંતા-સંતાપનો ગોદો નહિ લગાવવાનો.' આથી મુંજવણ ટળી જશે. આપણી શક્ય બધી મહેનત છતાં છોકરો કે શિષ્યાઈ ન સુધરે તો સમજવાનું કે 'ભાવીભાવ એમ જ નિર્ધારિત હશે, મારી ઉતાવળ શી કામ લાગે ? મને તો મારા સત્ત-પ્રયત્નનું આંતરિક ફળ મળી જ ગયું છે, હવે આ જીવ પર મારે હૈયે વાત્સલ્ય નહિ ગુમાવવાનું.' એમ સ્વાત્મહિતના પુરુષાર્થમાં જે સંયોગપરિસ્થિતિવશાત્ પાછાં પડાય ત્યાં પણ આજ વિચાર રાખવાનો કે ભવિતવ્યતામાં આવી પરિસ્થિતિ નિર્ધારિત હોય તે કેમ અન્યથા થાય ? ફિકર નહિ, માનસિક પુરુષાર્થ તો મારી પાસે છે જ. આમ ભવિતવ્યતા પર જવાથી બીજાઓ પર દ્વેષ હુભર્વ કરવાનું નહિ થાય.

U

વિરાધનાભીરુ ગુરુદેવ

V

સવારના 'પડિલેહણ'ની બૂમ પડતા બધા સાધુઓ લાભ લેવા માટે પડાપડી કરવા માંડચા... એમાં એક સાધુએ પોતાને ભાગે આવેલ કપડું પડિલેહણના આશયથી ઝાટક્યું. એ ઝાટકવાનો અવાજ સાંભળીને પૂજ્યપાદ ગુરુદેવશ્રી ચોકી ઉઠ્યા... અને શાન્તિથી કહ્યું 'અરે ! આ રીતે પડિલેહણ થાય ? આમાં જગણા શું રહી ? આ તો પંખો થઈ ગયો... અસંખ્ય વાયુકાયનાં જીવની વિરાધના થઈ... એક મુદ્પત્તિનું પણ પડિલેહણ કરવું હોય તો પણ કેવી કાળજીથી ફેરવવાની હોય છે. જરાક પણ પવનની ઝાપટ ના લાગવી જોઈએ. આમાં તો એકાદ જીવની રક્ષાને બદલે અસંખ્ય જીવની વિરાધના થઈ જાય છે એટલે પડિલેહણ સાવધાનીથી કરો...''

પૂજ્યપાદ ગુરુદેવશ્રીનું સંયમ અને વાયુકાય જીવો પ્રત્યે પણ અમાપ કરુણારસ સાંભળનારા બધાને ભીનો ભીનો કરી ગયો. પૂજ્યપાદ ગુરુદેવશ્રીની આવી કાળજીભરી સારણાથી ગાદ્ગાદ થયેલ સાધુઓ મનોમન મસ્તકથી ઝૂકી ગયા.

-“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર X

W

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૧૦, તા. ૧૬-૧૧-૧૯૬૩

૧૧૮ લહાવા કચાં લૂંટવા ?

માનવ જીવનમાં બે વસ્તુ નજર સામે છે,-એક, અનેક પ્રકારના પુષ્ય-શુભકર્મના ઉદ્ય, અને બીજ, અનેક પ્રકારની ધર્મ-આરાધનાની તક. ‘પ્રશ્ન આ છે કે પુષ્યોદયના લહાવા લૂંટવા ? કે ધર્મની તકના લહાવા લૂંટવા ?

અનાદિવાસનાની પકડમાં જ્કડાઈ રહેલા જીવની દશા પુષ્યોદયના લહાવા લૂંટવા તરફના ઝોકની રહે છે. એટલે જે જે પુષ્ય ઉદ્યમાં વર્તે છે, અને કેમ ભોગવી લઉં, કેમ એમાંથી સુખના અનુભવ કરી લઉં- એ રીતની તલપમાં રહે છે. એનું ચાલે ત્યાં સુધી એક પણ પુષ્ય-પ્રકારનો આ લહાવો લૂંટવા વિના જતો કરવા એ તૈયાર નથી, પછી ભલે એ લહાવામાં ભલીવાર ન હોય, તુચ્છ આનંદ હોય.

દા.ત. ચાર જણાની વચ્ચેમાં જઈને ઊભો રહે, ત્યાં પેલા પ્રશંસા કરે, એવું પોતાનું પુષ્ય છે, તો જટ અનો, લહાવો લઈ લેવાનું મન થાય છે અને ત્યાં જઈને ઊભો રહે છે. દિવસમાં બે જણ ટંકને બદલે પાંચ સાત ટંક ખાવાનું પુષ્ય પહોંચે છે, તો એમાંથી એક પણ ટંક ઓછો કરી એ પુષ્યનો લહાવો જતો કરવા તૈયાર નથી. કપડાને એક પણ કરચલી ન પડે એવો પોશાક પહેરવાનું પુષ્ય પહોંચે છે, તો એનોય લહાવો લૂંટવા સહેજ પણ કરચલી ન પડવા દેવા બરાબર કાળજી રાખે છે, મન અનેકવાર ત્યાં લઈ જાય છે.

આવા આવા તુચ્છ પુષ્યના ય લહાવા લૂંટવામાં સજાગ રહે ત્યાં મોટા પુષ્યના ય લહાવા લૂંટવામાં તો શું બાકી રાખે ? પેસા જેટલા મળવાનું પુષ્ય પહોંચતું હોય એટલા બધાયનાં પુષ્યનો લહાવો લઈ લેવો છે. એમ ખાન-પાન, માન-સન્માન, એશ-આરામી, રંગ-રાગ, સત્તા હુકરાઈ વગેરેના પહોંચતા બધાં જ પુષ્યના લહાવા લૂંટવામાં લેશમાત્ર બાકી રાખવું નથી ગમતું.

ત્યારે આ વિચારણીય થઈ પડે છે કે,

શું આ જીવન જીવવાનું માત્ર પુષ્યોદયના લહાવા લેવા માટે જ છે ?

શું જનાવરને ય કે કીડા-મંકોડાને ય આ નથી આવડતું ?

તુચ્છ આનંદદાયી પુષ્યાઈના લહાવા લૂંટી લીધા પછી પુષ્યાઈ ઊભી રહેવાની કે તળિયા સાફી ?

પુષ્યના એ લહાવા લૂંટવાની લત અને લપમાં બીજા કલ્યાણ લહાવા આદરી લઈ નવી પુષ્યાઈ કમાઈ લેવાનું રહી જશે તેનું શું ?

પુણ્યાઈ ઊભી કરવાનું બન્યું નહિ અને હતી એ લહાવા લૂંટવામાં ખત્મ કરી પછી જીવની પરલોકમાં ગતિ કરી ?...

જો આ બધો વિચાર કરવામાં આવે તો માણસ તુચ્છ આનંદ કે મનની ક્ષણિક મોજ દેનારા એ લહાવા લૂંટવામાંથી થંભી જાય. એને દેખાય કે આ મનુષ્યજીવનનું મૂલ્ય વિવિધ ધર્મસાધનાઓની તક મળવામાં છે, પશુ કરતા વિશિષ્ટ શરીર છે માટે વિશિષ્ટ રંગરાગ જેલી શકવા પર જીવનની વિશેષતા નથી, કિન્તુ અનેક પ્રકારના વિવેક અને તપ, ત્યાગ, સંયમ, પરોપકારની તક મળવા સફળ કરવા પર માનવભવની વિશેષતા છે.

જરાક મન સ્વસ્થ કરાય, રાગ-તૃષ્ણાઈ વ્યાકુળતાઓ શાંત કરાય, તો આ સમજાય એવું છે કે લહાવા તો મળેલી મહાદુર્લભ, દેવને દુર્લભ ધર્મતકના લેવામાં વિશેષતા છે, નહિ કે તુચ્છ ભોગના લહાવા લેવામાં.

આપણા નાથ મહાવીર ભગવાનને પુણ્યાઈમાં શી કમીના હતી ? એક જ યશોદા શા માટે, અનેક રાજકુમારીઓને પરણી શકે એવી જોગવાઈ હતી. સેવક દેવતાઓ બધું બરાબર કરી દે. મોટા રાજ્યોના માલિક બનાવી દે એવી તાકાત કીર્તિ વગેરેની પુણ્યાઈ પહોંચતી હતી. છતાં પ્રભુએ એના લહાવા લીધા ? શરીરનું બળ બાળપણે સુરગિરિ ડોલાયા એવું, છતાં ગોવાળિયો કાનમાં ખીલા ઢોકવા આવ્યો ત્યાં એ બળનો જરાય લહાવો ન લીધો ! આંખની ભમર સરખી ઊંચી ન કરી ! શૂળપાણી યક્ષે રાતના લગભગ નવ કલાક ભયંકર વેદનાઓ ઉપજાવી, આંખે, કાને, નખમાં...એવી કારમી વેદના કે જે એકમાંય આપણા જેવાનું તો મોત થઈ જાય ! પ્રભુ પાસે ઈન્દ્રની લાગવગની પુણ્યાઈ પહોંચતી હતી છતાં એમણે એનો લહાવો ન લૂંટ્યો...યક્ષને એટલુંય ન કહ્યું ‘ધ્યાન રાખજે, તારો માલિક ઈન્દ્ર મારો સેવક છે, એને બબર પડી પછી તારી કર્દ વલે ?’ પ્રભુને શું રોજ લિક્ષા મળવાનું પુણ્ય નહોતું ? હતું, છતાં દીક્ષાથી માંડી કેવળજ્ઞાન સુધીના સાડા બાર વર્ષમાં એનો લહાવો લૂંટી લેવાને બદલે ઓછામાં ઓછા બબ્બે ઉપવાસે પારણું રાખ્યું ! તેથી સાડા બાર વર્ષમાં પંદરસો લગભગ પારણાં આવે, પણ પ્રભુએ તો માત્ર ઉછ્ચ પારણે જ પતાવ્યું ! આ ધોર તપ, ઉપસર્ગ-પરીસહ સહન, નિરંતર કાઉસગગધ્યાને ખડા રહેવાનું...આ બધું શું ? એ જ કે માનવ જીવનમાં મળેલી ધર્મસાધનાની તકના જેટલા લહાવા લૂંટાય એટલા લૂંટી લેવાની જ એકમાત્ર લગની, લેશ્યા અને પરાક્રમ.

પુણ્યાઈ નહિ ભોગવી લઈએ તો એ કટાઈ જશે એવો ભય રાખવા જેવો નથી. ઊલટું ધર્મની તકના તનથી, મનથી અને ધનથી લૂંટાય એટલા લહાવા પળ

પળ લૂંટવાથી પુણ્યાઈ અઠળક વધી જાય છે. માટે શોધતા રહેવું કે શું પુણ્યની અનુકૂળતામાં કે પાપની પ્રતિકૂળતામાં વાણી, વિચાર કે વર્તાવથી કયો ધર્મ સાધવાની તક છે ? શોધી કાઢી એ તકનો લાભ લેવા મથવું.

U

First attract Then Attack

એક વાર એક છોકરો ઉપાશ્રયમાં વંદન માટે આવ્યો. પૂજ્યપાદશ્રીએ તેને પૂછ્યું : “શું ભણો છે ?”

તેણે જવાબ આપ્યો : “Seventh”

“કોન્વેન્ટમાં ભણો છે ?” “ચા”....

પછી તો પૂજ્યપાદશ્રીએ તેની સાચે અંગેજુ ભાષામાં જ વાતો કરી. ગુરુદેવશ્રીએ તેને કહ્યું : “જો તું અંગેજુનો ખાં છે, તો એક ખાલી જગ્યા પૂરી આપ : “They is a”

“ગુરુજી ! આપનું વાક્ય ખોટું છે, They ની સાચે are આવે, is ન આવે. કારણ કે ‘They’ plural = બહુવચન છે.” “તું ખાલી જગ્યામાં એવો શબ્દ મૂકને, કે is હોવા છતાં વાક્ય સાચું બને.”

પેલો છોકરો ખૂબ હોશિયાર હતો છતાં તે આ પ્રશ્નનો જવાબ ન શોધી શક્યો. તેણે હાર સ્વીકારી. “ગુરુજી, આપ જ જવાબ આપો.”

પૂજ્યશ્રીએ જવાબ આપ્યો : “They is a pronoun”- “દે એક સર્વનામ છે.” જવાબ સાંભળીને છોકરો અત્યંત આનંદિત બન્યો અને પૂજ્યશ્રીએ અત્યંત આવર્જિત બન્યો. પૂજ્યશ્રીએ ગમ્મત અને રમૂજ માટે પ્રશ્ન નહોતો પૂછ્યો. કોન્વેન્ટના ધર્મવિમુખ છોકરાને ધર્મસ્થાનનું આકર્ષણ ઊભું કરાવવું હતું. પછી તો ખૂબ ધર્મપ્રેરણા સીંચી. છોકરાએ કોન્વેન્ટ સ્કૂલ તો છોડી, આખો સંસાર છોડ્યો. આજે તે જૈન શાસનનો અણગાર છે.

પૂજ્યશ્રીએ કેવી પોલીસી અપનાવી ! Fist Attract Then attack.

W

—“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

૧૧૬ જીવન માટી થતું અટકાવો

ગયા લેખમાં એ વાત થઈ કે લહાવા લૂંટવા તે પુણ્યના લૂંટવાને બદલે ધર્મની તકના લૂંટવા જોઈએ, એના અનુસંધાનમાં આ વિચારવાનું છે કે, પુણ્યના સર્વ ઉદ્દ્ય યથેચું રીતે ભોગવી લેવામાં સુવર્ણજીવન પણ કેવું માટી થઈ જાય છે.

જીવનમાં એવા ધ્યાં પ્રસંગ આવે છે કે જ્યારે જો સાવધાન ન રહીએ તો આપણો પુણ્યોદ્ય જીવનને માટી બનાવવા તરફ ઘસડી જાય છે. પુણ્ય પહોંચતું ન હોત તો હજ્ય બચત, પણ પુણ્યની અનુકૂળતા છે માટે જ ઊંઘું વેતરણ થાય છે.

દા.ત. પુણ્યાઈના જોર પર જ્યાં ને ત્યાં રોફ બજાવવાનું મન થાય છે. અરે ! રોફથી વાત કરવાની એટલી બધી જરૂર પણ ન હોય, છતાં એવો પુણ્યોદ્ય પહોંચે છે કે રોફ પર સામેથી એવો જોરદાર જવાબ નથી આવવાનો એટલે જ રોફ, અભિમાન અને તોછાઈથી બોલવાનું કરાય છે. હા, જો સામેથી આપણા લમણામાં વાગે એવો સાંસસાંશતો બોલ કે ભારે રોફ યા અપમાન આવવાનું દેખતું હોત, તો ત્યાં રોફ બતાવતાં પહેલાં જ વિચાર કરત, રોફ દેખાડવાથી અટકી જાત.

આવું બહુ જોવા મળે છે. પોતાની પાસે ૫-૫૦ હજારની સંપત્તિ હોય તો બીજા ૫-૧૫ કે વધુ લાખ રૂપિયાવાળાની સામે રોફથી વાત કરવાનું નથી કરાતું, પણ પોતાના સમાન કે નીચેની સ્થિતિવાળા આગળ રોફથી વાત કર્યે જવાય છે. કેમ આવો ભેદ ? કહો એટલા જ માટે કે, ઉપરવાળાની અપેક્ષાએ પોતાનું પુણ્ય કાચું છે, તેથી ખોટું સાહસ નથી થતું, નહિતર રોફનું સાહસ કરવા જતાં સામેથી તમાચા પડે ! નીચેવાળા તરફથી એ ભય નથી, એટલે એની અપેક્ષાએ જે પુણ્યનો ઉદ્દ્ય વર્તી રહ્યો છે એનો જટ ઉપયોગ કરી લેવાનું, આ લહાવો લૂંટી લેવાનું મન થાય છે કે ‘બસ ! રૂઆબથી વાત કરવી. સામાને તુચ્છ હલકા અને ઉત્તરતા લેખી દબાવવા.’ જીવન આવું ને આવું ડાખિયા કૂતરા જેવું જીવી માટી જેવું ધૂળધાઢી કરાય છે. ડાખિયો કૂતરો શું કરે છે ? પોતાનાથી હલકાને જ્યાં ને ત્યાં દબાવતો ફરે છે. જેની તેની સામે રોફના ભસવાટ કર્યે રાખે છે, કેમકે એની પાસે પુણ્ય પહોંચે છે.

માણસ જેવો માણસ આ પશુના ખેલ ખેલે એ એનું ભાવી ભારે કરે છે

કારણ એ છે કે એવા રોફ બજાવે રાખવામાં ભારોભાર અભિમાન કષાય પોષાય છે, બીજાને હલકી દાઢિથી જોવાનું કરાય છે, સામાના હૈયાના તાર તોડવાનું કરાય છે, એટલે જરૂર પછે આમાં કષાય, મિથ્યાત્વ અને હિસાના પાપોનું સેવન આવીને ઊસું રહેવાનું પુણ્ય મળ્યું એના પર આ સરાસર દુરુપ્યોગ છે. એ જીવને પુણ્યરહિત અને પાપ-કચરાથી ઠસ ભરેલો કરે એ સુવર્ણજીવનને માટી બનાવવાનું થયું કહેવાય.

એમ જરા કુશાગ્ર બુદ્ધિનું પુણ્ય મળ્યું તો બીજાની મશકરી કરવાનું, બીજાની બનાવટ કરવાનું કે માયા રમવાનું કરાય છે. આ પુણ્ય ન હોત અને બુદ્ધિ મંદ હોત, એટલી આવડત હોત નહિ, તો આ કરત ? ના, પુણ્ય છે માટે કેમ એનો ઉપયોગ ન કરવો ? પછી ભલે ગેરઉપયોગ, તો તે સહી ! આ પણ જીવનને કૂચા જેવું કરે છે, કેમકે એ લતમાં હૈયું એટલું તુચ્છ રહે છે કે ત્યાં પ્રાય: ઊંચી ભાવના, પ્રશસ્ત વિચારસરણી અને ગુણગ્રહણની જગ્યા જ રહેતી નથી રહેતી. પુણ્યના જોર પર હલકી મનોવૃત્તિ અને વાણી વર્તાવમાં જીવન રગડોળી નખાય છે.

એવું જ પુણ્યની પહોંચ પર વધુ પડતા વ્યવહાર, વિલાસ અને વટના ખર્ચ કરવામાં પુણ્યના લહાવા લેવાનું મન થાય છે. આજે આ બહુ ચાલી પડ્યું છે. તેથી જ ધર્મની કિંમતી તકો મળેલી છતાં એનો ઉપયોગ કરવા તરફ બેપરવાઈ રહે છે. દેવ-ગુરુ-ધર્મ, જ્ઞાન અને સંધની સેવાના નિત્ય બજાવવાનાં કર્તવ્ય માટેનો કોઈ ભાર માથે નથી રખાતો. ‘એ ન કરીએ તો ચાલે. એ વિના પણ આપણે ધર્મ છીએ. ધર્મ એવો રોજનો હોવો જ જોઈએ એવું કાંઈ નહિ,’ વગેરે માન્યતાઓ ધરાઈ જાય છે. ‘આશ્રય છે કે સંસારના વટ-વિલાસ-વ્યવહારમાં જરાય ઓદ્ધું નથી ચાલતું. ઓદ્ધું માત્ર જ નહિ, અધિક ખર્ચને જીવ જંપે છે ! આ બધું શાના ઉપર ? પુણ્ય પહોંચે છે એના પર. પુણ્ય પહોંચતું ન હોત તો તો હાથ જોડી બેસી રહેત, પણ પહોંચે છે તેથી એનો આવો ઉપયોગ કરી લેવા હોંશ અને ધગશ રખાય છે.’

આમાંય સુવર્ણતુલ્ય માનવભવની માટી થઈ રહી છે, કેમકે લાંબા ખર્ચ કરીને પળતા સાંસારિક વ્યવહાર સંસારભાવનાને મજબૂત કરે છે. એક ચીજાના બહુ વ્યવહાર એની રમણતાને પોષે એમાં નવાઈ નથી. ત્યારે ખર્ચ કરીને બહુ વટ-મોભો ને દર્સો રાખવામાં માનાકંશા, અભિમાન, બાધ્યભાવ અને જડના જ પક્ષપાત પુષ્ટ બને છે. એમ, વિશેષ ધનવ્યદ્વારા કરતા વિલાસ અને રંગરાગ અનાદિની વિષયસંજ્ઞાની નાગચૂડને મજબૂત કરે છે. ઇન્દ્રિયોની પાકી ગુલામી માથે લાદે છે. ક્ષણિક જડ-સુખનાં અંજામણ ધેરા બનાવી નિવૃત્તિનાં સ્થિર વાસ્તવિક

સુખની કલ્પનાને પણ આવવા દેતા નથી. આ બધું પુષ્યના ખોટા લહાવા લૂંટવાની ધૂનને આભારી છે.

આ સંસારમણાતા, અભિમાન અને વિષયગૃહી ઉત્તમ ધર્મશાસનની પ્રાપ્તિને નિષ્ફળ કરી જીવને દીર્ઘકાળનાં ભવભ્રમણ સાધી આપે છે. એમાં વર્તમાન જીવન માટી જ થયું કહેવાય. માટે પુષ્યના એવા લહાવા લેવાને બદલે મળેલી ભવ્ય ધર્મતકોને એ જ પુષ્ય-સામગ્રી દ્વારા સફળ કરી લેવી હિતાવહ છે. એમાં સુવર્જ જીવનથી આત્મહિતરૂપી રત્નો ખરીદી લેવાનું થયું કહેવાય.

ક્ષેક્ષણના સાધક

પૂજ્યપાદશ્રી રાત-દિન-શાન-ધ્યાનમાં મસ્ત રહેતા. કોઈ જિજ્ઞાસુ ધર્મબોધની જિજ્ઞાસાથી આવે કે કોઈ શાસનના મહત્વના કાર્ય માટે આવ્યું હોય તો પૂજ્યશ્રી જરૂર તેમને સમય ફળવતા. પણ, કોઈ ગૃહસ્થ આવા કોઈ કારણ વગર નિરર્થક વાતો કરવા બેસી જાય તો તેવો સમય વેડફ્વો પૂજ્યશ્રીને જરાય પાલવતો નહિ. પણ, તેમ કોઈને ઉઠાડી તો કેવી રીતે મૂકાય ? તેથી પૂજ્યશ્રીએ એકવાર મને કહ્યું :

“જો ગુણસુંદર ! મારે સમયની પુષ્કળ તંગી રહે છે. વળી, નિરર્થક વાતોમાં એક મિનિટ પણ બગાડવી તે પ્રમાદ છે. પણ, કોઈને ઉઠાડી મૂકીએ તો તેને તારક ગુરુતત્વ પ્રત્યે દુભર્વિં થવા સંભાવના છે. તેથી તારે એક કામ કરવાનું. કોઈ ગૃહસ્થ નિરર્થક વાતો કરવા માટે પાસે બેઠેલા દેખાય ત્યારે જે શાસ્ત્રપંક્તિ તને ન સમજાતી હોય તે સમજવા આવી જવું, જે થી પ્રમાદને બદલે સ્વાધ્યાય થાય અને આપણને કામમાં રોકાયેલા જોઈને પેલા ભાઈ સ્વયં ઊઠી જાય.”

મેં કહ્યું : “ભલે ગુરુદેવ ! આ બાબતમાં હવેથી હું બરાબર કાળજી રાખીશ.”

પૂજ્ય ગુરુદેવશ્રીની એક-એક સેકંડ બચાવવાની કાળજી જોઈને હું તો ઓવારી ગયો.

—“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર-

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૧૨, તા. ૩૦-૧૧-૧૯૬૩

૧૨૦ વિવિધ ધર્મો અને ધર્મની તકો

(લેખાંક-૧)

સુવર્જસમું માનવ જીવન ઈન્દ્રિયોનાં વિષય-તર્પણ અને મનનાં કષાયસેવન દ્વારા પુષ્યના લહાવા લેવામાં માટી થઈ રહ્યું છે, એનો વિચાર ગયા લેખમાં કર્યો છે. જ્યાં જ્યાં પુષ્ય યારી આપે, અનુકૂળ રહે, ત્યાં ત્યાં જો એનો આ રીતે જ લહાવો લૂંટી લેવાનો હોય તો એમાં મનુષ્યજન્મની ઉચ્ચતા શી કારગત બને ? પુષ્યો લઈ આવ્યા છીએ એટલે સગવડ મળવા અને સત્તા-શાણપણ દેખાડવાના અવસર તો મળી આવે. પરંતુ શું એના એજ ઈન્દ્રિયોનાં વિષયતર્પણ અને મનનાં કષાયસેવન ચાલુ રાખવાના ? શું એ જ રીતે લહાવા લઈ પુષ્યો સફા કરી દેવાના ? જીવન માટી કરવાનું ?

ખરી રીતે એમાં રહેલી ધર્મની તક તરફ ધ્યાન રાખવાનું છે, અને એ તકનો લહાવો લઈ લેવા જેવો છે. એનો લાભ ઉઠાવી લેવો જોઈએ. ત્યારે જો જીવનમાં આ તક સાધવાનીજ ગણત્રી હોય, તો તો શું કોઈ પુષ્યોદય કે શું પાપોદય, બંને ઠેકાણે ધર્મની તક શી છે એના તરફ મુખ્ય લક્ષ જશે, અને એ શોધીને એને સફળ કરી લેવા માટે પહેલો પુરુષાર્થ થશે.

ભગવાન જિનેશ્વરદેવનું શાસન આપણને આ સંબંધમાં અદ્ભુત માર્ગદર્શન આપે છે. દરેકે દરેક જીવન ઘટનામાં કેવી રીતે ધર્મતકો છુપાયેલી છે, એનો પ્રકાશ જિનશાસન-જિનાગમરૂપી દીવો આપે છે. આ તકોને ઓળખવા માટે પહેલાં અહીં જિનાગમ ધર્મ કેટલા પ્રકારનો બતાવે છે તે જોઈએ. એનો વિસ્તાર જાણ્યા પછી તો આપણા જીવન-પ્રસંગોમાં એમાંથી કયાં ક્યો ધર્મ કેવી રીતે લાગુ પડે છે એટલું જ જેવું રહે છે.

ધર્મના ચાર પ્રકાર છે.-

- (૧) સમ્યગ્દર્શન-શાન-ચારિત્રદુપ ધર્મ;
- (૨) દાન-શીલ-તપ-ભાવનારૂપ ધર્મ;
- (૩) સાશ્વત-નિરાશ્વત ધર્મ, અને
- (૪) અધ્યાત્મ-ભાવના-ધ્યાન-સમતા-વૃત્તિસંક્ષયરૂપ ધર્મ.

હવે આ ચારને જરા વિસ્તારથી વિચારીએ.

(१) सम्यगदर्शनरूप धर्ममां जिनेश्वर भगवंत अने ऐमना वयन पर अथाग राग अने श्रद्धा आवे, तेमજ ए श्रद्धाना पोषक निस्संक्षिय निकंभिय,... उपबुंहणा...साधर्मिक-वात्सल्य वगेरे ८ आचार तथा ४ सद्हणा, ३ शुद्धि वगेरे ६७ व्यवहार अने देवदर्शन-पूजनादि करणी आवे. सम्यगज्ञानमां वीतराग सर्वज्ञ प्रभुना शास्त्रनुं अध्ययन-अध्यापन वगेरे, तथा काण-विनय बहुमानादि ८ आचार ए स्व-परमां ज्ञानवृद्धिनी करणी आवे. सम्यक्यारित्रमां हिंसादि पापोनी विरतिनुं ज्ञवन तथा समिति-गुप्तिना आचार अने संवर-निर्जरानी साधनाओ आवे.

(२) दानधर्ममां सुपात्रदान, धर्मोपकरण दान, अभयदान, अनुकंपादान वगेरे आवे. अहीं सुपात्रमां श्रेष्ठ पात्र तीर्थकर भगवान, पढी सम्यगज्ञान-शास्त्रादि, पढी साधु-साधीं महाराज अने पढी श्रावक-श्राविका, ऐमनी सेवा-भक्तिमां भरवानुं आवे. ● शील धर्ममां सदाचारो, व्रत नियमो अने सद्गुणो आवे, ● तपधर्ममां विविध तपस्याओ आवे, भाव्य-आत्मन्तर १२ प्रकारनो तप गणाय. ● भावनाधर्ममां अनित्य भावना, अशरण भावना, वगेरे १२ भावना, मैत्री आदि ४ भावना, तत्वचित्ता तथा आज्ञा-अपाय-विपाक-संस्थानादिनी भावना अने दर्शन-ज्ञान-यारित्र-वैराग्य-प्रतोनी भावना आवे.

(३) ● साश्रव धर्ममां गृहस्थ माटे आरंभवाणा धर्म दा.त. जिनपूजा-द्रव्यस्तव, जिनमंडिरादि निर्माण-तीर्थयात्रा, साधर्मिक वात्सल्य, जिनेन्द्रभक्ति भडोत्सवो वगेरे आवे. ● निराश्रव धर्ममां सामायिक, पोषण व्रतो, मुनियारित्र, वगेरे आवे. झीशवटथी जोतां मुनिने सराग संयम ए साश्रव धर्म. अने वीतराग संयम ए निराश्रव धर्म, एथी पण सूक्ष्मताए जोतां सयोगी सौने साश्रव धर्म अने १४ मा गुणस्थानके रહेल अयोगीने निराश्रव धर्म.

(४) योगात्मक धर्ममां ● अध्यात्म योग एटले अहिंसादि व्रतमां रही करातुं जिनोक्त ज्ञव-अज्ञव-आदि तत्त्वनुं चिंतन, ● भावना योग एटले ए ज चिंतननो पुनः पुनः अभ्यास. ● ध्यानयोग एटले ए चिंतनमां कोई एक पदार्थ पर एकाग्रता. ● समतायोग एटले ज्ञवित-भरण, ईष-अनिष्ट वगेरे उपर समभाव. ● वृत्तिसंक्षय योग एटले मन-वयन-कायाना समस्त सूक्ष्मातिसूक्ष्म पण व्यापारोनो त्याग. आ भधा प्रकारनो धर्म मनथी थाय, वयनथी थाय, कायाथी थाय.

प्र.- श्रद्धा, भावना वगेरे तो मनथी ज थवाना, कायाथी शी रीते ? ऐम दान, तप, किया, वगेरे तो कायाथी थाय, मनथी केवी रीते ?

३.- मनथी साध्य जे धर्मो छे, अने अनुरूप कायानी प्रवृत्ति कराय ते

कायाथी अने साध्यो कहेवाय, दा.त. जिनेन्द्रटेव पर राग छे, तो ऐमनुं सांभगतां, मूर्ति जेतां के याद करतां मों पर हर्षनी रेखा यमके, हाथ जेडाई जाय, माथुं नभी जाय, ए कायाथी धर्म थयो गणाय. ऐम अनित्य आदि भावनाओने अनुरूप मोंनी गंभीर सुरत, जडने लेवा-मूकवामां कायिक बेपरवाई, वगेरे थाय ते कायाथी धर्म थयो कहेवाय.

त्यारे जे धर्म कायाथी करवाना छे, दा.त. तीर्थयात्रा दान, तप वगेरे, ऐना करेलानां स्मरण थाय, आ करवाना मनोरथ थाय, अथवा मनथी जाणे साक्षात् सेवीए छाइ एवी भावना कराय. दा.त. तीर्थयात्रामां सिध्घगिरिनुं तणेटीथी यडवाथी मांडीने दादाने भेटवा-भजवा सुधीनुं चिंतन कराय, ए बधुं मनथी धर्म साध्यो कहेवाय.

वयनथी साधवामां ऐनी प्रशंसा थाय, सुति थाय, ऐनो उपदेश कराय, वगेरे आवे.

“दिव्य-दर्शन”-“अग्रलेखामृत”

वर्ष-१२, अंक-१३, ता. ७-१२-१५६३

१२१ (लेखांक-२)

पूर्वोक्त सम्यगदर्शनादिरूप यार प्रकारना धर्म मनथी, वयनथी के कायाथी कराय, ते पण स्वयं करवा रुपे या बीज पासे कराववा रुपे के बीजओ करे तेने अनुमोदवा रुपे कराय. आ त्राणेय प्रकार मनथी थाय, मनथी करवुं, मनथी कराववुं, मनथी अनुमोदवुं. ऐम वयनथी ने ऐम ज कायाथी. दा.त.

मनथी विचार कर्यो के ‘हुं दान दउं, बस, आटली रकम दान खाते,’ आ मनथी दान कर्यु कहेवाय. ऐम विचार्यु के ‘छोकरा के पत्ती पासे आटलुं देवरावीश.’ ए मनथी कराव्युं गणाय. त्यारे कोईए दान कर्यु छे, अगर करे के करवानो छे, ऐना पर मनमां खुशी अनुभवी, अथवा सामान्यथी दान माटे विचार्यु ‘दान धर्म केवो सरस !’ आ मनथी दानने अनुमोद्युं कहेवाय.

वयनथी,-दान खाते बोत्या के ‘लभो मारी आटली रकम,’ ए वयनथी दान कर्यु कहेवाय. दाननो बीजो आदेश कर्यो के, ‘हे, आटली रकम हे आ धर्म-धातामां, जे आटला दु. तारा लभी लउं हुं.’ अथवा उपदेश कर्यो के दान तो देवुं जोईए. दानना बहु लाभ, आ नक्की वयनथी दान कराव्यु कहेवाय, ऐम कोईना दाननी अथवा सामान्यथी दान धर्मनी प्रशंसा करी, ए वयनथी अनुमोद्युं गणाय.

કાયાથી દાનમાં રૂપિયા ગણી આચ્છા, કે વસ્તુ દીધી અથવા આંગળીના ઈશારાથી બતાવ્યું યા કાગળ પર લખ્યું કે, ‘મારા બે, કે પાંચ, કે દસ, યા બસો, વગેરે રૂપિયા દાનમાં.’- આ કાયાથી દાન કર્યું કહેવાય. એમ બીજાને દાન કરવાનો ઈશારો કર્યો, યા છોકરા પાસે દેવરાવ્યું, અથવા કોઈને દાનનો આદેશપત્ર કે ઉપદેશપત્ર લખ્યો, એ કાયાથી દાન કરાવ્યું કહેવાય. એમ હાથની સંજ્ઞાથી બીજાને પ્રેરણા કરી કે, ‘દે આટલું દે,’ અથવા એનો હાથ પકડીને દેવરાવ્યું, એ કાયાથી દાન કરાવ્યું ગણાય. ત્યારે કોઈનું દાન સાંભળી મોં પર હર્ષની રેખા ચમકી આંખમાં આનંદ-વિસ્મય ઊભરાયો, યા હાથની સંજ્ઞાથી ખુશી દેખાડી, એ કાયાથી દાન અનુમોદ્યું કહેવાય.

એમ, જિનભક્તિ કરવા કે કરાવવા કે અનુમોદવાનું મનથીય થાય, વચનથીય થાય, યા કાયાથીય થાય. મનથી એ રીતે કે જાતે ભક્તિ કરવાનો સંકલ્પ કરાય, યા જિનની મૂર્તિ, શાસ્ત્ર, તત્ત્વ કે મોક્ષમાર્ગ જોઈ જિન પર મન આકર્ષાઈ જાય, આ સ્વયં જિનભક્તિ કરી કહેવાય, એવું બીજા પાસે કરાવવાનો સંકલ્પ-વિચાર કરે એ જિનભક્તિ મનથી કરાવી ગણાય. ત્યારે બીજાઓથી કરાતી જિનભક્તિ પર મન હરખાઈ જાય, અથવા શાસ્ત્રે ઉપદેશેલી જિનભક્તિ માટે મનને એમ થાય કે ‘વાહ ! કેવી સરસ જિનભક્તિની કરાણી !’ આ મનથી જિનભક્તિ અનુમોદી ગણાય.

જિનભક્તિ વચનથી સ્વયં કરવાનું એ રીતે, કે જિનનાં સ્તોત્ર-ગીત-સ્તવન ગાય, સ્તુતિ કરે પ્રશંસા-ગુણાનુવાદ કરે, અથવા જિનભક્તિના કાર્યોમાં બોલીને પોતાનો ફાળો નોંધાવે, એમ, કરાવવાનું એ રીતે કે જિનભક્તિનો ઉપદેશ આપે, યા આદેશ કરે, ત્યારે વચનથી અનુમોદવાનું એ રીતે કે સામાન્યથી જિનભક્તિના ગુણ ગાય, યા બીજાઓએ કરેલ જિનભક્તિની પ્રશંસા કરે.

જિનભક્તિ કાયાથી સ્વયં કરવાનું સમજાય એવું છે. એવું બીજાને ઈસારો કરી યા હાથ પકડી કરાવવાનું થાય એમ જિનભક્તિના લાભને નિભિતે કાયોત્સર્ગ કર્યો તો ત્યાં કાયાથી જિનભક્તિની અનુમોદના થઈ ગણાય. અથવા કોઈની જિનભક્તિ યા જિનભક્તિના ઉપદેશ પર આંખ નાચી, મોં ખીલ્યું, વગેરે એ કાયાથી અનુમોદના થઈ.

જિનભક્તિ ભાવ અર્થમાં લઈએ તો જિનની આજ્ઞાનું પાલન એ તાત્ત્વિક જિનભક્તિ છે. માટે મનથી, કે વચનથી, યા કાયાથી જિનની આજ્ઞાનું પાલન કરીએ, કરાવીએ, યા અનુમોદીએ, એ જિનભક્તિ કરી-કરાવી અનુમોદી ગણાય. માટે જ સાધુપણું પાળનાર ચોવીસે કલાક જિનાજ્ઞા-પાલન કરવા દ્વારા રાતદિવસ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

જિનભક્તિ કરનારા કહેવાય છે. ગૃહસ્થ પણ જેટલા અંશમાં જિનની આજ્ઞાનુસાર અશુભ આશ્રવત્ત્યાગ અને શુભ આશ્રવ તથા સંવર અને નિર્જરામાર્ગનું પાલન કરે તેટલા અંશમાં જિનની ભક્તિ કરનારો કહેવાય. અલબત્ત આ બંનેને જિનની સર્વ આજ્ઞા સર્વવચનની અનન્ય શ્રદ્ધારૂપી સમ્યકૃત્વ તો જોઈએ જ.

આ રીતે પૂર્વે કહેલ સમ્યગદર્શનાદિ ધર્મ, દાન-શીલ વગેરે ધર્મ, સાશ્રવ-નિરાશ્રવ ધર્મ કે અધ્યાત્મ આદિ પંચયોગાત્મક ધર્મમાંથી ગમે તે પ્રકાર મનથી સ્વયં કરાય, બીજા પાસે કરાવવા કે સામાન્યથી તે ધર્મની અથવા કોઈથી કરાતા ધર્મની અનુમોદના થાય, એને ધર્મસાધના કહેવાય. એવું વચનથી આદેશ-ઉપદેશ-પ્રશંસા વગેરે દ્વારા કરવા-કરાવવા-અનુમોદવાનું થાય. એ ય ધર્મસાધના કરી કહેવાય.

અહીં પ્રસંગવશ એ પણ સમજી લેવાનું કે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કૃષાયો, આહાર-વિષય-પત્રિગ્રહ નિદ્રાની સંજ્ઞાઓ, હિંસા-જૂઠ વગેરે પાપ કિયાઓ, સંસાર ભાવનાઓ, ઈત્યાદિ પાપોમાં પણ મનથી કરવા-કરાવવા-અનુમોદવારૂપ, એવું વચનથી, અને એવું જ કાયાથી કરવા-કરાવવા-અનુમોદવા રૂપના પ્રકારો પડે છે. માટે પાપથી બચવા અર્થે અમાના દરેક પ્રકારના સેવનથી બચવા અર્થે અમાના દરેક પ્રકારના સેવનથી કેમ બચાય, એ લક્ષ રાખવાનું છે. એમ પાપત્યાગ કરાય એ પણ ધર્મ છે. તો જેટલા પ્રકારના પાપત્યાગ એટલા પ્રકારના ધર્મ ગણાય.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૧૪, તા. ૧૪-૧૨-૧૯૬૩

(૧૨૨) (લેખાંક-૩)

તુચ્છ વિષય ભોગ અને અહંત્વ ઉત્કર્ષમાં પુણ્યોદયના લહાવા લેવાને બદલે આ ખાસ જીવનમાં પથરાયેલી ધર્મની તકોના લહાવા લેવા જોઈએ. એમાં કેવી કેવી ધર્મ તકો મળે છે એ જાણવું જરૂરી છે. એ માટે ગત લેખમાં ધર્મના અનેક પ્રકાર વિચાર્યા, જેથી ક્યાં ક્યાં કેવા કેવા ધર્મની તક છે એનો ઘ્યાલ આવે. હવે એ ક્યાં કોણો લાગુ થાય, એ જોઈએ.

પૈસા મળ્યા છે, ત્યાં જીતના ભોગ વિલાસ પર અંકુશ મૂકવાની ધર્મતક છે, સાથે સુંદર દાનધર્મની તક છે, અર્હદ્ભક્તિ-ગુરુ ભક્તિ, શાસન પ્રભાવના વગેરે દ્વારા સમ્યગદર્શનધર્મ આરાધવાની તક છે, તીર્થયાત્રાદિ સાશ્રવ ધર્મની તક છે.

વેપાર કરવા બેઠા ત્યાં અનિત્ય ભાવના, અન્યત્વ ભાવના, આશ્રવ ભાવના જીવંત રાખવાની તક છે. વેપારની શક્યતા છતાં અંકુશ રાખી મૂર્ખાંકાપ, ઘડ્જાવ-નિકાયની દ્યા, તથા બીજા પ્રપંચાદિ પાપના ત્યાગ, એની ધર્મ તક છે.

૨૬૬ ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

આ ધર્મતકોનો લાભ ઉઠાવવો એ વહી જતામાંથી બચાવી લેવા જેવું છે. દુનિયાની કાર્યવાહી તો ચાલે જ જાય છે, કાયા વગેરે અનું કામ કરે છે. અને ધર્મ તકથી ઊલટા પુષ્યભોગના લહાવા લૂંટનાર કંઈ નક્કર સુખ પામી જાય છે એવું પણ નથી. પરંતુ પુષ્યની અનુકૂળતા ટેખી એમાં આંધળિયા કરીને બિન સાવધાન બન્યા, ધર્મની તકો સાધી લેવાનું ગુમાવું તો અંતે તો અહીંની લીલાનો પૂર્ણવિરામ છે. માટે ધર્મતકો સાધી લેવાની ભાવનામાં રમતા રહેવું જોઈએ. જો સારી ભાવના મનમાં નહિ રમતી હોય, તો ઈષ વેપાર વગેરે સારો ચાલવાના હરખ ઊભરાશે. અગર ધંધાદિ મંદા હોવા પર ખેડ-ઉદ્ઘેગ ચિત્તને કોર્યા કરશે. તેમજ બંને સ્થિતિમાં કોઈ પાપ વિચારણાઓ, પ્રપંચો વગેરે મનમાં ઊભરાયા કરશે. ખરી રીતે એના એ જ સંયોગોમાં ફૂતજ્ઞતા, દયા, પરાર્થવૃત્તિ, વૈરાગ્ય, પાપભય, પ્રમાણિકતા, સહદ્યતા, વગેરે ગુણો કમ માનસિક ધર્મ, તત્ત્વ-ચિંતન, ઊંચા સુદૂર-મનોરથ ઈત્યાદિ ધર્મની તક છે. ઈન્દ્રિયોને અને મનને ફટવવાનું થાય એવા પુષ્યના લહાવા લેવા કરતા હૃદયને સંતોષ અને સાત્ત્વિક દીર્ઘ આનંદ આપે એવી ધર્મની તકોના મળતા ભવ્ય અવસર સફળ કરી લેવામાં ડાપણ છે. તો જ આત્માને કંઈક પણ ઊંચે લાવવાનું થાય. નહિતર મેલી વાસનાઓ, ને મેલીધેલી પ્રવૃત્તિઓની ગતર્ભમાં ડૂબાડૂબ રહેલા એને એમાંથી ક્યારે ઊંચકવાનો ?

માટે ધર્મની તક શોધી શોધીને ઝડપી લેવી જોઈએ. દા.ત. ખાનપાનમાં વિવેક-અંકુશ-મર્યાદા વગેરે પર લક્ષ. જો કોઈ વિવેક નહિ, અંકુશ નહિ, તો એ તો પુષ્યના અનુકૂળ બધા જ ઉદ્ય ચટણી કરવા જેવું છે. એના બદલે જુઓ તો દેખાય કે ત્યાં મનની સુવાળી વૃત્તિ પર અંકુશ-માપમર્યાદા, એથી અંશે પણ રસત્યાગ, ઊનોદરિકા, વગેરે તપ ધર્મની તકનો લહાવો લૂંટી શકાય એમ છે. પાછું એના પર આરામી, મોજમજાહ અને અનેક પ્રકારની પાપધાંધકોમાં મસ્ત ડૂબવા કરતાં સમ્યગ્દર્શનાદિ ચારે પ્રકારના ધર્મમાંથી કોઈ ને કોઈ પ્રકારના ધર્મની જ તક સુલભ છે. દા.ત. તત્ત્વચિંતનનો અધ્યાત્મ યોગધર્મ, સ્વાધ્યાયનો તપધર્મ, ત્રતનિયમનો શીલધર્મ, સામાયિકનો ચારિત્રધર્મ, એમ ત્યાં શુભ ભાવના ધર્મ, કે સમ્યગ્દર્શનાદિનો કોઈ ને કોઈ આચાર ધર્મ... વગેરેમાંથી સાધવું શક્ય છે.

અરે ! બજારે જવા નીકળ્યા ત્યાં પણ પહેલાં નવકારસ્મરણ આદિ કોઈ પણ ધર્મમંગળ સાધવાની તક છે. ધર્મસંગ્રહ શાસ્ત્ર કહે છે કે આજીવિકા કમાવવા અર્થે જતાં નમસ્કારાદિ મંગળ કરે. શા માટે ? તો કહ્યું કે ધર્મસ્ય સર્વપુરૂષાર્થ પ્રધાનત્વાત् - અર્થાત્ કારણ કે ધર્મ એ સધળા પુરુષાર્થો-(ધર્મ, અર્થ કામ, મોક્ષ) માં પ્રધાન છે,

એટલે કે બીજા એની પાછળ છે. અત્યારે અર્થ કમાવવા જાય છે તો એનીય પહેલાં ધર્મપુરુષાર્થ કરવો જોઈએ. ધર્મને સૌઅે મોખરે રાખવાનો.

માટે જ સાંસારિક સર્વ વ્યવહારો અને પ્રવૃત્તિઓનાં કયાં કયાં ધર્મની કેવી રીતે તક છે, તે પોતાનું જીવનસ્તર અને પૂર્વ કહેલ વિવિધ-ધર્મના પ્રકારો, પેટા પ્રકારો પર વિચારી કયાં કયાં ધર્મ પ્રકારનો મેળ ખાય એ પહેલેથી વિચારી રાખવું જોઈએ.

મન કંઈ ને કંઈ વિચારો તો કરે જ છે, તો ફજુલ વિચારોને બદલે આ ગડમથલ કર્યા કરે કે જીવનની કઈ કઈ બાબતોમાં કયાં કયો ધર્મપ્રકાર લાગુ થઈ શકે. આ વિચારણાનું મોટું ક્ષેત્ર છે, તેથી એમાં રોકાયેલું મન અનેકાનેક પાપવિચારોથી બચી જશે.

આવું વિચારી રાખ્યું હોય તો દેખાશે કે કેટલે ય કેકાણો એની એજ પ્રવૃત્તિમાં વિચારનો જોક જ બદલવાની જરૂર છે. દા.ત. ચાહની તપેલી ચૂલેથી ઊતારીને ઢાંકી, શા માટે ? 'ચાહ ઢંડી ન પડે' એ પુષ્ય ભોગવવાનો ઉદ્દેશ થયો. 'કોઈ જીવ એમાં પડી મરે નહિ' એ ઉદ્દેશે ધર્મતક સાધી ગણાય. કપું પહેર્યું પણ 'ઢારા કરવા' એ પુષ્યભોગમાં તણાયું, અને 'શરીરની લાજ ઢાંકવા' એ ધર્મતક સધાઈ. સારું ય પહેર્યું પણ શાસનની શોભા વધારવા, તો એ ધર્મતક સાધી. મનમાની કમાઈ થઈ ત્યાં 'ચાલો, હવે સુખ સારું ભોગવી શકાશો.' એ પુષ્યભોગમાં તણાયું. પણ 'ચાલો હવે ચિત્તને અસમાધિ દુધ્યનિ નહિ થાય, ધર્મસાધના સ્વસ્થતાથી થશે.' એ ધર્મ તક તરફ દાખિ ગઈ, એવું જ પાપના ઉદ્યમાં પણ. દા.ત. તાવ આવ્યો ત્યાં અરેરે ને હાયવોય એ સંકલેશ છે, ત્યારે નિરાંતે નવકારજાપ, કમીવિપાકની વિચારણા, વેપાર-આશ્રવથી બચાવ થવા પર દાખિ ઈત્યાદિ ધર્મતક સધાય.

બસ વિવિધ ધર્મની તકોને ઠમઠામ સાધી સફલ કરી લઈએ.

૧૨૩ શરીર અને આત્માના વિચાર

(લેખાંક-૧)

આ એક સનાતન સત્ય છે કે,-
 ‘શરીરના વિચાર એ કાયરતા છે,
 આત્માના વિચાર એ સાંત્વિકતા છે.’

અનાદિ વાસના અને મોહમૂઢતાથી દ્વારાયેલો જીવ પોતાના શરીરના વિચારો બહુ કર્યા કરે છે. ‘મને સુખ (શારીરિક સુખ) કેમ મળે ? હું તગડો કેમ બનું ? બધે માન્ય કેમ થાઉં ? મને (મારી શારીરિક ઇન્દ્રીઓ આંખ, કાન, નાક, જીવ અને સ્પર્શનેન્દ્રીયને) સારાં સારાં રૂપાળા પદાર્થો, સારા મીઠા શબ્દ, સારી ગંધવાળી વસ્તુ, રસદાર ચીજો અને સુંવાળા મુલાયમ મનગમતા સ્પર્શ કેમ મળ્યા કરે ? એ જ મળ્યા રહે, અણગમતા નહિ, નઠારા નહિ,-આ બધા શરીરના વિચારો છે.’ એમ ‘મારો રોગ ક્યારે જાય ? શી દવા ખાઉં ? મને આ ઠીક નથી. ક્યારે આ રોગ જશે ? હું તો હેરાન હેરાન થઈ ગયો ? ક્યારે નિરોગી થઈશ ? આરોગ્ય કેમ બન્યું રહે ? હું શું શું ખાઉં ? ક્યારે ખાઉં પીઉં ?’ આ પણ શરીરના વિચારો છે, એમ ‘આજ ઉંઘ ન આવી, થાક બહુ લાગ્યો. ભૂખ નથી લાગતી. માખીઓ બહુ હેરાન કરે છે ! મચ્છર બહુ કરે છે ! માંકણ જપવા દેતા નથી ! પવન બહુ ઠંડો ! ગરમી ધણી પડે છે !...આજના ખાનપાન માલ વિનાના, ધી, દૂધ, કશું સાંત્વિક મળે નહિ...રસ્તા પર મોટરોનાં તોફાનો ભારે !...’ ઈત્યાદિ ઈત્યાદિ વિચારો શરીરની મુખ્ય દાણિમાંથી ઉદ્ભવ્યા કરે છે.

શરીરના વિચારોએ મનને એટલું બધું વેરી લીધું છે કે ત્યાં બિચારા આત્માના વિચારને જગા જ નથી મળતી. કદાચ પરાણે એનો વિચાર મનમાં ઘાલ્યો, તો એ મિનિટ-અંધી મિનિટ ટક્યો ના ટક્યો, ને શરીરના કે શરીરના સંબંધી પદાર્થના વિચાર ધોખમાર વહેવા લાગે છે. વગર વિચાર્ય વિચારો ઊભરાય છે. રોકાયા રોકાતા નથી, ને દિનરાત મનને ધેર્યું રાખે છે.

પરંતુ આ કાયરતા છે, નિઃસત્ત્વતા છે, તામસ-રાજસભાવ છે. કાયરતા એટલા માટે, કે એ વિચારો કર્યા કરવાથી બહુ કાંઈ નીપજતું નથી. ઊલટું જીવને વિચિત્ર કર્મના જે ઉદ્ય તો જીવા જ પડે છે, ને અનેક અણગમતા પરિણામ, બનાવ, સંયોગો જે અનુભવવા જ પડે છે, એમાં બેદ, ઉદ્ઘનતા, નિરાશા, ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

આવશે, મનમલિનતા વગેરેથી બચવા એની પાસે જોમ જ નથી હોતું, હાય ને વોય, ભય ને સંતાપ હિલને બાળ્યા કરે છે. કહે છે ને કે ‘બહાદુરનું એક જ વાર મૃત્યુ, ને કાયરનો ડગલે ને પગલે મરો.’ પોતાની સિદ્ધહસ્ત શાન્તિ, સ્વસ્થતા, પ્રકૃતિલિતતા, મનની મસ્ત બાદશાહી, તેજસ્વિતા વગેરે પર પોતાનો કોઈ કાણું નથી, ને બેદ આવેશ વગેરે પોતે રોકી શકતો નથી. એ કાયરતાનું પરિણામ નહિ તો બીજું શું છે ? ને એમાં નીતરતું આર્તધ્યાન હોઈ અશુભ કર્મના થોક બંધાઈ દીર્ઘ ભવિષ્ય પણ કેવું દુઃખદ બને !

આ તો એક હકીકત વાત થઈ. હવે વિચાર એ છે કે,

આ કાયરતા મિટાવવા શું કરવું ?

સાચો નક્કર ઉપાય એક જ છે કે આત્માના વિચાર બહુ બહુ કરવાનો અભ્યાસ શરૂ કરવો. આ સિવાય બીજો કોઈ વાસ્તવિક ઉપાય નથી. માનવ જીવનમાં આની શ્રેષ્ઠ શક્યતા હોઈ આ જીવનનો ઉપયોગ આત્માના વિચારોનો ધરખમ અભ્યાસ કરી લેવામાં આવે છે. આ જીવન આના માટે જ છે. આ કરેલું જ જીવનને શાંતિથી મધ્મધાતું રાખે છે, અને જીવનના અંતે અદ્ભુત શાંતિ, સમાધિ અને હૈયાને હુંક આપે છે, અવશ્યભાવી મરણ આનંદપૂર્વક વધાવી લેવા બળ આપે છે. જ્યારે શરીરના જ વિચારો અને શરીર સાથે સંબંધ રાખનારા ૪૩-ચેતન પદાર્થોના વિચારોનો જ જીવનભર કરેલો અભ્યાસ અંતે અપાર સંતાપ-અશાંતિ, વ્યાકુળતા-વિલ્બળતા અને શોક-કલ્પાંત સિવાય બીજું કાંઈ દેખાડી શકતો નથી.

આત્માના વિચાર બે રીતે હોય છે,-(૧) એક તો આત્મા અને આત્મહિતકારી તત્ત્વો વગેરેના અલગ વિચાર. (૨) બીજું શરીરના જે જે વિચાર આવ્યા કરે છે તેના તેના પ્રતિપક્ષી આત્મવિચાર.

આમાં બીજી કોટિના જે પ્રતિપક્ષી વિચાર, તે શરીરના વિચારોને નભળા પાડી દે છે. નવા નવા શારીરિક વિચારોની ધોંસ ઓછી કરે છે, અને ઉઠતા વિચારોને આત્મવિચારમાં ફેરવી નાખે છે, પરંતુ કેટલીક વાર શરીર વિચારના એકલા પ્રતિપક્ષી વિચારોથી કામ નથી ચાલતું. એટલા માટે પ્રથમ કોટિના અલગ આત્મવિચારોની આવશ્યકતા રહે છે. એનો અભ્યાસ પાડતા જઈએ એટલે ચિત્ત એમાં રોકાયેલું રહેવાથી શરીરના વિચારો કરવાને નવરું જ ન બને. એમ શરીરના વિચારો બહુ આવતા હોય ત્યાં આત્મા અને આત્મ-હિતકારી તત્ત્વો વગેરેનો વિચાર સ્વતંત્ર અર્થાત્ પ્રસ્તુત વિચારો સાથે કાંઈ પણ સંબંધવાળા જ નહિ, એવા જુદા જ વિચાર ચાલુ કરી દીધા એટલે મન સહેજે સહેજે પેલા શરીરસંબંધી

વિચારોમાંથી ખસી આમાં લાગી જવાથી પેલું ભૂલી જાય. વ્યવહારમાં આ અનુભવાય છે કે ખાવાના વિચારમાં મન ચક્કું હોય, ત્યાં જો કોઈ ધંધા-ધાપા આદિના વિચાર મનમાં ધૂસે છે, તો પેલા વિચાર પડતા મૂકાય છે. બસ, એ રીતે આત્માના કે આત્મહિતકારી તત્ત્વો વગેરેના સ્વતંત્ર વિચારોમાં મનને ચડાવી ટેવાથી શરીરના વિચારો તેટલા વખત પૂરતાં જરૂર અટકી જાય. એનો દીર્ઘ અભ્યાસ પડ્યા પછી તો મન સહેજે સહેજે આત્માના જ વિચારોમાં રમતું થઈ જવાનું.

હવે આ બે પ્રકારના આત્મ-વિચારોને સ્પષ્ટતાથી જોઈએ.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૧૬, તા. ૨૮-૧૨-૧૯૬૩

(૧૨૪) (લેખાંક-૨)

શરીર અને શરીરસંબંધી જડ-યેતન વસ્તુના વિચાર બહુ આવ્યા કરે એ જીવને જડાભિનંદી અને નિઃસત્ત્વ બનાવે છે. એને રોકવા માટે ગયા લેખમાં બે પ્રકારના આત્મવિચારોનો નિર્દેશ કર્યો હતો. એ કેવી કેવી જીતના હોય, એને જરા વિસ્તારી અહીં જોઈએ.

પહેલા પ્રકારના આત્મ-વિચારમાં શરીર વિચારની પ્રતિપક્ષી નહિ, કિન્તુ અલગ કોટિની સ્વતંત્રપણે ચાલે એવી વિચારણા રાખવાની છે. એમાં,

(૧) સરળતાથી ચાલે અને અત્યન્ત જરૂરી ગણાય એવા આત્મવિચાર તરીકે પ્રાર્થનાની વિચારણા રાખ્યા કરવાની છે. તે એ રીતે કે વારંવાર એ લાવવું કે, ‘હે અરિહંત નાથ ! તું અચિંત્ય અનંત શક્તિસંપન્ન છે, એવો મારો દઠ વિશ્વાસ છે. કેમકે હું જાણું હું કે આ જગતમાં તારી આજ્ઞામાં રહીને અનેક ભાગ્યવાનોને તારા નામસ્મરણથી, તારું શરણું લેવાથી, તને નમસ્કાર કરવાથી, તારાં પૂજન-સ્તકાર-સન્માન કરવાથી અને તારાં ધ્યાન-ગુણગાનથી અચિંત્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. તો હે પ્રભુ ! મારા કલેશ તારા પ્રભાવે નાશ પામે, મારા હિત તારી અચિંત્ય શક્તિથી સિદ્ધ થાઓ. જરૂર કલેશનાશ અને હિતસિદ્ધ મારા નાથ અરિહંતના અનંત પ્રભાવથી થશે જ.’ આવી પ્રાર્થના વારંવાર કરવાની. ગદ્દગદ દિલે આ વિચારણા થવી જોઈએ. એક મિનિટ પણ અવસર મળે ત્યાં આ કરી શકાય. વળી આ પ્રાર્થનામાં જે પૂર્વ પુરુષોને અરિહંતના પ્રભાવથી ઉક્ત સ્મરણ, દર્શન, પૂજન વગેરેથી અચિંત્ય ફળ પ્રાપ્ત થયાં છે, તેમના પ્રસંગ વિચારી શકાય. આનો અભ્યાસ પાડવાથી પછી એ વિચારણાની ટેવ પરી જવાની.

(૨) એવો બીજો આત્મ-વિચાર એ પ્રકારે, કે તીર્થકર ભગવાન અને અન્ય મહાપુરુષોના પરાકમભર્યા સુંદર જીવનપ્રસંગો અને ગુણો યાદ કરવાના. ‘ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ.’ પરાકમો યાદ કરતાં એવા સત્તું પરાકમોનું શૂર ચઢે છે. આનો વારંવાર અભ્યાસ જોઈએ. જેથી ચિત્ત એમાં એમાં રહે.

(૩) અથવા આત્મવિચાર એ રીતે, કે ચિત્તમાં ઉત્તમ ભાવનાઓ ચાલ્યા કરે, દા.ત. ‘સંસારના સંયોગ માત્ર કેવા અનિત્ય છે, સ્થિર ધારી રાખેલ કેવી વસ્તુઓ ઉપરી ગઈ, પલ્લાઈ ગઈ, નાશ પામી ગઈ...’ વગેરે વગેરે ચિત્તવાનું. એમ, ‘જીવની આ જગતમાં અરિહંત વિના અશરણ નિરાધાર સ્થિતિ કેવી કેવી છે.’-એ વિચારવાનું, જીવોના દાખલાથી એ વિચારી શકાય, જેમકે ઋષિ પરિવાર અને ડોકટરો આદિ સામગ્રીથી સંપન્ન લોકોની પણ એકલે પણ રોગમાં રિબામણ ! યા કરૂણ મૂલ્ય ! આવી બીજી સંસારભાવના, એકત્વભાવના વગેરેમાંની કોઈ ને કોઈ ગંભીરપણે ભાવતા રહેવાય. આની ધેરી અસર દિલમાં વૈરાગ્ય જવલંત રાખી જડ વિનશ્વર શરીરના વિચાર મોળા પાડી નાખે છે.

(૪) એક સુંદર આત્મવિચાર જીવોની દ્રવ્યદ્યા અને ભાવદ્યાનો છે, જ્યાં જ્યાં નજર પડે તે તે જીવના કોઈ ભૂખ તરસના, કોઈ રોગ પીડાના, કોઈ પરાભવ-પરાધીનતા યા કોઈ ત્રાસ-અપમાનના, ઈત્યાદિ દુઃખ પર મનને એમ થાય ‘કુ બિચારા કેવા દુઃખી ! કર્મ કેવા આને પીડી રહ્યા છે !’ હૈયું દ્રવિત થાય. સમવેદના અનુભવે. આવું કુદ્ર જંતુઓ માટે પણ થાય. આ દ્રવ્યદ્યા કહેવાય. ભાવદ્યામાં, જીવના કષાયો, હિસાદિ પાપ, ભૂલભાલ, મિથ્યાત્વ-મિથ્યામતિ વગેરે પર દ્યા આવે, મનને એમ થાય કે ‘બિચારો ભંયકર કર્મ જે મોહનીય એનાથી કેવો પીડાઈ રહ્યો છે ! કેવા કર્મ બાંધી રહ્યો છે ! એનું શું થશે !’ હૈયું પીગળી જાય, ત્રાસ અનુભવે, બંને પ્રકારની દ્યામાં એમ થાય કે ‘મારું ચાલે તો હું કેમ એને દુઃખમાંથી છોડાવું !’ આપણી નજર સામે પણ જીવો ઘણા છે. તો તે તે જીવોની દ્યાના વિચારો ય ખાસો સમય લઈ શકે. તેથી સ્વદેહના વિચારને ઓછો અવકાશ મળે.

(૫) એક આત્મવિચાર એવો પણ છે કે, સ્થાવર તીર્થ શ્રી શર્વંજ્ય આદિ જેની જેની આપણે યાત્રા કરી છે, અગર વર્ણન જાણ્યું છે, એની કુમશઃ યાત્રાની વિચારણા કરવી, ‘તણેટીએ ગયા, પછી આમ આમ...ચઢ્યા, આ આ જોયું, આવી આવી...રીતે દર્શન પૂજા ભક્તિ કરી...’ આમ વિચારી શકાય. એવી જંગમતીર્થ મુનિઓની કોઈ ફરસના, દર્શન, ભક્તિ, એમ કોઈ વિશાષ ધર્મ ઉત્સવો જોયેલા, એની યાદગીરી કરાય.

(૬) આત્મવિચારનો એક અદ્ભુત પ્રકાર એ છે કે, શાસ્ત્રના સૂત્ર યા પદાર્થોનું ક્રમશઃ સ્મરણ કરતા રહેવાય. આ શુદ્ધોપયોગ છે. મહામુનિઓ જિનકલ્યા જેવા પણ આમાં લીન રહે છે. એ લીનતામાં પરીસહ-ઉપસર્ગોની વેદના પણ ભૂલી જાય છે. વ્યાખ્યાનમાં સાંભળતાં સંકલિત કરી રાખેલા યા શાસ્ત્રવાંચન વખતે ક્રમસર ધારી રાખેલા-પદાર્થો તત્ત્વોનું સ્મરણ, ચિંતન, મનન કરી શકાય. અથવા સામાયિક-ચૈત્યવંદન-પ્રતિક્રમણના સૂત્રોનાં ક્રમશઃ એકેક પદ લઈ તે પર વિચારી શકાય, એમ સ્તવન-સજ્જાય-સ્તોત્ર વગેરેની ક્રમસર એકેક કરીના ભાવ વિચારી શકાય. આ વિચારવાનું પણ વારંવાર થવાથી એની મનમાં એવી રહેતા કરવાની કે પછીથી એ કરીઓ, પદો, ગાથાઓ યાદ કર્યા વિના જ સંકલનાબદ્ધ એના ભાવો યાદ આવ્યે જાય.

(૭) બાકી આત્મવિચારમાં, સ્વદોષ-દુષ્કૃત્યોના વિચાર, અરિહંત આદિ ઉપકારીઓના આપણા પરના ઉપકારોની વિચારણા, સુંદર સુકૃતોના મનોરથ, સત્કૃત્યોની યોજનાના વિચાર...વગેરે વગેરે પણ કરી શકાય.

આત્મવિચારોમાં ચિત્ત વ્યત્ર રહેવાથી શરીર યા શરીરસંબંધી પદાર્થોના વિચારને અવકાશ ઓછો રહે છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૧૭, તા. ૪-૧-૧૯૬૪

૧૨૫ (લેખાંકાં-૩)

અલગ રીતે આત્મવિચારોની વાત થઈ, હવે શરીરના વિચારોના ખાસ પ્રતિપક્ષી આત્મવિચારો જોઈએ.

જે આ વિચાર કેટલાયને આવે છે કે ‘મારું શરીર સારું નથી રહેતું...તાવ આવ્યા કરે છે...ખાંસી મટતી નથી...ભલાપ્રેશર રહે છે...શરીર તથા કરે છે...ગેસની તકલીફ કબજીયાત રહ્યા કરે છે....ભૂખ નથી લાગતી...’ વગેરે આની સામે એ વિચારવાનું છે કે,

‘હું તે કોણ છું ? શરીરનો પક્ષકાર ? કે આત્માનો ? આત્માના તો આના કરતાં કેઈ ભયંકર રોગો છે, તકલીફો છે, એનો વિચાર કેટલો સમય કરું છું ? આત્માનો પહેલો તો રોગ આ કે અવિનાશી પોતાની જાતના વિચાર કર્યા કરવાનું મૂકી વિનશ્યર શરીરના વિચાર આવ્યા કરે છે ? પાછો એમાં ખેદ નથી. આંચકો કે ભડક નથી કે, લાખો રૂપિયા બચાવવાની ચિંતા મૂકી એને રાખવાનું, કબાટ આગમાં સળગી ન જાય એની ચિંતા કરનાર મૂરખની જેમ આ આત્મ-વિસ્મરણ

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૨૭૩

એને શરીરચિંતા કરનાર હું મૂર્ખ કેવા ભયંકર નુકસાનમાં ઊતરીશ ?’

બીજો એક આત્મવિચાર અરિહંતાદિ ચારનાં શરણ સ્વીકારવાનો છે. પંચસૂત્ર શાસ્ત્ર કહે છે, ‘ચિત્ત જ્યારે જ્યારે રાગાદિ સંકલેશ યા હર્ષભેદના સંકલેશમાં ચઢે ત્યારે ત્યારે આ ચાર શરણ સ્વીકારવા.’ એ દિલના ગદ્ગાદ ભાવે એને ભયભીતિ રક્ષણાથીની જેમ આશ્રિતભાવે ‘અરિહંતા મે સરણાં, સિદ્ધા મે સરણાં, સાહૂ મે સરણાં, કેવલિપન્નતો ધર્મો મે સરણાં’ યાદ કરવાથી થાય. મન કહે ‘પ્રભુ ! આ મોહની ઘેરામણમાં તમે જ મારા રક્ષક છો.’

એક આત્મવિચાર એ છે કે, શરીર, દવા પથ્ય વગેરના વિચાર ઊઠે એની સામે અશાતા વેદનીયાદિ કર્મના અકાટ્ય વિપાક, રાગ, દ્વેષાદિ કષાયોની ભાવી પરંપરા એને નવો કર્મભાર ન વધે તે, ઈત્યાદિનો વિચાર રાખવો. આત્મા નિઃસત્ત્વ તો ભવોભવ બન્યો રહ્યો છે, પણ હવે સાત્ત્વિક ક્યારે થશે ? મહાપુરુષોએ આથી પણ ભારે કપરા કષ્ટમાં કેવાં કેવાં સત્ત્વ પ્રગતાબ્યાં છે, ઈત્યાદિનો વિચાર કરતા રહેવાનું.

વળી એ વિચારવાનું કે ‘આ શરીર આદિના વિચાર કર્યા કરવા ખોટા છે, કેમકે એથી વળવાનું કાંઈ જ નથી. કાર્ય થશે તે ચોક્કસ પ્રવૃત્તિથી થશે, વિચારોથી નહિ, આ વિચારોમાં તો સારા વિચાર કરવાની તક જાય છે, માનવભવનો અમૂલ્ય સમય વેડફાય છે. મારા પરમાત્મા એને એમનાં તત્ત્વ, ઉપદેશ ક્યાં ઓછા છે તે એ વિચારવાને બદલે આ વિચારું ?’

આ રોગ અંગે જોયું.

ત્યારે ખાવાના વિચાર રાખ્યા કરે એની સામે એ વિચારવાનું કે શું તું ધાન્યનો ધનેરો છે કે આવા વિચારો કરે છે ? આ માનવ-મગજથી વિચારવા માટે આનાથી કોઈ ઉમદા વિષય નથી શું ? આ તો ખરી ભૂખના વિચારને બદલે આહાર સંજ્ઞાના વિચાર બની જાય છે, તેથી સંસ્કરણ બહુ ખરાબ દઠ થાય છે. ખાવા-ખાવાનું બધું અહીં પડ્યું રહેશે, એને પરલોકમાં આ પુષ્ટ સંસ્કરણથી આહાર સંજ્ઞા કારમી પૂંઠે લાગશે, ભારે સત્તાવશે ! કીડાકીડી, પશુપક્ષી, વગેરેની દુર્દશા નજર સામે દેખાય છે ને ? શું એવી સ્થિતિ ઊભી કરવી છે ?

વળી ખરી ભૂખ લાગી છે ત્યારે પણ ક્ષુધાપરીસહ સહવાનો સુંદર વિચાર શા સારું ગુમાવે ? પરીસહ-સહના ખરા વિચારની તક તો તકલીફ ઊભી થાય ત્યારે જ મળે છે એ વખતે તો અવસર ઓળખી લેવો જોઈએ. વિચારી શકાય કે ‘નરક ગતિમાં ભૂખ તરસ ક્યાં ઓછી વેદી છે ? છતાં એ ચાહીને શાંતિથી ન સહી તો સહવાનું એળે ગયું, અહીં તો એના કરોડમાં ભાગેય સહન કરવાનું નથી,

૨૭૪

ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

પછી સહવાની રજ્જુશી પૂર્વક ચાહીને શાંતિથી કેમ નહિ સહેવું ?'

એમ, પૈસાના વિચાર આવ્યા કરે ત્યાં સામે એ વિચારવું કે ભાગ્યના હાથની વસ્તુમાં શા સારું દખલ કરે છે ? વળી જીવન-જરૂરિયાત જોગ પણ પૈસા એમ વિચારો કરવા માત્રથી મળતા નથી. ત્યારે વધુ પૈસાનો વિચાર તો એક ઘેલધા જ છે, કેમકે અંતે મૂકવાની વસ્તુના વિચાર કર્યા કરવા અને સાથે આવનાર ધર્મના વિચાર તથા દાન-શીલ-તપ-ભાવના સંસ્કારો ઊભા કરવા, દઢ કરવા માટેના વિચાર ન કરવા, એ ગાંડપણ નથી તો બીજુ શું છે ? આ જીવનમાં પણ કોણ સુખી છે ? પૈસાવાળો ? કે ત્યાગ-વૈરાગ્ય-જિનભક્તિમાં મસ્ત રહેનારો ? પૈસા તો દુર્ગુણોની ખાણ છે. એમાં દુર્ગુણો પાકે છે. પૈસા આવ્યા પછી તૃષ્ણા વધે છે, સગાં સંબંધી કડવા લાગે છે, મદ ચઢી મોં કડવું થાય છે. જડના રંગ અને હિંસાદિ પાપ વધે છે, કલેશ-રગડા ઊભા થાય છે. આવા પૈસાના વિચાર શા કરવા ?

એમ પત્ની-પુત્રાદિ કુટુંબના મોહઘેલા વિચાર આવ્યા કરે ત્યાં એ વિચારવું કે ‘આ તો મને દુર્ગતિ સાથે પરણાવવા નીકળેલી જાનના જાનેયા છે. પરણાવીને જ પાછા વળે એવા. પછી જોવાય નહિ આવે ! કન્યા-વિકય કરનારો પછી કન્યાને કેવો ત્રાસ છે એ કયાં જોવા જાય છે ?’

સારાંશ શરીર અને શરીરસંબંધી ખાનપાન-પૈસા પરિવાર વગેરેના વિચારો આવે ત્યાં એ દરેકના અનર્થ વિચારવા, વિશિષ્ટ માનવમનરૂપી મૂરીની બરખાદી થતી વિચારવી. પરલોકમાં એના કુસંસ્કારોની પરંપરા વિચારવી. આમ છતાં એ વિચાર ન હટે, તો એને આત્મહિતના વિચારમાં પલટવા મહેનત કરવી. દા.ત. કુટુંબનું આત્મહિત કેમ થાય ? એ મારા આત્મહિતમાં કેવી રીતે ઉપયોગી બને ? વગેરે વિચારવું.

બાકી ખાસ કર્તવ્ય તરીકે પૂર્વ લેખાંકમાં બતાવ્યા પ્રમાણે અલગ કોટિના આત્મવિચારનો ખૂબ અભ્યાસ રાખવો. એમાં મન રોકાયું રહેવાથી બીજા-ત્રીજા વિચારો ઘણા અટકશે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૧૮, તા. ૧૧-૧-૧૯૬૪

૧૨૬ દુઃખ અને દૂષિતમનનો નાશક વર્તમાન સમય

માનવ જીત છતી બુદ્ધિશક્તિએ દુઃખ અને દૂષિત મનથી પીડાય એ દુઃખદ ઘટના છે, એમાંય જૈન એ સ્થિતિમાં હોય એ વળી વિશેષ દુઃખ કહેવાય. નહિતર બુદ્ધિશક્તિથી યા જિનના વચનથી એવા એક અક્સીર ઉપાયને અજમાવી શકે છે કે જેથી એ દુઃખી ન બને, અને એનું મન દૂષિત ન થાય.

આ અક્સીર ઉપાયોમાં એક છે વર્તમાન સમયનો ઉપયોગ. આ ‘વર્તમાન સમય’ એટલે આજનો જડવાદી કાળ નહિ, પરંતુ જે જે સમય-સમય પસાર થઈ રહ્યો છે તે પ્રત્યેક સમય. એનો ઉપયોગ આ રીતે,-

માણસ પોતાને દુઃખી કેમ સમજે છે ? કાં ભૂતકાળની બાબત મન પર લાવે છે, અથવા ભવિષ્યનું ચિંતવવા બેસે છે અને મન બગાડે છે. માટે વર્તમાનમાં પાંચ પૈસા કમાયો, પણ એ વખતે જો આના મન પર એમ આવે કે પહેલા આના કરતા સારું કમાયો હતો, તો દીનતા આવે છે, ઓછું મળ્યાની કલ્પના થાય છે. ઈત્યાદિથી મન બગાડે છે, અને દુઃખી થાય છે.

એવી રીતે જો ભવિષ્યનું ચિંતવે છે કે, ‘મોંઘવારી વધી ગઈ છે, અગર ખર્ચ વધી ગયા છે, તેથી કમાયેલું ખરચાઈ જશે !’ તો નિરાશા, ભય, હાયવોય, વગેરેથી મન બગાડે છે અને દુઃખી થાય છે.

અથવા જો એમ વિચારે છે કે ‘પેલાને ઘણું મળ્યું, એ ભારે કબાડી ! સરકારે વળી કેવી હાડમારીઓ ઊભી કરી છે ! બજારો ને વેપારીઓનાં ય ક્યાં ઠેકાણાં છે ?...’ તો ય મન ઈર્ષા, સંતાપ વગેરેમાં અટવાઈ બગાડે છે અને દુઃખી થાય છે.

આવા લોચા વાળવાની જગાએ જો એમ વિચારે કે ‘ઊભો રહે, જે વર્તમાન સમયમાં છું એને સફળ કરવા શું કોઈ સદ્ગુણી નથી તે દીનતાના દુઃખના, ઈર્ષા, સંતાપ અને ભયના વિચારો કરું છું ? વર્તમાન સ્થિતિ ચોક્કસ પ્રકારના કર્મથી ઊભી થઈ છે, તો એમાં આડા અવળા વિચાર કે ચિંતા કરવાનું શું કામ છે ? તેમ એનાથી વળવાનું શું ? ઊલટું એ કરીને મારો વર્તમાન સમય બગાડી રહ્યો છું. આસપાસ ગમે તે સ્થિતિ હો, યા પૂર્વ ગમે તે બન્યું હો કે ભવિષ્યમાં ગમે તે બનવાનું હો, પરંતુ મારે વર્તમાન સમય અસદુ વિચારોથી બગાડવો નથી.’

આ સાવધાની પાકી રખાય, તો પછી એ જ શોધાય કે ‘ચિત્તમાં કઈ સારી વિચારસરણી પ્રસ્તુતમાં રાખી શકાય ? કેવો નિર્મળ અધ્યવસાય હૈયામાં રમતો કરાય ?’

પ્રસંગ એનો એ જ હોય, પરંતુ એના પર અશુભ વિચાર પણ કરી શકાય અને શુભ પણ કરી શકાય. આપણી સામે કોઈ ખરાબ ઘટના બની ગઈ એના પર જો એમ વિચારાય કે ‘ક્યાં આ બન્યું ! એવું કરનારા ખરાબ માણસો છે,’ તો એ કષાયનો વિચાર થયો, પરંતુ જો એવું વિચારાય કે, ‘હોય, ભવિતવ્યતાનો એવો જ ભાવ હોય તે કેમ અન્યથા થાય ? કરનારાને સદ્ગુદ્ધ પ્રાપ્ત થાઓ,’ તો એ વર્તમાન સમયનો શુભ વિચાર થયો. એમ નથી ને આપણી જ કોઈ ભૂલ થઈ ગઈ એના પર એવા વિચાર આવ્યા કરે કે, ‘આ ઉતાવળ કરી નાખી, ફલાણાના ભરોસે કુટાયો...,’ તો એ ખોટા ખેદના વિચાર થયા, પણ જો એમ વિચારે કે, ‘ચાલો સાવધાની મળી. હવે ભૂલ, ઉતાવળ, ખોટા ભરોસા નહિ કરવા. જગતની વચ્ચેના જીવન સાવધાનીથી જીવવા, મોહ અને અજ્ઞાનને વશ ન થવું...’ વગેરે, તો એ સારી વિચારણા થઈ.

વર્તમાન દરેક સમય સારો જ વિચારથી વ્યાપ્ત હોય એ જોવાનું છે. એ માટે મન બગડવા ન દેવાની તકેદારી જોઈએ. ગમે તેવી બાબત પર પણ આપણા મોંઘેરા અને બહુફળદાયી મનને શા માટે આપણો જ બગાડવું ? શુભ ભાવમાં રાખેલું મન કલ્પનાતીત લાભ આપે છે ! ધ્યાન રાખવા જેવું છે કે બનાવો તો ભૂતકાળનો વિષય બની જવાના, પરંતુ મનના શુભશુભ ભાવની ઘેરી અસરો ઊભી રહેવાની. તે ય આપણા આત્મા સાથે જડબેસલાક લાગેલી રહેવાની. શા સારું અશુભ ભાવ કરવાની મૂર્ખાઈ કરવી ? પ્રત્યેક સમયે શુભ ભાવની તક છે, તે કેમ સફલ ન કરી લેવી ?

દરેક વર્તમાન સમય શુભ ભાવ શુભ વિચારવાળો રાખવાથી આ પણ લાભ છે કે મન દુઃખ ભૂલે છે અને સુખશાન્તિનો અનુભવ કરે છે. એવું જ વર્તમાન સમય શુભ પ્રવૃત્તિમાં રાખવાથી પણ ચિત્ત પ્રફુલ્લિત રહે છે, દુઃખ વીસરાઈ જાય છે.

બસ, મન વ્યાકુળ થાય, ખોટા વિકલ્પો, ખેદ કે ચિંતામાં ચેદે, દુઃખ-દુઃખ લાગ્યા કરે, ત્યાં આ સાવધાની કરવાની કે ‘ઊભો રહે, આ વર્તમાન સમય શા માટે આમ બગાડવાની જરૂર છે ? આપણું ભાગ્ય, જીવોનાં ભાગ્ય, ભવિતવ્યતા, પુદ્ગલનાં સ્વરૂપ, ભાવદ્યા, વગેરે વગેરેમાં જ કોઈનો વિચાર કરવા દે.’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૧૮, તા. ૧૮-૧-૧૯૬૪

૧૨૭ વીતરાગ મિલનની આડે દિવાલો

મંદિરમાં ઈલેક્ટ્રિક લાઇટ (લેખાંક-૧)

વીતરાગ શ્રી તીર્થકર ભગવાનના ધર્મને માનીએ છીએ એ વીતરાગ બનવા માટે. આ ધર્મ માનવામાં એ જ ઉદ્દેશ હોય-હોવો જ જોઈએ, એ સહજ છે, આ ઉદેશની સફળતા માટે જ એ દેવાધિદેવને ભજવાનું અને એમની આજ્ઞાને આરાધવાનું આવશ્યક છે. એમને ભજ્યા વિના અને એમના શાસનને આરાધ્યા વિના ન બનાય એ નિર્વિવાદ છે.

પરંતુ આ સાથે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે શ્રી વીતરાગ પ્રભુને ભજતા જઈએ અને એમની આજ્ઞાને આરાધતા જઈએ, એમાં વીતરાગ પ્રભુને આપણું, દિલ મળતું રહેવું જોઈએ. વીતરાગ સાથે દિલનું મિલન થતું રહેવું જોઈએ.

વીતરાગ સાથે મિલન એટલે ? એ જ કે વીતરાગને સામે રાખ્યા છે, વીતરાગને સેવીએ છીએ, ધર્મ વીતરાગનો આરાધીએ છીએ, ત્યાં મનની આ જગ્યાતિ જોઈએ કે આ દેવ વીતરાગ છે, સર્વથા ઉપશાન્ત છે, રાગાદ્ધિના સર્વ ઉકળાટથી રહિત સૌભ્ય બનેલા છે, અને મારે એવા થવું છે. જો મનની આ જગ્યાતિ ન હોય તો મુખ્ય લક્ષ્ય જ ચૂકી જવાનું થાય. એથી શ્રી વીતરાગને ભજવાના અને એમનો ધર્મ આરાધવા ભરોસે રહેવા છાતાં વીતરાગ બનવાના અંતિમ પરિણામથી ઘણે ઘણે દૂર જ રહેવાનું થાય. કારણ એ છે કે એમાં તો પછી વીતરાગ ભૂલાઈને રાગદ્વેષ સાથે જ મિલન રહ્યા કરવાનું, તો એ ક્યાંથી વીતરાગતાની નજીક લઈ જઈ શકે ?

માટે વીતરાગ સાથે મિલન સાધના-કાળમાં અતિ જરૂરી છે.

એ તો જ શક્ય બનશે કે જો વીતરાગ-મિલનને અટકાવનારી દિવોલો આડે ખડી ન કરવામાં આવે કે હોય તો ખડી ન રહેવા દેવાય. એવી કેટલીય દિવાલો કે જે વીતરાગ-મિલનની આડે આવે છે. દા.ત.

જિનમંદિરમાં ઈલેક્ટ્રિક લાઇટના ઝગારા એ આંખને એટલી બધી આંજી દે છે કે એમાં પ્રતિમાની વીતરાગ-મુદ્રા નિહાળવી મુશ્કેલ પડે છે. રસ્તે ચાલતાં રાત્રે સામેથી મોટરની ફલેશ લાઇટ આવી, તો એ આંખને એવી આંજે છે કે બીજું દેખાય જ નહિ ! એવું અહીં બને છે. મૂર્તિની રચનામાં મુખ પર અવયવોને અનુસારે ઊંચા નીચા ભાગ હોય છે અને મધ્યમ મુલાયમ પ્રકાશમાં એમાં Shade-

light ધ્યાન-પ્રકાશ કાયમ રહેવાથી મુક્રાના ભાવ બરાબર દેખાય છે, જ્યારે વિજળીક-પ્રકાશના જગારામાં એ કંઈ રહે નહિ, તેથી ભાવ ક્યાંથી બરાબર દેખાય ?

બીજું એ પણ છે કે વિજળીક પ્રકાશનો મોહ મનને વીતરાગનું આકર્ષણ ચૂકવી પ્રકાશના આકર્ષણમાં તાણે છે. આજના કાળના લાઈટના ભપકાનો રંગ જિનમંદિરમાં પણ એવી લાઈટ તરફ ચિત્તને ખેંચે એ સ્વાભાવિક છે, ત્યાં વીતરાગતા પર મન શી રીતે કેન્દ્રિત બને ?

વળી એ પણ હકીકત છે કે વીતરાગ દશા પર ચિત્ત સ્થાપવું હોય તો મહા આરંભની વસ્તુનો વીતરાગની ભક્તિ નિમિત્તે મોહ નહિ રાખવો જોઈએ. ઈલેક્ટ્રિક લાઈટના જગારામાં કેટલાય ત્રસ જીવોની હિંસા થાય છે. રાત્રિના મંદિર માંગલિક કરતી વખતે એ લાઈટ એકદમ બંધ થતાં જીવજંતની કઠી દશા થાય છે એ તો અનુભવ કરનારા સમજુ શકે. પ્રતિમાજી પર ફલેક્ષ લાઈટના ફોક્સ પડવામાં વિજળીની ગરમીથી પ્રતિમાજી પર પણ ખરાબ અસર થાય છે. આ બધા તરફ આંખમિચામણા થાય ત્યાં અનંત જીવોને અભયદાન કરનાર પ્રભુની અહિંસા અને વીતરાગભાવ પ્રત્યે ચિત્ત શી રીતે આકર્ષિત રહે ?

ત્યારે એ પણ અનુભવસિદ્ધ છે કે ધીના દીવાની રોશનીમાં પ્રભુના દર્શને જે ઠંડક અને આધ્યાત્મિક ભાવની વૃદ્ધિ અનુભવાય છે એ વિજળીક પ્રકાશમાં નહિ. આ બધું જોઈને પૂ. ગણિવર્ય શ્રી ધર્મસાગરજી મહારાજ તથા શેઠ પનાલાલ ઉમાભાઈ આદિના પ્રયત્નથી અમદાવાદમાં તા. ૧૫-૮-૬૩ ના રોજ મળેલી સંઘસભામાં પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય મનોહરસૂરિજી મ., પૂ. આ. શ્રી વિજય કીર્તિસાગરસૂરિજી મ., પૂ. આ. શ્રી વિજય રામસૂરિજી મ. (ઉહેલાવાળા) આદિ વિશાળ શ્રમણ-સમુદ્દ્રાય તથા અમદાવાદના અગ્રણી શ્રાવકોના ભાષ્ણો પૂર્વક ઢીક જ છરાવ થયો કે,

‘દહેરાસરના ગર્ભગૃહ તથા રંગમંદ્ર આદિમાં બધે ઠેકાણો હિંસા, આશાતના આદિના કારણે ઈલેક્ટ્રિક લાઈટ ન થવી જોઈએ. આ માટે સૌને લાગતાવળગતાઓને આ સંબંધી યોગ્ય પ્રયત્ન કરી ઈલેક્ટ્રિક લાઈટ બંધ કરવા-કરાવવાની (આ સભા) ભલામણ કરે છે.’

આનો પ્રચાર કરવા સમિતિ પણ નીમાઈ છે અને પૂ. સાધુ-સાધ્વીજી મહારાજોને ભક્તિમહોત્સવો વગેરેમાં પણ ઈલેક્ટ્રિક-લાઈટ બંધ કરાવવાનો જોરદાર ઉપદેશ આપવા વિનંતિ કરાઈ છે.

જ્ઞાવા મળ્યું છે કે આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટનાં દેરાસરોમાં આનો અમલ થયો છે. અમદાવાદના દેરાસરોમાં ગભારામાંથી વિજળીક દીવા દૂર કરાયા છે. રંગમંડપમાંથી પણ કટાવવા તજવીજ ચાલું છે.

ભારતભરના જિનમંદિરોમાં તેમ થવાની જરૂર છે. ગભારામાં ધીના દીવા અને રંગમંડપમાં છેવટે કોપરેલના દીવા રાખી શકાય. ધાર્મિક મહોત્સવોમાં પણ આ વિવેક જરૂરી છે, જેથી ભૌતિકવાદ ન પોખાય અને આધ્યાત્મિક ભક્તિ-શક્તિ ખીલે. સવારે બહુ વહેલા પ્રકાલ-પૂજાદિ કરવાની ઉતાવળ ન કરવી જોઈએ.

સારાંશ, વીતરાગ સાથે હૈયાનું મિલન કરવા આડે મંદિરમાંની આ લાઈટ દિવાલરૂપ છે. એ દૂર થવાની ખાસ જરૂર છે.

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૨૦, તા. ૨૫-૧-૧૯૬૪

(લેખાંક-૨)

વીતરાગ ભગવાન સાથે હૈયાનું મિલન કરવું છે તો બીજી એક વસ્તુ એ ધ્યાનમાં લેવા જેવી છે કે વીતરાગ ભગવાનની ભક્તિ આપણા હાથે કરવી જોઈએ. પૂજારી પાસે ભક્તિનું કામ કરાવવું એ પ્રભુ સાથેના મિલનની આડે દિવાલ છે. એ તો જીણે પૂજારીનું જ કામ ! એ શું ભક્તિ કરવાનો ? એ જેનેતરને મન તો જેમ મંદિરમાં બીજી સાફસુઝીની નોકરીનું કામ, એમ પ્રતિમાજીનું પણ એક સાફસુઝીનું કામ ! એમાં એ પ્રભુ ઉપર બહુમાન શું રાખે ? દેખાય છે કે મોરપીઠી ઘસંપસં ચલાવે છે ! પ્રભુના અંગે લગાડવાની મોરપીઠી પબાસણ પર પણ ઘસે છે ! જીવજંતની રક્ષાની તો વાતેય શી ? વાળાંદુંચી તો જીણે એક ઓટલો સાફ કરવાના કૂચદાની જેમ ભગવાનને ગોદા મારતો ઘસાધસ ઠોક્યે રાખે છે ! આ તે પ્રભુની ભક્તિ છે કે વિટંબણા ? ધરાર નજર સામે શ્રાવક આ જુએ અને ચલાવી લે, અને પોતાનો સમય કિમતી માની, યા તકલીફનું કાર્ય માની કે એથી નીચે ઊતરીને નાનમનું કામ સમજુ, પોતે એ ન કરે, એમાં વળી પોતાના હૃદયનાથ ભગવાનની વિટંબણા થઈ રહી હોવાનું ય ન સમજે, એને વીતરાગ પ્રભુ સાથે હૃદયનો મેળ ક્યાંથી જામે ? લોભ અહંત્વાદિ કષાયો ઓછા કરી વીતરાગતા તરફ પ્રયાણ કરવાનું કયાં ઊભું રહે ?

અનંતા કાળથી આપણને આ સંસારમાં ભટકાવનારા રાગદ્રેષ્ટી મુક્ત થઈ આપણે વીતરાગ બનવું છે, તો સ્વાર્થના રાગ ઓછા કરી વીતરાગ પ્રત્યે ભક્તિ બહુમાન અને આકર્ષણ વધારવા જોઈએ. ત્યાં પછી ‘મારો સમય કિમતી છે,

એટલે પ્રભુના નિર્માય ઉતારવા મારી પાસે સમય નથી. વળી એ તો એક નોકરીનું કામ, હું કોઈ પ્રભુનો એવો નોકર નથી...' આવી બધી ગણતરીમાં નર્યો સ્વાર્થરાગ અને અહેત્વ પોષાય, વીતરાગની વિટંબણા ચલાવી લેવાય, ત્યાં વીતરાગ સાથે મિલન ક્યાંથી થાય ? ઉલટું ઘિંઠાઈ કરવા જતાં સ્વાર્થરાગ, અહેત્વ વગેરે મજબૂત થવાથી વીતરાગ-મિલનની આડે જોરદાર દિવાલ ખરી થાય.

આવું કેટલેય ડેકાઝે હવે પ્રક્ષાલ અંગે બની રહ્યું છે, પ્રભુની પૂજા એટલે જાણે માત્ર કેશરપૂજા-તિલકપૂજા, એવો ડિસાબ રખાઈ રહ્યો છે ! એટલે પખાળ તો પહેલાં પૂજારી જ પતાવી લે છે. કદાચ મૂળનાયક પ્રભુનો પખાલ શ્રાવક કરવા જશે. પણ બાકીના ભગવાનનો પૂજારીના માથે ! આ કેવી શેઠાઈ ! પ્રક્ષાલપૂજા એ ઈન્દ્રો અને દેવોએ કરેલ કલ્યાણકના અભિપેકનું પ્રતીક છે. અની ઉપેક્ષા કરી પૂજારીને પખાળ ભળાવી ઢેવો, એ પણ વીતરાગ-મિલનની આડે દિવાલ ખરી કરવા જેવું છે. પૂજારી પખાળમાં શો વિવેક અને શી ભક્તિ દાખવવાનો હતો ? ત્યારે મહાન પ્રક્ષાલ-પૂજા કરવા વખતના ઉચ્ચ ભાવોલ્લાસ એ પૂજા જાતે ન કરવામાં ક્યાંથી આવી શકવાના ?

આપણી વૃત્તિઓ અને આપણા પ્રમાણની જાંચ કરવી જોઈએ છે, અને એનું પૃથક્કરણ કરવું જરૂરી છે. એમ કરતાં દેખાશે કે આપણે કેટલીક વાર અહેત્વ, કાયાની આરામીની મમતા, મહત્વની આકંક્ષા, શેઠાઈનો મંદ, બહાના હેઠળ માયા, વગેરે કષાયો જ પોષતા હોઈએ છીએ. અને એ વીતરાગ મિલન નહિ પણ વીતરાગથી દૂર પડવાનું કરાવે છે.

આ કેટલી બધી કમનસીબી ? જે ઉત્તમ સત્કિયાઓમાં તો કષાયો દબાવી શકવાની અને ઉત્તમ ભાવોલ્લાસ સ્કુરાયમાન કરવાની સારી અનુકૂળતા છે, ત્યાં જ એનાથી ઊંધું વેતરણ, ઊંધી ચાલ અને અવળા ખેલ આદરાય પછી જીવને બચવાનું ક્યાં ? વીતરાગની માયા વધારવાનું ને દૂર દૂરની પણ વીતરાગતાની દિશામાં ડર ભરવાનું ક્યાં બનવાનું ? અનંતી વાર ધર્મક્ષયાઓ આમાં જ નિષ્ફળ ગઈ છે. વર્તમાન જન્મની સાધનાઓ સફળ કરવી હોય તો આ લક્ષ જાગતું રહેવું જોઈએ કે, 'બંધુ ય કરીને મારે વીતરાગ પ્રભુ સાથે હૈયું મેળવવું છે' પછી એક બાજુએ તારક દેવાધિદેવની વીતરાગતા પર મુખ્ય દર્શિ રાખી એમના પર ઉદ્ઘળતો અનન્ય ભક્તિભાવ કેળવવાનો અને બીજી બાજુ ઈન્દ્રિય વિષયો તથા કષાયોના જેંચાણ ઓછા કરવાનાં.

"દિવ્ય-દર્શન"-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૨૧, તા. ૧-૨-૧૯૬૪

(લેખાંક-૩)

વીતરાગ સર્વજ બની ભવદુઃખથી મુક્ત થવા માટે સાધના કરવાનું શ્રેષ્ઠ જીવન માનવજીવન છે, પરંતુ એ સાધના વીતરાગના આલંબન વિના શક્ય નથી. વીતરાગનું આલંબન ખરેખર પકડવાનું ત્યારે જ બનશે કે વીતરાગની સાચી માયા લાગશે. વીતરાગ પ્રભુ સાથે હૈયું ભળશે. વીતરાગમિલન વિના એમનું આલંબન ધર્યાનો વિશ્વાસ ખોટો નીવડવાનો. કહીએ કે, 'મારે વીતરાગનું શરણ છે, નજર સામે એ જ રાખવાના છે.' અને એમની માયા લાગી નથી. તો એ શરણ, આલંબન બનાવટી, ખાલી મન મનાવ્યાનું છે.

વીતરાગની માયા-મમતા લગાડવી હશે એટલે તો વીતરાગતા પર આકર્ષાઈ જવું જોઈશે. મનને એમ થાય કે ધન્ય પ્રભુ ! જે જાલિમ રાગ-દ્રેષાદિની શરમજનક રમત અમે આચરી રહ્યા છીએ અને એથી આ હુંખરૂપ, હુંખફલક અને હુંખાનુંબધી સંસારમાં પીસાઈ રહ્યા છીએ, એ રાગદ્રેષાદિનો સંપૂર્ણ નાશ કરી આપ વીતરાગ બન્યા છો ! ક્યારે એમે પણ આ રાગદ્રેષાદિની દુષ્ટ રમત મૂકીને વીતરાગ બનીએ ! વીતરાગતા અને વીતરાગનું આ આકર્ષણ અને વીતરાગતાની ખરી ભૂખ ઊભી થાય ત્યારે વીતરાગની સાચી માયા લાગે.

વીતરાગ સાથે માયા લાગે એટલે કે વીતરાગની સાથે હૈયાનું મિલન થાય. પત્ની-પુત્રાદિ સાથે હૈયાનું મિલન થાય છે એ અનુભવ સિદ્ધ છે. એવું પરાયા સાથે નથી થતું. પરંતુ જીવનમાં કેટલીક મૌલિક ખામીઓ વીતરાગ ભગવાન સાથે હૈયાનું મિલન નથી થવા હેતી. એ ખામીઓ મિલન આડે દિવાલ જેવી છે. એમાં મૂળ ખામી ભવરાગ છે.

સંસાર પર ગાઢ રાગ, પાકો પક્ષપાત, સંસારના સુખો પ્રત્યે નિર્ભક આસક્તિ,- એવી કે આના જ કારણે પારાવાર હુંખો ઊભા થયા છે એવું મનને જરાય ન લાગે,-એ ઉત્કૃષ્ટ કોટિના અનંતાનુંબધી નામના રાગને પોષે છે, અને એને શાસ્ત્ર સમ્પ્રક્તવના ધાતક કહે છે, ધુકડને અંધકાર ગમે, પછી તેજ ક્યાંથી ગમે ? એમ અહીં સંસાર, સંસારના પદાર્થ મીઠા લાગે, પછી વીતરાગ ક્યાંથી મીઠા લાગે ? સંસાર સાથે હૈયાનું મિલન છે એટલે પાછળ રાગ-દ્રેષ-કામ-કોધ-લોભાદિ સાથે ય તન્મય હદ્યમિલન છે, એ દિવાલ છે. એ વીતરાગ સાથે મિલન નહિ થવા હે.

બીજી દિવાલ છે ઉપકારી પ્રત્યેના કૃતજ્ઞભાવનું વિસ્મરણ, ઉપકારીને ઉપકાર

કર્યે વર્ષો વીત્યા હોય, અથવા નજીકના ઉપકાર પછી એમની સાથે મનોભેદ કે મતભેદ પડ્યો હોય, પણ તેથી કંઈ ઉપકાર રદ નથી થતો. તો અને ભૂલાય જ કેમ ? એનું મૂલ્યાંકન કેમ જ વિસરાય ? ખાસ કરીને માતા-પિતાએ તો સંતાનની તદ્દન અબુજુ-અશક્ત-અસ્વાધીન દશામાં જાતે કષ-અગવડ તથા સંતાનની ઉદ્ધતાઈ-આડાઈ પણ સેવીને પોષણ-શિક્ષણ-ગુણસંપાદન વગેરેનો અનહદ ઉપકાર કર્યો છે, પરંતુ જો સંતાન હવે મોટા થયે એમની પ્રત્યે કૃતજ્ઞભાવ ભૂલે તો અની પાછળ જાલિમ તૃષ્ણા, વાસના, સ્વાર્થધિતા કે ગર્વ-ગુસ્સો કામ કરી રહ્યા હોય છે. એમ બીજાના ય ઉપકાર ભૂલવામાં પણ એ દશા હોય છે. આવા નિષ્ઠુર હદ્દયની પ્રભળ દોષની પકડ વીતરાગ સાથે હદ્દયનું મિલન થવા દેતી નથી, એ નિર્વિવાદ છે.

વળી એક દિવાલ છે હદ્દયની મલિનતા, અપવિત્રતા, બીજાઓ સાથેના બ્યવહાર દિલમાં કપટભાવ રાખીને કરાય, ધંધાધાપા વગેરે અંગે હૈયું માયાવી અને નિષ્ઠુર રખાય, એમ પરસ્તીઓ પ્રત્યે છૂપી દાણીઓ નખાય, દિલમાં વાસનાને ભભુક્તી રખાય, બધે પોતાનું સારાપણું ને પોતાની હોશિયારી દાખવવા દિલમાં બીજા પ્રત્યે છૂપા ઈર્ઝાભાવ, બીજાના અસદ્દોષોની દાણી, એમ વગર હકનો માલ લેવા-ભોગવવાની રુચિ-કંકણા, સેવા-કર્તવ્યમાં ભોગ ન આપવો પડે એવી છૂપી ગણતરી...વગેરે વગેરે દિલની મલિનતાઓ છે. આવું અપવિત્ર દિલ વીતરાગ સાથે ક્યાંથી મળી શકે ? પરમ પવિત્ર વીતરાગદેવની સાથે મિલન પરમ પવિત્રતાની કંકણાવાળાને હોય, પરંતુ અપવિત્ર દિલની ધૂમ પ્રવૃત્તિઓ કર્યે જવી છે, અને એ અપવિત્રતા તરફ ધૂણા જ ક્યાં છે ? એ ધૂણા નહિ, તો પરમ તો શું, પણ સામાન્ય પવિત્રતાની ય રુચિ-ઝંખના-ગરજ ન હોય. તો એ વિના વીતરાગ-મિલન નહિ થઈ શકે.

વીતરાગમિલનની આડે વળી એક દિવાલ છે સ્વાર્થધિતા. જ્યાં બીજાનો વિચાર જ નથી, પરાર્થ-પરોપકાર એ જાણો જીવનનું એક અંગ જ નથી સમજાતું, ‘મારે મારું જ જોવાનું’ આ જ એક જીવનસરણી છે, બીજાને તકલીફ પડે એની પરવા નથી, બીજાની દુઃખ-અગવડનું શક્ય અને સરળ પણ નિવારણ લેશ પણ કર્તવ્ય લાગતું નથી અને સામાન્ય પણ પ્રયત્ન એ માટે કરવો નથી, આવા નર્ય સ્વાર્થમૂઢ માણસને વીતરાગ સાથે શી લેવાદેવા છે ? વીતરાગને એ કદાચ ભજશે તો એથી પોતાનો સ્વાર્થ નીચોવી લેવા માટે જ. એમાં તો સ્વાર્થમિલન છે, વીતરાગમિલન નહિ, એ માટે તો ‘વીતરાગ આખા જગતના અનન્ય અનુપકૃત-ઉપકારી છે, મારા પર અનંત ઉપકારને કરનારા છે, વળી એ અલોકિક અનંત

ગુણોને ધરનારા છે, અને અનંત કલ્યાણ માટે પરમ આલંબન છે, માટે એજ મારા આત્માના હૈયાના હાર, માથાના મુગટ, આંખની કીકી અને જીવનધ્યેય હો’...આવા ભાવ સાથે એમને ભજવા જોઈએ તો જ વીતરાગમિલન શક્ય છે.

ભવવિતરાગ, કૃતજ્ઞતા, પવિત્રતા, પરાર્થવૃત્તિ વગેરે દ્વારા વીતરાગમિલનની આડે આવતી દિવાલો દૂર કરીએ.

શિષ્ય-હિતાર્થ સદા જગૃત

સં. ૨૦૩૭ના સુરતના ચાતુર્મિસમાં રવિવારીય શિબિરો થઈ. શિબિરનો એક યુવાન મને મણ્યો : “સાહેબ, હું દર રવિવારે શિબિરમાં આવું છું. મેં આપને પત્ર લખ્યો હતો તે જ હું...”

“કયો પત્ર ?”

“કેમ, રજી. એ.ડી.શી ૧૮ પાનાંનો પત્ર મેં આપને લખ્યો હતો. આપને રૂબરૂ મળવાનો સંકોચ થતો હતો તેથી પત્ર લખ્યો. પણ આપનો કોઈ પ્રત્યુત્તર ન મળ્યો...”

“પણ, મને તો આવાં ૧૮ પાનાંના રજી. પત્રની કોઈ ખબર જ નથી. મને એવો કોઈ પત્ર મણ્યો નથી, હું તપાસ કરીશ.”

બધી ટપાલો પહેલાં પૂજ્યપાદશ્રી પાસે આવતી તેથી મેં તેઓશ્રીને પૂછ્યું : “ગુરુદેવ ! થોડા દિવસોમાં મારા નામનો કોઈ રજી. પત્ર આવેલો ? આજે એક યુવાન વાત કરતો હતો.”

“હા, રલસુંદર ! એક આવેલો ખરો. તે પત્રમાં તારાં પ્રવચનોનાં ખૂબ વખાણ લખેલાં તેથી તારા પ્રત્યેની હિતબુદ્ધિથી તને આપ્યા વગર પત્રની જયણા કરી દીધી. પત્રમાં બીજું કાઈ વિશેષ નહોતું.”

પૂજ્યશ્રીની વાત સાંભળતા જ મારી આંખો ભરાઈ ગઈ. શિષ્યોના હિત માટે પૂજ્યશ્રી કેવા સદા જાગ્રત હતા !

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

૭૫ જીવનની આંધીથી કેમ બચાય ?

(લેખાંક-૧)

આજે આ મોટા પ્રશ્ન છે કે ‘ધર્મ આચરવા છતાં હૈયે ધર્મનો રંગ કેમ નથી જામતો ? ધર્મભય વિચારો, કેમ નથી ચાલતા ? ધર્મની જ વાતચીતો વિશેષરૂપે અને મુખ્યરૂપે જીવનમાં સ્થાન કેમ નથી પામતી ?...’

પણ આનું નિદાન સ્પષ્ટ છે કે આજનાં જીવન જડ-પ્રધાન બની ગયા છે. જ્યાં ને ત્યાં ઈન્દ્રિયોના જડ વિષયોની ઉજળામણ અને ઝક્કમાળતાને જ આગળ કરવાનું થાય છે. લગભગ બધી વાતોચીતો અને વિચારણા એ કેન્દ્રની આસપાસ જ ચાલુ હોય છે. ત્યાં મારા આત્માનું શું ? કે સામાના આત્માનું શું ? એનો વિચાર જ કોઈ નથી આવતો ! બધા જ સંસારબ્યવહાર એવા જડમુખા જ હોય ત્યાં પછી ધર્મક્રિયાની અસર શી ઊભી રહે ? ઊલટું આની અસર ધર્મક્રિયા પર થાય છે ! તો ધર્મમાં ય જડનો રંગ મુખ્ય કરી એમાં જ અટવાઈ રહેવાનું બને છે. દા.ત. પ્રલુનું ચૈત્યવંદન કે પૂજા થઈ સ્તવન કે પૂજાની ઢાળ કોઈએ સુંદર રાગ-આલાપથી ભણાવી તો બસ એ સુંદરતામાં જ મન અટકી જાય છે. ‘વાહ કેવો સરસ રાગ ! કેવો અદ્ભુત આલાપ ! કેવી બોલવા-ગાવાની છટા અને મિઠાશ !’ થયું, ‘આત્માને માટે કંઈ એમાં આવ્યું ?’ એનો વિચાર જ નથી ! ક્યાંથી હોય ? બાબુ જીવનમાં કેવળ જડમયતા છે, જડ પુદ્ગળની જ બોલબાલા પર મન કેન્દ્રિત છે, વ્યવહાર બધો જ જડને અનુલક્ષીને છે, પછી એની ઘેરી અસર ધર્મક્ષેત્રમાં ય પહોંચે એમાં નવાઈ નથી.

છોકરાનો જન્મ થાય છે. ત્યાંથી માંડીને એની ચિંતા જડ પૌદ્ગળિક સુખ અને શોભા તરફ જૂંકેલી રાખીને કરવામાં આવે છે. એને આધુનિક ફેશનના સારા કપડાં, આધુનિક રમકડાં, ભૌતિક ચિત્રો, ને રેટિયો-સંગીત આદિથી એને ખુશ કરવાનું, બસ આના તરફ જ લક્ષ રહે છે. એને શબ્દ શિખવાડાય તો ‘બા, બાપા, ભાઈ, કાકા,’ એવા જ. ક્યાંય આમાં આત્માને અનુલક્ષીને વાત છે ? ભલે એ અણસમજણું છે, પણ જેવું દેખે છે એવા સંસ્કાર એના મગજ પર પડ્યા જ કરે છે, એ ભૂલવા જેવું નથી. એવા વિરલ બાળકો પણ જાણવા મળે છે કે જેને મંદિર, ઉપાશ્રય વગેરેની ચર્ચામાં પલોટ્યાં હોય છે તો એને એનો રસ લાગી જાય

છે, અને પછી આડો કરીને પણ એ ચર્ચા રોજ માગે છે. ‘બા, બાપા’ વગેરે સાથે વીર, અરિહંત વગેરે શબ્દો શિખવાડવાનું કરાતું હોય તો પછી એની રઠ લાગે એ સહજ છે. પણ આ કેટલા જૈનધરોમાં ? બાળકની દાખિમાં મોહના ચાળા-ચેદ્યા કરવાથી એના ભાવુક મન પર એની અસર પડે છે. મા બાપને પોતાના જડના રંગરાગમાં આ જોવાની તમના નથી અને બાળકની દાખિમાં ગમે તેમ વર્તવાની, બોલવા-ચાલવાની છૂટ છે, તો બાળકના મગજ પર એના ખરાબ સંસ્કાર પડવાના એ સહજ છે. એનું પરિણામ દેખાય છે કે બાળકો કુચેષ્ટાઓ કરે છે, મોટા થયેલ છોકરાઓમાં બદીઓ પેઠી છે.

છતાં આશ્રય છે કે બાળકને સારા આત્મહિતકારી સંસ્કાર પડે એવો વ્યવહાર, શિક્ષણ અને વાતાવરણ નથી અપાતું ! કુટુંબમાં જડમુખી વાતોને બદલે સામાયિક પ્રતિકમણ-પૂજા-પ્રતનિયમ-દ્યાદાન વગેરેની ભરપૂર વાતો ચાલતી હોય, પ્રવૃત્તિ હોય, એક બીજાના ગુણાનુવાદ-ક્ષમા-સહિષ્ણુતા-ઉદારતા વગેરેના ભરપૂર વ્યવહાર હોય તો બાળકના મન પર એના સંસ્કાર પડે. એમ બાળકને શિક્ષણ પણ માર્ગનુસારી જીવનનું, ધર્મપ્રવૃત્તિનું, દ્યા, સત્ય, પ્રામાણિકતા વગેરે ગુણોનું અપાતું હોય, તેમ બાળકની આજુબાજુ વાતાવરણ, દા.ત. ધરમાં મહાપુરુષોના ફોટા, એમનાં ધર્મપરાક્રમોના ચિત્રો, તેમજ ધર્મના ભરપૂર સાધન ઉપકરણ હોય, મોટાઓનો ગુણમય વ્યવહાર, ધર્મના સ્તોત્રો-ગીતો-સૂત્રો બોલાતા હોય, અતિથિ-સાધુ-દીનદુઃખીની યોગ્ય સરભરાઓ થતી હોય, સામાયિક-સ્વાધ્યાય-તપ-જપ વગેરે ક્ષયાઓ ચાલતી હોય, -આવા સુંદર ધ્યાંક-આધ્યાત્મિક વાતાવરણ હોય તો એની બાળકના મન પર સુંદર અસર-સંસ્કાર પડે.

આનાથી ઊલટું કુટુંબમા રગડા-ગડા, ઊંચા બોલ-તુચ્છકાર-તિરસ્કાર ચાલતા હોય, રંગરાગ વિલાસની જ પ્રવૃત્તિઓ થતી હોય, તુચ્છ ગપ્પાસપ્પા, એકલી વ્યાવહારિક વાતો, મોહભરી સલાહસૂચ્યના, વિલાસી ચિત્રો-ફોટા, ભરપૂર મોહક સાધનો...આવા બધા વ્યવહાર-વાતાવરણમાં બાળકને જડનું જ શિક્ષણ-સંસ્કરણ મળે એમાં નવાઈ નથી.

આજની દુનિયા સામે જોતા રહેવાથી તો જડ જીવનની જ આંધીમાં જ ફસાવવાનું થશે, કેમકે સહેજે એનું અનુકરણ કરતા રહેવાની જ વૃત્તિ અને પ્રવૃત્તિ રહેશે. વિચાર તો એ જોઈએ કે, ‘અમે જૈન, એટલે જગતથી નિરાણા વીતરાગના શાસનને પામેલા ! અમારા રાહ જગતના જેવા અણાના અંધકારભર્યા ન હોય. અમારી પ્રવૃત્તિ, અમારી ચેષ્ટાઓ, અમારા બોલચાલ-વ્યવહાર અને વાતાવરણ બધું

જ ધર્મ અને અધ્યાત્મભાવથી સુશોભિત-સુવાસિત હોય. દુનિયા જડમુખી હોય, અમે નહિ. અમે તો આત્મલક્ષી, પરમાત્મ-પ્રેક્ષી અને ધર્મ-પ્રધાન જીવનવાળા ! આ ચોક્કસ ધોરણ રાખી એને અનુરૂપ જીવન જીવાય, તો બાળક કોરા જડજીવનથી બચે.’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૨૩, તા. ૧૫-૨-૧૯૬૪

(૧૩૧) (લેખાંક-૨)

કુમાર અવસ્થાના સંતાનોનાં પણ જીવન જડજીવનની આંધીમાં ચઢી ગયા છે. પહેરવેશમાં ઠેઠ પગની પાની સુધીના લેંઘા, પણ માથું ઉઘાંતું ! માથે તો ટોપીનો ભાર-બોજ ગણાય, તે જ ઉડાઈ ! ત્યારે, કન્યાઓના પગ ઢીંચણની ઉપર સુધી ખુલ્લા ! આ વિલાયતી અનુકરણે સદાચાર-રક્ષાની પવિત્ર આધ્યાત્મિક ભાવનાને બાધ કરે છે એવી જડ વિલાસી સ્થિતિ ઊભી કરી, ભણવામાં જાતકાળજી-જાતમહેનતનું જોર ઘટ્યું, ટ્યુશન અને પરીક્ષા સમયે તાત્કાલિક તૈયારી વધી, અનેક રજાઓ, ફંકશનો વગેરેનાં તોફાન, ધાર્મિક વિના કેવળ ભૌતિક વિષયોના શિક્ષણ...વગેરે વગેરે ચાલ્યું. આ શું છે ? જડજીવનની મહા આંધી ! છોકરાઓના માબાપ સાથેના વ્યવહારમાં પણ સવારે ઊઠીને પ્રણામથી માંડી રાતના એમની પગચંપી સુધીના વિનય સેવા વગેરે લુખ થઈ ભણવું-રમવું-ફરવું વગેરે જડજીવનના બેલ લાગી પડ્યા ! છોકરીઓને ય એને યોગ્ય ગૃહજીવન અંગેનું સુસંસ્કરણ કરવાનું જાણે બિનજરૂરી લેખાઈ ગયું ! નહિતર એમાં વહિલની આજ્ઞા-આમન્યા-સેવા તથા સારી શિખામણ વગેરે આધ્યાત્મિકભાવને સ્થાન મળતું ! ના, આ તો છોકરીઓને ય છોકરાની જેમ જ શાળાશિક્ષણ, ડીશ્રી, કોન્સર્ટ, ડાન્સ...! વિશેષ ખતરનાક વળી સહશિક્ષણ ચાલ્યું !

છોકરાઓના બિસ્સાખર્ય, ધાપા-નોવેલ વગેરના વાંચન, રેઝિયોના પ્રોગ્રામ-શ્રવણ, આધુનિક બીજી ફેશન-ફીશિયારી, છોકરીઓને માથાની વેણીઓ ખુલ્લી, અંગ-ટાઈટ કપડાં !

આ બધું સરિયામ જડજીવનને પોખી રહ્યું છે. એ મફતિયા ખર્ચ, ઉદ્ઘતાઈ, અનાચાર, ધર્મ-ઉપેક્ષા, અને બીજા કેટલાય દુર્ગુણોને ઊભા કરે છે ! આ સ્થિતિમાં ઊછરી મોટા થયેલા સંતાનને ધર્મમાં રસ ક્યાંથી હોય ? કુળવ્યવહારથી પર્યુષણ જેવા ધર્મસ્થાને જવું પડતું હોય તો જાય, પણ એમાં મન ક્યાંથી પરોવાય ? આત્મકલ્યાણની બુદ્ધિ શાની રહે ?

આ વસ્તુ પર ગંભીર વિચાર કરવા જેવો છે. સંસ્કારયોગ્ય આ વયમાં તો

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૨૮૭

ખાસ કરીને શક્ય નવી ફેશનો-પદ્ધતિઓ ઓછી ફરી આત્મગુણ-આત્મહિત-પોષક પ્રાચીન પદ્ધતિઓ-રિવાજો પર ખાસ ભાર દેવા જેવો છે. દા.ત. (૧) સવારે ઊઠીને માતા પિતાને પ્રણામ કરે ને, તે પણ પગમાં માથું મૂકીને આશીર્વાદ માગવા સાથે કે ‘આજના દિવસે દોષોથી બચી આત્મગુણ સાધું,’ એમ (૨) દરેક કાર્ય માબાપને પૂછીને જ કરવાની ટેવ, (૩) માતાપિતાના કામકાજમાં જરૂરી સેવા, (૪) શિક્ષણની આકરી જાત-મહેનત, (૫) શિક્ષકનો પાકો વિનય, (૬) માથાના મોંધા તેલ, પફ-પાવડર અને બીજી ફેશનનો ત્યાગ, (૭) સિનેમાં-નોવેલ-ધાપાનો સ્પર્શ નહિ, (૮) આ ઉપરાંત જીવનના ખાસ અંગ તરીકે ભગવાનનાં દર્શન તથા અવશ્ય પૂજા, એ પણ શક્ય એટલી જાતમહેનત અને જાતખર્યના દ્રવ્યવાળી, (૯) રોજ એક સામાયિકમાં અથવા તે વિના એક ધાર્મિક ગાથાપાઠ-પુનરાવૃત્તિ, (૧૦) એક બાંધી નવકારવાળી, (૧૧) રાત્રિભોજન અને કંદમૂળ બંધ, (૧૨) પાંચ તિથિ લીલોતરીનો ત્યાગ-તપસ્યા-પ્રતિકમણ...વગેરે

ત્યારે મોટી ઉભર થયા પછી યુવાની-પ્રોફેટ-જૈફ વયમાં પણ આજે જોઈએ તો લગભગ જડ-પુદ્ગલલક્ષી જીવન બની ગયા છે. જડ જરૂરિયાતો ફેશન-સગવડો અને લહેલહાટ વધી ગયા ! પુરુષોમાં સ્ત્રીઓ જેવી ટાપટીપ-સુકોમળતા-ફેશનો ચાલી, અને સ્ત્રીઓમાં પુરુષો જેવી પ્રવૃત્તિઓ પેઢી ! પુરુષોના સ્ત્રીઓ સાથે સંપર્ક-વાતચીત-મજાક વધ્યા ! કલબ-કમિટીઓ-પાર્ટી વગેરે તૂત નીકળ્યા ! એટલે ચેરમેન-સેકેટરી-મેમ્બર વગેરે હોદ્દાના આકર્ષણ વધ્યાં ! મિટિંગો, કોન્ફરન્સો, ભાષ્યો, દરાવો, સંસ્થાપ્રચારો, એનાં લિટરેચર જાહેરાતો, વગેરે પ્રવૃત્તિઓ વધી. નામ-ધર્મનો પ્રચાર કરો. પણ બધું લગભગ ભાષણ-લેખન-સાહિત્યરૂપ. એજ ધર્મ-પ્રચાર ! (પણ સદાચારના કડક નિયમ-મર્યાદા, ભંગના દંડ, શ્રાવક-જીવનના આચાર અનુષ્ઠાન, બે ટંક અવશ્ય પ્રતિકમણ, સ્વદ્રવ્યથી જિનપૂજા, અભક્ષ રાત્રિભોજન, ત્યાગ, રાત્રિના રખડવાનું નહિ, પણ કુટુંબ સમક્ષ ધાર્મિક વાંચન, પર્વતિથિઓએ ત્યાગ-પ્રત-તપસ્યા, ચતુર્દશીએ પૌષ્ણ, અમુક ઉભરે બ્રહ્મચર્ય, વ્યવહારનિવૃત્તિ, શાસ્ત્ર-ચિંતન...ઈત્યાદિ કશું પ્રચારવાનું નહિ !)...આ સંબંધી અતિશય જડની જરૂરિયાતો-ફેશનો-રીતરસમો વગેરે એ જડજીવન-ભૌતિકજીવનના મૂળ પર ઊભા છે. જડજીવનના પરિણામે જૂઢ, અનીતિ, દુરાચાર, વિલાસ-વાસનાતિરેક, દગા-ફટકા, અહંત્વ-હોશાતોશી-ઈથર્ચી વગેરે જાલિમ વિકસ્યા છે.

જડજીવનની આ આંધીમાં બચવા ઉપાય આ છે કે ફટાટોપો પડતા મૂકી નક્કર ધર્મ-આચાર અનુષ્ઠાનો, પ્રત-નિયમો, શાસ્ત્રસ્વાધ્યાય વગેરેને જીવનમાં મુખ્ય સ્થાન મળે એના પ્રચાર, આદર, અભિનંદન વગેરે થાય.

૨૮૮

ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

૧૩૨ અનિવાર્ય શિક્ષણ વર્ચ્યે

આધુનિક શિક્ષણ અને શિક્ષણપદ્ધતિ અંગે સારા સારા માણસોની આજે ગંભીર ફરિયાદ છે-કે છોકરાઓનાં જીવન, જેમ જેમ કેળવાડી લેતા જ્યા છે, તેમ તેમ સુસંસ્કારી અને ગુણીયલ બનવાને બદલે ઉદ્ઘત, ઉચ્છ્રંખલ, જૂઠ-અનીતિ-વાસનાવેશ વગેરે દોષોથી ખરડાયેલા બને છે. આ બદી પાછી નવાનવા વિદ્યાર્થીઓમાં પ્રસરતી જ્યા છે.

સ્વેચ્છાચાર-સ્વચ્છંદાચાર અને વિલાસ વધતો ચાલ્યો છે. એના ઉપર કેટલીય, જીતની બદમાશી કરવાનું આજે ફાલ્યું-ફૂલ્યું છે. આનું પરિણામ વિચારવા જેવું છે કે આવતી કાલના નાગરિક કેવા ઊભા થશે?

ત્યારે શું આ શિક્ષણ અટકાવી ન દેવાય?

ના, એ આજે અટકાવ્યું અટકાવી શકવાનું નથી, નિવાર્ય નથી, અનિવાર્ય બની ગયું છે. દેશના મોટા માંધાતાનાં પણ દિલ દાઢે છે, છતાં અટકાવી શકતા નથી. તેમ આજની સમાજ્યવસ્થા પણ એવી બની ગઈ છે કે માબાપ પોતાના સંતાનોને આ શિક્ષણ અપાય્યા વિના રહેતા નથી. એટલે ‘આજનું શિક્ષણ નકામું છે, ન દેવરાવવું જોઈએ.’ એવી આદર્શની બૂમો મારવી એ અરણ્યરુદ્ધન જેવી બૂમો છે. ખાલી થુંક ઉરાડવા જેવી છે, વળવાનું કાંઈ નહિ.

પરંતુ જેવી રીતે નોણિયો સાપને મારી પછી એનું ઝેર ન ચઢે એ માટે નોરવેલ વનસ્પતિ સુંધી આવે છે, એ પ્રમાણે આજના શિક્ષણનું ઝેર ન ચઢે એ માટે નકર ઉપાય લેવા જેવા છે.

મહાન પુષ્યના ઉદ્યે આયદિશ આર્થકુળમાં ઉત્તમ મનુષ્ય અવતારે અવતરેલા બાળક-બાળિકાઓમાં નાસ્તિકતા, વિલાસિતા, અને જડવાદના રોગ ન જામી પડે એનો ઉપાય કરવો એ આર્થ માબાપ અને મોવડીઓની પ્રથમ નંબરની ફરજ છે.

આ માટે પહેલું તો રોગનું નિદાન પકડવું જોઈએ. નિદાન આ છે,-

આજનું શિક્ષણ કેવળ ભૌતિકવાદ ઉપર, ભૌતિક વિષયો પર, ખું કરવામાં આવ્યું છે. એથી વિદ્યાર્થીના માનસ માત્ર ભૌતિક ઉન્નતિથી પ્રભાવિત બનતા જ્યા છે, અને આધ્યાત્મિક ઉન્નતિ એટલે જાણો કોઈ ચીજ નહિ, એમ એની સરાસર અવગણના-વિસરણ કરે છે.

કેવળ જરૂર પદ્ધતિનું શિક્ષણ અને તે પણ ઈન્ડિયસુખોને અનુલક્ષીને અપાય, ભુવનભાનુ એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

એમાં વિદ્યાર્થીની દસ્તિ ‘કે વધારેમાં વધારે પૌદ્યગલિક સુખ-સગવડ, એશારામી અને માનમર્તિબા મળે એજ જોવાની બંધાય એ સહજ છે. એની આડે આવતી કોઈ પણ રોકટોક, પરાધીનતા, સેવાશુશ્રૂષા અને ધર્મ-નીતિનાં બંધન એનું મન સ્વીકારવા તૈયાર નહિ જ રહેવાનું, એટલે સ્વાભાવિક છે કે એથી અનેક જીતના દોષ-કુષ્ટ્યોની બદીઓ ઊભી થાય.’

ત્યારે આજની શિક્ષણપદ્ધતિમાં મૂળભૂત વિનય-નમ્રતા-કૃતજ્ઞતા તથા વડિલો અને શિક્ષકો પ્રત્યે બહુમાન પહેલું શિખવાડવાની વસ્તુ નથી, પૂજ્યો પ્રત્યે પૂજ્યભાવ દાખવવાનું આજે શિક્ષણ નથી, કૃતજ્ઞતા, ઔચિત્ય, અને વિવેકનું શિક્ષણ નથી, માત્ર એકની જ એક જ વાત છે કે પુસ્તકો-પ્રયોગો ખૂબ શીખીને ડીગ્રીધર બની તૈયાર થાઓ. ત્યાં કેવળ સ્વાર્થવૃત્તિ પોષાય છે, એટલે એમાંથી અનેક અનર્થો ઊભા થાય છે. વળી ધારી રજાઓ, મોજના વિષયો, તથા પરીક્ષા પદ્ધતિમાં માત્ર પરીક્ષા પાસ કરવાનું તેથી ભાણેલામાંથી બહુ ઓછું જ પૂછવાનું, તે પણ આદમાંથી ગમે તે પાંચ જ સવાલ લખવાના,-અને તેમાંથી ૧૦૦ માંથી ઉપ માર્ક પાસ, આવી બધી પદ્ધતિ વિદ્યાર્થીમાં સુખશીલતા, શ્રમની ચોરી, વર્ગ તથા પરીક્ષામાં ચોરી, ઉપલભ્યિયું અને ગોખણપણીનું અધ્યયન તત્કાલ પૂરતી જ યાદ રાખવાની જવાબદારી, વગેરે વગેરે બદીઓને પ્રેરે છે. વિદ્યાર્થી ઘડતરની પદ્ધતિમાં ગુનાની સજા નહિ જેવી. એ ગુનાહિત માનસને ઘડે છે.

આ નિદાનની સામે પ્રતિકારરૂપે એ જ જોઈએ કે ભરપૂર આધ્યાત્મિક અને ગુણવર્ધક શિક્ષણ-સંસ્કરણ વિવિધ ઉપાયોથી કરવું. પશુતાથી ચાઢિયાતી માનવતા જીવવાનું ક્યારે ગણાય અને એ કેમ બનાવાય એના રસ્તા બતાવવા, તથા જીવનમાં જીવતા કરાવવા.

જ્યારે બીજા દેશો સાવ પછાત અને અખું હતા ત્યારે ભારત દેશ ભવ્ય સંસ્કૃતિ જીવતો હતો, એ પ્રાચીન આર્થ શાસ્ત્રો પરથી દેખાય છે, એવા દેશમાં જન્મેલાએ તો આધ્યાત્મિક અને ગુણમય જીવન જ પ્રધાન બનાવવા જોઈએ. એના શિક્ષણ અને ઘડતર માટે ઘર ઘર રોજ ચાતની કોટુંબિક બોધશાળા, એ બોધનો અમલ કરવા-કરાવવાનો રોજંદો પ્રયત્ન, નિત્ય ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણની પાઠશાળા, રજાઓ પૂરતાં શિક્ષણ-સંસ્કરણના જ્ઞાનયુક્ત ધર્માનુષ્ઠાનનાં સત્ર, તથા ધાર્મિક કિયાઓના અવરનવર આયોજન અને મુનિ મહારાજનાં વ્યાખ્યાન શ્રવણ-આટલું કરવાની ખાસ જરૂર છે. એનો લાભ અદ્ભુત છે. આબુ ઉપર ગ્રીઝ-ધાર્મિકશિક્ષણ-શિબિરના કેટલાય કોલેજિયન તથા શાળાના વિદ્યાર્થીઓમાં આજે પણ દેખાતી સુ-અસર એનો એક પુરાવો છે.

૧૩૩ સંઘરણ શ્રી રમણમાઈ

રતલામ જિનમંદિર અંગે લાંબા વખતથી સનાતનીઓ અને મધ્યપ્રદેશની સરકારે ઉપાડેલા ઝગડામાં હાઇકોર્ટ તરફથી જૈનસંધની તરફણામાં ઐતિહાસિક જજ્મેન્ટ આવેલું, અને હવે છેવટની કોર્ટ સુપ્રીમ કોર્ટમાં પણ જૈનસંધને ગૌરવ આપતો ફેસલો આવી ગયો છે. એ સંધના જગત પુણ્યનું સૂચક છે.

પ્રસ્તુત ઝગડામાં અનેક પુણ્યવાનોએ ભારે સેવા અને ભોગ આપેલ છે જે ધન્યવાદને પાત્ર છે. છતાં એમાં ખંભાતના વતની સંઘરણ શેઠ શ્રી રમણલાલ દલસુખભાઈએ જે ચોવીસે કલાક ચિંતા રાખી જવલંત સેવા અને હજારો રૂપિયાનો ભોગ આપ્યો છે, એ કાળપટ પર સુવાર્ષાક્ષરે અંકિત થયેલ છે. પક્ષ, ગામ, વગરેનો ભેદ જરાય લક્ષમાં લીધા વિના એકમાત્ર તીર્થકર ભગવાન અને જિનશાસનની સેવા કરી લેવાની ધગશે. એમણે આ સુખદ પરિણામ લાવવા સુધીનો ભગીરથ પુરુષાર્થ કર્યો એ એમણે એમના પૂર્વજ શેઠ પોપટભાઈ પિતાંબરદાસ કસ્તૂરભાઈ અમરચંદ વગરેએ કરેલ તેજસ્વી શાસનસેવાના કીર્તિમંદિર પર સુવાર્ષકળશ ચઢાવવાનું કર્યું છે. એમણે આ કાર્ય માત્ર મંદિર પરના આકમણને હટાવવાનું જ નહિ, કિન્તુ જિનશાસનની મહાન પ્રભાવના કરવાનું અને જૈન સંધનું ગૌરવ વધારવાનું કિંમતી કાર્ય કર્યું છે.

ખૂબી તો એ છે કે આ શું કે બીજા કોઈ સત્કાર્યોમાં શું, તન-મન-ધનનો ભોગ આપવા પાછળ શેઠ શ્રી રમણભાઈના નિર્મળ હૈયામાં કોઈ કીર્તિનો કોટડો ચણાવવાની કે લોકવાહવાહના ફુલેકે ચડવાની લેશમાત્ર કામના નહિ. તેમજ પરમાર્થ કરવામાં સામેથી કોઈ તાણ, આગ્રહ, મનામણાં કરાવવાની વાત નહિ ! કેવળ આત્મકલ્યાણની વિશુદ્ધ ભાવનાથી વર્ષોથી એ અનેક ક્ષેત્રોમાં સુકૃત કરતા આવ્યા છે.

એવા તો એમના હજારો રૂપિયાના કેટલાય ગુપ્ત સુકૃતો છે કે જેની જગતને ખબર નથી, ને અમે પણ જાણતા નથી. કિન્તુ એમના જે બે-ચાર સુકૃત જાણમાં આવ્યા છે, એમાં શેઠ શ્રી રમણભાઈના નિર્જામ સુકૃતપ્રિય સ્વચ્છ માનસનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું છે. જીવનમાં તો કેટલાય ઊંચા સુકૃતો એમના હાથે થયેલા છે, પરંતુ સામાન્ય પ્રસંગોમાં અવસરને ઉચ્ચિત સત્કાર્ય બજાવી લેવાની એમની કેવી તકેદારી છે, એના બે ત્રણ પ્રસંગ અહીં જોઈએ. અલબત્ત એમના ભુવનભાનું એન્સાઈક્લોપીડિયા-અગ્રલેખામૃત (ભાગ-૨)

ભવ્ય અને વિશાળ સુકૃતજીવનમાં આ પ્રસંગો તો સામાન્ય છે, પણ એમાં શેઠ શ્રી રમણભાઈનું મહાન દિલ બતાવવાનો અમારો આશય છે.

એક વાર એ શંખેશ્વરજ યાત્રાએ ગયેલા. મોટી ઊછામણી બોલી પ્રભુભક્તિ, ઉચ્ચિતદાન વગરેમાં સુંદર ધન-વ્યય કર્યા બાદ તીર્થનો મુનિમ કહે, ‘શેઠ ! સાધારણ ખાતામાં ખોટ છે. કાંઈક કરવા જેવું છે.’ એમણે પૂછ્યું, ‘કેટલું ખૂટે છે ?’ મુનિમે કહ્યું, ‘એમ તો શેઠ ! સાડા પાંચ હજાર રૂપિયા બેંચાય છે.’ એમણે તરત એક જ મિનિટમાં કહ્યું, ‘સારું લખી લો છગનલાલ કસ્તૂરચંદના. મુંબઈ જઈને મોકલી આપું છું.’ પ્રભુભક્તિના મળેલા અનુપમ લાભના બદલામાં આ ભોગ આપવો જ જોઈએ એમ એમના બોલી ઉઠેલા અંતકરણનું આ કાર્ય હતું.

એક વાર એ પાલીતાશા ગયેલા. ત્યાં મુમુક્ષુને અપાતા સુંદર શિક્ષણને જોઈ પ્રસાન્ન થયા. એમને સહેજ સૂચના થઈ કે ‘દીક્ષા પછી આ શિખરજી યાત્રા કર્યારે કરવાના ? બસ કોઈ આગ્રહ-મનામણાં નહિ,’ બીજી જ મિનિટે એમણે કહ્યું, ‘યાત્રા થઈ જશે.’ મુંબઈ જઈ તરત રૂ. ત્રણ હજારનું પેકેટ મોકલી આપ્યું. ‘ચારિત્રનો ભગીરથ પુરુષાર્થ કરવા તૈયાર થનારની ભક્તિનો લાભ કયાંથી મળે ?’ એ તકનું મૂલ્યાંકન કર્યું.

એક વખતે દૂર પ્રદેશની સરકારી ચૂંટણીમાં શાસન સેવા કરવાની ધગશથી એક જૈન ભાઈ ઊભા રહેલા. અલબત્ત બીજેથી એમને એવો આર્થિક સહકાર ન મળ્યો. છતાં શ્રી રમણભાઈએ ગુપ્તપણે એક સાધ્યમિકને સહાનુભૂતિ તરીકે એમને રૂ. બે હજાર ભેટ કરી દીધાં.

આવા તો કોઈ અજ્ઞાત મહાન સુકૃતોથી આજે દાનવીર શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ, કે જેમણે વળી લાખો રૂપિયાનાં અદ્ભુત સુકૃતો કર્યા છે, એમની સાથે ઉદામનસ્ક શેઠ શ્રી રમણભાઈનું ય ભાવભીના હદ્યે સ્મરણ થઈ જાય છે.

શ્રી રમણભાઈના કેટલાય સુકૃતોમાં એમના સ્વજનો મેસર્સ છગલાલ કસ્તૂરચંદની પેઢીના ભાગીદારો શેઠ શ્રી બાબુભાઈ છગનલાલ વગરેનો સુંદર સહયોગ રહેતો આવ્યો છે. આ પેઢી તરફથી વર્ષોના વર્ષોથી થઈ રહેલ ખંભાતમાં જિનશાળાએ આવતા સમસ્ત મહેમાનોની ભક્તિ, પ્રતિવર્ષ પર્યુષણમાં આઠે દિવસ વિશાળ સંઘ્યામાં પોસ્ટાનોની ભક્તિ, ખંભાત આજુભાજુ આવતા સાધુ-સાધ્યિજ મહારાજોની ચિંતા, અનેક ધર્મક્ષેત્રમાં તથા જિનશાળાએ દરેક વરસે થતી ઊછામણી વગરેમાં હજારો રૂપિયાનો સદ્ગ્યય...વગેરે સુકૃતસાધના કદાચ સમસ્ત ભારતના શહેરોમાં આ એક ખંભાત શહેરમાં જ જોવા મળે. અહીંના શ્રી ચંદ્રકાન્ત ઊજમશીવાળા શેઠ શ્રી શાન્તિલાલ ઊજમશી (વડિલ) વગરેનો સુકૃત પ્રવાહ પણ અનુમોદનીય છે.

આજ ખંભાતની બલિહારી છે કે અતેના વતની શેઠ શ્રી રમણલાલ વજેચંદે
‘જૈન પ્રવયન’ના તંત્રી ભાઈશ્રી શ્રીકાન્તના અમૃત્ય સહયોગ સાથે તિથિપ્રથનો
હુક્કર ઉકેલ સાધ્યો છે.

રતલામ પ્રકરણની શાંતિના તબક્કે આટલું લખવા પાછળ શેઠ શ્રી રમણભાઈ
દલસુખભાઈ અને એમનાં સ્વજનોનાં સુકૃતોની અનુમોદના કરવા સાથે શક્તિસંપન્ન
જેનોને આનો ધડો લઈ શાસનના આજે જરૂરી અનેકવિધ રક્ષા-પ્રભાવનાના કાર્યોમાં
ઉદાર હાથે લાભ લેવાનું નમ્ર સૂચન કરવાનો અમારો આશય છે.

U ઉપવાસ નહિ, આયંબિલ કર. V

“સાહેબજી, ચોમાસામાં એકાંતર ઉપવાસ કરું ?” શિષ્યે
પૂછ્યાં.

પૂજ્યપાદ ગુરુદેવશ્રી : જો, એના બદલે આયંબિલ કરવાનું
રાખ. વર્ધમાન તપની ઓળી ઉપાડ.

શિષ્ય : સાહેબજી આપ ઉપવાસને બદલે આયંબિલ પર
કેમ વધુ ભાર આપો છો ?

પૂજ્યપાદ ગુરુદેવશ્રી : જો એમાં આ હિસાબ છે. આપણું
મન લાલચું છે. ઉપવાસના નામે પારણામાં અને ઉત્તર પારણામાં
આપણને દૂધ-ઘી-મીઠાઈ અને ફરસાશ ખાવાની લાલચ થઈ આવે
છે. અને જાણતા/અજાણતાં રસ ગારવનું પોષણ થઈ જાય છે.
એમાં તો બે બિલાડીની વચ્ચે ઉંદરની જેમ ઉપવાસ તો ફિક્કો
ફિસ થઈ જાય છે. એના કરતા આયંબિલ કરવાનું રાખ્યું હોય
તો તપ પણ થાય છે અને રસ-ગારવથી બચવાનું પણ થાય
છે. અને એ તો તું જાણો જ છે ને કે ચોમાસામામાં ખાસ કરીને
યુવાન સાધુએ વિગઈઓના ભોજનથી બચવું જોઈએ. કેમકે આ
બધા વિકારી પદાર્થો છે. માટે તું આયંબિલ જ કરવાનું રાખ.

પૂજ્યપાદ ગુરુદેવશ્રીની દીર્ઘદિષ્ટ, વિગઈઓ પ્રતિ તિરસ્કાર
ભાવ અને યુવાન સાધુઓના સંયમ/બલચયર્ય પ્રત્યેની કાળજી કોના
હૃદયમાં બહુમાન અને ભક્તિઓની કરાવી કાયાને ઝૂકાવે નહીં ?

W -“ભુવનભાનું એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્ય

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૨૮, તા. ૨૮-૩-૧૯૬૪

૧૩૪ સુખ અને સાત્ત્વિકતાની એક અનુપમ ચાવી

મનુષ્યમાર્ગ સુખ માટે જંખે છે, પણ પ્રશ્નમરતિમાં શ્રી ઉમાસ્વાતિજી
મહારાજ કહે છે,

‘દુઃખદ્વિદ્ય સુખલિલ્પુર્મોહન્યત્વદદૃષ્ટગુણદોષः ।

યાં ચાં કરોતિ ચેષ્ટાં તયા તયા દુખમાદત્તે ॥

-અર્થાત્ જીવ દુઃખનો દેખી અને સુખનો દીચ્છુક છતાં મોહાન્યતાએ ગુણ-
દોષ વિચારતો ન હોવાથી જે જે પ્રવૃત્તિ કરે છે, તેના-તેનાથી એ દુઃખ પામે છે.
સારાંશ દુઃખનું કારણ સાચા ગુણ-દોષ અને લાભ નુકસાનનું લક્ષ નહિ તે. તો
સુખનું સાધન આ લક્ષવાળી પ્રવૃત્તિ નક્કી થાય છે.

આ ‘ગુણ-દોષ’ શબ્દ ગંભીર છે, એના પર ધષ્ણો વિચાર થઈ શકે.

દા.ત. સુખ માટે જે જે પ્રવૃત્તિ યા નિવૃત્તિ કરીએ તેના તેના અંગે વિચારાય
કે આ પ્રવૃત્તિ-નિવૃત્તિના વિષયમાં ગુણ કેટલો અને દોષ કેટલો ? ત્યારે એથી
વિરુદ્ધ પ્રવૃત્તિમાં ગુણ-દોષ કેટલા ?

‘છોકરા કે નોકર પર ગુસ્સો કરવા જતા કેટલો ફાયદો અને નુકસાન ?
તથા ત્યાં ક્ષમા રાખવામાં કેટલું લાભ-નુકસાન ?’ આ સમજુને યોગ્ય પ્રવૃત્તિ યા
નિવૃત્તિ કરીએ તો સુખનો અનુભવ થાય.

ત્યારે અહીં પ્રશ્ન થાય,

પ્ર.- જીવનમાં એવી કેટલીય બાબત હોય છે કે જેમાં અનુકૂળતા કરવા માટે
આભિક હિત ઓછું દેખાય છતાં એ કરવી પડે છે, યા મન ઢીલું થઈને કરાય છે.
અને સરવાળે દુઃખ થાય છે, ત્યાં શું કરવું ?

૩.- અહીં એ જુઓ કે, આમ થવામાં એક મોટું કારણ એ છે કે ‘જગતના
સંયોગ અને પરિસ્થિતિ આપણને અનુકૂળ હોવા જ જોઈએ.’ એવો આપણે આગ્રહ
રાખીએ છીએ. અને અનુકૂળ ન હોય તો અનુકૂળ કરવા મથીએ છીએ. અનુકૂળ
થાય તો તે પણી ય જી નથી ! વધુ અનુકૂળતાની દીચ્છાઓ સળવળે છે અને
એની પાછળ વળી મથામણ ચાલુ રહે છે. પરંતુ ત્યાં જુઓ કે બાબ્ય બધું જ
અનુકૂળ કરવું એમાં કદાચ ગુણ થાય તો અલ્ય, અને દોષ-નુકસાન ઘણાં ! એટલે
એ જીવન પદ્ધતિમાં દુઃખ જ જોવા મળે એમાં નવાઈ નથી. આ તો પુણ્ય પહોંચેયતું
હોય તો જ અનુકૂળતા થવાની વાત, બાકી પુણ્ય કાચું હોય ત્યાં ધારી અનુકૂળતા

થાય નહિ, એટલે દુઃખના જ અનુભવ લમણે લખાયેલા રહે છે.

બસ ત્યારે સુખનો માર્ગ આ છે, કે સંયોગ-પરિસ્થિતિને આપણને અનુકૂળ બનાવવાની મથ્યમણને બદલે આપણે અનુકૂળ બની જવાનો અભ્યાસ કરવો.

આપણી સામે ગમે તેવા સંયોગ ઉપરિષિત થાય, પ્રતિકૂલ દેખાતા પણ પદાર્થ, જીવો કે બનાવો ઊભા થાય, ગમે તેવી પરિસ્થિતિ સર્જય, આપણે તો એ બધાને અનુકૂળ બની જવાનું. પેલું કેટલું ય અશક્ય છે, આ શક્ય જ છે.

વાત પણ સાચી છે કે માનો આખે રસ્તે કાંટા વેરાયા છે, તો હવે એ બધાને હટાવવાનું અને રસ્તો અનુકૂળ કરવાનું ક્યાં બને? પણ જો પોતે જ એને અનુકૂળ થઈ એટલે કે પગમાં જોડા પહેરીને ચાલશે તો કાંટાનું દુઃખ નહિ રહે. એમ અહીં જીવનમાં અથડાતી અનેક વસ્તુઓને અનુકૂળ કરવા બેસવાનું કેટલું બધું મુશ્કેલ છે? એના બદલે આપણે એકલાએ જાતે જ મનની ગણતરી ફેરવીને અનુકૂળ થઈ જવું એ સરળ છે, અને એમાં સુખી થવાનું જ બને છે. એટલું જ નહિ પણ જાતે અનુકૂળ બનવામાં આત્માનું સત્ત્વ ખીલે છે, આને કેટલાંક રોઝંડા દ્વારાન્તોથી સમજુએ.

એક માણસને પત્ની ઉગ્ર સ્વભાવની મળી છે. હવે જો દમ મારી મારીને એને પોતાને અનુકૂળ નમ્ર સ્વભાવની કરવા જ્ઞાને તો પેલીનો રોક અને રોષ વધવાનો મોટો સંભવ છે, અને એથી દુઃખ, દુઃખ ને દુઃખ રહેવાનું, એથી ઊલદું, ‘જો એ સંયોગને પોતે અનુકૂળ થઈ જ્ઞાને,’ અર્થાત્ મનથી પાંકું નક્કી કરશે કે ‘જેમ પાંચ રૂપિયામાંથી પાંચનો જ માલ મળે.’ ૫૦-૧૦૦ નો નહિ, એમ મને મારા પુષ્ય મુજબ બરાબર જ સંયોગ મળ્યો છે, અને લાભમાં એથી ખામોશ સહિષ્ણુતા તથા સામા પર ભાવદ્યા કમાવવાની તક છે, અને એમ કરવાનું નક્કી રાખી એ ગુણો કેળવશે. તો દુઃખ નહિ, સુખનો જ અનુભવ થશે, સાથે સત્ત્વ ખીલશે.

એમ, પેટમાં પચ્યતું નથી, ગેસ આમ કબજિયાત વગેરે થાય છે ઇતાં સારું ખાવાનું છોડાનું નથી. હવે ‘પેટ અનુકૂળ કરવા દવાઓ, ગોળીઓ, ચૂરણો વગેરે લીધે રાખે, તો એ દુઃખી થવાનો. એના બદલે પોતે જ પેટને અનુકૂળ થઈ સારું અને રીતસર દાબીને ખાવાનું ઓછું કરી નાખશે તો સુખી થશે.’ એમ મનોનિગ્રહમાં સત્ત્વ પણ ખીલશે.

મોંઘવારી ઘણી છે, આવક ઓછી છે, અનુકૂળતા કરવા જો આવક વધારવા જ્ઞાને તો પાપના અને બજારના માર ખાશે! પણ આવકને અનુકૂળ પોતે બનીને જરૂરિયાતો ઘટાડી નાખશે તો બેય મારથી બચશે.

સભામાં ગયો, જગા સાંકદી મળી, હવે જો પહોળો પલાઠો કરવા જ્ઞાને તો બીજાનો ખોઝ વહોરશે એના બદલે જે મળી તે બરાબર માની પોતે એને અનુકૂળ થશે, તો મન નિશ્ચિન્ત બનવાથી સુખ થશે. ઊલદું બીજાને કહી શકશે, ‘ભાઈ બેસો સરખા, પગ-પહોળા કરો, મારે કાંઈ વાંધો નથી.’ તો બીજાને પ્રિય બનશે અને સત્ત્વ તો ખીલવાનું જ.

ધરે મોડો આવ્યો, રસોઈ ઠંડી પડી છે ને એજ ખાવાની છે, છતાં જો એને અનુકૂળ કરવા ધમધમશે, ‘કેમ આ ગોતા જેવું? ઢોર-બોર છીએ? ભાન નથી?...’ વગેરે વગેરે તો કદાચ સામેથી લમણામાં લાગે એવો બડફો નીકળશે! અગર કમમાં કમ સામાનું દિલ ધવાશે, દિલમાં વિરોધ, અભાવ ઊભો થશે. પણ એના બદલે જો ઠંડી રસોઈને પોતે અનુકૂળ બની જાય કે ‘અત્યારે આટલું પણ તૈયાર મળે છે. એ મારા પુષ્યના પ્રમાણને મળતું ને છાજતું છે, વળી કોક દિ’ આનો અનુભવ કરાય એ સારું છે.’ તો ઉપરથી કહી શકશે, ‘વાહ મારે મોહું થયું તોય બધું રાખી મૂક્યું છે? ઢીક છે તમારા વિવેકથી ધર સારું ચાલે છે...’ તો સામાનો સદ્ગ્રાવ વધશે. એથી સુખ વધવાનું.

સારાંશ, સંયોગને આપણે અનુકૂળ થઈ જવું એ માટે વસ્તુમાંનું સારું તત્ત્વ જ પકડવું, અને બરાબરે દરગુજર કરવું. એમાં આત્મસત્ત્વ ખીલે છે અને સુખનો અનુભવ પણ નક્કી છે.

U

વાયુકાયની વિરાધના ન થવી જોઈએ

V

અમદાવાદ, પંકજ સોસાયટીમાં સાંજે દ વાગે પૂજ્યશ્રીને હૃદયરોગનો ગંભીર હુમલો થયો. પૂજ્યશ્રીની સહિષ્ણુતા અને સમાધિ એટલી બધી હતી કે, કોઈને અણસાર પણ ન આવ્યો કે પૂજ્યશ્રીને અત્યારે છાતીમાં ભયંકર દુઃખાવો થઈ રહ્યો છે. તેઓશ્રીને સાંજના આપવાની દવા હું કાઢી રહ્યો હતો. એકાદ ફૂટ જેટલા દૂરથી ફેંકીને મેં પૂજ્યશ્રીને દવાની ગોળી આપી. અત્યંત દુખાવાના કારણે પૂજ્યશ્રી કાંઈ બોલી તો ન શક્યા પણ મને ઈશારાથી જણાયું :

“આ રીતે દવા ફેંકાય? વાયુકાયની વિરાધના થાય! આવી જાલિમ વેદનામાં પણ જીવરક્ષાના કેવા કોમળ પરિણામ!

W —“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભારX

૧૩૫ નફા વિનાનો વેપાર

ધન-કમાઈ કરવાના વેપારમાં માણસ હંમેશા એ જોવા સાવધાન હોય છે કે ‘નફાનું માર્જિન કેટલું રહે છે.’ નવો ઘરાક બનાવવા કોઈને બે-ત્રણ વેચાણમાં કદાચ નફો જતો કર્યો હોય તો પછી એની પાસેથી સારી રીતે નફો આંચકી લેવા માટે સજાગ રહે છે. બજાર બહુ મંદા પડી ગયા હોય, નફા વિના માલ વેચવો પડતો હોય તો જીવને કાંઈ કાંઈ થઈ જાય છે ! એમાં વળી જો ખોટ ખાઈને માલ કાઢવો પડતો હોય તો ચિંતા-સંતાપનો પાર નથી રહેતો ! ત્યાં ભાવતા ભોજન પણ કરવામાં હોંશ નથી. શરીર સાંઝું સાંઝું છતાં સુસ્ત ફીંકું રહે છે. મનને ચેન નથી. અકળામણ, મુંજવણ, મુંજવણ રહ્યા કરે છે. ચારે બાજુ ફાંઝા મારે છે કે ‘ક્યાં દાવ લાગે ને બધી ખોટ પાછી વાળવા ઉપરાંત સારો નફો કરી લઉ !’ તાત્પર્ય દુનિયામાં નફાના જ વેપાર પર ચોંટ રહે છે.

હવે ધર્મની બાબતમાં જોવામાં આવે તો શું દેખાય છે ? ‘પ્રભુદર્શન કરવા, પૂજા કરવી, સામાયિક-પ્રતિકમળાદિ અનુષ્ઠાન, ત્યાગ, તપસ્યા, દાન, જ્ઞાનધ્યાન વગેરે કરવા એ ધર્મ વેપાર છે.’ એ કરવામાં નફો કમાઈ લેવાનું લક્ષ કેટલું ? નફાનું માર્જિન વધારવા માટે ચોંટ કેટલી ? બે ચાર ધર્મ વેપાર નફા વિનાના એમ જ કરાઈ ગયા હોય તો પછી આગળ ધર્મ વેપારમાં પૂરો નફો કમાઈ લેવાની જાગૃતિ કેટલી ? કોઈ માનસિક ચિંતાના કારણે ધર્મવેપાર વિના-નફાએ મંદા-ચાલ્યા કરતા હોય તો જીવને કાંઈનું કાંઈ થઈ જાય ખરું ? એમાં વળી ધર્મવેપાર વખતે આર્તધ્યાન, કષાયો, વિષયલગની વગેરેથી ઊલટી મોટી ખોટ આવતી હોય તો સંતાપનો, પાર ન રહે-એવું ખરું ? ધર્મ વેપાર કરાયે જતાં છતાં નફો નહિ, ને ખોટ માથે ચક્કે મીઠાં રસમય ભોજન પણ ન ભાવે શરીર સુસ્ત, મનને ચેન નહિ, મુંજવણ-અકળામણ થયા જ કરે, જીવ ફાંઝા માર્યા કરે કે ‘કેમ બધી પૂર્વની ખોટ ભરપાઈ કરી જોરદાર નફો કરી લઉ !’ આવો અનુભવ છે ખરો કે નહિ ?- આ આંતર નિરીક્ષણ કરવા જેવું છે.

ધર્મવેપારમાં નફો શું ? અહીં એવો નફો લેવાનો છે કે જે આપણને દેખાય. જેની ખબર પડે કે આ નફો વધ્યો, ઘટ્યો, યા નથી. તે નફો પુષ્ય નહિ લેવાય, કેમકે એ વધ્યાધટ્યાનો આપણને અનુભવ નથી થતો, તેમજ એના આધાર પર

આત્માની શ્રીમંતાઈ વધવાને હિસાબ નથી પરંતુ નફા તરીકે શુભ અધ્યવસાય, સંવેગ-વૈરાગ્યમય પરિણાતિ. નિરાશાંસ અર્હદ્વ ભક્તિભાવ, જિનવચન-રાગ, આંતરિક સાચી ક્ષમા-સમાધિ-દ્યાદિના ભાવ ઈત્યાદિ સમજવાના છે. નફામાં આ ઊભું થવું જોઈએ, આ વધવું જોઈએ.

વીતરાગપ્રભુના દર્શન કરીએ ત્યાં સુધી ભક્તિ-ઉછળાનો નફો ઊભો થવો જોઈએ. યા પ્રભુના મુખ અને ચક્ષુ પર યાવત્ત આખા અંગ ઉપર વીતરાગતા તરવરતી નિહાળી સંસારના કષાયો-ઉકળાટ-વિક્ષણતા, હર્ષ-ખેદ, ઈન્દ્રિયોની ખણજ વગેરેને ઘડીભર શાંત કરે અને શરીરના રુવે રુવે ઠંડગાર શીતલતાનો અનુભવ કરાવે એવા ઉપશમરસનો નફો ઊભો થવો જોઈએ. કામી માણસ રૂપાળી સ્ત્રીના દર્શન પર રાગનાં ગિલગિલિયાં અનુભવે છે, શાતાનો શેરડો અનુભવે છે, તો વીતરાગનો ભક્ત વીતરાગના દર્શન થતાં શાંત શીતલ ઉપશમ ભાવનો અનુભવ ન કરે ? કલેજે શેરડો ન પડે ? હૈયામાં ભક્ત કે બીજો શુભ ભાવોલ્લાસનો ઊભરો ન આવે ? જો આ નહિ, તો દર્શનના વ્યાપારમાંથી નફો લઈ લેવાની વાત ક્યાં રહી ?

એમ, પરમાત્માની પૂજના અનુષ્ઠાનમાં પણ પોતાના રીતસરનાં દ્રવ્યનો ભોગ આખ્યો હોય અને ત્યાં ભાવ એ જગાવાય કે મારા નાથ ! બધું તારી કૃપાનું ફળ પાય્યો, પણ આ રંક બેટ તારા ચરણે ધરું ધરું, કેવી મારી જાલિમ તૃપ્યા ! છતાં આટલું ય તારી ભક્તિમાં લગાવું ધૂં એટલા મારો અહોભાગ ! એટલી યત્કરીચિત્ર કૃતજ્ઞતા અદા થઈ તેટલું બચ્યો !’ અથવા વીતરાગે સાધેલા સુકૃતોના સ્મરણ સાથે હર્ષ અને ઉત્કંઠાભરી અનુમોદના કે પોતાના હુષ્ણૂત્ય અને રાગાદિ દોષભરી હુર્દશા પર રુદ્ધન, પ્રભુને મનોમન પ્રાર્થના કે ‘દેવ ! આપનું શરણું મળ્યું ને મને હવે આ વિટંબાણ ઓછી નહિ થાય ? જરૂર ઓછી કરો, આપ જ કરશો, આપ એવા મારા દિલમાં ઓતપ્રોત થઈ જાઓ કે એ હુર્દશા ચાલતી પકડે. મને પાકો વિશ્વાસ છે કે આપના આલંબને જરૂર એ દૂર થશો.’ જો આવો કોઈ ઉછળતા દિલનો ભાવ ન અનુભવાય તો નફો શું કમાયા ?

પ્રત્યેક ધર્માનુષ્ઠાન-ધર્મસાધનામાંથી આવા આવા કોઈ શુભ ભાવ, શુભ લેશયા અને સમાધિ તારવવાનું લક્ષ ખાસ રહે, જેથી ધર્મ ખાતે નફા વિનાનો વેપાર ન ગંગાયે જવાય.

અંતરમાં આ શુભ ભાવના ઉત્સાહ, દોષના છાસ અને ચુણના વિકાસ એ ધર્મસાધનામાંથી રોકડી કમાઈ છે. એ કરી લેવાનું જો લક્ષ જ ન રખાય, તો સાધના

શુષ્ણ-કોરી-ફિક્ડી અને પરાણે દિલની થાય છે. ઉલદું કેટલીકવાર એવું ને એવું ચલાવે રાખવામાં હદ્ય એવું ધિટહું બનતું જાય છે કે પછી ભાવ જગાવવાનું મુશ્કેલ બની જાય છે. ભાવોલ્લાસની આ કમાઈ પર દુર્લક્ષ એ માનવજીવનમાંની મોટામાં મોટી ખોટ છે, કેમકે વિશિષ્ટ બુદ્ધિના આ જીવનમાં જ એ ખરેખરી કમાઈ શક્ય છે. અહીં એ ન કરી તો પછી આગળ ક્યાં કરવાનું ? અને સારા ભાવ તરીકે અહીંથી શું લઈ જવાનું ?

U શૂરા બોલ્યા ના ફરે... V

એગભત્તાં ચ ભોયણં... શ્રી દશવૈકાલિકસૂત્રાના આ આગમવચનાનુસારે પૂજ્યશ્રી નિત્ય એકાસણાના આગહી હતા. માલેગામથી નાસિક તરફના વિહારના એ દિવસોમાં વૃદ્ધવયે પણ પૂજ્યશ્રીનો એકાસણા ચાલુ હતાં. એક દિવસ થોડી અસ્વસ્થતાના કારણે પૂજ્યશ્રીએ બેસણું કરેલું. સવારે નવકારશીના સમયે પ્રથમ બેસણું પૂજ્યશ્રીએ કર્યું પણ ઊઠતી વખતે રોજના અભ્યાસવશાત્ તિવિહારનું પચ્યક્ખાણ હાથ જોડવા પૂર્વક લેવાઈ ગયું. ને તરત યાદ આવ્યું કે આજે તો બેસણું છે, બીજું બેસણું બાકી છે. હાલ તિવિહાર કરવાનો નથી. બધા મહાત્માઓએ “એ પમાણ બંજણછે છ્લના એવા શાસ્ત્રવચનપૂર્વક આમ અનાભોગથી પચ્યક્ખાણ લેવાઈ જાય તો એ કાંઈ પ્રમાણભૂત હરતું નથી. અને તેથી પચ્યક્ખાણ ભાંગી જતું નથી. માટે બીજું બેસણું થઈ શકશે...” વગેરે ઘણો આગઈ કર્યો. પણ પૂજ્યશ્રીનો જવાબ હતો- એ શાસ્ત્રવચનાનુસારે બીજીવાર બેસણું કરવાની છૂટ મળે જ છે. પણ આપણે આપણા વચનને એમ સામાન્ય નિમિત્ત નિરથી નિષ્ફળ ન કરાય. થોડું સહન કરીએ તો સત્ત્વ વિકસે ને વચનો વજનવાળા બને... ને ખરેખર ! બેસણું સમજીને સાવ અલ્ય ખોરાક લીધો હોવા છતાં પૂજ્યશ્રીએ એ દિવસે ફરીથી બેસણું કર્યું જ નહીં.

W -“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્ય

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૩૦, તા. ૧૧-૪-૧૯૬૪

૧૩૬ સંસ્કૃતિ કર્યાં ?

પૃથ્વી-પાણી-વનસ્પતિકાય, કીર્તા-મંકોડા, વગેરે હલકી યોનિયોમાંથી યુગો વીન્યે માનવયોનિમાં આવવાનું થાય એ જીવન સંસ્કારી જીવવા માટે કે વિકારી ? વિકારી જીવનનો અંજામ આત્માને ઉન્નતિ પમાડવામાં નહિ પણ અધ્યપતન પમાડવામાં આવે એ નિશ્ચિત હકીકત છે. તો જીવન વિકારી બનાવવા માટે માનવયોનિ છે એવું કોણ કહે ? ધર્મની સ્થાપના, ધર્મશાસ્ત્રોની રચના, પરમાત્મા-તીર્થ-મંદિર, મહર્ષિઓની માન્યતા અને વિવિધ ધર્મનુજ્ઞાનો એ બધાનું પ્રયોજન જીવન સંસ્કારી બનાવવા માટે છે.

સંસ્કારી જીવન સંસ્કૃતિને અનુસરવાથી-અપનાવવાથી થાય છે. એ ‘સંસ્કૃતિ કઈ ? કોને કહેવાય ? તેને જ કે જેને અનુસરતા જીવનમાં દ્યા-કૃતજ્ઞતા-પરોપકાર, વિનય-દાક્ષિણ્ય-મયર્દા, સયંમ-સદાચાર-ત્યાગવૃત્તિ, લઘુતા-સહિષ્ણુતા વગેરેના સંસ્કાર ઘડાય.’

પશ્ચિમીય સભ્યતા રીતરિવાજ અને જીવનપદ્ધતિ જોઈએ તો દેખાય છે કે એ આવા સુસંસ્કારો ઘડવા સમર્થ નથી. ત્યાંની વાતવાતમાં હિંસાભરી વસ્તુઓ જ પહેલું તો દ્યાને બદલે નિર્દ્યતાનું ઘડતર છે. મા-બાપ પ્રત્યે દીકરા કે શિક્ષક પ્રત્યે વિદ્યાર્થી વગેરેનો વ્યવહાર વિનયની મુખ્યતાવાળો નથી. ‘સામાજિક જીવન પદ્ધતિ દાક્ષિણ્યને ભુલાવે એવી છે. મનોરંજનો અને ભૌતિક છેલ્લામાં છેલ્લી ફેશનની સુખ સગવડો સાથેની જીવનપદ્ધતિ ઈન્દ્રિયસંયમ તથા ત્યાગવૃત્તિને બદલે ઈન્દ્રિયતર્પણ અને ભોગલાલસાને સારી રીતે પોષનારી છે. એટલે જ ત્યાં કેટલાક દુરાચાર નથી ગણવામાં આવતા !’

ત્યારે ભારતીય સભ્યતા અને જીવનપદ્ધતિ દ્યા, વિનય, દાક્ષિણ્ય, ઈન્દ્રિયસંયમ, ત્યાગવૃત્તિ, સદાચારો વગેરેના સુસંસ્કારોને ઘડે છે. માટે જ એ ખરેખર સંસ્કૃતિ છે. એના આધાર પર લાખો વર્ષ પૂર્વનો પણ આર્ય ઈતિહાસ જવલંત સંસ્કારભર્યા આર્યજીવનને કહી રહ્યો છે.

આજે પશ્ચિમીય સભ્યતાનું આંધણું અનુકરણ ચાલ્યું છે, પરંતુ એનાં કટુફળ વિસ્તરતા જોઈ હવે કેટલાક એ સભ્યતામાં જેંચાયેલાને પણ એ અનુચિત લાગવા માંડ્યું છે, છતાં ચઢેલો જુવાણ એટલાથી નહિ ઉત્તરે, બુદ્ધિથી વિચારી શકે એવા સૌ કોઈએ એ પશ્ચિમીય સભ્યતાના ભયંકર અનર્થ વિચારી શક્ય એટલી આર્ય-મયર્દાઓ, રીત-રિવાજો, અને આર્ય જીવનપદ્ધતિમાં પાછા ફરવાની જરૂર છે.

નહિતર આજ વિલાયત અમેરિકા જેવામાં જે જે ચોરી-બદમાશી-ખૂન-વ્યભિયાર વગેરેનું પ્રમાણ કાબુ બહાર વધી ગયું છે એ અહીં ઊભું થઈ જશે. આજની નવી ખાનપાન પદ્ધતિ મનોરંજન પદ્ધતિઓ વગેરે વગેરેમાં જબરદસ્ત પલ્ટો લાવવાની જરૂર છે. નહિતર આર્થસંસ્કૃતિ અને ભાવી પ્રજાને ભયંકર નુકસાન છે.

આ પ્રસંગે અમને મુંબઈની એક કન્યા હાઈસ્ક્યુલે કન્યાઓના ઉજવેલા જાહેર વ્યાયમ-નૃત્ય કાર્યક્રમ પર સખેદ વિચાર આવે છે કે આજના મોવડીઓ અને આ ઉગતું નારીધન ક્યાં જઈ રહ્યું છે? શું આમાં કોઈ જ દ્યા-કૃતકાશ-પરોપકાર, વિનય-દાક્ષિણ્ય-મર્યાદા કે સંયમ-સદાચાર-ત્યાગવૃત્તિ વગેરેની સંસ્કારી સંસ્કૃતિને પોષણ મળે છે? કે એથી ઊલદું નિલજજતા, માનાકંકા, ભોગવૃત્તિ, વગેરેને ઉત્તેજન મળે છે? યોજક મોવડીઓને એ પણ વિચાર નહિ આવ્યો કે આ જોનારા આજના ઇન્ડિયલુભ્ય માણસો આ જોઈને શું લઈ જશે? જુઓ, આ સંબંધમાં આધુનિક વિચારના ભાઈ શ્રી પરમાનંદ 'પ્રબુદ્ધ જીવન'માં શું લખે છે-

'રંગ મંચ ઉપર જે નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા તે કેવળ પાશ્વાત્ય ફ્લબના હતા. એમાં કેટલાંક તો યુગલ નૃત્ય હતા. (અલબત્ત, યુગલ નૃત્યમાં પુરુષનો પાઠ પણ છોકરીને જ પુરુષનો પોષાક પહેરીને ભજવ્યો હતો) આમાં વળી પણ્યિમી ફ્લબમાં સજજ થયેલી કન્યાઓ બંને બાજુએથી સ્કર્ટની કોર ઊંચી પકડીને નાચતી જોતા આંખોને ખટકતી હતી. કાર્યક્રમમાં જે ઝોક ડાન્સ એટલે કે લોકનૃત્ય હતું, તેમાંનો પોષાક આમનીઓ કે જેકેસ્લોવાકીઓના સ્ત્રી-પુરુષોને મળતો દેખાતો હતો, ભારતીય તો હરગીઝ નહોતો.' આજે એક બાજુએ જ્યારે ભારતીય નૃત્યો અનેક આકારમાં આપણી સમક્ષ સિનેમા તથા રંગભૂમિ ઉપર રજૂ થઈ રહ્યા છે અને બીજી બાજુએ જ્યારે આપણે બોલરૂમ ડાન્સીંગ પ્રત્યે ચોક્કસ અણગમો દાખવી રહ્યા છીએ.- 'આ અમારી ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા સાથે અનુરૂપ નથી.' એમ તે સામે આપણો વિરોધ વ્યક્ત કરી રહ્યા છીએ-ત્યારે મુંબઈની અગ્રગણ્ય લેખાતી આ શિક્ષણસંસ્થા પોતાના જાહેર સમારંભ પ્રસંગે બોલરૂમ ડાન્સીંગને મળતાં નૃત્યો રજૂ કરે અને એ પ્રકારની પણ્યિમની આબેહુબ નકલ કરવામાં શિક્ષણની સાર્થકતા માને યા મનાવે, એ ભારે આશ્ર્ય સાથે જિન્નતા પેદા કરે એવું હતું.

અલબત્ત ઉક્ત વિચારોમાં જાહેર, ભારતીય નૃત્યનું સમર્થન ધ્વનિત થાય છે, એની સામે પણ જૈન સંસ્કૃતિનો વિરોધ છે, કેમકે એ સ્વ-પરને મોહોતેજક અને અનેક અનથને અવકાશ આપનાનું બને છે. પુરુષના નાટક પણ જો અનર્થદંડ પાપ છે, તો સ્ત્રીઓના નૃત્ય અને તે પણ અંગપ્રદર્શન સુધીનાં, એની પાપરૂપતાનું પૂછવું જ શું?

સારાંશ, આર્થ પ્રજાનું જીવન સંસ્કારી બને એવા ધરખમ પ્રયત્ન કરવાની અને વિકૃતિપોષક તત્ત્વોને રોકવાની અત્યંત આવશ્યકતા છે.

૧૩૭ કેટલીક હકીકત અને દર્શનમાં બેદ

જગતમાં વસ્તુસ્થિત યાને હકીકત જેવી હોય તેવું દર્શન કરવું જોઈએ. આ સામાન્ય નિયમ છે. પણ કેટલીક હકીકત એવી હોય છે કે એને એ રીતે જોવામાં આપણા જેવા બાળ જીવોનું હિત નથી થતું, ઊલદું એનાથી બિન્ન રીતે દર્શન કરવાથી જ આત્મહિત સધાય છે.

આ જરા વિચિત્ર લાગશે. કેમકે હકીકતથી બિન્ન રીતે વસ્તુ દર્શન કરવામાં અસત્ય અયથાર્થ દર્શન દોષ ઊભો થાય. પરંતુ જૈનદર્શન એકાંતવાદી નહિ પણ અનેકાંતવાદી દર્શન છે, તેથી એ એમ કહે છે કે હકીકત મુજબનું દર્શન સત્ય હોય અને ન પણ હોય. ધ્યાનમાં રહે કે સત્ય તે છે કે જીવનું હિતકારી હોય. કસાઈને પશુ બતાવનારું વચન એ સત્ય વચન નથી. કોઈના છતાં પણ દોષ બહાર કહેવા એ સત્ય વચન નથી, એટલે હકીકત હોવા છતાં તેવું કથન સત્ય ન પણ હોય, એવું બને છે. જેવું કથનમાં એવું દર્શનમાં, હકીકત મુજબનું દર્શનપણ ક્યારેક સત્ય ન હોય, ઊલદું બિન્ન જાતનું દર્શન કરાય એ જ સાચું દર્શન કર્યું ગણાય છે.

દા.ત. આપણામાં અંશે ક્ષમા, નમ્રતા, દ્યા, દાન વગેરે ગુણો હોય એ હકીકત છે. છતાં આપણે જો આપણી જાતને ગુણાહીન દેખ્યા કરીએ, અને એમ કરીએ એ દર્શનના બળ પર જાતનું અભિમાન થતું અટકાવવા સાથે ગુણનો અથાગ પ્રયત્ન ચાલુ રાખીએ, તો એ આપણું જાતદર્શન હકીકતથી ઊલદું હોવા છતાં એક સત્યદર્શન ગણાય. એના બદલે જાતને ગુણસંપન્ન માની ઘમંડમાં બીજા ગુણાહીનને તુષ્ટકારીએ અને ગુણિયલની ઈર્યા કરીએ તથા આપણે પ્રાપ્ત ગુણમાં સંતોષ માનીને બેસી જઈ અધિક યા નવા ગુણનો પ્રયત્ન જ ન રાખીએ, તો એ દર્શન હકીકત મુજબનું છતાં અસત્ય દર્શન બને છે, કેમકે એનું ફળ અહિતમાં આવે છે.

એમ, પરસ્ત્રી આપણી માતા, બેન કે દીકરી નથી એ હકીકત છે, છતાં મોટી એટલી માતા, સમાન ઉમરની એ સગી બેન, અને નાની એ આપણી પોતાની દીકરી તરીકે જોઈએ, ને એથી કામવાસનાનો ભાવ જ ઉઠે નહિ કે ઊઠલો શમી જાય, તો એ જોવાનું (દર્શન) હકીકતથી બિન્ન છતાં સત્ય દર્શન કહેવાય.

એમ, માતપિતાએ પુત્રને મોહથી ઉછેર્યો હોય, પણ કોઈ શુદ્ધ ઉપકારના

કાર્ય તરીકે નહિ, એ હકીકત છતાં પુત્ર એ જ જુએ કે માતાપિતાએ મારા પર અથગ ઉપકાર કર્યો છે. તો એ સત્ય દર્શન છે. એને બદલે હકીકત મુજબ જુએ કે ‘એમણે તો પોતાના મોહનું કાર્ય કર્યું છે.’ ઉપકાર કરવો હોત તો કોઈ પારક અનાથ છોકરાને લાવીને ઉછેરત ને ? તો આ દર્શન હકીકત મુજબનું છતાં અસત્ય દર્શન છે, કેમકે એથી કૃતભન્તા વડિલની અવગણના, સ્વાર્થિતા વગેરે દોષ પોષાય છે.

એમ, વીતરાગ પરમાત્મા હકીકતમાં દ્યાનો ભાવ રાખતા નથી, કેમકે એમાં પ્રશસ્ત પણ રાગદશા છે, ને વીતરાગને રાગનો છાંટો ય હોય નહિ, એમ વીતરાગ કૃતકૃત્ય બનેલા છે, એ ઉપદેશ આપવા સિવાય સદ્ગતિમાં ઊંચીને લઈ જવા-કરવાનો કે એનું પુણ્ય આપવાનો પ્રયત્ન કરતા નથી. અથવા જાતે ઊઠીને દાનાદિ ભાવના કે દાનાદિ પુરુષાર્થ આપવા જતા નથી. આ હકીકત છે.

હવે ભક્ત એમ જુએ કે ‘વીતરાગ કશું કરતા નથી એ કાંઈ ઉપકાર કરવા આવતા નથી. મનુષ્ય ભવ અને બીજી પુણ્યાઈ તો મેં પૂર્વે ધર્મ કરેલો તેથી મળ્યા. અહીં ધર્મભાવના અને ધર્મપુરુષાર્થ મારા પ્રયત્નથી થયેલ છે,’ તો આ મિથ્યા દર્શન છે, કેમકે એમાં ધમંડ પોષાય છે, પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા ભૂલાય છે, પ્રાર્થનામાં અને સેવામાં દિલ ચોરી કરે છે, વીતરાગનું શરણું સાચું સ્વીકારાતું નથી, ત્યારે એમ જોવાને બદલે જો ભક્ત આ જોયા કરે કે ‘અહો પ્રભુની મારા પર કેવી સુંદર દ્યા ! મારા પર કેટલો અનહં ઉપકાર ! આ ઉત્તમ મનુષ્ય ભવ એમના પ્રભાવે મળ્યો ! બધીય સારી પુણ્યાઈ એમની કૃપાથી પામ્યો ! બધીય ધર્મની ભાવના અને પુરુષાર્થ મળવામાં મારું શું ગજું ?’ એમનો જ ઉપકાર છે ! તો આ જોવાનું આ દર્શન, એ સત્ય દર્શન છે, કેમકે એમાં અત્યંત સ્વલઘુતા, કૃતજ્ઞભાવ, શરણસ્વીકાર, મહાન આત્મભોગ આપીને સેવા, વગેરે વગેરે કલ્યાણને પોષણ મળે છે.

વાત પણ સાચી છે કે વીતરાગ અરિહંત પ્રભુ અન્ય જગતકર્તા મનાયેલા ઈશ્વરની જેમ ભક્ત પર દ્યા અને ઉપકારનાં કાર્ય કરવા જતા નથી, છતાં એ પરમાત્મા ચિંતામણિરત્નની જેમ કોઈ એવું અચિંત્ય સામર્થ્ય અચિંત્ય પ્રભાવ ધરાવે છે કે એમની જ ઉપાસના-ભક્તિ-દર્શન-પૂજન-ધ્યાન-આશાનું પાલન અચિંત્ય અકલ્ય ફળ આપે છે, બીજાના ઉપાસનાદિ નહિ. એ પ્રભાવ એ જ એમનો અનુગ્રહ છે, ઉપકાર છે, દ્યા છે, કૃપા છે. કૃતજ્ઞ કદરદાન માણસ એના મુખ્ય મહત્વને કેમ ભૂલી શકે ! એ કૃતજ્ઞ ક્યાંથી બની શકે ?

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૩૪, તા. ૧૬-૫-૧૯૬૪

૧૩૮ પરમાત્મા સાથે સીધો સંબંધ

(લેખાંક-૧)

સધળાય આત્મવાદીઓનું અંતિમ લક્ષ્ય આત્માના રાગ-દ્રેષ-કામ-કોધ વગેરે સમસ્ત દોષોને નામશેષ કરી એને શુદ્ધ સ્વરૂપમાં સ્થાપિત કરવાનું જ હોય. આપણો પણ જો આત્મા જેવી વસ્તુને માનતા હોઈએ તો આપણું પણ આખરી લક્ષ્ય એ જ હોવું જોઈએ. આ લક્ષ્ય હોય એટલે સહેજે એ તરફનો પુરુષાર્થ અવિરત અને ભગીરથ રાખવો પડે.

(૧) પ્રયત્ન અવિરત રાખવાનું એ કારણ છે, કે જો આ પ્રયત્ન અવિરત-સતત ચાલુ ન રહેતાં વચ્ચમાં ભંગ પડે છે, તો એનો અર્થ એ, કે એ રાગ-દ્રેષાદિ પાછા માથે ચઢી બેસે છે, તે આપણને સર્વ કલેશમુક્તિથી ઊલટા પાછા પાડે છે, અંતર વધારી મૂકે છે. દુનિયામાં પ્રવાસમાં તો આગળ ન ચાલતાં વચ્ચમાં ઊભા રહી શક્ય છે. ત્યાં પાછું પડાતું નથી. પરંતુ અહીં તો રાગ-દ્રેષ-મદ-માયા વગેરેને અટકાવવાના માર્ગે પ્રયાણ ચાલુ ન રાખીએ તો ઊભા નથી રહેવાનું કિન્તુ રાગાદિને સેવવાનું થાય છે. તેથી જ મુક્તિનું અંતર ઘટવા કે એટલું ને એટલું રહેવાને બદલે વધી જાય છે !

(૨) પ્રયત્ન ભગીરથ રાખવાનું કારણ એ છે કે આત્મા પર આ દોષો જગતની અપરંપાર વસ્તુઓને લઈને પાર વિનાના છે. એક કપડાનો રાગ પણ પુમે પુમે જુદો જુદો છે, એમ એના પોતનો રાગ, એના રંગનો રાગ, એના ફોરાપણાનો, એના ચળકાટનો, એના ભાવ-કિમતનો, એના બીજા કપડા સાથે મેળનો, એના ટકાઉપણાનો, વગેરેના કેટલીય જાતના રાગ અનેક રહે છે. એવા બીજી અપરંપાર વસ્તુ અંગે. આમ એકલા રાગનો જ મોટો મેસુ-ટગ છે, ત્યારે દ્રેષ-ઈષ્ટા-અસૂયા-કામ-કોધ-લોભ-ઈશ્વરાદિનું પૂછવું જ શું ?

આવા જંગી ટગનો નિકાલ કરવાનો હોય તો એ માટે પ્રબળ ભગીરથ પુરુષાર્થ વિના કેમ ચાલે ? ભૂલવાનું નથી કે પાછા એ દોષો એવા ખંધા છે કે જરાક જેટલો પણ જ્યાલ ભૂલો કે એ ભભુકવા તૈયાર જ છે. તેમ જ કાચાપોચા પ્રયત્ને એ દબાય એવા પણ નથી. કેટકેટલા મન મારીને દઢ નિર્ધાર અને પ્રબળ સંકલ્પ સાથે એની સામે જરૂરીએ, જીવનસંગ્રામ બેલીએ, ત્યારે એ દબાય એવા છે.

હવે આની સામે આપણી વર્તમાન દશા જોઈએ તો કેટલી બધી ઊલટી, રાકુંડી અને મૂઢતાભરી દેખાય છે ! અવિરત અને ભગીરથ પુરુષાર્થ રાગાદિના નિકાલનો નહિ પણ આવકનો ચાલુ છે ! હાલતાં ને ચાલતાં રાગદ્વેષ કરવા જોઈએ છે, કેમકે જગતનું કાંઈ ને કાંઈ નજર કે મન સામે અથડાય છે, અને ત્યાં એનું રાગદ્વેષ મુક્ત શુદ્ધ દર્શન કે વિચાર કરતાં નથી આવડતું. વળી બીજા પર રોક મારવામાં, યા આપણી બડાઈ કે સારાપણું બતાવવામાં સંકોચ રહેતો નથી. એમાં મદ, માયા તૃષ્ણા પોખાય છે. ત્યારે ઈર્ઝા અને નિંદાની તો સૂર્ગ જ નથી. બીજા પાસેથી મફિત્યા સુખ અને સગવડ આંચકી શકીતી હોય તો એ ખ્પે છે ! અને આપણું તો બીજાને મફિતમાં ન જાય એની પૂરી તકેદારી ! આ નરી સ્વાર્થપદૃતા છે. એમ બીજાના દોષ જોવાનું પણ મોટા પ્રમાણમાં છે.

ત્યારે પ્રશ્ન એ છે કે આ દોષોની મોટી અને મહારથી લોથ શી રીતે અટકાવી શકાય ?

ઉત્તરમાં, એક અદ્ભુત ઉપાય એ છે કે પરમાત્મા સાથે સીધો સંબંધ રાખવો, સીધો એટલે સાક્ષાત્ જ્યારે ક્યારેય રાગાદિ સંકલેશના ઉછાળા આવે ત્યારે તરત પરમાત્માનું શરણું પકડવું. યાદ કરવું કે ‘અરિહંતા મે સરણં-હે અરિહંત ભગવાન ! તમે જ મારે શરણભૂત છો. હું મુંઝાયેલો હું. પ્રભુ ! તમે જ મારી ગતિ છો, મારી મતિ છો.’

બીજી રીતે સાક્ષાત્ સંબંધ એ, કે બહુધા, આપણે આપણા આત્માને છોડી બીજાના જ વિચારો કરીએ છીએ,-કાં કોઈ જડ વસ્તુ કે આપણી કાયા, કાં બીજા લાગતા વળગતા કે પરાયા માણસોના જ વિચાર ! આ અધમાધમ પરચિતામાંથી કેદી રાગ-દ્વેષ-ઈર્ઝા-અભિમાન આદિ ઊભા થાય છે, ત્યાં એને રોકવા માટે મનને ઝટ પરમાત્મા તરફ વાળવાનું અને વિચારવાનું કે ‘અરે ગાંડા ! તારી પાસે જગત જ જોવાનું છે ? જિન નહિ ? તારા આત્માનો સંબંધ એકલા જગત સાથે ? સંબંધ ભગવાન સાથે રાખ ને ? એ તને કેવો બનવા, અને શું કરવા, શું ન કરવા કહે છે. એ જોને ? બીજાના જ વિચારો કર્યા કરીશ તો પરમાત્મા સામે જોઈને તારા આત્માના અનંત દોષોનો વિચાર અને નિકાલ કરવાનું ક્યારે કરીશ ?’

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૩૫, તા. ૨૩-૪-૧૯૬૪

(૧૮) (લેખાંક-૨)

(૧) સીધો પરમાત્મા સાથે સંબંધ રાખ્યો હોય, તો પાર વિનાની પર ચિંતા જે ચાલી રહી છે, એના પર જબ્બર કાપ પડે, અને મનને એમ થાય કે ‘અરે રાંકડા ! તારે પરાયા સાથે જ સંબંધ છે ? ભગવાન અને તારા પોતાના આત્મા સાથે કોઈ સંબંધ, કાંઈ જ લાગતું વળગતું નથી કે એમને અનુલક્ષીને કોઈ વિચાર જ નહિ ?’ એવી રીતે,

(૨) સીધો પરમાત્મા સાથે સંબંધ રાખવાથી બીજો એક લાભ એ છે કે હુન્યવી સંપત્તિ-વિપત્તિમાં હરખના ઉન્માદ કે ખેદની રાંકડાગીરી અટકાવી શકાય છે. કેમકે મનને એમ થાય કે ‘આ સંપત્તિ-વિપત્તિ તો પર અને ચંચળ છે, ત્યારે પરમાત્મા મારા અને અવિનાશી છે. એવા પરમાત્મા સાથે જ મારે સંબંધ છે, તો આ સંપત્તિ-વિપત્તિથી શું ?’ વળી ભગવાન એને ‘મારા આધીન નહિ પણ કર્મને આધીન’ કહે છે, તો જ્યાં મારું ચલણ નહિ, એની ખાતર દિલ ઉહોળવાની મારે શી જરૂર ?’

(૩) વળી સીધો પરમાત્મા સાથે સંબંધ રાખવાથી, જેમ સીધો કોઈ સપ્રાટ રાજા સાથે સંબંધ ધરાવનારને હૈયે હુંફ અને મન માતબર રહે, તેમ, અરે તેથી કેદી ગુણી, હુંફ અને બાદશાહીવાળું મન બન્યું રહે છે ! પછી કોઈની દીનતા કરવાની, ચાપલુસી કરવાની, કે બીજા ધનાદ્ય કે સત્તાધીશને દેખ્યે હેવાઈ જવાની જરૂર નથી રહેતી. એવી શી જરૂર ? સ્વયં અનંત સમૃદ્ધિમાન અને અનંત સમૃદ્ધિના દાતાર ભગવાન સાથે સીધો સંબંધ છે, તો શા સારું દીન-હીન-લાળપાંઠું બનવું ?

(૪) મનમાં પરમાત્મા સાથે સંબંધ જીગતો રાખવાથી એ પણ લાભ છે કે રાગ-દ્વેષ, ઈર્ઝા-મદ-મત્સર, સ્વાર્થિધતા વગેરે દોષોને દબાવી શકાય છે. દોષ કદાચ ઊઠવા જાય ત્યાં જ મન કહે છે કે, ‘અરે ! હું તો વીતરાગ પ્રભુનો સેવક, ઓમણે મૂળમાંથી નાશ કરેલા એ દુર્ગુણો કમમાં કમ અંશેય દબાવું નહિ તો તો ઢોંગી પ્રભુભક્ત ઠું ! નિર્મણ ભગવાન પાસે છતાં એ રાગાદિ મેલથી વધુ મલિન કાં થાઉં ?’

(૫) અનંત શક્તિસંપન્ન પરમાત્મા સાથેના સીધા સંબંધની બલિહારી છે કે એથી સત્ત્વ ખીલે છે, જેમ પ્રગતે છે ! પછી તો ત્યાગ, તપસ્યા, સહિષ્ણુતા સહેલા અને પ્રિય બની જાય છે.

ત્યાગ તપસ્યાની આડે કોણ આવે છે ?

એ જ પર સાથેના સંબંધની બહુ લોથ છે તે. ‘મારું શરીર બરાબર નહિ. મારે આ ચીજ વિના ન ચાલે, પેલી ચીજ વિના ન ચાલે, આ તો બહુ સરસ. આ તો ખાસ કામનું. આનાથી શાંતિ સારી રહે છે...’ આવું ને આવું પર સાથે નક્કી કરી રાખ્યું છે, એટલે ત્યાગ, ગ્રત, નિયમ ભારે લાગે છે, એથી આધા ને આધા જ રહેવાનું થાય છે. ભગવાનમાં મન ગયા કરવાથી ભગવાનની ખુદની અતુલ સાધના, અનુપમ ગુણ ભંડાર, અને અનંત શક્તિના વારંવાર જગતા ખ્યાલ ઉપર જીવને પોતાની પરની ગુલામીની શરમ-ઘૃણા આવે છે, પરના બંધન હુબળા પડવા માંડે છે.

(હ) પરમાત્મા સાથેના વિશ્વાસપૂર્વકના સીધા સંબંધથી આત્મામાં ભારે જગૃતિ અને એમના વચન પર અથાગ શ્રદ્ધા તરવરતી રહે છે. જગૃતિને લીધે વિષય-કથાયની પરવશતા દભાવાય છે, પ્રસંગોને પાપાશ્રવરૂપ બનવા દેવાને બદલે સંવરરૂપ બનાવવાનું થાય છે. અર્થાત् દરેક પ્રસંગની મનથી ખતવણી જ એવી કરવામાં આવે છે કે જે પરમાત્માએ ફરમાવેલું કથાયત્યાગ, તૃષ્ણાકાપ, સ્વાત્મ જુગુપ્સા, પુદ્ગલસ્વરૂપ દાખિ, વગેરેમાં પરિણમતી હોય. તાત્પર્ય દરેક પ્રસંગને પાપભાવના અશુભ ભાવનામાં ન ઉત્તરવા દેતા શુભ ધર્મભાવના-ધર્મવૃત્તિ-ધર્મલેશ્યામાં ઉતારવાનું થાય.

બસ, સીધો પરમાત્મા સાથે સંબંધ રાખી વારંવાર મનને પરપ્રેક્ષી પરના જ ચિંતા કરતું અટકાવીએ અને ઉપરોક્ત મહાલાભ પ્રાપ્ત કરીએ.

U શોભનમુનિ યાદ આવી જાય V

શોભનમુનિને કોણ ન ઓળખે ? પંડિત ઘનપાલના ભાઈ. એ જ્યારે ગોચરીએ જઈને પાછા આવ્યા એટલા સમયમાં તો ૨૪ ભગવાનની મનોહર સ્તુતિઓ બનાવી દીધી. પૂજ્યપાદ સ્વ.ગુરુદેવશ્રી ભુવનભાનુસ્કૂરીશ્વરજી મ. સાહેબને પણ મન નવરું રહે કે અંટસંટ ધ્યાનમાં પડે એ પાલવે નહીં. એટલે કેટલાંય સ્તુતિ, સ્તવન, સજ્જાયો પોતે વિહારમાં જ યાદ કરી લેતા. એકવાર તો વિહારમાં ચાલતાં ચાલતાં આખી સંસ્કૃત રલાકર પચ્ચીશીનો મનમાને મનમાં પદ્યમાં અનુવાદ કરી દીધેલો. તે લખાઈને પ્રગાટ થઈ ગયો હોત તો કેટલું સારું થાત !

W -“ભુવનભાનુ એક સોનેરી પાનુ” પુસ્તકમાંથી સાભારX

“દિવ્ય-દર્શન”-“અગ્રલેખામૃત”

૧૨, અંક-૩૬, તા. ૬-૬-૧૯૬૪

૧૪૦ પદાર્થ જોવાની દાખિ

આપણી આંખ કેવી છે ?

વિષયભોગાર્જનની દાખિએ જોનારી ? કે આત્મહિતાર્જનની અપેક્ષા રાખીને જોનારી ? બંને દાખિથી જોઈ શકવાની તાકાત તો છે, પરંતુ તપાસવાનું છે કે કઈ તાકાત જીવનમાં અમલી બની રહી છે ?

જો ખરેખર સમ્યગ્દર્શનના દીવડાની જ્યોત ઝગમગતી હશે, તો વસ્તુ યા પ્રસંગને આત્મહિતોપાર્જનની દાખિએ જોવાનું સહેજે બની આવશે, અરે ! માત્ર સમ્યકૃતવની જ જ્યોત નહિ, પરંતુ એને અનુકૂળ એવી ભવમાં દુઃખ માત્ર દર્શનની પણ જ્યોત ઝગમગતી હશે તોય વસ્તુ કે પ્રસંગને આત્મહિતની દાખિએ જોતા રહેવાનું બનશે.

સમ્યગ્દર્શન એટલે સર્વજ્ઞ, સંપૂર્ણજ્ઞાની ભગવંત વિશ્વના પદાર્થને આત્માના હિત-અહિતની દાખિએ જોવા જુએ છે તેજ પ્રમાણે એ પદાર્થને હદ્યથી સ્વીકારવા. દા.ત. લક્ષ્મી એ રાગ-મુઢ્યર્થ ગર્વ, લોભ વગેરે કરવીને આત્મામાં જડતા, મૂઢતા, પાપારંભની આસક્તિ આદિ અહિતને જન્મ આપે છે, એવું સંપૂર્ણ જ્ઞાની ભગવંત પ્રત્યક્ષ જુએ છે. તો આપણે પણ એ લક્ષ્મીને એવા અહિતકારી પદાર્થ તરીકે હદ્યથી સ્વીકારવી. બાધ્ય કે આંતારિક નજર સામે લક્ષ્મી-માલમિલકત આવે એ ઈન્દ્રિય સુખો ભોગવવામાં, માન-સન્માન ભોગવવામાં અને સત્તા ભોગવવામાં ઉપયોગી થાય એ તરીકે નહિ, કેમકે એ ભોગવટા આત્માનું અહિત કરે છે, કિન્તુ રાગ, મમત્વ, મદ વગેરે દોષો અને પાપારંભોરૂપી આત્મ-અહિતને સર્જનારી તરીકે જ જોવી જોઈએ.

અહીં એક પ્રશ્ન ઉઠે છે,-

પ્ર.- લક્ષ્મીને તીર્થયાત્રા, પરમાત્મભક્તિ, દયા વગેરે કરવાનાં સાધન તરીકે જુએ તો શો વાંધો ?

૩. - વાંધો આ છે કે લક્ષ્મીમાં ઉપયોગિતા દેખાવા ગયા તો એને કિંમતી માનવાનું, કામની લેખવાનું મન થશે, તેથી એના પર રાગ મમતા અને આસક્તિ થશે. એટલે એને જોવાની તો કિંમત વિનાની, નકામી, અહિતકારી અને ફેંકી દેવા જેવી ચીજ તરીકે જ દેખવાની. જેથી એ ન છોડાય ત્યાં સુધી પણ એના પર રાગાદિ જામી પડે નહિ. તીર્થયાત્રાદિમાં પણ ઉપયોગી દેખાય છે તે લક્ષ્મી નહિ

કિન્તુ લક્ષ્મીનો ત્યાગ ઉપયોગી છે. આ વિવેક કરવો જોઈએ. કેમકે લક્ષ્મી તિજોરીમાં રાખી મૂકાય ત્યાં સુધી એ તીર્થયાત્રાદિમાં થોડી જ ઉપયોગી બને છે? ત્યાગની ભાવના આવે અને ત્યાગ કરાય તો જ ઉપયોગી બને છે. બાકી લક્ષ્મીને કિમતી માનવા જતાં મન પર તીર્થયાત્રાદિ કાર્ય કરતાં એનું મહત્વ વધુ લાગવાનો પૂરો સંભવ રહે છે, અને લક્ષ્મીને અહિતકારી તરીકે ન દેખવામાં પછી તીર્થયાત્રાદિ સત્કાર્યોમાં એનો ઉપયોગ કૃપણતાથી કરવાનો પણ સંભવ રહે છે.

વાત આ છે કે આપણી આંખ વસ્તુને સર્વજ્ઞ પ્રમુદ્રે ઓળખાવ્યા પ્રમાણે દેખવા ટેવાવી જોઈએ. લક્ષ્મીની જેમ હુન્યવી તેવી અનેક બાબતોને અને ઈન્દ્રિયોના મનગમતા વિષયોને પણ અહિતકારી તરીક જોતા રહેવાય, તો જ એના મોહમાં નહિ પડી, એનો પક્ષપાત સેવી આત્મહિતની પ્રવૃત્તિની ઉપેક્ષા નહિ થાય. એના બદલે જો અને આત્મહિતમાં ઉપયોગી માન્યા, અગર અહિતકારી ન લેખ્યા, તો એની પલેવણમાં ‘કશું ખોટું નહિ લાગે, અને એના સેવનમાં દેવ-ગુરુ-ધર્મની આરાધના ચૂકાશે! તે પણ દિલ ઊંઝ્યા વિના.’

બસ, જીવન-ઉત્થાનનો આ પહેલો ઉપાય છે કે આપણી આંખ અને મન દરેક પદાર્થ, પ્રસંગ અને પ્રવૃત્તિને ઈન્દ્રિયોનાં સુખની દાખિયા ન જોતા આત્મિક હિતની દાખિયા જુએ. જુએ કે આ પદાર્થ, આ પ્રસંગ, આ પ્રવૃત્તિ સહેજે સહેજે આત્મિક હિતને પ્રેરે છે કે અહિતને? પણ એમ ન જુએ કે આ કોઈ ઈન્દ્રિય સુખપ્રેરક છે કે દુઃખપ્રેરક? કેમકે એ દાખિયા આગળ કરવામાં આત્મિક હિતની ગણતરી લૂલી પડી જાય છે.

સારણાદિકમાં કુશળતા

U વિહારમાં પૂજ્યશ્રીની કપડાં વગેરે ઉપધિ બધા સાધુઓ ઊંચકી લેતા. એક વાર એક સાધુએ ભૂલથી પૂજ્યશ્રીનું એક કપડું આગળના ગામે કોઈ ગાડું જતું હશે તેમાં બેઠેલાને આપી દીઘું. પછી ગામમાં પહોંચીને પાછું લઈ લીધું. પૂજ્યશ્રીને ખબર પડી. પોતાની ઉપધિ ગાડા કે ગાડીમાં જાય એટલે એની વિરાધનાની અનુમોદનાનો ભારે દોષ લાગે તે પૂજ્યશ્રીને પસંદ નહીં. પેલા સાધુને ખખડાવી ચોક્કાં કહી દીઘું, તારે હવે ઉપધિ ઊંચકવાની નથી. મને ઊંચકવા આપી દેજો. સાધુએ માફી માગી. ફરી એમ નહીં કરવા કબૂલાત કરી. આવી વાતમાં ચલાવી લેવાની તો વાત જ નહીં.

W –“ભુવનભાનુ એક સોનેરી પાનું” પુસ્તકમાંથી સાભાર્ય

“દિવ્ય-દર્શન”–“અગ્રલેખામૃત”

વર્ષ-૧૨, અંક-૩૭, તા. ૧૩-૬-૧૯૬૪

૧૪૧ મહાન બનવું છે?

મહાન બનવાની તમના છે? આ જીવનમાં આપણાને અતિ કિમતી બુદ્ધિશક્તિ અને પ્રયત્નશક્તિ મહાન બનવા માટે મળેલી છે. બિચારા જનાવર કે ક્રીડા-મંકોડાને એ નથી મળી તો પછી આપણે એનો સુંદર ઉપયોગ કરવો જોઈએ. ખાવું, કમાવવું, બેલવું અને ઊંઘવું એ તો કૂતરા પણ કરે છે. એનાથી મહાન નથી બનાતું. જુઓ દુનિયામાં બહુ સારું ખાનારને કોઈ મહાન પુરુષ કહે છે? બહુ પૈસા ભેગા કરે, બહુ ખેલે કે ઊંઘે, એને મહાન ક્યાં કહેવાય છે?’

મહાન બનવું હોય તો બુદ્ધિનો ઉપયોગ કરો, ઘડી બેસીને વિચાર કરો, કે આપણી કિમતી કાયાને ક્યાં જોડીએ તો મહાન બનાય? જીવનના દીવામાંથી તેલ ઘટતું જાય છે, કાયાનો કિલ્લો એક દિ’ કડડભૂસ થવાનો છે. જીવને ઈચ્છા નહિ, છતાં મરવું પડે છે, રોગો આવે છે, અને આણગમતું ઘણું ય થાય છે. એવા આ અસાર સંસારના જીવનમાં સારું મન અને સારી કરણી કરતા રહી મહાન બનીએ તો અણગમતામાં, રોગમાં અને મૃત્યુ વખતે મસ્ત બન્યા રહેવાય, મુંજવણ કે ગરીબડાપણું ન આવે. ‘મારી પાસે સારા પવિત્ર મન અને ઉત્તમ કરણીની મોટી મૂડી છે. મોટો અજવાસ છે, મારે ગભરાવાનું શું?’ એમ હિમત રહે છે.

મહાન બનવું હોય તો દિલ પવિત્ર બનાવી સારા ઊંચા જ વિચારો કરો, અને વાણીથી સારું જ બોલવાનું તથા કાયાથી સારા સારા કૂત્યો આચરવાનું કરો. એનાથી જ મહાન બનાય. નહિતર તો નીચું પશુ જીવન જીવાય.

વિચાર-વાણી-વર્તન સારા બનાવવા માટે પહેલા નંબરમાં કૂતરા બનવું પડે. આપણા ઉપકારીઓના ઉપકારને જરાય ભૂલ્યા વિના એમની પ્રત્યે સત્ત કર્તવ્ય બજાવતા રહેવું જોઈએ. એ બજાવી કૂતરા બન્યો રહે એ મહાન બને છે. બાકી કર્તવ્ય ભૂલનાર કૂતંખ માણસ તો નીચ-અધમ જીવનારો ગણાય છે.

આપણા ઉપર દેવાધિદેવ અરિહંત ભગવાન તથા ગુરુ સાધુ મહારાજ અને માતા-પિતાનો અનહં ઉપકાર છે. દેવથી આટલો બધો ઊંચો મનુષ્યભવ, પુણ્યાઈ અને ધર્મ પાભ્યા. ગુરુથી વારંવાર હિતશિક્ષા મળે છે, અને માતાપિતાએ અજ્ઞાન, અભૂત, મૂઢ એવા આપણાને ઉછેરી સમજદાર બનાવ્યો છે. તો પ્રભાતે ઊઈને પહેલા ઉપકાર યાદ કરી પરમેહીને નમસ્કાર કરીએ અને માતપિતાના પગે પડીએ, પછી

શક્ય એટલી એમની આજ્ઞાનું પાલન કરીએ, તો ફૂતજ્ઞતા બજાવી કહેવાય. જીવન ધન્ય બને ! શાસ્ત્ર કહે છે માતા-પિતાને પણ ત્રિકાળ પ્રણામ કરવા, એમનો વિનય અવશ્ય સાચવવો, એમની સેવાભક્તિ કરવી. આ ચુકનારો, એમની અવગણના કરનારો એ દેવગુરુનો પણ ભક્ત નથી, ધર્મી જીવ નથી માટે એ ચૂકવું નહિ, અને સાથે દેવગુરુની ય ઉત્તમ સેવા ભક્તિ કરવી. આ બધું ફૂતજ્ઞતા રૂપે કરવું.

મહાન બનાવનાર સારા વિચાર-વાણી વત્તાવમાં બીજા કર્તવ્ય તરીકે આપણી ઈન્દ્રિયોની ગુલામી ટાળવા સંયમી બનવું, એની ઉચ્છૃંખલ દોડ્ધામ પર અંકુશ મૂકવો. જાગ્યા ત્યારથી માગ્યા, તે રાત્રે પણ મોંભા ઓર-ઓર કર્યું, એ તો ઢોરનું જીવન છે. એથી ફાટેલી ઈન્દ્રિયોરૂપી હુષ ઘોડીઓ જીવસ્વારને હુર્ગતિના જંગલમાં ઘસડી જાય છે ! જીવને અધમ બનાવે છે ! માટે મહાન બનવા એના પર કમમાં કુમ સવારે નવકારશી પચ્ચકખાશ, રાત્રિભોજન ત્યાગ (રતના ચોવિહાર ન જ બને તો તિવિહાર) અને કંદમૂળ-વાસી વગેરે અભક્ષય-ત્યાગની લગામ મૂકવી. એમ ચાલે ત્યાં સુધી હોટલના માલ અને બીજા તેવા હલકાં વેચાણિયા ખાણાં પીણાં ન વાપરવા. તેમ રસત્યાગ, દ્રવ્યસંક્ષેપ અને પર્વ તિથિએ તપસ્યા કરતાં રહેવું. જૂઠ, અનીતિ દંબ, ઈર્ધ્વ વગેરે ન સેવવા. સિનેમા જોવાનું તથા નોવેલ નવલિકા વાંચવાનું ન કરવું એ જેર છે.

મહાન બનવું છે ? તો (૧) સર્વશ્રેષ્ઠ પરમ પુરુષ શ્રી વીતરાગ પરમાત્માનું વારંવાર નામ-સ્મરણ, દર્શન અને આપણાં પોતાનાં દ્રવ્યથી એમની પૂજા તથા ભાવભક્તિ, (૨) એમણે આપણા હિત માટે ફરમાવેલ સામાયિક-પ્રતિકમણ તથા જીવદ્યા, પરોપકાર અને ગ્રત નિયમ, તેમજ (૩) એમનાં શાસ્ત્ર-સૂત્રનું અધ્યયન, વાંચન તથા મનન કરતાં રહેવું.

કપડાને વારંવાર ધોઈ ઉજણા રાખવામાં આવે છે, એમ આત્માને મહાન ઉજજ્વળ બનાવવા એક નોંધપોથીમાં એની થતી ભૂલોની નોંધ કરી એના પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધિ કરતા રહેવું. નોંધ કરવાથી સજ્ગા રહેવાય છે. પોતાને પોતાનો ખ્યાલ આવે છે, ને ભૂલો ઓછી કરવાની તકેદારી રહે છે.

જીવન ટૂકું છે, કામ ધણું છે, કેમકે અસંખ્ય જન્મોના પાપ ધોવા છે, અને ભાવી અનંત કાળની સુખ-ઉન્નતિના પાકા પાયા નાખવા છે. નાનપણથી જ ઉપરોક્ત કરવાની અને સદ્ગુણો કેળવવાની સારી ટેવ પાડવાથી મોટા થયે એ સરળ થઈ એમાં આગળ વધાય છે. નાનપણમાં એની પરવા ન કરી અને કુટેવો તથા દુર્ગુણોમાં રાચ્યામાચ્યા, તો જીવન મવાલીનું બને છે, માટે દઠ સંકલ્પ કરી મહાન જૈન ધર્મનો ઉચ્ચ ઉપયોગ કરી મહાન બનીએ.